

માકૃતિ દસ મસલા



પ્રકાશક:- પ્રાચીન શ્રુત સંરક્ષક સમિતિ કપડવાળ (જ.)



શ્રી વર્દ્ધમાનસ્વામિને નમઃ

ભક્તિ....રસ....ઝરણુાં

(ભા. ૨.)

શ્રી પૂર્વાચાર્યકૃત ૨૯ ચોવીશીઆના
સંગ્રહ



જિનગુણગાનં

નિજમાનકરં

પ્રકાશક

શ્રી પ્રાચીન શ્રુત સંરક્ષક સમિતિ
કપડવંજ (ખેડા)

વીર નિ. સં

૨૫૦૬

મૂલ્ય

૨૫-૦૦ રૂપીયા

વિ. સં.

૨૦૩૬

પુસ્તક પ્રાપ્તિસ્થાન
શ્રી પ્રાચીન-શ્રુત-સંરક્ષક સમિતિ

દિનેશચંદ્ર નગીનદાસ પરીખ

કાપડ બજાર (જી. ખેડા)

PO. કપડવાંજ



પ્રભુ-ગુણ-ગાનનું મહત્ત્વ

શુદ્ધાત્મસ્વરૂપી

વીતરાગ-પ્રભુના અનંતાનંત ગુણો પૈકી

યથામતિ યથાશક્તિ કળાતા ગુણોની

નિખાલસ સ્તવના

ભવસમુદ્રથી પાર ઉતારનાર થાય છે.

મુદ્રક : કેનીમિક પ્રિન્ટર્સ કાલુપુર તથા મંગલ મુદ્રણાલય,
રતનપોળ, અમદાવાદ

પ્ર કા શ કી ય

દેવ-ગુરૂકૃપાએ પ્રાચીન-પૂર્વાચાર્યકૃત તીર્થંકર-પરમાત્માઓના સ્તવનોત્તી ચોવિશીઓના સંગ્રહ સ્વરૂપ પ્રસ્તુત-પુસ્તકનું પ્રકાશન કરતાં અમો ગૌરવ અનુભવીએ છીએ.

કેમ કે સં. ૨૦૩૪ માં ૩૧ ચોવિશીઓના સંગ્રહરૂપે પ્રથમ ભાગ પ્રકાશિત કરવા અમે ભાગ્યશાલી બનેલા, ત્યાર પછી બીજી ૨૯ ચોવિશીઓના સંગ્રહરૂપ આ બીજો ભાગ પણ ૧૬ વર્ષ લગભગના ગાળામાં પ્રેસની કાગળની ઘણી હાડમારી છતાં પ્રકાશિત કરી શકીએ છીએ !

અમારી સંસ્થા આપણા જીવન-પ્રાણ સમા આગમોને પ્રાચીન પદ્ધતિએ લહીયાઓ પાસે ટીકા સહિત દેશો-કાશ્મીરી કાગળો પર લખાવવારૂપે શ્રુતજ્ઞાનનાં પ્રાચીન વારસાને જનગવવાનું પુણ્યકાર્ય કરવા સાકાર બની છે.

તેમાં અમારી સંસ્થાના પ્રાણપ્રેરક પ. આગમોદ્ધારક આગમ-જ્યોતિર્ધર આચાર્યદેવશ્રીના શિષ્યરત્ન પૂ. પં. શ્રી સૂર્યોદય-સાગરજી મ. શ્રીમ. શ્રીતી પ્રેરણા મુખ્ય છે.

તેથી તેઓની પ્રેરણાથી આગમો લખાવવા ઉપરાંત બીજા પણ તાર્ત્વિક-પ્રાચીન સાહિત્યના સુરક્ષાના કાર્યમાં અમો લાલ લઈએ છીએ.

એથી પ્રાચીન સ્તવનોત્તી ચોવિશીઓનો સંગ્રહ માત્ર જૂજ નકલો તે પણ કપાટમાં ક્યાંય આડીઅવળી પડી રહેવાની સ્થિતિમાં વિનાશોન્મુખ બની રહેવા પામે તે સ્થિતિમાંથી સ્તવન ચોવિશીઓના વિશ્લાળ-સંગ્રહને ઉગારવા અમારી કાર્ય-શક્તિક્ષેત્રની સીમાઓ થોડી

વિસ્તારીને પણ અમોએ અમારા પ્રાણપ્રેરક પુત્રમશ્રીનીસચ્ચમાથી આ પુનિત કાર્યના ભાગીદાર બન્યા છીએ !

આ ઉત્તમકાર્યનો લાભ અમોને મળ્યો છે તેમાં પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ. ના શિષ્ય પૂ. પં શ્રી મુનિ અભય-સાગરજી મ. શ્રી એ ખૂબ ખતભરી મહેનત કરી અનેક પ્રાચીન ભંડારોમાંથી જૂની હસ્તલિખિત પ્રતો ભેગી કરી પાઠ-ભેદો તપાસી યોગ્ય પાઠ નક્કી કરી કઠણ શબ્દોના અર્થ લખત્રા પૂર્વક વિશિષ્ટ રીતે સંપાદન કરી આપ્યું, તેનો અવિસ્મરણીય ફાળો છે.

અમે અમારી જાતને ધન્ય માનીએ છીએ કે આવા વિશિષ્ટ પ્રાચીન રતવન-ચોવીશીઓમાં બહોળા જથ્થારૂપ આ પુસ્તકના બંને ભાગ પ્રકાશિત કરી શકવા ભાગ્યશાળી બન્યા છીએ.

શ્રેયાંસિ बहु-विघ्नानि કહેતીની ચરિતાર્થતા અમોને અમારા કાર્યમાં ડગલે ને પગલે થવા પામી છે.

પ્રસ્તુત-પુસ્તકના પ્રકાશનમાં કાગળની તંગી, પ્રેસવાળાની કનડગતો છતાં ધર્મપ્રેમી પં. શ્રી રતિલાલ દોશી (પ્રધાનાધ્યાપક-શ્રી હેમચંદ્રાચાર્ય જૈન પાઠશાળા-અમદાવાદ) તથા ધર્મ પ્રેમી શ્રી બાબુલાલ કેશવલાલ શાહ (૧૧, નગરશેઠ, મારકેટ, રતનપોળ, અમદાવાદ)ના તનતોડલયાં પ્રયાસો અને જાત દેખરેખથી આ પ્રકાશન કડપથી અને સરળ બની શક્યું છે.

૫૧ કર્મોના આ ગ્રંથના ખૂબ વ્યવસ્થિત રીતે છાપકામ બદલ આ બંને મહાનુભાવોના ધર્મપ્રેમની અભિનંદના કરીએ છીએ !

વધુમાં આ ગ્રંથના પ્રકાશન અંગે ઉદારતાથી આર્થિક લાભ લેનાર શ્રી સંઘો તથા સદ્ગૃહસ્થોના ધર્મ પ્રેમની અનુમોદના સાંધે

આ અંગે ઉપદેશ આપનારા પૂ. સાધુ-સાધ્વી ભગવંતો પ્રત્યે કૃતજ્ઞતા ભરી વંદનાંજલિ રજૂ કરીએ છીએ.

વળી આ પ્રકાશનના કાર્યમાં સીધી કે આડકતરી રીતે અનેક પુણ્યભાગ્યે સહયોગ આપ્યો છે, તે બધા નામી-અનામી પુણ્યવાનોના ધર્મસ્નેહની અનુમોદના કરીએ છીએ.

વિશેષ કરીને મુદ્રણકાર્ય માટે અગવડભરી રીતે પણ સહયોગ આપનાર કેની-મેક પ્રીન્ટર્સ ફરમા ૧ થી ૫ તેમ જ મંગલ મુદ્રણાલયના (ફરમા ૬ થી ૫૧) માલીક કાન્તીભાઈ ડાહ્યાભાઈ તથા

પ્રેસ-કોપી કરી આપનાર શ્રી શાન્તિભાઈ ગોરધનભાઈ શાહ, આદર્શ બુક બાઇન્ડર, તથા સ્વામી સ્વરૂપાનંદજી (સાલરીવાડો-પાટણ), શેઠશ્રી લાલભાઈ દલપતભાઈ વિદ્યામંદિર (નવરંગપુરા-અમદાવાદ)ના વિશાળ હસ્તલિખિત પ્રતિઓના સંગ્રહમાંથી સ્તવન-ચોવીશીઓની પ્રાચીન પ્રતિઓ ભેગી કરી, તેની માહિતી પૂરી પાડનાર પં. શ્રી લક્ષ્મણભાઈ ભોજક તથા આ બધાની પ્રેસ કોપી લખી આપનાર, ભૂગોળના માર્મિક વિદ્વાન, પ્રાચીન સંસ્કૃતિના હિમાયતી શ્રી. રમણલાલ બખાભાઈ શાહ (તૃપ્તિ-ઓપેરા સોસાયટી પાસે-સરખેજરોડ-અમદાવાદ) પ્રુફ આદિની વ્યવસ્થાનું કામ ઉમંગભેર સંભાળનાર શ્રી આરિષભાઈ માણેદલાલ શાહ-કુમારપાળ જે. શાહ-અમદાવાદ અને શ્રી અશ્વિનભાઈ એસ. દવે (પાલીતાણા) આદિ મહાનુભાવોમાં ધર્મ પ્રેમ ભરી અનુમોદના સાથે તેઓના ધર્મ સ્નેહની નોંધ લેવામાં આવે છે.

છલ્લે મુખપૃષ્ઠની ડીઝાઈન વ્યવસ્થિત રીતે બનાવી આપનાર શ્રી શાંતિલાલ એસ. દોશી (હારિજ) અને ખલોક ટાઇટલ પેજ સુંદર રીતે છાપી આપનાર દીપક પ્રીન્ટરીના ધર્મસ્નેહની પણ નોંધ લઈ પ્રસ્તુત પ્રકાશનમાં હૃદયસ્થતા-સુલભ દૃષ્ટિદોષજન્ય કે સ્મૃતિ દોષજન્ય કોઈ ક્ષતિ રહેવા પામી હોય તો તે અંગે હાર્દિક ક્ષમાપના

સાથે પુણ્યવાન આત્માઓ વિશિષ્ટ રીતે પરમાત્માની લલિતગંગા પ્રસ્તુત
પુસ્તકના આલંબને અવગાહી અંતરના મેલ ઘોઈ ઉજવલ જીવનવાળા
બને એ મંગલ અભિલાષા !

વીર નિર્વાણ સંવત ૨૫૦૬
વિ. સં. ૨૦૩૬

પોષ વદ ૮ બુધ

૯-૧-૮૦, દલાલવાડો,
કપડવાજ (ખેડા)

: નિવેદન :

દિનેશચંદ નગીનદાસ પરીખ

કાર્યવાહક

પ્રાચીન શ્રુત રક્ષક સમિતિ



હાર્દિક વિનંતિ

(રાગ : આશાપરી)

પ્રભુ ! મેરે ઐસી આય બની !!!

મનકી વ્યથા કુનથે—કહીએ

જાનો આપ બની—પ્રભુ ॥૧॥

જનમ-મરણ-જરા જિઉ ગર્થ લહે

વિલગી વિપત્તિ બની ।

તન-મન-નયન દુઃખ દેખત

સુખ નવિ એક કની—પ્રભુ ॥૨॥

ચિત્ત દુઃખ દુરજન કે વચના

જૈસે અર અગનિ ।

સાજન કોઉ નહિ જાકે આગે

ખાત કહું અપની—પ્રભુ ॥૩॥

ચઉ ગર્થ-ગમણ-જમણ દુઃખ વારો,

વિનંતિ એહી સુની

અવિચલ સંપદ જસ કું દીજે,

અપને દાસ ભની—પ્રભુ ॥૪॥

શ્રી વર્ધમાન સ્વામિને નમઃ :

સંપાદક તરફથી...

શ્રી જિનશાસનને વરેલા પુણ્યવાન આરાધકો આત્મશુદ્ધિને કેન્દ્રમાં રાખી સઘળી ધર્મક્રિયાઓ કરે છે.

જે અનુદાન દ્વારા મોહનીયકર્મના ક્ષયોપશમ રૂપે અંતરંગ ભાવશુદ્ધિ ન થાય તો તે અનુદાન ભાવક્રિયારૂપ બની શકતું નથી.

આ ધોરણે ઔદયિકભાવની પરવશતામાંથી ઉપજેલ આત્માની મલિનતાને લક્ષ્યમાં રાખી શુદ્ધિ તરફ જગૃતપણે પ્રવૃત્તિ કરવી તે આરાધનાનો પરમાર્થ છે.

એટલે શુદ્ધિના સર્વશ્રેષ્ઠ ધોરણે પહોંચેલ આત્મતત્ત્વ (સિદ્ધપદ) ને આદર્શરૂપ બનાવી જીવન-શક્તિઓને તદ્દનરૂપ પ્રયત્નોમાં આરાધક પુણ્યાત્માઓ વધુ વિશ્વાસ ધરાવે છે.

એટલું જ નહીં, પણ આ જાતની ભૂમિકા અને યથોત્તર—વિકાસના પંથને ચીંધનાર, તેના ક્રમિક ઉપાયો દર્શાવનાર શ્રી તીર્થંકર પરમાત્માઓ પ્રતિ અત્યધિક બહુમાન ભરી સ્તવના, સ્તુતિ, આત્મનિવેદન આદિ કરવા મુમુક્ષુ આત્માઓ સતત પ્રવૃત્ત હોય છે.

આ રીતે ઉચ્ચકોટિના વિશિષ્ટ આરાધક પુણ્યાત્માના હૈયામાંથી પરમાત્મા પ્રતિ સ્વયંભૂ-અખંડ ભક્તિગંગા પ્રકટ થઈ સ્તવનોરૂપે જગતના જીવોને પણ ભક્તિગંગામાં અવગાડી જીવનની પરમશુદ્ધિ તરફ વળવા માટે ઉદાત્ત પ્રેરણાઓ આપે છે.

પ્રાચીન કાળમાં સંસ્કૃત-પ્રાકૃત-દેશી-અપભ્રંશ આદિ તે તે સમયે પ્રધાનપણે વપરાતી ભાષામાં અનંતોપકારી શ્રી તીર્થંકર પરમાત્માના ભાવવાહી સ્તવનોની રચના પરમાર્થ નિષ્ઠાવાળા મહાપુરુષો કરતા હતા.

સી. ૧

છેલ્લે છેલ્લે વિક્રમની આરમ્ભ gyanmandir@kobatirth.org ની ગૂર્જર ભાષાનું ઘડતર વિકસવા માંડ્યું, પરિણામે સોલમી સદીમાં અમુક ચોક્કસ સ્વરૂપમાં નિયત થયેલ ગૂર્જર ભાષાએ સત્તરમી સદીના આરંભે મધુરતાભર્યું સ્વરૂપ લીધું.

તે પ્રાસાદિકતા—ગુણનો લાલ લઈ તે વખતના મહાપુરૂષોએ પરમાત્માની ભક્તિ તરફ સામાન્ય જનતાને વાળવા માટે રચેલ સ્તવન ચોવીશીઓ અને છૂટક ઢાળખંધ અનેક સ્તવનો અસ્તિત્વમાં આવી રહ્યાં.

વર્તમાનકાલીન ઇતિહાસના ઉપલબ્ધ સાધનોના આધારે એમ પણ જણવા મળ્યું છે કે—

“ગૂર્જર ભાષાની આઘજનની રૂપ દેશ્ય અપભ્રંશભાષામાં સર્વ પ્રાચીન પ્રથમ કૃતિ તરીકે વિ.સં. ૧૨૪૧માં પૂ. આ. શ્રી શાલિભદ્રસૂરિ મહારાજે રચેલ “ભરત-ખાડુખલિ રાસ” મનાય છે.

પછી ઉત્તરોત્તર ભાષાકીય સુધારા-વધારા થતા ગયા. ભક્ત કવિ નરસિંહના કાળ પછી ગુજરાતી-ભાષાએ ચોક્કસરૂપ પકડ્યું.

એટલે તે ભાષાના માધ્યમે આપણા પરમોપકારી ગીતાઈ સ્ફુર્શી આચાર્યો આદિ મુનિ-ભગવંતોએ શ્રી વીતરાગ પ્રભુના અવ-ર્ણનીય ગુણોની સ્તવના સ્તવનો, ચોવિશીઓ અને પદો દ્વારા કરવા માંડી.

જેના અવલંબને મુમુક્ષુ પુણ્યાત્માઓ વિસરાઈ ગયેલ આત્મ-સ્વરૂપને ઓળખાવનારા મહાન્ ઉપકારી તીર્થંકર ભગવંતોના અત્ય-દ્વિભુત ઉદાત્તતમ લોકોત્તર-ગુણોને પોતાની ભાષામાં વ્યક્ત કરવારૂપે ભાવોલ્લાસ-પોષક રીતે સ્તવનો વગેરેને આત્મશુદ્ધિના અનન્ય સાધન રૂપે અપનાવતા ગયા.

આવું સ્તવન-સાહિત્ય એકધારું વિક્રમની પાંદરી સદીના ઉત્તરાર્ધથી જિનશાસનમાં સર્જાતું આવ્યું છે.

સત્તરમી સદીના પ્રારંભે તે સર્જન પૂર બહાર ખીલીને અઢારમી અને એગણીસમી અને વીસમી સદીમાં ખૂબ સમૃદ્ધ બનવા પામ્યું છે.

આવું સ્તવન સાહિત્ય ઉત્તમ-કક્ષાએ ટકી રહી અનેક ભવ્યા-ત્માઓને ઉપકારી બનતું આવ્યું છે.

આવા સાહિત્યનો અહુવિધ સંગ્રહ આરાધનામાં ખૂબ ભાવ વર્ધક અને તે આશયથી કરવાનો શુભ સંકલ્પ ઘણા વખતથી હતો, કેમકે—

ભૌતિકવાદી વિલાસપ્રચુર અર્થ-ગાંભીર્ય વગરના, વાસનાપોષક શબ્દોની ચમક-ભભકવાળા, શ્રોત્રેન્દ્રિય-મધુર, કામસંસાર અને તેના સંસ્કારી વાતાવરણને સમર્થક એકવીસમી સદીના મોટા ભાગના સ્તવન-સાહિત્યથી શ્રી સંઘમાં માનસિક રીતે જામી રહેલ અનિષ્ટ વાતાવરણના ભાવી દુષ્પરિણામોની કલ્પનાથી ધ્રુજતા હોવાને સાન્ત્વના આપવા ઘણા વખતથી મથામણ ચાલતી કે—

“શ્રમણ-પ્રધાન ચતુર્વિધ સંઘમાં કાળબળે આવેલી નિર્નાયક-સ્થિતિના ગરલાભના પરિણામે ભક્તિરાગના નામે તેમજ આસ્થવ-મહોત્સવોમાં શાસન-પ્રભાવનાના નામે લોક હેરીને અગ્રપદ જાણ્યે-અજાણ્યે અપાતું જાય છે. તે ઉચિત નથી.”

પણ નિષેધાત્મક વલણની સામે સક્રિય વલણના પ્રતિક તરીકે પૂર્વાચાર્યોની પ્રાચીન સ્તવન-ચોવિંશીઓનાં પ્રાચીન ચાર-પાંચ પુસ્તકો હોવાના ઊંડાણમાં પડેલી ગૂઢતમ ઇચ્છાના બળે ૨૦/૨૨ વર્ષથી સંગ્રહમાં વારંવાર હાથવગે થઈ રહેલાં.

છેવટે વિ.સં. ૨૦૩૨ના મહેસાણાના ચોમાસામાં વિવેક મહાત્માઓ, સહવર્તી સાધુઓ અને ધર્મપ્રેમી શાસનાનુરાગી સદ્ગૃહસ્થોની વિશિષ્ટ પ્રેરણાથી પડી રહેલા તે બધા સ્તવન-સંગ્રહોના પુસ્તકોની સળંગ પ્રેસકોપી બનાવવારૂપે વાત સાકાર બની રહી.

પરિણામે પ્રથમ ભાગમાં ૩૧ ચોવિંશીઓ અને દ્વિતીય ભાગમાં ૨૯ ચોવિંશીઓ વ્યવસ્થિત રીતે પ્રાચીન જ્ઞાનભંડારોમાંની ૩૦/૪૦ સ્તવન-ચોવિંશીઓની હસ્તલિખિત પ્રતિઓ મેળવી યથાશક્ય પાઠભેદો મેળવી, શુદ્ધ પાઠની ગવેષણાનો પ્રયત્ન કરી છપાવવાનો શુભ પ્રયાસ થયો છે.

હજી સંપાદક પાસે ૩૦/૪૦ ચોવિંશીઓ અને ૧૧ વિહરમાન ચોવિંશીઓનો સંગ્રહ સુવ્યવસ્થિત છે. પણ હવે શારીરિક સ્થિતિ આદિ વિશિષ્ટ કારણોથી પ્રકાશન કરાવવાની શક્યતા નથી લાગતી.

આટલું પ્રાસંગિક પ્રસ્તુત સંપાદન અંગેની પૂર્વ ભૂમિકા રૂપે જણાવ્યા પછી આ ગ્રંથના બે ભાગોમાં આવેલી ૬૦ ચોવિંશીઓની અનન્ય સાધારણ વિશિષ્ટતાનો ટૂંક પરિચય હવે આલેખાય છે.

ચાર દુર્લભ તકો !!!

- ૦ પુણ્યનો રસ ઉભરાય ત્યારે ગુણાનુરાગ દષ્ટિ જન્મે.
- ૦ પુણ્યનો રસ હલકાય ત્યારે શ્રી વીતરાગ પરમાત્માના ગુણો ઓળખાય.
- ૦ હકીકતમાં અંતર-દષ્ટિ ખૂબ નિર્મળ થાય ત્યારે શ્રી વીતરાગ પરમાત્માના ગુણો ગાવાની તક મળે.
- ૦ આત્મા વિકાસની પરમોચ્ચ ભૂમિકા નજીક આવે ત્યારે પરમાત્માના ગુણોની પ્રમોદભાવે ચિંતના કરવાનો ધન્ય અવસર મળે.

લકિતરસ ઝરણાં (ભાગ ૧-૨) માં સંગૃહિત સ્તવન ચોવીશીઓની વિશિષ્ટતાઓ

(પ્રથમ ભાગ)

- (૧) પૂ. શ્રી આનંદઘનજી મ. કૃત સ્તવન ચોવીશી.
આ ચોવીશી શાસ્ત્રદર્પણ, ઉચ્ચ અધ્યાત્મ-તત્ત્વ-જ્ઞાનની દ્રષ્ટિએ સર્વોત્તમ છે.
- (૨) પૂ. ઉપા. શ્રી યશોવિજયજી મ. કૃત સ્તવન ચોવીશી.
જેમાં અપૂર્વ લકિતરસ, પ્રાસાદિકલાષામાં બાળભોજ્ય શૈલિથી વર્ણવેલ છે.
- (૩) પૂ. ઉપા. શ્રી યશોવિજયજી મ. કૃત લઘુ સ્તવન ચોવીશી.
જેમાં સેવા, પ્રીતિ, લકિત, શ્રદ્ધા, વિનયાદિ પદાર્થો મિતાક્ષરી ભાષામાં જણાવવા સાથે નીચેના સ્તવનો ખૂબ સરસ અર્થ-ગંભીર છે.
શ્રી ધર્મનાથ પ્રભુ—પા. ૬૯
શ્રી શાંતિનાથ પ્રભુ—પા. ૭૦
શ્રી અરનાથ પ્રભુ—પા. ૭૨
શ્રી નેમિનાથ પ્રભુ—પા. ૭૪
શ્રી પાર્શ્વનાથ પ્રભુ—પા. ૭૫
શ્રી મહાવીર પ્રભુ—પા. ૭૬
- (૪) પૂ. ઉપા. શ્રી યશોવિજયજી મ. કૃત ૧૪ બોલની ચોવીશી.
જેમાં પૂ. ઉપાધ્યાયશ્રીએ શ્રી તીર્થંકર પરમાત્માના જીવનને લગતી મહત્વની નીચેની ૧૪ બાબતો સંગ્રહી છે.

- | | |
|------------------|---------------------------|
| (૧) પ્રભુનું નામ | (૮) દીક્ષા પરિવાર. |
| (૨) પિતાનું નામ | (૯) આયુષ્ય. |
| (૩) માતાનું નામ | (૧૦) સાધુ સંખ્યા. |
| (૪) જન્મ નગરી | (૧૧) સાધ્વી સંખ્યા. |
| (૫) લાંછન | (૧૨) નિર્વાણસ્થળ. |
| (૬) શરીરવર્ણ | (૧૩) અધિષ્ઠાયક યક્ષ |
| (૭) શરીરની ઉંચાઈ | (૧૪) અધિષ્ઠાયિકા યક્ષિણી. |

(૫) પૂ. ભાણુવિજયજી મ. કૃત સ્તવન ચોવિશી.

જેમાં ભક્તિભર્યા લટકાથી ભરપૂર રીતે પ્રભુ સાથે અંતરંગ વાતો કરવાની રીત-અદ્ભુત શૈલિથી વર્ણવી છે.

(૬) પૂ. શ્રી આણંદવર્ધનજી મ. કૃત સ્તવન ચોવિશી.

જેમાં ગીતની પદ્ધતિએ ત્રણ કે ચાર ગાથામાં અપૂર્વ ભક્તિરસ વર્ણવ્યો છે.

(૭) પૂ. શ્રી લક્ષ્મી વિજયજી મ. કૃત સ્તવન ચોવિશી.

જેમાં નીચે મુજબનાં સ્તવનો મહત્વનાં છે.

* શ્રી અજિતનાથ પ્રભુ સ્તવન—આધ્યાત્મિક-ભાવોની છણાવટ.

* શ્રી સંભવનાથ „ „ યોગ-માર્ગના પ્રાથમિક પદ્ધતિની રજુઆત.

* શ્રી અભિનંદન „ „ આજ્ઞાતસ્વની પ્રધાનતા.

* શ્રી સુમતિનાથ „ „ સમ્યક્ત્વ-વિચાર.

* શ્રી સુવિધિનાથ „ „ આંતરિક-શત્રુઓનો અદ્ભુત વિજય.

* શ્રી વાસુપૂજ્ય „ „ શ્રી જિનશાસન-વૃક્ષનું સુંદર રૂપક.

* અરનાથ „ „ પ્રભુ-ધ્યાનનું મહત્ત્વ.

* શ્રી મલિનાથ „ „ આધ્યાત્મિક અંતરંગ-યાત્રાનું વર્ણન.

- * શ્રી મુનિસુવ્રત ,, ,, નિગોદનું સુંદર વર્ણન.
- * શ્રી નમિનાથ ,, ,, આત્મ-તત્ત્વનું શુદ્ધ સ્વરૂપ.

(૮) પૂ. ઉપાધ્યાય માનવિજયજી મ. કૃત સ્તવન ચોવિશી.
આ ચોવિશીમાં વિશિષ્ટ શૈલિમાં અદ્ભુત રીતે ભક્તિરસ
પૂ. ઉપાધ્યાયશ્રીએ ઢાળ્યો છે, છતાં વિશિષ્ટ સ્તવનો નીચે
મુજબ છે.

- * શ્રી ઋષભદેવ જિન સ્તવન—ભક્તિનું મહત્ત્વ.
- * શ્રી અભિનંદન ,, ,, આધ્યાત્મિક ઉપાલંભ.
- * શ્રી સુમતિનાથ ,, ,, શબ્દ-ચમક તથા હૈયાનો
ભક્તિયોગ તથા પિંડસ્થ
ધ્યાનવિચાર.

- * શ્રી પદ્મપ્રભ ,, ,, પદસ્થ ,, ,,
- * શ્રીસુપાર્શ્વનાથ ,, ,, રૂપસ્થ ,, ,,
- * શ્રી ચંદ્રપ્રભ ,, ,, રૂપાતીત ,, ,,
- * શ્રી શ્રેયાંસનાથ ,, ,, ૮ પ્રાતિહાર્ય-વર્ણન તથા
આધ્યાત્મિક-ખેતીનું વર્ણન
- * શ્રી વિમલનાથ ,, ,, પ્રભુજીને મનમાં પધરાવવાની
અદ્ભુત વાત.
- * શ્રી મુનિસુવ્રત ,, ,, પ્રભુની નિષ્કારણ-ઉપકારિતા.
- * શ્રી નેમિનથ ,, ,, કામ-વાસનાનો અદ્ભુત
આધ્યાત્મિક વિજય
- * શ્રીપાર્શ્વનાથ ,, ,, દેવતત્ત્વનું અદ્ભુત વર્ણન
- * શ્રીમહાવીરસ્વામી , ,, ક્ષપક-શ્રેણિનું અદ્ભુત વર્ણન

(૯) શ્રી જ્ઞાનવિમલ સૂરિ મ. કૃત સ્તવન ચોવિશી.

પૂ. ધ્યાનયોગી આચાર્યશ્રીએ આખી ચોવિશીમાં અદ્ભુત,
તત્ત્વો વર્ણવ્યાં છે, જેમાં ખાસ કરી નીચેનાં સ્તવનો
વિશિષ્ટ છે.

- * શ્રી સંભવનાથ સ્તવન „ પ્રભુજીને મનમાં પધરાવવાની સુંદર ઉપમાઓ.
- * શ્રી સુવિધિનાથ „ „ આધ્યાત્મિક મનોમંદિરનું સુંદર રૂપક.
- * શ્રી શાંતિનાથ „ „ વિરોધાભાસી રીતે પ્રભુ ગુણોનું વર્ણન.
- * શ્રી મલ્લિનાથ „ „ લંછનનું અદ્ભુત વર્ણન
- * શ્રી નમિનાથ „ „ અન્યદેવોની તુલનાએ શ્રી વીતરાગ પ્રભુનું વર્ણન.

(૧૦) પૂ. શ્રી ભાવવિજયજી મ. કૃત સ્તવન ચોવિશી.

પાંચ-પાંચ ગાથાના સ્તવનોમાં નીચે મુજબના

અગિયાર બોલો વ્યવસ્થિતપણે ગોઠવ્યા છે.

- | | |
|--------------|------------------|
| (૧) નામ | (૭) શરીરની ઉંચાઈ |
| (૨) વંશ | (૮) આયુષ્ય |
| (૩) જન્મનગરી | (૯) શરીરનો વર્ણ. |
| (૪) માતા | (૧૦) યક્ષ |
| (૫) પિતા | (૧૧) યક્ષિણી |
| (૬) લંછન | |

(૧૧) પૂ. શ્રી વિનયવિજયજી મ. કૃત લઘુ સ્તવન ચોવિશી.

ત્રણ-ત્રણ ગાથાનાં દ્વંકા પદ જેવા સ્તવનોમાં

પૂ. ઉપાધ્યાયશ્રીએ અદ્ભૂત રીતે ભક્તિરસ

રેડ્યો છે, જેમાં વિશિષ્ટ સ્તવનો નીચે મુજબ.

- * શ્રી શીતલનાથપ્રભુસ્તવન—શીતળ પદાર્થોનું ભવ્ય વર્ણન.
- * શ્રી વાસુપૂજ્યપ્રભુ „ „ લંછનનું મહત્વ.
- * શ્રી મુનિમુવ્રત „ „ મન મધુકરની સુંદર ઉપમા.

(૧૨) શ્રી હરખચંદજી મ. કૃત સ્તવન ચોવિશી.

આ ચોવિશીમાં પાંચ, ચાર કે ત્રણ ગાથાના સ્તવનોમાં

અપૂર્વ રીતે નીચે મુજબના નવ બોલો ગૂંથ્યા છે.

(૧) નામ	(૫) પિતા
(૨) વંશ	(૬) ઉંચાઇ
(૩) જન્મ-નગરી	(૭) આયુ
(૪) માતા	(૮) શરીરવર્ણ.
	(૯) લાંછન

(૧૩) શ્રી નયવિજયજી મ. કૃત સ્તવન ચોવિશી.

આ ચોવિશીમાં લકિતભાવભર્યા ઉલ્લાસને ઉપજાવનાર શૈલિથી પ્રભુલકિતના તાત્ત્વિક સ્વરૂપનું વર્ણન કર્યું છે. જેમાં વિશિષ્ટ સ્તવનો નીચે મુજબ છે.

* શ્રી સંભવનાથ પ્રભુ સ્તવન—સમ્યગ્દર્શન—પ્રભુદર્શનની મહત્તા.

* શ્રી સુમતિનાથ „ „ સુમતિ શબ્દના વિશિષ્ટ અનેક અર્થો,

* શ્રી ચંદ્રપ્રભ „ „ આધ્યાત્મિક રીતે ચંદ્ર અને તેની પ્રભાનું સુંદર વર્ણન

* શ્રી શીતળનાથ „ „ પ્રભુદર્શનનો અદ્ભુત મહિમા

* શ્રી નમિનાથ „ „ મોટા ભેદભાવ ન રાખે એનું સુંદર વર્ણન

(૧૪) શ્રી ઋષભસાગરજી મ. કૃત સ્તવન ચોવિશી.

મારવાડી દેશીભાષામાં ખૂબ સરસ પ્રભાવશાલી કવિત્વ શક્તિ—સભર રચનાવાળી આ ચોવિશીનાં કેટલાક મહત્ત્વનાં સ્તવનો

* શ્રી સંભવનાથ પ્રભુ સ્તવન „ „ અંતર્ગત આધ્યાત્મિક વાતોની સારી રજૂઆત.

- * શ્રી ચંદ્રપ્રભ „ „ ભક્તિભર્યા લાડની વાતો.
- * શ્રી સુવિધિનાથ „ „ પ્રભુ સાથે પ્રીતિ કેવી ?
તેની સારી રજુઆત.
- * શ્રી શ્રેયાંસનાથ „ „ અપૂર્વ ઉચ્ચભાવના
- * શ્રી શાંતિનાથ „ „ અંતર નિવેદન.
- * શ્રી પાર્શ્વનાથ „ „ દેવાધિદેવની સેવાનું
સર્વોચ્ચપણું.
- * શ્રી મહાવીર „ „ આધ્યાત્મિક અંતરંગ
પૂજન વર્ણન.

(૧૫) શ્રી ઉદયરત્નજી મ. કૃત સ્તવન ચોવિશી.

પૂજ્યશ્રીએ ત્રણ કે ચાર ગાથાના ટૂંકા સ્તવનોમાં પ્રભુ ભક્તિનાં અનેક પાસાં બાળભોગ્યશૈલિમાં ગૂંથ્યાં છે.

(૧૬) શ્રી જિનવિજયજી મ. કૃત સ્તવન ચોવિશી.

શ્રી જિનવિજયજી મ. શ્રીએ પ્રભુભક્તિમાં વિશિષ્ટ ભાવોલ્લાસ ઉપજાવે તેવી શૈલિમાં રચેલી શાસ્ત્રીય-પદ્યરચોની ગૂંથ છીવાળી સુંદર આ ચોવિશીનાં મહત્ત્વનાં સ્તવનો નીચે મુજબ.

- (૧) શ્રી ઋષભદેવ જિન સ્તવન—સુંદર આધ્યાત્મિક ભાવો.
- (૨) શ્રી અજિતનાથ „ „ પ્રભુ-સેવાની સર્વોત્તમતા.
- (૩) શ્રી સંભવનાથ „ „ ચાર મૂળ-અતિશયોની વિગત
- (૪) શ્રી પદ્મપ્રભ „ „ આત્મનિવેદન-(ગર્હાંરૂપે)
- (૫) શ્રી સુપાર્શ્વનાથ „ „ સેવ્ય-સેવકભાવની સુંદર ઘટના.
- (૬) શ્રી વાસુપૂજ્ય „ „ મન-મંદિરની આદર્શ વિવેચના.
- (૭) શ્રી વિમલનાથ „ „ આંતર ભાવયુક્ત-દોષ
વિજયનું રૂપક.

(૮) શ્રી અનંતનાથ „ „ પ્રભુની સર્વોત્તમતાનો ચિતાર.

(૯) શ્રી શાંતિનાથ „ „ ચૈત્યવંદન-ભાષ્યનાં ૧૦ ત્રિકોની
સુંદર ગુંથણી.

(૧૦) શ્રી અરનાથ „ „ ૧ થી ૨૪ સંખ્યાના ધોરણે
આધ્યાત્મિક-સંકેત ૩૫ દોષ
ગુણનું વર્ણન

(૧૧) શ્રી મહાવીર „ „ સંક્ષિપ્ત જીવન-પ્રસંગો.

(૧૭) શ્રી જિનવિજયજી મ. કૃત બીજી સ્તવન ચોવિશી.

પૂજ્યશ્રીએ લક્ષિતયોગને રસતરબોળ બનાવનાર કેટલાક
શાસ્ત્રીય તત્ત્વોને બાળભોગ્ય રીતે રજુ કરનારી શૈલિમાં
બનાવેલ આ ચોવિશીનાં કેટલાંક વિશિષ્ટ સ્તવનો.

૦ શ્રી સંલવનાથ પ્રભુ સ્તવન—સંસારની રખડપટ્ટીનું
વર્ણન

* શ્રી અભિનંદન જિન સ્તવન લાંછનનું આધ્યાત્મિક રહસ્ય.

* શ્રી સુમતિનાથ „ „ પાંચની સંખ્યાએ પ્રભુનું
વિશિષ્ટ મહત્ત્વ.

* શ્રી પદ્મપ્રભ „ „ અંતરંગ-શત્રુઓના ભાવ-
યુદ્ધનું આધ્યાત્મિક વર્ણન

* શ્રી સુપાર્શ્વનાથ „ „ આધ્યાત્મિક-જિનાલયનું ભવ્ય
રૂપક.

* શ્રી વાસુપૂજ્ય „ „ મન-મંદિરની પધરામણીનું
સુંદર સ્વરૂપ.

* શ્રી અનંતનાથ „ „ આઠ પ્રાતિહાર્યનું વર્ણન તથા
જિનવાચીનું સુંદર રૂપકાત્મક
વર્ણન.

- * શ્રી શાંતિનાથ ,, ,, વિરોધાભાસી લાગતા પ્રભુજના ગુણોનું વર્ણન.
- * શ્રી કુંથુનાથ ,, ,, લાંછનનું ભવ્ય રહસ્ય.
- * શ્રી અરનાથ ,, ,, આત્મનિર્દા ૩૫ આંતરિક સ્થિતિ વર્ણન.
- * શ્રી મલ્લિનાથ ,, ,, આઠ કર્મના વિનાશ ઉપજતા આત્મ-ગુણોનું વર્ણન.
- * શ્રી મુનિસુવ્રતસ્વામી ,, ,, સપ્તભંગી-સ્યાદ્વાદ-ગર્ભ-વાણીનું સ્વરૂપ.
- * શ્રી પાર્શ્વનાથ ,, ,, અંતરંગ ભાવ-સૈન્ય વર્ણન.
- * શ્રી મહાવીર ,, ,, પ્રભુ-શાસનનું મહત્ત્વ.

(૧૮) શ્રી હંસરત્નજી કૃત સ્તવન ચોવિશી.

પ્રભુ ગુણગાનમાં અ-દ્વિતીય તત્ત્વમયતા ઉભી કરનાર આ ચોવિશીના-કેટલાંક વિશિષ્ટ સ્તવનો.

- * શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન સાત બોલ ગર્ભિત વર્ણન છે.
- * સુવિધિનાથ ,, ,, આઠ પ્રાતિહાર્યનું સુંદર વર્ણન
- * શ્રી શીતલનાથ ,, ,, ભવ-અટવીનું ભવ્ય વર્ણન
- * શ્રી વાસુપૂજ્ય ,, ,, મનઘરની સુંદરતાનું વર્ણન.
- * શ્રી શાંતિનાથ ,, ,, મેઘરથ ભવમાં કરેલ પારેવાની રક્ષાના પ્રસંગનું વર્ણન.
- * શ્રી મલ્લિનાથ ,, ,, શ્રી તીર્થંકર-પરમાત્માને સુંદર કલ્પવૃક્ષના રૂપકની ઘટના.
- * શ્રી મુનિસુવ્રત ,, ,, આધ્યાત્મિક વર્ષાઋતુનું વર્ણન.

(૧૯) શ્રી મોહનવિજયજી મ. કૃત સ્તવન ચોવિશી.

વર્તમાનકાળની બધી ચોવિશીમાં પ્રભુ પરમાત્મા સાથે ભકિતયોગના ગાનમાં એકાકાર બની વાતો કરવા રૂપે વિવિધ લટકા અને મીઠા ઉપાલંબને સૂચવનારા શબ્દો વાક્યોથી શોભતી આ ચોવિશી ખૂબજ સર્વોત્કૃષ્ટ છે.

આ ઉપરથી આના કર્તા શ્રીમોહન વિજયજીમ.

“લટકાળા” એ ઉપનામથી પ્રસિદ્ધ થયા છે.

આખી ચોવિશી ખૂબજ અર્થગંભીર-ગહન છે.

(૨૦) શ્રી રામવિજયજી મ. કૃત સ્તવન ચોવિશી.

પૂ. ઉપા. શ્રી વિમલવિજયજી મ. ના શિષ્ય પૂ. રામવિજયજીમ. બનાવેલ વિશિષ્ટ કાવ્ય રચનાવાળી તત્ત્વજ્ઞાન સાથે ભક્તિરસમાં જોડનારી આ ચોવિશીનાં વિશિષ્ટ સ્તવનો—

* શ્રી સુપાર્શ્વનાથ પ્રભુસ્તવન—રાગ-દ્વેષની વિષમતાનું વર્ણન—

* શ્રી વિમલનાથ „ „ પ્રભુજીના અંગોનું સુંદર વર્ણન.

* શ્રી કુંથુનાથ „ „ પ્રભુદર્શનની મહત્તા.

* શ્રી અરનાથ „ „ અંતરંગ ચિકારી-ભાવોના જ્યનું વર્ણન

(૨૧) શ્રી રામવિજયજી મ. કૃત સ્તવન ચોવિશી.

પૂ. શ્રી સુમતિવિજયજી મ. ના વિશિષ્ટ શ્રી રામવિજયજી મ. ની બનાવેલી વિશિષ્ટ શબ્દ પ્રયોગો અને વિગતોથી ભરપૂર આ ચોવિશીની વિશેષતા એ છે કે—

દરેક સ્તવનમાં તાત્ત્વિકવાતની ભક્તિયોગની શૈલિએ રજુ-
આત સાથે તે તે પ્રભુજના જીવનને લગતી ખીનાઓ આપવામાં
આવી છે, એ-

—આ ચોવિશીની આ વિશિષ્ટતા છે.

આ ચોવિશીના વિશિષ્ટ સ્તવનો.

* શ્રી અજિતનાથ પ્રભુ સ્તવન — દેશીરાગની સુંદર
ઢાળમાં બનાવાયેલું આ સ્તવન
અપૂર્વ ભક્તિરાગ ઉપજાવે છે
સેવા એટલે શું ? તેનું રહસ્ય
પણ વર્ણવાયું છે,

* શ્રી ચંદ્રપ્રભ સ્વામી સ્તવન— આંતરિક-શત્રુઓનું
દૂંકું વર્ણન

* શ્રી વાસુપૂજ્ય પ્રભુસ્તવન — અંતરંગ ભાવ-શત્રુઓનું
સૂચનાત્મક સુંદર વર્ણન.

* શ્રી પાર્શ્વનાથ „ „ મેઘમાળી ઉપસર્ગનું વર્ણન

(૨૨) શ્રી કાંતિવિજયજી મ. કૃત સ્તવન ચોવિશી

પૂ. શ્રી કાંતિવિજયજી મ. શ્રી એ વિવિધ રાગો
દેશીઓમાં બનાવેલ આ ચોવિશીમાં તાત્ત્વિક બાબતો સુંદર
રીતે રજુ કરી છે.

આનાં વિશિષ્ટ સ્તવનો

શ્રી અભિનંદન જિન સ્તવન—શ્રી તીર્થંકર પરમાત્માને

સૂર્યના રૂપકની સુંદર ઘટના.

* શ્રી સુવિધિનાથ „ „ યોગમુદ્રા ધ્યાનધારા તથા
અદ્ભુત ગુણોનું વર્ણન.

* શ્રી વિમલનાથ „ „ પ્રભુ સાથે તુલનાત્મક આપણા
જીવનનું વિહંગાવલોકન.

* શ્રી નમિનાથ ,, ,, વર્તમાન આત્મદશાનું વર્ણન.
(૨૩) શ્રી ન્યાયસાગરજી મ. કૃત સ્તવન ચોવિશી.

પૂ. ન્યાયસાગરજી મ. શ્રીએ શબ્દ-રચનાની દૃષ્ટિએ
અટપટા શબ્દોવાળી રચનારૂપે બનાવેલ આ ચોવિશી ખૂબજ
ભાવગંભીર છે.

આનાં વિશિષ્ટ સ્તવનો-

* શ્રી સંભવનાથ જિન સ્તવન મનમંદિરમાં ભાવપૂર્ણનું દ-
અદ્ભુત સ્વરૂપ.

* શ્રી સુવિધિનાથ ,, ,, શ્રી તીર્થંકર પરમાત્માનું નય-
સાપેક્ષરૂપે સર્વદેવમયપણું.

* શ્રી વિમલનાથ ,, ,, ભાવ પૂર્ણનું સંક્ષિપ્ત સ્વરૂપ

* શ્રી ધર્મનાથ ,, ,, ધર્મ શબ્દના ચાર નિક્ષેપાનું
વર્ણન

લાંછન રહસ્ય ગર્ભિત

(૧૪) શ્રી ન્યાયસાગરજી મ. કૃત સ્તવન ચોવિશી (બીજી)
વર્તમાન કાળે ઉપલબ્ધ સઘળી ચોવિશી ઝોમાં આ
ચોવિશી પ્રભુજીના લાંછનોના આધ્યાત્મિક રહસ્યને
સમજાવનાર તરીકે ખૂબજ મહત્વની છે.

એ અપેક્ષાએ આ ચોવિશી ખૂબ અગત્યની છે.

(૨૫) શ્રી પદ્મવિજયજી મ. કૃત સ્તવન ચોવિશી (પહેલી)

આ ચોવિશીની અપૂર્વ વિશિષ્ટતા એ છેકે-પ્રભુજીના પાંચ
કલ્યાણકોની તથિઓ, શરીરનો વર્ણ, અને આયુ આ ત્રણ
બાબતો માત્ર પાંચ ગાથાના દરેક સ્તવનમાં સંક્ષેપમાંજ
સરળ ગુંથી છે.

(૨૬) શ્રી પદ્મવિજયજી મ. કૃત સ્તવન ચોવિશી (બીજી)

આ ચોવિશી આધ્યાત્મિક શૈલિએ ગૂઢ ભાવભર્યા શબ્દોની
ફૂલ ગુંથીવાળી અત્યંત સુંદર છે.

આનાં વિશિષ્ટ સ્તવનો—

- * શ્રી ઋષભદેવ પ્રભુ સ્તવન-સિદ્ધસ્વરૂપ વર્ણન.
- * શ્રી અજિતનાથ „ „ સ્વરૂપ-સત્તાનું વિશિષ્ટ વર્ણન
- * શ્રી અભિનંદન „ „ શ્રી વીતરાગ-પ્રભુની વાણીની અદ્ભુતતાનું માર્મિક વર્ણન
- * શ્રી મુપાર્શ્વનાથ „ „ આમાં નીચે મુજબ કલ્યાણ મંદિરના કાવ્યોનું રૂપતાંતર છે.

સ્તવનની ગાથા

—કલ્યાણ મંદિરનું કાવ્ય

૨

૧૦

૪-૫

૧૬

૬-૭

૧૨

- * શ્રી ચંદ્રપ્રભ „ „ આખું સ્તવન જ્ઞાનસારના પ્રથમ પૂર્ણાષ્ટકનું રૂપાંતર છે.
- * શ્રી શીતલનાથ „ „ સિદ્ધના સુખનું તાત્ત્વિક વર્ણન.
- * શ્રી અનંતનાથ „ „ તીર્થંકરપ્રભુના ગુણોની અનંતતાનું રોમાંચક વર્ણન.
- * શ્રી શાંતિનાથ „ „ શ્રી સિદ્ધ ભગવંતના ૩૧ ગુણોનું વર્ણન.
- * શ્રી અરનાથ „ „ અંતરંગ શત્રુઓનું વર્ણન. સ્તવનકારની ગુરૂપદાવલીનું વર્ણન.
- * શ્રી મલિનાથ „ „ દ્રવ્ય-ગુણ-પર્યાયની તાત્ત્વિક વ્યાખ્યા.
- * શ્રી નમિનાથ „ „ શ્રી વીતરાગ પ્રભુના વિરોધાભાસી ગુણોનું વર્ણન.

* શ્રી પાર્થનાથ જિન સ્તવન — પ્રભુદર્શનની અપૂર્વ
મહત્તા (વિવિધ ઉપમાઓથી)

(૨૭) શ્રી વિજયલક્ષ્મી સૂરિજી મ. કૃત સ્તવન ચોવિંશી.

ધ્યાન-યોગ અને શાસ્ત્રીયતત્ત્વોના રહસ્યના જાણકાર પૂ. આજી
શ્રી વિજયલક્ષ્મી સૂરિજી મ. શ્રી ઐ વિશિષ્ટ આધ્યાત્મિક
તત્ત્વ, દર્શનિક વિચાર, નયવાદની ગહન વાત, ષડ્ દ્રવ્યનું ચિંતન,
ગુણ, સ્વભાવ, પર્યાયની તાત્ત્વિક, વાતો, પંચસમવાયની વાત, ચાર
નિક્ષેપા આદિ અતિ વિશિષ્ટ પદાર્થોના સંકલનરૂપે આ ચોવિંશી અદ્-
ભુત બનાવી છે,

જેનાં વિશિષ્ટ સ્તવનો નીચે મુજબ છે,

* શ્રી સંભવનાથ પ્રભુ સ્તવન આધ્યાત્મિક તત્ત્વ વિચાર

* શ્રી સુમતિનાથ „ „ પ્રભુ સાથે આપણી વિષમ
તુલનારૂપે આત્મગર્હાં,

* શ્રી પદ્મપ્રભ „ „ ષડ્દર્શન-વિચારની અદ્ભુત
ગુંથણી.

* શ્રી સુપાર્થનાથ „ „ સાત નયોના સ્વરૂપનો સરળ
વિચાર.

* શ્રી ચંદ્રપ્રભ „ „ આઠ કર્મના ક્ષયથી ઉપજતા
આત્મ-ગુણોનો વિચાર.

* શ્રી શીતલનાથ „ „ ષડ્દ્રવ્ય-વિચારની સુંદર
ઘટના.

* શ્રી ત્રેયાંસનાથ „ „ ગુણ-પર્યાયની વિચારણા.

* શ્રી વાસુપૂજ્ય „ „ શ્રી તીર્થંકર-પરમાત્માનાં
અદ્ભુત રૂપનું શાસ્ત્રીય વર્ણન.

શ્રી અનંતનાથ „ „ શ્રી જિનવાણીનું માર્મિક
વર્ણન.

- * શ્રીધર્મનાથ ,, ,, આર પર્ષદા સંબંધી વિચાર.
- * શ્રી શાંતિનાથ ,, ,, શ્રી આનંદધનજી મ.ના
શ્રી સુપાર્થનાથપ્રભુના
સ્તવનની યાદ અપાવે તેવા
શ્રી તીર્થંકર-પરમાત્માના
ગુણ-જન્ય યથાર્થ વિવિધ
નામો.
- * શ્રી કુંથુનાથ ,, ,, પંચ-સમવાય-વિચારની ગુંથણી.
- * શ્રી અરનાથ પ્રભુ સ્તવન 'દર્શન'-પદાર્થની વિવિધ રીતે
વિચારણા.
- * શ્રી મલ્લિનાથ ,, ,, ચાર નિલ્લેખાની વિચારણા.
- * શ્રી નેમિનાથ ,, ,, પ્રભુજીના અદ્ભુત ગુણોના વર્ણન
સાથે દ્રવ્ય-ભાવપૂજનનું શાસ્ત્રીય
સ્વરૂપ.
- * શ્રી મહાવીરપ્રભુ ,, ,, પ્રભુજીના અદ્ભુત ભાવવાહી અર્થ-
ગંભીર-મિશ્રદેનું વર્ણન.

(૨૮) શ્રી કીર્તિવિમલજી મ. કૃત સ્તવન-ચોવિંશી

બાળજીવોને ઉપયોગી ભક્તિરસપોષક સહજભાવે શ્રી વીતરાગ-
પ્રભુના ઉદાત્ત સ્વરૂપને ઓળખી શકાય તેવી સ્વરસવાહી-શૈલીમાં બનેલા
પાંચથી સાત ગાથાના સ્તવનોની આ ચોવીંશી ખૂબ જ પ્રાસાદિક છે.
વળી આમાં અવારનવાર પૂ. શ્રીતીર્થંકર ભગવંતોનાં નામ,
પિતા, માતા, જન્મનગરી, લંછન, શાસનયક્ષ-યક્ષિણી વિગેરે બોલોને
પણ ગુંથવામાં આવ્યા છે.

આખી ચોવીંશી લગભગ મહત્ત્વની છે.

(૨૯) શ્રી દાનવિમલજી મ. કૃત સ્તવન-ચોવિંશી

આ ચોવીંશી પણ બાળજીવોપયોગી સરળ ભાવવાહી અંતરથી

ઉમટેલા ભક્તિયોગના સુ-મધુર શબ્દોની ઝમકવાળી માત્ર પાંચ ગાથાના સ્તવનોની વિવિધ દેશી રાગોમાં બનેલી છે.

એકંદરે બાળ-જીવોપયોગી નાની ચોવિશી છે.

(૩૦) શ્રી વિનીતવિજયજી મ. કૃત સ્તવન-ચોવિશી

બાળભોગ્ય પદાર્થો સાથે યોગ-શાસ્ત્રીય પદાર્થોની ભવ્ય રજુઆત-વાળી આ ચોવિશી પ્રાયઃ પાંચ ગાથાના સ્તવનોની એકંદરે મધ્યમ શુદ્ધિના ભાવિક જીવોના ભાવોદ્ધાસને વધારનારી છે.

(૩૧) શ્રી અમૃતવિજયજી મ. કૃત સ્તવન-ચોવિશી

અત્યંત ગંભીર ભાવોને સ્પર્શવા સાથે ભક્તિયોગના મિશ્રણને વધુ વ્યવસ્થિત રીતે વિકસાવનાર વિશિષ્ટ ભક્તિપ્રધાન શબ્દગૂંથણી-વાળી આ ચોવિશી પ્રાચીન-મારવાડી-દેશી ભાષાના શબ્દોવાળી ક્યાંક આગમિક-પદાર્થોના ઝમકારાવાળી ખૂબ જ સરળ ભાષામાં શ્રી વીતરાગ પરમાત્માના સ્વરૂપનું નિદર્શન કરાવે છે.

એકંદરે મધ્યમશુદ્ધિવાળા જીવોને હિતકર આ ચોવિશી છે.

(૩૨) શ્રી પ્રમોદસાગરજી મ. કૃત સ્તવન ચોવિશી

આ ચોવિશીમાં શ્રી તીર્થંકર પરમાત્માના વિશિષ્ટ અદ્ભુત જીવનચરિત્રની જાણકારી બાળજીવોને થાય તે આશયથી નીચે મુજબના વિશિષ્ટ તેર બોલોની ફૂલ-ગુંથણી ભવ્ય રીતે કરવામાં આવી છે.

૧ નામ	૮ શરીરવર્ણ
૨ લંછન	૯ ગણધર સંખ્યા
૩ જન્મનગરી	૧૦ સાધુ સંખ્યા
૪ માતા	૧૧ સાધ્વી સંખ્યા
૫ પિતા	૧૨ યક્ષ
૬ આયુ	૧૩ યક્ષિણી
૭ ઉંચાઈ	

(૩૩) શ્રી ભાણુચંદ્રજી મ. કૃત સ્તવન ચોવિશી

અત્યંત ઉચ્ચકોટિના ભક્તિયોગની રજૂઆતવાળી આ ચોવિશી બાળ-મધ્યમ અને બુધજીવોને સંતોષ આપે તેવી સુરમ્ય શૈલિમાં રચાયેલ છે.

જેમાં અનેક વિશિષ્ટતાઓ સમાયેલી છે. જે નીચેના સ્તવનો જોતાં માલુમ પડે તેમ છે.

- * શ્રી અજિતનાથ પ્રભુ સ્તવન પ્રભુએ ભાષેલ ધર્મની અદ્વિ-
તીય મહત્તા.
- * શ્રી સુમતિનાથ " " પ્રભુના અહ્ભુત લોકોત્તર-રૂપનો
મહિમા.
- * શ્રી સુપાર્શ્વનાથ " " ભક્તિયોગ-વાસનાનું વર્ણન.
- * શ્રી ચંદ્રપ્રભ " " અરિહંત-પ્રભુજીના ચાર અતિ-
શયોનું વર્ણન.
- * શ્રી વાસુપૂજ્ય " " પ્રભુ-નામ-સ્મરણની વિશિષ્ટ
મહત્તા.
- * શ્રી અનંતનાથ " " શ્રી તીર્થંકર પરમાત્માની લોકો-
ત્તર રૂપ-કાંતિનું શાસ્ત્રીય વર્ણન
- * શ્રી શાંતિનાથ " " પ્રભુજી સામે અંતરવ્યથાનું
વર્ણન.
- * શ્રી અરનાથ " " પ્રભુજીના જન્મ કલ્યાણકનું
વર્ણન.
- * શ્રી મલ્લિનાથ " " લાંછનનું અહ્ભુત રહસ્ય
- * શ્રી નમિનાથ " " " " "

(૩૪) શ્રી ખુશાલમુનિકૃત સ્તવન ચોવિશી

શાસ્ત્ર અને અધ્યાત્મમાર્ગના મર્મજ્ઞ શ્રી ખુશાલમુનિએ

આ ચોવિંશીમાં માત્ર પાંચ કે છ ગાથાની મર્યાદામાં રહી વિવિધ શાસ્ત્રીય-તત્ત્વોની સમજુતી સાથે અપૂર્વ રીતે ભક્તિયોગને પોષણ આપ્યું છે.

આ ચોવીંશીનાં વિશિષ્ટ સ્તવનો

* શ્રી સંભવનાથ પ્રભુ સ્તવન પ્રભુજીના અંગોપાંગોની સુંદર-તાનું વર્ણન.

* સુવિધિનાથ ,, ,, પ્રભુજી પર પ્રીતિ કેવી ? તેની સરળ સમજુતી.

પૂ. ઉપા. શ્રી યશો વિ.મ. ના “અજિતજિણુંદશું પ્રીતડી.” સ્તવનનું સંભારણું થાય તેવું આ સ્તવન છે.

* શ્રી કુંથુનાથ જિન સ્તવન પ્રભુજીને આંતરિક ભક્તિભાવ ભર્યા મીઠા ઉપાસંભ.

આ સ્તવનથી પૂ. ઉપા. શ્રી યશોવિજયજી મ. ના “અંદ્રપ્રભજિનેશ્વર સાહિ-આરે” સ્તવનને યાદ કરાવે તેવું આ સ્તવન છે.

* શ્રી મલ્લિનાથ ,, ,, ભવ-બ્રમણનો દૂંક ચિતાર રજી કર્યો છે.

* શ્રી મહાવીર ,, ,, પ્રભુ મહાવીર-પરમાત્મા પ્રતિ અદ્ભુત ભક્તિભાવ તેઓશ્રીના નિર્વાણ-કથાણકને કેન્દ્રમાં રાખી આ સ્તવનમાં રજી કરાયો છે.

વળી પૂ.શ્રી ગૌતમસ્વામીજી મ.
ના વિલાપનું સ્મરણ કરાવનાર
આ સ્તવન જણાય છે.

(૨૫) શ્રી ચતુરવિજયજી મ. કૃત સ્તવન-ચોવિશી.

છન્નસ્થ-આત્માઓને કર્મના આવરણથી ઉભી થયેલ સંસારી
વિકલતાને ખંખેરવા લક્ષિતભાવભર્યા શબ્દોની વ્યવસ્થિત-સંકલનાવાળી
આ ચોવિશી ખૂબજ ભાવવાહી છે.

આનાં વિશિષ્ટ સ્તવનો—

- * શ્રી અજિતનાથ પ્રભુ સ્તવન „ લાંછનનું અહ્ભુત રહસ્ય
- * શ્રી સુવિધિનાથ „ „ મનની ગતિ વિધિ અને તેના નિગ્ર-
હનું સ્વરૂપ.

(૩૬) શ્રી દેવચંદ્રજી મ. કૃત સ્તવન-ચોવિશી.

આધ્યાત્મિક-જગતના બે-તાજ બાદશાહ સમા શાસ્ત્રયોગી
સમર્થ વિદ્વાન અધ્યાત્મયોગીશ્રી શ્રી દેવચંદ્રજીમ.ની આ ચોવિશી

અત્યંત અહ્ભુત વિશિષ્ટ શૈલિએ સપ્તભંગી, સ્યાદવાદ,
પડદ્રવ્યવિચાર, નયવિચાર આદિદ્વારા

પરમાત્માના લોકોત્તર વિશિષ્ટ સ્વરૂપને ભવ્યજીવોના માનસમાં
ઉપજાવનાર છે.

એકંદરે આ ચોવીશી સ્તવન-સૃષ્ટિમાં અર્થ-ગાંભી-
ર્યની દૃષ્ટિએ બેનમૂન ઉત્તમ અઅપદ ધરાવનારી છે.

(૩૭) શ્રી દેવચંદ્રજીમ. કૃત અતીત-જિન સ્તવન-ચોવિશી.

વર્તમાન સ્તવન-ચોવિશી-જગતમાં જવલે જ મળી આવતી
અતીત ચોવિશી ના સ્તવનો વાળી આ ચોવિશી (જે કે કાલબળે
છેલ્લા ત્રણ સ્તવનો ન મલવાથી તુટક છે)

જેમાં નીચેનાં સ્તવનો ખૂબજ મહત્વનાં છે.

- * ૩ શ્રી સાગર પ્રભુ સ્તવન ,, દ્રવ્ય-પર્યાયની સૂક્ષ્મતમ વાતો-નો વિચાર.
 - * ૪ શ્રી મહાયશ ,, ,, આધ્યાત્મિક-ફાગ-હોરીનું વર્ણન.
 - * ૫ શ્રી વિમલનાથ ,, ,, દ્રવ્યશક્તિ અને પર્યાય સંબંધી ખૂબ અદ્ભુત વિવેચના.
 - * ૬ શ્રી સર્વાનુભૂતિ ,, ,, સંસારના પરિભ્રમણનો કાયા-સ્થિતિ ના માધ્યમથી વિચાર.
 - * ૮ શ્રી દત્તપ્રભુ ,, ,, પ્રભુ-ગુણ-ગાનના પ્રતાપે આંતરિક ગુણોના થતા વિકાસનું આધ્યાત્મિક ફાગરૂપે વર્ણન.
 - * ૧૦ શ્રી સુતેજ પ્રભુ ,, ,, ઉત્પાદ-વ્યય અને ધ્રુવતાનું સુંદર વર્ણન.
 - * ૧૪ શ્રી શિવગતિ ,, ,, પ્રભુની સેવાનો નય સાપેક્ષ વિચાર.
 - * ૧૯ શ્રી કૃતાર્થ ,, ,, અદ્ભુત ભક્તિયોગનું વર્ણન.
- (૩૮) શ્રી જીવજી વિજયજીમ. કૃત સ્તવન-ચોવિંશી.

વિવિધ ભાવ-ભર્યા શબ્દોમાં બાળજીવોના ભક્તિરસને પોષક ઉદાત્ત-શૈલિથી કર્તાએ આ ચોવિંશીમાં પાંચ કે સાત ગાથાના દૂંકા પ્રમાણનાં સ્તવનો દ્વારા શ્રી વીતરાગ-પરમાત્માના અપૂર્વ ભક્તિયોગનું ભાવોદ્ભાસવર્ધક વર્ણન કર્યું છે.

એકંદર આ ચોવિંશી ખૂબ જ ભાવવાહી છે.

(૩૯) શ્રી દાનવિજયજી મ. કૃત સ્તવન-ચોવિંશી.

આ ચોવિંશીની રચના લોક-પ્રચલિત ચાલુ પ્રસિદ્ધ દેશીઓમાં પાંચ ગાથાની મર્યાદામાં રહી વિવિધ ભાવ-ભંગી-ભર્યા શબ્દોવાળા સ્તવનોવાળી છે.

એકંદર આ ચોવિંશી સામાન્ય ભણેલાને પણ બોલવામાં સુગમ પડે તેવી દેશીઓવાળી વિલક્ષણ સુંદર છે.

(૪૦) શ્રી મેઘવિજયજી મ. કૃત સ્તવન-ચોવિશી.

પાંચ ગાથાના સ્તવનોની અનેલી આ ચોવિશીમાં તાત્ત્વિક શૈલિને સ્વરસવાહી બનાવી લક્ષિતરાગને ઉપજનવનાર ભાવ-ભંગીવાળી વિવિધ શબ્દ-રચનાને મુખ્યતા આપી છે.

જેનાં વિશિષ્ટ સ્તવનો—

- * શ્રી શ્રેયાંસનાથપ્રભુ સ્તવન „ વિશિષ્ટ લક્ષિતયોગનું વર્ણન
- * શ્રી અનંતનાથ „ „ સમવસરણમાં પ્રભુની દેશનાનું પ્રારંભિક ટુંક વર્ણન.
- * શ્રી મહાવીર „ „ આંતરિક નિખાલસ વિગતિ

(૪૩) શ્રી કેશરવિમલજી કૃત સ્તવન-ચોવિશી.

આ ચોવિશી વિવિધ રાગો-દેશીઓમાં આત્મગુણોનું યથાર્થ ભાન કરાવનારી પદ્ધતિએ બાળજીવોને ખૂબ ઉપયોગી નીવડે તેવી બનાવાઈ છે.

(૪૨) શ્રી કનકવિજયજી મ. કૃત સ્તવન-ચોવિશી.

વિવિધ મારવાડી પ્રાચીન દેશીઓમાં બનાવાયેલી આ ચોવિશી-નાં સ્તવનો.

જુના દેશી શબ્દોની પ્રચુરતાવાળાં અને પ્રાચીન વિશિષ્ટ છંદોમાં ગાથાઓની વિશિષ્ટ રચનાવાળાં છે.

જેનાં વિશિષ્ટ સ્તવનો—

- * શ્રી અભિનંદન જિન સ્તવન—અપૂર્વ લક્ષિતયોગની ઝલક-વાળા સુંદર શબ્દોવાળી રચના
- * શ્રી સુમતિનાથ „ „ „ „
- * શ્રી પદ્મપ્રભ „ „ — „ „
- * શ્રી વાસુપૂજ્ય „ „ —લક્ષિતયોગ ભરી અપૂર્વ વિનતિ

* શ્રી મહાવીર „ —શ્રી ગૌતમસ્વામીના
વિલાપ-વિરહગીતનું વર્ણન

૪૩ શ્રી રચિરવિમલજીમ. કૃત સ્તવન-ચોવિશી

પાંચ ગાથાની આ લઘુ-ચોવિશીમાં પ્રભુભક્તિનું પોષણ સરળ-
સુંદર શબ્દોમાં કરવા સાથે કર્તાએ પ્રાસાદિકતા અને ગંભીરતા ગુણને
વણી લેવા આદર્શ પ્રયાસ કર્યો છે.

૪૪ શ્રી મહિમાપલસૂરિમ. કૃત સ્તવન-ચોવિશી.

પૂર્ણિમા ગચ્છીય આચાર્યશ્રીએ માત્ર પાંચ ગાથાના પ્રમાણ-
વાળા સ્તવનોની આ ચોવિશીમાં જિનભક્તિના અદ્ભુત તત્ત્વને બાલ-
ભોગ્યશૈલિમાં વર્ણવ્યું છે.

જેના વિશિષ્ટ સ્તવનો

* શ્રી અજિતનાથ પ્રભુ સ્તવન—પ્રભુ સાથે થયેલી પ્રીતિની
અદ્ભુતતાનું વર્ણન.

* શ્રી સંલવનાથ „ —પ્રભુ સાથે થયેલ અંતર-
પ્રીતિનું વર્ણન.

* સુપાર્શ્વનાથ „ —પ્રભુજીના ચાર નિક્ષેપાનું
વર્ણન.

* શ્રી સુવિધિનાથ „ —અનુભવ રસની મહત્તા

* શ્રી શ્રેયાંસનાથ „ —અંતરંગ-મનમંદિરમાં પ્રભુ
પૂજનું રૂપક

* શ્રી વાસુપૂજ્યસ્વામી સ્તવન—ભવસમુદ્રનું વર્ણન.

* શ્રી વિમલનાથ જિન સ્તવન—વાસના-તત્ત્વના નિગ્રહની
મુખ્યતા.

- * શ્રી અરનાથ ,, ,, —પૂજાવિધિતું સ્વરૂપ... મહત્વ.
* શ્રી મહાવીર ,, ,, —ભારવાડી ભાષામાં અંતરંગ
 વિનંતિ.

४५ श्री कीर्तिविमलगाथी इत स्तवन-योविशी

માત્ર પાંચ ગાથાના અંધારણમાં ગુંથાએલી આ ચોવિંશી એકંદર આલજીવોને પ્રભુલક્ષિતમાં તન્મય કરે તેવી છે.

રચના, શબ્દશૈલિ, જોડણી બાલજીવોને પ્રભુભક્તિ તરફ આકર્ષનારી છે.

ઉપરાંત આ ચોવિંશીનાં ઘણા-સ્તવનોમાં કર્તાએ પ્રભુનું નામ, લંછન, જન્મનગરી, માતા, પિતા, શાસનદેવ, શાસનદેવી, આ સાત બોલને પણ ગૂંથવા પ્રયત્ન કર્યો છે.

आ चोविशीनां विशिष्ट स्तवना

- | | | | |
|-----------------|-------|--------|--|
| * શ્રી વિમલનાથ | પ્રભુ | સ્તવન— | વિમલ શબ્દનો જુદા જુદા અર્થમાં પ્રયોગ કરી અપૂર્વ ભક્તિરસની જન્માવટ. |
| * શ્રી ધર્મનાથ | ,, | ,, | —ક્રોધાદિ કષાયો ઉપર નિગ્રહ કરવારૂપે પ્રભુભક્તિનું વર્ણન |
| * શ્રી કુંથુનાથ | ,, | ,, | —વિવિધ દૃષ્ટાંતોથી જનભક્તિનું મહત્ત્વ. |
| * શ્રી મલિનાથ | ,, | ,, | —વિવિધ દૃષ્ટાંતોથી પ્રભુસેવાનું મહત્ત્વ. |

४६ श्री रतनविजयशुभ. कृत स्तवन-त्रयोविंशी.

अध्यात्म-प्रधान-शैलिथी कर्ताये आ योविशीमां आत्मानुबन्ना

રણકારવાળા શબ્દોની ખૂબ છૂટ રાખી ભાવિક-ભવ્યાત્માને પ્રભુભક્તિના માધ્યમથી અંતરમાં ડોકીયું કરવાની ઘણી તક આપી છે.

એકંદરે આ ચોવિશી ખૂબજ શબ્દસમૃદ્ધ અને અર્થ-ગંભીર હોઇ ખાસ મનનીય છે.

૪૭ શ્રી માણેકમુનિ કૃત સ્તવન ચોવીશી.

આ ચોવિશી બાળજીવોપયોગી સરળ શૈલિમાં માત્ર પાંચ ગાથાના પ્રમાણવાળા સ્તવનો રૂપે વિશદ રીતે અંતરંગ ભક્તિભાવને વ્યક્ત કરનારી હોઇ ખૂબ જ ભાવવાહી છે.

૪૮ શ્રી દીપવિજયજીમ. કૃત સ્તવન ચોવીશી.

માત્ર પાંચ ગાથાવાળાં સ્તવનોની આ ચોવિશીમાં કર્તાએ ભક્તિ-ગુણગાન સાથે શ્રી તીર્થંકર પરમાત્માના નીચે મુજબના ૧૦ બોલોનો પણ ગુંથવા આદર્શ પ્રયત્ન કર્યો છે.

- | | |
|---------------------|--------------------|
| * પૂર્વભવનામ | * જન્મ રાશિ |
| * પૂર્વભવ દેવલોકનામ | * જન્મ ગણ. |
| * નામ | * છઠ્ઠાસ્થ કાલમાન. |
| * જન્મનગરી | * કેવલજ્ઞાન વૃક્ષ. |
| * જન્મનક્ષત્ર | * નિર્વાણિ પરિવાર. |

૪૯ શ્રી ધર્મકીર્તિગણી કૃત સ્તવન-ચોવિશી.

અત્યંત જીની દેશીભાષામાં સળંગ ૯૨ ગાથામાં બનાવાયેલ આ ચોવિશી ભાષાદૃષ્ટિએ અદ્ભુત છે

આ ચોવિશીમાં શ્રી તીર્થંકર પરમાત્માના ગુણોની સ્તવન સાથે નીચે મુજબના ૨૪ બોલો પણ ગુંથ્યા છે.

૧ પૂર્વભવ સ્થાન.	૧૩ દીક્ષા તપ.
૨ જન્મનગરી.	૧૪ પારણા સ્થાન.
૩ માતા.	૧૫ કેવળજ્ઞાન.
૪ પિતા.	૧૬ „ વૃક્ષ.
૫ જન્મનક્ષત્ર.	૧૭ ગણધર સંખ્યા.
૬ શરીર ઉચ્ચાર્થ.	૧૮ સાધુ „
૭ લંછન.	૧૯ સાધ્વી „
૮ રાશિ	૨૦ શ્રાવક „
૯ આયુષ્ય.	૨૧ શ્રાવિકા „
૧૦ શરીરવર્ણ.	૨૨ શાસનદેવ.
૧૧ દીક્ષા.	૨૩ શાસનદેવી.
૧૨ અંતર.	૨૪ સિદ્ધિ સ્થાન.

૫૦ શ્રી સ્વરૂપચંદ્રજીમ. કૃત સ્તવન-ચોવિશી.

લકિતરસમાં તરખોળ કરનારી સુંદરશૈલિમાં રચાયેલ આ ચોવિશીમાં ઘણા સ્તવનો વિશિષ્ટ ભાવવાહી છે. ખાસ કરીને—

- * શ્રી અભિનંદન પ્રભુનું—શ્રી અનંતનાથ પ્રભુનું
- * શ્રી ધર્મનાથ પ્રભુનું —શ્રી શાંતિનાથ પ્રભુનું
- * શ્રી અરનાથ પ્રભુનું —શ્રી મહાવીર પ્રભુનું સ્તવન ખૂબજ અર્થગંભીર છે.

૫૧ શ્રી જશવિજયજીમ. કૃત સ્તવન-ચોવિશી

કાળખળે આ ચોવિશી ત્રુટક મળી છે.

શરૂઆતના ૬ સ્તવનો નથી મળ્યા, છતાં જે મળ્યા છે તે ખૂબ સરસ સુંદર ભાવવાહી-શૈલિમાં રચાયેલ છે.

આખી ચોવિશી ભવ્ય ભાવ-ભરપૂર અર્થ-ગંભીર ઉદાત્ત-શૈલિમાં રચાયેલી છે.

જેના વિશિષ્ટ સ્તવનો—

- * શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન—આંતરિક ભાવ-ભક્તિભર્યા ઉપાસના.
- * શ્રી સુવિધિનાથ „ „ અંતરંગ ભવ-પ્રપંચનું વર્ણન.
- * શ્રી શીતળનાથ „ „ પ્રભુ-દર્શનના ઉલ્લાસનું વર્ણન.
- * શ્રી શ્રેયાંસનાથ „ „ અંતરંગ-પાપોની આલોચના.
- * શ્રી વાસુપૂજ્યસ્વામી „ વિરોધોક્તિ-અલંકારથી પ્રભુનું વર્ણન.
- * શ્રી વિમલનાથ „ „ વિમલ શબ્દની વિવિધ રીતે ગુંથણી.
- * શ્રી ધર્મનાથ „ „ આઠ કર્મના સ્વરૂપનું વર્ણન.
- * શ્રી મલિનાથ „ „ પ્રભુ-સેવા અને પ્રભુ-દર્શનની વિશિષ્ટ મહત્તા.
- * શ્રી મહાવીર „ „ અંતરંગ ભાવભરી નમ્ર વિશ્વપ્રિતિ.

(૫૨) શ્રી જ્ઞાનવિમલસૂરિમ. કૃત સ્તવન-ચોવિંશી.

પૂ. અધ્યાત્મયોગી આચાર્યદેવશ્રીની આ અપૂર્વ વિશિષ્ટ કૃતિ. ૩૫ ચોવિંશી કાળ-બળે અધુરી મળી છે.

આમાં ૪, ૬, ૭, ૮, ૧૨ માં પ્રભુનું સ્તવન નથી મળ્યું, છતાં ચોવિંશી ખૂબ જ અધ્યાત્મ-ધ્યાન-યોગના ભાવથી ભરપૂર પ્રભુ-ભક્તિના ઉદ્દાત્તતત્ત્વનું પોષણ કરનારી છે.

જેનાં વિશિષ્ટ સ્તવનો—

- * શ્રી આદીધર જિનસ્તવન—સમ્યગ્ દર્શનનો મહિમા.
- * શ્રી સંભવનાથ „ „ આત્મગર્હા રૂપે અંતર નિવેદન.
- * ચંદ્રપ્રભ „ „ પ્રભુ દર્શન પ્રાપ્તિનો મહિમા.
- * શ્રી શ્રેયાંસનાથ „ „ પ્રભુજીના મુખને સૂર્ય-ચંદ્રની અદ્ભુત વિશિષ્ટ ઉપમા સંગતિ.

* શ્રી શાંતિનાથ ,, ,, અપૂર્વ લકિત ભાવભરી વિનંતિ.

(૫.) શ્રી ગુણવિલાસશ્રુમ. કૃત સ્તવન-ચોવીશી.

માત્ર ત્રણ ગાથાના સ્તવનોની આ ચોવિશી અધ્યાત્મ, લકિત, શરણાગતિ, આદિ પદાર્થો વિવિધ ભાવભંગી ભરી, વિશિષ્ટ રચના શૈલિમાં ગુંથાયેલ છે.

જેનાં વિશિષ્ટ સ્તવનો—

* શ્રી ઋષભદેવ જિન સ્તવન— શરણાગતિ ભાવ.

* શ્રી અજિતનાથ ,, ,, ,,

* શ્રી સંભવનાથ ,, ,, પ્રભુ નામની મહત્તા.

* શ્રી સુપાર્શ્વનાથ ,, ,, અંતરંગ ભાવ—લકિત.

* શ્રી ત્રયાંસનાથ ,, ,, ભાવલકિતભરી પ્રાર્થના.

* શ્રી નમિનાથ ,, ,, આજીજી—ભર્યું અંતર—નિવેદન.

* શ્રી પાર્શ્વનાથ ,, ,, ભાવલકિતભરી ભવ્ય પ્રાર્થના.

(૫૪) શ્રી જગજીવનજી કૃત સ્તવન-ચોવિશી.

પૌરખંદર અને દીવખંદરમાં અદ્ભુત ભાવભરી શૈલિમાં રચાયેલી આ ચોવિશીમાં ઘણા શાસ્ત્રીય શબ્દોની ફૂલ-ગુંથણી છે.

લગભગ દરેક સ્તવનો કંઈ ને કંઈ અવનવી વિશિષ્ટતા ધરાવે છે.

(૫૫) ૫. શ્રી જિનહર્ષજી કૃત સ્તવન ચોવિશી.

વિવિધ શાસ્ત્રીય-રાગોમાં ગુંથાયેલી માત્ર ત્રણ ગાથાના સ્તવનોની આ ચોવિશી પ્રભુલકિતના આદર્શભાવને વિવિધ માર્મિક રચનાથી વ્યક્ત કરવા સાથે તદ્દનુરૂપ પસંદ કરાયેલ લલિત, કેદારો, કલ્યાણ, ટોડી, વસંત, જયંતાસિરી આદિ વિશિષ્ટ કક્ષાના રાગ-રાગણી-ઓના સુખદ અક્ષરદેહની અપૂર્વ વિલક્ષણતાથી સુસ વિદગ્ધજનોના મનને આકર્ષનારી છે.

પદ પૂ. ઉપા. શ્રી યશોવિજયજીમ. કૃત સ્તવન-ચોવીશી તાત્ત્વિક પ્રકાંડવિદ્વાન પૂ. ઉપાધ્યાયજીએ સરળ બાળભોગ્ય-શૈલિમાં વહેવડાવેલ ગૂર્જરભાષાના ધોધબદ્ધ પ્રવાહમાંથી જડી આવેલ આ ચોથી ચોવિશી કાળબળે ૧૨, ૧૩, ૧૪, ૨૧ મા પ્રભુના સ્તવન વિનાની ભાવ, અર્થગાંભીર્ય; ઉદાત્ત. રચના, વિશિષ્ટ અર્થો આદિથી મહત્ત્વની હોઈ અહીં રજુ કરી છે.

જેનાં વિશિષ્ટ સ્તવનો

- * શ્રી ઋષભદેવ પ્રભુ સ્તવન—અદ્ભુત લોકોત્તર-ભાવભરી પ્રાર્થના.
- * શ્રી સંભવનાથ „ „ —પ્રભુદર્શનનો મહિમા અને ભવ્ય ઉલ્લાસ.
- * શ્રી અભિનંદન „ „ —પ્રભુજીના કૃષ્ણાગુનેત્રોની ભવ્ય અદ્ભુત ઘટના.
- * શ્રી પદ્મપ્રભ „ „ —પ્રભુજીના ધ્યાનનો અદ્ભુત પ્રભાવ.
- * શ્રી સુપાર્થનાથ „ „ —પ્રભુ સાથે પ્રીતિનું અદ્ભુત સ્વરૂપ.
- * શ્રી સુવિધિનાથ „ „ —પ્રભુ સાથે અંતરંગ પ્રેમનું નિદર્શન.
- * શ્રી શીતલનાથ „ „ —શીતળતાનું અદ્ભુત વર્ણન.
- * શ્રી શાંતિનાથ „ „ —પ્રભુના ધ્યાનની મન્નતાનું સુંદર વર્ણન.
- * શ્રી મુનિસુવ્રતજી „ „ —આત્મતત્ત્વના સ્વરૂપનું અદ્ભુત વર્ણન.
- * શ્રી પાર્થનાથ „ „ —સેવાભક્તિના આદર્શપ્રકારનું વર્ણન.

* શ્રી મહાવીર „ „ — પ્રભુ જીવનનું દ્રંકુ સુંદર વર્ણન
પૃ ૭ અને ૬૦ સંપાદક સંકલિત ચોવિશી.

સ્તવન ચોવિશીના સંપાદનના કાર્યક્ષેત્રમાં વિચરતાં ભિન્ન ભિન્ન
કર્તાઓનાં છૂટક સ્તવનો ઘણાં સુંદર મળી આવ્યાં, તે બધાને તીર્થંકર
પ્રભુઓના ક્રમ પ્રમાણે ગોઠવી આ ચોવિશીનું સંકલન સંપાદકે
લકિતલાવના ઉમળકાથી કર્યું છે.

જેમાં લગભગ બધા સ્તવનો હૃદયંગમ અંતરની ઉર્મિને ઉલ્લાસ
આપનારાં ખૂબ જ લાવવાહી છે.

એકેક તીર્થંકર પરમાત્માના (પાછળની ચોવિશીમાંથી પણ ઉદ્ધૃત)
એકથી વધુ સ્તવનો ઉપયોગી સમજી કરી ઉદ્ધૃત કર્યા છે.

૫૮-૫૯ પૂ. શ્રી જ્ઞાનવિમલસૂરિજી મ. કૃત સાધારણ
જિન સ્તવન ચોવિશી
(સંપાદક સંકલિત)

પૂ. સમર્થ શાસ્ત્રયોગી અધ્યાત્મી શ્રીજ્ઞાનવિમલસૂરિજી

મ. શ્રીએ ઢગલાબંધ અનેક સ્તવનો વિશિષ્ટ નામ નિર્દેશ
વિના સામાન્યથી ગમે તે તીર્થંકર પ્રભુ આગળ બોલી શકાય તેવા
શ્રી તીર્થંકર પરમાત્માના વિશિષ્ટ અત્યહલુત એકાદ ગુણની સાપેક્ષ
મહત્તા જણાવનારાં બનાવ્યાં છે.

તેવાં સ્તવનો અનેક પુસ્તકોમાંથી ભેગાં કરી સંપાદકે આ
ચોવિશીની સંકલના કરી છે.

એકંદરે આ ચોવિશીના લગભગ બધા જ સ્તવનો ખૂબ જ
લાવવાહી, ઉપયોગી અને આંતરિક લાવસ્યદૃષ્ટિમાં થનગનાટ ઉપજાવ-
નારાં છે.

અનુપૂર્તિ

(સંપાદકીય)

(અ) પ્રસ્તુત પુસ્તકના પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં જણાવ્યા પ્રમાણે બધા ચોવિંશીકારોનો ઐતિહાસિક પરિચય લખીને તૈયાર કરેલ, પણ વિષય-સામગ્રી ઘણી વધી જવાથી તેનું સ્વતંત્ર પુસ્તક “ભક્તિગુંજન” નામથી તૈયાર કર્યું છે, પ્રસ્તુત પુસ્તકમાં તે લખાણ ઉમેરવા વિચાર હતો, પણ લખાણ ઘણું મોટું હોઈ તે છપાવવામાં સુધી આપું પુસ્તક રોકાઈ રહે, તેથી તેનું સ્વતંત્ર પુસ્તક રાખ્યું છે.

જિજ્ઞાસુઓએ તે ભક્તિગુંજન પુસ્તક જરૂરી ધાંચી-વિચારી ચોવિંશીઓના રચયિતા મહાપુરૂષોના વ્યવસ્થિત પરિચય મેળવવા ધ્યાન રાખવું.

(આ) વળી આ સંગ્રહમાં પ્રથમ તપાગચ્છની ચોવિંશીઓ લઈ પછી અન્ય ગચ્છની ચોવિંશીઓ લેવા વિચારતે હતો, પણ પ્રતો મેળવવાની કેટલીક મુશ્કેલી આદિ કારણથી તે કમ જળનાયો નથી.

એટલે પ્રસ્તુત ચોવિંશી-સંગ્રહમાંની ચોવિંશીઓમાં નીચેની ચોવિંશીઓ આવશ્યકક્રિયા (પ્રતિક્રમણ, દહેરાસર ચૈત્યવંદન)માં ન બોલી શકાય તેવા સ્પષ્ટ ખ્યાલ આપવા જરૂરી માની નીચેની નોંધ તૈયાર કરી છે.

આવશ્યક-ક્રિયામાં ઉપયોગી ન લાગે તેવી
ચોવિંશીઓની નોંધ

પ્રથમ ભાગ

(૧) શ્રી આણંદવર્દનજી મ.

૧૩૯ થી ૧૪૫

(૨) શ્રી હરખચંદ્રજી મ.

૨૬૭ થી ૩૧૪

સ્ત. ચો. ૩

(૩) શ્રી ભાણુચંદ્રજી મ.	દ્વિતીય ભાગ	૨૪ થી ૪૮
(૪) શ્રી ખુશાલમુનિજી		૪૯ થી ૬૩
(૫) શ્રી દેવચંદ્રજી મ.		૬૭ થી ૧૫૫
(૬) શ્રી ભાવપ્રભસૂરિજી મ.		૩૧૬ થી ૩૩૯
(૭) શ્રી ધર્મકીર્તિગણી		૪૪૧ થી ૪૬૮
(૮) શ્રી સ્વરૂપચંદ્રજી		૪૬૯ થી ૫૦૦
(૯) શ્રી ગુણવિલાસજી		૫૪૯ થી ૫૬૪
(૧૦) શ્રી જિનહર્ષજી		૫૪૬ થી ૬૧૧

(૬) એક બીજી વાત ખાસ 'મહત્ત્વની નોંધ' છું કે પ્રસ્તુત સંગ્રહના પ્રથમભાગ (પાન ૭૧૬ થી ૭૩૨) માં પૂ. શ્રી કીર્તિ-વિમલજી મ. ની ચોવિંશી છપાઈ છે.

તેમ છતાં આ બીજા વિભાગમાં પણ પૂ. શ્રી કીર્તિવિમલજી મ.ની ચોવિંશી (પા. ૩૪૦ થી ૩૬૧) પુનર્મુદ્રિત કરી છે, તેનું કારણ એ છે કે—

પ્રથમ ભાગમાં તે ચોવીંશી છાપ્યા પછી પ્રાચીન હ. લિ. પ્રતો મળી આવી તેના આધારે પાઠભેદો સારા મત્યા જેથી તે સુધારેલી ચોવિંશી પુનર્મુદ્રિત કરી છે.

વળી ચોવીંશમું સ્તવન પ્રાચીન પ્રતમાંથી નવું જ મળી આવ્યું તે બીજા વિભાગમાં છાપ્યું છે.

માત્ર ચોવિંશી એક છતાં બે વાર કેમ છાપી ? તે પ્રશ્ન સહેજે થાય તેમ છે. તેથી આ ખુલાસો કર્યો છે.

પ્રસ્તુત સંપાદનમાં અનેક સહયોગી પુણ્યાત્માઓનો સહકાર સાંપડ્યો છે. જેમાં ખાસ કરીને મુનિશ્રી નિરૂપમસાગરજી ગણી, મુનિશ્રી રવીન્દ્રસાગરજી મ., મુનિશ્રી હેમચંદ્રસાગરજી મ., મુનિશ્રી પુણ્ય શેખર-સાગરજી મ. આદિના ધર્મપ્રેમભર્યા સહકારની વિશિષ્ટ નોંધ સાથે પ્રમોદલાવે વ્યક્ત કરું છું.

છેવટે પ્રસ્તુત સંપાદનમાં યથામતિ શક્ય-સાધનોના આધારે વ્યવસ્થિત અને શુદ્ધ પાઠ અર્થો (ટિપ્પણ) આપવામાં દેવગુરુકૃપાએ સફળ પ્રયત્ન કરવા છતાં મતિદોષ કે મુદ્રણ-દોષથી જિન-શાસનની મર્યાદા વિરુદ્ધ, શાસ્ત્રીય-શૈલી કે પરંપરા વિરુદ્ધ અગર મૂળ કર્તાના આશય વિરુદ્ધ જે કાંઈ થયું કે લખાયું હોય તે બદલ સદલ શ્રી સંઘ સમક્ષ મિથ્યાદુષ્કૃત નિખાલસપણે દર્ઠ પુણ્યવાન આત્માઓ આ ચોવિશીઓને અંતરની ભાવવૃદ્ધિથી ઉપયોગમાં લઈ સ્વ-પર કલ્યાણકારી જીવન બનાવે એ મંગલ કામના.

વિ૦ સં૦ ૨૦૩૬

નિવેદક

વીર નિ૦ સં૦ ૨૫૦૬

પ્રથમ જોડ સુ. ૧૩

પૂ. તપસ્વી શાસન શુભટ

જૈન ઉપાશ્રય,

સ્વ. ઉપા. શ્રી ધર્મસાગરજીગણી

ઉંઝા,

ચરણોપાસક

જી. મહેસાણા

શ્રમણસંઘસેવક,

અભયસાગર

પરમાત્માની લક્ષિતો પ્રભાવ

વીતરાગ પરમાત્માની લક્ષિત એટલે અંતરની ઝણ-ઝણાટી સાથે વીતરાગ-પ્રભુ સમક્ષ ગુણોનો એકરાર !

તેનાથી આપણી કર્માધીન વિષમતાઓથી ઉપજેલી કાયરતા હટવા માંડે અને અંતરાત્માની વિરાટ શક્તિઓના વહેતા ધોધની જાણકારી મળે !

પરિણામે કર્મના બોજ તળે લદાયેલ આપણા જીવનને આત્મશુદ્ધિ ઓના વિકાસના પંથે વાળી શકીએ !!!

ભક્તિરસ-કરણી
(ભાગ-૨)
અનુક્રમ સિંકા

સં.	વ્યોવિશી ક્રમાંક	કર્તા	પૃષ્ઠ
૧	૩૨	શ્રી પ્રમોદસાગરજી	૧ થી ૨૩
૨	૩૩	શ્રી ભાણુચંદ્રજી	૨૪ થી ૪૮
૩	૩૪	શ્રી ખુશ્હાલમુનિજી	૪૯ થી ૬૩
૪	૩૫	શ્રી ચતુરવિજયજી	૬૪ થી ૯૬
૫	૩૬	શ્રી દેવચંદ્રજી	૯૬ થી ૧૨૯
૬	૩૭	શ્રી દેવચંદ્રજી	૧૩૦ થી ૧૫૫
૭	૩૮	શ્રી જીવણવિજયજી	૧૫૬ થી ૧૬૮
૮	૩૯	શ્રી દાનવિજયજી	૧૬૯ થી ૨૦૨
૯	૪૦	શ્રી મેઘવિજયજી	૨૦૩ થી ૨૨૪
૧૦	૪૧	શ્રી કેસરવિમલજી	૨૨૬ થી ૨૫૦
૧૧	૪૨	શ્રી કનકવિજયજી	૨૫૧ થી ૨૭૯
૧૨	૪૩	શ્રી રૂચિરવિમલજી	૨૮૦ થી ૩૧૫
૧૩	૪૪	શ્રી ભાવપ્રભસૂરિ	૩૧૬ થી ૩૩૯
૧૪	૪૫	શ્રી કીર્તિવિમલ	૩૪૦ થી ૩૬૧
૧૫	૪૬	શ્રી રતનવિજયજી	૩૬૨ થી ૩૯૦

સં.	ચોવિશી ક્રમાંક	કર્તા	પૃષ્ઠ
૧૬	૪૭	શ્રી માણેકમુનિ	૩૯૧ થી ૪૧૫
૧૭	૪૮	શ્રી દીપવિજયજી	૪૧૬ થી ૪૪૦
૧૮	૪૯	શ્રી ધર્મકીર્તિગણિ	૪૪૧ થી ૪૬૮
૧૯	૫૦	શ્રી સ્વરૂપચંદ્રજી	૪૬૯ થી ૫૦૦
૨૦	૫૧	શ્રી જશવિજયજી	૫૦૧ થી ૫૨૪
૨૧	૫૨	શ્રી જ્ઞાનવિમલસૂરીજી	૫૨૫ થી ૫૪૮
૨૨	૫૩	શ્રી ગુણવિલાસજી	૫૪૯ થી ૫૬૪
૨૩	૫૪	શ્રી જગજીવનજી	૫૬૫ થી ૫૯૫
૨૪	૫૫	શ્રી જિનહર્ષજી	૫૯૬ થી ૬૧૧
૨૫	૫૬	શ્રી યશોવિજયજી	૬૧૨ થી ૬૩૨
૨૬	૫૭	સંપાદક સંકલિત	૬૩૩ થી ૭૧૦
૨૭	૫૮	શ્રી જ્ઞાનવિમલસૂરિજી	૭૧૧ થી ૭૩૫
૨૮	૫૯	શ્રી જ્ઞાનવિમલસૂરિજી	૭૩૬ થી ૭૫૬
૨૯	૬૦	સંપાદક સંકલિત	૭૫૭ થી ૭૬૪



શ્રી મહાવીર પ્રભુ સ્તુતિ

ઉપશમ-રસમાં મગ્ન સદા જે, પ્રસન્નદષ્ટિ સદા;
વિકસિત-કમલ-સમ જસ વદન, સ્ત્રીસંગ નદિન કદા.
અહો ! કરયુગલ તે પણુ જસ, શસ્ત્રાદિકે વર્જિત;
શ્રી મહાવીર સત્ય હી તું દેવ, રાગદ્વેષનિર્ગત.

વિવિધ અર્થજાલીર
પ્રાચીન સ્તવન-ચોવિશીઓના
કર્તાઓની અકારાદિકમથી નામાવલી

ક્રમાંક	કર્તા નામ	ચોવિશી નંબર
૧	શ્રી અમૃતવિજયજી મ.	૩૧
૨	શ્રી આનંદધનજી મ.	૨
૩	શ્રી આનંદવર્ધનજી મ.	૬
૪	શ્રી ઉદયરતનજી મ.	૧૫
૫	શ્રી ઋષભસાગરજી મ.	૧૪
૬	શ્રી કનકવિજયજી મ.	૪૨
૭	શ્રી કીર્તિવિજયજી મ.	૨૨
૮	શ્રી કીર્તિવિજયજી મ.	૪૫
૯	શ્રી કીર્તિવિમલજી મ.	૨૮
૧૦	શ્રી કેશરવિજયજી મ.	૪૧
૧૧	શ્રી ખુશાલમુનિજી મ.	૩૪
૧૨	શ્રી ગુણવિલાસજી મ.	૫૩
૧૩	શ્રી ચતુરવિજયજી મ.	૩૫
૧૪	શ્રી જગજીવનજી મ.	૫૪
૧૫	શ્રી જશવિજયજી મ.	૫૧
૧૬	શ્રી જિનવિજયજી મ.	૧૬
૧૭	” ” ”	૧૭
૧૮	શ્રી જિનહર્ષજી મ.	૫૫
૧૯	શ્રી જીવણવિજયજી મ.	૩૮
૨૦	શ્રી દાનવિજયજી મ.	૩૯

ક્રમાંક

કર્તા નામ

ચોવીશી નંબર

૨૧	શ્રી દાનવિમલજી મ.	૨૯
૨૨	શ્રી દીપવિજયજી મ.	૪૮
૨૩	શ્રી દેવચંદ્રજી મ.	૩૬
૨૪	” ”	૩૭
૨૫	શ્રી ધર્મકીર્તિગણિજી મ.	૪૯
૨૬	શ્રી નયવિજયજી મ.	૧૩
૨૭	શ્રી ન્યાયસાગરજી મ.	૨૩
૨૮	” ” ”	૨૪
૨૯	શ્રી પદ્મવિજયજી મ.	૨૫
૩૦	” ” ”	૨૬
૩૧	શ્રી પ્રમોદસાગરજી મ.	૩૨
૩૨	શ્રી ભાણુચંદ્રજી મ.	૩૩
૩૩	શ્રી ભાણુવિજયજી મ.	૫
૩૪	શ્રી ભાવવિજયજી મ.	૧૦
૩૫	શ્રી મહિમાપ્રભસૂરિજી મ.	૪૫
૩૬	શ્રી માનવિજયજી મ.	૮
૩૭	શ્રી માણેકમુનિજી મ.	૪૭
૩૮	શ્રી મેઘવિજયજી મ.	૪૦
૩૯	શ્રી મોહનવિજયજી મ.	૧૯
૪૦	શ્રી યશોવિજયજી મ.	૨
૪૧	” ” ”	૩
૪૨	” ” ”	૪
૪૩	” ” ”	૫૬
૪૪	શ્રી રતનવિજયજી મ.	૪૬

ક્રમાંક

કર્તા નામ

ચોવીશી નંબર

૪૫	શ્રી રામવિજયજી મ.	૨૦
૪૬	” ” ”	૨૧
૪૭	શ્રી રૂચિરવિમલજી મ.	૭
૪૮	શ્રી લક્ષ્મીવિમલજી મ.	૨૭
૪૯	શ્રી વિજયલક્ષ્મીસૂરિજી મ.	૨૭
૫૦	શ્રી વિનયવિજયજી મ.	૧૧
૫૧	શ્રી વિનીતવિજયજી મ.	૩૦
૫૨	શ્રી સ્વરૂપચંદ્રજી મ.	૫૦
૫૩	સંપાદક સંકલિત	૫૭
૫૪	” ”	૬૦
૫૫	શ્રી હરખચંદ્રજી મ.	૧૨
૫૬	શ્રી હંસરતનજી મ.	૧૮
૫૭	શ્રી જ્ઞાનવિમલસૂરિજી મ.	૯
૫૮	” ” ”	૫૨
૫૯	” ” ”	૫૮
૬૦	” ” ”	૫૯



અંતરંગ-પ્રાર્થના

કરુણા સાગર હે વીતરાગ
 માંગું એક જ તારી કને !
 ભવોભવ તાહરું શરણુ હોજો !
 ભવ સાગરથી તારો મને !

શ્રી વર્ધ્ધમાન-સ્વામિને નમઃ
 શ્રી પ્રમોદસાગરજી કૃત
 ૧૩ જ્યોત્ ગર્ભિત
 સ્તવન-ચોવીસી

(૭૪૫) (૩૨-૧) ઋષભદેવ જિન સ્તવન.

(ત્રેયાંસ જિનવર વંદીયે રે લો-એ દેશી)

પ્રથમ^૧ જિનેશ્વર પૂજ્યે રે લો,

પૂજ્યે પાપ પલાય રે; રંગીલાં

વૃષભ^૨ લાંછન પદ શોભતું રે લો,

કંચન^૩ વરણી કાય રે, રંગીલાં પ્રથમ૦ ૧

શુભવિનીતા^૪ નગરી-પતિ રે લો,

નાભિ^૫ નૃપતિ જસ તાત રે; રંગીલાં

પાંચસે^૬ કામુક^૧ દેહતું રે લો,

માન કહ્યું વિખ્યાત રે, રંગીલાં પ્રથમ૦ ૨

પાળ્યું^૭ પૂરણ આઉખું^૮ રે લો,

પૂર્વ ચોરાશી લાખ રે; રંગીલાં

૧ ધનુષ,

અતુર ચોરાશી ગણધરા^૧ રે લો,
 એહ સિદ્ધાંતની સાખ રે, રંગીલાં પ્રથમં ૩
 સોહો તીન લાખ સાધવી^૨ રે લો,
 સહસ ચોરાસી મુણિંદ^{૧૦} રે; રંગીલાં
 ગોમુખ^{૧૧} જક્ષ ચક્રેશ્વરી^{૧૨} રે લો,
 જિનશાસન આણુંદ રે, રંગીલાં પ્રથમં ૪
 વંશ ઈક્ષાગ વખાણીયે રે લો,
 મરૂદેવી^{૧૩} જસ માય રે; રંગીલાં
 ઋષભ જિનેશ્વર સેવતાં રે લો,
 પ્રમોદસાગર સુખ થાય રે, રંગીલાં પ્રથમં ૫

★

(૭૪૬) (૩૨-૨) શ્રીઅજિતનાથજિન સ્તવન
 (રતનચંદ્રકે બાગ આંખો મોરી રહ્યોરો—એ દેશી)
 વંદું અજિતજિણુંદ^૧ મૂરતિ અવલર બનીરી,
 આંખો છું પ્રભુ પાસ, તારક ખિરૂદ સુણીરી
 જિતશત્રુનૃપબત,^૨ વિજયામાત^૩ લલીરી,
 ગજ^૪ લંછન અભિરામ, દેખી આશ ફળીરી ॥૧॥
 નગરી અયોધ્યા^૫ સ્વામી, કાયા કનક^૬ જિસીરી,
 સેવકને એકવાર, દેખો નયન હસીરી
 પૂરવ^૭ બહોતેર લાખ, જીવિત જસ સુણુરી,
 સાઠા^૮ ચ્યારશે ચાપર દેહનું માન લાણુરી ॥૨॥

૧ શ્રેષ્ઠ, ૨ ધનુષ્ય

ઝરણાં

સ્તવન ચોવીશી

પંચાણુ^૧ ગણધાર, દીપે દેવ જિસારી,
વાચંજમર એક^{૧૦} લાખ, માહરે હૃદય વસ્યારી
મહાજક્ષ^{૧૧} મહિમાવંત, અજિતા^{૧૨} નામે સુરીરી,
પૂજે પ્રભુના પાય, અહનિશ પ્રેમ ધરીરી ॥૩૥
સાહુણી^{૧૩} ત્રણ લાખ, સાચી શીયલવતીરી,
ઊપર વીશ હબર, હોજો તાસ નતિરીર
વળગ્યો છું પ્રભુ પાય, કીજે સોહ ચડેરી;
બાંદ્ય ગ્રહ્યાની લાજ, એ છે રીત વડેરી ॥૪૥
પંચમકાળે નાથ પામ્યો, પુણ્ય ભરેરી, ૩
પંચમી-ગતિ દાતાર, પંચમ-જ્ઞાનધરેરી
અમોહસાગર નમે પાય, વારંવાર લળીરી,
નિર્મલ સમકિત શુદ્ધિ, તુજથી થાય ભલીરી ॥૫૥



(૭૪૭) (૩૨-૩) શ્રીસંભવનાથ-જિન સ્તવન
(કીસકે બે ચેલે ને કીસકે બે પૂત—એ દેશી)
સંભવ^૧ જિનવર ત્રીજો દેવ, ત્રિવિધે પ્રણમું નિતમેવ
સાહિબ સુંદર
સાવશ્ચીનગરી^૨ સુલતાન, ૪ ચમકે દેહી પચંપકવાન^૩—
સાહિબ ॥૧૥
ભૂપ અતારિકે^૪ તનુજત, સેના^૫ રાણી છે જસ માત; સાં
હય^૬ લંછન લાગત જિન પાય, નામે દોહગ દારિદ્ર જાય
સાં ॥૨૥

૧ સાધુ, ૨ વંદના, ૩ સમૂહથી, ૪ રાજા, ૫ ચંપકના ફૂલ જેવી પીળી

આયુ^૭ પૂરવ ષષ્ટિલક્ષ, સેવે પદ યુગ ત્રિમુખ^૮ જક્ષ; સાં
 દુરિતારિ^૯ દેવી ગુણુ ધામ, દૂર કરી સવિ દુષ્કૃત નામ સાં ૩.
 ઉંચપણે^{૧૦} ધનુષ શત ચ્યાર, એક^{૧૧} શત ઉપર દો ગણુધાર;
 મુનિવર^{૧૨}જે લખ જસ ઉદાર, સાધવી^{૧૩}લખ ત્રિ છત્રીશ
 હજાર સાં ૪

અ-કલ સરૂપી એહ અનંત, વંદો ભવિકા એ ભગવંત; સાં
 પ્રમોદસાગર પ્રભુ ચરણે લીન, જિમ જલનિરતિ પામિ મીન
 સાં ૫

કૃત

(૭૪૮) (૩૨-૪) શ્રીઅભિનંદન જિન સ્તવના

(સુમતી સદા દિલમાં ધરે-એ દેશી)

અભિનંદન^૧ અવધારીયે, વિનતડી એક વાર સલૂણે
 ભાગ્યદશાએ ભેટીઓ, તું ત્રિભોવન આધાર-સં૦૧
 રિદ્ધિભરી વિનીતાપુરી^૨, સોહ સંવર^૩ ભૂપ; સલૂણે
 રમણી જસ સિદ્ધારથ^૪, રાજે રંભા રૂપ-સં૦૨.
 સારથ તીણુશત^૧ જેહનું, ઉંચું^૫ તનુ ધનુ માન; સં૦
 પ્લવગર લાંછન^૬ ચરણે ભલું, દેહી^૭ કુંદનવાનડ; સં૦૩
 પૂરવ પંચાસ લાખ હે, જીવિત^૮ જિન પ્રમાણુ, સલૂણે
 એક શત ષોડશ ગણુધર^૯, ત્રિણુલાખ સાધુ^{૧૦} સુબાણુ-સં૦૪
 જક્ષ નાયક^{૧૧} નામે કાળિકા^{૧૨}, સાધવી^{૧૩} ખટ લખ સાર; સં૦
 ત્રીશ સહસ્ર ઉપરે વળી, પ્રમોદસાગર સુખ્યકાર-સં૦૫

૧ સાદા ત્રણસો, ૨ વાંદાનું, ૩ સોના જેવી.

(૭૪૯) (૩૨-૫) શ્રી સુમતિનાથજિન સ્તવન
(મહારી સહીરે સમાણી—એ દેશી)

સુમતિ^૧ જિનેશ્વર સેવા સારી, સુરનર લાગે ખ્યારી રે;
જિન મોહનગારો
મૂરતિ જિસકી મોહનગારી, સુરતિ શિવ સુખકારી રે-જિ૦૧
કુશલકારી કૌશલનગરી^૨, દૂર કર્યા સખ વયરી રે; જિ૦
શીલવતી જશ મંગલા^૩ માતા, મેઘ^૪ નરેસર તાતા રે-જિ૦૨
કૌચ લાંછન^૫ કરે ચરણની સેવા, સેવે તુંબરૂ^૬ દેવા રે; જિ૦
મહાકાળી^૭ મનવંછિત પૂરે, શાસન સંકટ ચૂરે રે-જિ૦૩
જીવિત^૮ ચ્યાલીશ લાખ પૂરવનું, ત્રિણસે ધનુ તનુ^૯
માન રે; જિ૦

સુનિ^{૧૦} ત્રણ લાખને વીશ હજાર, એક શત જસ^{૧૧} ગણુ-
ધાર રે-જિ૦ ૪

અજ્ઞા^{૧૨} પંચ લાખ ત્રીસ હજાર, પામી ભવજલ પાર રે; જિ૦
ફિરફિર વદન પ્રભુકો નિરખે,

પ્રમોહસાગર મન હરખે રે-જિ૦૫



(૭૫૦) (૩૨-૬) શ્રી પદ્મપ્રભજિન-સ્તવન

[ચતુર સનેહી મોહના-એ દેશી.]

શ્રી જિનરાજ જયંકરૂ, શ્રી પદ્મપ્રભુ^૧ રાજે રે ।

દિનકર૧વાને^૨ દીપતો, જ્ઞાન-ગુણે કરી ગાજે રે,

બલિહારી જિન-રૂપકી. ૧

૧ ઉગતા સૂર્ય જેવી,

કોશાંત્રી^૩ નગરી ધણી, ધરરાજ^૪ જસ તાતો રે ।
 કુખે સુસીમા^૫ માતની, અવતરીઆ જગ તાતો રે, બલિ૦ર
 ત્રીશ પૂરવ લાખનું, આઉખું^૬ અભિરામ રે ।
 ધનુષ^૭ અઢીશત દેહડી કમલ^૮ લાંછન શુભ ઠામ રે, બલિ૦
 કુસુમજક્ષ^૯ અને જક્ષણી, શ્યામા^{૧૦} કરે પ્રભુ સેવ રે ।
 સાત અધિક શત ગણધરા,^{૧૧} હું વંદુ તતખેવ રે, બલિ૦૪
 ત્રીશ સહસ ત્રિણલખ યતિ,^{૧૨} સાહુણી^{૧૩} ચઉલાખ રે ।
 વીશસહસ અધિકી સહી, પ્રમોદસાગર ઇમ ભાખે રે. બલિ૦



(૭૫૧) (૩૨-૭) શ્રીસુપાર્શ્વનાથજિન સ્તવન

[દાન કહે જગ હું વડો-એ દેશી.]

મુજરો માનો સુપાસજી,^૧ તું મુજ આતમરામ;-લલના ।
 દીનદયાળ કૃપા કરી, આપો ઠામ સુકામ-લલના-મુજરો૦૧
 સુરપુરી સરસી વારાણસી^૨ સુપ્રતિજ્ઞ^૩ નામે નરેશ, લલના
 પૃથવી^૪ જનની જેહની, સ્વસ્તિક^૫ અંક૧-નિવેશ,
 લલના-મુજરો૦ ૧૨૧।

વીશ લાખ પૂરવ આઉખું,^૬ કંચનવાન^૭ ઉદાર;-લલના ।
 દેહ^૮ દોય શત ધનુષની, નવકણ શિરપર સાર-લલના, મુ૦
 પંચાણુ જસ ગણધરા,^૯

ત્રિણલખ મુનિવર^{૧૦} સાર;-લલના ।

૧ લાંછન.

ચહલખ સાધવી^{૧૧} અતિ ભલી, ઉપર ત્રીસ હજાર-લલના, મુઠ
 માતંગયક્ષ^{૧૨} શાંતાસુરી, ^{૧૩} શાસન-સાનિધ્યકાર;-લલના ।
 પ્રમોદસાગરની વિનતિ, ધરજ્યો હૃદય મઝાર.-લલના,
 મુજરો ॥૫૫॥



(૭૫૨) (૩૨-૮) શ્રી ચંદ્રપ્રભજિન સ્તવન

[નંદનકં ત્રિશલા હુલરાવે-એ દેશી]

શ્રીચંદ્રપ્રભ^૧ સાહિબ મેરા, શશીકર^૨ બેજલ^૨ દેહરે-શ્રીઃ
 ચંદ્રલંછન^૩ નિજ ચરણે શોભે. અડ મહાસિદ્ધિ ગેહરે-શ્રીઃ
 ચંદ્રાનના^૪ નગરીનો નાયક, મહસેન^૫ રાજના જાત રે ।
 દશલખ પૂરવ આયુ^૬ અનોપમ,

લાખમણા^૭ માત વિખ્યાત રે; શ્રીઃ ॥૨૫॥

કાયા^૮ સારથશત ધનુ માને, ત્રાણું ગણધર^૯ જાસ રે ।
 વિજયાસુર^{૧૦} ભુકુટી^{૧૧} તસ દેવી,

નવિ છંડે પ્રભુ પાસરે; શ્રીઃ ॥૩૫॥

સારથ દો લાખ મુનિજન^{૧૨} કહીયે, ગુણમણિગણ ભંડાર રે ।
 તીણલખ સહસ એંશી ઝાઝેરી,

સાહુણી^{૧૩} પરિવાર રે-શ્રીઃ ॥૪૫॥

અષ્ટાદશ ગુરૂ-દોષ નિવારણ, તારણ એ જિનરાજ રે; ।
 પ્રમોદસાગર પ્રભુ ચરણ પ્રસાદે,

દુશ્મન દૂરે ભાંજેરે-શ્રીઃ ॥૫૫॥



૧ ચંદ્રના કિરણ જેવો

(૭૫૩) (૩૨-૯) શ્રી સુવિધિનાથજિન સ્તવન

[અંદનખાલા બારણે રે લોલ-એ દેશી.]

વિધિશું સુવિધિ^૧ જિણુંદનીરે લોલ, સેવ કરું નિશદીશ—
મન મોહિઓ રે ।

આઠ કરમ દૂરે કર્યાં રે લોલ, નામે સુર-નર શીશ—
મનં વિધિશું ॥૧॥

સુગ્રીવ^૨વંશ-દિવાકરે લોલ, શામા^૩ માત મલ્હાર-મનં
પૂરવ દોય લખ આઉખું^૪ રે લોલ, પુષ્પદંત^૫ જ્યકાર
મનં વિધિશું ॥૨॥

કાકંદીપુરી^૬ જેહની રે લોલ, લાંછન^૭ મધર અનૂપ-મનં
શતધનુ માને દેહડી^૮ રે લોલ, શોભે એક સુરૂપ
મનં વિધિં ॥૩॥

સોહે દોય લખ રસજતી^૯ રે લોલ, અઠ્યાશી ડગણનાથ^{૧૦}—
મનં ।

વીશસહસ એક લાખ છે રે લોલ, સાહુણી^{૧૧} પ્રભુ સાથ—
મનં વિધિં ॥૪॥

અજિતાયક્ષ^{૧૨} સુતારીકારે^{૧૩} લોલ, પૂજે જિનપતિપાય
મનં ।

પ્રમોદસાગર પ્રભુ-ધ્યાનથી રે લોલ, સમક્ષિત નિર્મલ થાય
મનં વિધિં ॥૪॥



૧ પ્રભુજીનું બીજું નામ, ૨ સાધ્વી, ૩ ગણધર.

(૭૫૪) (૩૨-૧૦) શ્રી શીતળનાથ જિન સ્તવન

[ગાડી મન લાગ્યું એ દેશી]

શીતલનાથ^૧ સુખંકરૂ, શીતલ વચન રસાળ રે—

જિનશું દિલ લાગ્યું^૨ ।

શીતલતા નયણે થઈ, જિનપતિ વદન^૩ નિહાળ રે—જિન૦ ૧

ભદ્રિલપુરી^૪ નામે નગરી, દૃઢરથ^૫ રાજા ધીર રે—જિન૦

નંદારાણી^૬ જનમીઓ, શ્રીવત્સ^૭ લંછન વીર રે—જિન૦ ૨

ભવિત^૮ પૂરવ લાખનું, નેઉ ધનુષ તનુ^૯—માન રે—જિન૦

એકાશી ગણધર^{૧૦} મુનિ, ચામીકરસમરે વાન^{૧૧} રે—જિન૦ ૩

વાચંજમ^{૧૨} લખ જેહને, અમ્હેશ્વર^{૧૩} જસ યક્ષરે—જિન૦

દેવી અશોકા^{૧૪} દીપતી, મહીમા જસ પ્રત્યક્ષ રે—જિન૦ ૪

એક લખ ખટ સહસ સાહુણી,^{૧૫} સાધે નિજ વર કાજ રે—જિન૦

પ્રમોદસાગર ભગતિ ભણે, દેજે અવિચલ રાજ રે—જિન૦ ૫



(૭૫૫) (૩૨-૧૧) શ્રીશ્રેયાંસનાથજિન સ્તવન

[દેહી દેહી નણુંદ હડીલી—એ દેશી]

વંદો વંદો એહ જિણુંદ, પદ પ્રણમે સુર જન વૃંદારી; વંદો

શ્રીશ્રેયાંસ^૧ મુણિંદા, રવિન્નુકુલ^૨ કુવલયચંદારી—વંદો ૧

૧ મુખ, ૨ સોના જેવી,

૩ વિષ્ણુ રાજના કુળરૂપી કુમુદ=ચંદ્રવિકાશી કમલ ખીલવવા ચંદ્ર જેવા,

માતા^૩ વિશ્નુરાણીજાત, લાંછન^૪ ખડૂગી^૧ ઉપશાંતરી; વંદો^૦
આયુ^૫વરસ ચોરાશી લાખ,

એહવી પ્રવચનર સાચી સાખરી-વંદો ૨
શુભ સિંહપુરિપતિ^૫ જાણુ, એંશી ધનુષનું દેહ^૬-પ્રમાણરી.
—વંદો^૦

જસ સહસ ચોરાશી મુણિંદા,^૭

છિહોતર જસ ગણધારરી—વંદો^૦ ૩

જસ એક લાખ તીશ હજાર, સાહુણી^૮ નિરધારરી—વંદો^૦ ૪

શ્રીમાનવીદેવી^{૧૦} જખેસસુર^{૧૧} શાસન મંગલકારીરી—
વંદો^૦ ૪

જસ અષ્ટાપદ^{૧૨}સનૂર, ધનમોહતિમિર કરે દૂરીરી—વંદો^૦ ૫

પ્રભુ પ્રમોદસાગર સુખપૂર,

પ્રગટયો અનુભવ ગુણ સૂરીરી—વંદો^૦ ૫



(૭૫૬) (૩૨-૧૨) શ્રી વાસુપૂજ્યજિન સ્તવન

[મુને ખ્યારોરે લાગે વીધુઓ—એ દેશી]

સખી ! ^૧વાસુપૂજ્ય પ્રભુ ખારમા,

મનમોહન સાહિબ દેવરે

સખી ! દેહી દીપે સુરસી,

સુર-કિંનર કરતા સેવરે—સખિ^૦ ૥૧૧૮

સખી ! સીતોર ધન ^૨તનુ-માન છે,

લાખ જાહોતર વરસનું ^૩આયરે ।

૧ ગેંડાનું, ૨ આગમની

સખી ! નરપતિ, ૪વાસુપૂજ્ય નામે,

જસ રાણી જયાદેવી^૫ માયરે—સખિં ॥૨૦॥

સખી ! મહિષ ૬લંછન ૭ચંપાધણી,

જસ છાસકં ૮ગણધર સ્વામીરે ।

સખી ! ૯કૌમાર ૧૦ચંડા જક્ષિણી,

પ્રભુ આણુ ધરે શિરનામીરે—સખિં ॥૨૧॥

સખી ! સહસ્ર બહોતર ૧૧સંયતી,

સુખકર શ્રીજિનરાજરે ।

સખી ! એક લખ સુંદર ૧૨સાધવી,

અતિ સાધે આતમ કાજરે—સખિં ॥૨૨॥

સખી ! હૃદય કમલમાં એહને, ધ્યાઈને હોયે સિદ્ધિરે ।

સખી ! પ્રભોદસાગર પ્રભુ સેવથી,

ઘેર પ્રગટે નવનિધિ રિદ્ધિરે—સખિં ॥૨૩॥

(૭૫૭) (૩૨-૧૩) શ્રીવિમલનાથજિન સ્તવન

(૨શીયાની-દેશી)

વિમલ^૧ વિમલ-ભાવે ભવિ પ્રણુમીયે,

વિમલ થયાં મુજ નયન-કૃપાનિધિ !

૧શ્રવણ-યુગલ માહરાં પાવન થયાં,

નિસુણી પ્રભુજનાં વચણ-કૃપાંવિમલં ॥૧॥

કોડિકલ્યાણકરી રકંપિલપુરી,

ભૂપ ભલો કૃતવમ^૨—કૃપાં

૪ શામારાણી જનની પ્રભુ કેરી,
કરતી ધર્મના કર્મ-કૃપાંવિમલં ॥૨॥

સાઠ ધનુષ સરસી જસ પદેહડી,
સાઠ લાખ વરસનું ૬ આય-કૃપાં
સૂયર ૭ લંછન ચરણે બિરાજતું,
૧ પ્રગટત-રવિ(કંચન)સમ ૮ કાય-કૃપાંવિમલં ॥૩॥

શ્રુતધર સત્તાવન ૯ ગણધર ભલા,
૧૦ મુનિવર અડસઠ સહસ-કૃપાં
૧૧ અજન્ત એક લખ ઉપર આઠસેં;
પામી સદ્ગતિવાસ-કૃપાંવિમળં ॥૪॥

૧૨ પાણ્ડુમુખયક્ષ અને ૧૩ વિજયાસુરી,
પૂજે જિનના પાય-કૃપાં
અહુનિશ ધ્યાન ધરે પ્રભુ તાહરે,
પ્રમોદસાગર ગુણ ગાય-કૃપાંવિમળં ॥૫॥

(૮૫૮) (૩૨-૧૪) શ્રીઅનંતનાથજિન સ્તવન
(વાહલેશ્વર મુજ વિનંતિ ગાડીચારાય-એ દેશી)

નગરી ૧ અયોધ્યારાણ્યો-જિણુંદરાય,
સંત ૨ અનંત-ભગવંતરે-જિં ૧
૩ સિંહસેન ૪ સુયશામાતનો-જિં,
નંદન શુભ ગુણવંતરે-જિં ૦ ૦ ॥૧॥

૧ સ્પષ્ટ સુવર્ણ જેવી કાયા

ત્રીસ લાખ વરસનું ^૫આઉખું-જિં,
 તાપિત૧ સોવન ^૬વાનરે-જિં ૧
 ૭સીંચાણો સેવા કરે-જિં,
 ૮પંચાસ ધનુષનું ^૯માનરે-જિં ૦નં ૥૨૧૥
 ૯પાતાલજક્ષને ^{૧૦}અંકુશા, જિં,
 જિનશાસન જયકાર રે-જિં ૦
 ૨૫ંચાશત્ ^{૧૧}ગણનાયકા-જિં,
 આગમજલ આધાર રે-જિં ૦નં ૥૨૩૥
 સહસ્ર બાસઠ સંજતા-જિં ૦
 ધરમધુરંધર ^{૧૨}સાધરે-જિં ૦ ૧
 સહસ્ર બાસઠ ^{૧૩}સાધવી-જિં,
 તપ જપ કરે નિરાધારે-જિં ૦નં ૥૨૪૥
 શક્તિ અનંતી નાથની-જિં,
 પામ્યો ઠામ અનંતરે-જિં ૦ ૧
 પ્રમોદસાગર ઈમ વિનવે-જિં,
 આપો ઠામ અનંત રે-જિં ૦નં ૥૨૫૥



(૭૫૯) (૩૨-૧૫) શ્રીધર્મનાથજિન સ્તવન
 (હે સખી ! અમીય રસાલકે ચંદ્રાવાખંડરે-એ દેશી)
 પ્રણમું ^૧ધર્મજિણેસર ધર્મધુરંધર રે—ધર્મં
 ધરીયે ધર્મસનેહ અનેહીજ વરૂં રે—અને ૦ ૧

૧ તપાવેલા સોના જેવી કાંતિ ૨ પચાસ

૨૨૨તનપુરનો નાયક લાયક સોહતોરે,—લાયક૦;

૩કંચનકાંતિ સુકાંતિ સદા મોહતો રે—સદા૦ ॥૧॥

તેજે ૧લાનુસમાન ૪લાનુવસુધાપતિરે રે—લાનુ૦,

૫સુવતામાતા વિખ્યાત સદા વ્રત ધારતી રે—સદા૦ ।

૬વજ્રલંછન શુભ લંછન અંગ બિરાજતાં રે—અંગ૦ ।

ત્રેતાલીશ ૭ગણધાર ગુણુકર છાજતારે—ગુણુ૦ ॥૨॥

દશલાખ વરસનું ૮જીવિત સુરધણી રે—જીવિત૦,

પણ્યાલીસા ધનુમાને ૯કાયા જિનતણી રે—કાયા૦ ।

૧૦કિંનરનામે યક્ષ પૂરે મનકામના રે—પૂરે૦

૧૧કંકડપં સુરી પૂજે પદ્મજ સ્વામીના રે—પદ્મ૦ ॥૩॥

સોહે સખલા ચોસઠ સહસ ૧૨તપોધના રે,—સહસ,

સહસ બાસઠ ચ્યારસે ૧૩સાધવી લવિજનારે, સાધવી૦ ।

તુજસરીખો નહી સ્વામી અવર કિમ આદરું,—અવર૦ ।

મધુરી સાકર ચાખી કંકર શું કરું રે?—કંકર૦ ॥૪॥

ગુણુવંત સાથે ગોઠડી જો હોય નિખળીરે—જો૦ ।

ત્રિલોવન નાથ અનાથકે મોયણિ તે લલીરે,—મોયણિ૦ ।

ત્રિલોવન નાથ અનાથકે મોયણિ તે લલીરે,—મોયણિ૦ ।

જો સફળી હોવે પ્રીત તો નીચ ન સેવીયેરે,—નીચ૦ ।

પ્રમોદસાગર ત્રિવિધશું લવિજન સેવીયે રે—લવિ૦ ॥૫॥



૧ સૂર્ય જોવો; ૨ લાનુ રાજ, ૩ સાધુ.

(૭૬૩) ૩૨-૧૬) શ્રી શાંતિનાથ જિન સ્તવન
(૬૭૨ આંખા આંખલી રે એ દેશી)

૧ શાંતિજિનાધિપ સોલમોરે, પુણ્ય તણો અંકુર ।

ધ્યાનાનલ મળ ટાળીને રે, પ્રગટ્યો આતમનૂર—

ચતુર ! જિન પ્રગટ્યો :અનુભવ પૂર.

મોહતિમિર દૂરે કરી રે, ઉગ્યો સમકિતસૂર—ચતુરં ॥૧॥

૨ ગજપુરનગર સોહામણોરે, ૩ વિશ્વસેનનરપતિ તાત ।

૪ અચિર જનની દેવનીરે,

૫ હરિણુ લાંછન અતિકાંત—ચતુરં ॥૨॥

૬ ભવિત વરસ એક લાખનું રે, ૭ વ્યાલીશ ધનુષનું માન ।

૮ છત્રીશ ગુણુધર ગુણુનીલા રે,

ધરતા પ્રભુકો ધ્યાન—ચતુરં ॥૩॥

૯ બાસઠ સહસ જસ સાધુ છે રે, ત્રીન રચણુ આધાર ।

૧૦ એકસઠ સહસ સાધવી રે,

અધિકી ખટ અવધાર—ચતુરં ॥૪॥

સેવે ૧૧ ગરૂડ યજ્ઞેશ્વર રે, ૧૨ નિરવાણી તસ નાર;

શાંતિકરણ જગ શાંતિજી રે,

પ્રમોદસાગર જયકાર—ચતુરં ॥૫॥

(૭૬૧) (૩૨-૧૭) શ્રી કુંથુનાથ જિન-સ્તવન.

(મ કરો માયા કાયા કારમી—એ દેશી)

રંગ લાગ્યો પ્રભુ-રૂપશુ, તું જ્યો વૃકુંથુ જિનરાય રે ।

દેહની કાંતિ રકંચનસમી,

૩ગજપુર ૩સૂરનૃપ તાય રે—રંગ૦ ૥૧૥

રાણી પસિરી જેહની માતૃકા, પાંત્રીશ વ્યાપની દેહરે,

સેવતો ૭છાગ લંછન મિસે,

કિમ દીયે પ્રભુ તસ છેહ રે—રંગ૦ ૥૨૥

જેહને પાંત્રીસ^૮ ગણધરા, મુનિજન^૯ સાઠ હજાર રે ।

૧૦સાઠ સહસ પ્રભુ સાહુણી,

ખટશત અતિ મનોહાર રે—રંગ૦ ૥૩૥

૧૧ચક્ષુગંધર્વ^{૧૦} ૧૨બલા જક્ષિણી, દોય કરે શાસન સેવરે ।

વરસ પંચાણુ સહસ ૧૩આઉખું,

તુંહી તુંહી સહી દેવરે—રંગ૦ ૥૪૥

જ્ઞાનગુણ-કુસુમ તનુવાસિત, ભાસિત લોક અલોક રે ।

પ્રમોદસાગર પ્રભુ ચિત્તો ધરો,

જિમ ધરે રદિનકર ડોકોકરે—રંગ૦ ૥૫૥



૧ ધનુષ્ય, ૨ સૂર્ય, ૩ ચક્રવાક પક્ષી

(૭૬૨) (૩૨-૧૮) શ્રીઅરનાથજિન સ્તવન

[વાહણ પાંચસે પુરીયાં—એ દેશી]

આશ પૂરે ^૧અરનાથજી, સાતમો ચક્રધર સ્વામી રે.

ભવિષકજ પ્રતિબોધતો, શોધતો આતમરામીરે

મોહન મૂરતિ જિન તણી. ॥૧॥

^૨ગજપુર નગર અતિ સુંદર, નામ ^૩સુદરશણુ ભૂપરે,^૪દેવીરાણી જસ માત છે,^૧ગાલિતહેત પમનુરૂપ રે. મોહન ॥૨॥લંછન ^૧નંદાવરતનું ધનુષ ^૨જસ ત્રીશનું માન રે.વરસ ચોરાશી હજારનું, ^૩જીવિત જસ પ્રધાન રે—મોહન ॥૩॥^૪ગણધર તેત્રીશ જાણીયે, ^૫સાધુ ગણ સહસ પંચાસ રે,^૬સાહુણી સાઠ સહસ ભલી,

છોડવે મોહ ભવ-પાશ રે—મોહન ॥૪॥

^૧ચક્ષરાજ સુર ચક્ષુણી, ^૨ધારિણી નામે કહેવાય રે,

પ્રભુ તણી આજ્ઞા શિર ધરે,

પ્રમોહસાગર ગુણ ગાયરે—મોહન ॥૫॥

卐

卐

卐

(૭૬૩) (૩૨-૧૯) શ્રીમદ્વિનાયજિન સ્તવન

[આદિ જિનેસર વિનતિ—એ દેશી]

^૧મદ્વિજિનેસર વંદીયે, ^૨નીલકમલહલ અંગ-લાલરે,

તીર્થંકર પદ ભોગમયું, કુમરીરૂપે ચંગ-લાલરે. મદ્વિ ૧

૧ શુદ્ધ સોના જેવું.

૩ભિથિલાનગરીનો રાજ્યો, ૪કુંભપિતા યશવંત-લાલરે,
 ૫દેવીનામે પ્રભાવતી, કુખે રચણુ ગુણવંત લાલરે. મદ્દિલ ૨
 સહસ પંચાવન વર્ષનું, ૬જીવિત જગમાં સાર-લાલરે,
 ૭પણુવીશ ધનુષની ૮દેહડી, ૯કલશ લંછન શિવકાર-લાલરે. ૩
 સહસ ત્ર્યાલીશ ૧૦મુનિ જોહને,

ગણુધર ૧૦ અઠાવીશ સાર-લાલરે,
 સહસ પંચાવન ૧૧સાધવી,

નામે પ્રભુપદ શીશ-લાલરે. મદ્દિલ ૪
 ૧૨ચક્ષુકુખેર ૧૩ધરણુપ્રિયા, જિનશાસન રખવાળ-લાલરે,
 પ્રમોદસાગર જપે ઈશુ, આપો વાણી રસાળ-લાલરે.

卐

卐

卐

(૭૬૪) (૩૨-૨૦) શ્રીમુનિસુવ્રતજિન સ્તવન
 વીશમો જિનવર સુકૃતકારી, મનમથ-વૈરી માન નિવારી,
 મોહના ૧મુનિસુવ્રતસ્વામી જીવના ! મુનિસુવ્રત. સ્વામી
 મોહના ૦ ॥૧॥

રકજજલ વાંને દેહી દીપે,

નિરૂપમ રૂપે ત્રિલોવન જીપે—મોંજી ૦ ॥૨॥

૩કચ્છપ લંછન પદકજ ભાસે,

વીશ ધનુષ ૪તનુ ધર્મ પ્રકાશે—મોંજી ૦ ॥૩॥

૫જીવિત વરસ ત્રીશહજાર,

૬ગણુધર સોઢે જાસ અઢાર—મોંજી ૦ ॥૪॥

વીશ સહસ ૭મુનિવર પ્રભુપાસ,

૮સાહુણી કહી સહસ પંચાસ—મોંજી ૦ ॥૫॥

૯રાજગૃહી નગરીનો રાજા,

૧૦સુમિત્ર નરપતિ કુળ દિવાળ—મોંજી ૦ ૥૬૥

૧૧પદ્માવતી દેવી તનુભત,

૧૨હરિવંશમાં જનમ વિખ્યાત—મોંજી ૦ ૥૭૥

૧૩વરૂણ સુર ૧૪નરદત્તા દેવી,

આણુ અધિકે શાસન સેવી—મોંજી ૦ ૥૮૥

પ્રમોહસાગર પ્રભુ ચરણે લાગે,

વીશવશાનુ સમકિત માગે—મોંજી ૦ ૥૯૥

卐

卐

卐

(૭૬૫) (૩૨-૨૧) શ્રીનમિનાથજિન સ્તવન

[સેવો સેવો હો લાલ પુરસાદાણી તુમને-એ દેશી]

વંદો વંદો ને લાલ ! જિનભુવન જયકારી

પૂજે પૂજે યે લાલ જિન શાસન સુખકારી;

એકવીશમા ૧નમિનાથ જિણુંદા,

૨મિથિલાપુર અધિકારી—વંદો ૦ ૥૧૥

૩લંછન નીલકમળ અતિસુંદર,

પનર ધનુષ ૪તનુ ધારી—વંદો ૦ ૥

જસ દશ સહસ વરસનું ૫આયુ,

કાયા ૬કંચન સારી—વંદો ૦ ૥૨૥

૭વિજય નૃપતિને ૮વપ્રારાણી,

નંદન આનંદકારી, વંદો ૦ ૥

૯ભૂકુટી સુર ૧૦ગંધારી દેવી,

શાસનને હિતકારી—વંદો ૦ ૥૩૥

સત્તર ^{૧૧}ગણધર વર ગુણખાણી,

વીશ સહસ્ર ^{૧૨}વ્રતધારી—વંદો ૦ ।

^{૧૩}અજબ એકતાલીસ હજાર,

કુમતિ કુગતિ ભય વારી—વંદો ૦ ॥૪૧॥

હિયડે હરખી નયણે નિરખી,

મોહન મૂરતિ તાહરી—વંદો ૦ ।

પ્રમોદસાગર જંપે પ્રભુજના,

દરશણકી ખલિહારી—વંદો ૦ ॥૪૨॥

卐

卐

卐

(૭૬૬) (૩૨-૨૨) શ્રીનેમિનાથ-જિન સ્તવન

[મ કર જીવ પરતાંતિ દિનરાતિ તું-એ દેશી]

નેમિજિન સાંભળો વિનતિ મુજ તણી,

આશ નિજદાસની સફળ કીજે,

બ્રહ્મચારી શિર સેહરો તું પ્રભો ?

તાત મુજ વાત ચિત્તોં ધરીજે—નેમિ ૦ ॥૧૧॥

નગર રશૌરીપુર નામ રળીઆમણું,

^૩સમુદ્રવિજયાભિધ૧ ભૂપ દીપે,

^૪શ્રી શિવાદેવી નંદન કડું વંદના,

^૫અંજનવાન રતિનાથર જીપે—નેમિ ૦ ॥૨૧॥

શંખ ઉન્નવલ ગુણા શંખ ^૬લાંછન થકી,

સાર ઇગ્યાર ^૭ગણધર સોહાવે,

આઠ એક સહસ વરસમાને કહ્યું,
 અંગ દશધનુષમાને કહાવે—નેમિં ॥૩૮॥
 યક્ષ ૧૦ગોમેધ ને ૧૧અંધિકા યક્ષિણી,
 જ્ઞેનશાસન સદા સૌખ્યકારી,
 અઠાર હજાર અણુગાર શ્રુતસાગરા,
 સહસ ચ્યાલીશ ૧૩અન્નજીવિચારી—નેમિં ॥૪૮॥
 કાંચનાદિક બહુ વસ્તુ જગકારમી,
 સાર સંસારમાં તુંહી દીકો,
 પ્રમોદસાગર પ્રભુ હરખથી નિરખતાં,
 પાતિક પૂર સર્વ દૂર નીકો—નેમિં ॥૫૮॥

卐

卐

卐

(૭૬૭) ૩૨-૨૨) શ્રી પાર્શ્વનાથજિન સ્તવન

[થારા મોહલાં ઉપર મેહ ઝરખે વીજળી-એ દેશી]

પુરિશાદાણી ૧પાસ જિનેશ્વર પૂજયે—હો લાલ—જિનેં
 ત્રેવીશમો જિનરાય—દેખી મન રંજિયે—હો લાલ—દેખીં
 ચરણે સરોરહ યમલ પ્રણમીયેં સ્વામીના—હો લાલ, પ્રણં
 કમઠાસુર હઠ ચૂરત—પૂરી મનકામના હો લાલ—પૂરીં ॥૧॥
 ૨અશ્વસેન નરપતિ—વંશ—કુમુદ—ચંદલો—હો લાલ—કુમું
 ૩વામા માતા કુખે—સરોવર હંસલો—હો લાલ—સરોં ॥
 ૪નીલવરણ તનુ કાંતિ—સુભાતિ રાજતી—હો લાલ—સું ॥
 ૫નવ કર માંને કાયા—અનોપમ છાજતી—હો લાલ—અનોં ૨

નગરી ^૬વારાણસી જેહની

ધનદુપરી જિસી હો લાલ—ધન૦ ।

^૭સરય લંછન શિવકારણ—ચરણે

સેવે હસી—હો લાલ—ચરણે૦ ।

દશ ^૮ગણધર મનોહાર—મનોલવ

ટાળતા—હો લાલ—મનો૦ ।

^૯સોળસહસ મુનિ આણ—

જિણુંદની પાળતા—હો લાલ—જિ૦ ॥૩૥

^{૧૦}ધરણેંદ્ર ને ^{૧૧}પદમાવતી—

કરે જિન ચાકરી—હો લાલ—કરે૦ ।

^{૧૨}સાધવી અડત્રીશ સહસ—અતીવ

કૃપા કરી—હો લાલ—અતી૦ ।

એકશત વરસતું ^{૧૩}જીવિત—જેહનું

જાણીયે—હો લાલ—જેહ૦ ।

જગજીવન જિનરાજ—સેવા ચિત

આણીયે—હો લાલ—સેવા૦ ॥૪૥

સંસારસાગર તીરથી—લવિજન તારીયે—હો લાલ,—લવિ૦

અધર્મ અક્રીતિ અનીતિ—અંગ

નિવારીયે—હો લાલ—અંગ૦ ।

ઉત્તમ સરસી પ્રીત—કરે તે સુખ લહે—હો લાલ—કરે૦ ।

પ્રમોદસાગર પ્રભુ નિસદ્દિન—આજ્ઞા

શિર વહે—હો લાલ—આજ્ઞા૦ ॥૫૥

(૭૬૮) (૩૨-૨૪) શ્રીમહાવીર-જિન સ્તવન

[મુજરો છ જીરે-એ દેશી]

મુજરો લ્યોજી ^૧સિદ્ધારથ દારક ! મુજરો લ્યોજી,

સેવક સુખ કારક—મુજરોં

ત્રિભોવન જનતારક—મુજરોં જિનશાસન ધારક—મુજરોં

વંદો ભવિકા ! ^૨વીર જિનેશર, ચોવીશમે જિનત્રાતા,

ઝકેસરી લાંછન કેસરી સરખો,

^૪ત્રિશલારાણી માતા—મુજરોં ॥૧॥

^૫જીવિત વરસ બહોતર અનોપમ, ^૬સોવન કાંતિ ઉદાર,

^૭ક્ષત્રિયકુંડ નગર અતિ શોભે,

^૮એકાદશ ગણધાર—મુજરોં ॥૨॥

^૯માતંગસુર ^{૧૦}સિદ્ધાઈ દેવી, પૂજે જિનવર પાયા,

^{૧૧}સાતહાથ તુજ દેહ પ્રમાણજ,

^{૧૨}ચઉદ્ધ સહસ મુનિરાયા—મુજરોં ॥૩॥

^{૧૩}સાધવી સહસ છત્રીશ ખીરાજે, ચરમજિનેશ્વર દેવા,

તેર પદે મેં જિનવર ગાયા,

સુરપતિ કરતા સેવા—મુજરોં ॥૪॥

ભણશે ગણશે જે જન સુણશે, તસ ઘર રિદ્ધિવિશાળ,

પ્રમોદસાગર જંપે પ્રભુજીને,

હોજો મંગળમાળા—મુજરોં ॥૫॥



શ્રી વર્ધમાનસ્વામિને નમઃ

શ્રી ભાણ્યંદ્રજી કૃત

સ્તવન-ચૌવીશી

(૭૬૯) (૩૩-૧) શ્રીરૂપભદ્રેવ-જિન સ્તવન

પદમ જિજ્ઞેસર ! પ્રણુત સુરેસર ! કેશર-સમ વળી દેહ,
એહ સમ સુખકર અવર કોઈ નહીં, મહિયલ ગુણુમણિગેહ-
હો ! સ્વામી ! તુંહિ સદા સુખકાર !

તું જગજીવ આધાર-હો-સ્વામીં ॥૧॥
પાર સંસાર-સાગરતણો તે લહે, જે વહે શિર પ્રભુ આણુ,
પાણુપાટક^૧ અન્ય દેવો તણ,

લજી લ્યો ! ત્રિભુવનભાણુ-હો સ્વામી-તુંહિં ॥૨॥
જ્ઞાન પૂરણુ તુજ રવિ સમ ઝડહલે, ખલહલે વચનપયોધિ,
બોધ લહિવા પીયે જે ભવિ શ્રુત-સુધા,

તે બુધા કરે નિજ શોધિ-હો સ્વામી-તુંહિં ॥૩॥
ચોધ જિમ મોહરિપુ દૂર કરી તું જ્યો, થયો શિવસુંદરી-કંત,
અંત નહી જેને તેહવા સુખ લહ્યો,

મેં અહ્યો, તું ભગવંત-હો સ્વામી-તુંહિં ॥૪॥

૧ ચંડાળોનો મહોદ્દેવો

શાંત-સુધારસ-અસરીસ સાગર જગત દિવાકર દેવ
સેવક ભાણુ કહે મુનિ વાઘનો

ભવ ભવ તાહરી સેવ-હો સ્વામી—તુંહિં ॥૫૫॥

卐

卐

卐

(૭૭૦) (૩૩-૨) શ્રી અજિતનાથજિન સ્તવન

[લાછલ દે માત મદહાર—એ દેશી]

શ્રી અજિત અમિત ગુણધાર, સોભાગી સિરદાર,
આજ હો ! ખારહુ પરખદ આગળ ધર્મ કહે મુદાળ ॥૧॥

ધર્મ—તે જે સ્યાદવાદ, અનેકાંત અવિવાદ,
આજ હો ! મિથ્યાવાદ કુતર્ક—વિતર્ક નહી કદાળ ॥૨॥

જિનનો એ વિધિવાદ, જિહો નહીં હિંસા વિષાદ,
આજ હો ! ઉત્સર્ગે અપવાદે ભિન્નપણે કહેળ ॥૩॥

નિશ્ચય ને વિવહાર, સામાન્ય વિશેષ પ્રકાર,
આજ હો ! સાર વિચાર જિનાગમ તત્ત્વ તે સંગ્રહેળ ॥૪॥

એક આરંભે ધર્મ માને મિથ્યા ભર્મ,
આજ હો ! કર્મ બહુજસંસારી તે જિન ભાખીયોળ ॥૫॥

ધર્મ, મિશ્ર-આરંભ, એક કહે નિરારંભ,
આજ હો ! તે પણ દંભમતિ હઠ વાદીનો સાખીયોળ ॥૬॥

ધર્મ અધર્મ મિશ્રપક્ષ, જે જાણે તે દક્ષ,
આજ હો ! કર્મકક્ષને દહવા તેહ વિભાવશુંળ ॥૭॥

પહેલે સાધુ મહંત, ખીજે મિથ્યા જ્ઞાંત,
 આજ હો ! ત્રીજે શાંત ગૃહસ્થ કુટુંબને પરવશું ॥૮૬॥
 એકલો સૂધો ભાગ, સદહે તે મહાભાગ,
 આજ હો ! આગળ શિવસુખ સુંદર લીલા ભોગવેજી ॥૮૭॥
 વાઘજી મુનિનો ભાણુ, કહે સુણો ચતુર સુભાણુ,
 આજ હો ! તે સુખિયા જગ જે મારગ ભોગવેજી ॥૮૮॥

❧

❧

❧

(૭૭૧) (૩૩-૩) શ્રીસંભવનાથ-જિન સ્તવન

[કૃતના ચૌસર પ્રભુજીને શિર ચડે—દેશી]

શ્રીસંભવજિનદેવની સેવના, દેવ-દનુજ માનવના ઈંદરે
 નિજ નિજ વૃંદે સંયુત નિતુ કરે,

ધરે બહુ આદર લક્ષ્મિ અમંદરે

સેવો લવિકા ! સંભવ જિનવરૂં ॥૧॥

અણુ હુંતે એક કોડી અમરવરા,

રાત દિવસ સેવક રહે પાસે રે ।

ભાષે તત્ત્વ જિનેશ્વર તે સુણી,

શુભ વાસન આતમ અધિવાસે રે—સેવો ॥૨॥

તજી વિરોધ મૃગાદિક પશુપતિ,

જગપતિ જોતાં બહુ દિશિ ધાવેરે ।

માનવ તો પ્રભુ આગમ-કથકને,

કંચન કોડી દેઈ વધાવે રે—સેવો ॥૩॥

ઇણિપેરે ત્રણ ભુવનના ભંચ જે,

સર્વ અહં પૂર્વક મન ભાવે રે ।

સેવા અવસર બહુ માને ઘણું,

એહવો પૂજતિશય સોહાવે રે—સેવોં ॥૪૧॥

હરિહર બ્રહ્માદિક દૂરે તજે,

લજે એક અવિનાશી અવિકાર રે ।

વાઘજી મુનિનો ભાણુ કહે મુદા,

પ્રભુ-સેવાથી શિવસુખ સારરે—સેવોં ॥૪૨॥

卐

卐

卐

(૭૭૨) (૩૩-૪) શ્રીઅભિનંદન-જિન સ્તવન

ફિતેમલ પાણીડાં ગઈતી તળાવ,

કાંટો ભાગ્યો પગની લાંકમાં-એ દેશી]

પ્રભુજી ! અભિનંદન જગનાથ, શિવપુર સાથ ભલો મળ્યો,

પ્રભુજી ! તસ્કરપતિ રાગાદિ, તેહનો ભય દૂરે ટળ્યો. ॥૧॥

પ્રભુજી ! તુજ સરિખો સત્યવાહ, બાંહ્ય અહીંને ઉદ્ધરે,

પ્રભુજી ! દુઃખદાયક જગ જેહ, તે વૈરી તિહાં શું કરે ? ॥૨॥

પ્રભુજી ! ભવ ભમતાં બહુ કાળ, ચક્ર અનંતા વહિ ગયાં,

પ્રભુજી ! ઇહાં મિદ્યા જિનરાજ,

કાજ સવે મુજ સિદ્ધ થયા. ॥૩॥

પ્રભુજી ! શ્યો હવે સિદ્ધિ વિલાંબ ? પ્રાપ્તિનો અવસર ભાવિયો,

પ્રભુજી ! મહિર કરો મહારાજ ! તુમ ચરણે હું આવિયો ॥૪॥

પ્રભુજી ! તારણુતરણુ જહાજ, આજ ભલે પ્રભુ ભેટિયા,

પ્રભુજી ! વાઘજી મુનિનો ભાણુ,

કહે ભવદુઃખ સવિ ભેટિયા. ॥૫॥

卐

卐

卐

(૭૭૩) (૩૩-૫) શ્રીસુમતિનાથ-જિન સ્તવન

(કબકો દેવર અર્જ કરે છે-એ દેશી)

શ્રી સુમતિ જિણેસર અતિ અલવેસર,

મનમોહન વડલાગીજી-જયજિન સોલાગીજી;

તુજ સુરતિ સુંદર સુગુણ-પુરંદર,

ત્રિભુવન તુમ ગુણ રાગીજી; સુજ સુદશા જાગીજી. ॥૧॥

જય પંચમ જિનવર નિરૂપમ સુખકર,

મૂરતિ મોહન ગારીજી-સર્વ ભવિજન પ્યારીજી,

તુમ રૂપ અનોપમ નવિ કોઈને સમ,

મહનાદિક ગયા હારીજી-જેહ રૂપમદધારીજી. ॥૨॥

સુરપતિના થોક મળી ત્રિહું લોક,

સર્વે પ્રભુ રૂપ બનાવેજી-નિજશક્તિ સલાવેજી;

જે જગમેં પુગ્ગલ રૂપ 'સમગ્ગલ,

તે સવિ રૂપરિઘળ લાવેજી-આદર અતિ લાવેજી. ॥૩॥

અંગુષ્ઠ પ્રમાણુ અનેક વિન્નાણુ,

રચી મૂળ સમોવડી જોડેજી-પણુ નવિ હોય હોડે જી

ગિરિ-સરિસવ અંતર રૂપ પટંતર,

દેખી નિજ મદ છોડેજી-થુણે જિન મન કોડેજી ॥૪॥

એહવું પ્રભુ રૂપ શમામૃત-રૂપ,

સદા ભવિને સુખકારીજી, નહીં કદાપિ વિકારીજી ।

વાઘજી મુનિ ચંદ્ર, શિષ્ય કહે ભાણુચંદ્ર,

જિનેન્દ્ર સદા જયકારીજી, એહ રૂચિ મન ધારીજી. ॥૫॥

(૭૭૪) (૩૩-૬) શ્રીપદ્મપ્રભ-જિન સ્તવન
(દેશી-હમીરીયાની)

શ્રીપદ્મ ^૧સદ્ગ કમળાતણે; પાય પદ્મ રહ્યો જાસ—સનેહી
તિણ પદ્મમાં તિહું લોકની;

વસી પદ્મપ્રભ પાસ—સનેહી—શ્રી૦ ॥૧॥

^૨કમલા તે બેહું ભાતની, દ્રવ્ય-ભાવ પ્રકાર,—સનેહી ।
દ્રવ્યરમા અરિહંતની,

સુરનિર્મિત પ્રાકાર—સનેહી—શ્રી૦ ॥૨॥

પ્રાતિહારાજ આઠ જે; જન સુખકારી વિહાર—સનેહી ।

^૩હાટક કજ પદ્મથાપના સુરનાયક છડીદાર—સનેહી—શ્રી૦ ૩

ભાવસિરી નિજ ઘરતણી, જ્ઞાનાનંદ અખંડ—સનેહી,
લોકાલોક—પ્રકાશક, દર્શન સહિત પ્રચંડ—સનેહી—શ્રી૦ ॥૪॥

સંતત નિજગુણુ લોગ જે, અવ્યાખાધ સ્વભાવ—સનેહી,

અપળા કમળા ચિર રહી, એ તુમ અતુલ પ્રભાવ

—સનેહી—શ્રી૦ ॥૫॥

મહિમાનિધિ પ્રભુ સુજ મળ્યા, પ્રસર્યો પુણ્ય પ્રકાશ—સનેહી,

વાઘજી મુનિના ભાણુને, ઘો શિવકમળા વિલાસ

—સનેહી—શ્રી૦ ॥૬॥

卐

卐

卐

ધર ૨ સદ્ગમી ૩ સુવર્ણ કમલ

(૭૭૫) (૩૩-૭) શ્રીસુપાર્શ્વનાથજિન રતવન
(દેશી-વીંધુઆની)

શ્રી સુપાસ સુવાસના, પસાર જગ પરિમરપૂર રે લાલ ।
તિણે તિહું લોક વાસિત કર્યા,

કીધા સવિ જન ^૧સ-સનૂર રે લાલ ॥૧॥

મિથ્યા અવિરતિ પ્રમુખની, અનાદિ કુવાસના જેહરે લાલ ।
પ્રભુ વાસન ફરસન થકી,

અતિ દૂર કરી સવિ તેહ-રે લાલ શ્રી૦ ॥૨॥

એક વાર પ્રભુ વાસના, વાસિત થયો જે ભવિજીવ-રે લાલ ।
તે નિયમા શુકલપક્ષીઓ,

અર્ધ પુદ્ગલે સિદ્ધિ સમીવ-રે લાલ શ્રી૦ ॥૩॥

એહ વાસના ^૨અઘ-નિનાસના,

જિન ભાસિત ભાસના તત્વ-રે લાલ ।

અંતરજ્ઞાન પ્રકાશના,

ભવપાસના છોડે મમત્વ-રે લાલ શ્રી૦ ॥૪॥

પ્રભુ વાસના મુજ આપજો,

સુણો વિનતિ એ જગભાણુ-રે લાલ ।

જિન-ચરણે ધિર થાપજો,

કહે વાઘજી મુનિનો ભાણુ-રે લાલ શ્રી૦ ॥૫॥

ક્ર

ક્ર

ક્ર

(૭૭૬) (૩૩-૮) શ્રીચંદ્રપ્રભ-જિન સ્તવન
(દેશી-આછેલાલની)

ચંદ્રપ્રભ જિનચંદ્ર, આઠમો પૂરણાનંદ;
આછે લાલ ! દીકો અતિશય શોભતોજી. ૥૧૥

મંદરમહીધર ધીર, પ્રાપ્ત ભવોદ્ધિ તીર,
આછે લાલ ! ભવ પડતાંને થોભતાજી. ૥૨૥

રાગાદિક જે અપાય, જેહથી ભવવૃદ્ધિ થાય,
આછે લાલ ! દૂર કર્યાં તે દોષનેજી. ૥૩૥

વાર્યો મોહ જંજાળ, સંતત કર્મ જ બાલ;
આછે લાલ ! પામ્યા સર્વ ગુણ પોસનેજી. ૥૪૥

કરતા જગ ઉપકાર, ધર્મદેશના જળધાર,
આછે લાલ ! સાર વચને ભવિ ખૂઝવેજી. ૥૫૥

સંયમ સત્તર પ્રકાર, ભાવ આમય પ્રતિકાર,
આછે લાલ ! અતિચાર વ્રણ રૂઝવેજી ૥૬૥

કેવળજ્ઞાન પ્રકાશ, ભવિજન કર્મળ વિકાશ,
આછે લાલ ! કરતો દિનમણિની પરેજી ૥૭૥

મહિયલ કરે વિહાર, સકળ લોક સુખકાર,
આછે લાલ ! જિહાં આદર તિહાં સંચરેજી ૥૮૥

એહવો તીરથનાહ, ભેટ્યો અધિક ઉચ્છાહ,
આછે લાલ ! હર્ષ અથાગ હૈયે થયોજી ૥૯૥

વાઘજી મુનિનો ભાણુ, કહે પ્રભુ અનંત વિનાણુ,
આછે લાલ ! સમતાસાગર તું જયોજી. ૥૧૦૥

❧

❧

❧

(૭૭૭) (૩૩-૯) શ્રીસુવિધિનાથજિન સ્તવન

(કપુર હોવે અતિ ઉજળો રે એદેશી)

સુવિધિનાથ જગનાથજીરે, અનુપમ સુવિધિનિધાન ।

અવિધિ દોષ સવિ વારતારે, કરતા સકળ વિધાન રે ।

સ્વામી ! બલિહારી તુમ ધર્મ ॥

જે આપે શિવશર્મ રે સ્વામી,

ફર હરે ભવ ભર્મરે-સ્વામી-બલિં ॥૧॥

વિધિ ભાખ્યો અરિહંતજીરે, સકળ જીવ સુખકાર ।

હિંસા અવિધિ જિહાં નહીરે,

જીવહયાનિધિ સારરે-સ્વામી-બલિં ॥૨॥

જે વિધિ કહો જગતાતજીરે, તે વિધિ મેં નવિ થાય ।

વિધિ વિના શિવપદ નહીરે,

હવે શ્યો સિદ્ધિ ઉપાય રે-સ્વામી-બલિં ॥૩॥

વિધિ-અવિધિ જાણું નહીરે, સેવું પ્રભુના પાય ।

ખાંદ્ય ગ્રહ્યાની લાજથીરે,

આપે તારશ્યો જિનરાયરે,-સ્વામી-બલિં ॥૪॥

તારક બિરૂદ જિણુંદનોરે, જગમેં છે સુપ્રસિદ્ધ ।

તે ઈણું ઠામે કિમ રહેરે,

જો મુજ કાજ ન સિદ્ધ રે-સ્વામી-બલિં ॥૫॥

પોતાવટ જાણી કરીરે, આપો અવિચળ રાજ ।

વાધજી મુનિના ભાણુનાંરે,

એટલે સિદ્ધાં કાજરે,-સ્વામી-બલિં ॥૬॥

(૭૭૮) (૩૩-૧૦) શ્રી શીતલનાથજિન સ્તવન

ભોળીડા હંસા ! વિષય ન રાચીએ-એ દેશી

સહેજે શીતળ શીતળ-જિન તણી, શીતળ વાણી રસાળ ।
વદન-ચંદ્રબરાસ અધિક સુણી,

સમજે બાળ ગોપાળ-સહેજે ॥૧॥
મર્મ ન ભાખેરે સંશય નવિ રાખે, દાખે ભવજળ દોષ ।
રાગાદિક મોષક^૧ ફરે હરે,

કરે સંયમનોરે પોષ-સહેજે ॥૨॥
સુર નર તિરિગણુ મન એકાગ્રથી, નિસુણે હર્ષ અપાર ।
ઘેર વિરોધ ન ભૂખ વૃષા નહીં,

વળી નહીં નિદ્રા લગાર-સહેજે ॥૩॥
સહુને સુણતાંરે હર્ષ વધે ઘણો, ઉત્તમ અધિક ઉચ્છાહ ।
વૃષ્ટિ ન પામેરે સ્વાદુપણુ થકી,

જિહાં લગી ભાખેરે નાહ-સહેજે ॥૪॥
તાપ મિટે સવિ વિષય કષાયનો, શીતળ હુવે ભવિ મન્ન ।
અમૃત-પાન વૃષ્ટિ જિમ સુખ લહે,

વહે જનમ ધન્ન ધન્ન-સહેજે ॥૫॥
ભવહવ તાપ નિવારો નાથજી, ઘો શીતળતારે સાર ।
૥૬જી મુનિનો ભાણુ કહે પ્રભુ ।

જિમ લહું સુખ અપાર-સહેજે ॥૬॥

卐

卐

卐

ચોર

(૭૭૯) (૩૩-૧૧) શ્રીશ્રેયાંસનાથ જિન સ્તવન

(સાંભળરે તું સજની મારી, રજની કયાં રમી આવીછી)

શ્રી શ્રેયાંસ ^૧નિઃશ્રેયસ યાત્રી, શ્રેયોવૃદ્ધિ-વિધાઈ રે ।

જિજ્ઞે નિજ આતમ-સિદ્ધિ નિપાઈ,

સહજ રિદ્ધિ સવિ પાઈ, પ્રભુજી ! સુખદાઈ ॥૧॥

મિથ્યા રજની વિનાશનકારી, ^૨દિનકરને ^૩અનુહારે ।

કર્મજાળેંદ્રઘટા વિનિવારી, મૃગપતિ-વિક્રમધારી-પ્રભુ૦ ॥૨॥

અજ્ઞાન-ક્રોધ પ્રમુખ જે દોષા, દૂરે કર્યા રાગ રોષારે ।

ભાષા દોઈ વદે ચિહ્નું કોશા,

સત્ય અસત્ય-મોષા-પ્રભુ૦ ॥૩॥

જેહની શીતળ મુદ્રા, હીસે દેખત હિયડું હીસે રે ।

અતિ સુપ્રસન્ન રહે નિશિ હીસે,

^૪અવિતત્ત વિસવાવીશે-પ્રભુ૦ ॥૪॥

દોષરહિત ગુણસહિત જે દેવા, નિતુ કીજે તસ સેવા રે ।

વાઘજી મુનિના ભાણુને હેવા,

ચરણ રહુ નિતમેવા-પ્રભુ૦ ॥૫॥

❧

❧

❧

(૭૮૦) (૩૩-૧૨) શ્રીવાસુપૂજ્યજિન સ્તવન

(દેશી નજીદલની)

વસુપૂજ્ય નૃપકુળ મંડણે,

વાસુપૂજ્ય જિનરાય-જિનવર ।

૧. મોક્ષમાં જનારા ૨. સૂર્યને ૩. અનુસરે ૪. પ્રમ ન થાય

વસ્તુતત્વ પ્રકાશતા, વાસવ પૂજિત પાત્ર.-જિનવર
બલિહારી તુમ નામને, જેહથી કોડી કલ્યાણુ,-જિનવર ।
નામથી દુખ દોહગ ટળે,

મળે સુખ નિરવાણુ-જિન૦ બલિ૦ ॥૨૧॥
નામનું સમરણુ જે કરે, પ્રતિદિન ઉગતે ભાણુ-જિન૦ ।
તે કમળા વિમળા લહે,

પણુ કરે કોઈ સુખણુ-જિન૦ બલિ૦ ॥૨૩॥
ચંદન^૧ પન્નગખંધન, શિખિ-રવે વિખરી જાય-જિન૦ ।
કર્મ^૨ બંધન તેમ જીવથી,

છૂટે તુમ નામ-પસાય-જિન૦ બલિ૦ ॥૨૪॥
સધન ધનાધનની ઘટા, વિઘટે પવન પ્રચંડ-જિન૦ ।
મયગલનો મદ કિમ રહે,

જિહાં વસે જમૂગપતિ ચંડ-જિન૦ બલિ૦ ॥૨૫॥
સહસ-કિરણુ જિહાં ઉગીયો,

તિહાં કિમ રહે અંધકાર-જિન૦ ।
તિમ પ્રભુનામ જિહાં વસે,

તિહાં નહીં કર્મ^૩ વિકાર-જિન૦ બલિ૦ ॥૨૬॥
ભાણુ કહે મુનિ વાઘનો, નિતુ સમરૂં તુમ નામ-જિન૦ ।
જિમ શિવકમળા સુખ લહુ,

માહરે એહીજ કામ-જિન-૦ બલિ૦ ॥૨૭॥

卐

卐

卐

૧ સર્પનું બંધન ૨ મોરના અવાજથી ૩ મદમસ્ત હાથી
૪ સિંહ ૫ સૂર્ય

(૭૮૧) (૩૩-૧૩) શ્રી વિમળનાથ જિન સ્તવન

(ગારીકેન નસો ગોફન ગાલા-એ દેશી)

શ્રી વિમળ જિણુંદ વિમળપદવાસી, અવિનાશી જિતકાસી
હો સાંધ્યાં અળ મોહો તારો જિનપતિ ।

પૂરણ લોકાલોક પ્રકાશી;

નિત્યાનંદ વિલાસી હો સાંધ્યાં અળ ॥૧૧॥

જગતાર્યો જળ મુજકું તારો,

તળ સળ સાચ કહાઈ હો-સાંધં ।

જળલગ મેં ન તર્યો તળ જૂઠી,

તારક-ખ્યાતિ બહાઈ હો-સાંધં અળ ॥૨૧॥

કળહુક આપ તારોગે મોંકું, મેં ન તરું ગોસાંધ-હો સાંધં

મેરે કૃલ સળહે જૂઠે,

કયોં તારોગે ગુસાઈ? હો-સાંધં અળ ॥૩૧॥

કૌન ભાંત અળ બિરૂદ રહે હે.

આઈ મિલે હો મોસું-હો-સાંધં ।

મેં પાપી ન તરું તળ તારક,

કૌન કહેંગે તોસું હો-સાંધં અળ ॥૪૧॥

તારક જનકેં આઈ હુકયો હું;

આશ ધરી મેં તુમારી-હો-સાંધં ।

જ્યોં ત્યોં અપનો બિરૂદ નિવાહો,

યહ બિનતિ હે હુમારી-હો સાંધં અળ ॥૫૧॥

મેરે ગુન ઔગુન ન બિચારો;

જગનાયક યશ લેહુ હો-સાંઈ૦ ।

વાઘજી મુનિકો લાણુ કહે પ્રભુ !

મુજકું શિવપદ દેહું-હો સાંઈ૦ અખ૦ ॥૬॥

ક્ર ક્ર ક્ર

(૭૮૨) (૩૩-૧૪) શ્રીઅનંતનાથજિન સ્તવન
(જિણુંદા તારી વાણીયે મન મોહયું એ દેશી)

અનંત અનંત ભગવંત, અનુપમ કેવળ કમળા કંત ।

મુરત સંત પસંત જસ છાજેરે,

જશ છાજેરે શક્તિ અનંત પ્રભુજી તારા રૂપની બલિહારી રે,

જિણુંદા હાંરે બલિહારીરે હાંરે બલિહારીરે !

હું તો વારીરે પ્રભુજી ! તારા રૂપની બલિહારી ॥૧॥

રૂપે મોહ્યા ત્રિભુવન લોક, હરખ્યા નર નારીના થોક ।

૧દિનકર ઉદયે જિમ રકોક,

રંગે ગાવેરે રંગે ગાવેરે જિનગુણ શ્લોકરે પ્રભુજી ! તારા૦ ॥૨॥

પ્રાકૃત-નરથી અધિકે રૂપ, નિર્જિત ઝમંડળ ઝમંડળ ભૂપ ।

તેહથી બળદેવા અનૂપ, કીર્તિપુરૂષારે

કીર્તિપુરૂષારે અતુળસ્વરૂપરે પ્રભુજી ! તારા૦ ॥૩॥

એહથી ભરતાધિપ રાજન, તેહથી વ્યંતર રૂપનિધાન !

ભવન-જ્યોતિષ ચઢતે વાન, અનુકમે બારેરે

અનુકમે બારેરે વસે જે વિમાનરે-પ્રભુજી-તારા૦ ॥૪॥

ઐવેચક જે કલ્પાતીત, પાંચે અનુત્તરવાસી પ્રતીત; !

૧. સૂર્ય, ૨. ચક્રવાક, ૩. સમૂહ ૪. દેશાધિપતિ રાજઓ,

અનુક્રમે ચઢતે રૂપ વિદીત, તેહથી અધિકેરે

તેહથી અધિકે રે સાધુ વિનીતરે-પ્રભુ ૦ ૥૫૥

જે કોઈ ચઉદ્ધ પૂરવ ધાર, આતમલખિય તણે અનુસાર, !

વિરથે આહારકતનુ સાર,

તે તો રૂપેરે તે તો રૂપેરે તેજ અપારરે પ્રભુ ૦ તારા ૦ ૥૬૥

એહથી ગણુધર રૂપ રશાળ, તેહથી રૂપ અનંત વિશાળ !

જેહની ઉપમા નહિં ત્રિહુંકાળ, એહવું પ્રભુનું રે

એહવું પ્રભુનું રે રૂપ દયાળરે-પ્રભુ ૦ તારા ૦ ૥૭૥

જગમાં મનોહર પુદ્ગળ જેહ, જેહથી નિપજ્યું પ્રભુનું દેહ !

બાણું છતમાં તેટલા તેહ, જેણે બીજેરે

જેણે બીજેરે નહી ગુણુગેહરે-પ્રભુ ૦ તારા ૦ ૥૮૥

રૂપ અનંતુ તુમ જિનરાય, તે મેં કિમ વિરણુચું બય !

પામી વાઘજી મુનિ સુપસાય, જિન ચૌદમા રે

જિન ચૌદમા ભાણુચંદ્ર ગાયરે-પ્રભુજી ૦ તારા ૦ ૥૯૥

卐

卐

卐

(૭૮૩) (૩૩-૧૫) શ્રીધર્મનાથ જિન સ્તવન

(દીઠીહો પ્રભુ દીઠી મૂરત તુજ-એ દેશી)

દ્વિગ્યા ! હો ! પ્રભુ ! દ્વિગ્યા મનોરથ મુજજ,

મગ્યા હો ! પ્રભુ ! મગ્યા ધર્મ જિનેશ્વરજી

ઉરણુ હો ! પ્રભુ ! પૃથવી ઊરણુ કીધ,

પૂરણુ હો ! પ્રભુ ! આશાપૂરણુ સુરતજી ૥૧૥

આપે હો ! પ્રભુ ! આપે સવિ સુખ રિદ્ધિ,

થાપે હો ! પ્રભુ ! થાપે નિજપદ લોકનેજી;

વ્યાપે હો ! પ્રભુ ! વ્યાપે પ્રભુ ગુણ જેહ,
 કાપે ! હો ! પ્રભુ ! કાપે તેહના શોકનેજી ॥૨॥
 ધન ધન ! હો ! પ્રભુ ! ધન ધન તું જગમાંહિ,
 મુજમન હો ! પ્રભુ ! મુજમનમેં તુંહિજ વસ્યોજી ।
 નિરખી હો ! પ્રભુ ! નિરખી તાહરું રૂપ,
 હરખી હો ! પ્રભુ ! હરખી તનમન ઉલ્લસ્યોજી ॥૩॥
 સમતા હો ! પ્રભુ ! સમતા અમૃતસિંધુ,
 ગમતા હો ! પ્રભુ ! મન ગમતા સ્વામી મળ્યાજી ।
 તેહવા હો ! પ્રભુ ! તેહવા દીકા આજ,
 જેહવા હો ! પ્રભુ ! જેહવા કાને સાંભળ્યાજી ॥૪॥
 માહરી હો ! પ્રભુ ! માહરી પૂગી આશ,
 તાહરી હો ! પ્રભુ ! તાહરી દ્રષ્ટી હુઈ હવેજી !
 વાઘજી હો ! પ્રભુ ! વાઘજી મુનિનો ભાણુ,
 પન્નરમા હો ! પ્રભુ ! પન્નરમા જિનને વિનવેજી ॥૫॥

卐

卐

卐

(૭૮૪) (૩૩-૧૬) શ્રીશાંતિનાથજિન સ્તવન
 (દેશી મથુરાની)

સોળમા શાંતિ જિનેશ્વર હો રાજ, ચક્રી પંચમ એહ હો !
 -મન મોહન સ્વામી ।

વિનવું હું શિરનામી હો ! રાજ !

તું મુજ અંતરજામી હો-મન૦ ।

ઉપકારી ત્રિહું લોકના હો ! રાજ !

જિન જગ રવિ શશિ મેહ રે -મન૦ ॥૧॥

માહરે તુમશું પ્રીતડી હો ! રાજ !

તું તો સદા વીતરાગ હો-મન૦ ।

લિન્ન સ્વભાવ તે કિમ મિલે હો ! રાજ !

ઈમ નહીં પ્રીતિનો લાગ હો-મન૦ ॥૨૧॥

હું મોહિ મુંઝયો ઘણું હો ! રાજ !

તું નિરમોહી ભદ્રંત હો-મન૦ ।

તું સમતા-સુખ સાગર હો ! રાજ !

હું જગ મમતાવંત હો- મન૦ ॥૩૧॥

હું જડ-સંગે રંગીઓ હો ! રાજ !

તું ચિદાનંદ-સ્વરૂપ હો-મન૦ ।

ભવ-વૃણ્ણા મુજને ઘણી હો ! રાજ !

તું શીતળ જગ-ભૂપરે-મન૦ ॥૪૧॥

ઈમ બિહું લિન્નપણાથકી હો ! રાજ !

કિમૈ એક તાન મિલાય હો-મન૦ ।

સ્વામી-સેવક અંતરે હો ! રાજ !

કિમ લહું ! સ્વામી ! પસાય રે-મન૦ ॥૫૧॥

પણ ભક્તિ નિર્મળ કરી હો ! રાજ !

અહનિશ કરું તુમ સેવરે-મન૦ ।

આશ્રિત જાણી સંઘડો ! રાજ !

પાર ઉતારો દેવ હો-મન૦ ॥૬૧॥

તુમ નાથે હું સ-નાથ છું રાજ !

ધન્ય ગણું અવતાર ! હો-મન૦ ।

વાઘજી મુનિના ભાણુને હો ! રાજ !

આપો શિવસુખ સાર હો-મન૦ ॥૭૧॥

(૭૮૫) (૩૩-૧૭) શ્રીકુંથુનાથ જિન સ્તવન

(અજિત સયાને જિનજી ! અજિત સયાને-એ દેશી)

તીરથ નાયક લાયક કુંથુ યુષ્ણીજે,

કુંથુ યુષ્ણીજે નિજ વીનતિ ભણીજે—૧૧૧

સાહિબ અરજ સુણીજે

અરજ સુણીને જે લેખી ગણી જે—સાં ॥

નિજપદ સેવક બાણી વંછિત કીજે,

વંછિત દેઈ આશા પૂરણ કીજે—સાં ॥

સુરતર સમ સુખદાયક બાણી,

બાણીને સ્વામી આગળ માંડયો છે પાણિ સાં

તુમસમ દાયક બીજે નહીં ગુણ ખાણી,

ત્રિભુવન પ્રભુતા સઘળી તુજમેં સમાણી સાં ॥૨૧॥

રાગી જે દેવા જગમેં તેને ન યાયું

યાયું તો માયું પ્રભુજી મુખથી રાયું સાં

તું જિન આપે તે તો નહીં કાયું,

બાયું જે આપે છે તે શિવસુખ સાયું સાહેબં ॥૩૧॥

યદ્યપિ બહોળા યાચક છે તુજ સ્વામી,

સ્વામી તું માહરે એક અંતર જામી સાં ।

આશ્રિત ઉવેખિયે વિસરામી,

ધામીયે શિવસુખ એહવો અવસર પામી. સાહેબં ॥૪૧॥

ખોટ ન દીસે કોઈ પ્રભુને ખજાને,

શ્યાને વિલંબ કરો મુજ દાને સાં ।

વાઘજી મુનિનો ભાણુ પ્રભુ બહુ માને

નિજ માનવ ભવ ધન્ય ધન્ય માને. સાહેબં ॥૫૧॥

(૭૮૬) (૩૩-૧૮) શ્રી અરનાથજિન સ્તવન
(ઘણરા હોલા એ દેશી)

અરે જિનવર અઠારમોરે,

સાતમો ચક્રી સુખકર-સ્વામી ।

જય જય દેવી નંદન જય ! શિવગામી

ભવ સાયરનોં અર^૧ લહયો રે,

હર કર્યો ભવચક્ર-સુખકર સ્વામી. ॥૧॥

જન્મ સમે હોય પ્રભુતણેરે,

ત્રિભુવન માંહી ઉઘોત. સુખં ।

^૨ભારાકુલ ^૩ધરા વીસમેરે,

નારકી સુખીયાં હોત.-સુખં ॥૨॥

દ્વિશિ પ્રસન્ન સરવે તદ્દારે, અનુકૂળ વાય સુવાય-સુખં

સુરલોકે વધામણા રે, વાસવ હર્ષ ન માય.-સુખં ॥૩॥

છપ્પન્ન દ્વિશિકુમરી તિહારે, નિજ નિજ રિદ્ધિ સમેત-સુખં

સ્નાન-વિભૂષાદિક કરેરે, પ્રભુશું અધિકે હેત-સુખં ॥૪॥

સુરગણ મળી સુરગિરિ જઈરે, અભિષેકે જગનાહ;-સુખં

નિજ ભવ ધન્ય ગણે થુણેરે,

જય જય જગ-સચ્ચવાહ-સુખં ॥૫॥

નૃપ કારાગૃહ છોડવેરે, દિવ્યે દાન અપાર, સુખં ।

ધર્મ માનવ સુખીયા સહુરે,

પશુ સુખ પટહ અમાર-સુખં ॥૬॥

૧. કિનારો, ૨. ભારથી થાકેલ ૩. પૃથ્વી.

ઈમ સહુને સુખાકારીયારે; સુખ કરેા મુજને દયાળ;-સુખં
વાધળ મુનિના ભાણુને રે,

ઘો શિવસુખ વિશાળ-સુખં ॥૭૧॥

卐

卐

卐

૭૮૭ (૩૪-૧૯) શ્રી મલ્લિનાથ જિન સ્તવન
(જાટડીની-દેશી)

સુકૃતવલ્લિ-વિતાન વધારવા, શ્રી મલ્લિજિનવર જલધાર;
મોહમહા પલ્લિપતિ હરાળ્યો. ભવહલ્લીસક^૧ નહિ લગાર.

ત્રિભુવન મોહ્યો પ્રભુજીને દરિસણે,

જિમ મોહ્યા ખટ રાજન ।

તે પણ બોધ્યા જિન વચનામૃતે,

પામ્યા શિવપુર સૌખ્ય નિધાન-ત્રિં ॥૧-૨॥

ત્રણસેં કુમરી રાજ તણી અમરી સરખું રૂપ ।

સાથે વ્રત અને દાન ગ્રહી લહ્યું,

તિણે દિન કેવળજ્ઞાન અનૂપ-ત્રિં ॥૩॥

મનકામિત સુખદાયક કુંભ જે,

જગમે કામકુંભ કહેવાય ।

અગણિત દેતા સુણી લાંછન મિષે;

સેવે કુંભનૃપાંગજ પાય-ત્રિં ॥૪॥

પ્રભાવતી પુત્રી સાવિત્રી જગતની,

ઓગણીસમે તીરથ નાથ ।

વાઘજી મુનિના શિષ્ય ભાણુચંદ્રને,

પાર ઉતારો ગ્રહી હાથ-ત્રિ.૦ ૥૫૥

ક

ક

ક

(૭૮૮) (૩૩-૨૦) શ્રીમુનિસુવ્રતજિન સ્તવન

(સાહિબા શામળીયારે-એ દેશી)

શ્રી મુનિસુવ્રત જિન વીસમારે, મહિમાનિધિ મહારાજ
પ્રગટયા પૂરવ ભવે કર્યારે,

પુણ્ય અમારાં આજ-મોહન ! મનવસીયારે. ૥૧૥

તુજ સરીખો સાહિબ મળ્યો રે, હવે કોઈ નાચે દાય, ।
માલતી મોહ્યા 'ભૂ'ંગને રે,

આકરકુસુમ ન સુહાય-મોહન૦ ૥૨૥

રાજહંસ માનસ રમેરે, ન ગમે છીલ્લર નીર ।

ગજ રશર-વન કિમ રતિ લહે રે,

જે રહે રેવાતીર-મોહન૦ ૥૩૥

દ્રાખ લહી અમૃત સમીરે. લીંગોળી કુણુ ખાય ।

તિમ પ્રભુ મળીયા અન્યનીરે,

વાંરછા કિમહિ ન થાય-મોહન૦ ૥૪૥

મેં તું સ્વામી સેવીયોરે, સેવકજન આધાર ।

વાઘજી મુનિના ભાણુનેરે;

આપો શિવસુખ સાર-મોહન૦ ૥૫૥

ક

ક

ક

(૭૮૯) (૩૩-૨૧) શ્રીનમિનાથ જિન સ્તવન
 હરેમારે શાંતિ જિજ્ઞેસરદેવ, અરજ સુણા એક માહરીજરે
 હરે ! નમિ જિન અમિત આણુંદ,

૨મંદર સમ ૩ધીરિમ ગુણે-જરેજી ।

હરે ! જેહ વિજયનૃપનંદ, ચંદન સમ શીતળપણે-જી ૧૧ ।

હરે ! વપ્રાઉદર-સરહંસ, વંશ ઈજ્યાગ સુહંકરૂં-જી ૧૦

હરે ! કંસ-ભાજન જળ અંશ,

જિમ નિલેંપી જિનવરૂં-જી ૧૨ ॥

હરે ! નીલકમળ પ્રભુ પાય, લાંછન મિસ સેવા કરે-જી ૧૦

હરે ! દ્રવ્યરમાનો ગેહ, ભાવરમા આશા ધરે-જી ૧૩ ॥

હરે ! એકવીશમા અ-કષાય, શિવસખાય લાયક મળ્યા-જી ૧૦

હરે ! પૂરણ થઈ મુજ આશ,

આજ મનોરથ સહુ ફળ્યા-જી ૧૪ ॥

હરે ! દ્યાનિધિ જિનદેવ, સેવા કરૂં હું તાહરી-જી ૧૦ ।

હરે ! કહે વાવજી મુનિનો ભાણુ,

સફળ કરેજ્યો માહરી-જી ૧૫ ॥

卐

卐

卐

(૭૯૦) (૩૩-૨૨) શ્રી નેમિનાથ જિન સ્તવન
 (દેશી-ખિંદલીની)

ખાવીસમા નેમી જિણુંદા,

મુખ દીઠે પરમ આણુંદા હો- જિનવર સુખકંદા ।

૧ ઘાસનું જંગલ. ૨ મેરૂ, ૩ ધીર, ૪ કાંસાનું વાસણ

ભવિ-કુમુદ ચકોરી ચંદા,

સેવે ૧૧૪૨૬-૨૪૬૬ હો-જિન૦ ૧૧૧૧

પરમાતમ પૂરણ આનંદા,

પુરુષોત્તમ પરમ મુણિંદા હો-જિન૦ ।

જય જય જિન જગત જિણંદા,

ગુણગાવે ત્રિભુવન વૃંદા હો-જિન૦ ૧૧૨૧

૩ધીરીમ જિત મેરૂગિરીંદા,

ગંભીરમ ૪શયન-મુકુંદા હો-જિન૦ ।

સદા સુપ્રસન્ન મુખ અરવિંદા,

દંત છબિ ચિત્ત મસિ ૫કુંદા હો જિન૦ ૧૧૩૧

શ્રીસમુદ્રવિજય નરીંદા,

માતા શિવાદેવીના નંદા હો-જિન૦ ।

વારંતા પ્રભુ ભવ-ભય કંદા,

ફરે કર્યા દુઃખ કંદા હો-જિન૦ ૧૧૪૧

જેણે જીત્યા મોહ-મૃગેંદા,

શિવસુખ-લોગી ચિદાનંદ હો-જિન૦ ।

વાઘજી મુનિ શિષ્ય ભાણુચંદા,

ઈમ વિનવે હર્ષ ૬અમંદા હો-જિન૦ ૧૧૫૧

卐

卐

卐

૧ દેવ, ૨ સમૂહ, ૩ પૈય, ૪ સમુદ્ર, ૫ સ્વેતપુષ્પ,
૬ ધણી

(૭૯૧) (૩૩-૨૩) શ્રીપાર્શ્વનાથ જિન સ્તવન
(છેડાનાંજી ! છેડાનાંજી ! કોશ્યાજી !

વિષયનાં વયણાં વિરૂપા છેડા નાંજી-એ દેશી)

શ્રીપાર્શ્વજિનેશ્વર પરમ દયાનિધિ,

દુખહર સુખકર સ્વામી ।

૧કુમતનિશા-તિમિરાંતક દિન મણિ, શિવમંદિર વિસરામી
અંધરયામી ! તું પરિણતિ નિઃકામી,

તેં નિજ પ્રભુતા પામી-અંતર૦ ૥૧૥

તું સુખદાયક ત્રિભુવનનાયક, નતસુરનાયક વૃંદ ।

મોહ-મહા તસ્કરપતિ-ધાયક,

જ્ઞાયક સકળ જિણુંદ-અંતર૦ ૥૨૥

અસુરાધમ કમઠાસુર શઠતર; હઠભર દલન રઘરદૃ ।

જયકૃત કર્મસમૂહ વિજય જિમ,

મદિત મદન ઉમરદૃ-અંતર૦ ૥૩૥

અશ્વસેન નૃપકુળ તિલકોપમ, લાંછન જાસ ફણિંદ ।

લબ્ધ પસાય કષાય-ખહુજે,

ફણિધર હુવો ધરણિંદ-અંતર૦ ૥૪૥

વામાસુત અદ્ભુત ગુણગણયુત, ઈંદ્રનીલ સમકાય ।

વાઘજી મુનિનો ભાણુ કહે પ્રભુ !

કરો શિવસુખ પસાય-અંતર૦ ૥૫૥

卐

卐

卐

૧ મિથ્યાત્વરૂપી=નિશા રાત્રિના તિમિર=અંધકારને દૂર કરવા
દિનમણિ=સૂર્ય ૨ ઘંટી

(૭૯૨) (૩૩-૨૪) શ્રીમહાવીરજિન સ્તવન

(મનોહર મિત્ત ! એ પ્રભુ સેવો-એ દેશી)

શ્રી વીરજિન કેવળ નાણી, લોકોત્તર ગુણગણ ખાણી, ।
જસુ પાંત્રીશ ગુણ યુત વાણી; ગણધર મતિજળધિ સમાણી
સુહંકર દેવ ! એ જગદીવો,

શાસન નાયક ચિરંજીવો-સુહં ॥૧॥

ધન્ય સિદ્ધારથ નૃપવંશ, ત્રિસલા કુખે રાજહંસ ।

જેહમાં નહીં પાપનો અંશ;

જશ ત્રિભુવન કરે પ્રશંસ-સુહં ॥૨॥

જસ મૂળ અતિશય ચ્યાર, ઉત્તર ચોત્રીસ પ્રકાર; ।

ત્રિભુવન સુખકારી વિહાર, સર્વિ ભવ્યતાના આધાર-સુહં ॥૩॥

જસ નિર્મળ ભાસુર અંગ, ધ્યામીકર સમ વડ રંગ ।

નિતુ તેજ પ્રતાપ અભંગ, જોતાં વાધે ઉછરંગ-સુહં ॥૪॥

જય ચોવિશમા જગલાણુ, શિર છત્ર ધરી પ્રભુ આણુ ।

વાઘજી મુનિ સેવક ભાણુ,

લહે દિન દિન કોડી કલ્યાણુ-સુહં ॥૫॥



શ્રી વર્દ્ધમાન-સ્વામિને નમઃ
 (શ્રી અખ્યયચંદ સૂરીશ શિષ્ય)
 શ્રી ખુશાલમુનિજી કૃત
 સ્તવન-ચોવીસી

(૭૯૩) (૩૪-૧) ઋષભદેવ જિન સ્તવન

(રાયજી હમણે હિંદુવાણી રાજ કે રાજ ગરાશિયારેલો)

પ્રભુજી ! આદીસર અલવેસર જિન અવધારિયે રે-લો,

પ્ર૦ સુ-નજર કરીને સેવક માન વધારીયે રે-લો ।

પ્ર૦ તારક એહવો બિરૂદ તુમારો છે સહી રે-લો,

પ્ર૦ તિણે મનમાંહી વસિયા ઓર ગમે નહી રે-લો. ॥૧॥

પ્ર૦ મરૂદેવીના નંદન મહેર કરીજીએ રે લો,

પ્ર૦ યોગગિયા બાણીને સમકિત દીજીએ રે-લો ।

પ્ર૦ કરમ કસાઈ ભારી દૂર નિવારિયે રે-લો,

પ્ર૦ નિરમળ મુજને કરીને પાર ઉતારિયે રે-લો. ॥૨॥

પ્ર૦ મનમંદિરિયે માહરે વહેલા આવળે રે-લો;

પ્ર૦ નિજ રચનુચર બાણીને ધરમ બતાવળે રે-લો ।

૧ સેવા કરનારા ૨ સેવક

- પ્ર૦ ઇણુ જગમાં ઉપગારી લવિને તારણુ રે-લો;
 પ્ર૦ ધ્યેય સરૂપે તું છે લવલય વારણુ રે-લો ॥૩૧॥
 પ્ર૦ અહનિશિ મુજને નામ તમારું સાંભરે રે-લો,
 પ્ર૦ તિમ તિમ માહરે અંતર આતમ અતિ ઠરે રે-લો ।
 પ્ર૦ બહુ ગુણનો તું દરિયો ભરિયો છે ઘણું રે-લો,
 પ્ર૦ તેમાંથી શું દેતાં જાયે તુમતાણું રે-લો. ॥૪૧॥
 પ્ર૦ તુમ 'પદ્મજની' સેવા કલ્પતરૂ સમી રે-લો,
 પ્ર૦ મુજને આપજો તેહ કહું પાયે નમીરે લો ।
 પ્ર૦ શ્રીઅખયચંદ સુરીશ પસાય તે સાધશું રે લો,
 પ્ર૦ દુશ્મન દૂર કરીને સુખથી વાધશું રે લો. ॥૫૧॥

(૭૯૪) (૩૪-૨) શ્રીઅજિતનાથજિન સ્તવન

(આદિ તે અરિહંત અમઘેરે આવો રે-એ દેશી)

- શ્રી અજિત જિનેશ્વરદેવ માહરે સ્વામી રે,
 મેં પૂરવ પુણ્ય-પસાય સેવા પામી રે ।
 મન-ચિંતિતનો દાતાર મુજને મળિયો રે,
 હવે મિથ્યામતિનો જોર સહુયે ટળિયો રે. ॥૧॥
 તો સમ બીજો કેઈ દેવ માહરે નયણુરે,
 નાવે ઇણુ સંસારમાંહિ સાચે વયણુરે ।
 તમે નિરાગી ભગવાન કરૂણા રસિયારે,
 આવીને મનડામાંહી ભગતેં વસિયારે. ॥૨॥

વિજયા રાણીના નંદ મહેર કરીજો રે,
 જિતશત્રુ નૃપકુળચંદ હુરિત હરીજો રે ।
 મનમોહન શ્રી જિનરાજ કંચન કાચારે,
 અવલંબ્યા મેં મહારાજ તોરા પાચારે ॥ ૩ ॥

ધંમ જાણીને જગદીશ મુજને તારો રે,
 દુઃખ દારિદ્ર ભયથી નાથ મુને ઉગારો રે ।
 ઝાઝી ઝાઝી શી વાત તુમને કહીએ રે,
 પ્રભુ ખાંદ્ય ગ્રથ્યાની લાજ હવે નિરવહિયેરે । ૪ ॥
 તુમને છોડીને ચોર કેને જાયું રે,
 જિન ! દાખો મુજને તેહ કહિયે સાચું રે,
 શ્રીઅખયચંદ સૂરીશ ચરણ પસાયે રે,
 ખુશાલમુનિ મન ખંત પ્રભુ ગુણ ગાયેરે ॥ ૫ ॥

(૭૯૫) (૩૪-૩) શ્રીસંભવનાથ-જિન સ્તવન

શ્રીસંભવ ભવ-ભયહરે,
 જગજીવન જિનઆધાર-અંતરજામીરે ।
 જેહનું મુખ દીકાં થકાં,
 સુખ પામે ભવિક અપાર-અંતરજામીરે ॥ ૧ ॥
 આંખડી કમળની પાંખડી,
 વળી 'વદન શરદનો ચંદ;-અંતર ૦ ।
 વાણી મીઠી જિનતણી, સાંભળતાં થાય આણુંદ.-અંતર ૦ ॥ ૨ ॥

૧ મુખ

૧અર્ધશશિ ૨ભાલ વિરાજતો,

અધર પ્રવાળી જેમ-અંતર૦ ૧

૩દશન ૪છળિ હીરા જિશી તે દેખ્યાં વાધે પ્રેમ.-અંતર૦ ૧૩

અ-મળ અ-રોગ શુચિ સદા,

વળી અદ્ભુત દેહ-સુવાસ-અંતર૦ ૧

શુભલક્ષણ જે જગતમાં,

તે સહુ છે તાહરી પાસ-અંતર૦ ૧૪૧

અનુપમ ઉપમ તાહરે, કહો દીજે કેણી રીત-અંતર૦ ૧

શ્રી અખયચંદ સૂરીશનો,

ખુશાલ નમે એક ચિત્ત.-અંતર૦ ૧૫૧

(૭૯૬) (૩૪-૪) શ્રીઅભિનંદન જિન સ્તવન

(હું'રે આવીશું મહી વેચવા રે લોલ-એ દેશી)

અભિનંદન અરિહંતજીરે લોલ,

સાંભળો ચતુર સુખણ મોરા સાહેબ જીરે ૧

હવે નહિં સેવું ખીજા દેવને રે લોલ ૧

તું લાગે મુજને ઘણીરે લો,

વાદ્દો જીવન પ્રાણ-મોરાં હવે ૧૧૧

તું સમરથ શિર માહરે લો,

તારણ તરણ જિહાજ-મોરાં

જે કોઈ તુજ પદ ૫આસર્યા રે લો,

તેહ લહ્યા અવિચળ રાજ-મોરાં હવે ૧૨૧

૧ આઠમનો ચંદ્ર ૨ કમળ ૩ દાંત ૪ ક્રાંતિ ૫ આશ્રય લીધો

કાળ અનાદિ અનંતનોરે લો, હું લખ્યો લવની રાશ-મોરાં
હરધ અરધ તિરછી ગતેરે લો,

વસિયો મોહનિવાસ—મોરાં હવેં ॥૩૩॥

મેં અપરાધ કર્યા ઘણારે લો, કહેતાં નાવે પાર-મોરાં ।
હવે તુજ આગળ આવિયોરે લો,

સુજ ગરીબને તાર—મોરાં હવેં ॥૪૪॥

પારંગત પરમેશ્વરે લો, ભગતિવત્સળ પ્રતિપાળ—મોરાં ।
શ્રી અખયચંદ સૂરીશનો રે લો,

શિષ્ય નમે ખુશિયાળ—મોરાં હવેં ॥૫૫॥

(૭૯૭) (૩૪-૫) શ્રી સુમતિનાથજિન સ્તવન

(ગરબો દોણેને કોરાવ્યો કે, નંદજીના લાલ રે-એ દેશી)

સુમતિજિણેસર સાહિબ સેવો કે—ભવિ ચિત લાય રે,
એ તો ટાળે કુમતિ કુટેવો કે—કરી સુપસાય રે ।

સુર નર દેવોનો એ દેવો કે—ભવિં ।

સહજે આપે સમકિત મેવો કે, કરી સુપસાયરેં ॥૧॥

ઈશુ દુક્કર પંચમ આરે કે—ભવિં,

એહને નામતણે આધારે કે—કરીં ।

જે નર ભાવથકી સંભારે કે—ભવિં,

તેહના ભવભય દૂર નિવારે કે—કરીં ॥૨॥

સોહે હીરો જેહવો જાયો કે—ભવિં,

એ તો જિનજી તિણિપરે સાચો કે—કરીં ।

હોવે જેહની મિથ્યા વાચો કે—ભવિં,
 તેહને સેવે જે હોય કાચો કે—કરીં ॥૩૩॥

ગુણ વિણ રાચે ઉંચે ઠામે કે—ભવિં,
 તે નહી ગુણવંતનું પદ પામે કે—કરીં ।

૧વાયસ શિખરે જઈને બેસે કે—ભવિં,
 ઉપમ ગરૂડતણી કિમ લેશે કે—કરીં ॥૩૪॥

તરતમ ભેગે સગવડ નાવે કે—ભવિં,
 જે વિષયાદિક તાપ શમાવે કે—કરીં ।

તેણે જગનાયક કહેવાય કે—ભવિં
 ખુશાલમુનિ હરખિત થાય કે—કરીં ॥૩૫॥

(૭૯૮) (૩૪-૬) શ્રી પદ્મપ્રભજિન-સ્તવન

(જોગમાયા ગરબે રમે જો-એ દેશી)

પદ્મપ્રભ જિનરાજનાં જો, રૂડા ચરણકમળની છાંહજો ।
 વસતાં વિષય-કષાયનાં જો,
 સર્વ દૂર ટળે દુઃખ-દાહજો—પદ્મં ॥૧॥

આ ભવ પરભવ તુજ વિના, જો કોઈ કર્મ મર્મના અંતજો ।
 કોઈક રે એહવો નહી જો,
 બળિ સુખકર સાહિબ સંત જો—પદ્મં ॥૨॥

અગણિત મહિમ ૨પુરંદર જો, ૩તનુ સુંદર ૪વિદ્રુમવાન જો ।

૧ કાગડો ૨ ઇંદ્ર ૩ શરીર ૪ પરવાળા જેવું (લાલ)

મંદરગિરિ જિમ ધીરમાં જો,
 આપે સેવકને વંછિતદાન જો—પદ્મ૦ ॥૩૭॥
 તુજ રમોટિમ ગુણ અરવિંદમાં જો,
 થયો મન-મધુકર એક તાનજો ।
 વિનય વિધે રસિયા રહેજો,
 લહે ભક્તિ-પરાગ અમાન જો—પદ્મ૦ ॥૪૦॥
 ધરનૃપતિકુળચંદ્રો જો, રાણી સુસીમામાત મદ્દાર જો ।
 શ્રી અખયચંદ્રસુરીશનો જો,
 કહે ખુશાલમુનિ હિતકાર જો—પદ્મ૦ ॥૪૫॥

(૭૬૯) (૩૪-૭) શ્રીસુપાર્શ્વનાથજિન સ્તવન
 (હાંજ આઠે ઓરાને નવ ઓરડી રે,
 તિહાં વસે રંગેતા ચાર રે-એ દેશી)
 હાંજ ! જિમ નિરખું તુજ જિંબને રે,
 હોય હરખ અધિક મુજ મન્ન રે ।
 જિન સુપાસ સોહામણા ।
 હાંજ ! વિષય-રહિત તાહરાં નેણ છે રે,
 ઘણું મુખડું સદા સુપ્રસન્ન રે—જિન૦ ॥૧॥
 હાંજ ! ભાવ-સ્વરૂપ તુજ સાંભરે,
 તિહાં પ્રાતિહારજ મનોહાર રે—જિન૦ ।
 હાંજ ! સુર-નરપતિ વિદ્યાધરા રે,
 તિહાં સેવ કરે નિરધાર—જિન૦ ॥૨॥

૧ મેષ્પર્વત ૨ મોટાર્ધ

હાંજી ! લોકલોક પ્રકાશતા રે,

તિહાં વાસતો ભવિ-મન બોધ રે—જિન૦ ।

હાંજી ! શાશ્વતુ શાસન તાહરું રે,

તિહાં થાયે આશ્રવ-રોધ રે—જિન૦ ॥૩॥

હાંજી ! હાસ્યાદિક તાહરે નહી રે,

તિહાં નહી ક્રોધાદિક ચાર રે—જિન૦ ।

હાંજી ! ચોત્રીશ અતિશય રાજતો રે

સવિ જન-મન-કજ-દિનકાર રે—જિન૦ ॥૪॥

હાંજી ! તાહરો તુજ પ્રતિબિંબમાં રે,

તિહાં ભેદ ન હોય લગાર રે—જિન૦ ।

હાંજી ! શ્રી અખયચંદ સૂરીશનો રે,

શિષ્ય ખુશાલમુનિ હિતકાર રે—જિન૦ ॥૫॥

(૮૦૦) (૩૪-૮) શ્રી ચંદ્રપ્રભજિન સ્તવન

(આસો માસે શરદપૂનમની રાતજો-એ દેશી)

સાહિબો મારો ! ચંદ્રપ્રભ જિનરાજ જો,

ભવિક રે ચકોર નયનડે ચંદ્રમા રે લો ।

સાહિબ માહરા ! તીન ભવન શિરતાજ જો,

છાજે રે ઠકુરાઈ પદવી તીરમાં રે લો ॥૧॥

સાહિબ માહરા ! વાણી યોજન માનજો,

રૂડીરે ધુની ગાજે મેઘતણી પરે રે લો;

૧ ધ્વનિ-અવાજ

- સાહિબ માહરા ! 'કૃષ્ણ' પુઠે એક તાન જે
સાંભળતાં ન રહેરે સંશય ચિત્ત ઠરે રે લોાં ॥૨॥
- સાહિબ માહરા ! દેવ રચિત તિહાં ફૂલ જે,
પંચરે વરણના પગર સોહામણો રે લોાં ।
- સાહિબ માહરા ! ચામર છત્ર અમૂલ્ય જે,
મુઠેરે લામંડળ સોહે અતિ ઘણો રે લોાં ॥૩॥
- સાહિબ માહરા ! સુર-દુદ્ધલિનો નાદ જે,
વાજેરે લાંબે સવિ દુખડાં દેહનારે લોાં ; ।
- સાહિબ માહરા ! જાયે દૂર વિષાદ જે,
પાતિકડાં રે ઉભાં ન રહે કેહનાં રે લોાં ॥૪॥
- સાહિબિયાણ ! તું છે માહરો નાથ જે,
હું છું રે લઘુ સેવક દિલમાં જાણુજે રે લોાં ।
- સાહિબાણ ! તું શિવનગરીનો સાથ જે,
મુજરોરે ખુશાલમુનિનો માનજે રે લોાં ॥૫॥



- (૮૦૧) (૩૪-૯) શ્રી સુવિધિનાથજીન સ્તવન
(ઊગ્યો સરદપૂનમનો ચંદ્ર, મુજને ઉપજ્યો રે આનંદ)
સુવિધિ જિનેસરણશું પ્રીત, માહરા મનની અવિહત રીત ।
એહ વિણ ન ગમે બીજે કોઈ, જાણું રહીએ સેવક હોય.૦ ॥૧॥
મોહ્યો માલતી-ફૂલે રલંગ, ન કરે બાઉલ તરૂં રંગ ।

૧ કાનને સ્પર્શે છે ૨ લમરો

ગંગાજળમાં નાહ્યા જેહ, છીલર જળશું ન કરે નેહ. ૦ ॥૨॥
 સરોવર ભરિયાં બહુજે નીર, જળધર વિણ નવિ પિયે પીર ।
 કમલિની દિનકર કુમુદિની ચંદ, એહથી વાધે અધિક આણુંદ.
 ગૌરી કમળા હર હરી જેમ, વાધે દિન દિન વધતો પ્રેમ ।
 કોકિલ પામી તરૂં સહકાર, મંજરીશું તે અધિકો પ્યાર. ॥૪॥
 તિણિપરે તુમ ગુણશું છે રાગ, માહરો જાગ્યો પૂરણુ ભાગ ।
 શ્રી અખયચંદ સૂરીશ પસાય,

ખુશાલમુનિ પ્રભુના ગુણગાય. ॥૫॥



(૮૦૨) (૩૪-૧૦) શ્રી શીતળનાથ જિન સ્તવન ।
 (આંગણે ઉભા કાનજી ને ગરબે રમે ગોપી રે-એ દેશી) .

દશમા શીતળનાથ સેવો ભવિકા, રૂડે ભાવરે,
 તેહશું અંતર કેમ રખાયે, જેહશું નેહ જમાવરે ।
 દાતા એહવું નામ ધરાવે, કોઈ ગુમાની ભૂપરે,
 તું તો ખીર સમુદ્ર સરિખો, મેં તો ખાલી કૂપરે. ॥૧॥
 એર ખબુઆ તગતજે, વળી તું તો તેજે ભાણરે,
 ગિરજો જાણી આદર્યો મેં, મનમાં મહેર આણરે, ।
 હુઃખડાં માહરાં દૂર ટાળો, પાળો મહારાજરે,
 સહજે હેતે નૈન નિહાળો, રાખો માહરી લાજરે. ॥૨॥
 કરૂણાવંત કહાવે તું તો, હું તો કરૂણા ઠામ રે,
 કરજે વેગે સાહિબિયાને, આપી જે ઇનામ રે ।

અંતરજામી માહરો તું આતમ આધારે,
 મનની જાણે વાતડી તો, શે ન કરે ઉપગારે. ॥૩૭॥
 તું છે માહરો નાથજીને, હું છું તાહરો દાસરે ।
 મનને મોજે મુજને આપો, સાઈં સુખ વિલાસરે ।
 શીશ નમાવી તુજને લાખું, સુણ તું દીન દયાળરે ।
 નામ તુમારો જપવાનો ઘણો, ઋષિ ખુશાલને ઢાલરે. ॥૪૦॥

(૮૦૩) (૩૪-૧૧) શ્રીશ્રેયાંસનાથજિન સ્તવન

(કાનજી કાળાને વાંસળીવાળા ન કરે તું ચાળા-એ દેશી)
 શ્રી શ્રેયાંસ કૃપાકર ઠાકુર, ચાકરશું ચિત્ત દીજે રે,
 લોકાલોક પ્રકાશ ¹દિવાકર, માહરાં વચણ સુણીજે રે ।
 સુગુણતણા ²રતનાકર સ્વામી, વહિલી સુ-નજર કીજે રે,
 તાહરે છે બહુ સેવક તો ઈક, મુજ મન તુજશું રીઝે રે ॥૧॥
 ન ગમે મુજને તુજ વિણ બીજે, દીઠો ³સુહણ નાથ રે,
 તો કિમ પરતક્ષ તેહને દેખું, તે નહી શિવપુર સાથ રે ।
 ઈક નિસનેહી એક સનેહી, નેહ કિણિ પરે થાય રે,
 એકપખી જે પ્રીત કરતાં, કિમ નિરવાહી જાય રે ॥૨॥
 રાખે મનડાં તું સવિ જનનાં, નિજ મન કયાં ન મેળે રે,
 લલચાવે નિજ રૂપ દેખાડી, સહજ સલાવમાં ખેલે રે ।

....

....

....

....

રાગે કરીને ભવિને રંજે, પણ તું તો વીતરાગ રે ॥૩॥

૧ સૂર્ય

૨ સમુદ્ર

૩ સ્વપ્ને

એહવાશું મેં ચિત્તડું બાંધ્યું, પહેલાં કાંઈ ન વિચાર્યું રે,
હવે નિરવાહન પ્રભુથી હાશે, એ નિશ્ચય મેં ધાર્યું રે ।
સંગ રહિતને મિળવાનું જે, તે કારણ મેં જાણ્યું રે,
ત્રિકરણ જોગે લક્ષિત કરી જે હિયડામાંહી આણ્યું રે ॥૪૧॥

મુજને ભાવે લક્ષિત કરતાં, હિત કરીને શીખાવો રે,
હું મૂરખ મતિહીન મહાશક, એહવો શું સમજાવો રે ।
શ્રી અખયચંદ સૂરીશ સુગુરની, કરૂણા જ્યારે થાશે રે,
શિષ્ય ખુશાલમુનિના દુશ્મન, દહ દિશિ દૂર પલાશે રે ॥૪૨॥

(૮૦૪) (૩૪-૧૨) શ્રી વાસુપૂજ્યજિન સ્તવન

(અનિ હારે વાહાલો વસે વિમળાચળે રે-એ દેશો)

અને હારે મહારો પ્રભુ દિયે છે દેશના રે,
તે તો સાંભળે છે લવિજન્ન ।

સમવસરણ બેઠા શોભતા રે,
ભાળે ચાર મુખે સુ-પ્રસન્ન—પ્રભુ ॥૧॥

અં બારે પરવદા તિહાં મિળી રે, સવિ બેસે આપણે ઠાય ।
વાણી જોજન ગામિની રે,
એ તો સુણતાં આવે ઠાય—પ્રભુ ॥૨॥

અં રૂડાં વયણડાં નીકળે રે. ધુની મેઘ પડે ગાંભીર ।
પામર વચને ન મિલે કંઈ રે,
ઉંચે શબ્દે સાહસ ધીર—પ્રભુ ॥૩॥

અં પડછંદા ઉઠે ખોલતાં રે, અતિ સરલપણે અલિરામ ।
 માળવકૌશિક રાગથી રે, જે આણે હિયડું કામ—પ્રભું
 અં શ્રી વાસુપ્રજ્ય જિન સાહિબા રે,
 મહારી મિથ્યામતિને ટાળ ।

ખુશાલમુનિને નિત આપણો રે,
 તું જાણીને થાજ્યો દયાળ—પ્રભું ॥૫॥

(૮૦૫) (૩૪-૧૩) શ્રીવિમલનાથજિન સ્તવન
 (આદીતે અરિહંત અમઘર આવો રે-એ દેશી)
 વિમળ જિનેસર દેવ-નયણે દીઠા રે,
 મૂર્તિવંત મહંત-લાગે મીઠા રે ।
 મધુરી જેહની વાણી-જેવી શેલડી,
 સાંભળતાં સુખ થાય-કામિત વેલડી—॥૧॥
 જાગ્યાં માહરાં ભાગ્ય-તુજ ચરણે આયો,
 પાપ ગયા પલાય-ગંગાજળ ન્હાયો ।
 દુધે વુઠ્યા મેહ-અશુભ દિવસ નાઠા,
 ફર ગયા દુઃખ દંદ-દુશ્મન થયા માઠા—॥૨॥
 હવે માહરો અવતાર-સફળ થયો લેખે,
 પણ મુજને એકવાર-નેહ નજરે દેખે ।
 સુરમણિથી જગદીશ-તુમે તો અધિક મિળ્યા,
 પાસા માહરે દાવ-મુંહ માગ્યા ઢળ્યા—॥૩॥
 ભૂખ્યાને માહારાજ-જિમ લોજન મિળે,
 તરશ્યાને ટાઢું નીર-અંતર તાપ ટળે ।

થાક્યો તે સુખપાળ એસી સુખ પામે,
તેમ આહતા મિત્ત મિજતાં હિત જામે—૧૪૧

તાહરે ચરણે નાથ હેજે વળગ્યો છું,
કદિય ન દેજો છેડ નહી હું અળગો છું ।
શ્રી અખયચંદસૂરીશ ગુરૂજી ઉપગારી,
શિષ્ય મુનિ ખુશાલ જાવે બલિહારી—૧૪૨

(૮૦૬) (૩૪-૧૪) શ્રીઅનંતનાથજિન સ્તવન
(સોનલા રે કેરડી ચાલ રૂપજાનાં પરાથાજિયાં રે-એ દેશી)
સાહિબારે ! અનંત જિનરાજ તુમે તો જઈ અળગા રહ્યા રે;
સાત રાજે રે ! એહવા દૂર તુમ દરશણના ^૧ઉમડયા રે ।
એ જગમાં રે લવિ-જન લોક તાહરા ગુણને ગાવતા રે,
મનશુદ્ધિ રે એકણુ-રાગ લાવના રૂડી લાવતા રે ॥૨૧॥
કહો તેહને આપણા દાસ રલેખવીને સંભાળશે રે,
કોણુ એહવો રે પૂરે પ્રેમ તુમ વિણુ બીજો પાળશે રે ।
તે માટે રે માહરા મનમંદિરમાં આવવું રે,
વીતરાગજી રે વિનતિ એહ માની સુખ ઉપજાવવું રે ॥૨૨॥
તે દેખી રે જાએ દુઃખ દોહગડાં દૂરે હરે રે ।
તિહાં ^૪લેખણુ રે કાગળ એક લિખવા નહી શાહી વળી રે,
કાંઈ ન ચળે ^૫વાટ-વિશેષ વિષય-કષાયે સંકળી રે ॥૨૩॥

૧ ઉમંગવાળા ૨ માનીને ૩ કાગળ ૪ કલમ ૫ રસ્તો

સસનેહા રે સુગુણ સુખાણુ, હિયડથી નવિ વિસરે રે,
 સાંભળતા રે વાર હજાર, બલિહારી તે ઉપરે રે ।
 જન ધહાંથી રે આવે ત્યાંહ, તિહાંથી ઇંહાં આવે નહીં રે,
 સંદેશે રે મુજને જોહ, સંભળાવે વાહલો સહી રે ॥૪॥
 હોય દોહિલો રે જોહનો યોગ, મિળવાનો તો મિત્તશું રે,
 કાંઈ કનાવો રે તેહશું નેહ, તે સંતાપની ભીતિ શું રે ।
 શ્રી ગુરુ રે અખયસૂરીશ, હેજ નજર શું જોયશે રે,
 ત્યારે ક્ષણશે કામિત વાત

પુશાલમુનિ હાખ જોયશે રે ॥૫॥

(૮૦૭) (૩૪-૧૫) શ્રીધર્મનાથજિન સ્તવન

ધરમ જિનેસર ધરમી જનશું, કામણુડું કિમ કીજે,
 સેવકના ચિત્તને ચોરીને પાછી ખખર ન લીજે ।
 ૧નિપટ નિરાગી થઈને એવા બેસી રહ્યા એકાંતે,
 શ્યો રઅવગુણ ? ગુણવંત પ્રભુજી !

અમને કહોને ખાંતે-ધરમ ॥૧॥

જિમ તુમે કીધું તિમ અમે કરશું કામણુડું તુમ સાથે,
 ભગતિ બળે વિધિશું વશ કરીને કરશું તુમને હાથે ।
 રાખશું અમે હિયડા ઉપર જાવા કયાંશ ન દેશું,
 નિશ-દિન મુખડું જોઈ જોઈ,

આનંદ અંગે લેશું-ધરમ ॥૨॥

૧ એકદમ ૨ વાંક

માહરું મન પાતિકડે મેલું તે હવે થાશે શુદ્ધ,
ભાખી જે કરુણાસાગર તેહવી કાંઈક યુદ્ધ !
તુમ વિણ કેહને પૂછું ? એહવી માહરી અંતર વાત,
કોઈને તેહવો ? સચણ રસખાચો.

જગમંધવ જગતાત-ધરમં ॥૩૧॥

ગંગાજળ પરે નિર્મળ જે નર તાહરા ગુણને ગાવે,
અનુભવ-યોગે જિન(નિજ) ગુણભોગે તે તુમ રૂપ કહાવે ।
ભાવે પાવે પાત્રન પટુતા પ્રાણી તે જગમાંહી,
વ્યસનાદિક તે નાવે ઝનેડાં જે ઝાલ્યા તે ખાંહી-ધરમં ॥૪૧॥
દૂર રહ્યો પણ નહીં હું અળગો વળગ્યો તાહરે પાય,
ધ્યાયક ધ્યાન ગુણે અવલંબી ધ્યેય—સરૂપી થાય ।
શ્રી અખયચંદ્રસૂરીશ—પસાયે થઈને એકી ભાવે,
હલશું—મિલશું ઇણિપુરે તુમને,

નકષિયુશાલ ગુણ ગાવે—ધરમં ॥૫૧॥

(૮૦૮) (૩૪-૧૬) શ્રી શાંતિનાથ જિન સ્તવન

(જગળામુખીરે મા જગતાં રે-એ દેશી)

સકળ સુખકર સાહિબોરે-શ્રી શાંતિ જિનરાયરે;

ભાવ સહિત ભવિ વંદવારે, શ્રીં

ઉલસિત તન મન થાય છે રે શ્રીં

૪વદન અનોપમ રાજતોરે શ્રીં શાંતિં ॥૧૧॥

૧ કુટુંબી

૨ મિત્ર

૩ પાસે

૪ મુખ

તે દીકાં ભવદુઃખ જાય છે રે—શ્રી૦,

જગગુરૂ મહિમા જાગતો રે—શ્રી૦ ।

સંપૂર્ણ સુખકંદરે—શ્રી૦,

ભવિજનને હિત વ્દાય છે રે—શ્રી૦ શાંતિ૦ ॥૨૦॥

મુજને તાહરા નામનોરે—શ્રી૦,

સ્પરમ રતિ-રસનો કામ છે રે—શ્રી૦ ।

નિશ— સૂતાં દિન જાગતાં રે—શ્રી૦,

હિયાથી ન વેગળો થાય છે રે—શ્રી૦ ॥૨૧॥

સાંભરતા ગુણ તાહરા રે—શ્રી૦,

આનંદ અંગ ન માય છે રે શ્રી૦ ।

તું ઉપગાર—ગુણે ભર્યોરે—શ્રી૦,

અવગુણ કોય ન સમાય છે રે—શ્રી૦ ॥૨૨॥

મેઘરથ રાજતણે ભવેરે—શ્રી૦,

પારેવો ઉગારીયો રે;—શ્રી૦ ।

તિમ મુજને નિરભય કરોરે—શ્રી૦,

સ્વામી સુપ્રસન્ન થાય છે રે—શ્રી૦ ॥૨૩॥

શ્રીઅખયરાંદસૂરીસરે—શ્રી૦,

ગુરૂ ગુણમણિ—ખાણુરે—શ્રી૦ ।

તેહના ચરણ પસાયથીરે—શ્રી૦,

ખુશાલસુનિ ગુણ ગાય છે રે—શ્રી૦ ॥૨૪॥

ક્ર

ક્ર

ક્ર

(૮૦૯) (૩૪-૧૭) *શ્રીકુંથુનાથજિન સ્તવન
 કુંથુ જિણેસરરે સ્વામી માહરા,
 તુમે છો સુગુણા રે જગદાધાર ।
 નિજ-સેવકનીરે સેવા જાણો, કીજે કર્ણારે એ છે ટાણો ॥૧॥
 મનના માન્યારે મન આણી, આસંગાયતરે તેહની વાણી ।
 વધતું-ઘટતું રે જે કહેવાશે,
 પણ ચિત્તમાંરે નહી દુહવાશે ॥૨॥
 વિણ—માગ્યાથીરે ફળ જે આપે,
 તેહનો મહિમારે જગમાં વ્યાપે !
 એહવો ગિરિઓરે સાહિબ કહિજે,
 તેહને ચરણેરે અહનિશિ રહીજે ॥૩॥
 આવો આવોરે પરઉપગારી, થઈ એકાંતેરે વાતો સારી ।
 ગુણની ગોઠેરે આપણ કીજે,
 જેહથી દુખડારે સહુએ છીજે ॥૪॥
 દ્વીનપણાનાં રે વચણ કહાવે, તેહજ દાતારે શોભા ન પાવે ।
 ચતુર સનેહારે ગુણના ગેહા,
 હું છું ચાતક રે તુમે છો મેહા. ॥૫॥
 એક લહેરમાં સુખડાં કરશે, મુજ પાપીનેરે તુમે ઉગરશે ।
 નેક નજરશું રે સાહમું જોવો,
 કરમ-રિપુને રે દૂરે જોવો. ॥૬॥

* આ સ્તવનનો ભાવાર્થ પૂ. ઉપા શ્રી યશોવિ મ. ચોવીશીના
 શ્રી. ચંદ્રપ્રભ જિન સ્તવન સાથે લગભગ મળતો આવે છે.

એહ કારજમાં રે ઢીલ ન કરવી,

વળી વિનતડીરે ચિત્તમાં ધરવી ।

અખયચંદ સૂરીસરરે હિતશુ' જોશે,

ખુશાલ મુનિનારે કામિત હોશે. ॥૭૧॥

ક્ર

ક્ર

ક્ર

(૮૧૦) (૩૪-૧૮) શ્રી અરનાથજિન સ્તવન

(મારગ રોક્યો રે મુરારી શિર થકી મટાકી ઉતારી-એ દેશી.)

શ્રીઅરજિનની સેવા કરીએ, તો સંસાર સમુદ્રને તરીએ ।

શિવ સુંદરીને સહજે વરીએ,

ખોટાં વિધન સવિ પરિહરીએ૦ ॥૧॥

સંપત્તિ સઘળી એહને નામે, આઠ મહાસિદ્ધિ નવનિધિ પામે ।

હઃખડાં સહુએ દૂરે ૧વામે,

સફળ હોયે જે મનમેં કામે૨૦ ॥૨॥

મહામાતા અંગણુ ગજ સોહે, રૂડા ઘોડા જનમન મોહે ।

અંધવ બેટા બેટી બહુળા,

સેવ કરે ઘણા સેવક જમળા૪૦ ॥૩॥

મનગમતાં બહાલાનેા મેળો, હોએ દુરજનનેા અવહેલો ।

તેહનેા કારણ જગમેં માને, દીન હીન થાએ વધતે વાને૦ ॥૪॥

નર-નારી મિલીને જશ ગાયે, જે પ્રભુજી તાહરો કહેવાયે ।

એ સવિ લીલા તાહરે ધ્યાને,

શિષ્ય ખુશાલ થયો ઈક તાને ॥૫॥

ક્ર

ક્ર

ક્ર

૧ જાવ

૨ ઈચ્છીએ

૩ મદમસ્ત

૪ સમૂહ રૂપે

(૮૧૧) (૩૪-૧૯) શ્રી મલ્લિનાથજિન સ્તવન

(તુમે ચૌમાસે આકરી ન જાશે રે,

રત આવીને આંખો માહરિયો-એ દેશી)

તુમે તીન ભુવનના સ્વામી રે મલ્લિજિનજી મુજને તારિયે,

હવે લાખું છું શિરનામી રે, મલ્લિજિનજી મુજને તારિયે

કાંઈ ખમજો ! માહરી ખામી રે, મલ્લિં

તુમે માહરા અંતર જામીરે,—મલ્લિં ।

અતિ નેહ કહું હું તો અરજ કહું મલ્લિં

ફિરિ ફિરીને સાહિજ તોશું રે—મલ્લિં ॥

તું તો ઉપશમ રચણાયક, સેવે સુરનરના વૃંદા રે—મલ્લિં

તે માટે તુજને વિનવું,

સહુ ટાળો કરમના ફંદારે—મલ્લિં ॥૧૧॥

હું તો કાળ અનાદિ-અનંતનો,

ઘણું વસિયો સુહમ નિગોદે રે,—મલ્લિં ।

વળી તિહાંથી બાહર આવીયો,

વશ્યો કરમ તણે જ્યું વિનોદે—મલ્લિં ॥૨૧॥

પુઢવી અપ તેઉ રહ્યો, હું તો વાયુ વનસ્પતિ માંહેરે;—મલ્લિં ।

ખિતિ-ચઉ-પંચેદિ મણુ વિણા,

તિરિય નરય નિવાસ તિહાંયે રે.—મલ્લિં ॥૩૧॥

સુર-મનુષ થયો હું અનારજે,

ઈમ ચિંહુ ગતિમાં રહવડીયો રે,—મલ્લિં ॥

મેં તો જનમ મરણ બહુળાં કર્યાં,

તું તો કહિયે હાથે ન ચઢિયો—મલ્લિં ॥૪૧॥

કોઈ માહરા પુણ્યતણે બળે,
 હું તો તાહરે ચરણે આયો રે-મદિલ૦ ।
 શ્રીઅખયસૂરીશે કૃપા કરી,
 ખુશાલમુનિ સમજયો રે-મદિલ૦ ॥૫૧॥

❧

❧

❧

(૮૧૨) (૩૪-૨૦) શ્રી મુનિસુવ્રતજિન સ્તવન
 (આસુવુંડકં અજુઆળિયું રે-એ દેશી)

શ્રી મુનિસુવ્રત સ્વામીજી રે,
 મહેર કરો મહારાજ કે હું સેવક છું તાહરો ।
 અહનિશ પ્રભુજીની ચાકરી રે, કરવી એહજ કાજકે, -હું૦ ॥૧॥
 દુરલભ છે સંસારમાં રે, તુમ સરિખાનો સંગકે-હું ।
 વળી તિમ દરિસણુ દેખવું રે,

તે આળસુ આંગણે ગંગકે-હું૦ ॥૨॥
 સમય છતાં નહીં સેવશેરે, તે મૂરખ શિરદાર કે, -હું૦ ।
 સહી મનમેં પસતાયશેરે, સહશે દુઃખ અપાર કે-હું૦ ॥૩॥
 સફળ થયો હવે માહરો રે, મનુષ્ય તણો અવતારકે-હું૦ ।
 કલ્પતરૂ સમ તાહરો રે, પામ્યો છું દિદાર કે.-હું૦ ॥૪॥
 કરમ ભરમ ફરે ટળ્યો રે,

જખ તું મિળિયો જીનરાજ કે-હું૦ ।
 અખયસૂરીશ કૃપા થકી રે,
 ખુશાલમુનિ સુખ થાય કે-હું૦ ॥૫॥

❧

❧

❧

(૮૧૩) (૩૪-૧) શ્રીનમિનાથજિન સ્તવન

(સાબરમતી આવ્યાં છે ભરપૂર જો—એ દેશી.)

શ્રી નમિજિનવરજી છે દેવદયાળ જો,

અવધારો વિનતડી ગુણ સારી તુમે રે ।

૧કદ્દીએ થાશે। પરસન વયણ રસાળ જો,

૨વારે રે વારે પૂછાં છાં તે અમે રે ॥૧૧॥

સેવા કરવા ઉભા છાં દરખાર જો,

૩રાતેરે ૪દીહેરે તાહરે આગળે રે ।

ખામી ન પડે તેહમાં એક લગાર જો,

તોયેરે તુમારો મનડો ન મિલે રે ॥૧૨॥

અખય ખજનો તાહરે દીસે નાથજો,

સેવકને દેતાં રે ઓછું શું હુવેરે ।

સાહિબાજી રે ! તો હું થયો સનાથ જો,

નેક રે નજર શું જો સાહમું જુઓ રે ॥૧૩॥

મુજને આપો વહાલા વંછિત દાન જો,

જેહવો રે તેહવો છું તો પિણુ તાહરો રે ।

ઠહાલો વહિલો રૂઠો સેવક વાન જો,

દોષ ન કોઈ રે ગણજો માહરો રે ॥૧૪॥

જગખંધવ જાણીને તાહરે પાસજો,

આવ્યો રે ઉમાહ ધરીને નેહશું રે ।

શ્રી અખયચંદ સૂરીશ પસાયે આશ જો,

સઘળી ફળી છે ખુશાલ મુનિને જેહશું રે ॥૧૫॥

૧ ક્યારે ૨ વારંવાર ૩ રાત ૪ દિવસ

(૮૧૪) (૩૪-૨૨) શ્રી નેમિનાથજિન સ્તવન
(ઉંચી મેડી દીવો બળે રે-એ દેશી)

શિવાદેવી સુત સુંદર વાહલો.

નેમિ જિણુંદ રાજ-રાજુલ નારીનો સાહિબો ।
ચદ્ધવંશી-શિર શેહરો,

સમુદ્રવિજય કુળચંદ-રાજ-રાજુલ ॥૧॥

મ્હોટે ઉત્સવે શ્રી કૃષ્ણજી,

તેહનો વિવાહ કરવા-રાજ-રાજુલ ॥

તેડી ૧જેરાવરી આણીયા,

ઉગ્રસેન પુત્રી વરવાય-રાજ-રાજુલ ॥૨॥

વિણ પરણ્યે જે પાછા વળ્યા,

તોરણથી રથ ફેરી-રાજ-રાજુલ ॥

તે શું કારણ બાણીએ,

પશુની વાત ઉદેરી-રાજ-રાજુલ ॥૩॥

રહજીધર ૩કાનહા આડા ફરી,

બંધવ ઇમિ નવિ કીજે-રાજ-રાજુલ ॥

છોકરવાદ શાણા થઈ,

કરતાં લજ્જા છીજે-રાજ-રાજુલ ॥૪॥

ઉલો ઉગ્રસેન વિનવે, વહેલા મહેલ પધારો-રાજ-રાજુલ ॥

માન વધારો મ્હોટો કરો,

અવગુણ કે ન વિચારો-રાજ-રાજુલ ॥૫॥

૧ પરાણે, ૨ બળદેવ, ૩ શ્રીકૃષ્ણ,

કોઈનું વચન ન માન્યું, હુલ્હન રોતી મૂકી-રાજ-રાજુલ૦ ।
 રૈવત ચઢી શિવને વર્યા,

રાજુલ પણ નવિ ચૂકી-રાજ-રાજુલ૦ ॥૬॥
 હકડેહક હાથ ધણે કરી, જે બીજે નવિ થાયે-રાજ-રાજુલ૦ ।
 શ્રીઅખયચંદ સૂરીશનો, ખુશાલ મુનિ ગુણ ગાયે-
 રાજ-રાજુલ૦ ॥૭॥

卐

卐

卐

(૮૧૫) (૩૪-૨૩) શ્રીપાર્શ્વનાથ-જિન સ્તવન
 (બાઈજી ! તુમારો બેટા, નણદી તુમારો વીર રે-એ દેશી)
 પુરિસાદાણી પાસજી, અવધારો

અવધારો મુજ અરદાસ રે-સેવાશું મનઘણું ।
 અહનિશિ હિયડા મેં વસ્યા રહી,

કુસુમે જેમ સુવાસ રે-પ્રભુ૦ ॥૧॥
 પરમ-પુરૂષશું પ્રીતડી, કરતાં આતમ સુખ થાય રે-પ્રભુ૦ ।
 કામી કોધી લાલચી, નયણે દીઠા ન સુહાય રે-પ્રભુ૦ ॥૨॥
 આઠ પહોર ચોસઠ ઘડી, સંભારું તાહરું નામ રે-પ્રભુ૦ ।
 ચિત્તથી ન કરું વેગજો,

બીજું નહીં માહરે કામ રે-પ્રભુ૦ ॥૩॥
 અવનિ ઇચ્છિત પૂરવે, સહુ સેવકનો મહારાય રે-પ્રભુ૦ ।
 મહેર કરીજે સાહિબા, દીજે વંછિત સુપસાય રે-પ્રભુ૦ ॥૪॥
 અ-વિનાશી અરિહંતજી, વામાનંદન દેવ રે-પ્રભુ૦ ।
 શ્રીઅખયચંદ સૂરીશનો,

શિષ્ય ખુશાલ કરે તુજ સેવ રે-પ્રભુ૦ ॥૫॥

(૮૧૬) (૩૪-૨૪) શ્રી મહાવીરજિન સ્તવન
 (સહિયાં મોરીરે ચાંદલીયા ઉગ્યા મધરાતનારે—એકેશી)
 જિન માહારે! શ્રી મહાવીરજીરે જિનપતિ ચોવીશમારે ॥
 જિં શાસન નાયક દક્ષિણ—ભરતમારે,
 જિં કરમ ખપાવી પહેત્યા શિવમંદિરે રે ।
 જિં સેવક—જનનારે ઉલટ ઇમ રહ્યારે,
 જિં વીરજી વિના શાસન સંભાળ કુણ કરેરે જિનં ॥૧॥
 જિં અતિશયધારીરે નહી હમણાં ઇણે જગરે,
 જિં વીરજી વિનારે દીઠાં ચિત્ત ઠરેરે ।
 જિં દુર્લભ યોધિરે પ્રાણી ભૂદ્યા ભમેરે,
 જિં વીરજી વિનારે સંશય કોણ હરેરે જિનં ॥૨॥
 જિં ઇણ પંચમ—આરે વિરહો જિનતણોરે,
 જિં દુર્ગતિ માંહેરે પડતાં કુણ ઉદ્ધરેરે ।
 જિં કુમતિ—કુતીરથનારે થાપક છે ઘણારે,
 જિં વીરજી વિનારે તે બીજાથી નવિ ડરેરે જિનં ॥૩॥
 જિં મુગતિપુરીનો મારગ વિષમો થયોરે,
 જિં વીરજી વિનારે કોણ તેહને સુખ કરેરે ।
 જિં ધરમ તણોરે નાયક દૂર રહ્યોરે,
 જિં ભવિજન તેહનેરે નામે ભવજળ તરેરે જિનં ॥૪॥
 જિં ત્રિશક્તાદેવીનારે નંદન સાહિબોરે,
 જિં મુજશુંરે હવે મહેર કર્યાવિણ નહી રહેરે ।
 જિં શ્રી અખયચાંદ સૂરીશ સુગુરની સેવનારે,
 જિં ખુશાલ મુનિ તેહને સુપસાયે સુખ લહેરે જિનં ॥૫॥

શ્રી વર્ધમાનસ્વામિને નમઃ

શ્રી ચતુરવિજયજી કૃત

સ્તવન ચોવિશી

(૮૧૧) (૩૪-૧) શ્રી ઋષભદેવજિન સ્તવન

(મહાવિદેહ ક્ષેત્ર સોહામણ્ય—એ દેશી.)

જગતગુરુ ! જિન માહરો, જગદીપક જિનરાય—લાલ રે ।
શાંતસુધારસ ધ્યાનમાં,

આતમ અનુભવ આય—લાલરે—જ૦ ૧૧૧।

૧ચિત્ત પ્રસન્નતા દૃઢ થઈ, કીડતી ખેલાખેલ;—લાલ રે ।
તે દગ દગ તે જ્ઞાનથી, વધતી વેલકલ્લેલ—લાલ રે જ૦ ૧૨।

પરભાવિક પાંચે ભલા, અવર ન એકાએક,—લાલ રે ।
ખટદ્રવ્ય દ્રવ્યે કર્યા, દેખત શોભા દેખ—લાલ રે જ૦ ૧૩।
તે તુજ દરિસણુ જાણીયે, આણીયે ચિત્ત આણુંદ—લાલ રે ।

૧. અત્યંત ચંચળ પછે રમતી તેવી વિશિષ્ટ જે આંખ કે જે આંખ
ભરતીના મોજની જેમ વધતી રહેલ જ્ઞાનથી શોભે છે—તે આંખથી
ચિત્તની પ્રસન્નતા દૃઢ થઈ (બીજી ગાથાનો અર્થ).

વિહસિત-વદનકમળ મુદ્દા,

જિમ સુરતરૂ સુખકંદ-લાલ રે । જ૦ ૧૪૧।

ઈમ ગુણ જિનજી ! તાહરા, માહરા ચિત્તમાં આય,-લાલ રે ।

નવલ્લવિજય જિન ધ્યાનથી,

ચતુર આનંદપદ પાય-લાલ રે જ૦ ૧૪૨।

卐

卐

卐

(૮૧૮) (૩૫-૨) શ્રી અજિતનાથજિન સ્તવનઃ

(સુત લાડકડા ઉઠ હો-એ દેશી.)

મહીમાં, મહિમા ગાજતો-રાજિંદ મોરા,

તુજ ગુણગણ વિખ્યાત હો ।

અનુલવ પ્રગટયો ચિત્તમાં-રા૦, લાગી મુજ મન જાંત હો-

સુગુણ સનેહી ખ્યારો । મનનો મોહનગારો, સાહેબો-રા૦,

જુહારો અજિત જિણુંદ હો. ૧૧૧।

ઈંદુ જિમ ગ્રહગણ માંહિ-રા૦, નિશિપતિ તેમ દિણુંદ હો ।

દિનકર-ઉદયથી જિમ હોવે-રા૦,

તિમ અનુલવથી મુણિંદ હો-સુ૦ ૧૨૧।

મોંઘા ઝમૂલનો જે ઝકરી-રા૦, ચહે તુજ ચરણની સેવ હો ।

લંછન તેહ વિરાજતો-રા૦,

જગત નમે' જસ દેવ હો-સુ૦ ૧૩૧।

૧ પૃથ્વીમાં ૨ ચંદ્રમાં ૩ કિંમતનો ૪ હાથી

લીલાધર જગ જાણીયે-રા૦, લીલા લહેર કરંત હો, ।
સકળ પદારથ જે હોવે-રા૦,

તે મુજ પાસ વસંત હો-સુ૦ ॥૪॥

અજિત અજિત જિન વંદતાં-રા૦, કર કરૂણા ભગવંત હો, ।
ચરણ કમળની ચાકરી-રા૦,

ચતુર તે માંગે સંત હો-સુ૦ ॥૫॥

❧

❧

❧

(૮૧૯) (૩૫-૩) શ્રીસંભવનાથ-જિન સ્તવન
(અરણિક મુનિવર એ દેશી)

સંભવસ્વામીરે સ્વામી જગદાણી, કરો કૃપા દયાળજી ।
અચાર પદારથ પદ તે અનુભવે,

જિમ જાએ પાપ પાયાળજી-સં૦ ॥૧॥

ચરણે રૂપીરે અરૂપીતાપણે જે પક્ષે સુવિચારો જી ।
તે જગ જીવેરે જીવ્યું જાણીયે,

સકળ કરે અવતારો જી-સં૦ ॥૨॥

અરથ અગોચર ગોચર કો નહી, જગદાયક જિન ધારેજી ।
એક-એક ભેદે રે રસ નવિ ઊપજે,

દોષ મિહ્યા સુખ સારેજી-સં૦ ॥૩॥

અહુ નર બુદ્ધિરે બુદ્ધિ આગળા, કરતા આપ વખાણજી ।

ખેલાખેલેરે રંગેશુ રમે, અવર તે પરિમાણજી-સં૦ ॥૪॥

જસ પદ-સેવારે ઈદ્રાદિક કરે, તસ સેવામાં હું લીનજી ।
 નવલ રસ ભોગીરે ૧દિનકર તેજથી,
 તે જસ ચતુર આધીનજી—સં ૦ ॥૫૧॥

卐

卐

卐

(૮૨૦) [૩૫-૪] શ્રી અભિનંદન-જિન સ્તવન.
 [દેશી-જીલખડાની.]

મુખ મટકે જગ મોહી રહ્યો રે,
 દગ લટકે લલચાય—જિજ્ઞેસર ! સાંભળે!!
 અભિનંદનજિન તાહરીરે.

મૂરતિ મોહનરાય—જિજ્ઞે ૦ ॥૧॥

અહી અંગે ગુણ તાહરારે, પરમારથ પદ એક—જિજ્ઞે ૦ ।
 હું નમું કયું હવે તે સદારે,

એ મુજ મોટી ટેક—જિજ્ઞે ૦ ॥૨॥

કમળ કમળદળ પાંખડીરે, આંખડી નિરમળ થાય—જિજ્ઞે ૦ ।
 પરમ પ્રભુ રૂપ જોવતારે, આવે ન દૂજો દાય—જિજ્ઞે ૦ ॥૩॥

સફળ ફળી હવે માહરીરે, જો મુજ મળીઓ ઈંટ—જિજ્ઞે ૦ ।
 રંગ પતંગ ન દાખવું રે, રાખું ચોળ મજાઠ—જિજ્ઞે ૦ ॥૪॥

ગગને વાળાં વાળ્યાંરે, અમ ઘર મંગળ તૂર—જિજ્ઞે ૦ ।
 નવલવિજય જિન વંદતારે,

ચતુરને સુખ ભરપૂર—જિજ્ઞે ૦ ॥૫॥

(૮૨૧) [૩૫-૫] શ્રી સુમતિનાથ જિન સ્તવન
(દેશી-ગરબીની)

હારે ! વાહલો ! સુમતિજિણુંદ જુહારીરે,
વારીજાઉં લામણે, રે લો ।
હારે ! પ્રભુ ! સુરતરૂ કળીઓ માહરેરે,
ગુણનિધિ આંગણે રે લો ॥૧॥
હારે ! મેં તો દેવનો દેવ નિહાળીરે,
જીવન જગધણી રે લો ।
હારે ! પ્રભુ તેજે ઝળામલ દીપેરે,
રઝોપી જેમ ઝોપણી રે લો ॥૨॥
હારે ! વાહલા ! નયણુ રહ્યો લોભાઈરે,
મોહ્યું મુજ મનડું રે લો ।
હારે ! પ્રભુ ! વાણી સરસ રસ પીધેરે,
ભાંજે લવ ભૂખડી રે લો ॥૩॥
હારે ! પ્રભુ જીવન જગદાધારેરે, વાહલા છો પતિરે લો ।
હારે ! પ્રભુ મહોદય પદવી આપોરે,
કાપો દુરગતિ રે લો ॥૪॥
હારે ! પ્રભુ નફર કરે અરદાસરે, આશ તે પૂરીયે રે લો ।
હારે ! વાહલો રસભર રસીઓ કહાવેરે,
ચતુર દુઃખ ચૂરીયે રે લો ॥૫॥

❧

❧

❧

૧ ઓવારણાં ૨ ચક્રચકાટ કરેલ

(૮૨૨) [૩૫-૬] શ્રી પદ્મપ્રભાજિન સ્તવન

(વાહલો મારો દીએ છ દેશનારે-એ દેશી)

અંતરજામી પ્રભુ માહારારે, પદ્મપ્રભુ વીતરાગ !
સ્નેહલતા મુખ પેખતારે, મેં ધર્યો તુજથી રાગ—
૦હાલો મારો પદ્મજિન સેવીયે રે૦ ॥૧॥

ગુણસત્તા ધર ઓળખેરે, તે ગુણગણનો જાણુ ।
અવગુણ છાંડીને ગુણ સ્તવેરે,
તે જસ જગત પ્રમાણુ—૦હાલો૦ ॥૨॥

અંગ થકી રંગ ઉપનોરે, જિમ ચાતુક મન મેહ ।
તેલખિંદુ જિમ વિસ્તરેરે, તિમતિમ તુજશું નેહ-૦હાલો૦ ॥૩॥

સુરનર ઈંદ્ર મુનિવરારે, અહનિશ ધરે તુજ ધ્યાન ।
સરીખાસરીખી સાહેલડીરે, ગાવે જિનગુણ ગાન
—૦હાલો૦ ॥૪॥

ચરણ—કમલની ચાકરીરે, અવિહડ ધરજ્યો નેહ ।
નવલ્લવિજય જિન સાહેબારે,
ચતુરની વધતી રેહ—૦હાલો૦ ॥૫॥

(૮૨૩) [૩૫-૭] શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન

(માહસ ધણું વાઈ ઢોલા-એ દેશી)

શ્રી સુપાર્શ્વ જિનરાય. હાંરે ! તુમે સારો સેવક કાજરે—
—માહરા પરમ સનેહી દેવા ૬

પરમારથ પદ ધારી,

હું તો વારી જાઉં વાર હજારીરે—માહરાં ॥૧॥

એક લહેર મુજ કીજે, પ્રભુ વાય સુવાય વહીજેરે—માહરાં
તન મન ધન ચિત્ત ચોખું,

હઠ નયણ કરી મુખ નિરખુંરે—માહરાં ॥૨॥

અંતરધ્યાન તુમ આવો, જસ સઘળા ભાવદેવોરે,—માહરાં ૧
અનુભવ ભવિ મુજ સાચો,

જેણે કાંઈ ન રાખ્યો કાચોરે,—માહરાં ॥૩॥

હાંરે ! પ્રભુ તેજે ઝળામલ દીપે,

જલજલથી જલને જીપેરે—માહરાં ૧

મૃગતૃણાયે નવિ ભાજે,

પ્રભુ મળિયાં અંખર ગાજેરે—માહરાં ॥૪॥

ઈમ નિત નિત જે શુણ ગાવે,

પ્રભુ સુખીઓ તે નર થાવરે—માહરાં ૧

શુર નવલવિજય જિનરાયા,

એ તો હરખે ચતુર ગાયા—માહરાં ૧ ॥૫॥

(૮૨૪) (૩૫-૮) શ્રી ચંદ્રપ્રભજિન સ્તવન

[કુંવર ગભારો નજરે દેખતાં-એ દેશી.]

તું મનમોહન જિનજી માહરોજી, જગખંધવ જગભાણુ રે ।
 કર્ણાનજરે નિહાલતાંજી, હોવે તે કેડ કલ્યાણુરે-તું ૦ ॥૧॥
 પ્રગટયા તે પૂરવ પુણ્યનાજી, અંકુર જગ આધાર રે ।
 શશિ શિરોમણી છે ભલોજી, લાંછન તસ સાધાર રે-તું ૦ ॥૨॥
 ખિણખિણ મુલકને કારણેજી, મહોદય મોટો થાય રે ।
 અવલંબવા ઈચ્છા ધણીજી, તુજ ગુણ જિનજી ! સહાયરે-તું ૦ ૩
 આશ્યા-વિલુદ્ધા જે રહ્યાજી, યાચકજન વળી દાસ રે ।
 ૧માધુરતા મધુરસ્વરેજી, પૂરીજે તેહની આશ રે-તું ૦ ॥૪॥
 તુજ મુજ ૨અંતર છે નહિજી, જિન કસ્તુરી ૩ધનવાસરે
 ચંદનતા સુચંદનેજી, પ્રેમે ચતુર પ્રકાશરે-તું ૦ ॥૫॥



(૮૨૫) (૩૫-૯) શ્રી સુવિધિનાથ-જિન સ્તવન

(પ્રભુજીની ચાકરીરે-એ દેશી.)

અલવેસર અવધારીયે રે, સેવકની અરદાસ રે;—સલૂણા સાંભળો રે !
 ચરણ-કમળની ચાકરીરે, માંશુ છું તુમ પાસરે.—સલૂણા ૦ ॥૧॥
 જગ એક મિત્ર તે માંહરે રે,
 તે તો રહ્યો તુજ સંગ રે-સલૂણા ૦ ૧.
 અવસર લહી જબ આપણો રે,
 આવી કહે મન રંગ રે-સલૂણા ૦ ॥૨॥

૧ હૈયાની મીઠાશ, ૨ ભેદ ૩ નક્કર સુગંધ

૧ધનમાં રહી જિમ રદામિની રે,

કરતી હાલકલોલ, રે-સલુણાં ।

ઈમ અમે ગુણશુ ગુણ બળી રે,

તુજશુ ખેલાખેલ રે-સલુણાં ॥૩॥

૩પયમાં મણિમય^૪ લેળવી રે,

પીવે મૂરખ બુધ રે-સલુણાં ।

રસના રસની લાલચે રે.

જે હોએ સાકર-દૂધ રે-સલુણાં ॥૪॥

મોટાથી મોટા થઈ એ રે, કનક કચોલે નીર રે-સલુણાં ।

ખીરોઢકની (ઉનતા) ઉપમા રે,

તે પામે નર ધીર રે-સલુણાં ॥૫॥

કાકંદી નગરી ધણી રે,

મગર-લંછન જલ પાય રે-સલુણાં ।

સુવિધિ-જિનેસર વંદતારે,

ભવ-ભવના દુઃખ બાય રે-સલુણાં ॥૬॥

એ હિતશીખની વાતડી રે,

જાણે જાણે સુખજી રે-સલુણાં ।

નવલ-ચતુરની ચાતુરી રે.

મ કરે ખેંચાતાણુ રે-સલુણાં ॥૭॥



૧ મેઘવટામાં, ૨ વીજળી, ૩ દુધમાં ૪ સિંધાલજી.

(૮૨૬) (૩૫-૧૦) શ્રી શીતલનાથજિન સ્તવન

(સાહેબ બાહુ જિણેસર વિનવું-એ દેશી.)

હે ! સાહિબ ! શ્રી શીતલજિન ભેટિયે.

મેટિયે સવિ દુખદંદ હો;

સાં સુ-નજરે કૃપાથડી ઉઘ્યો જ્ઞાન-દિણ્દ હો-સાં શ્રીં ॥૧॥

સાં પાર ન પામીએ જેહનો, તે કહો અવદાત હો;

સાં અક્ષય દોય રેફે કરી,

જાણ્યો મેં એહ વિખ્યાત હો-સાં શ્રીં ॥૨॥

સાં એ રિદ્ધ એ સિદ્ધ એહથી, આવે સઘળી આથ હો;

સાં કરે કર જે ઉપરે,

તે લહે હાથોહાથ હો-સાં શ્રીં ॥૩॥

સાં શીતલે શીતજતા હોવે, હોવે તે સુખવિલાસ હો;

સાં નયણ કમલ નિરખતાં,

વરષતાં ઉઘ્ય ઉલ્લાસ હો સાં શ્રીં ॥૪॥

સાં દૃઢરથરાજ-નંદાજી, બદીલપુરે અવતાર હો;

સાં શ્રીવત્સલંછન જસ સદા,

પ્રણમું પ્રેમે પાય હો-સાં શ્રીં ॥૫॥

સાં વાણી એ સુરતરૂ વેલડી, પ્રગટે પ્રેમની પાળ હો;

સાં સુજસ ચતુર તે એહને,

મહોદય દીને દયાળ હો-સાં શ્રીં ॥૬॥



(૮૨૭) (૩૫-૧૧) શ્રી શ્રેયાંસનાથજિન સ્તવન

(ધરમજિજીસર ગાઉ રંગશું-એ દેશી.)

શ્રીશ્રેયાંસજિજીસર મહારા, પરમનિધિ પરગટ્ટ-સોભાગી ।
ધન ધન તે દિન ધન વળી માહરો,

સેવકને ગહગટ્ટ-સો ॥ શ્રી ॥ ૧૧ ॥

કમલ-દિનકર કમલા કમલની, વધતી છે જસવેલ-સો ॥

સુરીજન-પુરીજન સેવે જે સદા,

તે તુજ કૈલાસકેલ-સો ॥ શ્રી ॥ ૧૨ ॥

તે માટે પ્રભુ હું તુજ કને, માંશું જગમાં જે સાર-સો

પૂરવ પ્રીત વિચારત હુંકડી,

લહી જિમ લગન નિરધાર સો ॥ શ્રી ॥ ૧૩ ॥

ઉઠ્યો અનુભવ હવે એ વાતનો, તે કિમ રહ્યોએ બાય-સો ॥

કાલાંતર ફરતાં તુજ મિલ્યો,

હવે મુજ આતમકાય સો ॥ શ્રી ॥ ૧૪ ॥

લંછન ખડગી જે જસ સિંહપુરી સુતશ્રી વિજયકુમાર-સો ॥

કૃતારથ કૃત એ કરમથી,

ફળ લહે ચતુર શ્રીકાર. સો ॥ શ્રી ॥ ૧૫ ॥

★

(૮૨૮) (૩૫-૧૨) શ્રી વાસુપૂજ્યજિન સ્તવન

(તુમે બહુ મિત્રારે સાહેબા-એ દેશી.)

સુવિહિતકારીરે સાહિબા, સુંદર રૂપ નિધાન ।

તુજ મુજ રીઝની રીઝમાં, ઉપજે આતમ-જ્ઞાન-સુ ॥ ૧૬ ॥

આકર્ષે^૧ અવયવ તાહરા, લક્ષણાલક્ષિત દેહ ।
 પ્રેમ પ્રગટતારે પુણ્યની, વધતી મોહને જેહ-સું ॥૨॥
 કિહાં ઉપનો કિહાં નીપનો, રૂપાતીત સલાય ।
 અચરિજ એ મુજ વાતનો, કહોને શ્રી જિનરાય-સું ॥૩॥
 પૂરવગતિરે પ્રયોગથી, જોગ મિદ્યે છે રે આય
 તો ભેદઅંધિ^૨ ન રાખીયે, રાખી ન આવેહો દાય-સું ॥૪॥
 કામિત-પૂરણ સુરતરૂ મૂરત મોહનવેલ ।
 સાચો જાણી મેં સેવિઓ, જિમ ઘન^૨-ચાતકમેલ-સુ ॥૫॥
 લલના નયણેરે નિરખતાં, હિયડો હેજે ભરાય ।
 ચંપાનચરીનો રાજિઓ, વાસુપૂજ્ય જિનરાય-સું ॥૬॥
 કરકમલે જિન કેતકી, ભમરપરે રસ લીન ।
 ભેલો ચતુર તે આતમા, થઈ રહ્યો તુજ આધીન-સું ॥૭॥



(૮૨૯) (૩૫-૧૩) શ્રી વિમલનાથજિન સ્તવન
 (ગુણરાલાયક-એ દેશી.)

જગલોચન જખ ઉગીઓ,
 પસર્યો પુહવિ પ્રકાશ હો-ગુણરા લાયક ।
 અનુભવ એ મુજ વાતનો, ઉદય હુઓ ઉભસ હો-ગુણ ।
 વિમલજિન સેવીયે.....૥૧॥
 ભજનથકી ભવભયહરૂ, દરિસણથી દૂર દુઃખ હો-ગુણ ।
 પધવિ^૩ કપુરની વાસ તે, પામે મહા સુરસુખ હો-ગુણવિં ॥૨॥

૧ ભેદ-જુઠાઈતી ગાંઠ, ૨ વાદળાં અને ચાતકનો પ્રેમ, ૩ સળગતા કપૂરની

અવિહત એહને કારણે, ધરે ધરમશું ધ્યાન હો; શું
ચિત્ત-વિત્ત-પાત્ર સંજોગ શું, પ્રગટે બહુરિદ્ધિદાન હો. -શું વિ૦ ૩
વાન વધારણ સાહેબો, કામિત-કામનો ૧ધામ હો; શું ૧
૨જલહર જલ વરસે સદા, ન જોવે ઠામ-કુઠામહો. શું વિ૦ ૪
પશ્ચિમ ૩૬૬ ૪રવિ પૂરવે, જગત નમે જસ પાયહો; શું
ચિત્ત વિત્ત પાત્રને કારણે, આવે ચતુરને દાય હો. શું વિ૦ ૫



(૮૩૦) (૩૫-૧૪) શ્રી અનંતનાથજિન સ્તવન

(લાલ કસુંબલ પાવડીજી-એ દેશી.)

ચાલો સહીયર ! જિન વંદવાજી રે,

અનંતનાથ શુભ ગેહરે જીરે ચા૦ ૧

સરીખા સરીખી સાહેલજી રે, વધાવે ઘણે નેહરે જીરે-ચા૦ ૧૧

તાલ મૃદંગ ધ્વનિ વાજતીજીરે, સમવસરણ મંડાણ રે, જીરે,

તાથૈ તતથૈ નાયતીજીરે, લીએ કુદડી ધમસાણ રે જીરે-ચા૦ ૧૨

ટાળક વારક મોડનાજીરે, તરણતારણ જિહાજરે જીરે;

લાગ્યો છે રંગ તે ચોળનોજીરે,

આતમરામ મહારાજરે જીરે ચા૦ ૧૩

ગોમય અંગની સમાણાજીરે, ચ્યાર તે કરી રહ્યા ચુપરે જીરે;

અતિશયધારી આપણાજીરે,

ત્રિલોકીક જિન-ભૂપરે જીરે-ચા૦ ૧૪

આઠ સત્તર એકવીશનીજીરે, પૂજકાર એ ભાવન રે જીરે;

૧. ઇચ્છિત વસ્તુનું સ્થાન, ૨ મેઘ, ૩ ચંદ્રમા, ૪ સૂર્ય.

અરચી-ચરચી મહાલ શું જીરે,
 નાટિક કેઈ કેઈ રાગનારે જીરે-ચાં ॥૫૧॥
 ત્રિવિધ ભાવના ભાવતાજીરે, પરિમલ તાપણું થાયરે જીરે ।
 અવસર લહી નવિ ચૂકીએજીરે,
 જિમ જીઓ રાવણુરાયરે જીરે-ચાં ॥૫૨॥
 જિન ગુણ-ગણશું ગોઠડીજીરે, અવર ન આવે કોઈ દાયરે જીરે ।
 લખી લખી કરતી હુંછણાંજીરે,
 પ્રભુ ગુણ ચતુર સહાયરે જીરે-ચાં ॥૫૩॥

(૮૩૧) (૩૫-૧૫) શ્રીધર્મનાથજિન સ્તવન

(પ્રશ્નોત્તર પૂછે પિતારે એ દેશી.)

ધરમધુરંધર ધરમજીરે, ધરમ એ નાથ નિહાન ।
 અવસર પામી આપણોરે,
 સમય થઈ સાવધાનરે -ધરમ ન મૂકીયે ॥૧॥
 અંગવિલેપન તાહરે રે, માહરે મનશું રે ભાવ ।
 ગ્રહી અંગે ગુણ મુહારે, હવે ન ખેલું હું દાવરે-ધરમ ॥૨॥
 મોહ મહે મુજ લેજાવ્યો રે, કુમતિ કદાગ્રહી નાર ।
 સમતાશું મન મેળવીરે, કીધો ઈશ્વે ઉપગાર રે-ધરમ ॥૩॥
 કર હવે કરૂણા ! નાથજીરે, શરણાગત આધાર ।
 કરમમલ નિવારવારે, એ મોટો આધાર રે.—ધરમ ॥૪॥
 સેવા કીધી મેં તાહરીરે, ફળી હવે માહરીરે આશ;
 પ્રેમપદારથ લોત્રવોરે, ચતુરને લીલવિલાસરે-ધરમ ॥૫॥

(૮૩૨) (૩૫--૧૬) શ્રીશાંતિનાથજિન સ્તવન

(સીતાહો પ્રીયા સીતા કહે સુણે વાત એ-દેશી,)

શાંતિ હો ! જિન ! શાંતિ કરે શાંતિનાથ,

અચિરા હો ! જિન ! અચિરાનંદન વંદનાજી ॥

૧ કેવળ હો ! પ્રભુ ! કેવળ લહિયે રદ્દીદાર,

ભાંગી હો ! જિન ! ભાંગી ભાવક ભંજનાજી ॥૧॥

પ્રગટી હો ! જિન ! પ્રગટી રિદ્ધિનિદાન,

માહરે હો ! જિન ! માહરે જસ સુરતરૂં ફળ્યોજી ।

તોરણ હો જિન ! તોરણ ખાંધ્યાં ખાર,

અભય હો ! જિન ! અભયદાન દાતા મળ્યો જી ॥૨॥

દાયક હો ! જિન ! દાયક દીનદયાળ,

જેહને હો ! જિન ! જેહને ખોલે હુયો મુદાજી ।

જિનની હો ! જિન ! જિનની વાણી મુજ,

પ્યારી હો ! જિન ! પ્યારી લાગે તે સદાજી ॥૩॥

ઉદ્યો હો ! જિન ! ઉદ્યો જ્ઞાન-દિશુંદ,

ઝઘાઠો હો ! જિન ! ઘાઠો અશુભ દિન વળ્યોજી ।

મળીઓ હો ! જિન ! મળીઓ ઈષ્ટ-સંજોગ,

સુંદર હો ! જિન ! સુંદરતા તન-મન ભળ્યોજી ॥૪॥

સાખી હો ! જિન ! સાખી ઈંદ્ર-નરિંદ,

અવર હો ! જિન ! અવર અનુભવ આતમાજી ।

પ્રેમે હો ! જિન ! પ્રેમે ચતુર સુજાણ,

ગાયા હો ! જિન ! ગાયા ગુણ એ તાતનાજી ॥૫॥

૧. ફક્ત, ૨. ચહેરો, ૩. ધસાઈ ગયો.

(૮૩૩) (૩૫-૧૭) શ્રી કુંથુનાથજિન સ્તવન

[હાંજી અજિત-જિણંદશું પ્રીતડી-એ દેશી]

હાંજી ! સુરતરૂસમે વડ સાહેબો,

જિન કુંથુ હો ! કુંથુ ભગવાન કે ।

હું તુજ દરિશણ ? અલજયો,

કર કરણા હો કરણા ખહુમાન કે-સુર૦ ૥૧૥

જિમ શશિ સાયરની પરે, વધે વધતી હો જિમ વેલની રેલ કે ।

તિમ મુજ આતમ અનુભવે,

નવિ મૂકે હો ! ખહુલો તસ મેવ કે-સુર૦ ૥૨૥

છીલર જલ જખ ગ્રહી પીવે, મૂરખ હો ! કોઈ ચતુર સુજણ કે ।

નિરમળ ચિત્તના ચિત્તધણી,

બાણે માણે હો ! ગુણની ગુણખાણ કે-સુર૦ ૥૩૥

ચિત્ત ચોખે મનમોકળે, ધરે તાહરું હો ! નિરમળ જે ધ્યાન કે ।

તો તસ સવિ સુખ-સંપદા,

લહે ખિણમાં હો ! ખિણ માંહે જ્ઞાન કે-સુર. ૥૪૥

મેહર કરો મહાશ નાથજી ! બાણી પ્રાણી હો એ તુમચો દાસકે ।

નવલ્લવિજય જિન સાહેબા,

તુમે પૂરો હો ચતુરની આશ કે-સુર૦ ૥૫૥



(૮૩૪) (૩૫-૧૮) શ્રી અરનાથ-જિન સ્તવન

[ધણુરા ઢાલા-એ દેશી]

શ્રી અરજિનજી માહરેરે,

તુમશું અવિહડ રંગ-મનના માન્યા. ।

રંગ પતંગ ન દાખવો રે,
 યોગમજીઠ અભંગ-ગુણુરા ગેહા. ॥૧૧॥
 ચાતક ચાહે મેહને રે, પીઉ પીઉ જ'પે જસ નામ-મન૦ ।
 પ્રેમપદારથ એહવારે, માહરે તુમશું કામ-ગુણુ ॥૧૨॥
 સાચો સાજન સાહેબો રે, કાચો કેવળ કાચ-મન૦ ।
 મૂલ ન હોવે જેહનો રે, હોવે તે સાચો સાચ-ગુણુ ॥૧૩॥
 ગજપુરી નયરીનો ઘણી રે, દેવી હો ! રાણી જાય-મન૦ ।
 લંછન નંદાવત સાચીઓ રે, પુરજન સેવે પાય. ગુણુ ॥૧૪॥
 સુદરશન-સુત સાહેબો રે, દરિશણુ ઘો મહારાય-મન૦
 ચતુરવિજય જિન-ધ્યાનથીરે, લીલાલહેર કરાય-ગુણુ ॥૧૫॥

(૮૩૫) (૩૫-૧૯) શ્રી મલિનાથજિન સ્તવન
 (દેશી-પારઘોયાની)

નયરી મિથિલાએ રાજતો રે,
 કુંભ પિતાકુળ હંસ રે-મલિનજિન માહરા
 પ્રભાવતી કૂખથી જાતથી રે,
 ઉપન્યો તે જશ વંસરે-મં ॥૧૧॥
 પૂરવકૃત્યના કૃત્યથી રે, માયાએ રચીઓ કુંદ રે-મં ।
 રત્રિયાદિકપણે તીરથનીરે, અતિશય ધારી વૃંદરે-મં ॥૧૨॥
 આ ચોવીશીએ ઇણીપે રે, ઘણી રાખી જગખ્યાત રે-મં ।
 કેઈકેઈ અંતર દાખવો રે, અદ્ભુત એહ છે વાત રે-મં ॥૧૩॥
 જેહનો મન જિહાં વેધીઓ રે, તે વેધક સુવિલાસરે-મં ।
 ચાખવી સમક્તિ સુખડી રે, હેળવીઓ એ દાસ રે-મં ॥૧૪॥

૧ શ્રેષ્ઠથી, ૨ સ્ત્રીપણે

સેવા બાણો દાસનીરે, લાંછન કલશ નિધાનરે-મં ।
અનુભવે ચતુર એ આતમારે, દિનદિન ચઢતે વાનરે-મં ॥૫॥



(૮૩૬) (૩૫-૨૦) શ્રી મુનિસુપ્રતજિન સ્તવન

(કાંધ લો પરવત ધુંધલો રે-એ દુશી)

ચઉમુખ દેતા દેશના રે લાલ,
લવિક-કમળ ઉદ્યોતરે,-જિણુંદરાય. ।
અળહળતો જખ ઉગીઓ રે લાલ,
૧અક^૧ પ્રભાસમ રકંતરે-જિં ચઉં ॥૧॥
લક્ષણ અંગ વિરાજતારે લાલ,
૩અડહિય સહસ ઉદાર રે-જિં ।
અભ્યંતર ગુણ તાહારારે,
૪કે'તા કહું અપારરે-જિં ચઉં ॥૨॥
ભગતી ભલી પરે ઉધર્યો રે લાલ,
સાહેબ ! સરલ સ્વભાવ રે-જિં
વિમળ-કમળ દળ-લોચણો રે લાલ,
અતિશયથી હાવભાવ રે-જિં ચં ॥૩॥
રાજગૃહી રળીયામણી રે લાલ,
મુમિત્ર રાય કુલચંદ રે-જિં ।
મુનિસુપ્રતજિન સાહેબા રે લાલ,
કચ્છપ લાંછન સુખકંદરે-જિં ચં ॥૪॥

૧. સૂર્યકાંતિ, ૨. કાંતિ, ૩. ૧૦૦૮, ૪. કેટલા

વિનય અધિક જગમાં વડો રે લાલ,

તો તસ હોવે આધીન રે-જિં ૦ ।

ત્રિહું જગ જગમાં વિસ્તરે રે લાલ,

જસ ચતુર સમીચીનરે—જિં ૦ ચં ॥૫॥



(૮૩૭) (૩૫-૨૧) શ્રી નમિનાથજિન સ્તવન

(સંભવ જિનવર વિનતિ-રાગ-પ્રભાતી)

મનમાન્યાની વાતકી, સાહિબ શી પેરે કહીજે રે ?

૧લવ એક ઉઠકખિંદુ લગ્યો,

સાયર લેહેર લહીજેરે-મં ॥૧॥

લઘુતા ફળે રસ કટુકતા, અવર વયે તે ખટાશરે ।

વય રીતુ પાલટો જો કરે,

તો તે સઘળે મીઠાશરે-મં ॥૨॥

મગન ભયે માહુરા નાથજી, શરણાં તોરે આઈ રે ।

અખ નહિ રકિસી વાતકી,

ખામી રહે તન કાંઈ રે-મં ॥૩॥

વિજયરાજ વપ્રા ઘરે, થઈ કુમર બધાય રે ।

નામ નિરંજન નિરખતાં, પરમાનંદ પદ પાયરે-મં ॥૪॥

નીલોત્પલ^૩ લાંછન જગધણી, કર કરણા સ્વામી રે ।

સવિ સુખ સંપદા ચતુરને, દીજે અંતરજામી-મં ॥૫॥

*

૧. એક જરા જેટલું પાણીનું ટીપું દરિયામાં મળી જવાથી, દરીયાની
લહેરનો અનુભવ લે છે, (પ્રથમ ગાથાના ઉત્તરાર્ધનો અર્થ)

૨. ક્યો ૩. નીલકમલ

(૮૩૮) (૩૫-૨૨) શ્રી નેમિનાથજિન સ્તવન

(દેશી-ભટ્ટીયાણીની)

વિનતડી અવધારો હોજી પધારો વહાજા નેમજી,

અરજ સુણો મુજ દેવ ।

તુમે છો જગના તારૂ હો, ભવવારૂ મોહન માહરૂ,

અહનિશ કરસ્યાં સેવ-વિ. ૧૧૧॥

જાદવકુળના ધારી હો અધિકારી સુરત તાહરી,

સૂરત મોહનવેલ ।

દેખત દિલડું હરખેહો અતિ નિરખે વરસે મેહુલો,

અષાડો ગજગેલ-વિં ૧૧૨॥

દીસો છો જગન્યારા હો દિલ પ્યારા, વાર્યા નવિ રહો,

કિમ કરી દાખવું પ્રીત ।

જિમ જીઓ કેતકીવનમાં હો વળી દિલમેં મન તે ભમરજીયું,

ધમિ અમ કુલવટ રીત-વિં ૧૧૩॥

સસુદ્રવિજય સુત ઇંદાહો શિવાનંદા હંદા સાહેબા,

નયણ રહ્યાં લોભાય ।

તુમે મુજ અંતરજામી હો શિવગામી સ્વામી માહરા,

સુગુણનિધિ કહેવાય-વિં ૧૧૪॥

પશુની કરૂણા પેખી હો ઉવેખી દેખી નવિ રહ્યા,

આણી હૃદય વિચાર ।

મનમાર્યા તિહાં રાચ્યા હો સવિ આશ્યા મુજ મનમાં રહીં,

કુણુ વર એહ આચાર, વિં ૧૧૫॥

મેં જાણ્યું તુમે રાગી હો સોભાગી ત્યાગી પ્રેમતા,
 પુણ્ય તણા અંકુર ।
 મુજ મંદિરિયે આવો હો દિલ લાવો નાવો કિમ નહિ,
 જિન ઘરહિયેં હજુર. વિ० ॥૬॥
 દીજે સાહેબ સેવા હો મુખમેવા દેવા હેજથી.
 અષ્ટ કરમ મદ મોડ ।
 ચતુરવિજય ચિત્ત ધરવા હો મુખ કરવા વરવા નેમને
 સુંદર બે કર જોડ. વિ. ॥૭॥



(૮૩૯) (૩૫-૨૩) શ્રીપાર્શ્વનાથજિન સ્તવન
 (પદમણી પાણીડાં સંચરી, માણ વાવ ખોદાવો-એ દેશી)
 નયરી વારાણસી સાહેબો, પ્રભુજી પાર્શ્વજિભુંદ ।
 જગદાનંદન ચંદ જગતગુરુ ! રાજતો,
 ભવિજન નયણાનંદ. ॥૧॥
 કામિત-પૂરણ-સુરતરૂ, પ્રભુજી ! પરમ આધાર ।
 દુઃખઠાવાનલ-વારક જગતગુરુ ! તું જયો,
 સજલ-જલદ સુખકાર ॥૨॥
 તુજ દરિસણથી રૂચિરાગથી, પ્રભુજી ! પરમ કૃપાલ ।
 પામું જ્ઞાન રસાળ જગતગુરુ ! સેવતાં,
 ચારિત્ર ગુણ સુવિશાળ ॥૩॥
 મુખમટકે જગ વશ કર્યો, પ્રભુજી ! પરમ પુનીત ।
 વામાદેવી મુત પ્રીત જગતગુરુ ! માહરો,
 અશ્વસેન સુવિનીત ॥૪॥

અતીત અનાગત જિનપતિ, પ્રભુજી જે વર્તમાન ।

તુજ વંદન શુભ જ્ઞાન જગતશુર ! તે સવે,

પ્રભુમું પરમનિધાન. ॥૫૫॥

ગણધર મુનિવર પ્રમુખ જે, આઘ અંત પરિવાર ।

તે વંદુ સુવિચાર જગતશુર ! ધ્યાઈએ,

કૃષ્ણપતિ-લંછન સાર. ॥૬૫॥

પાશ્વ' પ્રમુખ જે યક્ષ છે પ્રભુતીરથ રખવાળ ।

દીજે દીનદયાળ જગતશુર ! ચતુરને,

ચરણરી સેવા રસાળ. ॥૭૫॥



(૮૪૦) (૩૫-૨૪) શ્રી મહાવીરજિન સ્તવન

[શ્રી પદ્મપ્રભુજીના નામને-એ દેશી]

શાસનપતિને વંદના, હોજ્યો વાર હજાર હો સાહેબ ।

ગંગાજલમાં જે રમ્યા,

તે કિમ ૧છીલર છાર હો સાહેબ-શાં ॥ ૧ ॥

જાઈ જુઈ જસ સેવતાં, માલતી મોગર માળ હો-સાં ।

ચંપક શુભાબની વાસના,

તે આહોરે કરે કિમ આળ હો-સાં ॥૨॥

સતીય અવર ૩ ઇચ્છે નહી, નર ભોગી ભરતાર હો;-સાં ।

અવર કદાચહી આતમા, તાર તાર મુજ તાર હો-સાં ॥૩॥

૧ ન્હાતું તલાવડું, ૨ આવળમાં, ૩ ખીજો.

મૃગમદ્ધ ધન જિન વાસના, વાસિત યોધ અગાધ હો-સાં ।
 મૃગપતિ જે જસ સેવના, ફર ગયા દુખદાધ હો-સાં ॥૪॥
 નિર્યામક સત્ય સાહેબા, આલંબન તુજ લીધ હો-સાં
 ભવિ-જન-મન જિન ! તું વસ્યો,

ત્રિશલાનંદન રિદ્ધ હો-સાં ॥ ૫ ॥

એ રીધ એ સીધ તાહરી, પાત્રી પરમાણુદ હો-સાં ।
 અજ્ઞાન-તિમિરતા ભયહરે, પ્રગટયો જ્ઞાનદિષ્ટુદ હો-સાં ॥૬॥
 સૂરિ પ્રતાપે રાજ્યમાં, શુષ્કિયલ જિન શુષ્ક ગાય હો-સાં ।
 ચતુરવિજય જિન નામથી,

દિન દિન હોલત થાય હો-સાં ॥ ૭ ॥

ઈતિશ્રી ચતુરવિજયજીકૃત ચોવિંશી સંપૂર્ણ.

શ્રી વર્ધમાન સ્વામિને નમઃ
શ્રી દેવચંદ્રણ મં કૃત
સ્તવન-ચૌવિશી

(૮૪૧) (૩૬-૧) ૧-શ્રી ઋષભદેવજિન સ્તવન

[નિંદરડી વેરણ ચર્ધ-એ દેશી]

ઋષભ-જિણું શુ પ્રીતડી, કિમ કીજે હો !

કહો ચતુર વિચાર ।

પ્રભુણ જઈ અલગા વસ્યા,

તિહાં? કિણુ નવિ હો કે વચન ઉચાર-ઋં ॥ ૧ ॥

કાગળ પથ્રુ પહુંચે નહિ, નવિ પહુંચે હો !

તિહાં કે પરધાન? ।

જે પહુંચે તે તુમ સમો, નવિ ભાખે હો !

કોઈનું વ્યવધાન-ઋં ॥ ૨ ॥

પ્રીત કરે તે રાગિયા, જિનવરણ હો ! તુમે તો વીતરાગ ।

પ્રીતડી જેહ અ-રાગીથી, લેળવવી હો !

હોકોત્તર માગ-ઋં ॥ ૩ ॥

પ્રીત અનાદિની વિષભરી, તે રીતે હો ! કરવા મુજ ભાવ ।

કરવી નિરવિષ પ્રીતડી, કિણુ ભાંતે હો !

કહો અને બનાવ !-ઋં ॥ ૪ ॥

૧ તે સ્થાને, ૨ કૃત, ૩ રસ્તો

પ્રીતિ અનંતી પર થકી, જે તોડે હો ! તે જોડે એહ !
પરમ-પુરૂષથી રાગતા, એકત્વતા હો !

દાખી ગુણ ગેહ-ઋં ॥ ૫ ॥
પ્રભુજીને અવલંબતાં, નિજ પ્રભુતા હો ! પ્રગટે ગુણરાશ !
દેવચંદ્રની સેવના, આપે મુજ હો !

અવિચળ સુખવાસ-ઋં ॥ ૬ ॥



(૮૪૨) (૩૬-૨) શ્રી અજિતનાથ જિન સ્તવન
[દેખો ગતિ દેવની રે-જો દેશી]

જ્ઞાનાદિક ગુણ સંપદારે તુજ અનંત અપાર ।
તે સાંભળતાં ઉપનીરે, રૂચિ તેણે પાર ઉતાર-
-અજિત જિન ! તારજ્યો રે ! તારજ્યો દીનદયાળ-॥૧॥
જે જે કારણ જેહનોરે, સામગ્રી-સંયોગ ।
મિલતાં કારજ નિપજેરે, કર્તાતણે પ્રયોગ-અજિત૦ ॥ ૨ ॥
કાર્યસિદ્ધ કર્તા વસુરે, લહી કારણ સંયોગ ।
નિજ-પદકારક પ્રભુ મિદ્યારે,

હોય નિમિત્તહ ભોગ-અજિત૦ ॥ ૩ ॥

અજકુળ^૧-ગત કેસરી^૨ લહેરે, નિજ^૩-પદ સિંહ નિહાળ ।
તિમ પ્રભુ ભકતે ભવિ લહેરે,

આતમ-શક્તિ સંભાળ-અજિત૦ ॥૪॥

કારણપદ કર્તાપણે રે, કરી આરોપ અ-ભેદ ।

નિજ-પદ અરથી પ્રભુ થકી રે, કરે અનેક ઉમેદ-અજિત૦ ॥૫॥

૧ બકરીના ટોળામાં રહેલ, ૨ સિંહ, ૩ પોતાપણું,

અહુવા પરમાત્મ પ્રભુ રે, પરમાનંદ સ્વરૂપ ।
 કયાદ્રાઢ-સત્તા-રસીરે, અ-મલ અ-ખંડ અનૂપ-અનિત ૦ ॥૬॥
 આરોપિત સુખ-બ્રમ ટલ્યો રે, ભાસ્યો અ-વ્યાખાધ ।
 સમર્થો અભિલાષીપણેરે, કર્તા સાધન સાધ્ય-અનિત ૦ ॥૭॥
 ગ્રાહકતા સ્વામિત્વતારે, વ્યાપક ભોક્તાભાવ ।
 કારણુતા કારજદશારે, સકળ ગ્રહું નિજ-ભાવ-અનિત ૦ ॥૮॥
 શ્રદ્ધા ભાસન રમણુતારે, દાનાદિક-પરિણામ ।
 સકળ થયા સત્તા-રસી રે, જિનવર દરસણુ પામ-અનિત ૦ ॥૯॥
 તેણે નિર્યામક-માહણુ રે, વૈદ્ય ગોપ આધાર ।
 દૈવચંદ્ર સુખસાગરરે, ભાવ-ધરમ-દાતાર-અનિત ૦ ॥ ૧૦ ॥



(૮૪૩) (૩૬-૩) શ્રી સંભવનાથ-જિન સ્તવન

[ધણુરા ઢોળા]

શ્રી સંભવ જિનરાજણ રે,

તાહરું અ-કલ્પ સ્વરૂપ-જિનવર પૂજો ।
 સ્વ-પરપ્રકાશક^૧-દિનમણિ રે, સમતા-રસનો ભૂપ-જિન-
 પૂજો પૂજો રે ભવિક ! જિન પૂજો !

પ્રભુ પૂજ્યા પરમાનંદ-જિન ૦ ॥૧॥

અર-વિસંવાદ નિમિત્ત છો રે, જગજંતુ-સુખ કાજ-જિન ૦ ।
 હેતુ-સત્ય બહુમાનથી રે, જિન સેવ્યાં શિવરાજ-જિન ૦ ॥૨॥

૧ સૂર્ય, ૨ સચોટ,

ઉપાદાન આતમ સહી રે, પુષ્ટાલંબન દેવ-જિન૦ ।
 ઉપાદાન-કારણ પણે રે, પ્રગટ કરે પ્રભુ સેવ-જિન૦ ॥૩૩॥
 કાર્ય-ગુણ-કારણપણે રે, કારણ-કાર્ય અનૂપ-જિન૦ ।
 સકળ સિદ્ધતા તાહરી રે, માહરે સાધન રૂપ-જિન૦ ॥૪૧॥
 એકવાર-પ્રભુ-વંદનારે, આગમ રીતે થાય-જિન૦ ।
 કારણ-સત્યે કાર્યનીરે, સિદ્ધિ-પ્રતીત કરાય-જિન૦ ॥ ૫ ॥
 પ્રભુપણે પ્રભુ ઓલખીરે, અ-મલ વિ-મલ ગુણ ગેહ-જિન૦ ।
 સાધ્ય-દષ્ટિ સાધકપણે રે, વંદે ધન નર તેહ-જિન૦ ॥૧૧॥
 જન્મ કૃતારથ તેહનોરે, દિવસ સરૂળ પણ તાસ-જિન૦ ।
 જગત-શરણ જિન-ચરણને રે, વંદે ધરીય ઉલ્લાસ-જિન૦ ॥૧૭॥
 નિજ-સત્તા નિજ-ભાવથીરે, ગુણ અનંતનો ઠાણ-જિન૦ ।
 દેવચંદ્ર જિનરાજી રે, શુદ્ધ સિદ્ધ-સુખ ખાણ-જિન૦ ॥૮૧॥



(૮૪૪) (૩૬-૪) શ્રી અભિનંદન-જિન સ્તવન

[બ્રહ્મચર્ય પદ પૂજ્યે હો વિનીત-જે દેશી]

કયું જાણું કયું બની આવહી,

અભિનંદન રસ રીત-હો મિત્ત !

પુદ્ગલ-અનુભવ ત્યાગથી,

કરવી જસ પરતીત-હો મિત્ત કયું ॥ ૧ ॥

પરમાતમ પરમેશ્વર, વસ્તુગતે તે અ-લિપ્ત-હો મિત્ત ।

દ્રવ્યે દ્રવ્ય મિલે નહી,

ભાવે તે અન્ય અ-વ્યાપ્ત-હો મિત્ત કયું ॥ ૨ ॥

શુદ્ધ-સ્વરૂપ સનાતનો, નિર્મલ જે નિરસંગ-હો મિત્ત ! ।

આત્મ-વિષ્ણુ તે પરિભ્રમ્યો,

ન કરે તે પર-સંગ-હો મિત્ત ! કયું ૦ ॥ ૩ ॥

પણ જાણું આગમ બળે, મિલવો તુમ પ્રભુ સાથ-હો મિત્ત ! ।

પ્રભુ તો સ્વ-સંપત્તિ મર્ધ,

શુદ્ધ સ્વરૂપનો નાથ-હો મિત્ત ! કયું ૦ ॥ ૪ ॥

પર-પરિણામિકતા અછે, તે તુજ પુદ્ગલ-ભેગ-હો મિત્ત ! ।

જડ-ચલ જગની ઐઠનો,

ન ઘટે તુજને ભોગ-હો મિત્ત ! કયું ૦ ॥ ૫ ॥

શુદ્ધ નિમિત્ત પ્રભુ બ્રહ્મો, કરી અ-શુદ્ધિ પરિહેય-હો મિત્ત ! ।

આત્માલંબી ગુણુલયી,

સહુ સાધકનો ધ્યેય-હો મિત્ત ! કયું ૦ ॥ ૬ ॥

જિમ જિન-વર આલંબને, વધે સુધે એક-તાન-હો મિત્ત ! ।

તિમ તિમ આત્માલંબની,

અહે સ્વરૂપ નિહાન-હો મિત્ત ! કયું ૦ ॥ ૭ ॥

સ્વ-સ્વરૂપ એકત્વતા, સાધે પૂર્ણાનંદ-હો મિત્ત ! ।

રમે ભોગવે આતમા, રતનત્રયો ગુણુવૃંદ-હો મિત્ત ! કયું ૦ ॥ ૮ ॥

અભિનંદન અવલંબને, પરમાનંદ-વિલાસ-હો મિત્ત ! ।

દેવચંદ્ર-પ્રભુ સેવના,

કરી અનુલવ-અભ્યાસ હો મિત્ત ! કયું ૦ ॥ ૯ ॥

(૮૪૫) (૩૬-૫) શ્રી સુમતિનાથજિન સ્તવન

[કડખાની દેશી]

અહો શ્રી સુમતિજન શુદ્ધતા તાહરી,

સ્વ-ગુણ-પર્યાય-પરિણામ રામી ।

નિત્યતા એકતા અસ્તિતા ઇતરચુત,

લોગ્ય-લોગી થકો પ્રભુ અ-કામો-અહો ॥ ૧ ॥

ઉપજે વ્યય લહે તહવિ તેહવે રહે,

ગુણ-પ્રમુખ બહુલતા તહવી પિંડી ।

આત્મ-ભાવે રહે અ-પરતા નવિ ગ્રહે,

લોક-પરદેશ-મિત પિણુ અ-ખંડી-અહો ॥ ૨ ॥

કાર્ય-કારણપણે પરિણુમે તહવિ ધ્રુવ,

કાર્ય ભેદે કરે પિણુ અ-ભેદી ।

કર્તૃતા પરિણુમે નવ્યતા નવિ રમે,

સકલવેત્તા થકો પિણુ અ-ભેદી-અહો ॥ ૩ ॥

શુદ્ધતા બુદ્ધતા દેવ પરમાત્મતા,

સહજ નિજ-ભાવ લોગી અ-યોગી ।

સ્વ પર-ઉપયોગી તાદાત્મ્ય-સત્તારસી,

શક્તિ પરબુજતો ન પ્રયોગી-અહો ॥ ૪ ॥

વસ્તુ નિજ-પરિણુમે સર્વ પારિણુમિકી,

એતલે કોઈ પ્રભુતા ન પામે ।

કરે જાણે રમે અનુભવે તે પ્રભુ,

તત્ત્વ સ્વામીત્વ શુચિ-તત્ત્વ ધામે-અહો ॥ ૫ ॥

૧ વાપરતો,

જીવ નવિ પુગ્ગલી નેવ પુગ્ગલ કદા,
 પુગ્ગલાધાર નહીં તાસ રંગી ।
 પર તણે ઈશ નહી અ-પર ઐશ્વર્યતા,
 વસ્તુ-ધર્મે કદા ન પર-સંગી-અહો ॥ ૧ ॥
 સંગ્રહે નહીં આપે નહીં પર-ભણી,
 નવિ કરે આદરે ન પર રાખે ।
 શુદ્ધ સ્યાદ્દાદ નિજભાવ-ભોગી જિકે,
 તેહ પરભાવને કેમ ચાખે !-અહો ॥ ૭ ॥
 તાહરી શુદ્ધતા-ભાસ-આશ્ચર્યથી,
 ઉપજે રૂચિ તેણે તત્વ ? છંદે ।
 તત્વરંગી થયો દોષથી ઉભગો,
 દોષ ત્યાગી ટળે તત્વ લીધે.-અહો ॥ ૮ ॥
 શુદ્ધ-માર્ગે વધ્યો સાધ્ય સાધન સધ્યો,
 સ્વામી પ્રતિ-છંદ સત્તા આરાધે ।
 આત્મ-નિષ્પત્તિ તિમ સાધના નવિ ટિકે,
 વસ્તુ ઉત્સર્ગે આતમ-સમાધે-અહો ॥ ૯ ॥
 માહરી શુદ્ધ-સત્તા તણી પૂર્ણતા,
 તેહનો હેતુ પ્રભુ તુંહિ સાચો ।
 દેવચંદ્રે સ્તંભો મુનિ-ગણે અનુભવ્યો,
 તત્વ-ભકતે ભવિક સકળ રાચો-અહો ॥ ૧૦ ॥



૧ છંદે, ૨ તત્વની રૂચિથી,

(૮૪૬) (૩૬-૬) શ્રી પદ્મપ્રભાજિન સ્તવન

[હું તુજ આગળ શી કહું ? કેશરીયા લાલ-ભેદેશી]

શ્રી પદ્મપ્રભાજિન ગુણનિધિ રે લાલ,

જગતારક જગદીશ રે-વાલ્હેસર ।

જિન-ઉપગાર થકી લહે રે લાલ,

ભવિજન સિદ્ધિ^૧ જગીશ રે-વા૦ ॥૧॥

તુજ દરિસણુ મુજ વાલહો રે લાલ,

દરસણુ શુદ્ધ પવિત્તરે-વા૦

દશાંન શબ્દનયે કરે રે લાલ,

સંગ્રહ-એવંબૂત રે-વા૦તુજ૦ ॥૨॥

બીજે વૃક્ષ અનંતતા રે લાલ, પસરે ભૂ-જલ યોગ રે-વા૦ ।

તે મુજ આતમ-સંપદારે લાલ,

પ્રગટે પ્રભુ-સંયોગ રે-વા૦તુજ૦ ॥૩॥

જગતજંતુ કારજ-રૂચિ રે લાલ, સાધે ઉગે ભાણુ રે-વા૦

ચિદ્ધાનંદ સુ-વિલાસતા રે લાલ,

વાધે જિનવર ઝાણુ રે-વા૦તુજ૦ ॥૪॥

લબ્ધિ સિદ્ધિ મંત્રાક્ષરે રે લાલ, ઉપજે સાધક-સંગ રે-વા૦ ।

સહેજ અધ્યાતમ તત્વતા રે લાલ,

પ્રગટે તત્વી-રંગ રે-વા૦તુજ૦ ॥૫॥

લોહ-ધાતુ કંચન હુવે રે લાલ, પારસ-ફરસન^૨ પામીરે-વા૦ ।

પ્રગટે અધ્યાતમદશા રે લાલ,

વ્યક્ત-ગુણી ગુણુઆમરે-વા૦ તુજ૦ ॥૬॥

૧ મોટી, ૨ સ્પર્શ.

આત્મરિક્ષિ કારજ ભણીરે લાલ,

સહજ નિર્યામિક હેતુ રે-વા૦ ।

નામાદિક જિનરાજના રે લાલ,

ભવસાગર મહાસેતુ રે-વા૦ તુજ૦ ॥૭૧॥

થંભન ઈન્દ્રિય-યોગનોરે લાલ,

રક્ત વરણુ ગુણુ ગાય રે-વા૦ ।

દેવચંદ્ર-વૃંદે સ્તવ્યો રે લાલ,

આપે અવણુ અકાયરે-વા૦ તુજ૦ ॥૮૧॥

(૮૪૭) (૩૬-૭) શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન

(હો સુંદર! તપ સારિખું જગ કો નહી-એ દેશી)

શ્રીસુપાસ આણુંદ મેં, ગુણુ અનંતનો કંદ હો જિનજી ।

જ્ઞાનાનંદે પૂરણો, પવિત્ર ચારિત્રાનંદ હો-જિ૦-શ્રી૦ ॥૧॥

સંરક્ષણુ વિણુ નાથ છો, દ્રવ્ય વિના ધનવંત હો-જિ૦ ।

કરતાપદ કિરિયા વિના, સંત અજેય અનંત હો-જિ૦ શ્રી૦ ॥૨॥

અગમ અગોચર અમર તું, અન્વય ઋદ્ધિ સમૂહ હો-જિ૦ ।

વરણુ-ગંધ-રસ-ફરસ વિણુ,

નિજ ભોક્તા ગુણુબૂહ હો-જિ૦ શ્રી૦ ॥૩॥

અક્ષયદાન અચિંતના, લાભ અ-યત્ને ભોગ હો-જિ૦ ।

વીર્ય-શક્તિ અપ્રયાસતા,

શુદ્ધ સ્વગુણુ ઉપભોગ હો-જિ૦ શ્રી૦ ॥૪॥

એકાંતિક આત્યંતિકો, સહજ અ-કૃત સ્વાધીન હો-જિ૦ ।

નિરૂપચરિત નિર્દંદ સુખ, અન્ય અહેતુક પીન હો-જિ૦ શ્રી૦ ॥૫॥

એક પ્રદેશે તાહરે, અ-વ્યાખાધ સમાય હો-જિં ૦ ।
 તસુ પર્યાય અ-વિભાગતા, સર્વાકાશ ન માય હો-જિં ૦ શ્રીં ૦ ॥૬॥
 ઈમ અનંત-ગુણનો ધણી, ગુણ ગુણનો આનંદ હો-જિં ૦ ।
 ભોગરમણ આસ્વાદ યુત, પ્રભુ ! તું પરમાનંદ હો-જિં ૦ શ્રીં ૦ ॥૭॥
 અવ્યાખાધ-રૂચિ થઈ, સાધે અવ્યાખાધ હો-જિં ૦ ।
 દેવચંદ્ર પદ તે લહે, પરમાનંદ સમાધ હો-જિં ૦ શ્રીં ૦ ॥૮॥

(૮૪૮) (૩૬-૮) શ્રી ચંદ્રપ્રભજિન સ્તવન

(શ્રી શ્રેયાંસજિન અંતરજામી-એ દેશી)

શ્રી ચંદ્ર પ્રભ જિન-પદ સેવા, હેવાયે જે હુજિયાળ ।
 આતમ-ગુણ-અનુભવથી મળિયા,
 તે ભવભયથી ટળિયાળ-શ્રીં ૦ ॥૧॥
 દ્રવ્યસેવ વંદન-નમનાદિક, અર્ચન વળી ગુણગ્રામેળ ।
 ભાવ અલેહ થાવાની ઈહા, પરભાવે નિઃકામેળ-શ્રીં ૦ ॥૨॥
 ભાવસેવ અપવાદે નૈગમ, પ્રભુ-ગુણને સંકલ્પેળ ।
 સંપ્રહ-સત્તા તુલ્યારોપે, ભેદાલેહ વિકલ્પેળ-શ્રીં ૦ ॥૩॥
 વ્યવહારે બહુમાન જ્ઞાનનિજ, ચરણે નિજ-ગુણ રમણાળ ।
 પ્રભુ-ગુણ આલંબી પરિણામે,
 નહીં પદ દયાને રમરણાળ-શ્રીં ૦ ॥૪॥
 શબ્દે શુકલ-ધ્યાનારોહણ, સમિભરૂં ગુણ દશમેળ ।
 ખીઅ ? શુકલ અવિકલ્પ એકત્વે,
 એવંભૂત તે અ-મમેળ-શ્રીં ૦ ॥૫॥

૧ શુકલધ્યાનના બીજ પાયે

ઉત્સર્ગે સમક્રિત-ગુણ પ્રગટયે, નૈગમ પ્રભુતા અંશેણ ।

સંપ્રહ આતમ સત્તાલંબી, મુનિપદ ભાવ પ્રસન્ન શેણ-શ્રી૦ ૧૦૬ ॥

ઋણુસૂત્રે શ્રેણિ-પદસ્થે, આતમશક્તિ પ્રકાશેણ ।

યથાખ્યાત પદ શબ્દ-સ્વરૂપે, શુદ્ધ-ધર્મ ઉદ્ભાસેણ-શ્રી૦ ૧૦૭ ॥

ભાવસયોગી અયોગી શૈલેશે, અત્ય દુઃગ-નય જાણેણ ।

સાધનતા એ નિજ-ગુણ-વ્યક્તિ,

તે સેવના વખાણેણ-શ્રી૦ ૧૦૮ ॥

કારણ ભાવ તેહ અપવાદે કાર્ય રૂપ ઉત્સર્ગેણ ।

આતમભાવ તે ભાવદ્રવ્યપદ, બાહ્ય પ્રવૃત્તિ નિસર્ગોણ-શ્રી૦ ૧૦૯ ॥

કારણભાવ-પરંપર-સેવન, પ્રગટે કારય-ભાવેણ ।

કારય-સિદ્ધે કારણતા-વ્યય,

શુચિ પરિણામિક ભાવેણ-શ્રી૦ ૧૧૦ ॥

પરમ ગુણી-સેવન તન્મયતા, નિશ્ચય-ધ્યાને ધ્યાવેણ ।

શુદ્ધાતમ-અનુભવ-આસ્વાદી, દેવચંદ્ર-પદ પાવેણ-શ્રી૦ ૧૧૧ ॥



(૮૪૯) (૩૬--૯) શ્રી સુવિધિનાથ જિન સ્તવન

(થારા મહેલાં ઉપર મેહ જરૂએ—એ દેશી)

દીઠો સુવિધિ જિણુંદ સમાધિ રસે ભર્યો-હો લાલ-સમાધિ૦,

ભાસ્યો આતમસ્વરૂપ અનાદિનો વિસર્યો હો લાલ-અનાદિ૦ ।

સકળ વિભાવ ઉપાધિ થકી મન એસર્યો હો લાલ-થકી૦,

સત્તા-સાધન માર્ગ ભણીએ સંચર્યો-હો લાલ-ભણી૦ ૧૧૨ ॥

જુમ પ્રભુ જાણુગ રીતિ સરવ જગ દેખતાં હો લાલ-સ૦ ।

નિજ-સત્તાએ શુદ્ધ સહુને લેખતાં હો લાલ સહુ૦ ।

પરપરિશ્રુતિ અદ્વેષપણે ઉવેખતાં-હો લાલ-પણે૦,
લોગ્યપણે નિજ-શક્તિ અનંત

ગવેખતા હો લાલ-અનંત૦ ॥૨૧॥

દાનાદિક નિજ-લાવ હતા જે પરવશ્યા-હો લાલ-હતા૦,
તે નિજ સનમુખ-લાવ ગ્રહે લહી તુજ દશા-હો લાલ-ગ્રહે૦
પ્રભુનો અદ્ભુત યોગ-સ્વરૂપતણી રસા-હો લાલ-સ્વરૂપ૦,
ભાસે વાસ તાસ જાસ ગુણ તુજ જિસા-હો લાલ-ગુણ ॥૪૧॥
મોહાદિકની ધૂમિ અનાદિની બિતરે-હો લાલ-અનાદિ૦,
અમલ અખંડ અસ્થિત સ્વભાવ જ સાંભરે-હો લાલ-સ્વ૦ ।
તત્ત્વ-રમણુ શુચિ-ધ્યાન ભણી જે આદરે-હો લાલ-ભણી૦,
તે સમતારસ-ધામ સ્વામી ! મુદ્રા વરે-હો લાલ-સ્વામી૦ ॥૪૨॥
પ્રભુ ! છે ત્રિભુવનનાથ ! દાસ હું તાહરો હો લાલ-દાસ૦,
કરૂણાનિધિ અભિલાષ અછે મુજ એ ખરો હોલાલ-અછે૦
આતમ વસ્તુ-સ્વભાવ સદા મુજ સાંભરો-હો લાલ-સદા૦,
ભાસન-વાસન એહ ચરણુ ધ્યાને ધરરો-હો લાલ-ચરણુ ॥૪૩॥
પ્રભુ-મુદ્રાનો યોગ પ્રભુ ! પ્રભુતા લખે હો લાલ-પ્રભુ૦,
દ્રવ્યતણે સાધર્મ સ્વ-સંપત્તિ ઓલખે હો લાલ-સ્વ૦ ।
ઓલખતાં બહુમાન-સહિત રૂચિ પણુ વધે હો લાલ સ૦,
રૂચિ-અનુભવી વીર્ય-ચરણુ-ધરા સધે-હો લાલ-ચરણુ ॥૪૪॥
ક્ષાયોપશમિક ગુણ સર્વ થયા તુજ ગુણ-રસી-હો લાલ-થયા૦,
સત્તા સાધન શક્તિ વ્યકતતા ઉલ્લસી હો લાલ-વ્યકતતા૦
હવે સંપૂરણુ સિદ્ધ તણી શી વાર છે-હો લાલ-તણી૦,
દેવચંદ્ર જિનરાજ જગત-આધાર છે-હો લાલ જગત ॥૪૫॥

(૮૫૦) (૩૬-૧૦) શ્રીશીતલનાથજિન સ્તવન.

(આદર છવ ક્ષમાગુણ આદર એ દેશી)

શીતલ જિનપતિ પ્રભુતા પ્રભુની, મુજથી કહી ન જાયછ ।

અનંતતા નિમ્મલતા પૂર્ણતા

જ્ઞાન વિના ન જણાયછ-શી૦ ॥૧॥

ચરમ-જલધિ-જલમિથે અંજલિ, ગતિ છપે અતિ-વાયછ ।

સર્વ-આકાશ ઉદ્દલધે ચરણે,

પિણ પ્રભુતા ન ગિણાયછ-શી૦ ॥૨॥

સર્વ-દ્રવ્ય પ્રદેશ અનંતા, તેહથી ગુણ-પર્યાયછ ।

તાસ વર્ગથી અનંતગુણે પ્રભુ !

કેવલજ્ઞાન કહાયછ. શી૦ ॥૩॥

કેવલદર્શન એમ અનંતો, ગ્રહે સામાન્ય-સ્વભાવછ ।

સ્વ-પર અનંતથી ચરણ અનંતો,

સ્વ-રમણ (સમરણ) સંવર-ભાવછ-શી૦ ॥૪॥

દ્રવ્ય ક્ષેત્ર ને કાળ-ભાવ ગુણ, રાજનીતિ એ ચ્યારછ ।

ત્રાસ વિના જડ-ચેતન પ્રભુની,

કોઈ ન લોપે? કારછ શી૦ ॥૫॥

શુદ્ધાશય ચિર પ્રભુ-ઉપયોગ, જે સમરે પ્રભુ-નામછ ।

અ-વ્યાભાધ અનંતો પામે,

પરમ-અમૃત-સુખ-ધામછ-શી૦ ॥૬॥

આણા ઇશ્વરતા નિર-ભયતા, નિરવાંચકતા રૂપછ ।

ભાવ સ્વાધીન તે અવ્યય-રીતે,

ઈમ અનંત ગુણ-ભૂપછ-શી૦ ॥૭॥

અવ્યાખ્યાય સુખ નિરમલ તે તો, કાશ્ણ-જ્ઞાન ન જણાયજી ।
 તેહજ એહનો જાણજી ભોક્તા,
 જે તુમ્હ સમ ગુણ રાયજી-શી૦ ॥૮૧॥
 ઇમ અનંત-દાનાદિક નિજ ગુણ, વચનાતીત-પંડુરજી ।
 વાસન ભાસન-ભાવે દુર્લભ,
 પ્રાપતિ તો અતિ દૂરજી-શી૦ ॥૮૨॥
 સકળ પ્રત્યક્ષપણે ત્રિભુવન-ગુરુ, જાણું તુજ ગુણ ગાયજી ।
 ખીજી કાંઈ ન માંગુ સ્વામી, એહ છે મુજ કામજી-શી૦ ॥૧૦૧॥
 ઇમ અનંત પ્રભુતા સદ્ગુણ, અરચે જે ભુ રૂપજી
 દેવચંદ્ર પ્રભુ પ્રભુતા તે પામે, પરમાનંદ સ્વરૂપજી-શી૦ ॥૧૧૧॥

(૮૫૧) (૩૬-૧૧) શ્રી શ્રેયાંસનાથજિન સ્તવન

(પાંચે પાંડવ વાંદતાં મન મોહયો રે-એ દશી,)
 શ્રીશ્રેયાંસ પ્રભુ તણો, અતિ અદ્ભુત સહજાનંદ રે ।
 ગુણ ઇકવિધ ત્રિક પરિણમ્યો, ઇમ અનંત ગુણનો વૃંદ રે-
 મુનિચંદ ! જિણુંદ ! અમંદ-દિણુંદપરે
 નિત દીપતો સુખકંદરે ॥૧॥
 નિજ જ્ઞાને કરી જ્ઞેયનો. જ્ઞાયક જ્ઞાતા પદ ઇશ રે
 દેખે નિજ દર્શન કરી. નિજ દ્રશ્ય સામાન્ય જગીશ રે-મુ૦ ॥૨॥
 નિજ રમ્યે રમણ કરો પ્રભુ ! ચારિત્રે રમતા રામ રે !
 ભોગ અનંતને ભોગવો,
 ભોગે વિષુ (તેણે) ભોક્તા સ્વામી રે-મુ૦ ॥૩॥
 દેવ દાન નિત દીજતે, અતિ દાતા પ્રભુ સ્વયમેવરે
 પાત્ર તુમે નિજ-શક્તિના ગ્રાહક વ્યાપકમય દેવરે-મુ૦ ॥૪॥

પરિણામિક કારણ તણે, કરતા ગુણ-કરણે નાથ રે ।

અ-કિય અક્ષય સ્થિતિમયી, નિકલકં અનંતી આથરે-મું ॥૫॥

પરિણામિક સત્તા તણે, આવિર્ભાવ વિલાસ નિવાસરે

સહજ અ-કૃત્રિમ અ-પરાશ્રયથી. નિર્વિકલ્પને

નિઃપ્રયાસ રે-મું ॥૬॥

પ્રભુ પ્રભુતા સંભારતાં, ગાતાં કરતાં ગુણ-આમ રે

સેવક સાધનતા વરે.

નિજ સંવર પરિણતિ પામ રે-મું ॥૭॥

પ્રગટ તત્વતા ધ્યાવતાં, નિજ તત્વનો ધ્યાતા થાય રે ।

તત્વરમણ એકાગ્રતા,

પૂરણ તત્વે એહ સમાય રે-મું ॥૮॥

પ્રભુ દીઠે મુજ સાંભરે, પરમાત્મ પૂરણાનંદ રે

દેવચંદ્ર જિનરાજના, નિત વંદો પય-અરવિંદ રે. મું ॥૯॥



(૮૫૨) (૩૬-૧૨) શ્રીવાસુપૂજ્યજિન સ્તવન

(પંચડા નિહાલું રે, બીજા જિનતણે રે (એ-દેશી)

પૂજના તો કીજે રે બારમા જિન તણી,

જશુ પ્રગટયો પૂજ્યસ્વભાવ ।

પર-કૃત પૂજા રે જે ઈચ્છે નહિ રે,

સાધક કારય દાવ-પૂં ॥૧॥

દ્રવ્યથી પૂજારે કારણ ભાવનીરે, ભાવ પ્રશસ્તને શુદ્ધ ।

પરમ ઈંટ વલ્લભ ત્રિભુવન ધણી રે,

વાસુપૂજ્ય સ્વયંભુદ્ધ-પૂં ॥૨॥

અતિશય મહિમા રે અતિ ઉપગારિતારે,

નિરમલ પ્રભુ ગુણુરાગ ।

સુરમણિ સુરઘટ સુરતરૂ તુચ્છ તે રે,

જિનરાગી મહાભાગ-પૂં ॥૩૧॥

દર્શન-જ્ઞાનાદિક ગુણુ આત્મનારે, પ્રભુ પ્રભુતા લયલીન ।

શુદ્ધ-સ્વરૂપી રૂપે તન્મયીરે, તસુ આસ્વાદન પીન-પૂં ॥૪॥

શુદ્ધ તત્વ રસરંગી ચેતના રે, પામે આત્મ સ્વભાવ ।

આત્માલંબી નિજ ગુણુ સાધતો રે,

પામે (પ્રગટે) પૂજ્ય સ્વભાવ-પૂં ॥૫॥

આપ અકર્તા સેવાથી હુવેરે, સેવક પૂરણુ સિદ્ધિ ।

નિજ ધન ન દીયે પિણુ આશ્રિત લહેરે;

અ-ક્ષર-અ-ક્ષય-રીદ્ધિ-પૂં ॥૬॥

જિનવર પૂજા તે નિજ-પૂજનારે. પ્રગટે અન્વય શક્તિ

પરમાનંદ વિલાસી અનુભવેરે, દેવચંદ્ર-પદ વ્યક્તિ-પૂં ॥૭॥



(૮૫૩) (૩૬-૧૩) શ્રી વિમલનાથજિન સ્તવન

(દાસ અરદાસ શીર પર કર કહેલ-એ દેશી)

વિમલજિન! વિમલતા તાહરીલ, અવર બીજે ન કહાય ।

લઘુ નદી જિમ તિમ લંબીએ લ,

પણુ સ્વયંભૂ-રમણુ ન તરાય-વિં ॥૧॥

સયલ પુઠવી ગિરિ જલ તરૂલ, કેઈ તોલે એક-હત્ય ।

તેહપણુ તુજ ગણુગણુ ભણીલ,

ભાખવા નહીં સમરત્ય-વિં ॥૨॥

સરવ પુદ્ગલ-નલ-ધરમનાજી, તેમ અધરમ પ્રદેશ ।

તાસ ગુણ ધરમ પાળવ સહુજી,

તુજ ગુણ ઇક તથો લેશ-વિં ॥૩૩॥

એમ નિજ ભાવ અનંતનીજી, અસ્તિતા કેતલી થાય ।

નાસ્તિતા સ્વ-પર-પદ અસ્તિતાજી,

તુજ સમ કાળ સમાય-વિં ॥૩૪॥

તાહરા શુદ્ધ-સ્વભાવનેજી, આદરે ધરી બહુમાન ।

તેહને તેહીજ નિપજેજી. અહો કોઈ અદ્ભુતતાન.-વિં ॥૩૫॥

તુમ્હે પ્રભુ ! તુમ્હે તારક વિભુજી,

તુમ્હે સમે અવર ન કોઈ ।

તુમ્હે દરસણ થકી હું તર્યોજી, શુદ્ધ આલંબન હોય-વિં ॥૩૬॥

પ્રભુ તણી વિમલતા ઓલખીજી, જે કરે થિર મન સેવ ।

દેવચંદ્ર-પદ તે લહેજી, વિમલ આનંદ સ્વયમેવ.-વિં ॥૩૭॥



(૮૫૪) (૩૬-૧૪) શ્રી અનંતનાથજિન સ્તવન

(દીઠી હો પ્રભુ ! દીઠી જગગુર ! તુજ એ દેશી)

મૂરતિ હો પ્રભુ ! મૂરતિ અનંતજિણુંદ,

તાહરી હો પ્રભુ ! તાહરી મુજ નયણે વસીજી ।

સમતા હો પ્રભુ સમતા-રસનો કંદ,

સહેજે હો પ્રભુ સહેજે અનુભવ રસ લસીજી-॥૧૧॥

ભવદવ હો પ્રભુ ભવ-દવ-તાપિત જીવ,

તેહને હો પ્રભુ તેહને અમૃતધન સમીજી ।

મિથ્યાવિષ હો પ્રભુ મિથ્યા વિષની ખીવ^૧,
 હરવા હો પ્રભુ હરવા જાંગુલિમન રમીજી. ॥૨॥
 ભાવ હો પ્રભુ ભાવ ચિંતામણિ એહ,
 આતમ હો પ્રભુ આતમસંપત્તિ આપવાજી ।
 એહિ જ હો પ્રભુ એહિ જ શિવસુખગેહ,
 તત્ત્વ હો પ્રભુ તત્ત્વાલંબન થાપવાજી ॥૩॥
 જાયે હો પ્રભુ જાયે આશ્રવ રચાણ,
 દીઠે હો પ્રભુ દીઠે સંવરતા વધેજી ।
 રતન હો પ્રભુ રતન-ત્રયી ગુણમાળ,
 અધ્યાતમ હો પ્રભુ અધ્યાતમ સાધન સધેજી ॥૪॥
 મીઠી હો પ્રભુ મીઠી સૂરતિ તુજ,
 દીઠી હો પ્રભુ દીઠી રૂચિ બહુ માનથીજી ।
 તુજ ગુણ હો પ્રભુ તુજ ગુણ ભાસન ચુકત,
 સેવે હો પ્રભુ સેવે તસુ ભવ ભય નથીજી ॥૫॥
 નામે હો પ્રભુ નામે અદ્ભુત રંગ,
 ઠવણા હો પ્રભુ ઠવણા દીકાં ઉલ્લસેજી ।
 ગુણુ-આસ્વાદ હો પ્રભુ ગુણુ-આસ્વાદ અભંગ,
 તનમય હો પ્રભુ તનમયતાએ જે ધસેજી ॥૬॥
 ગુણુઅનંત હો પ્રભુ ગુણુ અનંતનો વૃંદ,
 નાથ હો પ્રભુ નાથ અનંતને આદરેજી ।
 દેવચંદ્ર હો પ્રભુ દેવચંદ્રને આણુંદ,
 પરમ હો પ્રભુ પરમ મહોદય તે વરેજી ॥૭॥



(૮૫૫) (૩૬-૧૫) શ્રી ધર્મનાથજિન સ્તવન

(સકળ સંસાર અવતાર એ હું ગણું-એ દેશી)

ધરમ જગનાથનો ધર્મ શુચિ ગાઈએ,

આપણે આતમા તેહવે ભાવિયે ।

બલિ જસુ એકતા તેહ પલટે નહિ,

શુદ્ધ ગુણ-પજજવા વસ્તુ સત્તા સહીં ॥૧॥

નિત્ય નિરવયવ વળી એક અ-ક્રિય પણે,

સર્વગત તેહ સામાન્ય ભાવે લણે ।

તેહથી ઈતર સાવયવ-વિશેષતા,

વ્યક્તિ-ભેદે પડે જેહની ભેદતા ॥૨॥

એકતા પિંડને નિત્ય અ-વિનાશતા,

અસ્તિ નિજ-રીદ્ધિથી કાર્યગત ભેદતા

ભાવશ્રુત-ગમ્ય અભિલાષ્ય અનંતતા,

ભવ્ય-પર્યાયની જે પરાવર્તિતા ॥૩॥

ક્ષેત્ર-ગુણ ભાવ અ-વિભાગ અનેકતા,

નાશ-હૃતપાદ અનિત્ય પરનાસ્તિતા ।

ક્ષેત્ર-વ્યાખ્યત્વ અ-ભેદ અ-વકતવ્યતા,

વસ્તુ તે રૂપથી નિયત અભવ્યતા ॥૪॥

ધર્મ-પ્રાગભાવતા સકળ ગુણ-શુદ્ધતા,

ભોગ્યતા કર્તૃતા રમણ પરિણામતા ।

શુદ્ધ-સમ્રદેશતા તત્ત્વ ચૈતન્યતા,

વ્યાપ્ય-વ્યાપક તથા આદ્ય-આહુકગતા ॥૫॥

સંગ-પરિહારથી સ્વામી ! નિજ પદ લહું,

શુદ્ધ આત્મિક-આનંદ પદ સંગ્રહું ।

જઈ વિ પરભાવથી હું ભવોદ્ધિ વસ્યો,

પર તણે સંગ સંસારતાએ ગસ્યો ॥૬૫॥

તહવિ સત્તા-શુણે છવ છે નિરમળો,

અન્ય-સંશ્લેષ જિમ કટિક નવિ શામળો ॥

જે પરોપાધિથી દુષ્ટ-પરિણુતિ ગ્રહી,

ભાવ-તાદાત્મ્યમાં માહરૂં તે નહીં ॥૬૬॥

તિણે પરમાત્મ-પ્રભુ-ભક્તિ-રંગી થઈ,

શુદ્ધ કારણ રસે તત્ત્વ-પરિણુતિમયી ॥

આત્મ-ગ્રાહક થયે તજે પર-ગ્રહણતા,

તત્ત્વ-ભોગી થયે ટળે પર-ભોગિતા ॥૬૭॥

શુદ્ધ નિઃપ્રયાસ નિજ ભાવ-ભોગી યદા,

આત્મક્ષેત્રે નહીં અન્ય-રક્ષણ તદા ॥

એક અ-સહાય નિરસંગ નિરદ્વંદ્વતા,

શક્તિ ઉત્સર્ગીની હોય સહુ વ્યક્તતા ॥૬૮॥

તિણે મુજ આતમા તુજ થકી નિપજે,

માહરી સંપદા સકળ મુજ સંપજે ॥

તિણે મનમંદિરે ધર્મ-પ્રભુ ધ્યાઈયેં,

પરમ દેવચંદ્ર નિજ સિદ્ધિ-સુખ પાઈયે ॥૧૦૧॥



(૮૫૬) (૩૬-૧૬) શ્રી શાંતિનાથજિન સ્તવન

(માલા કિહાં છે રે—એ દેશી)

(આંખડીયે મેં આજ શત્રુજય દીઠો રે—એ દેશી)

જગતદિવાકર જગત કૃપાનિધિ,

વાદહા મારા ! સમવસરણુમેં જોઃ ॥

ચૌમુખ ચક્રવિહુ ધર્મ પ્રકાશે, તે મેં નયણે દીઠારે-
ભવિક જન હરખો રે ! નિરખી શાંતિજિણુંદ-ભ૦,
ઉપશમ-રસનો કંદ, નહિ ઈણું સરખો રે. ॥૧૧॥

પ્રાતિહાય અતિશય શોભા, વાં તે તો કહિય ન જાવે ।
ઘૂક-ખાલકથી રવિ-કર-ભરનો;
વણું ન કિણુપરે થાવે રે ? ભ૦ ॥૧૨॥

વાણી ગુણ પાંત્રીશ અનોપમ, વાં અ-વિસંવાદ-સરૂપે ।
ભવ-હુઝવારણુ શિવ-સુખકારણુ, શુદ્ધધર્મ પ્રરૂપેરે-ભ૦ ॥૧૩॥
દક્ષિણ પશ્ચિમ ઉત્તર દિશિ મુખ, વાં ઠવણુ જિન ઉપગારી ।
તસુ આલંબન લહીય અનોપમ,

તિહાં થયા સમકિત-ધારી-॥૧૪॥

ખટ નય કાર્ય રૂપે ઠવણુ, વાં સગ નય કારણુ ઠાણી ।
નિમિત્ત સમાન થાપના જિનજી, એ આગમની વાણી-ભ૦ ॥૧૫॥
સાધક ત્રીન નિશ્લેષા મુખ્યે, વાં જે વિણુ ભાવ ન લહીયે ।
ઉપગારી હુગ ભાળ્યે ભાખ્યા, ભાવ વંદકનો ગહીયેરે-ભ૦ ॥૧૬॥
ઠવણુ સમવસરણુ જિનસેંતી, વાં જો અ-ભેદતા વાધી ।
એ આત્માના સ્વભાવ ગુણ, વ્યક્ત યોગ્યતા સાધી-ભ૦ ॥૧૭॥
ભલું થયું મેં પ્રભુગુણ ગાયા, વાં રસનાનો ફળ લીધો ।
દેવચંદ્ર કહે મહારા મનનો, સકળ મનોરથ સીદ્ધો. ભ૦ ॥૧૮॥

(૮૫૭) (૩૬-૧૭) શ્રીકુંથુનાથ-જિન સ્તવન (ચરમ જિણુસર-એ દેશી)

સમવસરણુ જેસી કરી રે, ખારહ પરખદ માંહિ ।
 વસ્તુ-સ્વરૂપ પ્રકાશતા રે, કરૂણાકર જગનાહો રે. ॥૧॥
 કુંથુજિનેસર....! નિરમલ તુજ મુખ વાણિ રે ।
 જે શ્રવણે સુણે, તેહિજ શુભ-મણિ-ખાણિ રે-કું ॥૨॥
 શુભ-પર્યાય અનંતતા રે, વળી સ્વભાવ અ-ગાહ ।
 નય-ગમ લંગ-નિશ્લેષ ના રે, હેયાદેય-પ્રવાહ રે-કું ॥૩॥
 કુંથુનાથ પ્રભુ દેશના રે, સાધન સાધક સિદ્ધ ।
 ગૌણ-મુખ્યતા વચનમે' રે, જ્ઞાન તે સકલ સમૃદ્ધ રે-કુંથુનાથ ॥૪॥
 વસ્તુ અનંત-સ્વભાવ છે રે, અનંત કથક તસુ નામ ।
 આહક અવસર-બોધથી રે, કહેવે અપિંત-કામો રે-કુંથુ ॥૫॥
 શેષ અનર્પિત-ધર્મને રે, સાપેક્ષ શ્રદ્ધા-બોધ ।
 ઉભય-રહિત ભાસન હવે રે, પ્રગટે કેવલ-બોધ રે-કુંથુ ॥૬॥
 છતી પરિણતિ શુભ-વર્તનારે, ભાસન ભોગ આણુંદ ।
 સમકાળે પ્રભુ ! તાહરે રે, રમ્ય-રમણુ શુભવૃંદો રે-કુંથુ ॥૭॥
 નિજ-ભાવે સિય અસ્તિતા રે, પર-નાસ્તિત્વ-સ્વભાવ ।
 અસ્તિપણે તે નાસ્તિતા રે, સિય તે ઉભય-સ્વભાવો રે-કુંથુનાથ ॥૮॥
 અસ્તિ-સ્વભાવ જે આપણો રે, રૂચિ વૈરાગ્ય-સમેત ।
 પ્રભુ સન્મુખ વંદન કરી રે, માગીશ આતમ-હેતો રે-કુંથુનાથ ॥૯॥
 અસ્તિ-સ્વભાવ જે રૂચિ થઈ રે, ધ્યાતો અસ્તિ-સ્વભાવ ।
 દેવચંદ્ર પદ તે લહે રે, પરમાનંદ જમાવો રે-કુંથુ ॥૧૦॥



(૮૫૮) (૩૬-૧૮) શ્રી અરનાથ-જિન સ્તવન

(રામચંદ્રકે બાગ આંબો ભોરી રહ્યો રી-એ દેશી)

- પ્રભુમો શ્રી અરનાથ, શિવપુર સાથ ખરોરી ।
 ત્રિભુવન-જન-આધાર, ભવ-નિસ્તાર કરોરી. ॥૧॥
- કરતા કારણુ યોગ, કાર્ય-સિદ્ધિ લહેરી ।
 કારણુ ચ્યાર અનૂપ, કાર્યથી તેહ ગહેરી. ॥૨॥
- જે કારણુ તે કાર્ય, થાયે પૂર્ણ-પઢેરી ।
 ઉપાદાન તે હેતુ, માટી ઘટ જેમ વઢેરી. ॥૩॥
- ઉપાદાનથી ભિન્ન, જે વિણુ કાર્ય ન થાયે ।
 ન હુવે કાર્ય-રૂપ, કર્તાને વ્યવસાયે. ॥૪॥
- કારણુ તેહ નિમિત્ત, ચક્રાદિક ઘટ-ભાવે ।
 કાર્ય તથા સમવાય-કારણુ નિયતને દાવે. ॥૫॥
- વસ્તુ અભેદ-સરૂપ, કાર્યપણું ન ગહેરી ।
 તે અ-સાધારણુ હેતુ, કુંભે થાસ લહેરી. ॥૬॥
- જેહનો નવિ વ્યાપાર, ભિન્ન નિસત બહુ ભાવી ।
 ભૂમિ કાળ આકાશ, ઘટ કારણુ સદ્ભાવી. ॥૭॥
- એહ અપેક્ષા-હેતુ, આગમમાંહિ કહ્યોરી ।
 કારણુ પદ ઉત્પન્ન, કાર્ય થયે ન લહ્યોરી, ॥૮॥
- કર્તા આતમ દ્રવ્ય, કાર્ય સિદ્ધિ-પણોરી ।
 નિજ-સત્તાગત ધર્મ, તે ઉપાદાન ગણોરી. ॥૯॥
- યોગ-સમાધિ-વિધાન, અ-સાધારણુ તેહ વઢેરી ।
 વિધિ-આચરણુ ભકિત, જિણે નિજ કાર્ય સધેરી. ॥૧૦॥

નરગતિ પદમ-સંઘયણ, તેહ અપેક્ષા જાણેારી ।	
નિમિત્તાશ્રિત-ઉપાદાન, તેહને લેખે આણેારી.	॥૧૧॥
નિમિત્ત હેતુ જિનરાજ, સમતા-અમૃતખાણી ।	
પ્રભુ આલંબન સિદ્ધિ, નિયમા એહ વખાણી.	॥૧૨॥
યુગ્ત હેતુ અરનાથ, તેહના શુણ્ઠી હીલીયે ।	
રીઝ-ભક્તિ-બહુમાન, ભોગ-ધ્યાનથી મીલિયે.	॥૧૩॥
ઝોટાને ઉછંગ, ઝેઠાને શી ચિંતા ? ।	
તિમ પ્રભુ-ચરણ પસાય, સેવક થયા ન-ચિંતા.	॥૧૪॥
અરપ્રભુ પ્રભુતા રંગ, અંતર-શક્તિ વિકાસી ।	
દેવચંદ્ર આણુંદ, અ-ક્ષય-ભોગ વિલાસી.	॥૧૫॥



(૮૫૯) (૩૬-૧૯) શ્રી મલ્લિનાથ-જિન સ્તવન

(કરતાં સેતી પ્રીતિ સહુ હુંસી કરે રે-એદેશી)

મલ્લિનાથ જગનાથ, ચરણ-યુગ ધ્યાઈયે રે-ચરણ૦,	
શુદ્ધાતમ-પ્રાગભાવ, પરમ પદ પાઈયે રે-પરમ૦ ।	
સાધક-કારક ખટ, કરે શુણ્ઠ સાધના રે-કરે૦	
તેહિજ શુદ્ધ સરૂપ, થાયે નિરાખાધના રે-થાયે૦	॥૧॥
કર્તા આતમ દ્રવ્ય, કાર્યની સિદ્ધતા રે-કાર્ય૦	
ઉપાદાન પરિણામ પ્રયુક્ત, તે કરણતા રે-પ્રયુક્ત૦ ।	
આતમ-સંપદ દાન, તેહ સંપ્રદાનતારે-તેહ૦,	
દાતા પાત્ર ને દેય, ત્રિ-ભાવ અ-ભેદતા રે-ત્રિભાવ૦	॥૨॥
સ્વ-પર વિવેચન કરણ, તેહ અપાદાનથી રે-તેહ૦,	
સકળ-પર્યાય-આધાર, સંબંધ આસ્થાનથી રે-સંબંધ૦ ।	

બાધક-કારક ભાવ, અનાદિ નિવારવોરે-અનાદિં,
સાધકતા અવલંબી, તેહ સમારવો રે-તેહં ॥૩૧॥

શુદ્ધપણે પર્યાય, પ્રવર્ત્તન કાર્યને રે-પ્રવં,
કર્તાદિક પરિણામ, તે આતમ-ધર્મ (મેં) નેરે-તેં ।
ચેતન-ચેતન્ય ભાવ, કરે સમવેતમેં રે-કરે,
સાદિ-અનંતો કાળ, રહે નિજ ખેતમેં રે-રહેં ॥૩૨॥

પર-કર્તૃત્વ-સ્વભાવ, કરે ત્યાં લગીરે-કરેં,
શુદ્ધ કાર્ય-રૂચિ ભાસ, થયે નવિ આદરેરે-થયેં ।
શુદ્ધાતમ નિજ કાર્ય-રૂચિ કારક ફિરેરે-રૂચિં,
તેહિજ મૂળ સ્વભાવ, ગ્રહો નિજ પદ વરેરે-ગ્રહોં ॥૩૩॥

કારણ-કારણ રૂપ, અછે કારકદંશા રે-અછે,
વસ્તુ પ્રગટ પર્યાય, એહ મનમેં વસ્યા રે-એહં ।
પણ શુદ્ધ-સરૂપ ધ્યાન, ચેતનતા ગ્રહે રે-ચેતનં,
તવ નિજ સાધક-ભાવ, સકળ કારક લહે રે-સકળં ॥૩૪॥

માહરૂં પૂર્ણાનંદ, પ્રગટ કરવા ભણી રે-પ્રગટં
પુષ્ટાલંબન રૂપ સેવ, પ્રભુજી તણી રે-સેવં ।
દેવચંદ્ર જિનચંદ્ર, ભગતિ મનમેં ધરો રે, ભગતિં ।
અન્યાબાધ અનંત, અખયપદ આદરો રે-અખયં ॥૩૫॥



(૮૬૦) (૩૬-૨૦) શ્રી મુનિસુવ્રતજિન સ્તવન
 (ઓલગડી ઓલગડી સાહેલી હો શ્રી શ્રેયાંસનીરે-એ દેશી)
 ઓલગડી(૨)તો કીજે શ્રી મુનિસુવ્રત-સ્વામિની રે,
 જેહથી નિજપદ સિદ્ધ ।

કેવલ-જ્ઞાનાદિક શુભ ઉદ્દેસે રે,
 લહીયે સહજ સમૃદ્ધિ-ઓ ॥૧॥

ઉપાદાન (૨) નિજ પરિણતિ વસ્તુની રે,
 પિણુ કારણુ નિમિત્ત-આધીન ।
 પુષ્ટ-અપુષ્ટ દુવિધ તે ઉપદેશ્યો રે,
 ગ્રાહક વિધિ-આધીન-ઓ ॥૨॥

સાધ્ય (૨) ધર્મ જે માંહિ હુવે રે, તે નિમિત્ત અતિ પુષ્ટ ।
 પુષ્પમાંહિ તિલવાસક વાસના રે,
 નહિ પ્રધ્વંસક દુષ્ટ-ઓ ॥૩॥

દંડ (૨) નિમિત્ત અપુષ્ટ ઘડા તથો રે નવિ ઘટતા તસુ માંહિ ।
 સાધક (૨) પ્રધ્વંસકતા અછે રે,
 તિથે નહિ નિમિત્ત પ્રવાહ-ઓ ॥૪॥

ખટકારક (૨) તે કારણુ-કાર્યનો રે, જે કારણુ સ્વાધીન ।
 તે કર્તા (૨) સહુ કારક તે વસુ રે,
 કર્મ તે કારણુ પીન-ઓ ॥૫॥

કાર્ય (૨) સંકલ્પે કારણુ દશા રે, છતી સત્તા-સદભાવ ।
 અથવા તુલ્ય-ધર્મને જોઈયે રે,
 સાધ્યારોપણ દાવ-ઓ ॥૬॥

અતિશય (૨) કારણ કારક કરણતે' રે, નિમિત્ત અને ઉપાદાન ।
સંપ્રદાન (૨) કારણ પદ ભવનથી રે,

કારણ વ્યય અપાદાન-ઓ ॥૭૭॥
ભવન (૨) વ્યય વિણ કારય નવિ હુવે રે, જિમ દષ્ટે ન ઘટતવ !
શુદ્ધાધાર (૨) સ્વગુણનો દ્રવ્ય છે રે,

સત્તાધાર સુ-તત્ત્વ-ઓ ॥૮૦॥
આતમ (૨) કર્તા કારય સિદ્ધતા રે, તસુ સાધન જિનરાજ ।
પ્રભુ દીઠે (૨) કારજ રૂચિ ઉપજે રે,

પ્રગટે આત્મ-સમાજ-ઓ ॥૮૧॥
વંદન સેવન (૨) નમન વળી પૂજના રે,

સમરણ સ્તવન વળી ધ્યાન ।
દેવચંદ્ર (૨) કીજે જિનરાજનો રે,
પ્રગટે પૂર્ણ નિધાન-ઓ ॥૯૦॥



(૮૬૧) (૩૬-૨૧) શ્રી નમિનાથ-જિન સ્તવન

(પીછાલારી પાલિ ઉભા દોય રાજવીરે-એ દેશી)

શ્રીનમિજિનવર સેવ, ધનાધન ઉનચોરે-ધના ॥
દીઠાં મિથ્યારોરવ, ભવિક-ચિત્તથી ગમ્યો રે-ભવિ ॥૩૭॥
શુચિ આચરણા રીતિ, તે અબ્ર વધે વડારે,-તે ॥
આતમ-પરિણતિ શુદ્ધ, તે વીજ-ઝણુકડાં રે-વીજ ॥૧૭॥
વાજે વાયુ સુવાયુ તે, પાવન ભાવનારે,-પાવન ॥
ઇંદ્રધનુષ ત્રિકયોગ તે, ભકિત ઈક-મના રે;-ભકિત ॥

નિર્મળ પ્રભુ-સ્તવધોષ, ^૧જૂણી ધનગર્જનારે, જૂણીં ।
 તૃષ્ણા શ્રીધમ કાળ, તાપની તર્જનારે.-તાપનીં ॥૨॥
 શુભ લેશ્યાની ^૨આલી, તે બગ પંકિત બની રે,-બગં ।
 શ્રેણી-સરોવર હંસ, વસે શુચિ-શુણુ મુનિ રે-। વસેં ॥
 ચઉગતિ મારગ બંધ, ભવિક જન ઘર રહ્યા રે,-ભવિકં ।
 ચેતન સમતા-સંગ, રંગમે' ઉમહ્યા રે-રંગં ॥૩॥
 સમ્યગ્ દષ્ટિ મોર, તિહાં હરખે ઘણું રે-તિહાંં ।
 દેખી અહ્ભુત રૂપ, પરમ જિનવર તણું રે-પરમં ।
 પ્રભુ-શુણુનો ઉપદેશ, તે જલધારા વહીરે,-જલં ।
 ધરમ-રૂચિ ચિત્ત-ભૂમિ માંહિ નિશ્ચય રહી રે-માંહિં ॥૪॥
 આતક શ્રમણ-સમૂહ, કરે તખ પારણેા રે-કરેં ।
 અનુભવ રસ આસ્વાદ, સકળ દુઃખ-વારણેા રે-સકળં ।
 અશુભાચાર નિવારણ, તૃણ અંકુરતારે,-તૃણં ।
 વિરતિ તણેા પરિણામ, તે બીજની પૂરતારે-બીજં ॥૫॥
 પાંચ-મહાવ્રત ધાન, તણેા ^૩કરસણુ વધ્યારે,-તણાં ।
 સાધ્ય-ભાવ નિજ થાપી, સાધનતાએ સધ્યાં રે-સાધનં ।
 ક્ષાયિક દર્શન જ્ઞાન, ચરણુ શુણુ ઉપના રે;-ચરણું ।
 આદિ બહુ શુણુ શસ્ય, આતમ ઘર નીપના રે.-આતમં ॥૬॥
 પ્રભુ હરસણુ મહામેહ, તણે પ્રવેશમે' રે,-તણેં ।
 પરમાનંદ સુભિક્ષ થયો, મુજ દેશમે' રે,-થયેં ।
 દેવચંદ્ર જિનચંદ્ર તણેા, અનુભવ કરોરે,-તણેાં ।
 સાદિ-અનંતો કાળ, આતમ-સુખ અનુસરો રે-આતમં ॥૭॥

૧ ધ્વનિ, ૨ શ્રેણી, ૩ ખેતી.

(૮૬૨) (૩૬--૨૨) શ્રી નેમિનાથ-જિન સ્તવન.

(પદ્મ પ્રભ જિન જઈ અલગા રહ્યા-એ દોશી)

નેમિજિણેસર ! નિજ કારજ કર્યો, છાંડ્યો સર્વ વિભાવોજી ।

આતમ-શક્તિ સકળ પ્રગટ કરી,

આસ્વાદ્યો નિજ ભાવોજી.-નેમિં ॥ ૧ ॥

રાજુલ નારીરે સારી મતિ ધરી, અવલંબ્યા અરિહંતોજી ।

ઉત્તમ-સંગેરે ઉત્તમતા વધે,

સાધે આનંદ અનંતોજી-નેમિં ॥૨॥

ધર્મ-અધર્મ-આકાશ અ-ચેતના, તે વિજતી અ-ગ્રાહ્યોજી ।

પુદ્ગળ ગ્રહવેરે કર્મ કલંકતા, વાધે બાધક વાહ્યોજી-નેમિં ॥૩॥

રાગી-સંગેરે રાગદશા વધે, થાયે તિથે સંસારોજી ।

નિ-રાગીથી રે રાગનો જોડવો, લહીયે ભવનો પારોજી.-નેમિં ॥૪॥

અ-પ્રશસ્તતારે ટાળી પ્રશસ્તતા, કરતાં આશ્રવ નાસેજી ।

સંવર વાધેરે સાથે નિર્જરા, આતમ-ભાવ પ્રકાશેજી.-નેમિં ॥૫॥

નેમિ-પ્રભુ ધ્યાને એકત્વતા, નિજ તત્ત્વે ઈકતાનોજી ।

શુકલ-ધ્યાનેરે સાધી સુસિદ્ધતા,

લહીયે મુક્તિ-નિદાનોજી-નેમિં ॥ ૬ ॥

અ-ગમ અ-રૂપીરે અ-લખ અ-ગોચર, પરમાતમ પરમીશોજી ।

દેવચંદ્ર જિનવરની સેવના, કરતાં વાધે જગીશોજી-નેમિં ॥૭॥

(૮૬૩) (૩૬-૨૩) શ્રી પાર્શ્વનાથ-જિન સ્તવન
(કહખાની-દેશી.)

સહજ શુભ-આગરો સ્વામી સુખ-સાગરો.

જ્ઞાન વધરિગ રે પ્રભુ સવાયોં ।

શુદ્ધતા એકત્વતા તીક્ષ્ણતા-ભાવથી,

મોહરિપુ છુટી જગ-પડહ વખયો.-સં ॥૧॥

વસ્તુ નિજભાવ-અવભાસ નિ-કલંકતા,

પરિણતિ વૃત્તિતા કરી અભેદે, ।

ભાવતાદાત્મ્યતા શક્તિ ઉદ્ભાસથી,

સંતતિ-યોગને તું ઉછેદે-સં ॥૨॥

દોષ-શુભ વસ્તુને લખીય યથાર્થતા,

લહી ઉદાસીનતા આપભાવે ।

દ્વંસી તન્મજન્યતા ભાવ-કર્તાપણો,

પરમ-પ્રભુ ! તું રમ્યો નિજ-સ્વભાવે સં ॥ ૩ ॥

શુભ-અશુભ ભાવ અવભાસ-તહકીક(તા)થી,

શુભ-અશુભ ભાવ તિહાં પ્રભુ ન કીધો ।

શુદ્ધ પરિણામતા વીર્યકર્તા થઈ,

પરમ અક્રિયતા અમૃત પીધો સં ॥ ૪ ॥

શુદ્ધતા પ્રભુ તણી આત્મ-ભાવે રમે,

પરમ પરમાત્મા તાસ થાયે ।

મિશ્ર-ભાવે અછે ત્રિ-શુભની ભિન્નતા,

ત્રિ-શુભ એકત્વ તુજ ચરણ આયે સં ॥ ૫ ॥

ઉપશમ-રસભરી સર્વજન-સંકરી,

મૂર્તિ જિનરાજની આજ ભેટી ।

કારણે કાર્ય-નિષ્પત્તિ શ્રદ્ધાન છે,

તિણે ભવ-ભ્રમણની ભીડિ મેટી સં ॥ ૬ ॥

નયર ખંભાયતે પાશ્વ-પ્રભુદરશણે,

વિકસતે હર્ષ-ઉત્સાહ વાધ્યો ।

હેતુ એકત્વતા-રમણ પરિણામથી,

સિદ્ધિ-સાધક પણે આજ સાધ્યો સં ॥ ૭ ॥

આજ કૃતપુણ્ય ધન દીહ માહરો થયો,

આજ નર-જનમ મેં સફળ ભાળ્યો ।

દેવચંદ્ર સ્વામિ ત્રેવીશમો વંદીયો,

ભક્તિ-ભરચિત્ત તુજ ગુણ રમાળ્યો સં ॥ ૮ ॥



(૮૬૪) (૩૬-૨૪) શ્રી મહાવીર-જિન સ્તવન

[કડખાની દેશી]

તાર હો તાર પ્રભુ ! મુજ સેવક ભણી,

જગતમેં એટલો સુયશ લીજે ।

દાસ અવગુણ-ભર્યો જાણી પોતા તણો,

દયાનિધિ ! દીન પરિ દયા કીજે-તારં ॥ ૧ ॥

રાગ-દ્વેષેં ભર્યો માહ વૈરી નડ્યો,

લોકની રીતિમેં ઘણું રાતો ।

ક્રોધ-વશ ધમધમ્યો, શુદ્ધ ગુણ નવિ રમ્યો,

ભમ્યો ભવ માંહિં હું વિષય-ભાતો તારં ॥ ૨ ॥

આદ્યેર્ધ આચરણ લોક-ઉપચારથી,

શાસ્ત્ર-અભ્યાસ પણ કાંઈ કીધો ।

શુદ્ધ-સરધાન વળી આત્મ-અવલંબ વિણ,

તેહવો કાર્ય તિણે કે ન સીધો-તાર૦ ॥ ૩ ॥

સ્વામી કરશણ સમે નિમિત્ત લહી નિરમળો,

જે ઉપાદાન શુચિ ન થાસ્યે ।

દોષ કે વસ્તુનો ? અહવ ઉદમ તણો ।

સ્વામી સેવા સહી નિકટ લાસ્યે-તાર૦ ॥ ૪ ॥

સ્વામી-શુણ ઝોલખી સ્વામીને જે ભજે,

ઠરિશણ શુદ્ધતા તેહ પાસે ।

જ્ઞાન-ચારિત્ર-તપ-વીર્ય ઉલ્લાસથી,

કર્મ છપી વસે મુક્તિ ધામે-તાર૦ ॥ ૫ ॥

જગતવત્સલ મહાવીર જિનવર સુણી,

ચિન્ત પ્રભુ-ચરણને શરણ વાસ્યે ।

તારજ્યો બાપજી ! બિરૂદ નિજ રાખવા,

ઠાસની સેવના રખે જોસ્યો-તાર૦ ॥ ૬ ॥

વિનતિ માનજ્યો શક્તિ એ આપજ્યો,

ભાવ-સ્વાદ્વાદતા શુદ્ધ ભાસે ।

સાધી સાધક-દશા સિદ્ધતા અનુભવી,

દેવચંદ્ર વિમલ-પ્રભુતા પ્રકાશે-તાર૦ ॥ ૭ ॥



[કલશ]

ચઉવીસે જિન ગાઈયે, ધ્યાઈયે તત્ત્વ-સરૂપોણ ।
 પરમાનંદ પદ પાઈયે, અક્ષય-જ્ઞાન અનૂપોણ-ચઉં ॥ ૧ ॥
 ચઉદ્દહસેં ખાવન ભક્ષા, ગણુધર-ગુણુ-ભંડારોણ ।
 સમતામયી સાહુ-સાહુણી, સાવય-સાવઈ સારોણ-ચઉં ॥ ૨ ॥
 વર્ધમાન જિનવર તણે, શાસન અતિ સુખકારોણ ।
 ચઉવિહ સંઘ વિરાજતા, દુઃખમ કાલ આધારોણ-ચઉં ॥ ૩ ॥
 જિન-સેવનથી જ્ઞાનતા, તિણે હિતાહિત-ખોધોણ ।
 અ-હિત ત્યાગ હિત આદરે, સંયમ-તપની શોધોણ-ચઉં ॥ ૪ ॥
 અભિનવ-કર્મ અ-અહણુતા, જીર્ણ-કર્મ-અભાવોણ ।
 નિ-કર્મીને અ-ખાધતા, અ-વેદન અનાકુલ-ભાવોણ-ચઉં ॥ ૫ ॥
 ભાવ-રોગના વિગમથી, અ-ચલ અ-ક્ષય નિરાખોણ ।
 પૂર્ણાનંદ-દશા લહી, વિલસે સિદ્ધિ-સમાધોણ-ચઉં ॥ ૬ ॥
 શ્રી જિનચંદની સેવના, પ્રગટે પુણ્ય-પ્રધાનોણ ।
 સુમતિ સાગર અતિ ઉલ્લાસે,
 સાધુરંગ પ્રસુખ્યાનોણ-ચઉં ॥ ૭ ॥
 સુવિહિત ગચ્છ ખરતર વરૂ, રાજસાગર ઉવઝાયોણ ।
 જ્ઞાનધર્મ-પાઠક તણે, શિષ્ય સુજન-સુખદાયોણ-ચઉં ॥ ૮ ॥
 દીપચંદ્ર પાઠક તણે, શિષ્ય સ્તવે જિનરાજોણ ।
 દેવચંદ્ર પદ સેવતાં, પૂર્ણાનંદ સમાજોણ-ચઉં ॥ ૯ ॥

*

શ્રી વર્દ્ધમાન સ્વામિને નમઃ
 શ્રી દેવચંદ્રજી મં કૃત
 અતીતજિન-ચૌવિશી
 (અપૂર્ણ)

(૮૬૫) (૩૭-૧) શ્રી કેવલજ્ઞાનીજિન સ્તવન
 નામે ગાજે પરમ આદહાદ, પ્રગટે અનુભવ રસ આસ્વાદ ।
 તેથી થાયે મતિ-સુપ્રસાદ, સુષુતાં ભાંજેરે, કાંઈ વિષયવિખાદ રે
 જિણુંદા ! તારા નામથી મન ભીનો ॥૧॥

ક્ષેત્ર અસંખ્ય-પ્રદેશ, અનંત-પર્યાય- નિવેશ ।

જાણુગ-શક્તિ અ-શેષ,

તેહથી જાણે કાંઈ સકળ વશેષ રે-જિં ॥૨॥

સર્વ પ્રમેય-પ્રમાણુ, જસ કેવળ-નાણુ પહાણુ ।

તિણે કેવળનાણી અભિહાણુ,

જસ ધ્યાવે રે કાંઈ મુનિવર જાણુ રે-જિં ॥૩॥

ધ્રુવ પરિણુતિ છતી જસ, પરિણુતિ પરિણામે ત્રિક રાશ ।

કર્તાપદ પ્રવૃત્તિ પ્રકાશ,

અસ્તિ-નાસ્તિરે કાંઈ સર્વનો ભાસ રે-જિં ॥૪॥

સામાન્ય-સ્વભાવનો બાધ, કેવળ-દર્શન શોધ ।

સહકાર અભાવે રોધ, સમયંતર રે

કાંઈ બાધ-પ્રત્રોધ રે-જિં ॥૫॥

કારક ચક્ર સમગ્ગ, તે જ્ઞાયક-ભાવ વિલગ્ગ ।

પરમભાવ-સંસગ્ગ, ઈક રીતે રે કાંઈ થયો ગુણુ-વગ્ગ રે-જિં ॥૬॥

ધર્મ સાલંબન જિન ધ્યાન, સાધે તત્ત્વ વિધાન ।

લહે પૂર્ણાનંદ અ-માન,

તેહથી થાયે રે કાંઈ શિવ-ઇશાન રે-જિં ॥૭॥

દાસ વિલાવ-અપાય, (તે) નાશે પ્રભુ-સુપસાય ।

જે તન્મયતાયે ધ્યાયે,

સહી તેહને રે દેવચંદ્ર-પદ થાય રે-જિં ॥૮॥

(૮૬૬) (૩૭-૨) શ્રી નિર્વાણી-પ્રભુ-જિન સ્તવન

[વીરજી પ્યારા હો ! વીરજી પ્યારા-એ દેશી.]

પ્રભુમું ચરણ પરમ-ગુરૂ-જિનના, હંસ તે મુનિ જનમનના ।

વાસી અનુલવ-નંદનવનના, લોગી આનંદધનના—

મોરા સ્વામી હો ! તોરો ધ્યાન ધરીજે ।

ધ્યાન ધરીજે હો સિદ્ધિ વરીજે,

અનુલવ અમૃત પીજે—મોરાં ॥૧॥

સકલ પ્રદેશ-સમા ગુણ ધારી, નિજ-નિજ કારજ કારી ।

નિરાકાર અવગાહ ઉદારી, શક્તિ સર્વ વિસ્તારી—મોરાં ॥૨॥

ગુણ ગુણ પ્રતિં પર્યાય અનંતા તે અલિલાપ સ્વતંતા ।

અનંતગુણા-નલિલાપી સંતા,

કાર્ય-વ્યાપાર કરંતા-મોરાં ॥૩॥

છતી અ-વિભાગી પર્યાયવ્યકતે, કારજ-શક્તિ પ્રવર્તે ।

તે વિશેષ સામર્થ્ય-પ્રશકતે,

ગુણ-પરિણામ-અલિવ્યકતે-મોરાં ॥ ૪ ॥

નિરવાણી પ્રભુ ! શુદ્ધ સ્વભાવી, અ-ભય નિશ્ચય અપાવી ।
 સ્યાદ્દાદી અ-મની ગતરાવી, પૂરણ શક્તિ-પ્રભાવી-મોરાળાપા
 અ-ચલ અ-ખંડ સ્વ-ગુણુ-આરામી, અનંતાનંદ વિસરામી ॥
 સકલ-જીવ-ખેદજ સુ-સ્વામી,

નિરામગંધી અક્ષમી-મોરાળ ॥ ૬ ॥

નિઃસંગી-સેવનથી પ્રગટે, પૂર્ણાનંદી-ઈહા ।

સાધન-શકતે ગુણુ-એકત્વે, સીઝે સાધ્ય-સમીહા-મોરાળાળા
 પુષ્ટ-નિમિત્તા-લંબન ધ્યાને સ્વાલંબન લય ઠાને ।

દેવચંદ્ર ગુણુને એક-તાને, પોહોંચે પૂરણુ-થાને-મોરાળાળા



(૮૬૭) (૩૭-૩) શ્રી સાગર-પ્રભુ જિન સ્તવન

[શીતલજિન સહજનંદી-એ દેશી]

ગુણુસાગર-આગર સ્વામી, મુનિભાવ જીવન નિઃકામી ।

ગુણુ-કરણે કર્તૃ-પ્રયોગી, પ્રાગભાવી સત્તા ભોગી-

-સુહંકર ભવ્ય ! એ જિન ગાવો,

જિમ પૂરણુ પદવી પાવો-સુ૦ ॥૧૧॥

સામાન્ય-સ્વભાવ સ્વ-પરના, દ્રવ્યાદિ-ચતુષ્ટય ધરના ।

દેખે દર્શન-રચનાયે, નિજ-વીર્ય અનંત સદાયે-સુભારા

તેહને તે જાણે નાણુ, એ ધર્મ-વિશેષ પહાણુ ।

સાવય-વિકારજ શકતે, અ-વિભાગી પર્યાય-વ્યકતે-સુ૦ ॥૩૧॥

જે કારણુ-કારજ ભાવે, વરતે પર્યાય-પ્રભાવે ।

પ્રતિ સમયે-વ્યય-ઉત્પાદી, સ્ત્રેયાદિક અનુગત-સાદી-સુભારા

અ-વિભાગી પર્યાય જેહ, સમવાયી કાર્યના જેહ ।
 જે નિત્ય ત્રિકાળી અનંત, તસુ જ્ઞાયક જ્ઞાન મહંત-સુ૦૥૫૥
 જે નિત્ય-અનિત્ય સ્વભાવ, તે દેખે દર્શન ભાવ ।
 સામાન્ય-વિશેષનો પિંડ, દ્રવ્યાર્થિક વસ્તુ પ્રચંડ-સુ૦૥૬૥
 ઈમ કેવળ દર્શન-નાણુ, સામાન્ય-વિશેષનો ભાણુ ।
 દ્વિ-ગુણુ આતમ-શ્રદ્ધાએ, ચરણાદિક તસુ વ્યવસાયે-સુ૦૥૭૥
 દ્રવ્ય જેહ વિશેષ-પરિણામી, તે કહીયે પન્નવ-નામી ।
 છતી સામથ્ય હુ-લેહે, પર્યાય-વિશેષ નિવિહે-સુ૦૥ ૮ ॥
 તસુ રમણે ભોગનો વૃંદ, અ-પ્રયાસી પૂર્ણાનંદ ।
 પ્રગટી જસ શક્તિ અનંતી,

નિજ કારજ-વૃત્ત સ્વતંત્રી-સુ૦ ॥ ૯ ॥

ગુણુ-દ્રવ્ય સામાન્ય સ્વભાવી, તીરથપતિ ત્યકત વિભાવી ।
 ત્રણુ આણુ-લકતે લીન, તિણુ દેવચંદ્ર પદ કીન-સુ૦ ॥૧૦॥



(૮૬૮) (૩૭-૪) શ્રી મહાજશ-જિન સ્તવન
 (રાગ ફાગ)

આતમ પ્રદેશ રંગ થલ અનોપમ, સમ્યગ્ દર્શન રંગ રે-
 -નિજ-સુખ કે સધૈયા.

-તું તો નિજ ગુણુ ખેલ વસંતરે;-નિજ૦ ।
 પર-પરિણુતિ ચિંતા તજ નિજમે,
 જ્ઞાન-સખા કે સંગ-નિજ૦ ॥૧૧॥

વાસ બરાસ સુરચિ કેશરધન, છાંટો પરમ પ્રમોદરે-નિજ૦ ।
 આતમ-રમણુ ગુલાલકી લાલી,
 સાધક-શક્તિ વિનોદ રે-નિજ૦ ॥૨૨॥

ધ્યાન સુધારસ પાન મગનતા,
 લોજન સહજ સ્વ-લોગ રે-નિજ૦ ।
 રીઝણ એકત્વતા તાનમેં વાજે,
 વાળંત્ર સનમુખ યોગ રે-નિજ૦ ॥૩૧॥
 શુકલ-ધ્યાન હોરી કી ઝાલા, જાલે કર્મ કઠોર રે-નિજ૦ ।
 શેષ-પ્રકૃતિદલ ખિરણ નિર્જરા,
 લક્ષ્મ-ખેલ અતિ જોર રે-નિજ૦ ॥૩૨॥
 દેવ મહાજશ ગુણ અવલંબન,
 નિર્ભય પરિણુતિ વ્યક્તિ રે-નિજ૦ ।
 જ્ઞાને ધ્યાને અતિ બહુમાને,
 સાધે મુનિ નિજ શક્તિ રે-નિજ૦ ॥૩૩॥
 સકળ અ-જોગ અ-લેશ અ-સંગત,
 નહિ હોવે સિદ્ધ રે-નિજ૦ ।
 દેવચંદ્ર આણામેં ખેલે ઉત્તમ યુદ્ધિ પ્રસિદ્ધ રે-નિજ૦ ॥૩૪॥



(૮૬૯) (૩૭-૫) શ્રી વિમલનાથ જિન સ્તવન:

(કડખાની-દેશી)

ધન્ય તું ધન્ય તું ધન્ય જિનરાજ । તું,
 ધન્ય તુજ શક્તિ વ્યક્તિ સ-નૂરી ।
 કાર્ય-કારણ દશા સહજ ઉપગારિતા,
 શુદ્ધ કર્તૃત્વ પરિણામ પૂરી ધન૦ ॥૧॥
 આત્મ-પ્રભાવ પ્રતિભાસ કારજદશા,
 જ્ઞાન અ-વિલાગ પર્યાય પ્રવૃત્તે ।

એમ ગુણ સર્વ નિજ-કાર્ય સાધે પ્રગટ.

જેય દૃશ્યાદિ-કારણ-નિમિત્તે-ધન્ય૦ ॥૨॥

દાસ બહુમાન શાસન રમણ એકતા,

પ્રભુ ગુણાલંબની શુદ્ધ થાયે ।

બંધના હેતુ રાગાદિ તુજ ગુણ રસી,

તેહ સાધક અવસ્થા ઉપાયે-ધન્ય૦ ॥૩॥

કર્મ-જંજાલ યુજનકરણ-યોગ જે,

સ્વામી ! ભક્તિ રમ્યા થીરસમાધિ ।

દાન તપ શીલ-વ્રત નાથ ! આણા વિણા.

થઈય બાધક કરે ભવ ઉપાધિ, ધન્ય૦ ॥૪॥

સકળ પ્રદેશ સમકાળ સર્વ કાર્યતા,

કારણ સહકાર કર્તૃત્વ ભાવે ।

દ્રવ્ય-પરદેશ-પર્યાય આગમ પણે,

અ-ચલ અ-સહાય અ-ક્રય દાવે.-ધન્ય૦ ॥૫॥

ઉત્પત્તિ નાશ-ક્રુવ સર્વદા સર્વની,

બહુગુણી હાનિ-વૃદ્ધિ અ-ન્યૂનો ।

અસ્તિ-નાસ્તિત્વ સત્તા અનાદી થકી,

પરિણમન ભાવથી નહી અજૂનો-ધન્ય૦ ॥૬॥

ઇણી પરે વિમલ જિનરાજની વિમલતા,

ધ્યાન મન-મંદિરે જેહ ધ્યાવે ।

ધ્યાન પૃથક્ત્વ-સ-વિકલ્પતા રંગથી રે,

ધ્યાન એકત્વ-અ-વિકલ્પ આવે-ધન્ય૦ ॥૭॥

વીતરાગી અ-સંગી અનંગી પ્રભુ,

નાથુ અ-પ્રયાસ અ-વિનાશ ધારી ।

દેવચંદ્ર શુદ્ધ-સત્તારસી સેવતાં,

સંપદા આત્મ-શોભા વધારી-ધન્ય૦ ॥૮૮॥

★

(૮૭૦) (૩૭-૬) શ્રી સર્વાનુભૂતિ-જિન સ્તવન

[જગજીવન જગવાલહો-એકેશી]

જગતારક પ્રભુ વિનવું, વિનતડી અવધાર-લાલ રે ।

તુજ દરશણુ વિણુ હું ભર્યો,

કાળ અનંત-અપાર-લાલ રે-જગ૦ ॥૧॥

સુહુમ-નિગોઠ ભવે વર્યો, પુદ્ગલ પરિચટ્ટ અનંત-લાલ રે ।

અ-વ્યવહાર-પણે ભર્યો,

ક્ષુદ્ધક ભવ અત્યંત-લાલ રે-જગ૦ ॥૨॥

વ્યવહારે પણ તિરિય-ગતે, ઇગિ-વણુખંડ-અ-સન્ની-લાલ રે ।

અ-સંખ્ય પરાવર્તન થયાં.

ભમિયો જીવ અ-ધનન-લાલ રે-જગ૦ ॥૩॥

સૂક્ષ્મ-થાવર ચારમેં, કાલહ ચક્ર અસંખ્ય-લાલ રે ।

જનમ-મરણુ બહુલા કર્યાં,

પુદ્ગલ-ભોગને કંખ-લાલ રે જગ૦ ॥૪॥

ઓઘે બાહર-ભાવમેં, બાહર તરૂપણુ એમ-લાલ રે ।

પુદ્ગલ અઢી લાગટ વર્યો,

નામ નિગોઠે પ્રેમ-લાલ રે-જગ૦ ॥ ૫ ॥

થાવર થૂલ-પરિત્તમે, સીતેર ઠોઠાઠોડિ-લાલ રે ।

અયર ભમ્યો પ્રભુ ! નવિ મિથ્યા,

મિથ્યા અવિરતિ જોડિ-લાલ રે-જગ૦ ॥ ૬ ॥

વિગલપણે લાગટ વસ્યો, સંખિજ્જ વાસ હંજર-લાલ રે ।

ખાદર પજ્જ-વણુસસઈ, ભૂ-જલ-વાયુ મઝાર-લાલ રે જગ૦ ॥ ૭ ॥

અનલ-વિગલ પજ્જત્તમે, તસ લવ આયુ પ્રમાણુ-લાલ રે ।

શુદ્ધ-તત્તવ પ્રાપ્તિ વિના,

ભટકયો નવ-નવ ઠાણુ-લાલ રે-જગ૦ ॥ ૮ ॥

સાધિક સાગર સહસ દો, ભોગવીયો ત્રસ-ભાવ-લાલ રે ।

એક સહસ સાધિકોદ્ધિ,

પંચેંદ્રિ પદ દાવ-લાલ રે-જગ૦ ॥ ૯ ॥

પર-પરિણુતિ રાગીપણે, પર-રસ રંગે રક્ત-લાલ રે ।

પર-ગ્રાહક-રક્ષક-પણે, પરભોગે આસક્ત-લાલ રે-જગ૦ ॥ ૧૦ ॥

શુદ્ધ સ્વ-જાતિ-તત્તવને, બહુમાને તલ્લીન-લાલ રે ।

તે વિજાતિ-રસ તાતણ !

સ્વ-સ્વરૂપ-રસ પીન-લાલ રે જગ૦ ॥ ૧૧ ॥

શ્રી સર્વાનુભૂતિ જિનેશ્વર ! તારક લાયક દેવ-લાલ રે ।

તુજ ચરણે શરણે રહ્યો,

ટળે અનાદિ કુટેવ-લાલ રે-જગ૦ ॥ ૧૨ ॥

સખલા સાહિબ ઓલગ્યે, આતમ સખલો થાય-લાલ રે ।

આધક-પરિણુતિ સવિ ટળે,

સાધક સિદ્ધ કહાય-લાલ રે-જગ૦ ॥ ૧૩ ॥

કારણથી કારજ હુયે, એ પરતીત અનાદિ-લાલ રે ।

માહરા આતમ-સિદ્ધિના,

નિમિત્ત હેતુ પ્રભુ સાદિ-લાલ રે-જગ ॥૧૪॥

અ-વિસંવાદન-હેતુની, દઢ સેવા-અભ્યાસ-લાલ રે ।

દેવચંદ્ર પદ નિપજે, પૂર્ણાનંદ-વિલાસ-લાલ રે-જગ ॥૧૫॥

(૮૭૧) (૩૭-૭) શ્રીધરનાથજિન સ્તવન

(રસીયાની-દેશી)

સેમુખ મુખ પ્રભુને ન મળી શક્યો,

તો શી વાત કહાયે-જિણુંદજી ।

નિજ-પર વીતક વાત લહો સહુ,

પણ મને કિમ પ્રતીત આય?-જિં સે ॥૧॥

ભવ્ય-અભવ્ય પરિત્ત-અણુંત તો, કૃષ્ણ-શુકલપક્ષ ધાર-જિં ।

આરાધક-વિરાધક રીતનો, પૂછી કરત નિરધાર-જિં સે ॥૨॥

કિણ કાળે કારણ કેહવે મળે, થાશે ? મુજને હો સિદ્ધ-જિં ।

આતમ-તત્ત્વ રૂચિ નિજ-રિદ્ધિની.

લહેશું સર્વ-સમૃદ્ધ-જિં સે ॥૩॥

એક વચન જિન-આગમનું લહો, નીપાવ્યાં નિજ કામ-જિં ।

એતલે આગમ કારણ સંપજે,

ઢીલ થઈ કિમ આમ ?-જિં સે ॥ ૪ ॥

શ્રીધર જિન નામે બહુ નિસ્તર્યા,

અલપ-પ્રયાસે હો જેહ-જિં ।

મુજ સરિખો એત લે કારણ લહે,

ન તરે કહો કિમ તેહ ?-જિં સે ॥ ૫ ॥

કારણ-જોગે સાધે તત્ત્વને, નવિ સમયોં ઉપાદાન-જિં ૧
શ્રી જિનરાજ પ્રકાશે મુજ પ્રતે,

તેહનું કાણુ નિદાન ? જિં સેં ॥ ૬ ॥

લવ-રોગના વૈદ્ય જિનેશ્વર, ભાવૌષધ તુજ ભક્તિ-જિં ૧
દેવચંદ્રને શ્રી અરિહંતનો,

છે આધાર એ વ્યક્તિ-જિં સેં ॥ ૭ ॥

(૮૭૨) (૩૭-૮) શ્રી દત્તનાથ-જિન સ્તવન

[રાગ ધમાલ]

જિન-સેવનતેં પાઈયે હો, શુદ્ધાત્મ મઠરંદ-જિનં ॥

તત્ત્વ-પ્રતીત વસંત-ઋતુ પ્રગટી,

ગઈ શિશિર કુ-પ્રતીત-લલના ॥

દુરમતિ-રજની લઘુ ભઈ હો,

સદ્ગોષ્ઠ દિવસ વહીત-લલના-જિં ॥ ૧ ॥

સાખ્ય-રૂચ સુ-સખા મીલી હો,

નિજ ગુણ-૧ચરચા ખેલ-લં ૧

બાધક-ભાવકી નિંદના હો,

મુખ-મુખ રગારિકો મેલ-લં જિં ॥ ૨ ॥

પ્રભુ-ગુણ-ગાનશું છંદ શું હો, વાજિંત્ર અતિશય તાન-લં ૧

શુદ્ધ-તત્ત્વ બહુ માનતા હો,

ખેલત પ્રભુ-ગુણ ધ્યાન લં જિં ॥ ૩ ॥

ગુણ-બહુમાન ગુલાલસું હો, લાલ ભયે ભવિષ્ય-લં ૧

૧ વિચારણા, ૨ અપશબ્દનો.

રાગ-પ્રશસ્તકી

ધૂમમેં હો,

વિલાવ ૧વિહારે અતીવ. લ૦ જિ૦ ૥૪૥

જિન-ગુણ ખેલમેં ખેલતે હો, પ્રગટયો નિજ ગુણ-ખેલ લ૦ ।

આતમ ધર આતમ રમે હો, સમતા સુમતિકે મેલ-લ૦ જિ૦ ૥૫૥

તત્વ-પ્રતીત ખ્યાલે ભર્યા હો, જિનવાણી-રસપાન-લ૦ ।

નિર્મલ-લક્ષિત-લાલી જગી હો,

રીઝે એકત્વતા-તાન લ૦ જિ૦ ૥૬૥

ભવ-વૈરાગ અખીરશું હો, ચરણ-રમણ સુ-મહંત-લ૦ ।

સુમતિ-ગુપતિ વનિતા રમે હો,

ખેલે હો શુક-વસંત-લ૦ જિ૦ ૥૭૥

૨ચાચર ગુણ-રસિયા લીયે હો, નિજ સાધક પરિણામ-લ૦ ।

કર્મ પ્રકૃતિ અ-રતિ ગર્હ હો,

ઉલસિત અમિત-ઉદામ-લ૦ જિ૦ ૥૮૥

ધિર-ઉપયોગ સાધન મુખે હો, પિયકારીકી ધાર-લ૦ ।

ઉપશમ-રસ ભરી છાંટતાં હો,

ગર્હ ઉત્તાર્ધ અપાર-લ૦ જિ૦ ૥૯૥

ગુણ-પર્યાય વિચારતાં હો, શક્તિ-વ્યક્તિ અનુભૂતિ-લ૦ ।

દ્રવ્યાસ્તિક અવલંબતાં હો,

ધ્યાન એકત્વ-પ્રસૂતિ-લ૦ જિ૦ ૥૧૦૥

રાગ-પ્રશસ્ત પ્રલાવના હો, નિમિત્ત કરણ ઉપલેદ-લ૦

નિર્વિકલ્પ સુ-સમાધિમેં હો,

ભયે હેં ત્રિગુન અલેદ-લ૦ જિ- ૥૧૧૥

ધર્મ શ્રીદત્તપ્રભુ ગુણે હો, કાગ રમે મતિવંત-લ૦

૧ દૂર કરે, ૨ ટોળી, ૩ ગમી.

પર-પરિણતિરજ ઘાયકે હો,

નિરમળ સિદ્ધિ વરંત-લ૦ જિ૦ ॥૧૨॥

કારણથે' કારજ સધે હો, એહ અનાદિકી ચાલ-લ૦ ।

દેવચંદ્ર પદ પાઈયે' હો

કરત નિજ ભાવ-સંભાળ-લ૦ જિ૦ ॥૧૩॥



(૮૭૩) (૩૭-૯) શ્રી દામોદર-જિન સ્તવન

(મોરા સાહેબ હો શ્રી શીતલનાથકે-એ દેશી)

સુપ્રતીતે હો કરી ધિર-ઉપયોગ કે, દામોદર જિન વંદીયે,
અનાદિની હો જે મિથ્યા બ્રાન્તિ તેહ સર્વથા છંડીએ ।
અવિરતિ હો જે પરિણતિ હુન્ટ કે, ટાળી ધિરતા સાધીએ,
કષાયની હો કશ્મલતા કાપી કે, વર સમતા આરાધીયે. ॥૧॥
જંખૂને હો ભરતે જિનરાજ કે, નવમા અતીત ચોવીશીયે,
જસ નામે હો પ્રગટે શુણ્વરાશિ કે, ધ્યાને શિવસુખ વિલાસીયે ।
અપરાધી હો જે તુજથી દૂર કે, ભૂરિ બ્રમણ-હુઃખના ઘણી,
તે માટે હો તુજ સેવા રંગ કે, હોજો એ ઇન્દ્રા ઘણી. ॥૨॥
મરૂધરમે' હો જિન સુરતરૂ-હુંખ કે, સાગરમે' પ્રવહણસમો,
ભવ ભમતાં હો ભવિજન-આધાર કે, પ્રભુ દરશણ સુખ અનુપમો ।
આતમની હો જે શક્તિ અનંત કે, તેહ સ્વરૂપ-પદે ધર્યા,
પરિણામિકે હો જ્ઞાનાદિક ધર્મ કે, સ્વ-સ્વકાર્યપણે વર્યા. ॥૩॥
અવિનાશી હો જે આત્માનંદ કે, પૂર્ણ અખંડ સ્વભાવનો,
નિજ-શુણ્વનો હો જે વર્તન-ધર્મ કે, સહજ વિલાસી દાવનો ।

તસ લોગી હો તું જિનવરદેવ કે, ત્યાગી સર્વ વિભાવનો,
 શ્રુત જ્ઞાની હો ન કહી શકે સર્વ કે, મહિમા તુજ પ્રભાવનો ॥૪૧॥
 નિઃકામા હો નિકષાઈ-નાથ કે, સાથ હોજો નિત તુમ્હ તણો,
 તુમ આણુ હો આરાધન શુદ્ધ કે, સાધું હું સાધકપણો ।
 વીતરાગથી હો જે રાગ વિશુદ્ધ કે, તેહીજ ભવભય વારણો,
 જિનચંદ્રની હો જે લકિત એકત્વ કે, દેવચંદ્ર-પદ-કારણો ॥૪૨॥



(૮૭૪) (૩૭-૧૦) શ્રી સુતેજ-જિન સ્તવન

અતિ રૂઢી રે (૨) જિનજીની ધિરતા અતિ રૂઢી ।
 સકલ પ્રદેશ અનંતી, શુણુ-પર્યાય શક્તિ મહંતી-લાલ-અતિ૦
 તસુ રમણે અનુભવવંતી,
 પરરમણે જે ન રમંતી-લાલ અતિ૦ ॥૧॥
 ઉત્પાદ-વ્યય પલટંતી, ધ્રુવ શક્તિ ત્રિપદી સંતી-લાલ-અતિ૦ ।
 ઉત્પાદે ઉત્પત્તિમંતી,
 પૂરવ-પરિણુતિ વ્યયમંતી-લાલ-અતિ૦ ॥૨॥
 નવ-નવ ઉપયોગે નવલૌ,
 શુણુ-છતીથી તે નિત અચલૌ-લાલ-અતિ૦
 ચરદ્રવ્યે જે નવિ ગમણી,
 ક્ષેત્રાંતરમાંહિ ન રમણી-લાલ-અતિ૦ ॥૩॥
 અતિશય-યોગે નવિ દીપે,
 પરભવ લણી નવિ છીપે-લાલ-અતિ૦ ।
 નિજ-તત્વ-રસે જે લીની,
 ખીજે કૌણહી નવિ કીની-લાલ-અતિ૦ ॥૪॥

સંબ્રહ્મનયથી જે અનાદિ, પણ એવંજૂતે સાદિ-લાલ-અતિં ।
જેહને બહુમાને પ્રાણી,

પામે નિજ ગુણ ૧ સહનાણી-લાલ-અતિં ॥૫॥
થિરતાથી થિરતા વાધે, સાધક નિજ-પ્રભુતા સાધે-લાલ-અતિં ।
પ્રભુ-ગુણને રંગે રમતા,

તે પામે અવિચલ સમતા-લાલ-અતિં ॥૬॥
નિજ-તેજે જેહ સુતેજ, જે સેવે ધરી બહુ હેજ લાલ-અતિસ ।
શુદ્ધાલંબન જે ધ્યાવે, તે દેવચંદ્ર-પદ પાવે-લાલ-અતિં ॥૭॥

(૮૭૫) (૩૭-૧૧) શ્રી સ્વામીપ્રભુ-જિન સ્તવન

[રહો રહો રહો વાલ્હા-એ દેશો.]

નમી નમી નમી વિનવું, સુગુણ સ્વામી ! જિણુંદ ! નાથ રે ।
જેય સકલ જાણુગ તુમે, પ્રભુજી ! જ્ઞાનદિણુંદ-નાથ રે-નમીં ॥૧॥
વર્તમાન એ જીવની, એહવી પરિણિતિ કેમ-નાથ રે,
જાણું હેય-વિલાવને, પિણુ નવિ છુટે પ્રેમ-નાથ રે-નમીં ॥૨॥
પર-પરિણિતિ-રસરંગતા, પર-ગ્રાહકતા ભાવ, નાથ રે ।
પર-કરતા પર ભોગતા, રથો થયો એકુ સ્વભાવ ? નાથ રે-
નમીં ॥૩॥

વિષય-કષાય-અશુદ્ધતા, ન ઘટે એ નિર્ધાર, નાથ રે ।
તો પણ વંછું તેહને, કિમ તરીએ સંસાર ? નાથ રે-નમીં ॥૪॥
મિથ્યા અવિરતિ પ્રમુખને, નિયમા જાણું દોષ, નાથ રે ।
નિંદ્રગરહૂં વળી વળી, પણ તે પામે સંતોષ-નાથ રે નમીં ॥૫॥

૧ ઓળખાણ, ૨ મસ્તીમાં.

અંતરંગ પર-રમણુતા, ટલશે કિરચે ઉપાય ?-નાથ રે ।

આણુ-આરાધન વિના,

કિમ ગુણુ સિદ્ધિ થાય ?-નાથ રે-નમીં ॥૬૫॥

હવે જિનવચન-પ્રસંગથી, બાણી સાધક-નીતિ-નાથ રે ।

શુદ્ધ-સાધ્ય-રૂચિ પણે,

કરીએ સાધન રીતિ-નાથ રે-નમીં ॥૬૬॥

ભાવન-રમણુ પ્રભુ ગુણે, યોગ ગુણી આધીન-નાથ રે ।

રાગ તે જિન-ગુણુ-રંગમેં,

પ્રભુ ! દીઠાં પરિત-પીન-નાથ રે-નમીં ॥૬૭॥

હેતુ પલટાવી સવિ, જોડયા ગુણી ગુણુ-ભક્તિ-નાથ રે ।

તેહ પ્રશસ્તપણે રમ્યા,

સાધે આતમ-શક્તિ-નાથ રે-નમીં ॥૬૮॥

ધન-તન-મન-વચના સખે, જોડયા સ્વામી પાય-નાથ રે ।

આધક-કારણુ-વારતા, સાધક કારણુ થાય-નાથ રે-નમીં ॥૬૯॥

આતમતા પલટાવતાં, પ્રગટે સંવર-રૂપ-નાથ રે ।

સ્વ-સ્વરૂપ-રસીક રે, પૂર્ણાનંદ-અનૂપ-નાથ રે-નમીં ॥૭૦॥

વિષય-કથાય જહેર ટળી, અમૃત થાએ એમ-નાથ રે ।

જે પર-સિદ્ધિ-રૂચિ હુવે,

તો પ્રભુ સેવા ધરી પ્રેમ-નાથ રે-નમીં ॥૭૧॥

કારણુ-રંગી કાર્યને, સાધે અવસર પામી-નાથ રે !

દેવચંદ્ર-જિનરાજની,

સેવા શિવસુખ-ધામ-નાથ રે-નમીં ॥૭૨॥



(૮૭૬) (૩૭--૧૨) શ્રી મુનિસુવ્રત જિન સ્તવન

(નમણી ખમણી નમ ન ગમણી-એ-દેશી)

દીઠો દરિશણુ શ્રી પ્રભુજનો, સાચે રાગે મનથું લીનો ।

જસુ રાગે નિરાગી થાયે,

તેહની ભક્તિ કેને ન સુહાયે ? ॥ ૧ ॥

પુઢગલ-આશા-રાગી અનેરા, તસુ પાસે કુચ્છ ખાયે ફેરા ? ॥

જસુ ભગતે નિરભય પદ લહિયે,

તેહની સેવામાં ધિર રહિયે ॥ ૨ ॥

રાગી-સેવકથી જે રાચે, બાહ્ય-ભગતિ દેખીને માચે ।

જસ ગુણુ ^૧દાઝે તૃણુ ^૨આંચે,

તેહનો સુજસ ચતુર કિમ વાંચે ? ॥ ૩ ॥

પૂરણુબ્રહ્મ ને પૂર્ણાનંદી, દરશન-જ્ઞાન-ચરણુ રસ કંદી ।

સકળ વિભાવ-પ્રસંગ અ-ફંદી,

તેહ દેવ શમ-રસ-મકરંદી ॥ ૪ ॥

તેહની ભગતિ ભવ-ભય ભાંજે,

નિગુણુ પિણુ ગુણુ-શક્તિ :ગાંજે ।

દાસ-ભાવ પ્રભુતાને આપે.

અંતરંગ કલિમત્ત સવિ કાપે, ॥ ૫ ॥

અધ્યાતમ-સુખકારણુ પૂરો, સ્વ-સ્વભાવ-અનુભૂતિ સનુરો ।

તસુ ગુણુ વળગી ચેતના કીજે,

પરમ-મહોદય શુદ્ધ લહિ જે. ॥ ૬ ॥

મુનિસુવ્રતપ્રભુ પ્રભુતા-દીના, આતમસંપતિ-ભાસન-પીના ।

આભ્યારંગે ચિત્ત ધરીજે, દેવચંદ્ર-પદ શીઘ્ર વરીજે. ॥ ૭ ॥

૧ રાગથી, ૨ ઢઠે.

(૮૭૭) (૩૭-૧૩) શ્રી સુમતિનાથ-જિન સ્તવન
(કન્હૈયાલાલ-એ દેશી)

પ્રભુ શું ઈશ્યું વિનવું રે લાલ,

સુજ વિભાવ હુખ રીત રે-સાહિબાલાલા ।

તીન કાળના જોયની રે લાલ,

બાણો છો સહુ નીતિ રે-સાં પ્રભું ॥૧॥

જોય-જ્ઞાનશું નવિ મિલે રે લાલ,

જ્ઞાન ન બાળે તત્થ રે-સાં ।

પ્રાપ્ત-અ-પ્રાપ્ત અ-મેયને રે લાલ,

બાણો જે જિમ જત્ય રે-સાં પ્રભું ॥૨॥

છતી પરયાય જે જ્ઞાનના રે લાલ,

તે તો નવિ પલટાય રે-સાં ।

જોયની નવ-નવ વર્તના રે લાલ,

સવિ બાણે અસહાય રે-સાં પ્રભું ॥૩॥

ધર્માદિક સહુ દ્રવ્યનો રે લાલ,

પ્રાપ્ત બાણી સહકાર રે-સાં ।

રસનાદિક ગુણ વર્તતા રે લાલ,

નિજ-ક્ષેત્રે તે ધાર રે-સાં ॥૪॥

બાણુગ અભિલાષી નહિ રે લાલ,

નવિ પ્રતિબિંબે જોય રે-સાં ।

કારક-શક્તે બાણુવું રે લાલ,

ભાવ અનંત અ-મેય રે-સાં પ્રભું ॥૫॥

તેહ જ્ઞાન-સત્તા થકેરે લાલ,

ન બાણુયો નિજ તત્ત્વ રે-સાં ।

રૂચિ પણ તેહવી નવિ વધે રે લાલ,

૧ઐ ઐ મોહ મહત્વ રે-સાં પ્રભુ ॥૬॥

મુજ જ્ઞાયકતા પરરસી રે લાલ, પરતૃષ્ણાયે તત્ત્વ રે-સાં ।

તે સમતારસ અનુભવે રે લાલ,

સુમતિ સેવન વ્યાપ્ત રે-સાં પ્રભુ ॥૭॥

બાધકતા પલટાયવા રે લાલ, નાથ ભગતિ આધાર રે-સાં ।

પ્રભુ ગુણ રંગી ચેતના રે લાલ,

એહિજ જીવન સાર રે-સાં પ્રભુ ॥૮॥

અમૃતાનુષ્ઠાને રહ્યો રે લાલ, અમૃતકિયાને ઉપાય રે-સાં ।

દેવચંદ્ર રંગે રમે રે લાલ,

તે સુમતિદેવ-પસાય રે-સાં પ્રભુ ॥૯॥



(૮૭૮) (૩૭-૧૪) શ્રી શિવગતિ-જિન સ્તવન

(ધારા મોહલાં ઉપર મેહ ઝખૂકે વીજળી હો—એ દેશી)

શિવગતિ જિનવર સેવના દોહિલી-હો લાલ, સેં ।

પર-પરિણતિ-પરિત્યાગ કરે તસુ સોહિલી-હો લાલ ॥

આશ્રવ સર્વ નિવારી જેહ સંવરે ધરે-હો લાલ, જેહં ।

જે નિજ-આણા લીન પીન સેવન કરે-હો લાલ-પીનં ॥૧॥

વીતરાગ ગુણરાગ ભકિત રૂચિને ગમે-હો લાલ-ભકિતં ।

યથાપ્રવૃત્તિ ભવ્યજીવ નયસંગ્રહ રમે-હો લાલ-નયં ॥

અમૃતકિયા વિધિયુક્ત વચન, આચારથી-હો લાલ-વચનં ।

મોક્ષાર્થી જિનભકિત કરે વ્યવહારથી-હો લાલ-કરેં ॥૨॥

૧ અત્યંત ખેદવાચી દેશી શબ્દ છે.

ગુણપ્રાગભાવી કાય' તણે કારણપણે-હો લાલ-તણેં ।
 રતનત્રયી પરિણામ તે રૂઝુસૂત્રે લણે-હો લાલ-રૂઝું ॥
 જે ગુણ પ્રગટ થયો નિજનિજ કારય કરે-હો લાલ-નિજં ॥
 સાધકભાવે યુક્ત શબ્દ નય તે ધરે-હો લાલ-શબ્દં ॥૩૥
 પોતે ગુણ પર્યાય પ્રગટ પણ કાય'તા-હો લાલ-પ્રગટં ।
 ઉણે થાએ જાવ તાવ સમભિરૂઢતા-હો લાલ-તાવં ॥
 સંપૂરણ નિજ ભાવ સ્વ-કારય કીજતે-હો લાલ-સ્વં ।
 શુદ્ધાતમ નિજરૂપતણે રસ લીજતે-હો લાલ-તણેં ॥૪૥
 ઉત્સર્ગે એવંભૂત તે ફળને નિપને-હો લાલ-તેં ।
 નિઃસંગી પરમાતમ-રંગથી તે બને-હો લાલ-રંગ ॥
 સહજ અનંત અત્યંત મહંત સુખે ભરયા-હો લાલ-મહંતં ॥
 અ-વિનાશી અ-વિકાર અ-પાર ગુણે વર્યા-હો લાલ-અમરં ॥૫૥
 જે પ્રવૃત્તિ ભવ-મૂળ છેદ-ઉપાય જે-હો લાલ-મૂળં ।
 પ્રભુ-ગુણરાગે રક્ત થાય શિવદાય તે-હો લાલ-થાયં ॥
 અંશ થકી સર્વાંશ વિશુદ્ધપણું ઠવે-હો લાલ-વિશુદ્ધં ।
 શુક્લ-બીજ-શશિરેહ તે પૂરણ હુવે-હો લાલ-તેં ॥૬૥
 તિમ પ્રભુથી શુચિ રાગ કરે વીતરાગતા-હો લાલ-કરેં ॥
 ગુણ-એકત્વે થાય સ્વ-ગુણ પ્રાગભાવતા-હો લાલ-ગુણં ॥
 દેવચંદ્ર-જિનચંદ્ર સેવામાંહિ રહો-હો લાલ-સેવાં ।
 અ-વ્યાપાધ આત્મ-સુખ સંત્રહો-હો લાલ-આત્મં ॥૭૥

(૮૭૯) (૩૭-૧૫) શ્રી અસ્તાગનાથ-જિન સ્તવન

[મન મોહું અમારું પ્રભુ-ગુણે-એ દેશી]

કરો સાચા રંગ જિનેશરૂ, સંસાર વિરંગ સહુ અન્ય રે ।

સુરપતિ-નરપતિ-સંપદા, તે તો દુરગંધિ-કદનરે-કરો ॥૧॥

જિન અસ્તાગ-ગુણ-રસ રમી, ચલ વિષય-વિકાર વિરૂપરે ।

વિષુ સમકિત મતે અભિલખે,

જિણે ચાખ્યો શુદ્ધ સ્વરૂપ રે-કરો ॥૨॥

નિજ-ગુણ-ચિતન જગ રમ્યા, તસુ ક્રોધ અનળનો તાપ રે ।

નવિ વ્યાપે કાપે ભવસ્થિતિ,

જિમ શીતને અર્ક-પ્રતાપ રે કરો ॥૩॥

જિન-ગુણુરંગી ચેતના, નવિ બાંધે અભિનવ-કર્મ રે ।

ગુણુ-રમણે નિજ-ગુણુ ઉલ્લસે,

તે આસ્વાદે નિજ-ધર્મ રે-કરો ॥૪॥

પર-ત્યાગી ગુણુ એકતા, રમતા જ્ઞાનાદિક-ભાવ રે ।

સ્વ-સ્વરૂપ ક્યાતાં થઈ, પામે શુચિ ખાયક ભાવ રે-કરો ॥૫॥

ગુણુ-કરણે નવ-ગુણુ-પ્રગટતા સત્તાગત-રસચિતિ છેદ રે ।

સંક્રમણે ઉદય પ્રદેશથી, કરે નિર્જરા ટાળે ખેદ રે-કરો ॥૬॥

સહજ-સરૂપ-પ્રકાશથી થાએ પૂર્ણાનંદ-વિલાસ રે ।

દેવચંદ્ર-જિનરાજની, કરજ્યો સેવા સુખવાસ રે-કરો ॥૭॥

(૮૮૦) (૩૭-૧૬) શ્રી નમીશ્વરસ્વામી-જિન સ્તવનં

(હો પીઉ પંખીડા-એ દેશી)

જગત-દિવાકર શ્રીનમીશ્વર સ્વામ જો.

તુજ મુખ દીકે નાઠી ભૂલ અનાદિની રે લો ।

ભગ્યો સમ્યગ્ જ્ઞાન સુધારસ-ધામ જો,

છોડી દુર્જય મિથ્યા-નિંદ પ્રમાદની રે લો જગતં ॥૧॥

સહજે પ્રગટયો નિજ-પર ભાવ વિવેક જો,

અંતર-આતમ ઠહરયો સાધન સાધવે રે લો ।

સાધ્યાલંબી થઈ જ્ઞાયકતા છોક જો,

નિજપરિણતિ નિજ-ધર્મરસે ઠવે રે લો.. જગતં ॥૨॥

ત્યાગી (ને સવિ) પર-પરિણતિ-રસ-રીઝ જો,

ભગી (છે નિજ) આતમ-અનુભવ ઈષ્ટતા રે લો ।

સહજે છુટી આશ્રવ-ભાવની ચાલ જો,

જાલમ પ્રગટી સંવર-શિષ્ટતા રે લો. જગતં ॥૩॥

ખંધ (ના) હેતુ જે છે પાપસ્થાન જો,

તે તુજ ભગતિ પામ્યા પુષ્ટ પ્રશસ્તતા રે લો ।

ધ્યેય-ગુણે વલગો ઉપયોગ જો,

તેહથી પામે ધ્યાતા ધ્યેય-સમસ્તતા રે લો. જગતં ॥૪॥

જે અતિ-દુસ્તર જલધિ સમો સંસાર જો,

તે ગોપક સમ કીધો પ્રભુ-અવલંબને રે લો ।

ભણ્યો પૂર્ણાનંદ તે આતમ પાસ જો,

અવલંબ્યો નિર્વિકલ્પ પરમાતમ તત્ત્વને રે લો. જગતં ॥૫॥

સ્યાદ્રાદી નિજ પ્રભુતાને એકત્વ જો,
 ક્ષાયિકભાવે થઈ નિજ રતનત્રયી રે લો ।
 પ્રત્યાહાર કરીને ધારે ધારણ શુદ્ધ જો,
 તત્વાનંદી પૂર્ણ-સમાધિલયે મઈ રે લો. જગતં ॥૫૫॥
 અ-વ્યાખાધ-સ્વ-ગુણની પૂરણ રીત જો,
 કરતા-લોકતા ભાવે રમણપણે ધરે રે લો ।
 સહજ અ-કૃત્રિમ નિર્મળ જ્ઞાનાનંદ જો,
 દેવચંદ્ર-એકત્વે સેવનથી વરે રે લો. જગતં ॥૫૬॥

(૮૮૧) (૩૭-૧૭) શ્રી અનિલપ્રભ-જિન સ્તવન

[દેખો ગતિ દૈવનીરે—એ દેશી.]

સ્વારથ વિણ ઉપગારતા રે, અહભુત અતિશય રીદિ ।
 આત્મ-સ્વરૂપ પ્રકાશતા રે, પૂરણ સહજ સમૃદ્ધિ—
 —અનિલજિન સેવીયે રે ॥

નાથ ! તુમ્હારી જોડિ, ન કો ત્રિહુ લોકમેં રે ।
 પ્રભુજી ! પરમ-આધાર, અછો ભવિ? થોકને રે ॥૧॥
 પર-કારજ કરતા નહિ રે, સેવ્યા પાર ન હેત ।
 જે સેવે તન-મન થઈ રે, તે લહે શિવ-સંકેત-અનિલં ॥૨॥
 કરતા નિજ ગુણ-વૃત્તિતા રે, ગુણ પરિણુતિ ઉપભોગ ।
 નિ-પ્રયાસ-ગુણ વત્તાંતારે, નિત્ય સકલ ઉપયોગ-અનિલં ॥૩॥
 સેવ-ભક્તિ ભોગી નહી રે, ન કરે પરનો સહાય ।
 તુજ ગુણરંગી ભક્તના રે, સહેજે કારજ થાય-અનિલં ॥૪॥

૧ સમૂદને.

કિરિયા કારણ કાર્યતારે, એક સમય સ્વાધીન ।
 વરતે પ્રતિગુણ સર્વદા રે, તસુ અનુભવ લયલીન-અનિલ ॥૫॥
 જ્ઞાયક લોકાલોકનારે, અનિલપ્રભ જિનરાજ ।
 નિત્યાનંદમયી સદા રે, દેવચંદ્ર સુખદાય-અનિલ ॥૬॥

(૮૮૨) (૩૭-૧૮) શ્રી યશોધરસ્વામી-જિન સ્તવન

[રાગ મારૂ]

વદનપર વારી હો જશોધર ! વદનપર વારી ।
 મોહ-રહિત મોહન બકે, ઉપશમ-રસ-કયારી હો
 અહો ઉપશમ ० વદન ० ॥૧॥
 મોહજીવ લોહકો કંચન, કરવે પસાર ભારી હો ।
 સમકિત-સુરતરૂ (ઉપ) વન સિંચનકો,
 વર પુષ્કલ જલધારી હો, અહો વર ० વદન ० ॥૨॥
 સર્વ-પ્રદેશ પ્રગટ શમગુણથી, પ્રવૃત્તિ અનંત અપહારી હો ।
 પરમ-ગુણી સેવનથે સેવક,
 અપ્રશસ્તતા વારી હો-અહો અપ્ર ० વદન ० ॥૩॥
 પરપરિણુતિ રૂચિ રમણ અહણતા, દોષ અનાદિ નિવારી હો ।
 દેવચંદ્ર પ્રભુ સેવન ધ્યાને,
 આતમશકિત સમારી હો, અહો આતમ-વદન ० ॥૪॥

(૮૮૩) (૩૭-૧૯) શ્રી કૃતાર્થનાથ-જિન સ્તવન

[અધિકા તાહરં હું તો અપરાધી-એ દેશી]

સેવા સારજ્યો જિનની મન સાચે, પિણુ મત માંગો ભાઈ ।
 મહિનતના ફળ માગી લેતાં, દાસભાવ સવિ બંધ સેવા૦ ॥૧॥
 ભકિત નહી તે તો ભાડાયત, જે સેવાફળ બચે ।
 દાસ તિકે જે ધન-ભર નિરખી, કેકીની પરે નાચે-સેવા૦ ॥૨॥
 સારી વિધિ-સેવા સારતાં, આણુ ન કાંઈ ભાંજે ।
 હુકમ હાજર ખીજમતિ કરતાં સહેજે નાથ નિવાજે. સેવા૦ ॥૩॥
 સાહિબ ! જાણો છો સહુ વાતો, શું કહિયેં તુમ આજે ? ।
 સાહિબ-સનમુખ અને માગણુની, વાત કારમી લાગે-સેવા૦ ॥૪॥
 સ્વામી-કૃતાર્થ તો પિણુ તુમથી, આશ સહુ-કો રાખે ।
 નાથ વિના સેવકની ચિંતા, કોણુ કરે વિણુ દાંખે ? સેવા૦ ॥૫॥
 તુજ સેવ્યાં ફળ માંગ્યો દેતાં, દેવપણુ થાયે કાચો ।
 વિણુ માગ્યાં વંછિત ફલ આપે, તિણે દેવચંદ્ર પદ સાચો-સેવા૦ ॥૬॥



(૮૮૪) (૩૭-૨૦) શ્રી જિનેશ્વર-જિન સ્તવન

(અખીયાં હરખન લાગી હમારી અખાયાં-એ દેશી
 રાગ—પરભાતી)

હું તો પ્રભુ વારી છું તુમ મુખની,
 હું તો જિન બલિહારી-તુમ મુખની ।
 સમતા અમૃતમય મુપસનની, ગેયા નહીખની-ગ-૩ હું૦ ॥૧॥
 ભ્રમર અધર શિષ ધનુહર કમલદલ, કીર હીર પુનમ-શશી નીર ।

શોભા તુચ્છ પ્રભુ દેખત યાકી,

કાયર હાથે જિમ અસીની-હુંં ॥૨॥

મનમોહન તુમ સન્મુખ નિરખત, આંખ ન તૃપતિ અમ્હચી ।

મોહ-તિમિર-રવિ હરખ-ચંદ્ર-છબી,

મરત એ ઉપશમચી-હુંં ॥૩॥

મનની ચિંતા મહી પ્રભુ ધ્યાવત, મુખ દેખંતાં તુમ જિનની ।

દંદ્રિયવૃષા ગઈ જિનેસર । સેવંતાં, શુભગાતાં વચનની-હુંં ॥૪॥

મીન-ચકોર-મોર-મતંગજ, જલ-શશી-ધન નીચનથી !

તિમ મો પ્રતિ સાહિબ સૂરતથી, ઓર ન ચાહું મનથી-હુંં ॥૫॥

જ્ઞાનાનંદન (બ) જયાનંદન, આશા દાસ નીચતની ।

દેવચંદ્ર-સેવનમેં અહનિશ,

રમજ્યો પરિણુતિ ચિત્તની હુંં ॥૬॥



(૮૮૫) (૩૭-૨૧) શ્રીશુદ્ધમતિ-જિન સ્તવન

[શ્રીજિન પ્રતિમા હો જિન સરખી કહિ-એ દેશી.]

શ્રીશુદ્ધમતિ હો જિનવર પૂરવો, એહ મનોરથ માળ ।

સેવક બાણી હો મહિરખાની કરી, ભવસંકટથી ટાળ-શ્રીં ॥૧॥

પતિત-ઉદ્ધારણુ હો તારણુ-વત્સલુ, કર અપણાયત એહ ।

નિત્ય નિ-રાગી હો નિરુપૃહ જ્ઞાનની,

શુદ્ધ અવસ્થા દેહ-શ્રીં ॥૨॥

પરમાનંદી હો તું પરમાતમા, અવિનાશી તુજ રીત ।

એ શુભ બાણી હો તુમ વાણી થકી,

ઠહરાણી મુજ પ્રીત-શ્રીં ॥૩॥

શુદ્ધ-સ્વરૂપી હો ! જ્ઞાનાનંદની, અંયામાધ-સ્વરૂપ !
લવ-જલનિધિ હો તારક જિનેશ્વર,

પરમ-મહોદય ભૂપ-શ્રીં ॥૪૧॥

નિરમમ નિ-સંગી હો નિરભય અ-વિકારતા,

નિરમલ સહજ સમૃદ્ધિ !

અષ્ટ કરમ હો વનદાહથી, પ્રગટી અન્વય-રિદ્ધિ-શ્રીં ॥૪૨॥

આજ અનાદિનીહો અનંત અક્ષતા, અ-ક્ષર અનક્ષર રૂપ !

અ-ચલ અ-કલ હો અ-મલ અ-ગમનું,

ચિદાનંદ ચિદ્રૂપ-શ્રીં ॥૪૩॥

અનંતજ્ઞાની હો અનંતદર્શની, અનાકારી અવિરૂદ્ધ !

લોકાલોક હો જ્ઞાયક સુહંકર, અનાહારી સ્વયંબુદ્ધ-શ્રીં ॥૪૪॥

જે નિજ પાસે હો તેશું માંગીયે, દેવચંદ્ર જિનરાજ !

તો પિણુ મુજને હો શિવપુર સાધતાં, હોળ્યો

સદા સહાય-શ્રીં ॥૪૫॥

[ઈતિ દેવચંદ્રજી કૃત અતીત ચોવીશીના ૨૧ સ્તવન સંપૂર્ણ]



શ્રી વર્ધમાનસ્વામિને નમઃ
શ્રી જીવણવિજયજી કૃત
સ્તવન-ચોવીશી

(૮૮૬) (૩૮-૧) શ્રી ઋષભદેવ-જિન સ્તવન
[દેશી-ગાડીની]

મોહ્યો મન ^૧મધુકર ગુણ કૂલ સાહેબજી ? ઉડાયો ઉડે નહિંજી ।
પ્રભુ મૂર્તિ અતિહી અમૂલ-સાં, નયણ ઠરે દીકો સહીજી ॥૧॥
મળવા મનમેં મોરી છે આશ સાં પશુ કર્મ અશુભ દીસે ઘણાંજી ।
રવિસવાવીસ અછે વિશ્વાસ-સાં તુમથી તાપ નાશે ચેતન
તણાજી ॥૨॥

કોઈ પૂર્વ લવાંતર નેહ-સાં આવી બન્યો રે તુમથી ઘણોજી ।
તિણે દાખો રખે ! પ્રભુ ^૩છેહ-સાં હાજર ^૪બંદો હું છું
જિન તણોજી. ॥૩॥

જાણો વલી ^૫વેલા જો સુઝ, -સાં તો ઢોલ ઘડી કરતા રખેજી !
વાદલા ! વાત કહી જો મેં સુઝ-સાં હેત ધરી હિયડે ^૬લખેજી ॥૪॥
તું તો ^૭નાનુક નાલિનો નંદ-સાં આદિકરણ આદીસરજી ।
એ તો મરૂદેવી સુત સુખકંદ-સાં જીવણવિજયને જયકરજી પ



૧ બ્રમર, ૨ સંપૂર્ણ ૩ વિયોગ, ૪ સેવક, ૫ પરિસ્થિતિ,
૬ વિચારજો, ૭ કોમલ-લાડીલા.

(૮૮૭) (૩૮-૨) શ્રી અજિતનાથ-જિન સ્તવન

(દેસી-વીંછિયાના)

અજિત જિનેસર આજથી, ^૧મુજ રાખજો રૂડી^૨ રીતિ રે લાલ ।
ખાંદ્ય ગ્રહીને બહુ પરે, પ્રભુ ! પાળજો પૂરણ પ્રીતિ રે લાલ-અં ૦૧ ।
કામિત-કલ્પતરૂ સમો એ તો મુજ મન-મોહન-વેલી રે લાલ ।
અનુકૂળ થઈને આપીયે, અતિ અનુભવ રસ રંગરેલી રે લાલ-અં ૦૨ ।
મનહ મનેરથ પૂરજો, એ તો ભકત તણા ભગવંત રે લાલ ।
^૩આતુરની ઉતાવળે ^૪ખરી મન કરી પૂરીએ ^૫ખાંત રે લાલ-અં ૦૩ ।
મુક્તિ મનોહર ^૬માનિની, વશ તાહરે છે વીતરાગ રે લાલ ।
આવે જો તે આંગણે, માહરે તે મોટે ભાગ્ય રે લાલ-અં ૦ ૥ ૪ ॥
સિદ્ધિવધુ સહેજે મળે, તું હો જો તારક દેવ રે લાલ ।
કહે જી રાણુ જિન તણી, ^૭સખરી ^૮સઘવાથી સેવ રે લાલ, અં ૦ ૥ ૫ ॥

(૮૮૮) (૩૮-૩) શ્રી સંભવનાથ જિન સ્તવન

(મારું મન મોહ્યું રે શ્રી સિદ્ધાચલે રે-એ દેશી)

સુશુણ સનેહી! સાંભલ વિનતિ રે, સંભવ સાહિબ ! બહુ સુખદાયરો ।
ઓલગ કીજે અહોનિશ તાહરીરે,

લેજો ^૯વાસર લાયક ! થાય રે-સું ૦ ૥ ૧ ॥

તારક બિરૂદ એ છે જો તાહ રે, તારો ^{૧૦}કરમીને ^{૧૧}કિરતાર રે ।

સાય-મનાછો સંભવનાથજી રે,

સેવશે આવી સહુ સંસાર રે-સું ૦ ૥ ૨ ॥

૧ મને, ૨ સારી રીતે, ૩ ગરજવાનની, ૪ સાચામનથી, ૫ ભાવનાઓ,
૬ જી, ૭ શ્રેષ્ઠ, ૮ બધાકરતાં. ૯ સફળ, ૧૦ પાપી. ૧૧ હે પ્રભુ !

ઉત્તર કરશે। મુઝને એહવો રે, ગુણનો રાગી છું ગુણવંત રે ।
જીગતો નેગ હુએ વહી જાણુશું રે,

સૂધો આણીને અતિ ગુણસંત રે-સુ૦ ॥૩॥
એહવું જાણી જન એકમના થઇ રે,

પ્રેમશું પ્રણુમો પ્રભુના પાય રે ।
અંતર-ઢાઝ એલાશે આપથી રે,

ખિજમત કરીએ ખરી મહારાય ! રે-સુ૦ ॥૪॥
આલસ અરતિ અલગી ટાળીને રે, ધરિયે ધ્યાન કરી દઢચિત્ત રે ।
જીવણવિજયે જય-લક્ષ્મી વરી રે,
મળિયો ને મેલું સાહેબ ચિત્ત રે-સુ૦ ॥૫॥



(૮૮૯) (૩૮-૪) શ્રી અભિનંદન જિન સ્તવન
(સાંભલો ચંદ નરેસર રે લો,-એ દેશી)

અભિનંદન અરિહંતજી રે લોલ,
કાંઈ કરુણા કર ! ગુણવંતજી રે લો ।

સજ્જન સાચા ને મલે રે લો,
તો દૂધમાંહી સાકર ભળે રે લો-અભિ૦ ॥૧॥

કેવલ-રકમલા ને તાહરે રે લો,
તેણે કારજ શ્યો સરે માહરે રે ? લો ।

ભાળતાં ભુખ ન ભાંજીયે રે લો ।
કાંઈ પેટ પડ્યાં ડ્રાપીજીએ રે લોલ-અભિ૦ ॥૨॥

૧ ગુણવાન. ૨ લક્ષ્મી, ૩ તૃપ્તિ થાય,

હેજ કરી હુલરાવિયાં રે લો, કાંઈ વધીયે નહિં વિષ્ણુ ધાવિયા રે લો ।
ઉત્તમ હુએ ઉપગારને રે લો,

તે તત્ત્વ વહેચી દિયે ૧ તારી રે લો-અભિં ॥૩॥

આતમમાં અનુઆસીયે રે લો, કાંઈ વાસ તુમારે વાસિયે રે લો ।
કારણ બે કાંઈ લેખવો રે લો,

તો નેહ-નજર-ભર દેખવો રે લો-અભિં ॥૪॥

સિદ્ધારથા-સંવર તણો રે લો,

કાંઈ કુલ અનુઆદ્યો તેં ઘણો રે લો ।
શાશ્વતી સંપદા સ્વામીથી રે લો,

જીવણ જસ લહે નામથી રે લો-અભિં ॥૫॥



(૮૯૦) (૩૮-૫) શ્રી સુમતિનાથ-જિન સ્તવન

(જગજીવન જગ વાલ હો. એ દેસી)

પૂરણ પુણ્યે પામીએ, સુમતિ જિણુંદ રસિરદાર-લાલ રે ।
ચિંતામણિ સમ આહના, જિનની જગદાધાર-લાલ રે-પૂરણ ॥૧॥

ભૂખ્યાને કોઈ ભાવશું, ઘેબર દે ધરે આણી-લાલ રે ।
તરસ્યાંતોયને ટેતાકતાં, ઉમટે અમૃત ખાણી-લાલ રે-પૂરણ ॥૨॥

શૂર સૂરજને દેખતો, અધિક ધરે ઉછરંગ-લાલ રે ।

તિમ જિન જગત્રય-તારકો,

મોટો એ મહારે ૪ અંગ-લાલ રે-પૂરણ ॥૩॥

૧ તારવીને, ૨. શ્રેષ્ઠ, ૩. જોતાં, ૪, સુંદર

ઓલગી તુજ અલવેસર. ખીજ કુણુ ગહે ! ખાંદા-લાલ રે ।
સંગતિ સુરતર છોડીને,

કિમ ખેસુ ? આવલ છાંય ? લાલ રે-પૂરણુ ॥૪૧॥
ગુણુ દેખીને ગહુગહ્યો, પામ્યો હું પરમ-ઉલ્લાસ-લાલ રે ।
જીવણવિજય સુપસાયથી,

જીવણુ જિન તણે દાસ-લાલ રે-પૂરણુ ॥૪૨॥



(૮૯૧) (૩૮-૬) શ્રી પદ્મપ્રભ-જિન સ્તવન

(શ્રી સિદ્ધચક્ર આરાધીયે રે લો, એ દેશી)

પદ્મ પ્રભનો પામીએ રે લો, ^૧દોલતવંત રહેદાર રે-જિનેસર ।
મંગલમાલા કારણે રે લો,

સુસીમા માત મલ્હાર રે-જિને ૦ પદ્મ ૦ ॥૧॥
ચતુર કરીજે ચાકરી રે લો, ભાવજલે ભરપૂર રે-જિને ૦ ।
પરમ-પુરૂષના સંગથી રે લો,

શિવ સુખ લહીયે-સ-નૂર રે-જિને-પદ્મ ૦ ॥૨॥
ઝવાલેસર ! ન વિસારિયે રે લો, ગિરૂઆ ગરીબ-નિવાજ રે-જિને ૦ ।
દાતારી તું દીપતો રે લો,

હે ઇચ્છિત મુજ આજ રે-જિને ૦ પદ્મ ૦ ॥૩॥
૪ઓઘ તું ^૫ઠેલ હવે પાપના રે લો, પાલ્ય ^૬સહુણા ! પ્રીત રે-જિને ૦ ।
તિલતિલ થાઉં ^૭તોપરે લો,

ચતુર ! નાણે કિમ ? ચિત્ત રે-જિને ૦ પદ્મ ૦ ॥૪॥

૧. પ્રભાવશાલી, ૨ ચહેરો, ૩ અત્યંત પ્યારો, ૪ સમૂહ, ૫ દુર કર !

૬. સૌભાગ્યશાળી, ૭ તમારા ઉપર.

મન મંદિર મુજ આવિયે રે લો, એહ કડું અરદાસ રે-જિનેં ।
 કહે જીવણુ આવી મિલે રે લો,
 સહેજે લીલ-વિલાસ રે-જિનેં-પદ્મ ॥૫૧॥



(૮૯૨) (૩૮-૭) શ્રી સુપાર્શ્વનાથ-જિન સ્તવન

(એકે દિન પુંડરીક ગણધર રે લાલ-એ દેશી)

સપ્તમ કેવ સુપાસજી રે લાલ, સાંભળ મુગુણ વાત રે-સનેહી ।
 દરિસણ પ્રભુનો દેખીને રે-લાલ, નિરમલ કડું નિજ ગાત રે-સનેહી-
 તું મનમોહન માહરે રે-લાલ,

જીવન-પ્રાણ આધાર રે-સનેહીં તું ॥૧॥

સંદેશે ઓલગ મુણી રે લાલ, કારજ નાવે કોઈ રે-સનેહી ।

વેધાલક ! મન વાતડી રે લાલ,

હજૂર થયે તે હોય રે-સનેહીં તું ॥૨॥

ચતુર ! તેં ચિત્તને ચોરીઓ રે લાલ,

મન-તન રહ્યો લયલીન રે-સનેહી ।

વેધાણુ તુજ વેધડે રે લાલ,

જિમ મૃગ વેધે વીણુ રે-સનેહીં તું ॥૩॥

વાલેસર ! ન વિલંબીએ રે-લાલ, સેવક દીજે સુખ રે-સનેહી ।

ન ૧ખમિયે હવે નાથજી રે-લાલ,

રેભાણા ૩ખડખડ ભૂખ રે-સનેહીં તું ॥૪॥

૧ ધીરજ રાખતી. ૨ જમવા ટાણે-ભાણે બેઠા પછી, ૩ કકડતી
 = હિય

કાલ-કંટક દૂરે કરો રે-લાલ, આણે જેહ અંતરાય રે-સનેહી ।
નાણે તે નવિ પામીએ રે-લાલ,

વેલા જેહ વહી જાય રે-સનેહીં તું ॥૧૧॥

સહજ-સ્વરૂપી સાહિબા રે-લાલ, શિવપુરના શિરદાર રે-સનેહી ।
આપ લીલા આવી મલો રે-લાલ,

મુજને એ મનોહાર રે-સનેહીં તું ॥૧૨॥

પૃથ્વી-સુત પુહવીતલે રે લાલ, જીયો અભિનવ ભાણુ રે-સનેહી ।
કહે જીવજી જીવનો રે લોલ,

કરજો કોડિ—કલ્યાણુ રે-સનેહીં તું ॥૧૩॥



(૮૮૩) (૩૮-૮) શ્રી ચંદ્રપ્રભ-જિન સ્તવન

(પુરૂષલવર્ધ વિજયે જયો રે, એ દેશી)

ચંદ્રપ્રભજીની ચાકરી રે, દ્રાખ-સાકર થેં મીઠ-જિનેસર ।

સફલ કર્યો સંસારમાં રે, જન્મ જેણે જિન દીઠ-જિનેસર ૧ ।

વહાલો તું વીતરાગ, મુઝ મલિયો મોટે ભાગ-જિનેસર ।

વળી પહોંતે પુણ્ય અથાગ,

કરું સેવા હું ચરણે લાગ-જિનેં વહાલોં ॥૨॥

૧ મેવાસી ૨ ભડ મારીઓ રે, મયાણુ મહા-દુરદંત-જિનેં ।

૩ વિપયા-૪ તરુણી વેગળી રે,

મૂકી થયા મહંત રે-જિનેં વહાલોં ॥૩॥

૫ કરડા કર્મઘટકે ચોરડા રે, જિનપતિ જીત્યા જેહ-જિનેં ।

૧ માથાભારે ઠાકોર, ૨ મોટો, ૩ વાસના, ૪ સ્ત્રી, ૫ કઠોર,

તૃષ્ણા-દાસી જે તણ રે,

મુઝ મન અચરિજ એહુ-જિનેં વહાલોં ॥૪॥

દોષ દોય દોહાવિયા રે, ધુરથી રાગ ને દ્રેષ-જિનેં ।

જગવ્યાપી યોધ લોભને રે,

રાખ્યો નહિ કાંઈ રેખ-જિનેં વહાલોં ॥૫॥

અરિયણુ છતી આકરા રે; વરિયો કેવલનાણુ-જિનેં ।

લક્ષ્મણા માતનો લાડલો રે,

કરતો સફલ ૭વિહાણુ-જિનેં વહાલોં ॥૬॥

પામી તેં તે હું પામશું રે, લીલા લહેર ભંડાર-જિનેં ।

કહે જીવાણુ જિનજી કરો રે,

નિશદિન હર્ષ અપાર-જિનેં વહાલોં ॥૭॥



(૮૮૪) (૩૮-૯) શ્રી સુવિધિનાથ-જિન સ્તવન

(રાજગૃહી નગરીનો વાસી, શ્રેણિકનો સુત સુવિલાસી
હો-મુનિવર વૈરાગી-એ દેશી)

સુવિધિ સુવિધિના રાગી,

એક અરજ કરૂં પાય લાગી-હો જિનવર સોભાગી ।

દીદાર દીઠે વડલાગી, ભલો ભાગ્યદશા મુજ જાગો હો-જિન ॥૧॥

સુષ્ણ શિવરમણીના કંત ! મનમોહન તું શુભવંત હો-જિન ॥

સુખ વંછિત દીજે સંત,

પ્રભુ પામ્યા જેહુ અનંત હો-જિન ॥૨॥

ક ચકવી દીધા, ૭ પ્રભાત.

લાયકથી લાયક લાજ, લહીયે મહીયલ મહારાજ હો-જિનં
શુભગ્રાહી ગરીબ-નિવાજ,

પય પ્રભુમી કહું પ્રભુ આજ હો-જિનં ॥૩૧॥
રાગી રસ અનુલવ દીજે, સુપસાય એ તો અમ કીજે હો જિનં ।
સાચાને સાચ દાખીજે,

જિનજી તો જસ પામીજે હો-જિનં ॥૩૨॥
મત ચૂકો માનવ ! ખેવ, તારક છે એહીજ દેવ હો-જિનં ।
જગ જીગતિ છે નિતમેવ,

કહે જીવણ પ્રભુપય સેવ હો-જિનં ॥૩૩॥



(૮૯૫) (૩૮-૧૦) શ્રી શીતલનાથ-જિન રેતવન
(આંખડિયે મેં આજ શેત્રુંજે દીઠો રે, એ દેશી)

શીતલ શીતલ છાયા રે-સુરતરૂ સારી રે ।

લાગી છે મન શુદ્ધ માયા રે-પ્રાણથી પ્યારી રે ॥
પૂનણ-પુણ્યે હું પાસ તુમારે, વહાતા મારા !

આવ્યો છું આશ કરીને ।

રંગ-વિલાસ કરો મન રૂઝે, હિયડે હેત ધરીને રે—

સાહેબ સાચો રે !

પામીને પરતક્ષ સાંઈ રે, ચોર મત જાયો રે ॥૧॥

આશાને આધારે ૧એતા, વહાંમેં તો ૨દુષ્કૃત દિનખડુ કાઢયા ।

જાણુ થકાં તે કાં નવિ જાણો, રાગી છો ધર્મ-ધનાઢયા રે,

--સાહેબ ॥૨॥

લક્ષ્મી મનો-ગત લાવ જાણે છે,

૦હાં તો મુખ કાં નવિ યોલો ! ।

વહતી^૩ વેલા જાણી^૪ વેગે, અંતર પડદો યોલોરે-સાહેબં ॥૩૭॥

ગાંડ તણો કાંઈ^૫ ગરથ ન જોસે, ૦હાં અનુકૂલ અમને દેતાં ।

દ્વણ લાગે તો પણ દાખે; નેહ નજર ભરી જોતાં સાહેબં ॥૪૦॥

પંચમ-ગતિ દાયક પ્રભુ પામી, ૦હાં અવર ન ધીજો જાયું ।

નવ નિધિ જીવણ નિત્ય ઘર આવે,

નામ શીતલનાથ-સાયું રે. સાહેબં ॥૪૫॥



(૮૯૬) (૩૮-૧૧) શ્રી શ્રેયાંસનાથ-જિન સ્તવન

(ગઢડામેં જૂને સહીયાં હાથણી એ દેશી)

મનડો મેં મોહ્યો શ્રી શ્રેયાંસજી, તનડે તુજ દેખણુરી મન ઢોડા ।

મારી^૧ ઓલગડી અવધારો રૂડા રાજ્યા,

વળી વળી કહિયે જે કર જોડ-મારીં

રૂપકલા નિહાલી રૂડા રાજવી,

લખપતિ લાયક રહે કર જોડ-મારીં ॥૧॥

આંખલડી છે પ્રભુની^૨ અંબુજ-પાંખડી,

જીલલડી તે જાણે^૩ અમી-રસ કંદ-મારીં ।

નાસિકા પ્રભુની દીપરિખા જિસી,

શોભિત સોલ કલા મુખચંદ-મારીં ॥૨॥

ગહન રાન-ગુણે તું પૂરિયો,

મહીયલે પ્રભુ મુદ્રા લાગે મીઠ-મારીં ।

૩ જઈ રહેલ, ૪ જલદી ૫ પૈસો, ૧ સેવા ૨ કમલની પાંખડી,
૩ અમૃતનો રસ;

૪ લેખે ભવ આણ્યો તેણે આપણો,
 જન્માન્તર જેણે જિનજી દીઠ-મારી. ॥૩૭॥
 લીલી ને લાખેણી જેણે લીન છે,
 તેહની કાંઈ ચાહુ ઘણી છે ચિત્ત-મારી. ૧
 મન તણી જાણ્યો હોશો માહરી,
 હિત કરીને દેશ્યો દિલ જે મિત્ત-મારી. ॥૪૦॥
 એક તારી જે કરીયે જિનજી ચાકરી,
 પામીજે તો સફલ સદા સુવિહાણ-મારી. ૧
 પંડિત જીવવિજય પદ દાસના,
 કર ધરી કરીયે કોડિ કલ્યાણ-મારી. ॥૪૧॥



(૮૯૭) (૩૮-૧૨) શ્રી વાસુપૂજ્ય-જિન સ્તવન

(સંભવજિન અવધારિયે—દેશી)

જય જયાનંદન દેવની, ૧ સખરી સઘલાથી સેવ-સાહેબજી ૧
 એક-મના આરાધતાં, વર વાંછત લહે નિતમેવ-સાં ॥૧॥
 વહાલી હો મૂર્તિ મન વસી, મનમોહન વસુપૂજ્ય-નંદ-સાં ૧
 ૨ સાસ-સમાણો તે સાંભરે,

વાસુપૂજ્ય વહાલો જિનચંદ-સાં ॥૨॥
 વાસ વસ્યા જઈ ઓગલે, એ તો અહીં થકી સાત રાજ-સાં ૧
 ધ્યાતા જન મન હું કહો, કરવા નિજ-ભક્તિ સુકાજ-સાં ॥૩॥
 અનોપમ આશ તુમારડી, અનુભવ રસ ચાખણ આજ-સાં ૧
 મહેર કરી મુજ દીજીયે, નેક નજર ગરીબ-નિવાજ-સાં ॥૪॥

સફળ, ૧ શ્રેષ્ઠ, ૨ શ્વાસની સાથે, ૩ દૂર.

વિનતડી વીતરાગની, કરતાં કાંઈ કોડિ કદ્યાણુ-સાં ।

જીવણુ કહે કવિ-જીવનો તુજ તૂઠ્યે નિરમલ નાણુ-સાં ॥૫૦॥



(૮૮૮) (૩૮-૧૩) શ્રી વિમલનાથ-જિન સ્તવન

(મુનિમુદ્રત કીજે મયા રે, એ દશી)

વિમલ-કમલ પરે વિમલ વિરાજે, ગાજે ગુણનિધિ જાસ ।

કીરતિ અતિ કાને સુણી પ્રભુ ! પામ્યો હું પરમ-ઉલ્લાસ,

-સલૂણા સાહેબ ! શ્યામા-નંદ,

તુજ સોહત આનન-અંદ-સં

૧પયસેવિત સુર-નર-વૃંદ-સં ॥૧॥

૨સુરપતિ ૩સુરમણિ ૪શશી ૫ગિરિના, ગુણલઈ ઘડિયો અંગ ।

મૂરતિ મોહન વેલડી, વાડ વિમલ જિજ્ઞંદ સુઅંદ-સં ॥૨॥

જ્ઞાતા દાતા ને વલ્લી ત્રાતા, બ્રાત તું જગ મિત્ત ।

જ્ઞાતા દીજે ૬સામટી, અજરામર પદ સુવિદિત-સં ॥૩॥

૭અલીક ન લાખું સહી સત્ય લાખું, દાખું છું ધરી નેહ ।

આપ-લીલા ધન ઉમટી, વરસો મુજ ૮મન-વન મેહ-સં ॥૪॥

વિનતડી મુજ મુણીને ૯વેગે, નેહી હોજો નાથ ।

કહે જીવણુ જિનજી મિલ્યાં, હુવે હર્ષિત હુઓ સનાથ-સં ॥૫॥



૧ ચરણ કમલની સેવા કરે, ૨ ઈંદ્ર, ૩ ચિંતામણી, ૪ ચંદ્ર

૫ મેરુપર્વત, ૬ વિપુલ, ૭ ખોટું, ૮ મનરૂપવનમાં, ૯ જલદી

(૮૯૯) (૩૮-૧૪) શ્રી અનંતનાથ-જિન સ્તવન
(નિરખ્યો નેમિ જિણુંદને, અરિહંતાણ. એ દેશી)

આજ અમારે આંગણે-સોભાગી રે,

૧ મુરતરૂ ફલીયો સાર-સાહિબ ગુણ રાગી રે :

અનંત અનંતા જ્ઞાનનો-સોં, દીઠો દેવ ભંડાર-સાં ॥૧॥

ઓલાંધે ઉંખર ઘણા-સોં, તેહને કેતા ઇશ-સાં ।

એકમનો હું રતો-થકી-સોં, ચાહું છું ઉબગસીસ-સાં ॥૨॥

આપ-સરૂપી હોઈ ને, -સોં, બેઠા થઈ બલવાન-સાં ।

મરણ જરા ને જનમના.-સોં, ભય ભાંગ્યા ભગવાન-સાં ॥૩॥

સાચી વિધિ સેવા તણી, -સોં, અવધારી અરિહંત-સાં ।

મનહ મનોરથ પૂરજો-સોં, ભકત તણા ભગવંત-સાં ॥૪॥

કર્મરહિત કિરતારની-સોં, એવા શિવ દાતાર-સાં ।

જીવણ જીવિજય તણો, -સોં, આપ્યો પુણ્ય-અંખાર-સં ॥૫॥



(૯૦૦) (૩૮-૧૫) શ્રી ધર્મનાથ-જિન સ્તવન
(થેં તો મહેલાંરા પોઢણહાર, હંગર ડેરા કચું મહારા રાજ)

સાહિબા મારા ૧ વિણુ-સેવાએ દાસ,

કહો કુણુ ? તારિવાણ-મારા રાજ-કહોં ।

સાં સેવા-દાન જે દીધ,

તે અર્થ શ્યા સારિયાણ ? માં અં ॥૧॥

સાં નાવા તારે જે નાથ ! કે, નિશ્ચય તારકુણ-માં નિં ।

સાં આપ તરે અરિહંત કે, અવરાં કર્મ-વારકુણ-માં અં ॥૨॥

૧ કદપવૃક્ષ, ૨ તારી પાસેથી, ૩ ધનામ ૧ સેવાવિના,

સાં ઓળગતા દિન-રાત કે, કદીક નિવાળ્યો-માં કં ।

સાં બિરુદ જે ગરીબ-નિવાજ કે,

સાચ દિવાળ્યો-માં સાં ॥૩૧॥

સાં ઉપકારી નરપાત્ર, કુપાત્ર ન લેખશે-માં કું ।

સાં જવું સમ-વિષમા-ધાર,

જલદ કેમ દેખશે ? માં જં ॥૪॥

સાં જપ કર્યે કર્મ એ ઈશ, પડ્યો જસ લેયશે-માં પં ।

સાં ધરશે ધર્મનું ધ્યાન તે,

જીવણુ જસ દેયશે, માં જં ॥૫॥



(૯૦૧) (૩૮-૧૬) શ્રી શાંતિનાથ-જિન સ્તવન

(કેવલી અચલ કહેવાણી)

જગ જગનાયક, જિનચંદા ! તુજ દરિસણુ નયનાનંદા રી-

સુણો ! સાહિબ શાંતિ જિણંદા !

જિન સોળમે પંચમ ચક્રી,

પય પ્રણમે ચોસઠ ૧ શક રી-સુણો ॥૧॥

આપ રઓળગુઆ મન આણો,

મળિયો મન માન્યો એ ટાણો રી-સુણો ॥

અવસર લહી ચતુર ન ચુકે,

નિજ દાસ નિરાશ ન મૂકે રી-સુણો ॥૨॥

ટળે તન-મન તાપ તો મેરા,

ચાહી ચરણ ગ્રહું હું તોરા રી-સુણો ॥

૧ ઈન્દ્ર, ૨ સેવક,

તુજ સંગમથી સુખ પાચે,
 જાણે ગંગા-જલમાં ન્હાયે રી-સુણો ॥૩॥
 ૩અળગા ૪અરિ ૫વંછિત હોશી,
 સાહિબ ! જો સનમુખ જોશી રી-સુણો ॥૪॥
 પ્રભુ મિલવા જે મન કરશે,
 થઈ એકમનો ધ્યાન ધરશે રી-સુણો ॥૪॥
 નેહ-નજરે નાથ ! નિહાળી,
 સુજ ટાળો મોહ જંજાળી રી-સુણો ॥૫॥
 કહે જીવણ જિન ચિત્ત ધારી,
 ભણ્યે ભવિ મુકિત તૈયારી-સુણો ॥૫॥



(૯૦૨) (૩૮-૧૭) શ્રી કુંથુનાથ-જિન સ્તવન

(હાં રે ! મારે ઠામ ધરમના)

હારે ! જગજીવન અ-નાથનો કહીયે કુંથુનાથ જો,
 નેહડલો નિત્ય નવલો તિણથું કીજીયે રે લો ।
 હારે ! ઓવારણ કાળે તન-મન ધન અતિ સાર જો.
 નરભવ પામી ઉત્તમ લાહો લીજીયે રે લો ॥૧॥
 હારે ! પ્રભુ થયા, થશે, ને છે તસ એક જ રીત જો,
 ૧ગાઠા છે નિરાગી પણ ગુણરાગિયા રે લો ।
 હારે ! પ્રભુ જોઈ ભવિ-પ્રાણી જાણીને મન-ભાવ જો,
 તેહને રે નિજ વાસ દિયે વડલાગિયા રે લો ॥૨॥

૩ આધા, ૪ દુશ્મનો ૫ મન ધાયું. ૧ ખૂબ જ,

હારે ! મધ્યવતી^૧ થઇને હિયડું જે લીએ હાથ જે,
 ઉત્તમ છે જે અનુભવ-રસ તે ચાખિયે રે લો ।
 હારે ! તે રસ પીધાથી જે લહે જીવ સુવાસ જે,
 ૨અ-વિયોગી-સુખ ઓપમ કેહી દાખિયે રે લો ॥૩॥
 હારે ! ૩દુઃખ-આકર તરવા ૪તૃષ્ણા રાખે જેહ જે,
 નેહડલો નિત્ય માંડે જિન નિકલંકથી રે લો ।
 હારે ! ૫અતિ-આતુર થઈ જે સેવે સુર ૬સ-કલંક જે,
 ૭જન-હાસો ૮મન-ધોખો થાયે રંકથી રે લો ॥૪॥
 હારે ! ચતુર નર તેહને કહિયે કલિયુગમાંહી જે,
 સાચા રે શિવગામી સાહિબ ઓળખે રે લો ।
 હારે ! કવિ જીવવિજયનો જીવણ કહે કર જોડી જે,
 તરશે તે જિનરાજ હૃદય મેં જે રખે રે લો ॥૫॥



(૯૦૩) (૩૮-૧૮) શ્રી અરનાથ જિન સ્તવન

(બંધ સમય ચિત્ત ચેતિયે)

રહો મન-મંદિર માહરે, દાસ કરે અરદાસ-વાલમજી ।
 વશ નાવો ૧કિણુ વાંકથી, નાણોજી તેહ નિવાસ-વાં રહો ॥૧॥
 ૨દૂષણુ ૩દાખીને દીજીયે, ૪શિક્ષા ૫સાર-મોલ-વાં ।
 તહત્તિ કરું હું તારકા ૧, તો લહું વંછિત મોલ-વાં રહો ॥૨॥

૨ શાશ્વત, ૩ દુઃખનો સાગર, ૪ ઉત્કંઠા, ૫ ખૂબ લાગણીથી,
 ૬ દોષવાળા લૌકિક દેવો, ૭ લોકોમાં મરકરી, ૮ ખોટો દિલાસો.
 ૧ કયા ગુનહાથી, ૨ જૂલ, ૩ ખતાવી, ૪ શીખામણ, ૫ માટે,

નિ-સનેહી ગુણ તાહરો, જાણું છું જગદીશ !-વા૦ ।
 છોડીશ કિમ પ્રભુ-છાંયડી, વિણ દીધા^૭વિસવાવીસ-વાંરહોના૩૥
 કલ્પતરુ જે ઠર ચડયો, બાઉલ દે કોણ બાથ !-વા૦ ।
 પામર નર કેમ પૂજિયે, ઓળખી શ્રી જગનાથ-વાંરહોના૪૥
 એવલ ઉપમ અરનાથની અવરાં કુણ જણુ જાત-વા૦ ।
 જીવણુ જિન-ગુણ ગાવતાં,
 હોશ્યે ૧^૦ગુણનિધિ ૧^૧જાત-વાંરહોના ૫૥



(૯૦૪) (૩૮-૧૯) શ્રી મલ્લિનાથ-જિન સ્તવન

(સુણ જિનવર શેત્રુંજી ધણી જી)

મલ્લિ જિનેસર !^૧ મો થકી જી, કરશે અંતર કેમ ? ।

પુરૂષ પિત્તળીયા પરિહરી જી, હૈડે ધર્યો તું ઝહમ-

-વાલમજી ! વિનવું છું જિનરાજ ૥૧૥

^૪લાયક-^૫પાયક-^૬અંતરોજી, રાખે નહિ પ્રભુ રેખ ।

ગુણ ઇત્યાદિક બહુ ગ્રહ્યાજી, તિણમેં મીન ન મેખ-વા૦ ૥૨૥

કરી કરુણા^૭ મો ઉપરેજી, દો દિલ દેવ ! દયાલ ।

ખાસી ખિજમત માહરી જી, સુજરો લીજે અમ્યાલ (વા૦ ૥૩૥

જલ અંજલિ દરિયો દીયેજી, ઓછો કેતો તે હોય ? ।

અવધારી નય એહમાંજી, સેવક-સનમુખ જોય-વા૦ ૥૪૥

૬ આપત્તિનિશ્રા ૭ ચોક્કસ, ૮ હાથે=પાસે મલ્યો, ૯ ઉત્તમ, ૧૦

સુંદર=પવિત્ર, ૧૧ શરીર.

૧ મારાથી, ૨ હલકા, ૩ સોના જેવા ઉત્તમ, ૪ શ્રેષ્ઠ, ૫ હલકા,

૬ ભેદભાવ. ૭ મારા ૮ મયા-દયાના લાંડાર, ૯ વાત.

નીલ-વરણ તનુ નાથનુંજ, મોહ્યા સુર-નર-વૃંદ ।
જીવણ જિન હેતથી હવેજ, ચડત કલા જિમ ચંદ-વાં ॥૫૧॥



(૯૦૫) (૩૮-૨૦) શ્રી મુનિસુવ્રતસ્વામી-જિન સ્તવન

(જિનજી ! ત્રેવીસમો જિનપાસ; આશ મુજ પૂરવે રે લો)
જિનજી ! મુનિસુવ્રતશું માંડી, મેં તો પ્રીતડી રે લો-
-મારા સુ-ગુણ સનેહી લો ।

જિનજી ! તું સુરતરુની છાંય,
ન છાંડું હું ઘડી રે લો-માં ॥૧॥

જિં ! શ્રી પદ્મા-સુત નંદન, શ્રી સુમિત્રનો રે લો-માં ।

જિં ! દીપે વરતનુ શ્યામ, કલાશું વિચિત્રનો રે લો-માં ॥૨॥

જિં ! આરતડી મુજ અલગી ગઈ, તુજ નામથી રે લો-માં ।

જિં ! વિનતડી સફળી કરી, લીજે,
રમન-ધામથી રે લો-માં ॥૩॥

જિં ! ક્ષણ-ક્ષણમેં તુજ આશા, પાસ ન છોડશું રે લો-માં ।

જિં ! ઉવારુ પરિ-પરિ વધતો નેહ,
સુરંગો જોડશું રે લો-માં ॥૪॥

જિં ! વિસાર્યા કિમ બહાલા, તું મુજ વિસરે રે લો-માં ।

જિં ! તાહરે સેવક કંઈ,
પણ મુજ તું શિરે રે લો-માં ॥૫॥

જિં ! સિદ્ધિ-વધૂની ચાહ, કરી મેં તો પરે રે લો-માં

૧ અરતિ-કુઃખ, ૨ મનના ઉંડાણમાંથી, ૩ સારા, ૪ ધણીરિત,
૫ પ્રયત્નથી,

જિં ! દીજે તેહી જ દેવ, !

કૃપા કરી મોં પરે રે લો-માં ॥૬॥

જિં ! તારે એ કિરતાર, પ્રભુને જે સ્તવે રે લો-માં ।

જિં ! જીવણિજય પય-સેવક,

જીવણુ વિનવે રે લો-માં ॥૭॥



(૯૦૬) (૩૮-૨૧) શ્રી નમિનાથ-જિન સ્તવન

(નાણુ નમો પદ સાતમે)

નમિ-જિનના નિત્ય નામથી, સદા ઘર સફળ ^૧વિહાણુ-મેરેલાલ ।

અણુજાણી આવી મીલે,

મનવાંછિત લીલ મંડાણુ-મેરેં નમિં ॥૧॥

^૨તૃષ્ણા તુજ મળવા તણી, દિનમાં હોય દશ વાર-મેરેં ।

મન દેઈ મળો જે પ્રભુ,

તો સફળ ગણું સંસાર-મેરેં નમિં ॥૨॥

અંતરગત આલોચતાં, ^૩સુર તુજ સમ અવર ન હોય-મેરેં ।

જેહના જે મનમાં વસ્યો,

તેહને પ્રભુ તેહિ જ હોય-મેરેં નમિં ॥૩॥

^૪પોયણી પાણીમાં વહે, નલોપરિ ચંદ્ર નિવાસ-મેરેં ।

એકમના રહે અહોનિશે,

જાણો મુજ તિમ જિન પાસ-મેરેં નમિં ॥૪॥

હેમવરણુ હરખે ઘણે, લવિયણુ મન મોહનગાર-મેરેં ॥

કહે જીવણુ કવિ જીવનો,

હુંકૃત હઃખ દૂર નિવાર-મેરેં નમિં ॥૫॥



૧ પ્રભાત=દિવસ, ૨ ઉત્કટ ઇચ્છા, ૩ દેવ, ૪ ચંદ્રવિકાશીકમળ,

(૯૦૭) (૩૮-૨૨) શ્રી નેમિનાથ-જિન સ્તવન
(પ્રથમ જિનેસર પૂજવા સૈયર મોરી)

સુખકર સાહિબ શામળો.

જિનજી મારો ! નાહ સુરંગો નેમ હો ।
૧ કામિત-કલ્પતરુ સમો, જિં રાજિમતી કહે એમ-હો-
-કામણુગારા કંતજી !

મનમોહન ગુણવંતજી ! જિનજી મારા !

એક-રસો રથ વાળ હો ॥૧॥

૨ ત્રેવડ સુજ તજવા તણી જિં હુંતી જો શિવ હુંથ હો ।
૩ અ-બલા યજાલ ઉવેખવા-જિનં ।

શી કરી એવડી પધૂંસ હો-કામણું ॥૨॥

ઉંડું કાં ન આલોચિયું ? જિં સગપણુ કરતાં સ્વામી હો ।
પાણી પી ઘર પૂછ્યું જિં કાંઈ ન આવે તે કામ હો-કામણું ॥૩॥

ઓલંભે આવે નહીં-જિનં રાજુલ ઘર ભરતાર હો ।

વાલિમ વંદન મન કરી-જિનં ।

જઈ ચડો ગઢ ગિરનાર હો-કામણું ॥૪॥

શિવપુર ગઈ સંજમ ઘરી-જિનં અનુપમ સુખરસ પીધ હો ।

જીવણુ-જિન-સ્તવના થકી-જિનં ।

સમકિત ઉજ્જવલ કીધ હો-કામણું ॥૫॥

૧ ઇંટ વરતુ માટે કલ્પવૃક્ષ જેવો, ૨ અંદરની વિચારણા, ૩ નિર્બલ,
૪ ભોળી એવી આલિકાઓને, ૫ ફટાટોપ તૈયારી,



(૯૦૮) (૩૮-૨૩) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન

(મોહ મહોપતિ મહેલ મેં બેઠે)

મન મોહન મેરે પ્રાણથી ખ્યારે ।

પાસજી પરમ નિધાન-લલના ।

પૂરવ-પુણ્યે દરિશન પાયો, આયો અબ જસ વાન,

બલિહારી બાઉં જિથુંદની હોં ॥૧॥

વામા-નંદન પાપ-નિકંદન, અશ્વસેન કુલચંદ-લલના ।

બાકી મૂરતિ-સૂરતિ દેખી, મોહ્યા સુર-નર-વૃંદ-બલિં ॥૨॥

ત્રીન જીવન કે આપ હૈ ઠાકુર, ચાકર હૈ સબ લોક-લલના ।

નીલવરણ તનુ આપ બિરાજે, છાજે ગત-લય-શોક-બલિં ॥૩॥

કમઠાસુરકો મદ પ્રભુ ગાળ્યો, ટાલ્યો કોપકો કોટ-લલના ।

અતિ અધિકાઈ આપકી દીસે,

નિજ કમ-શિરે દીની ચોટ-બલિં ॥૪॥

ધનઘાતી પશુ દૂર નિવારી, લહી કેવલ થયા સિદ્ધ-લલના ।

જીવજી કહે જિન-પાસ-પસાયે,

અનુભવ-રસ-ઘટ પીધ,-બલિં ॥૫॥



(૯૦૯) (૩૮-૨૪) શ્રી મહાવીર સ્વામી જિન સ્તવન

(પરમાતમ પૂરણ કલા)

^૧વધતી વેલી મહાવીરથી, માહરે હવે થઈ મંગલમાલ કે ।

દિન-દિન દોલત દીપતી, ^૨અળગી ટળી હો બહુ આળ-જંજળકે

વીર-જિથુંદ જગ વાલહોં ॥૧॥

૧ ચદતી કલાએ, ૨ દૂર,

તારક ત્રિશલા-નંદનો, મુજ મળિયો હો મોટે સૌભાગ્ય કે ।

૩કોડી ગમે વિધિ કેળવી,

તુજ સેવીશ હો ૪લાયક પાય પલાગ્ય કે-વીરનાર ॥૨॥

તાહરે જે તેહ માહરે, હેજે કરી હો વર-વાંછિત એહ કે ।

દીજે દેવ ! દયા કરી,

તુજ સંપત્તિ હો મુજ ૬વલ્લભ તેહ કે-વીર ॥૩॥

સૂતાં સાહેબ સાંભરે, યેઠાં પણ હો દિન મેં બહુ વાર કે ।

સેવકને ન વિસરજે, વિનતડી હો પ્રભુ ! એ અવધાર કે-વીર ॥૪॥

સિદ્ધારથ-સુત વિનંયો કર, જોડી હો મદ-મચ્છર છોડકે ।

કહે જીવણુ કવિ જીવનો,

તુજ તૂઠે હો મુખ-સંપત્તિ કેડ કે-વીર ॥૫॥



કળશ

(રાગ ધનાશ્રી; ગાયો ગાયો રે)

ગાયા ગાયા રે, મેં તો જિન-ગુણ રંગે ગાયા ।

અવિનાશી પ્રભુ ! ૬ઓળગ કરતાં,

આનંદ અંગ ઉપાયા રે-મેં ॥૧॥

ધ્યાન ધરીને જિન ચોવીશે, જેહ નરે નિત્ય ધ્યાયા ।

૭પરગટ પંચમગતિના ઠાકુર,

તે થયા તેજ સવાયા રે-મેં ॥૨॥

૧ ધણા ૨ ઉપાયો ૩ શ્રેષ્ઠ ૪ ચરણો એ લાગીને, ૫ પસંદ ૬ સેવા,

૭ સાક્ષાત્,

આ-ભવ પરભવ વળીય લવોભવ, અનંત અનંત જિનરાયા ।
અનંત લીલામેં જે જઈ વસિયા,

તે માહરે મન લાયા રે-મેં ॥૩૭॥

૧ મુનિ શશિ-શંકર-લોચન-પર્વત વર્ષ સોહાયા ।

ભાઠો માસની વદિ આઘા ગુરે,

પૂર્ણ મંગલ વરતાયા રે-મેં ॥૪૦॥

રાણુકપુર મેં રહીય ચોમાસું, જગ જસ પડક વળયા ।

દિન દિન ચડત કલા થઈ જાણો,

હૃદય-કમલ જિન ધ્યાયા રે મેં ॥૪૧॥

ભવ-દુઃખ-વારક સકલ ભટ્ટારક, શ્રી હીરવિજય-સૂરિરાયા;

તસ શિષ્ય શુભવિજય પયસેવક,

જયવિજય જસ લાયા રે-મેં ॥૪૨॥

શિષ્ય સુખંકર નિત્યવિજય બુધ, જીવવિજય સુપસાયા ।

જીવણવિજયે જિન ચોવીસે ગાતાં નવનિધિ પાયા રે, મેં ॥૪૩॥



શ્રી વર્ધમાનસ્વામિને નમઃ
શ્રી દાનવિજયજી કૃત
સ્તવન-ચોવીસી

(૯૧૦) (૩૯-૧) શ્રી આદિનાથ-જિન સ્તવન
(એક દિન પુંડરીક ગણધર રે લાલ)

મંગલવેલી વધારવા રે લાલ,
જે જિનવર ^૧જલધાર-ખલિહારી રે ।
મુજને તે ભાગ્યે મળ્યો રે લાલ,
આદીશ્વર આધાર-ખલિહારી રે-
એ ત્રિભુવન-જન-તારણો રે-લાલ
જગ-બંધવ જિનરાય-ખલિં એં ॥૧॥
^૨ભાણુ આજ ઉગ્યો ભલો રે-લાલ,
સફળ થયું ^૩સુ-વિહાણુ-ખલિહારી રે ।
આજ દિવસ વળ્યો આપણો રે-લાલ,
ભેટ્યો ત્રિભુવન-ભાણુ-ખલિં એં ॥૨॥
આજ સહી મુજ આંગણે રે-લાલ,
સફલ ફળ્યો સહકાર-ખલિહારી રે ।
મુંહ-માગ્યા પાસા ઢળ્યા રે-લાલ,
જગ વરત્યો જયકાર-ખલિં એં ॥૩॥

૧ મેઘ ૨ સૂર્ય, ૩ આરં પ્રભાત,

વૂઠો ઘરે ૪વારુ-પરે રે-લાલ,

મેતિયડાનો મેહ-ખલિહારી રે ।

ચિંતામણિ હાથે ચડયું રે-લાલ,

ગંગા આવી ગેહ-ખલિં એં ॥૪૮॥

આજ ઉદધિ જિમ ઉલટયો રે-લાલ,

હુંડે હર્ષ-પ્રવાહ-ખલિહારી રે ।

દીનવિજય પ્રભુ દેખતાં રે લાલ,

ફર ગયો ૫દુઃખદાહ-ખલિં એં ॥૫૦॥



(૯૧૧) (૩૯-૨) શ્રી અજિતનાથ-જિન સ્તવન
(ચોપઈ; ભોમપલાશ)

અજિતનાથ જગનાયક ! આજ,

મહીયલ છો મોટા મહારાજ ।

૧કહિયે છીયે ઈમ જાણી કાજ,

લાલચવાળાને શી લાજ ? ॥૧॥

ખરો ખજનો તાહરો ૨ખીસે,

દેતા પણ તોટો નવિ દીસે ।

આવી ઉભો તિણુ કારણુ ૩ઓસીસે,

મુંહ૪-ફાડી સાહિબ ! ૫માંગીશે, ॥૨॥

૪ સારી રીતે, ૫ દુઃખનો તાપ,

૧ ઈમ જાણી કાજ કરિયે છીએ—આ રીતે અન્વય જાણવો.

૨ અખૂટ, ૩ નજીક, ૪ મ્હોં પહોળું કરી=ખુલ્લા દિલથી, ૫ માંગણી કરીશ,

આજ લગે રાખી કંઈકતારી,

મિરુઆ છો પણ નવિ ગણકારી ।

વાત હવે ચિત્ત એમ વિચારી,

બાલ્યા વિણ કુણુ ખોલે ખારી ? ॥૩૧॥

સેવક ને મન બાણો સારો,

આપી નિજ-ગુણ પાર ઉતારો ।

તુજ સમ ને કેા ખીલે તારો,

૭લહિયે તો ગહિયે તસ ૮તારો ॥૪૧॥

૯પાલવ વળગા જેહ પરાણે,

તે કેમ છોડે છેડો તાણ્યો ? ।

દાન(વજય પ્રભુ ને દિલ આણે,

પહોંચે તો સવિ વાત પ્રમાણે ॥૫૧॥



(૯૧૨) (૩૯-૩) શ્રી સંભવનાથ-જિન સ્તવન
(માહરો મુજરો લ્યો ને નાથ)

સંભવ ! ભવ-હુઃખ-વારણ તારણ, સુખકારણ તું સાચો ।

૧તોશું નેહ કીયો મેં તેહવો, જેહવો હીરો ૨બચો,

પ્રભુજી ! નેહ બન્યો તુમ સાથ, નિરવહવો તુમ હાથે ॥૧॥

પર-વાદી-વચને પણ તુમશુ, નેહ ન ટલે તિલ માત ।

લાંબ્યો પણ હીરો કિમ લાંબે ?

સહી ૩સખલ ૪ધણુધાત-પ્રભુ ॥૨॥

૬ એક રસવાળી પ્રીત, ૭ મળે, ૮ છેડો, ૯ આપણી કેડે,

૧ તારી સાથે, ૨ જાણ્યો, ૩ જોરદાર ૪ ધણુના પ્રહારથી,

સાચા સાજન સોના-સરીખા, પાય વખત પ્રમાણ ।
 લોક-વચન મન આણી છોડે, સૂધો તે અ-જાણુ-પ્રભુ ॥૩૧॥
 અંતર-મન મળિયો જિન-સાથે, ગુણ દેખીને પગાડો ।
 આતમ-હિતકર તે કિમ તજિયે ?,
 કહો ૧ ઉન્હો કોઈ ૭ ટાડો-પ્રભુ ॥૪૧॥
 નિખિડ-નેહ જે જિનવર સાથે, તે સમકિત કહેવાય ।
 દાનવિજય-પ્રભુ-ચરણ-પસાયે.

નિત નિત મંગળ થાય, -પ્રભુ ॥૫૧॥



(૯૧૩) (૩૯-૪) શ્રી અભિનંદન-જિન સ્તવન

(અક્ષયપદ વરવા ભણી સુણો સંતાજી)

અભિનંદન જિનરાયની-ભવિ પ્રાણી રે,
 વાણી વિવિધ-વિલાસ-સુણો ગુણકારી રે ।
 સાકરથી પણ સો-ગુણી-ભવિ, જેહમાંહી મીઠાશ-સુણો ॥૧॥
 ઇન્દ્રાદિક પણ સાંભળી-ભવિ, હોવે ૧ તલ્લય-લીન-સુણો ॥
 અમૃતને પણ અવગણે-ભવિ, જાણી ૨ એહથી ૩ હીણુ-સુણો ॥૨॥
 પોતે રાગવતી છતાં-ભાવ, રાગ-નિવારણકાર-સુણો ॥
 કૌપ-દાવાનલ ટાળવા-ભવિ, ૪ નવ-જલધરની ધાર-સુણો ॥૩॥
 ભવિજનના મન રંજતી-ભવિ, ભજતી વિષય-વિકાર-સુણો ॥
 ગંગ-પ્રવાહ જ્યું ગાજતી-ભવિ,

૫ ખૂબ, ૬ બિંચું, ૭ નીચું, ૮ ગાઢ

૧ એકાગ્ર, ૨ પ્રભુ-વાણીથી, ૩ ઉતરતી, ૪ નવા મેઘની,

છાજતી અતિહી-^૫શ્રીકાર-સુણો ॥૪॥

તે વાણી મુજ મન વસી-ભવિં, ^૬સકલ-કુશલ-તરુ-મૂલ સુણો ।

દાનવિજયને એ પ્રભુ-ભવિં,

અહુ-નિશ છે અનુકૂલ-સુણો ॥૫॥



(૬૧૪) (૩૯-૫) શ્રી સુમતિનાથ-જિન સ્તવન

(સ્વામી ! તુમે કાંઈ કામણુ કીધું)

સુમતિ-જિનેસર ! જગ-પરમેસર,

હું ^૧ખિજમત-કારક તુજ કિંકર ।

સાહિબા ! મુજ દરશન દીજે,

જીવના ! ^૨મન-મહેર કરીજે, સાં ॥

રાત-દિવસ લીને તુમ ધ્યાને,

દિન ^૩અતિવાહુ પ્રભુ-ગુણગાને-સાં ॥૧॥

જગત-હિતકર અંતરજામી,

પ્રાણુ થકી અધિકો મુજ સ્વામી ।

૪પ્રાણુ ! ભમ્યો બહુ ભવ-ભવ માંહી,

પ્રભુ સેવા ઈણુ-ભવ વિણુ નાહી-સાં ॥૨॥

ઈણુ-ભવમાં પણ આજ તું બીઠો,

તિણુ કારણુ તું પ્રાણુથી મીઠો ।

૫ શોભાવાલી, ૬ બધા શુભ સંયોગરૂપ વૃક્ષના મૂળ જેવી,

૧ સેવા કરનારો, ૨ અંતરની-દયા, ૩ વીતાવું છું, ૪ હે મારા

પ્રાણુતુલ્ય સ્વામી !

પ્રાણ થકી જે અધિકો પ્યારો.

તે ઉપર સહુ તન-ધન ઓવારો-સાં ॥૩૥

અજ્ઞાની અજ્ઞાની-સંઘાતે,

એહવી પ્રીત કરે છે પધાતે ।

દેખો દીપક-કાજ પતંગ,

પ્રાણ તજે હોમી નિજ ગાતે-સાં ॥૪૥

જ્ઞાન-સહિત પ્રભુ જ્ઞાની-સાથે,

તેહવી પ્રીત ચડે ને હાથે ।

તો પૂરણ થાયે મન આશ,

દાન વિજય કરે એ અરદાસ-સાં ॥૫૥

★

(૯૧૫) (૩૬-૬) શ્રી પદ્મપ્રભ-જિન સ્તવન

(આતમ ભક્તિ મળ્યા કેઈ દેવા)

પદ્મપ્રભ-જિનરાયની પ્રભુતા, પેણું તો મુજ વાઘે રખ્યાર ।

રચણ કનક ને રૂપા કેરા,

ઉન્નત ત્રણ ગઠ અતિહી ઉદાર-પદ્મ ॥૧૥

વિચ-માંહી મણિપીઠ વિરાજે, તાજે અશોક તિહાં તરુરાય ।

વિપુલ-પત્ર-ફૂલ-ફૂલ-વિભૂષિત,

છાજે એક-જોજન જસ છાંય-પદ્મ ॥૨૥

સોવનમય મણિમંડિત સુંદર,

ચિહું દિશિ તસ સિંહાસન ચાર ।

૫ જોરથી, અગર રૂઢિ મુજબ અણસમજથી

૧ ઐશ્વર્ય, ૨ રાગ,

ચઉવિહ ધર્મ કહે ઝચઉ-વદને,

જિન બેસી તિહાં જગદ્ધાર-પદ્મ ॥૩૧॥

૪ગહિરી એક ભોજન લગે ગાળે, જિનવાણી બળે જલધાર ।

સહુ નિજ-નિજ-ભાષામય સમજે,

બેઠી તિહાં જે પરવદ બાર-પદ્મ ॥૩૨॥

ધન્ય દિન તે ! તેહજ વેળા ધન્ય !

દેખશું જબ ઇણુ-વિધિ દેહાર ।

દાન કહે ગણશું તે દિનને,

સઘલા ભવમાંહી ૫શ્રીકાર-પદ્મ ॥૩૩॥



(૮૧૬) (૩૬-૭) શ્રી સુપાર્શ્વનાથ-જિન સ્તવન

(સંજમ રંગ લાગ્યો)

શ્રી સુપાસ-જિનરાય ૭ હો, અરજ સુણો મુજ એહ,

સાહિબ ! ગુણ-દરિયા

પ્રગટયો પૂરવ-પુણ્યથી હો,

તુમ શું ૧નિબિડ-સનેહ-સાહિબ ॥૧॥

તિણે તું અહનિશિ દલ વસે હો,

જિમ ૨ક-જમાંહી સુવાસ-સા ॥

દિન-દિન મુજને તેહથી હો,

અધિક વધે ઉલ્લાસ-સાહિબ ॥૨॥

૩સુરલિત નિંબાદિક હુએ હો, અંદન-પવન-પ્રસંગ-સા ॥

૩ ચારમુખથી, ૪ ગંભીર ૫ શ્રેષ્ઠ

૧ ગાદ. ૨ કમલમાં. ૩ મુગંધવાળા,

થાયે તિમ તુમ-ધ્યાનથી હો,

મુજ પ્રભુ-શુભુ-૪આસંગ-સાં ॥૩૩॥

ખીર મિલે જવ નીરને હો, તવ કરે આપ-સમાન-સાં ।

તિમ હું થાઈશ તુજ-સમેા હો,

તુજ-ધ્યાને ભગવાન !-સાં ॥૩૪॥

ચણાચરની ચાકરી હો, કરતાં દારિદ્ર્ય જાય-સાં ।

દાનવિજય પ્રભુ-ધ્યાનથી હો,

મન-વંછિત-સુખ થાય-સાં ॥૩૫॥



(૯૧૭) (૩૯-૮) શ્રી ચંદ્રપ્રભ-જિન સ્તવન

(વીર જિજ્ઞાસુ જગત ઉપકારી)

ચંદ્રપ્રભ—પ્રભુને કિમ દીજે ?

ચંદ્ર તણું ઉપમાન રે ।

જિનવર-^૧શશધર વિવરી^૨ જોતાં.

શુભુ-અધિક ભગવાન રે, -ચંદ્રં ॥૧॥

ચંદ્ર કલંકી પ્રભુ-તનુમાંહી, કોય કલંક ન હીસે રે ।

નિશિ-વાસર જિનરાજ ઓસ-તેજો,

^૪શશી નિસ્તેજો દિવસે રે-ચંદ્ર ॥૨॥

સૂરજ-મંડલ માંહી મિલે જળ,

તવ પદ્મ-છતો શશી થાયે ।

૪ સુદદરાગ

૧ ચંદ્ર, ૨ ખુલાસાવાર, ૩ તેજસ્વી ૪ ચંદ્ર, ૫ દેખાય નહી તેવો

તે સૂરજ પણ પ્રભુને આગે,

ખજૂઆ જેમ જણાયે રે-ચંદ્રં ॥૩૭॥

દ્રવ્ય-અંધાર હરે ફરજનિ-કર,

તે પણ ૭ અંતર-પાખે ।

જિનવર ભાવ-અંધાર નિવારે,

રતિ-માત્ર નવિ રાખે રે,-ચંદ્રં ॥૪૦॥

જગમાં ચંદ્ર-અસંખ્ય જિનેશ્વર,

એક એ છે ઉપગારી રે ।

ઘાન કહે સેવે ૮ તિણે પ્રભુને

લંછન-મિથે શશધારી રે-ચંદ્રં ॥૪૧॥



(૯૧૮) (૩૯-૯) શ્રી સુવિધિનાથ-જિન સ્તવન

(જ હો ! વિમલ-જિનેશ્વર સુંદર)

જ હો ! સુવિધિ-જિનેશ્વર સારીખો,

સખી ! નહિં બીજો જગમાંહિ ।

જ હો ! વિવિધ-પ્રકારે વિદોકતાં,

સખી ! નજરે આવ્યો નાંહિ ।

જિનેશ્વર ! તું ત્રિભુવન-શિરદાર ।

જ હો ! જિમ ૧ વારિધિ રચણે ભર્યો,

સખી ! તિમ તું શુભલંકાર-જિને ॥૧॥

૬ ચંદ્ર, ૭ અંતરવાળા પખવાડીએ, એટલે વારા ફરતી પખવાડીએ

૮ તે કારણથી ૧ સમુદ્ર.

જી હો ! સુર હરિ-હર-પ્રમુખ બહુ,
સખી ! છે જગમાંહી જિણુંદ ।

જી હો ! પશુ તેહ-તુઝમાં આંતરુ
સખી ! સરસવ-મેરુગિરીંદ-જિનેં ॥૨॥

જી હો ! લક્ષણ-હીન ને લાલચી, સખી ! પલપલ જે પલટાય ।

જી હો ! એહવા સુર શું કીજિયે ?
સખી ! એકો અરથ ન થાય-જિનેં ॥૩॥

જી હો ! નિરલોભી શુણસાયરૂ,
સખી ! અ-વિચલ એક સ્વભાવ ।

જી હો ! પર-ઉપગારી તું સહી,
સખી ! તરણ-તારણ^૨ લવપાથ-જિનેં ॥૪॥

જી હો ! તુજ છાંડી કુણુ અવરની,
સખી ! ખાંદ્ય ગહે ! ખુદ્દિહીન ।

જી હો ! તુજ ચરણાંખુજ ભમર જયું,
સખી ! દાનવિજય લયલીન. જિનેં ॥૫॥



(૯૧૯) (૩૯-૧૦) શ્રી શીતલનાથજિન સ્તવન
(અજિત જિણુંદશું પ્રીતડી)

શીતલ-જિનની સાદ્યખી, સાંભળતાં હો ! સહુને સુખ થાય કે ।
વૃક્ષ અશોક વિરાજતો,

શિર ઉપરે હો ! જસ શીતલ છાંય કે-

૨ સંસારરૂપ સમુદ્ર

સાહિબ એહવા સેવિયે,

જસ સોહો હો ! પ્રાતિહાર જ આઠ કે-સાં ॥૧॥

ફૂલ-^૧પગર ઢીંચણુ લગે, બહુ પરિમલ હો ! મધુકર અંકાર કે ।
દિવ્ય-દ્વનિ તિમ ઢીપતી,

એક યોજન હો ! જેહનો વિસ્તાર કે-સાં ॥૨॥

ઉજ્જવલ ^૨અમર-નદી જિસ્યાં,

ચિહું પાસે હો ! ચઉ આમર ઢલંત કે ।

કનક ઘડયું રચણુ જડયું,

સિંહાસન હો ! પ્રભુને સોહંત કે-સાં ॥૩॥

શિર પૂંઠે સૂરજ પરે, લામંડલ હો ! ઝળહળ ઝલકંત કે ।

૩અણુવાઈ અંબર તલે,

સુર-હુંડુભિ હો । ૪સખરી વાજંત કે-સાં ॥૪॥

છત્રત્રય શિર-ઉપરે, અતિ ઉજ્જવલ હો ! જસ કાંતિ અપાર કે ।

તે જિનવર મુનિ-દાનને,

આપો ! આપો ! હો ! નિજ પદ અધિકાર કે-સાં ॥૫॥

(૯૨૦) (૩૯-૧૧) શ્રી શ્રેયાંસનાથ-જિન સ્તવન

(ઋષભ જિણુંદા, ઋષભ જિણુંદા)

શ્રી શ્રેયાંસ-જિણેસર સાચો, જગમાંહી એ સુરતર બાચો ।

ભવિ-જનને મન-વંછિત પૂરે,

સચિ સંતાપ નિવારે દૂરે-શ્રીં ॥૧॥

૧ ઢગલા, ૨ ગંગાનદી, ૩ વગાડનાર વગર (આપોઆપ) વાગતી,
૪ સુંદર.

નિજ-છાયાએ ત્રિભુવન છાયો,

કીર્તિ^૧ કુસુમ પરિમલ મહકાયો ।

સુનિવર-^૨મધુકર જેહને પાસે,

રસ-લીના નિશિ-દિવસ રઉપાસે. શ્રી૦ ॥૨॥

ફલની આશા ધરી મનમાંહે, સુર-નરપતિ પણ જેહને ચાહે ।

^૩પ્રાપતિ ^૪પાપે નવિ પામી જે,

કોડી ઉપાય જો પોતે કીજે-શ્રી૦ ॥૩॥

કલિકાલે જસ મહિમ ન ^૫જાંપે, નિરાધાર નવિ વાયે કંપે ।

કળ્પ નહિં બહુવિધ ફળ લહિયે,

તેણે એ અલિનવ-સુરતર કહીયે-શ્રી૦ ॥૪॥

પૂરણ-ભાગ્ય પ્રમાણે પામી, લોકોત્તર સુરતર એ સ્વામી ।

દાન કહે સેવો ધરી નેહ,

જિમ પામે સુખ સકલ અ-છેહ-શ્રી૦ ॥૫॥

(૯૨૧) (૩૯-૧૧) શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન

(બાઈ, કાઠા ગહુંથે પીસાવ-એ દેશી)

હાં જી ! વાસુપૂજ્ય-જિનરાજ, કાજ અછે મુજ ^૧તોહિશું-

-પ્રભુ ! અરજ સુણો ।

હાં જી ! બાંદ્ય-ગ્રહ્યાની લાજ,

જાણી હેત ધરો ^૨મોહિશું-પ્રભુ ॥૧॥

^૧ જમર સેવે, ^૩ જે પ્રભુની પ્રાપ્તિ, ^૪ પિતા, ^૫ જાંપો—ઓછો થાય,

^૧ તમારાથી. ^૨ મારા ઉપરથી,

હાં જી ! ઝાઝો હો ઝચાઝો ચાણી,

અધિકુન્-ઝોણુન્ ૪આખિયે-પ્રભુન્ ।

હાં જી ! કહેવા માંડી જિહાં વાણી.

ઝોછે તિહાં કિમ રાખિયે ?-પ્રભુન્ ॥૨॥

હાં જી ! ઝઘડો ઝઘડા ઠાય, કીધા પપાખે કહો કેમ સરે ?-પ્રભુન્ ।

હાં જી ! માંગ્યા વિણુ પણુ માય,

લોજન નવિ આગે ધરે-પ્રભુન્ ॥૩॥

હાં જી ! જિણુશુન્ અવિહડ નેહ,

ઝઘડો તિણુશુન્ કીજિયે-પ્રભુન્ ।

હાં જી ! સહી આપાઠી મેહ,

૬તાવડે તુરત ન ૭છીજિયે-પ્રભુન્ ॥૪॥

હાં જી ! તું પ્રભુ કરુણાસિન્ધુ,

અવિહડ હેત તો શું સહી-પ્રભુન્ ।

હાં જી ! શિવસુખ ઘો જગખન્ધુ,

દાનવિજયને ગહગહી-પ્રભુન્ ॥૫॥



(૯૨૨) (૩૯-૧૩) શ્રી વિમલનાથ-જન સ્તવન

(મારું મન મોહું રે, શ્રી સિદ્ધાચલે રે)

વિમલ જિનેસર સુણુ ! મુજ વિનતિ રે,

તું ૧નિ-સનેહી આપ ।

૩ ઉલ્લાસ, ૪ કહીએ. ૫ વિના. ૬ તડકાથી ૭ ખસે. ૮ ઉમંગથી
૧ નિરાગી.

હું સ-સનેહી છું પ્રભુ-ઉપરે રે,

ઈમ કિમ થાશે ? મિલાપ-વિમલં ॥૧॥

નિ-સનેહી-જન વશ આવે નહિ રે, કીજે કોડી ઉપાય ।

તાલી એકણુ-હાથે બળવતાં રે,

ઉદમ નિષ્કળ થાય-વિમલં ॥૨॥

રાત-દિવસ રહિયે કર જોડીને રે, ખિજમત કરીએ રે ખાસ ।

તો પણ જે નજરે આણે નહિ રે,

તે શું દેશ્યે ! શાખાશ-વિમલં ॥૩॥

ભગત-વચ્છલ જિન લક્ષિત-પસાયથી રે, ચઢશે કાજ પ્રમાણ ।

ઈમ થિર નિજ મન કરીને જે રહે રે,

લહે ફલ તે ૧નિરવાણુ-વિમલં ॥૪॥

મેં પોતે મન થિર કરી આદર્યો રે, તું પ્રભુ ! દેવ દયાલ ।

આપ-વડાઈ નિજ મન આણીને રે,

દાનવિજય પ્રતિપાલ-વિમલં ॥૫॥



(૯૨૩) (૩૬-૧૪) શ્રી અનંતનાથ-જિન સ્તવન

(ચોપાઈ-કદયાણ)

પ્રભુ ! તુમ નામ છે નાથ અનંત,

તુમ ગુણ પણ છે અ-કલઅનંત ।

છે અનંત-સુખનો તુજ ભોગ,

હુઃખ અનંતનો કર્યો વિચોગ ॥૧॥

વીર્ય^૧ અનંત તુજ પાસે વસે, જ્ઞાન-અનંતે તું ઉલ્લસે ।

તિમ અનંત-દર્શન શ્રીકાર,

આપ અનંત થયા અ-વિકાર ॥૨॥

તું અનંત કર્ણ-જલ-રૂપ, તાહરી જ્યોતિ અનંત-સરૂપ ।

તુજ અનંત વાણી વિસ્તરે, તેહથી ભવિક અનંત તરે ॥૩॥

દ્રવ્ય અનંત તુજને પ્રત્યક્ષ, તિમ અનંત-પર્યાય પણ લક્ષ્ય ।

તું અનંત-લક્ષણનો ગેહ, બળ અનંત પૂરણ તુજ દેહ ॥૪॥

તે માટે સુષુ દેવ અનંત ! તાહરી છે પ્રભુ શક્તિ અનંત ।

સુજને પણ સુખ દેહી અનંત, દાન કહે ધરી હરખ અનંત. ॥૫॥



(૯૨૪) (૩૯-૧૫) શ્રી ધર્મનાથ જિન સ્તવન

(સંભવ જિનવર ! વિનતિ)

ધર્મ-જિનેસર સાહિબા, વિનવિયે ઇષ્ટિ રીતે રે ।

^૧ઈજ્જત અધિક છે માહરી, પ્રભુજ સાથે પ્રીતે રે-ધર્મના ॥૧॥

સમરથ સાહિબ જો લહી, રહીયે એકણ ^૨ઘાટે રે ।

તો સવિ મન-વાંછિત ફલે, હુશમન-હિયડાં ફાટે રે-ધર્મનારા ॥૨॥

સિંહ-ચુકા જો સેવિયે, તો ^૩સહી મોતી લહીયે રે ।

^૪જંબૂક-^૫દર ^૬કર ઘાલતાં,

કહે ! ^૭કેહું ફલ ગહિયે રે-ધર્મના ॥૩॥

સમરથ ^૮સાજન સંપજે, પૂરવ-વખત પ્રમાણે રે ।

૧ પ્રતિષ્ઠા, ૨ નિશ્રાએ, ૩ સાચા, ૪ શિયાળની, ૫ બખોલ
૬ હાથ, ૭ કેવું, ૮ સારા માણસ.

ચિંતામણિ ! દોહિલું હોવે,

જોતાં પણ મણિ-ખાણે રે-ધર્મં ॥૪॥

જગ-ચિંતામણિ ! તું મિલ્યો, સઘળી વાતે ૧૦ સ-નૂરો રે ।
દાનવિજય કહે માહરાં,

મન-વાંછિત સુખ પૂરો રે-ધર્મં ॥૫॥



૯૨૫ (૩૯-૧૬) શ્રી શાંતિનાથ-જિન-સ્તવન

(વામાનંદન જિનવર, મુનિમાંહે વડો રે કે)

શાંતિ-જિનેસર સુખકર, મૂરતિ તાહરી રે-કે મૂરતિ તાહરી,
ઢીઠી મીઠી આજ, અમૃત પરે દુઃખહરી રે કે-અમૃતં ।
નિરખી નિરખી સંતાપ મિટે, સઘળો મને રે કે-મિટેં,
વરસંતાં જલધાર, શમે જિમં દવ વને રે કે-શમેં ॥૧॥
જિમ ગંગા-પરવાહ, ગિરીન્દથી ઉતરે રે કે-ગિરીં,
તિમ સમતારસ અમૃત, જે ચિહું દિશિ ઝરે રે કે-જેં ।
જાતિ તણાં પણ વૈર, જે દેખી તિમ ટલે રે કે-જેં,
વાયે દક્ષિણ વાય, ઊઘનાઘન જિમ ફળે રે કે-ઘનાનારા ॥
રાગ તણું પણ ચિન્હ, ન જેહમાં દેખિયે રે કે-નં,
દ્વેષ તણો તિહાં અંશ, કહો કિમ ? લેખિયે રે કે-કહેં ।
રાગ-દ્વેષ અભાવ, ઋતિણે પશુધ કંઠકળે રે કે-તિં,
વહુનિ-પખે કહો કેમ, ધુંઆડો નીકળે રે કે-ધુંઆં ॥૩॥

૯ મણિની ખાણમાં. ૧૦ સંપૂર્ણ.

૧ દાવાનલ=જંગલનો અગ્નિ, ૨ દક્ષિણ દિશાનો, ૩ મેઘ ધટા ૪ તેથી
૫ સમજી માણસો ૬ અનુમાન કરે ૭ વિના

નિરખે સુર-નર નારી, ફરી ફરી નેહ શું રે-ફરી૦,
 પણ તિલ ભાર વિકાર, ન ઉપજે તેહશું રે-ન૦ ।
 એ લોકોત્તર અતિશય, જોહનો સાંભળ્યો રે કે-જે૦,
 ચિંતવતાં જિન ચિત્ત, મહારસ ઉછળ્યો રે કે-મહા૦ ॥૪॥
 સમતામય ધ્યેય લેય, માનું સહી એ ઘડી રે કે-માનું૦,
 આંખથી મહેલતાં અલગ, સુહાયે ન એક ઘડી રે કે-સુ૦ ।
 અ-કલંકિત પ્રભુ-મૂરતિ, અંદ્ર-કલા જિસી રે કે-અંદ્ર૦,
 દાન વિજય કહે દેખત, મુજ કીકી હસી રે કે-મુજ૦ ॥૫॥



(૯૨૬) (૩૯-૧૭) કુંથુનાથ-જિન સ્તવન

(એ તીરથ તારું)

કુંથુ-જિનેસર પર ઉપગારી, સાહિબ શિવ-સુખકારી રે,
 -પ્રભુશું મન માન્યું ।

મેં તુજ સાથે કરી એકતારી,

કીધો રંગ ૧ કરારી રે-પ્રભુ૦ ॥૧॥

સુપને પણ ન ગમે મુજ દીઠા, દેવ અનેરા ધીઠા રે-પ્રભુ૦ ।

જિણે ચાખ્યા રસ અમૃત મીઠા,

આછણું તાસ અનીઠા રે-પ્રભુ૦ ॥ ૨ ॥

જેહ હંસ માનસ-સર ડનાડે,

તે કિમ છિલ્લર વર ચાહે રે-પ્રભુ૦ ।

ચિંતામણિ હોય જસ કર માંહે,

કાચને કહો ! કિમ ૪ સાહે રે-પ્રભુ૦ ॥ ૩ ॥

૮ લેવા માટે ૧ મળ્યૂત ૨ જાણના ઉપરનું પાણી ૩ રનાન કયું
 ૪ સ્વીકારે

સાચા સાજન જેહ મિલીયા, અંતર-હિત અટકળિયા રે-પ્રભુઁ ।
તે દુરજનથી દૂરે ટળિયા,

લોળપણે નવિ લળિયા રે-પ્રભુઁ ॥૪॥
અલવેસર ! તું અંતરજામી, પરમ-પુરૂષ પ્રભુ પામી રે-પ્રભુઁ ।
ખિજમતમાં નવિ કરશું ખામી,

દાન કહે શિર નામી રે-પ્રભુઁ ॥ ૫ ॥



(૯૨૭) (૩૯-૧૮) શ્રી અરનાથ-જિન સ્તવન.

(મુનિસુવ્રત કીજે મયા રે)

૧ અલવેસર અવધારિયેજી, જગ-તારણ જિન-લાણુ ।

ચાહું છું તુજ ચાકરીજી, પણ ન મલે રઅહિનાણુ-
-પ્રભુજી ? છે મુજ તુજશું રે પ્રીતિ,

જયું ઘન-ચાતક-રીતિ-પ્રભુજી ॥૧॥

દુશ્મન કમં એ માહરાંજી, ન તજે કેડ લગાર ।

આઠેને આપ-આપણેજી, અવર-અવર અધિકાર-પ્રભુજી ॥૨॥

ઘેરી રહે મુજને ઘણુંજી, ન મિલે મિલણુ ઉપાય ।

જીવ ઉદ્ધાસ રહે સદાજી, કળ ન પડે તિણે કયાંય-પ્રભુજી ॥૩॥

શિર ઉપરે તુમ સારીખોજી, જો છે પ્રભુ ! જિનરાય ।

તો કરશું મન ચિંતવ્યુંજી, દેઈ દુશ્મન-શિર પાય-પ્રભુજી ॥૪॥

સન્મુખ થઈ મુજ સાહિબજી, દુશ્મન દૂર નિવાર ।

દાનવિજયની વિનતિજી, અર-જિનવર ! અવધાર-પ્રભુજી ૦૫



(૯૨૮) (૩૯-૧૯) શ્રી મલ્લિનાથ-જિન સ્તવન

(સાંભળજો મુનિ સંજમ રાગે)

પામ્યો અવસર એહ પિછાણો, મનમાં આલસ વમાણો રે ।

સાહિબ મળિયો છે રસપરાણો,

ટાળ્યાનો નહિ ટાણો રે-પામ્યો ૦ ॥૧॥

સેવો જિનવર શિવ-સુખદાઈ, પરિહરી આશ પરાઈ રે ।

અવસર ભૂલે જે કેઅલસાઈ,

ચૂકી તસ ચતુરાઈ રે-પામ્યો ૦ ॥૨॥

લેખે ઉદમ તો સવિ લાગે, અવસર ને હોય આગે રે ।

માળી તરુ સીંચે મન-રાગે,

લહી ઋતુને દેલ લાગે રે-પામ્યો ૦ ॥૩॥

માનવલવ પામીને મોટો, ખિણુ-ખિણુ મ કરો ખોટો રે ।

અશુભ-કરમનો કાઠો ઓટો,

તો ભાંજે સવિ તોટો રે-પામ્યો ૦ ॥૪॥

જિનવર મદહી જયો જયકારી, ઝનખરી વાત નિવારી રે ।

દાનવિજય પ્રભુ છે દાતારી,

સંપત્તિ આપે સારી રે-પામ્યો ૦ ॥૫॥

૧ મ આણો, ૨ ચનાશૌલિથા પરસ્પર સંધિ કરી જણાય છે,

૨ હોશિયાર, ૩ આળસ કરી, ૪ અશુભ

(૯૨૯) (૩૯-૨૦) શ્રી મુનિસુવ્રત-જિન સ્તવન

(દુઃખ દોહન દૂરે ટળ્યા રે)

શ્રી મુનિસુવ્રત-સાહિબા રે, તુજ વિષ્ણુ અવર હો ! દેવ ।
નજરે દીઠા નવિ ગમે રે, તો કિમ કરિયે સેવ ?

-જિનેસર ! મુજને તુજ આધાર,

-નામ તુમારું સાંભરે રે, સાસમાંહી સો વાર-જિનેસર૦ ॥૧૧॥
નિરખ્યા સુર નજરે ઘણા રે; તેહશું ન મિલે તાર ।

તારોતાર મિલ્યા પખે રે, કહો કિમ વાધે પ્યાર !-જિનેસર૦ ॥૨૧॥
અંતર-મન મિળિયા વિના રે, ન ચઢે પ્રીતિ પ્રમાણ ।

પાયા વિષ્ણુ કિમ સ્થિર રહે ? રે,

મોટા ઘર મંડાણુ-જિનેસર૦ ॥૩૧॥

જેતાં મૂરતિ જેહની રે. ઉલ્લસે નજર ન આપ ।

તેહવાશું જે પ્રીતડી રે, તે સામે સંતાપ-જિનેસર૦ ॥૪૧॥

તેણે હરિ-હર સુર પરિહરી રે, મન ધરી તાહરી સેવ ।

દાનવિજય તુમ દરિશને રે,

હરખિત છે નિત્યમેવ-જિનેસર૦ ॥૫૧॥

(૯૩૦) (૩૯-૨૧) શ્રી નમિનાથ-જિન સ્તવન

(શ્રી સિદ્ધપદ આરાધીએ)

શ્રી નમિ-જિનવર ^૧પ્રાહુણા રે,

આવો મુજ મન-જેહ રે-ગુણરાગી ।

જો રહેખો તિહાં ઓગળ્યતા રે,

તો રહેજો ધરી નેહ રે-ગુણ૦ ॥૧૧॥

૧ મહેમાન, ૨ લાગે, ૩ કીક,

ધર્મધ્યાન-જલ છાંટીને રે, મન-ધર કીધ અમૂલ રે-ગુણ૦ ।
તિહાં વિધવિધનાં પાથર્યા રે,

સુકૃત-મનોરથ ફૂલ રે-ગુણ૦ ॥૨૧॥

તિહાં સમતા-શય્યા ભલી રે, ખિમા-તળાઈ વિશાલ રે-ગુણ૦
ધૂપ સરસ તિહાં મહમહે રે, પ્રભુ-ગુણ-ગાન રસાલ રે-ગુણ૦ ॥૩૧॥
ખાંધ્યો તિહાં યથિર-બંધને રે, હરખ-અંદુઓ હેજ રે-ગુણ૦ ।
સદા ૫ અ-કંપ સોહામણો રે, દીપક જ્ઞાન સ-તેજ રે-ગુણ૦ ॥૪૧॥
એક ક્ષણ પણ આવીને રે, જો પ્રભુ ! દ્યો વિસરામ રે-ગુણ૦ ।
તો એ મહેનત માહરી રે, સઘળી હોય ૬ સ-કામ રે-ગુણ૦ ॥૫૧॥
પણ પ્રભુ-વશ છે આવવું રે, મુજ-વશ છે અરદાસ રે-ગુણ૦ ।
હાથી તો હાથે ગ્રહ્યા રે, કિમ આવે આવાસ રે ?-ગુણ૦ ॥૬૧॥
સેવક જાણી સાહિબે રે, સહી રાખ્યું સનમાન રે-ગુણ૦ ।
દાનવિજય દિલ આવિયા રે, અધિક વધાર્યો વાન રે-ગુણ૦ ॥૭૧॥

★

(૯૩૧) (૩૯-૨૨) શ્રી નેમિનાથ-જિન સ્તવન

(અનંતવીરજ અરિહંત ! મુણે મુજ વિનતિ)

એહ અથિર સંસાર-સ્વરૂપ અછે ધસ્યો,

ક્ષણ પલટાએ રંગ ૧ પતંગ તણો જિસ્યો !

ખાજીગરની ખાજી જેમ જૂઠી સહી,

તિમ સંસારની માયા એ સાચી નહીં. ॥૧॥

ગગને જિમ ૨ હરિ-ચાપ પલક એક પેખિયે ।

ખિણુમાંહે ૩ વિસરાલ થાયે નાંવ દેખિયે ।

૪ મજબુત, ૫ સ્થિર, ૬ સફળ. ૧ હલદર, ૨ ઈન્દ્ર-ધનુષ્ય, ૩ વિખરાળ

તિમ એહ યૌવન-રૂપ સકલ ચંચલ અછે,
ચટકો છે દિન ચાર ૪વિરંગ હુએ પછે ॥૨॥

જિમ કૌઠક નર રાજ્ય લહે સુપના વિષે,
હય-હાથી-મઢ-મંદિર દેખી ઉલ્લસે ।

જળ જાગે તવ આપ રહે તિમ એકલો,
તેહવો ઋદ્ધિનો ગારવ તિલ પથુ નહિ ભલો ॥૩॥

દેખીતાં કિંપાક-તણાં ફલ પકૂટરાં,
ખાતાં સરસ સવાહ અંતે જીવિતહરાં ।

તિમ તરૂણી-તનુભોગ તુરત સુખ ઉપજે,
આખર તાસ વિપાક કટુક રસ નિપજે. ॥૪॥

એ સંસાર શિવા-મુત એહવો ઝોળખી,
રાજ રમણી ઋદ્ધિ છોડી થયા પોતે ફરિખી ।

કર્મ ખપાવી આપ ગયા શિવ-મંદિરે,
દાનવિજય પ્રભુ-નામથી ભવ-સાગર તરે. ॥૫॥



(૯૩૨) (૩૯-૨૩) શ્રી પાર્શ્વનાથ-જિન સ્તવન
(દેશી ગિંહુંચડાની)

સકલ-કુચલ-તરૂ પોષવા રે,
હાંજી ! જે જિનવર જલધર કહેવાય-સુખકારી ।

મન-વંછિત-સુખ પૂરવા રે,
હાંજી ! સુરતરૂ-સમ જેહનો મહિમાય-સુખ ॥૧॥

૪ વિકૃત, ૫ સુંદર, ૬ ઋષિ=મુનિ=સંયમી

જગશુરુ જિનરાજ-સુખં ભવ-જલધિ જહાજ-સુખં,
 દીઠો મેં આજ-સુખં, ક્રિયાં સવિ કાજ-સુખં ।
 સ-જલ જલદ જિન સોહતી રે,
 હાંજી ! નિરુપમ નીલવરણ જસ કાય-સુખં ।
 શિર પર સૌદામિની-સમી રે,
 હાંજી ! ક્ષિ-મણિ-કિરણ ઝલકો ઝલકાય-સુખં ॥૨॥
 ગરૂડ તણે ગરજા-રવે રે,
 હાંજી ! જિમ પન્નગ-કુલ પ્રબલ પલાય-સુખં ।
 તિમ પ્રભુ-નામ-પસાયથી રે,
 હાંજી ! સંકટ-વિકટ સકલ મિટ જાય-સુખં ॥૩॥
 કમલાકરમાંહી કમલડાં રે,
 હાંજી ! જિમ વિકસે દેખી દિનરાય-સુખં ।
 તિમ મુજ હિયડું હેજશું રે,
 હાંજી ! હરખી હસે નીરખી પ્રભુ-પાય-સુખં ॥૪॥
 વામા-નંદન વાલહો રે,
 હાંજી ! જગદાનંદન જિનવર રાય-સુખં ।
 દાનવિજય સુખિયો સદા રે,
 હાંજી ! પામી પાસ-ચરણ-સુપસાય-સુખં ॥૫॥



(૯૩૩) (૩૯-૨૪) શ્રી મહાવીર-જિન સ્તવન
(જાત્રા નવાણું કરિયે-સહુણા)

શાસન-નાયક સુંદરુ રે,

વર્ધમાન જિનરાય-સકલ સુખ-સાયરૂ ।

જસ નામે નિત્ય નવનવા રે, મંદિર મંગલ થાય-સકલ ॥૧॥

રંગ મજ્જના સારીખો રે, જેહશું ધર્મસનેહ-સકલ ॥

અહનિશ દિલમાંહી વસે રે, જિમ મોરા મન મેહ-સકલ ॥૨॥

રાતી પ્રભુ ગુણુ-રાગશું રે, માહરી સાતે ઘાત-સકલ ॥

વિધ-વિધ ભાંતે વખાણીએ રે, જેહનો જશ અવદાત-સકલ ॥૩॥

તે જિનવર ચોવીસમો રે, ગુણુગણુ-રચણુનિધાન-સકલ ॥

મુજ ભવ-ભાવઠં ભાંજિયે રે,

ભગત-વચ્છલ ભગવાન !-સકલ ॥૪॥

સાહુખ ગુણુ-રંગે કરી રે, જે રાતા નિશદિશ-સકલ ॥

તસ દર રંગ-વધામણું રે,


દિન-દિન અધિક જગીશ-સકલ ॥૫॥

શ્રી તપગચ્છ-શિરોમણિ રે, શ્રી વિજયરાજ સુરીન્દ-સકલ ॥

તાસ શિષ્યે એમ વિનવ્યા રે, ચોવીસમા જિનચન્દ-સકલ ॥૬॥

વર્તમાન-શાસનધણી એ, સુખ-સંપત્તિ-દાતાર-સકલ ॥

સકલ મનોરથ પૂરવો રે, દાનવિજય જયકાર-સકલ ॥૭॥



શ્રી વર્દ્ધમાન સ્વામિને નમઃ
શ્રી મેઘવિજયજી મં૦ કૃત
સ્તવન-ચૌવિશી
(અપૂર્ણ)

(૯૩૪) (૪૦-૧) શ્રી ઋષભદેવ-જિન સ્તવન
(શ્રી સુપાસ જિનરાજ એ દેશી)

શ્રી જિન જગ-આધાર, મરૂદેવી-માત-મલ્હાર^૧,
આજ હો ! સ્વામી રે, ઋષભ-જિનેશ્વર સેવીયેજી ॥૧॥
શત્રુજય-ગિરિ-છત્ર, નાલિ-નરેસર-પુત્ર,
આજ હો ! જીપે રે જગદીસર તેજે^૨ લાણુનેજી^૩ ॥૨॥
આયો હું પ્રભુ-પાસ, સેવક ઘો શાળાશ,
આજ હો આશા રે, સાહિબ વિષ્ણુ કેહની દાસનેજી ? ॥૩॥
મન માને અરદાસ, માને મોટિમ જસ,
આજ હો તેહ રે, મન મોહે નયન^૪ પસાઉલેજી ॥૪॥
નામ ધરી જે નાથ, હો સહુનાં દિલ હાથ,
આજ હો નેહી રે, સ્થિતિ એહી મોટા મેઘનીજી ॥૫॥



૧ પુત્ર ૨ પોતાની કાંતિથી ૩ સૂર્યને ૪ પ્રસન્ન થાય છે.

(૯૩૫) (૪૦-૨) શ્રી અજિતનાથ-જિન સ્તવન
(સંખેશ્વર સાહિબ સાચો એ-દેશી)

જયકારી અજિત-જિનેશ, મોહન મન-મહેલ-પ્રદેશ,
પાવન કરીએ પરમેશરે, સાહિબજી ! છેરે સોભાગી ॥૧॥
સાહિબજી ! છે રે સોભાગી, તુજ સુરતિશું રતિ જાગી,
મુજ એક-રસે લય લાગી રે-સાહિબજી ॥ ૨ ॥

જિનપતિ ! અતિશય^૧-ઇતખારે, દેવ ! સેવક રહું દરખારે,
અવસર^૨ શિર કયું ન ચિંતા રે-સાહિબજી ॥ ૩ ॥

ગુણવંતા ગરવ ન કીજે, હેતાલશું હેત ધરી જે,
પોતાવટ^૩ પેરે પાળીજે રે-સાહિબજી ॥ ૪ ॥

તુમ બેઠા કૃતારથ હોઈ, સેવકનું કામ ન હોઈ,
તો પણ ન હુએ તુજ કાંઈ રે-સાહિબજી ॥ ૫ ॥

સાહિબને ચાહીને જોવે, સેવક-જન નિજ શિર ઠોવે,
મેઘની સરસાઈ હોવે રે, સાહિબજી ॥ ૬ ॥



(૯૩૬) (૪૦-૩) શ્રી સંભવનાથ-જિન સ્તવન
(અજીત જિણ્દશું પ્રીતડી-એ-દેશી)

ભવતારણ સંભવ પ્રભુ ! નિત નમીએ હો !

નવ નવ ધરી ભાવ કે,

નવ-રસ નાટક નાચીએ, વળી રાચીએ હો !

પૂજા કરી ચાવ કે-સેના-નંદન વંદીએ ॥ ૧ ॥

૧ વિશ્વાસે ૨ આ અવસરે તમારે માથે કેમ ચિંતા નથી ? (ત્રીજી ગાથાની બીજી લીટીનો અર્થ) ૩ પોતાના માણસ

હુઃખ-ઢોહગ ફરે કરે, ઉપગારી હો ! મહી મહિમાવંત કે ।
ભગવંત ભક્ત-વચ્છલ લલો, સાંઈ દીઠે હો !

તન-મન વિકસંત કે-સેના૦ ॥ ૨ ॥
અપરાધી તેં ઉદ્ધર્યા, હવે કરીએ હો ! તેહની કેહી કેહી વાત કે ।
મુજ વેળા આળસ ધરે, કિમ વિણસી હો !

જિનજી ? તુમ' ઘાત કે-સેના૦ ॥ ૩ ॥
ઊભા ઓળગ કીજીએ, વલી લીજીએ હો ! નિત પ્રત્યે તુમ નામ કે ।
તો પણ મુજરો નવિ લીએ, કેતા દિન હો !

ઈમ રહે મન ઠામ ? કે-સેના૦ ॥ ૪ ॥
ઈમ જાણીને કીજીએ, જગ-ઠાકર હો ! ચાકર પ્રતિપાળ કે ।
તું હુઃખ-તાપને ટાળવા, જ્યવંતો હો !

પ્રભુ ! મેઘ વિશાળ કે-સેના૦ ॥ ૫ ॥



(૮૩૭) (૪૦-૪) શ્રી અભિનંદનજિન સ્તવન
(સિદ્ધારથ રાય કુળ તિલો એ-એ દેશી)

અભિનંદન-જિન વંદના એ, કરીએ ધરીય ઉચ્છાહ તો ।
ઘર સવિ સંપદ સંપન્ને એ, વર મંગલ-વિવાહ તો-અભિ૦ ॥ ૧ ॥
પુરુષોત્તમ પરમેસર એ, રસ-કળ સ્વરૂપ અનંત તો ।
મોહ-તિમિર-મહ મોડવા એ,

ઉઠ્યો રવિ ઉદ્ભસંત તો-અભિ૦ ॥ ૨ ॥
રસ-સનેહા સવિ દેવતા એ, તુ નિઃ-સનેહી નાહ તો ।
તો પણ સેવકને કરે એ, દિલ દેઈ નિરવાહ તો, -અભિ૦ ॥ ૩ ॥

૧ ઉમંગ-ભિર્મિ ૨ કલાસહિત-સંપૂર્ણ-સુંદર, ૩ રાગવાળા,

ગુણવંતા આદર કરે એ, સવિ ૧નિ-ગુણા પણુ સ્વામ તો ।
નિ-ગુણાને પણુ ગુણુ કરે એ.

એ જગ પ્રભુ અભિરામ તો-અભિં ॥૪॥

સુતાં સુપને સાહિબો એ, આવે અતિશયવંત તો ।
તો જાણું જગતનો ધણી એ, રાખે મહેર મહંત તો-અભિં ॥૫॥
શ્રી જિનવર-પદ-પંકજે એ, ભમર પરે રમે જેહ તો ।
મેઘ તણી પરે મહિઅલે એ, જગ વલ્લભ હુએ તેહતો-અભિં ॥૬॥



(૯૩૮) (૪૦-૫) શ્રી સુમતિનાથ-જિન સ્તવન

(કુંથુ જિનેશ્વર જાણજો રે લોલ એ દેશી)

સુમતિ-જિનેશ્વર સાહિબો હો ! લાલ,
સમરૂં હું નિશદ્દિશરે-જિણુંદરાય ।
ચકવો જિમ રવિ-ખિંબને હો લાલ,
સેવક પ્રભુ બગસીસ રે-જિંસું ॥ ૧ ॥
તુજ જસ-રસ-રસીયા જિકે હો ! લાલ,
રતિસીયા દરીસણુ-ઠાજ રે-જિં ।
ઉલ્લસ્યા તુજ ગુણુ-ગીત-શું હો ? લાલ,
તે વસીયા શિવરાજ રે-જિંસું ॥ ૨ ॥
ગયણું-ગણુ તારા પરે હો ! લાલ,
તુમ ગુણુ-ગણુણુ અ-સંખ રે-જિં ।

૧ ગુણુ વગરના ૨ ઉત્કંઠાવાળા ૩ પ્રખળ-વિશાળ

લોકાલોક ન લંઘીએ હો ! લાલ,

જો હોય પરગલ પાંખ રે-જિંસું ॥ ૩ ॥

તો પણ તુમ ગુણ-ખોલથી હો ! લાલ,

પાવન કીજે જીહરે-જિં ૧

દરીસણ કીજે દેવનું હો લાલ,

ધન ધન તે મુજ દીહ રે-જિં સું ॥ ૪ ॥

પતિત-પાવન તુંહી જ પ્રભુ ! હો લાલ,

મેં દીઠો મહારાજ રે-જિં ૧

મેઘવિજય જયવંતની હો ! લાલ,

લોક વધારે લાજ રે-જિંસું ॥ ૫ ॥



(૯૩૯) (૪૦-૬) શ્રી પદ્મપ્રભ-જિન સ્તવન

(શ્રી નમિ જિનવર સેવ ઘનાઘન ઉનમ્યો રે

ઘનાઘન ઉનમ્યો એ દેશી)

પદ્મપ્રભ-ભગવંત મહંત હૈયે રમ્યો રે-મહંત હૈયે રમ્યો, ૧

જ્ઞાન-નિધાન આનંદ-અમીરસમય જન્યો રે-અમીં ૧

અવર દેવતા-સેવ-સ્વભાવ ૧સહી રવમ્યો રે-સ્વં ૧

કલિયો^૩ ખલીયો મોહ, મહા-રિપુને દમ્યો રે-મહાં ॥ ૨ ॥

લક્ષિત-રાગનો લાગ, જિનેસર શું કરે રે ૧-જિં ૧

તે નરવંછિત-ભોગ-સંભોગ લીલા વરે રે-સં ૧

મહિમાદિક સ્તવિ સિદ્ધિ, પ્રસિદ્ધિ સુવિસ્તરે રે-પ્રં ૧

અ-પરંપાર સંસાર-મહોદધિ નિસ્તરે રે-મહાં ॥ ૨ ॥

૧ ખરેખર ૨ દૂર કર્યો ૩ કળવાળો

દીઠે જિન-દેહાર, ઉદાર દિશા જગી રે-ઉં ।
 મલીયો ઝમીનતિ પયોગ કે, વિનતિ સવિ લગી રે-વિં ।
 પવિત્ર કરું તન એહ, સનેહશું ઓળગી રે-સં ।
 થાયે રવામી-પ્રસાદથી, સિદ્ધિ-વધૂ સગી રે-સિં ॥ ૩ ॥
 તુજ નામે આરામ હુએ મન માહરે રે-હું ।
 પામું સુખ-સંજોગ, સુણ્યે જસ તાહરે-સું ।
 તું મુજ જીવન-પ્રાણ કે, આણુ વહું સહીરે-આં ।
 રહું સદા લયલીન, હજુ રે ગહગહી રે-હું ॥ ૪ ॥
 જસ કરી જે આશ કે, તાસ વેસાસશું રે-તાં ।
 વાધે રંગ-તરંગ કે, મન આસાસશું રે-મં ।
 મેઘ-મહોદય દેખ, મયૂર-વિલાસશું રે-મં ।
 ખેલે તેમ પ્રભુ-પાસ કે, દાસ ઉદ્ધાસશું રે-દાં ॥ ૫ ॥



(૯૪૦) (૪૦-૭) શ્રી સુપાર્શ્વનાથ-જિન સ્તવન
 [સુણ સુગુણ સનેહી રે સાહિબા-એ દેશી)

પ્રભુ-વદન વિરાજે રે કમલ જયું, નયણાં તિહાં વિકસિત પત્ર રે ।
 વલી શ્યામ ^૧ભમુહ ભમરા બન્યા,

^૨અધર-છવી પદલવ તત્ર રે-૥૧॥

જિનરાજ સુપાસજી ! જગ જ્યો,

મોહરો મન-મોહનકર મંત્ર રે ।

વર-સિદ્ધિ-વધૂ વશ આણવા,

ઈણે ધરીયું ધ્યાનનું તંત્ર રે-જિં ॥૨॥

૪ ઘણી માનતા-પ્રાર્થનાથી ૫ સંયોગ ૧ ભૂકુટી ૨ હોઠ,

કરે-દેવ-દાનવ-માનવ-પતિ, શિર અંજલિ જોડી સેવ રે ।

પરિવારે કમલાકર જિસ્સ્યા,

નવ-રંગ ભરે નિતમેવ રે-જિં ॥૩૩॥

જય-કમલા-કેલિ કરે ઘણું, જન-કમલા કોઈ ન થાય રે ।

દેવ-દુઃકલિના રવ ગડગડે,

જિન-સમવસરણુ જિહાં થાય રે-જિં ॥૩૪॥

ઇમ ત્રિભુવન-પ્રભુતા લોગવે, બેસી ત્રિગટે સ્વામી સ્વરૂપ રે ।

લણે ભવિયણુ એ ભગવંતને,

જોગીસર જોગ અનૂપ રે-જિં ॥૩૫॥

૧ધૂર ધર્મચક્રે રવિ ઝળહળે, ખળભળે કુમતિ-વિકાર રે ।

સહી વરસે ગંગોદક તણે,

નવ-મેઘ તિહાં તેણી વાર રે-જિં ॥૩૬॥



(૯૪૧) (૪૦-૮) શ્રી ચંદ્રપ્રભ—જિન સ્તવન

(ઋષભ જિનેસર પ્રીતમ માહરો રે-એ દેશી)

ચાંદલીયા ! સંદેશે કહે મારા સ્વામીને રે, વંદન વારંવાર ।

શ્રી ચંદ્રપ્રભ-ચરણે તું વસે રે.

મુજ મન-તાપ નિવાર-ચાં ॥૧॥

હર દેશાંતર દેવ ! તુમે વસો રે, કારજ સવિ તુમ હાથ ।

સાથ ન કોઈ તેહવો સાંપડે રે,

નયન મિલાવે નાથ-ચાં ॥૨॥

તુમ ગુણ સુણતાં મુજ મનડું ઠરે રે, નવલો જાગે નેહ ।
સાસોસાસ-^૧સમા તુમ સાંભરે રે,

માન માને નિઃસંદેહ-ચાં ॥૩૭॥

મુગતિ-^૨માનિની મોહન ! મોહિયારે, આનંદમય અવતાર ।
વાત ન પૂછો સેવકની કઠારે,

એ કુણુ ? તુમ આચાર-ચાં ॥૪૦॥

ચતુર ને ચિંતા ચિત્તની શું કહું રે, તુમ છો જગના જાણુ ।
આપ-સ્વરૂપ પ્રકાશો આપશું રે, મહીયલ મેઘ-પ્રમાણુ-ચાં ॥૪૧॥



(૯૪૨) (૪૦-૬) શ્રી સુવિધિનાથ-જિન સ્તવન

(અનંતવીરજ અરિહંત ! સુણો મુજ વિનતિ-એ દેશી)
વિધિશું સુવિધિ-જિનેશને વંદવા ઉમદ્યા,

મન મેરા જિનનાથ ! ગુણે કરી ગહગદ્યા ।

અપરાધીના વાંક તુમે સવિ ^૧સાસદ્યા,

ધંણુ વાતે એક આંક જગત શિર સદ્યા ॥૧॥

તેં સમતા સંતોષ દયા ગુણ સંગ્રહ્યા,

માયા મમતા દોષ સવે તે નિગ્રહ્યા ।

રઘ્યાન-અનલ-ખલયોગથી ધંધણુ પરે દહ્યા,

શુકલ-ધ્યાન-જલ ડથાક કે પંક સવે વહ્યા ॥૨॥

તે ખાવીશ પરિસહ સાહસધર સદ્યા,

તું મુજ મન વિશ્વાસ ચરણુ તુમ મેં ગ્રહ્યા ।

^૧ સાથે, ^૨ જી

^૧ ખૂબ ખંખ્યા, ^૨ ધ્યાનરૂપ અગ્નિના પ્રખળ યોગથી, ^૩ પામીને,

ઉગમતે જિમ લાણુ પંખીજન ચહયહ્યા,
 તિમ તુમ દીઠે નૂર ભવિ સહુ સામહ્યા, ॥૩૧॥
 ભાગ્ય-ઉદયથી આજ ભલા પ્રભુ એ લહ્યા,
 અંગ અડયો બહુ રંગ અમી-રસ પરિવહ્યા ।
 ઉપગારી જિનરાજ સમા જગ કુણુ કહ્યા,
 તપ-જપ હીણુ તે પણુ તે જન નિરવહ્યા ॥૪૧॥
 મુજ મન-કમલે નિત્ય હંસા પરે તુમ રહ્યા,
 જસ પરિમલ તુજ સ્વામી સદા જગ મહમહ્યા ।
 તારક ! પાર ઉતાર મેં પાયક તુજ અહ્યા,
 કરો સરસ રસ-રેલ કે મેઘ જ્યું ઉન્નહ્યા ॥૫૧॥

(૬૪૩) (૪૦-૧૦) શ્રી શીતલનાથ-જિન સ્તવન
 (ધરમ જિનેસર ગાઉ રંગશુ-એ દેશી)
 શીતલ શીતલ ઉપશમ આદરે,
 દશમે જિણુંદ દયાલ-શુભંકર ।
 ભવ-ભય-ભંજન રંજન જન તણો,
 મુનિ-મન-કમલ-^૧મરાલ-જયંકર-
 નંદા-નંદન દેવ જિનેસર ॥૧॥
 જિમ જિમ કીજે દરિસણુ જિન તણો,
 તિમ તિમ તેજ પ્રસાર-શુભંકર ।
 રએક-તારીશું જે પ્રભુ ડોળાજે,
 અધિકો તસ અધિકાર-જયંકર-નંદા ॥૨॥

૧ રાજહંસ, ૨ એક ધ્યાનથી, ૩ સેવે,

જે તુજ ચરણે શરણે આવીયા, તેહને કીધ પસાય-શુભંકર ।
આપસમે વડ દિલ દેઈ ઘણી,

થાપ્યા ત્રિભુવનરાય-જયંકર-નંદાં ॥૩૭॥

તુજ દરબારે રેખ ઈસી પડે, કીજે રંકને રાજ-શુભંકર ।
સાચું સાહિબ બિરૂદ વહે સહી,

નાથ ગરીબ-નિવાજ-જયંકર-નંદાં ॥૪૦॥

અંતર-હુશ્મન દૂર કરી સહુ,

આપો અરિહંત ! સિદ્ધિ-શુભંકર ।

મેઘ-મહોદધિ મોટા રાજવી,

તુઠા હુએ નવ નિધિ-જયંકર-નંદાં ॥૪૫॥



(૯૪૪) (૪૦-૧૧) શ્રી શ્રેયાંસનાથ-જિન સ્તવનં

[સાહેબા હે કુંથુ જિનેસર દેવ-એ દેશ્વર]

નાયકજી હો ! શ્રી શ્રેયાંસ-જિણુંદ કે,

ભગતે હું તુમ ભોળીયોજી ।

નાયકજી હો ! સવિ સંસારી વાત,

વિસારી હુએ । ૧ પોળીયોજી ॥૧૧॥

નાયકજી હો ! દેવ અવર સહુ છાંડી,

માયા ધરી તુમ ઉપરેજી ।

નાયકજી હો ! સુજસ સુણ્યો છે અખંડ,

અપરાધી પણ ઉદ્ધરેજી ॥૨૧॥

૧ દ્વારપાલ=તમારો ચોકીદાર=તુજસેવક,

નાયકજી હો ! મુજ અવગુણ છે અનેક,

તો પણ તે મન મત ધરોજી ।

નાયકજી હો ! વહીએ રાજ વિવેક, ગતિ પડતાં ઉદ્ધરોજી ॥૩॥

નાયકજી હો ! દાખે નહિ જગ-દોષ,

રાખે લાજ રદ્યા તાણીજી ।

નાયકજી હો ! રઆખે આપણો ઓપ.

મહેર કરે મોટા ઘણીજી ॥૪॥

નાયકજી હો ! શું કહીએ બહુવેલ,

મેલ મિલાવો મન તણોજી ।

નાયકજી હો ! મેઘ મહા રસપૂર,

ઉપજે આનંદ અતિ ઘણોજી ॥૫॥



(૯૪૫) (૪૦-૧૨) શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન

(સંજય રંગ લાગ્યા-એ દેશી)

વાસુપૂજ્ય જિન વંદીએ,

ભાવ ધરી ભગવંત રે-જિનપતિ જશધારી ।

દીઠો દેવ દયાળ તે, નયણાં ૧ હજે હસંત રે-જિન૦ ॥૧॥

હરિ-હર ૨જેણે વશ કર્યા, ઇન્દ્રાદિક જસ દાસ રે-જિન૦ ।

તે મન્મથનો મદ હર્યો, તેં પ્રભુ ! કીધો ઉદાસ રે-જિન૦ ॥૨॥

૩મયણ ૪મયણ-પરે ગાળીયો,

૫ધ્યાન-અનળ-બળ દેખ રે-જિન૦ ।

૨ બતાવે. ૩ પ્રસન્નતા ૧ ઉમંગથી, ૨ જેણે-મન્મથ=કામદેવે,
૩ કામદેવ, ૪ મીણની જેમ. ૫ ધ્યાનરૂપઅગ્નિનું બળ,

કામિની-કેમળ-વયલ્લુ શું,

ચૂક્યો નહિ ફરાઈ-રેખ રે-જિનં ॥૩૩॥

નાથ-દરિસણ-ચરણ તણે, જે ભંડાર જથવંત રે-જિનં ॥

આપ તરી પર તારવા, તું અ-વિચળ બળવંત રે-જિનં ॥૩૪॥

મન મેરો તુમ ઉપાંખલી, રસીયો કરે દિન-રાત રે-જિનં ॥

સરસ-મેઘને વરસવે રે, નાચે મોર વિખ્યાત રે-જિનં ॥૩૫॥



(૯૪૬) (૪૦-૧૩) શ્રી વિમલનાથ-જિન સ્તવન

(કુખ દોહણ દૂરે ટળ્યાં રે-એ દેશી)

વિમલ-જિનેસર વાંદવા રે, જાગે રાગ વિશે ॥

જેહને નર-તિરિ સહુ નમે રે, વૈર-વિરોધ ઉવેખ-

-જગતગુરૂ ! કર અમને ઉપગાર ॥

તુમે ^૧કરૂણા-રસ-ભૂંગાર-જગતગુરૂ

તુમે સિદ્ધિ-વધૂ-^૨શૃંગાર-જગતં ॥૧॥

નામ અનેક જિણુંદનાં, રે ષણુ પરિણામે એક ॥

ઉધારાધર જળ ^૪એક-સારે, ^૫વૂઠે ફામ-^૭વિવેક-જગતં ॥૨॥

નામ-થાપના-દ્રવ્ય શું રે, તું તારે બહુ લોક ॥

ભાવે ભગતિ સહુ કરે રે, જાણે લોકાલોક-જગતં ॥૩॥

૬ રાઈ જેટલી પણ રેખા=મર્યાદા. ૭ આસપાસ ૮ સારા, ૯ વરસવાથી.

૧ કરૂણા૩૫ રસના કળશસમા, ૨ શૃણુગાર=શોભા વધારનાર, ૩ મેઘ

૪ એક સરખા, ૫ વરસ્યા પછી, ૬ જુદા જુદા સ્થાનના આધારે,

૭ ભેદવાળું,

કામધેનુ ચિંતામણિ રે, નાથ ન આવે જોડ ।
 છીલ્લર-સર કહો કિમ કરે રે, ખીર-સમુદ્રની હોડ ?-જગત ૦૧૪॥
 મોટાના પગ તુસવે રે, લઘુ પથ મોટાં-નામ ।
 મેઘ સમુદ્ર-રસ મેલશું રે, પામે ? ઇન્દ્રનું ઠામ-જગત ૦૧૫॥



(૯૪૭) (૪૦-૧૪) શ્રી અનંતનાથ-જિન સ્તવન

(તુમે બહુ મૈત્રી રે સાહિબા-એ દેશી)

જ્ઞાન અનંત અનંતનું, દરિશન ચરણ અનંત ।

સ-રસ કુસુમ વરસે ઘણાં, સમવસરણ સુહંત-

અતિશય દ્વીસે જિન-નાથના ॥૧॥

નવ-પદ્મવ દેવે રચ્યો, તરૂવર નામ અ-શોક ।

દેઈ પ્રદક્ષિણા દેવને, વાણી સુણે સવિ લોક-અતિ ૦ ॥૩॥

વાણી જોજન-ગામિની, સુર નર ને તિરિયંચ ।

ધ્વનિ મધુરી પ્રતિબુઝવે, કહે સંસાર-પ્રપંચ-અતિ ૦ ॥૩॥

ચિહું કિશિ વર ચામર ઢળે, સુરપતિ સારે છે સેવ ।

મણિમય કનક-સિંહાસને, બેઠા દેવાધિદેવ-અતિ ૦ ॥૪॥

પૂંઠે ભામંડળ ઝળહળે, ગાજે ઢુંડુંભિ ગાજ ।

છત્રત્રયી શિર ઉપરે, મેઘાડંબર સાજ-અતિ ૦ ॥૫॥



૮ કરુણાથી, ૯ દરીયાનું જળ ખાડે છતાં ૧૦ ઉત્તમની સોબતથી
 ૧૧ આખા સંસારને પોષક હોઈ મેઘરાજ કહેવાય છે.

(૯૪૮) (૪૦-૧૫) શ્રી ધર્મનાથ-જિન સ્તવન

(ઋષભ-જિણુંદા ઋષભ જિણુંદા એ-દેશી)

ધરમ-જિનેસર ૧ કેસર-વરણા,

અલવેસરૂ ૨ સરવાંગી-શરણા ।

એ ચિંતામણિ ૩ વાંછિત-કરણા,

ભજ ! ભગવંત ભુવન -ઉદ્ધરણા-ધરમ ॥૧॥

૪ નવલે નૂરે ૫ ચઢતે શૂરે, જે જિન ભેટે ભાગ્ય-અંકૂરે ।

પ્રગટ-પ્રભાવે પુણ્ય ૬ પંદૂરે,

દારિદ્ર્ય-હુઃખ તેહનાં પ્રભુ ચૂરે-ધરમ ॥૨॥

જે સેવે જિન-ચરણ-હજુરે, તાસ ઘરે ભરે ધન ભરપૂરે ।

ગાજે ૭ અંબર ૮ મંગળ-તૂરે,

અરિયણના ભય ભાંજે દૂરે-ધરમ ॥૩॥

ગજ ગાજે શોભિત ૯ સિંધુરે, જન સહુ ગાજે સુ-જસ સપુરે ।

ગંજ્યો જાય ન ૧૦ કિણ્ણહી કરૂ રે,

અરતિ થાય ન કાંઈ ૧૧ આણુ રે-ધરમ ॥૪॥

જિમ ભોજન હોય દાહને કૂરે, છપે તે રણ-તેજે શૂરે ।

મેઘ તણાં જળ નદીય ૧૨ હહુરે,

તિમ તેહને સુર લખમી-પૂરે-ધરમ ॥૫॥



૧ કેસર જેવી કંચનવર્ણી કાયાવાળા, ૨ સર્વ રીતે શરણભૂત,
૩ ઈષ્ટવસ્તુની પૂર્તિ કરવામાં, ૪ નવા ઉમંગથી, ૫ ચઢતા પરિણામે,
૬ નિર્મળ, ૭ આકાશમાં ૮ મંગલવાજિંત્ર, ૯ સિંદૂરથી, ૧૦ કેમે
કરી, ૧૧ જરાપણ, ૧૨ વધ કરી મુકે,

(૯૪૯) (૪૦-૧૬) શ્રી શાંતિનાથ જિન સ્તવન

(સાહિબ ! બાહુ-જિનેસર વિનવું-એ દેશી)

સજની ! શાંત-મહારસ-સાગર, સેવો શાંતિજિણુંદ હો ! ।

સં આશ પૂરે સવિ દાસની,

વિચરે કાંઈ વિદેશ હો !-સં શાંતિં ॥૧॥

સં સમતા શું મમતા ધરી, સંધરી રાખી શાંતિ-હો !

સં એ પ્રભુ-સેવાથી સહી,

ભાવઠે ^૧ભાંજે બ્રાંતિ-હો !-સં શાંતિં ॥૨॥

સં ઈણે ધરવાસે લોગવી, ષટખંડ-ઋદ્ધિ નાથ ! હો !

સં તીર્થ^૨કર--પદ-સંપદા,

લોગવી શિવપુર-સાથ-હો !-સં શાંતિં ॥૩॥

સં દેવ અવર જે આદરે, જે છંડી જિનરાય હો !

સં તે સુરતર-છાયા તણ,

બાઉલીયા દિશિ ધાય હો-સં શાંતિં ॥૪॥

સં ^૨પરિજન ^૩અરિજન બેહુ સમા, સમવળી રંકને રાય હો !

સં પ્રભુ સમતાસ-પૂરીયો,

મેઘ-સમે કહેવાય હો !-સં શાંતિં ॥૫॥



(૯૫૦) (૪૦-૧૭) શ્રી કુંથુનાથ જિન સ્તવન

(સાંભળજો મુનિ સંજમ-રાગે-એ દેશી)

આવો રે મન-મહેલ હમારે, જિમ સુખ-^૧બોલ કહાય રે !

સેવકને અવસર પૂછો, તો વાતે રાત ^૨વિહાય રે-આવો ॥૧॥

^૧ ભવ શ્રમણા, ^૨ પોતાના પરિવારના લોકો, ^૩ દુશ્મનો,

^૧ ધ્વનિ-ધોંધાટ, ^૨ વહી જાય,

અપરાધી ગુણુહીણા ચાકર, ઠાકુર નેહ ઝનિવાળે રે
જો ૪તે અવર નરા દિશિ દોરે,

પ્રભુ ! ઇષ્ટિ વાતે લાળે રે, -આવોં ॥૨૦॥

કુંથુ-જિનેસર-સરખા સાંઈ, પર-ઉપગારી પૂરા રે
ચિત્તવંતા ચાકર નવિ તારે,

તો શ્યા અવર અધુરા ! રે-આવોં ॥૨૧॥

મુજ અનુચરની ૫મા'મ વધારો, તો પ્રભુ ંહેલા પધારો રે !
ઉંચી-નીચી મત અવધારો,

સેવક-જન્મ સુધારો રે-આવોં ॥૨૨॥

શ્રી નામે જનની ધન્ય જિનની, જિણે જન્મ્યો તું જ્ઞાતા રે !
મેઘ તણી પરે મોટા નાયક,

દીજે શિવ-સુખ-શાતા રે-આવોં ॥૨૩॥



(૯૫૧) (૪૦-૧૮) શ્રી અરનાથ-જિન સ્તવન

(સંભવ જિન અવધારીયે,

મહેર કરી મહેરખાન સનેહી-એ દેશી)

શ્રી-અર-જિનવર વિનતિ, કીજે લાગી પાય-પ્રભુજી !

તું પરમેસર સાચલો, મેં પરખ્યો મહારાય-પ્રભુજી શ્રીં ॥૧॥

રાખે રમણી રાગીયા, લાગીયા ૩મનમથ-રંગ-પ્રભુજી !

ઉતારે નહિ અંગથી, ભગત ભણે નિઃકલંક-પ્રભુજી શ્રીં ॥૨॥

૩ ધટ વસ્તુ આપી પ્રસન્ન કરે, ૪ જો તે સેવકો બીજી દિશાએ દોડે,
૫ મહિમા, ૬ કામદેવના;

રીસ-ભરે આયુધ ધરે, કોઈ ક્રોધ વિરૂપ-પ્રભુજી ! ।
 મોહ નટાવે નાચવ્યા, નાચે નટ-સ્વરૂપ-પ્રભુજી શ્રીં ॥૩॥
 તું મન-માંહે ધરે નહિ, મોહ કોહ ને રાગ-પ્રભુજી ! ।
 મૂરતિ નિરંજન દેખતાં, જાગે જળ વૈરાગ-પ્રભુજી શ્રીં ॥૪॥
 ઉપશમવંત હૈયા થકી, તું મત દૂરે થાય-પ્રભુજી ! ।
 વૂઠ્યા મેઘ-પ્રસંગથી, વાયે શીતલ વાય-પ્રભુજી શ્રીં ॥૫॥



(૯૫૨) (૪૦-૧૯) શ્રી મલિનાથ-જિન સ્તવન

(સહીયા ! શત્રુજગઠ ભેટણ ચાલો હો-એ દેશી)

મલિલ-જિનેસર મહિમા-ધારી,
 સોહે સુરતિ અતિશય સારી હે ! ।
 મૂરતિ ભવિયણ મોહનગારી,
 દૂર ન મુકી જાય લગારી હે-મલિલં ॥૧॥
 અરજ સુણીજે એક અમારી, એ મુજ તુજ પર વારી હે ! ।
 જોગી પણ જગે આણ ચલાવે,
 રાજરાણા તુજ ગુણ ગાવે હે-મલિલં ॥૨॥
 જે સહુ ઠામે સમતા રાખે, દેવ પરમપદ તું તલ દાખે હે ! ।
 રાત-દિવસ હું તુજ જસ ગાઉ,
 તો પણ મુજરો કાં ન પાઉ હે-મલિલં ॥૩॥
 તું પોતાનો પરનો ન જાણે, લોક વિવેકી સહુ વખાણે હે ! ।
 એહ સહજ કિમ આવે ટાણે,
 જીમિયે તો જો ભોજન લાણે હે-મલિલં ॥૪॥

નિશુણે। પણ નેહે નિરવહીએ,

સઘલા સુશુણા કિહાંથી લહીએ હે ! ।

જલ-થલ મેઘ સમા સફહીએ,

સાચો સાહિબ ઇચ્છુ ગુણ કહીએ હે-મલ્લિં ॥૫૦॥



(૯૫૩) (૪૦-૨૦) શ્રી મુનિસુવ્રત-જિન સ્તવન
(શ્રી ચંદ્રપ્રભ જિન સાહિબારે૦)

મુનિ સુવ્રત-જિન-રાજીઓ રે,

ગાજીઓ મહિમા અગાધ- ભવિજન લેટો ।

^૧સ-જલ જલદ પરે શામલો રે, જોગીસર-શિરતાજ-ભવિં

લેટો લેટો હો ^૨સુજાણુ-જન લેટો,

ભાવો ઉજવલ-ધરમનું ધ્યાન-ભવિં ॥૧॥

લાખ-ચોરાશી-યોનિમાં રે, ભમતાં વાર અનંત-ભવિં ।

ચિંતામણિ-સમ પામીયો રે, નામી સ્વામી સંત-ભવિં ॥૨॥

મોહ-તણાં બળ ચૂરવારે, સખજો તું ^૩બળ-શૂર-ભવિં ।

ચતુરાઈ શું ચિત્ત વસ્યો રે, પલક ન કીજે દૂર-ભવિં ॥૩॥

આવ્યા જે તુજ-આગળે રે, ^૪પાતકીયા પણ લોક-ભવિં ।

તે પણ સહુ સુખીયા કર્યા રે, પાયા જ્ઞાન-^૫આલોક ભવિં ॥૪॥

ભવ-^૬ભ્રમ ટાળો માહરો રે, આણી કરૂણા-^૭નેઠ-ભવિં ।

તુજ મુજ મેઘ મયૂરનો રે, સગપણ સમરથ ^૮સદ્ ભવિં ॥૫॥



૧ પાણીવાળા મેઘની જેમ, ૨ સમજી લોકો, ૩ પરાક્રમવાળો. ૪ પાપી,
૫ પ્રકાશ, ૬ ભ્રમણ, ૭ સંપૂર્ણ. ૮ શ્રેષ્ઠ,

(૯૫૪) (૪૦-૨૧) શ્રી નમિનાથ જિન સ્તવન

(અખ ભવિકજન જિન પૂજ લે-એ દેશી)

નમિનાથ આથ અનંત તાહરે, નાણુ-દંસણુ ચરણુની ।
ભગવંત ! ભક્તની વાત મનમેં,

ભાવે ભવ-જળ-તરણુની-નમિં ॥૧॥

શુણુવંત સંત જયંત જગમેં, પૂજ પામે દેવતા ।

મેં સર્વ પાયા તેહ તુમથી, પાદ-પંકજ સેવતા-નમિં ॥૨॥

છહ ઋતુ આપે ફૂલ નવ-નવા, ભવિક નવ-નવ ભાવના ।

નવ-નવા ઉપજે દ્રવ્ય-દેશે. કરણુ પ્રભુની સેવના-નમિં ॥૩॥

વિદ્યા-વિવેક-રવિઓધ વૈભવ, ઝચતુર-૪ચામીકર-મણિ ।

જિનરાજ-પૂજ-કાજ વિધિના,

કર્યા જય જય જગ-ધણી-નમિં ॥૪॥

નવ-નવે ભાંતે ખ્યાતિ પામે, લોક તે શુણુ સેવતા !

જગ ઉપર ગરજે દુઃખ વરજે, મેઘ સેવક દેવતા-નમિં ॥૫॥



(૯૫૫) (૪૦-૨૨) શ્રી નમિનાથ-જિન સ્તવન

(દીઠો સુવિધિ-જિણુંદ, સમાધિ રસે ભર્યો હો લાલ. એ દેશી)

રાણુ કરીએ આજ કે-યાદવ-રાણ્યા

હો લાલ કે-યાદવ રાણ્યા,

નાથ ! ૧નિવાજ અવાજના-વાળાં વાણ્યા હો લાલ કે-વાળાં ।

જળપરે જગ સુ-ધ્યાન કે-રાજે રાણ્યા હો લાલ કે-રાજેં,


દીજે મુજ શિર હાથ કે-છત્ર જયું છાણ્યા હો લાલ કે-છત્રના ॥૧॥

૧ સંપત્તિ, ૨ જ્ઞાન, ૩ સારા, ૪ સોનું, ૧ પ્રસન્નતાના સૂરના,

તુમ સોભાગી સ્વામી-રાગી જન ઘણા હો લાલ કે-રાગીં;
 વલી સેવાનો જોગ ન-પામે તુમ તણા હો લાલ કે-પામેં ।
 અવધારો અરદાસ-સદા કુણુ કેહની હો લાલ કે-સદાં,
 રલાવ-તિસિ દીયો સિદ્ધિ કે,

નિશ્ચય-નેહની હો લાલ કે-નિં ॥૨॥

સ્વાસ્થીયાની વાત-ન કો મન સદહે હો લાલ કે-નં,
 પરમાસ્થીયા લોક, તુમે સહુ કો કહે હો લાલ કે-તુમેં ।
 શિવ-સાસ્થીયા જીવ-જગત્રય ધારીયે હો લાલ કે-જગં,
 સહુ સાથે તિમ નાથ-નેહી પણ તારીયે હો લાલ-નેહીં ॥૩॥
 તુમ પ્રસાદ જસવાદ-સવાદ સેવે મલે હો લાલ કે-સવાદં,
 ન હુએ કોઈ અપવાદ-નિવાજ સરસ ભલે હો લાલ કે-નિં ।
 તુકયો જાણી જિજ્ઞાસ કે, ૩ પુઠો ૪ પડિવજ્યો હો લાલ કે-પુઠોં,
 અઠ-સિદ્ધિ લઈ હાથ કે, મહિમા ૫ વજવજ્યો હો લાલ કે-મં ૪
 જીગતે આઠે જામ કે-નામ ન વિસરું હો લાલ કે-નામં,
 ગુણે ૬ તુમહિ જાણી મન-૭ મોટીમ હું ધરું હો લાલ કે-મોં ।
 મયા કરો મહારાજ-નિવાજે ઈશ્વિ પરે હો લાલ કે-નિવાજેં,
 પિયુ-પિયુ સાદે મેઘ, મહીતલ સર ભરે હો લાલ કે-મહીં ॥૫॥



૨ ભાવતૃષાર્પ, ૩ સમજણ સાથે, ૪ સ્વીકાર્યો, ૫ જાળવજો,
 ૬ તમને ૭ મોટાઈ

(૯૫૬) (૪૦-૨૩) શ્રી પાર્શ્વનાથ-જિન સ્તવન

(તે મુનિવર જગ વંદીએ-એ દેશી)

જિનવર પાસ-^૧ પસાઉલે, ઘર છાજે હો ! વર મંગલ-કેલિ કે ।
પ્રભુ બગસીસ કરે સહી, સહુ કાજે હો ! રાજે રંગ-રેલિ કે-
-સોભાગી ! એ જિન સેવીયે,

સેવાનો હો ! સાહિબ છે જાણુ કે ।

મંત્ર-તંત્રાદિ જપ્યા વિના,

સેવકને હો ! કરે જગ ^૨સુલતાન કે-સોં ॥૨॥

પુરિસાદાણી-પાસજી, મહી મહિમા હો ! જાગે જયવંત કે ।
ધરણેન્દ્ર ને પદ્માવતી,

કરે સાનિધ્ય હો ! ભગતિ ભગવંત કે-સોં ॥૩॥

દાસ કહે કર જોડીને, તેં કીધા હો ! જગ મહા-ઉપગાર કે ।
ઉનાશયણ ^૪નર-રાજયો,

તે તુજને હો ! છાજ્યો છત્રધાર કે-સોં ॥૪॥

પકમલા ફરમલ કરે ઘણી, ઘણીઆણી હો ! આણી અતિરૂપ કે ।
લોગ લલી-પરે લોગવે,

તુજ ધ્યાને હો ! માને થયા ભૂપ કે-સોં ॥૫॥

૭સાહી ૮ખાંડ તેં જેહની, ૯પાતશાહી હો ! આવી તસ હાથ કે ।
સોવન-રૂપા મેઘ જ્યું,

સહી વરસે હો ! નમતાં તુમ નાથ કે-સોં ॥૬॥



૧ મહેરબાનીથી, ૨ બાદશાહ, ૩ શેષનાગ તે નારાયણ=વિષ્ણુનું,
સ્વરૂપ છે, ૪ શ્રેષ્ઠ રાજા, ૫ લક્ષ્મી, ૬ દેખાવ, ૭ પકડી, ૮ ખાંડ=ભુજ,
૯ બાદશાહી સમૃદ્ધિ,

(૯૫૭) (૪૦-૨૪) શ્રી મહાવીર-જિન સ્તવન

(સુણ જિનવર શેત્રુંજી ધણીજી-એ દેશી)

૧ કોડી-ગમે ગુન્હા કર્યાજી, વિષય થયો લયલીન ।

તે બગસીસ હવે કરોજી, અરિહંત વીર ! ૨ અમીન-

જિનેસર ! શાસનનો શણગાર ॥૧॥

૩ ઓળગીયા ઓળંભડેજી, મત આણો મન રીશ ।

જે પુઠે સરજ્યા સદાજી, જાંપે ઇમિ જગદીશ, -જિને ॥૨॥

લળી-લળી લટકે પાયે પડુંજી, વળી વળી વિનવું એહ ।

સમકિત ચિત્ત તુમ શું મિળ્યોજી, મત મુકાવો તેહ-જિને ॥૩॥

કહો કેણી પરે કીજીએજી ? બહાલો ! તું વીતરાગ ।

ભગતે કાંઈ ન રંજ્યેજી, લાલચનો શો લાગ ? -જિને ॥૪॥

ધ્યાતા દાતા મુજ તણોજી, ત્રાતા તું જિનરાય ।

કેવળ-લક્ષ્મી-વર કરોજી મેઘાવજય-ઉવજઝાય-જિ ॥૫॥

કલશ

ઇમ થુણ્યા જિનવર સરસ-રાગે, ચોવીશે જગના ધણી,

થિર-રાજ આપે, જાસ જાપે, આપ આવે સુરમણિ ।

સવિ સિદ્ધિ સાધો જિન આરાધો, સ્તવન માળા ગળે ધરી,

બહુ થુણ્ય-ભેગે સુખ-સંભેગે, પરમ-પદવી આદરી ॥૧॥

તપગચ્છ-રાજે તેજ તાજે, શ્રી વિજયપ્રભ-ગણુધર,

તસ પદધારી વિજયકારી, વિજયરત્ન-ધુરંધર ।

કવિરાજ રાજે સુગુણ ગાજે, કૃપાવિજય જયંકર,

તસ શિષ્ય ગાવે ભગતિ ભાવે, મેઘ-વાચક જિનવર ॥૨॥



૧ કોડો, ૨ મોટા અમલદાર, ૩ વિનવ્યા,

શ્રી વર્ધમાનસ્વામિને નમઃ
શ્રી કેસરવિમલજી કૃત
સ્તવન-ચોવીશી

(૯૫૮) (૪૧-૧) શ્રી ઋષભદેવ-જિન સ્તવન
(લાડીલો લાખેણી લાડી વખાણો આયો-એ દેશી)
સહીયાં ઋષભ-જિણુંદ શુ' મન લાગ્યું
૧ ચોલ તણી પરે રંગ લાગે હે !
મોરું મન રસાતું એ પ્રભુ-રાગે,
જેહવું ઝહીર ૪કીરમજી રાગે હે !
રાત-દિવસ જે પ્રભુ-મુખ-આગે,
મીન જ્યું રમે નીર અથાગે હે, -સહીં ॥૧॥
મેહે મોરા ચંદ ચકોરા, જિમ કોયલ વલી સહકારા હે !
તિમ પ્રગટે બહુ નેહા મેરી;
એહ મૂરતિશું અધિકેરા હે-સહીં ॥૨॥
શોભા ઢેખી પ્રભુ-મુખ-કેરી, આંખલડી ઉલ્લસે અધિકેરી હે !
બાણું જે કીજે સેવા લલેરી,
ટાળે દૂર ભવની ફેરી હે-સહીં ॥૩॥
મોહન મૂરતિ મોહનગારી, એ સમ નહિં જગ ઉપગારી હે !
એહીજ સાચી કામણગારી,
જિણે વશ કરી યુગતિ ઠગારી હે-સહીં ॥૪॥

૧ વાટેલી મજા, ૨ રાગવાણું, ૩ રેશમ, ૪ પાકાં,

જિમ-જિમ દેખું નયણુ નિહારી,
તિમ મુજ મન લાગે પ્યારી હે ! ।

એક મૂરતિ દેખી મનોહારી,
દરિસણની જાઉં બલિહારી હે-સહી-૥૫૥

નાભિ-નરેસર-કુલ-અવતારી,
મરૂદેવી માતા જેણે તારી હે ! ।

સુનંદા-સુમંગલા વરી જેણે નારી,
યુગલા-ધર્મનિવારી હે- સહી-૥૬૥

રાજ્યની રીતિ જેણે વિસ્તારી, નિરમલ વર-કેવલધારી હે ! ।
શેત્રુંજી-ગિરિવર પ્રભુ પાઉં ધારી,

મહિમા અનંત વધારી હે-સહી-૥૭૥

ઋષભ-જિનેસર-મૂરતિ સારી,
શેત્રુંજી-ગિરિવર શોભાકારી હે ! ।

કેશર-વિમલ કહે જે નરનારી,
પ્રણમે તે જગ જયકારી હે-સહી-૥૮૥



(૯૫૯) (૪૦-૨) શ્રી અન્જિતનાથ-જિન સ્તવન
(અનુમતિ દીધી રે માયે રાવતા એ-દેશી.)

મુજ અન્જિત-જિનેસર મન વસ્યો,
જિમ કમલિની મન રવિરાય ! ।

હાંજી ! મુખ દીઠે મન ઉલ્લસે જાયે પાતિક દૂર પલાય
-મુજ ંહાલોજી અન્જિત-જિનેસર ! ॥૧॥

હાંજી ! મોહન મહીયલે દીપતો, પ્રભુ નાણુ અનંત-પ્રકાશ ।

હાંજી ! મોહ^૨-તિમિર-ભર-ભંજણો,

કરે ભવિયણુ-કમલ-વિકાસ-મુજાં ॥૨૧॥

હાંજી ! અનુપમ અતિશય-આગલો, પ્રભુ મહિમાવંત મહંત ।

હાંજી ! ગુણ ગાવે સુર જેહ તણા,

પ્રભુમી પૂજી ભગવંત-મુજાં ॥૨૨॥

હાંજી ! ભવિ-જન-મન-સુખ કારણે,

તું ઉદયો જિન જગ-લાણુ ।

હાંજી ! તુજ દરિસણુથી સંપજે,

મન-વંછિત ફળ મહીરાણુ-મુજાં ॥૨૩॥

હાંજી ! વિજયાનંદ વાલહો જિતશત્રુ-નૃપ-સુખ કંદ ।

હાંજી ! કેશર કહે જિનરાજી,

ધો દરિસણુ, મુજ સુખ કંદ મુજાં ॥૨૪॥



(૯૬૦) (૪૦-૩) શ્રી સંભવનાથ-જિન સ્તવન

(ઋષભ જિણુંદા ઋષભ જિણુંદા-એ દેશી)

સેવો સંભવ-જિન ! સુખકારી, એહીજ સાહિબ જગ જયકારી ।

મૂરતિ જેહની મોહનગારી,

દેખત દુરગતિ દૂર નિવારી-સેવો ॥૨૫॥

નિત આરાહે જે નર-નારી, સાચી ભક્તિ હૈયે અવધારી ।

તસ ઘર લગ્ન ત્રિભુવન-કેરી,

નિશદિન નિવસે આવી ઘણેરી-સેવો ॥૨૬॥

૨ મોહરૂપી અંધકારના સમૂહને દૂર કરનાર, ૩ શ્રેષ્ઠ; ૪ પુત્ર;

સેના માતા તાત જિતારિ, ^૧હય-લંછન સોઢે મનોહારી ।
નિરમલ-કેવલ-કમલા ધારી,

શિવ-રમણી દીયે ભવ^૨ જળ તારી-સેવો ॥૩૭॥
સુણુ સાહિબ ! મનમાં અવધારી, મહેર કરો મુજ હેત વધારી ।
કહે કેસર તુમશું એક તારી,
દિન-દિન દેખે સેવા સારી-સેવો ॥૪૦॥



(૯૬૧) (૪૦-૪) શ્રી અભિનંદન-જિન સેતવન.

(સુણુ જિનવર શેત્રુંજી ધણીજી-એ દેશી)

નિરમલ-નાણુ ગુણે કરીજી, તું બાણે જગ-ભાવ ।
જગ-હિતકારી તું જ્યોજી, ભવ-જલ તારણુ નાવ-
જિનેસર ! સુણુ અભિનંદન જિણુંદ,

તુજ દરિસણુ સુખકંદ-જિને ॥૧॥
તુજ દરિસણુ મુજ વાલહુંજી, જિમ કુમુદિની-મન ચંદ ।
જિમ ભોરલા-મન મેહલોજી, ભમરા-મન અરવિંદ-જિને ॥૨॥
તુજ વિણુ કુણુ છે ? જગતમાંજી, જ્ઞાની મહા ગુણુ-બાણુ ।
^૧તુજ-ધ્યાયક મુજ મહેરથીજી,

હિત કરી દો બહુમાન-જિને ॥૩॥
તુજ હેતથી મુજ સાહિબાજી ! સીઝે વાંછિત-કાજ ।
તિણુ હેતે તુજ સેવાયેજી, મહેર કરો મહારાજ-જિને ॥૪॥

૧ ધોડો, ૨ સંસાર સમુદ્ર

૧ તમારું ધ્યાન કરનારા એવા મારું હિત મહેર=કૃપાથી કરી દો.
ત્રીજી ગાથાના ઉત્તરાર્ધનો અર્થ.

સિદ્ધારથા-ઉર-હંસલોલ, સંવર-નૃપ-કુલ લાણુ ।

કેસર કહે તુજ હેતથીલ,

દિન-દિન કોડિ-કલ્યાણુ-જિને૦ ॥૫॥

(૯૬૨) (૪૦-૫) શ્રી સુમતિનાથ-જિન સ્તવન

(શ્રી ચંદ્રપ્રભ જિન સાહિબા રે-એ દેશી)

સુમતિ-જિનેસર સાહિબા રે,

તું મન વસીયો આય-મનના માન્યા ।

જિમ ચાતક-મન મેહલો રે, કમલિની-મન રવિરાય-મનના૦

મન મોહું રે જિણુંદ! મન મોહું,

મન મોહન તું મહીમાંહિ ॥ ૧ ॥

જિમ મન ઉલ્લસે માહરું રે. તેમ ઉલ્લસે તુજ હેજ-મન૦ ।

તો વાંછિત સઘલાં ફલેરે, જાણીજે તુમ તેજ-મન૦ ॥૨॥

મુજ મન-મંદિર તું વસે રે, જાણે જગત-સ્વભાવ-મન૦ ।

કિયું ય કહાવે મો લણું રે, મુજ-હૈડાના લાવ-મન૦ ॥૩॥

હિતકર સુમતિ-જિણુંદજી રે, કીજે સવિ સુખ-સંગ-મન૦ ।

સોવન વાન સદા જ્યો રે, કેશર-અરચિત અંગ-મન૦ ॥૪॥

(૯૬૩) (૪૦-૬) શ્રી પદ્મપ્રભ-જિન સ્તવન

(પુદ્ગલવર્ધ વિજયે જ્યોરે-એ દેશી)

પદ્મપ્રભ-જિન ભેટીયેરે, સાચો શ્રી જિનરાય ।

હુખ દોહગ દૂરે ટળે રે સીજે વાંછિત-કાજ-

લવિકજન! પૂજે શ્રી જિનરાય,

આણી મન અતિઠાય-લવિ૦ ॥૧॥

શિવ-^૧રામા વશ તાહરે રે રાતો તેણે તુમ અંગ ।
 કમલ રહે નિજ પગ-તલે રે, તે પણુ તિણુહીજ રંગ-ભવિં ॥૨૧॥
 રંગે રાતા જે અછે રે, વિચે રહ્યા થિર થાય ।
 તુ રાતો પણુ સાહિબા રે, જઈ એઠો સિદ્ધિમાંય-ભવિં ॥૨૩॥
 અધિકાર્થ એ તુમ તણી રે, દીડી મેં જિનરાજ ।
 ઠકુરાઈ ત્રણુ-જગતણી રે, સેવ કરે સુરરાજ-ભવિં ॥૨૪॥
 દેવાધિદેવ ! એ તાહરે રે, નામ અછે જગદીશ ।
 ઉદારપણુ પણુ અતિ-ધણુ રે, રંક કરો ક્ષણુ ઈશ-ભવિં ॥૨૫॥
 એહવી કરણી તુમ-તણી રે, દેખી સેવું તુંજ ।
 કેશર વિમલ કહે સાહિબા રે ! વાંછિત પૂરો મુજ-ભવિં ॥૨૬॥

(૯૬૪) (૪૧-૭) શ્રી સુપાર્શ્વનાથ-જિન સ્તવન

(સંભવ-જિનવર વિનતિ-એ દેશી)

સાંભળ સ્વામી સુપાસણ ! તુંહીજ જગત-આધારો રે ।
 અવર ન કોઈ તુંજ સમો, મહિમાવંત ઉદારો રે-સાંભલં ॥૨૧॥
 ઇણુ જગે સમરથ તું અછે, પૂરણુ મનની આશો રે ।
 તુંજ ચરણે મુજ મન રમે,
 દિન-દિન અધિક ઉલ્લાસો રે-સાંભળં ॥૨૨॥
 તુમ સેવા મુજ મન વસી, જિમ ^૧રેવા ગજ-વાસો રે ।
 તુંજ સેવાથી સહુ કલે, પૂગે મનની આશો રે-સાંભળં ॥૨૩॥
 રચણુચરને સેવતાં, લહીયે રચણુ-ભંડારો રે ।

૧ લક્ષ્મી-સ્ત્રી ૧ નર્મદા નદી

સંગતિ-સરખાં ફલ હુએ,

સચણા ! એહ વિચારો રે-સાંભળ૦ ॥૪૦॥

સુશુણ-સંવાસો સેવતાં, ભવ-તણી ભાવઠ જાયે રે ।

સદહણા એ હુદયે ધરતાં કહે કેશર સુખ થાયે રે-સાંભળ૦ ॥૪૧॥



(૯૬૫) (૪૧-૮) શ્રી ચંદ્રપ્રભ-જિન સ્તવન

(સહજ સહુણા હો ! મિલીયો મારો સાહિબો-એ દેશી)

આજ મેં દીઠો મીઠો જિનજી આઠમો, ચંદ્રપ્રભ બહુ-પ્રેમ ।

મૂરતિ નિરખી હો ! હરખી મોરી આંખડી,

ચંદ ચકોરી જેમ-આજ૦ ॥૧॥

ચંદો વારી હો ! વારી નાખું વારિમાં, સાહિબ ! તુજ મુખ દેખી ।

ચંદો છે સરિસો હો ! જો પણ આઠમો,

તું મુખઠાયી વિશેષ-આજ૦ ॥૨॥

ઉજલો શુણ્યું હો ! જોહી તોહી માહરં, તું મન રંજે રાય ।

એહ અચંબો હો ! મુજ મન રાગે તું રમે,

તોહિ ન રંજ્યો જાય-આજ૦ ॥૩॥

તું નવિ રંજે હો ! રંજે સુર-નર-ચિત્તડાં, તુંહી નિરંજન તેણુ ।

અંતર-ગતની હો ! તાહરી વાત કેા લહે,

અ-કલ-સરૂપી જેણુ-આજ૦ ॥૪॥

એકજ તુમચી હો ! મૂરતિ મુજ હિયડે વસી

પુણ્યથી સહ ઉલ્લાસ

મુપ્રસન્ન થઈ હો ! સાહિબ ! મુજ ભગતે મિલો,

પૂરો મનતણી આશ આજ૦ ॥૫॥

અંક વિરાજે હો ! શરદ્-પૂનમનો ચંદ્રમા, ચંદ્રપ્રભ જિનશય ।
કેશર જંપે હો ! સેવક બાણી આપણો,

મહેર કરો મહારાય-આજ ॥૬॥



(૯૬૬) (૪૧-૯) શ્રી સુવિધિનાથ-જિન સ્તવન

(ખંધ સમય ચિત્ત ચેતીયે-એ દેશી)

સુવિધિ-જિનેસર ! સાંભળો,

તું પ્રભુ નવનિધિ દાય-સાહિબજી ।

તુજ સુ-પસાયે સાહિબા,

મન-વાંછિત રૂળ થાય-સાહિબજી ! સુવિધિ ॥૧॥

તું સાહિબ સમરથ લહી, બીજાશું કેહી પ્રેમ ?-સાહિબજી ।

છોડી સરોવર હંસલો,

છીલ્લર રીઝે કેમ ?-સાહિબજી ! સુવિધિ ॥૨॥

રયણ-ચિંતામણિ પામીને, કુણુ કાચે લોભાય-સાહિબજી ।

કલ્પતરૂ-છાયા લહી,

કુણુ આવલ કને જાય ?-સાહિબજી ! સુવિધિ ॥૩॥

થોડી હી અધિકી ગણું, સેવા તુમચી દેવ-સાહિબજી ! ।

કરે ગંગાજલ-ખિંદુઓ,

નિરમલ સર નિતમેવ-સાહિબજી ! સુવિધિ ॥૪॥

સમરથ દેવ ? સિર-તિલો, ગુણુનિધિ ગરીબ-નિવાજ-સાહિબજી ! ।

થોડે નિવાજે મયા કરી,

સાહિબ ! સુવિધિ-જિનરાજ-સાહિબજી ! સુવિધિ ॥૫॥

તુજ ચરણે મુજ મન રમે, જેમ બ્રમર અરવિન્દ-સાહિબજી ! ।
 કેશર કહે સુવિધિ-જિના,
 તુમ દરિસણુ મુખ-કંદ-સાહિબજી ! સુવિધિ ॥૬॥

(૯૬૭) (૪૧-૧૦) શ્રી શીતલનાથ-જિન સ્તવન
 (વિહરમાન ભગવાન સુણે મુજ વિનતિ-એ દેશી)

દશમે દેવ દયાલ ^૧મયાલ મનોહર,
 નયણાનંદ જિણુંદ ^૨અ-મંદ ^૩મુહંકર ।

સેવીજે સુખદાય સુરાસુર-શિર-તિલો,
 શીતલ શીતલ વાણી ગંભીર ગુણે નીલો ॥ ૧ ॥

શીતલ ચંદન ચંદ જ્યું દરિસણુ તુમ તણો,
 નિરખી નિરખી જિન-નાહ હૈયે આનંદ ઘણો ।

ધન-ધન દિન મુજ આજ ! દીઠો મુખ તુજ તણો,
 સુરતર-સુરમણિ જેમ મનોરથ-પૂરણો ॥૨॥

તું પ્રભુ ! રચણુનિધાન પ્રધાન-ગુણે કરી,
 ઘો એક સમકિત રચણુ ! વચણુ મુજ મન ધરી ।

ભવ-ભવ-ભાવઠ દૂર સાંઈ કરણુ કરે,
 રવિ-મંડલ જ્યું ^૪તિમિર-નિકર દૂરે હરે ॥૩॥

મુજ મન નિવસી ^૫આપ ભગતિ પ્રભુ ! તુમ તણી,
 તુજ દરિસણુકી ચાહ તેણે મુજ મન ઘણી ।

ઘો દરિસણુ સુપ્રસન્ન મનોરથ પૂરવો,
^૬ગુણુ-ઘાતક જે પાપ તે મુજ ચૂરવો ॥૪॥

૧ કરણા ભરપૂર. ૨ અત્યંત, ૩ સુખ કરનાર, ૪ અંધકાર સમૂહ,
 ૫ પોતાની મેળે, ૬ આત્મ ગુણનો ધાત કરનાર જે પાપ=મોહાદિ દૂષણો,

સુષુ શીતલ ! જિનભાણુ ! સુખાણુ ! સુહંકર !

દંઢરથ-રાય-કુલચંદ ! નંદા-નંદન ! વર !

કહે કેશર જિનનાહ ! કહું એક તુજ ભણી,

આપણે ભાણી જિણુંદ ! મયા કરજો ઘણી ॥૫૦॥



(૬૬૮) (૪૧-૧૧) શ્રી શ્રેયાંસનાથ-જિન સ્તવન

(અરિહંત પદ ધ્યાતો થકો-એ દેશી)

શ્રી શ્રેયાંસ -જિન સાંભળો, સિંહપુર નગર-નિવાસી રે !

તુમ સેવા સુજ મન વસી, ગજ મન રેવા જેસી રે-શ્રીં ॥૧॥

જો આપો તુમ સેવના, તો મન હરખ ન માય રે !

કસ્તુરી-અંબર સહી, જિમ અધિકી મહમાય રે-શ્રીં ॥૨॥

રગિર્યા-જનની સેવના, કદીય ન નિષ્ફલ થાય રે !

હરિ ૪રયણાયર સેવતાં, લગ્ગી લહી સુખ દાય રે-શ્રીં ॥૩॥

શિસહેસર-સેવા થકી, નમિ-વિનમિ નૃપ થાય રે !

હર સેવત ગંગા લહ્યા, હરશિર ઉત્તમ ઠાય રે-શ્રીં ॥૪॥

તિમ પ્રભુ ! તુજ સેવા થકી, સીજે વાંછિત આશો રે !

તુજ સુ-પસાયે સાહિબા ! પલહીયે લીલ-વિલાસો રે-શ્રીં ॥૫॥

લોહ-ચમક જ્યું માહરો, મન લાગ્યો તુમ સાથે રે !

તિમ જો મોશું તુમે મિલો, તો મુગતિ મુજ હાથે રે-શ્રીં ॥૬॥

૧ નર્મદા નદી, ૨ મોટા, ૩ વિષ્ણુ, ૪ સમુદ્ર, ૫ લક્ષ્મીજી, ૬ ગંગા-
જીએ હર=મહાદેવની સેવા કરતાં મહાદેવના મસ્તકે ૩૫ ઉત્તમ સ્થાન
મેળવ્યું (ચોથી ગાથાના ઉત્તરાર્ધનો અર્થ).

મનમોહન ! મુજ વિનતિ, શ્રી શ્રેયાંસ-જિન ! સ્વામી રે ।
ઘો પ્રભુ ! તુમ પય સેવના, કેશર કહે શિર નામી રે-શ્રીં ॥૭૧॥

★

(૯૬૯) (૪૧-૧૨) શ્રી વાસુપૂજ્ય-જિન સ્તવન

(આચારજ ત્રીજે પદે-એ દેશી)

વસુપૂજ્ય-નૃપ-કુલ-ચંદ્રલો, શ્રી વાસુપૂજ્ય-જિનરાય રે ।
રાણી-જયા-ઉર-હંસલો, મહિષ-લંછન જસ પાય રે-
શ્રી વાસુપૂજ્ય-જિન ! વિનતી, સુષુ ત્રિભુવન-જયકારી રે ।
મનહ મનોરથ પૂરવો, અંતર દૂર નિવારી રે-શ્રી વાસું ॥૭૨॥
મહિયલ તું મહિમા-નીલો, નહિ કોઈ તાહરી ભેડી રે ।
જિમ સૂરજ સમ કો નહિં ! તારા-ગણુની કોડી રે-શ્રી વાસું ॥૭૩॥
જે તુમ બાણપણું અછે, બીજામાં નહિ તેહોરે ।
તિમિર નવિ તારા હરે, ચંદ્ર હરે છે જેહો રે-શ્રી વાસું ॥૭૪॥
મોહ્યો મુજ મન-હંસલો, તુજ ગુણુ-ગંગ-તરંગે રે ।
૧ અવર-સુરા-છિદ્ધર-જલે,

તે કિમ રાચે ? રંગે રે-શ્રી વાસું ॥૭૫॥

ભાવ-ભગતે પ્રભુ ! વિનવું, સુષુ સ્વામી ! અરદાસ રે ।
કેશર-વિમલ કહે સાહિબા !

પૂરો મુજ મન આશ રે-શ્રી વાસું ॥૭૬॥

○

૧ બીજા દેવરૂપ આબોચીયાના પાણીમાં, (પાંચમી ગણ્યાની ત્રીજી લીટીનો અર્થ)

(૯૭૦) (૪૧-૧૩) શ્રી વિમલનાથ-જિન સ્તવન

(સંભવ દેવ તે ધૂર સેવો સવેરે-એ દેશી)

સાંભળ વિમલ-જિનેસર ! વિનતી રે, તુમ્હશું સહજ-સનેહ ।
ચંદન સહજ-સ્વભાવે શીતલો રે,

જગ-સુખદાયી મેહ-સાંભળ૦ ॥ ૧ ॥

વાંછિત-દાયક સુરતર-સુરમણિ રે, રવિ કરે તેજ-પ્રકાશ ।
છાયા શીતલ શીતલ ચંદલો રે, સુરગવી પૂરે આશ-સાં ॥૨॥
સહજ-સ્વભાવે જિમ એ સુખ દીયે રે, તું જગ-તારક તેમ ।
તો હવે તારક-ગિરૂદને સાહિબા રે !

હેજ ન કીજે કેમ ?-સાંભળ૦ ॥ ૩ ॥

એકને તારો ન તારો એકને રે, એકને નિજ-પદ દેહ ।
એક અધિકો એક આછો પાંતિમાંરે,

કરવો ન ઘટે એહ ! સાંભળ૦ ॥૪॥

સહુશું સરીખા-હેજે હુએરે, ગિરૂઆ ! તે ગુણવંત ! ।
અંતર ન કરે મોટા-નાનડારે, મોટા તેહ મહંત-સાં ॥૫॥
નિગુણ-સુગુણ પણ સેવક આપણા રે, નિરૂઆ નિવહે જાણ ।
શશી દોષી પણ ઇશ-શિરે ધરી રે,

જિમ નિવહ્યો નિરવાણુ-સાંભળ૦ ॥૬॥

તો હવે જાણી સેવક આપણા રે, પરમ કૃપાપર ! દેવ ! ।
કેશર-વિમલ જિનેસર ! વિનવેરે,

હેત ધરજો નિતમેવ-સાંભળ૦ ॥૭॥



(૯૭૧) (૪૧-૧૪) શ્રી અનંતનાથ-જિન સ્તવન
(સાહિબ બાહુ જિનેસર વિનવું-એ દેશી)

સાહિબ ! અનંત-જિણુંદ ! મયા કરો,
આપણો જાણી જિણુંદ-હો ।

સાં ! સહજ-સનેહ હૈયે ધરી,
ઘો દરિસણુ સુખ-કંદ હો-સાહિબ ! અનંતં ॥૧॥

સાં ! વિણુ-કહેવે જ્ઞાને કરી, તું જાણે જગ-લાવ હો ।

સાં ! તુજ દીઠે મન ઉલ્લસે,
મિલણુ તણો ધરી દાવ હો-સાહિબ ! અનંતં ॥૨॥

સાં ! થોડો હી પણુ તુમ તણો, મિલણુ મહા સુખદાય હો ।

સાં ! એકજ બિંદુ અમીતણો,

તાપ-નિવારક થાય હો-સાહિબ ! અનંતં ॥૩॥

સાં ! જથું મન માહરે તું રમે, તિમ તુમ મન મુજ વાસ હો ।

સાં ! જો પ્રભુ ! મન શું મન મિલે,

તો પુગે મન આશ હો-સાહિબ ! અનંતં ॥૪॥

સાં ! મુજ ભગતે સુપ્રસન્ન થઈ તારો અનંત-જિણુંદ હો ।

સાં ! કેશર-વિમલ ધમિ વિનવે,

તુજ દરિસણુ સુખ-કંદ હો-સાહિબ ! અનંતં ॥૫॥



(૯૭૨) (૪૧-૧૫) શ્રી ધર્મનાથ-જિન સ્તવન
(વીર જિણુંદ જગત ઉપકારી-એ દેશી)

ધર્મ-જિનેસર ! સુણ ! પરમેશ્વર !, તુજ શુણ કેતા કહાયણ ।

તુજ વચને તુજ રૂપ જણાયે,

અવર ન કોઈ ઉપાયણ-ધર્મં ॥૧॥

તાહરે મિત્ર અને શત્રુ સમ, અરિહંત તુંહી ગવાયજી ।

રૂપ-સ્વરૂપ અનુપમ તું જિન !,

તોહી અ-રૂપી કહાયજી-ધર્મં ॥૨॥

લોભ નહિ તુજમાંહિ તો પણ, સઘલા ગુણ તેં લીધજી ।

તું નિ-રાગી પણ તેં રાગી,

લગત તણાં મન કીધજી ધર્મં ॥૩॥

નહિં માયા તુજમાં જિનરાયા ! પણ તુજ વશ જગ થાયજી ।

તુંહી સ-કલ તુજ અ-કલ કલે કુણ !,

જ્ઞાન વિના જિનરાયજી ! ધર્મં ॥૪॥

મુગુણ-સનેહી મહેર કરો, મુજ મુપસન્ન હોઈ જિણુંદજી ।

પલણે કેશર ધર્મ જિનેસર !,

તુજ નામે આણુંદજી-ધર્મં ॥૫॥



(૯૭૩) (૪૧-૧૬) શ્રી શાંતિનાથ-જિન સ્તવન

(દીઠી હો પ્રભુ દીઠી જગગુર ! તુજ-એ દેશી)

સાંભળ હો ! પ્રભુ ! સાંભળ શાંતિ-જિણુંદ !,

વિનતિ હો ! પ્રભુ ! વિનતી માહરા મનધણીજી ।

પૂરણ હો ! પ્રભુ ! પૂરણ મનની આશ,

પામ્યો હો પ્રભુ ! પામ્યો મેં તું સુરમણિજી ॥૧॥

તુજશું હો ! પ્રભુ ! તુજશું લાગ્યું મન,

નેહી હો ! પ્રભુ ! નેહી મેહા મોર જ્યુંજી ।

લોચન હો ! પ્રભુ ! લોચન તુજ મુખ દેખી,

હરખે હો ! પ્રભુ ! હરખે ચંદ ચકોર જ્યુંજી ॥૨॥

તુજશું હો ! પ્રભુ ! તુજશું સાચો પ્રેમ,
 પંકજ હો ! પ્રભુ ! પંકજ રવિ જ્યું ઉલ્લસ્યોલ;
 તું પશુ હો ! પ્રભુ ! તું પશુ સુપસન્ન થાય,
 સુખકર હો ! પ્રભુ ! સુખકર જો સુજ મન વસ્યોલ ॥૩॥
 કીજે હો ! પ્રભુ ! કીજે મુજશું હેત,
 સાચી હો ! પ્રભુ ! સાચી પ્રીત મનમાં ધરીલ ।
 સેવા હો ! પ્રભુ ! સેવા તો પરમાણુ,
 જાણું હો ! પ્રભુ ! જાણું તેં જાણી ખરીલ ॥૪॥
 હેજે હો ! પ્રભુ ! હેજે હૈયે ધરી આપ,
 દીજે હો ! પ્રભુ ! દીજે વાંછિત-સુખ ઘણુંલ ।
 દરસણુ હો ! પ્રભુ ! દરસણુ દેઈ દેવ,
 પૂરો હો ! પ્રભુ ! પૂરો ! મનોરથ મન તણાલ ॥૫॥
 અચિરા હો ! પ્રભુ ! અચિરા-નંદન દેવ,
 જાણી હો ! પ્રભુ ! જાણી વિનતિ જગધણીલ ।
 કેશર હો ! પ્રભુ ! કેશર કહે જિનરાય ।
 દીજે હો ! પ્રભુ ! દીજે દરિસણુ સુજ ભણીલ ॥૬॥



(૯૭૪) (૪૧-૧૭) શ્રી કુંથુનાથ-જિન સ્તવન

(રાગ મલ્હાર ઢાલ વીંછીયાની)

કુંથુ-જિનેસર ! સાંભળો, એક અરજ કરું કરજોડ રે-લાલા ।
 મહેર કરી મુજ સાહિબા !

ભવ-ભવ-તણી ભાવઠ છોડ રે-લાલા-કુંથુ ॥૧॥

અંતરજામી માહરા ! હિયડાના જાણે ભાવ રે-લાલા ।

ભક્ત-વચ્છલપણું તુમ-તણું,

જણાવો ! ભવ-જલ-નાવ રે-લાલા-કુંથુ ॥૨૦॥

ભવ-હુઃખ વારો ! ભવિતણાં, દેઇ દેઇ દરિસણુ-નૂર રે લાલા ।

નિશ-દિન નિ-વસો ! મુજ મને,

તો કાં ! ન કરો ! હુઃખ દૂર રે લાલા-કુંથુ ॥૨૧॥

તું નિવસત મુજ હિયડલે,

કહો ! કિમ રહે ! દુરિત દુરંત રે-લાલા ।

તિમિર-પટલ તિહાં કિમ રહે ?

જિહાં દિણ્યર-તેજ દીપંત રે લાલા-કુંથુ ॥૨૨॥

કુંથુ-જિણુંદ ! મયા કરો,

મન-વદ્ધમ ! જિન ! જગદીશ રે !-લાલા ।

કેશર-વિમલ ઈમ વિનવે,

મુખ કનક-વિમલચુર-સીસ રે-લાલા-કુંથુ ॥૨૩॥



(૯૭૫) (૪૧-૧૮) શ્રી અરનાથ-જિન સ્તવન

(પુરૂષલવઈ-વિજયે જ્યોરે-એ દેશી)

કવિ-કુમુદ-વન-^૧કૌમુદી રે, સમરી શારદ-માય ।

અરજ કરું અર-જિનલણી રે, ભાવ ધરી મનમાંય-

જિણુંદરાય ! અવધારો ! અરદાસ,

તું પ્રભુ પૂરણ આશ-જિણુંદ ॥૧॥

તું સમરથ ત્રિહું લોકમાંરે ગિરૂઓ ગરીબ-નિવાજ ।

તુજ સેવાથી સાહિબા રે, સીએ વાંછિત કાજ-જિણુંદ ॥૨॥

૧ ચંદ્રની ચાંદની,

શિવ-સુખ-દાયક તું જ્યોરે, ભવ-ભય-ભંજનહાર ।
 તુજશું મુજ મન-નેહલો રે, આતક જિમ જલ-ધાર-જિણુંદ૦ ॥૩૩॥
 તુજ પદ-પંકજ-ફરસથી રે, નિરમલ આતમ હોય ।
 લોહ સોવનતા જિમ લહેરે, રવેધક-રસથી જોય-જિણુંદ૦ ॥૩૪॥
 તુજ પ્રણમીજે પૂજ્યે રે. તે દિન સફલ ષવિહાણ ।
 તુજ હિતથી પ્રભુ મુજતણું રે,

જીવિત-જન્મ પ્રમાણ-જિણુંદ૦ ॥૩૫॥

અંતરજામી માહરા રે, અરજ કરું કરજોડ ।

ભગતે તુમ પદ-સેવનારે,

ધો ! મુજ એહીજ કોડ-જિણુંદ૦ ॥૩૬॥

સુખ-દાયક ત્રિભુવન-ધણી રે, ભવ-જલ-તારણ નાવ ।

કેશરવિમલ ઈમ વિનવે રે,

અરજિન-ભકિત-પ્રભાવ-જિણુંદ૦ ॥૩૭॥



(૯૭૬) (૪૧-૧૯) શ્રી મલિનાથ-જિન સ્તવન

(તુજ શાસન અમૃત મીઠું-એ દેશી)

સેવોભવિયણુ ! મલિલ-જિનેસર, ભાવ-ભગતિ મન આણી રે-

-મારો જિનજી સુહાવે ।

ગંગોદક જલ કુંભ ભરી ભરી, સનાત કરો ભવિ પ્રાણી રે

મારો જિન મનોહારી-મારો ॥૧॥

કેશર ચંદન ભરીય ક્યોલી, આણી ફૂલ ચંગેરી રે-મારો ॥

નવ-અંગે પૂજે મૂરતિ, મલિલ-જિનેસર કેરી રે મારો ॥૨॥

૨ સોનું પનાવનાર, ૩ જહાણું=પ્રભાત,

દેવાધિદેવતાણી જે પૂજા, કીજે આઠ-પ્રકારી રે-મારોં ।
 તે તો આઠ મહા-સિદ્ધિ આપે, આઠે કરમ નિવારી રે-મારોં ॥૩૥॥
 ધન તે દીઠા ! છઠા તે ધન ! જેણે પ્રભુ-ગુણુ ગાઈ જે રે-મારોં ।
 જિણે પ્રભુ દેખી હરખ લહીજે,

સો નયણાં ફલ લીજે રે-મારોં ॥૪૥॥

જિણુ નયણે દીઠો એ જિનવર,
 તેહીજ જિન હૈયે વહીયે રે-મારોં ।

ધન તે હૈડું નયન થકી પણ,

અધિક કૃતારથ કહીયે રે-મારોં ॥૫૥॥

તે ધન હાથ ! જેણે પ્રભુ પૂજે,

તે ધન શિર ! જેણે નમીયે રે-મારોં ।

જિન-ગુણુ ગાતાં લકિત કરતાં,

શિવ-રમણીશું રમીયે રે-મારોં ॥૬૥॥

શિવ-સુખકારી ભવ-ભય-હારી,

મૂરતિ મોહનગારી રે-મારોં ।

કહે કેશર નિત સેવા કીજે,

મલિહ-જિનેસર કેરી રે-મારોં ॥ ૭ ॥

★

(૯૭૭) (૪૧-૨૦) શ્રી મુનિસુવ્રત-જિન સ્તવન

(પંથીડા ! સંદેશો પૂજ્યજીને વિનવે રે-એ દેશી)

સાંભળ સુવ્રત-સ્વામી ! શામળા રે,

શ્રી હરિ-વંશ-વિભૂષણુ રચણુ રે ।

નયણાં હરખે તુજ મુખ દેખવા રે,

તુજ ગુણ ગાવા ઉલસે વયણ રે-સાંભળ૦ ॥૧॥

તુજ ગુણ નિરમલ ગંગ-તરંગમેં રે,

મોહ્યો મુજ મન-ખાલ મરાલ રે ।

ત્રિભુવન મોહ્યો તુજ મહિમ કરી રે,

સાચો મોહન ! તું હી મયાલ રે-સાંભલ૦ ॥૨॥

મહેર કરી જે સ્વામી મો લણી રે,

દીજે સમકિત-રયણ સુ-હેજ રે ।

જે દીયે સાહિબ ! મુજ ૧સુ-હેજથી રે,

તો નિત્ય દીયે સેવક-તેજ રે-સાંભલ૦ ॥૩॥

ભકત-વત્સલ જગ-ખાંધવ તુંહી,

તું જગ-જીવન તું ગુણ-ગેહરે ।

જે હેત વહેશ્યો અમરું આપણો રે,

તો નિરવહેશ્યો ધર્મ-નેહરે-સાંભળ૦ ॥૪॥

શ્રી મુનિમુવત-જિનશું નેહલો રે,

તે તો શશી જિમ ૨સિંધુ-ઉલ્લાસ રે ।

કેશર જંપે સ્વામી માહરા રે,

દરશન દેઈ પૂરો આશ રે-સાંભળ૦ ॥૫॥



(૯૭૮) (૪૧-૨૧) શ્રી નમિનાથ-જિન સ્તવન

(પંડતીયા હો ! તું જોયને જોશ કે

અમ ગુરુ કંઈ એ આવશેજી-એ દેશી)

જગ-નાયક ! હો ! સુષ્ઠ નમિ-જિનરાય કે,

તુજ દરિસણુ મુજ વાલહું જી ।

જિમ વાલ્હો હો ! મોરા મન મેહ કે,

હંસા-સરોવર વાલહું જી ॥ ૧ ॥

તુજ મુખડું હો ! નિરખી શશી જેમ કે,

હિયડું કુમુદ જ્યું ઉલ્લસેજી ।

મુજ મીઠડું હો ! લાગે તુજ વયણુ કે,

સરસ અમીરસ જિહાં વસેજી ॥ ૨ ॥

અતિ-સુંદર હો ! નિરખી તુજ નયણુ કે,

પંકજ જળમાં તપ કરેજી ।

વલ્લી ખંજન હો ! ગયા ગગન મોઝાર કે,

હાર્યા મૃગ વન-વન ફરેજી ॥ ૩ ॥

એણે નયણે હો ! પ્રભુ તું મુજ જોય કે,

હેજ હિયામાં દાખવેજી ।

દેઈ દર્શન હો ! ભવ-જલ નિધિ તાર કે,

સુ-પ્રસન્ન મુજ સાહિબ હુવેજી ॥ ૪ ॥

તુજ ચરણે હો ! નમતાં નિત્યમેવ કે,

મનહ મનોરથ સવિ ફલેજી ।

સમરંતા હો ! તુજ નામ-સુમંત્ર કે,

સંકટ સવિ ફરે ટળેજી ॥ ૫ ॥

સુખ-દાયક હો ! સુષુ નમિ-જિનરાય ! કે,
મહેર કરે ને મો ભણીજી ।
ભલી ભગતે હો ! કહે કેશર એમ કે,
આશા પૂરો પ્રભુ ! મુજ ઘણીજી ॥૧॥



(૯૭૯) (૪૧-૨૨) શ્રી નેમિનાથ-જિન સ્તવન
(વર્ધમાન જિનવર વરદાયી-એ કેશી)

સાંભળ સ્વામી ! ચિત્ત-સુખકારી !
નવ-ભવ-કેરી હું તુજ નારી ।
પ્રીતિ વિસારી કાં ! પ્રભુ ! મોરી.

કયું રથ ફેરી જાઓ ? છોરી ॥૧॥
તોરણ આવી શું મન જાણી ?, પરિહરી ! માહરી પુરાણી ।
કિમ વન ? સાધે ? વ્રત લીયે રઆધે,
વિણ-અપરાધે ! શ્યે ૩પ્રતિબંધ ! ॥૨॥

પ્રીતિ કરી જે ! કિમ તોડીજે,
જેણે જસ લીજે ! તે પ્રભુ ! કીજે ।
૪જાણ-સુ-જાણ જ તે જાણીજે,
વાત જે કીજે તે ૫નિવહીજે ॥૩॥

ઉત્તમહી ને આહરી છ'ડે, મેરૂ-મહીધર તો કિમ ૬મ'ડે ? ।
ને તુમ-સરીખા સયણ જ ચૂકે,
કિમ (નવિ) જલધર (નિધિ-માઝા) દ્વારા મૂકે. ॥૪॥

૧ જાઓ છો ! ૨ અર્થે-અધ વચ્ચેથી, ૩ કારણે ! ૪ જાણકારોમાં
થણ શ્રેષ્ઠ ૫ નલાવે-પૂરી કરે, ૬ સ્થિત રહે !

નિ-ગુણા ભૂલે તેતો ત્યાગે, ગુણ વિણ નિવહી પ્રીતિ ન જાયે ।
પણ સુ-ગુણા જો ભૂલી જાયે,

તો જગમાં કુણને કહેવાયે ? ॥૫૫॥
એક-પખી પણ પ્રીતિ નિવાહુ;

ધન ધન તે અવતાર આરાહે ।
ધમ કહી નેમશુ' મલી એકતારે,

રાબુલ-નારી જઈ ગિરનારે ॥૬૫॥
પૂરણ મનમાં ભાવ ધરેઈ, સંયમી હોઈ શિવ-સુખ લેઈ ।
નેમશુ' મલીયા રંગે રલીયા,

કેશર જ'પે વાંછિત ફલીયાં, ॥૭૫॥



(૯૮૦) (૪૧-૨૩) શ્રી પાર્શ્વનાથ-જિન સ્તવન

(નમો રે નમો શ્રી શેત્રુંજી-ગિરિવર-એ દેશી)

સુણ સાહેબ ! પ્રભુ ! પાસ-જિનેસર !,

નેહ-નજરથી નિહાળ રે ।

તુજ સાનિધ્યથી ૧ હેલાં લહીયે,

દિન-દિન મંગળ-માળ રે-સુણું ॥૧॥

કારણ મહીયલે શિવસુખ-કેરો, એક તુંહી જ જિનરાજ રે ।

જયું વ્યવહાર સદા જગ-જનનો,

૨ વરતાવણુ ૩ દિનરાજ રે-સુણું ॥૨॥

મોહ-વશે તુમ છંડી જે જન, અવર સુ-દેવ કરી જાણે રે ।

૧ જલ્દી, ૨ ચલાવવા, ૩ સૂચ

સ-જલ સરોવર છંડી તે મન,

૪મૃગ-જલશું સુખ માણે રે-સુણું ॥૩॥

દર્શન-લેઢે તું બહુ રૂપી, પરમારથ એક-રૂપ રે ।

સ્ફટિક-મણિ જ્યું પવરણ-ઉપાધે,

આભાસે બહુ-રૂપ રે-સુણું ॥૪॥

ભવ-દુઃખ-ભંજન તું જગ-રંજન, તુંહી નિરંજન દેવ રે ।

કહે કેશર પ્રભુ ! પાસ-જિનેસર !,

દીજે તુમ પદ-સેવ રે-સુણું ॥૫॥



(૯૮૧) (૪૧-૨૪) શ્રી મહાવીર-જિન સ્તવન

(સાંભળજો મુનિ સંજમ રાગે-એ દેશી)

વીર-જિનેસર ! સુણ મુજ સ્વામી,

વિનવીયે શિર નામી રે ।

તું પ્રભુ ! પૂરણ મન-હિત-કામી,

તું મુજ અંતરજામી રે-વીર૦ ॥૧॥

એક જ તું શિર સાહિબ કીજે, તુમ સમ કાણ કહીજે રે ? ।

ભગતિ કરતાં જો તું રીજે,

તો મન-વાંછિત સીજે રે-વીર૦ ॥૨॥

તુજ હિતથી સુખ-સંપદ આવે, દાહિદ્ર દૂર ગમાવે રે ।

જગ-બંધવ જિન તુંહી કહાવે,

સુર-નર તુજ ગુણ ગાવે રે-વીર૦ ॥૩॥

૪ ઝંઝવાના પાણી સાથે, ૫ રંગના કારણે

તું પ્રભુ ! પ્રીતિ ન હેત જણાવે,

પણ સેવક સુખ પાવે રે ।

ગિર્યા-સેવા-ફલ નવિ જાવે,

સેવીજે ઈષ્ટ ભાવે રે-વીર૦ ॥૪॥

ત્રિશક્તા-નંદન ! વીર-જિનેશ્વર ! વિનતડી અવધારી રે ।

કેશર જંપે હરિસણુ દીજે,

હરગતિ હર નિવારી રે-વીર૦ ॥૫॥



(૯૮૧) (૪૧-૨૫) ચોવિશી-મંગલગીત સ્તવન

(આજ માહરે આંગણે કાંઈ જાણું સુરતર ફૂલીયો રે-એદેશી)

(રાગ ધનાશ્રી)

સેવાને રે ભવિ ! સેવાને, ચોવીશે જિનરાયા બે ।

ભવ-ભય-વારક, શિવ-સુખ-દાયક,

ત્રિભુવનમાંહી સુહાયા બે-સેવો૦ ॥૧॥

પૂરવ-પુણ્ય લઈ અવતરીયા, ચૌદ સુપન કરી જાયા બે ।

ચોસ્રઠં ઇન્દ્ર મિલી બહુ ભગતે,

મેરૂ-શિખર નવરાયા બે-સેવો૦ ॥૨॥

અનુકંમે પૂરવ-પુણ્ય-વશે ^૧વરી, રાજ-લીલા ^૨વર-નારી બે ।

ભોગ ભોગવી વર-દાને વરસી,

વ્રત-લીલા અવધારી બે-સેવો૦ ॥૩॥

તપ કરી ઘન-ઘાતી-મલ ટાળી,

ઉજ્જવલ કેવલ પાયા બે ।

૧ મેળવી, ૨ શ્રેષ્ઠ નારી,

સમવસરથે બેઠા પ્રભુ શોભે,
 ચોવીશે જિનરાયા બે-સેવોં ॥૪॥
 ચોત્રીશ અતિશય જે પ્રભુ રાજે, પાંત્રીશ વચન વિરાજે બે ।
 મધુર-ધ્વનિ પ્રભુ-દેશના ગાજે,
 પ્રભુતા અધિકી છાજે બે-સેવોં ॥૫॥
 પૂજે પ્રભુમે જે પ્રભુ સમરે, ધ્યાને ધ્યાવે જુગતે બે ।
 હુઃખ-ઢોહગ તસ દૂર પણાસે,
 જો સેવે જિન ભગતે બે-સેવોં ॥૬॥
 ઇષ્ટિ પર ચોવીશે જિન ગાયા, ભાવ ભગતિ પરસંગે બે ।
 સત્તર પચાશે (૧૭૫૦) રહી ચોમાસે,
 માંગલોર મનરંગે બે-સેવોં ॥૭॥
 તપગન્ધ-^૩સિંધુ-^૪મુધાકર-સરીસા,
 શ્રી વિજયપ્રભ-સૂરિંદા બે ।
 તસ-પદ-ગયણુ-^૫પ્રભાકર-ઉદયા,
 શ્રી વિજયરત્ન-મુણિંદા બે-સેવોં ॥૮॥
 તેહ તણે રાજ્યે પંડિતવર, શાંતિવિમલ ગુરરાયા બે ।
 તસ બાંધવ બુધ કનકવિમલ-ગુર,
 સુરગુર-બુદ્ધિ-સવાયા બે-સેવોં ॥૯॥
 તાસ ચરણુ-પંકજ-સુપસાચે, કેશર-વિમલ ગુણુ ગાયે બે ।
 ભણે ગુણે જે જિનવરના ગુણુ,
 જનમ સફલ તસ થાયે બે-સેવોં ॥૧૦॥



૩ સમુદ્ર, ૪ ચંદ્ર, ૫ સૂર્ય,

કલશ

ઈમ વિશ્વ-નાયક મુગતિ-દાયક, શુણ્યા ચોવીસ જિનવરા ।

૧જિત-૩૫-રતિવર સયલ યતિવર,

શ્રી વિજયરત્ન-સૂરીશ્વરા ।

તસ તણે રાજે કવિ વિરાજે, શાંતિ-વિમલ બુધ-સિંધુરા ।

તસ સીસ કેશર-વિમલ કહે જિના,

સર્વ-સંઘ-મંગલ કરા. ॥૧॥

પરમાત્માની વંદના

“ જય ! જિનેંદ્ર !

જયોતિ સ્વરૂપી !

ભવ-ભય-વારણ !

ભવદુઃખ-વારણ !

શિવસુખકારણ !

જય જય શ્રી જિનેંદ્રાય નમઃ ! ”

૧ ૩૫થી રતિના વર-ધણી-કામદેવ, તે જિત્યો છે જેમણે

શ્રી વર્ધમાનસ્વામિને નમઃ
શ્રી કનકવિજયજી-કૃત
સ્તવન-ચોવીશી
(૪૨)

॥ સકલ-ભદ્રારક-ચક્ર-ચક્રવર્તી^૧ ભદ્રારક શ્રી ૧૯ શ્રી
વિજયસેન સૂરીશ્વર શિષ્ય । પંડિત શ્રીપ શ્રી ધીરવિજય
ગણી શિષ્ય । પંડિત શ્રીપશ્રી લાભવિજય ગણી શિષ્ય ।
પંડિત શ્રીપ શ્રી વૃદ્ધિવિજય ગણી ગુરુઓ નમઃ ॥

(૯૮૫) (૪૨-૧) શ્રી નંપભદ્રેવ-જિન સ્તવન
(કુંઞ્ચરજીની દેશી)

અરજ સુણો મુઝ સાહિબા !, ^૧અલવેસર અરિહંત-રિખલજી ।
મુઝ મનડું મોહી રહું, ^૨દરસણુ તુમ્હ દેખત-રિખલજી-

અરજ સુણો મુઝ સાહિબા. ॥૧॥

ખિણુ પણિ રાખ્યું નવિ રહઈ, ખેંચ્યું નવિ ખેંચાય-રિખલજી ।
કમલઈ ^૩મધુકરની પરઈ, અધિક રહું લલચાય-રિખલજી-

અરજ સુણો ॥૨॥

^૪સુખહેલી પામી કરી, નહિ ^૫કારેલી ચાહ-રિખલજી ।
સુરતરૂ છાયા છાંતી નઈ,

કિમ હુઈઆ ^૬કિં ^૭ભિમાહ-રિખલજી-અરજ સુણો ॥૩॥

૧ સર્વશ્રેષ્ઠ, ૨ નેત્ર=આંખ, ૩ ભમરો, ૪ સુખની ભરપૂર સ્થિતિ
૫ અશુભ સ્થિતિ, ૬ ક્યાં, ૭ ઉમંગવાળા,

હેવ અવર હીસઈં ઘણા, નહિ કોઈ આવઈ હાય-રિખભજી ।
જાઓ હીરો કર ચઢઈ, કાંકર કેમ લેવાઈ!-રિખભજી-

અરજ સુણો ॥ ૪ ॥

ઈમ જાણી સેવક તણો, ભાવ ભગતિ ભરપૂર-રિખભજી ।
કનકવિજય વહાલેસર, રાખો ચરણ હજુર-રિખભજી-

અરજ સુણો ॥ ૫ ॥



(૯૮૬) (૪૨-૨) શ્રી અજિતનાથ-જિન સ્તવન

(ઈડર આંખા આંખલી રે, ઈડર દાડિમ દ્રાખ-એ દેશી)
અજિત-જિણેસર ભેટીયો રે, મન-મોહન મહારાજ ।
અલવેસર અરિહંતજી રે, ગિરજો ગરીબ-નિવાજ-

સફલ મુઝ આજ થયો અવતાર ॥ ૧ ॥

^૧કરુણાકર ઠાકુર મિલ્યો રે, ^૨અડવડીયાં આધાર ।
મન-વંછિત સુરતરુ ફલ્યો રે, જે પામ્યો પ્રભુ હીદાર-

-સફલ મુઝ ॥ ૨ ॥

આજ પૂરવ-પુણ્યઈ કરી રે, મિલિયો મનનો મિત્ત ।
ચિત્ત ચરણે લાગી રહ્યું રે, અવર ન આવઈ ચિત્ત-

-સફલ મુઝ ॥ ૩ ॥

મણુસ-જનમ ફલ પામીઓ રે, જે નામિઓ પ્રભુ-પય સીસ ।
જો એ સાહિબ સુપ્રસન હસ્યઈ રે

તો કસ્યઈ ડસહી ઋગસીસ-સફલ મુઝ ॥ ૪ ॥

૮ સાચો.

૧ કરુણાનો ભંડાર, ૨ રખડેલ-નિરાધારના, ૩ ખરેખર, ૪ બક્ષીશ=ભેટ

ધર્મ ધંકતારી આઢરી રે, ધરતાં પ્રભુનું ધ્યાન ।

કનકવિજય કહ્યું પામીઈ રે,

અવિચલ પદ સુખધામ-સફલ મુઝઁ ॥ ૫ ॥



(૯૮૭) (૪૨-૩) શ્રી સંભવનાથ-જિન સ્તવન

(મારી સહી રે સમાણી-એ દેશી)

સંભવજિન ! તુમ્હર્યુ' લય લાગી,

ચિત્ત ૧ પ્રભુ-પય-અનુરાગી રે-જિનજી સુખકારી ।

પ્રેમઈ પ્રીતિ અખંડિત જાગી,

લય ભાવઈ સખ લાગી રે-જિનજી સુખકારી ।

હું જાનુ તુમ્હે બલિહારી રે જિનજી સુખકારી ॥૧॥

મુઝ મન મોહું તુઝ મુખ-મટકઈ,

લાગી ૨ લાલ ત્રિલોચન લટકઈ રે-જિનજી સુખકારી

અનોપમ ત્રિભુવન મોહઈ, સુંદર સૂરતિ સોહઈ રે

-જિનજી સુખકારી ॥ ૨ ॥

લાગ્યો રંગ ૩ અલંગ ૪ કરારી,

હું તન ધન મન જાગ્યો વારી રે-જિનજી સુખકારી ।

આંણી મન માંહઈ ૫ એક-તારી,

કીજઈ સેવા સારી રે-જિનજી સુખકારી ॥૩॥

દરસન દીઠઈ હું આનંદ,

પ્રભુ મોહન વલ્લી કંદ રે-જિનજી સુખકારી ।

૧ પ્રભુજના યરણોતો, ૨ લાલય, ૩ દૂર નહી તેવો, ૪ દંડ,
૫ એકાગ્રતા,

અલવેસર આતમ-આધાર,

ગિરુઓ ગુણ-ભંડાર રે-જિનજી સુખકારી ॥ ૪ ॥

વૃક્ષિવિજય કવિરાજનો સીસ,

માંગઈ એ ખગસીસ રે-જિનજી સુખકારી ।

કનકવિજય કહઈ કરુણા આણી,

દીજઈ અવિચલ-પદ ગુણ ખાણી રે-જિનજી સુખકારી ॥ ૫ ॥



(૯૮૮) (૪૨-૪) શ્રી અભિનંદન-જિન સ્તવન

(કાયલો પરવત ધૂંધલો રે લો એ દેશી)

કર જોડી કરું વિનતી રે લો, છાંડી મન અભિમાન રે-વાલ્હેસર ।

મહેર કરો મુજ ઉપરઈ રે લો,

ગિરુઆ ન ધરઈ ૧ ગુમાન રે રે-વાલ્હેસર-

-અભિનંદન અવધારિઈ રે લો ॥ ૧ ॥

હું અપરાધી ૨ સો પરઈ રે લો, તુઝ સેવાથી દૂર રે-વાલ્હેસર ।

જનમ સકલ ૩ એલે ગમ્યો રે લો,

નાળ્યો ચરણ હજૂર રે-વાલ્હેસર-અભિનંદન ॥ ૨ ॥

ચાહ ઘણી ચિત્તમાં હુંતી રે લો,

આવવા તુમ્હ પય પાસ રે-વાલ્હેસર ।

પણિ અંતરાય તણુઈ વશઈ રે લો,

નવિ પૂગી મન આશ રે-વાલ્હેસર-અભિનંદન ॥ ૩ ॥

તુઝ કીરતિ જગી ઉજલી રે લો,

તઈ સાર્યા કેઈનાં કાજ રે-વાલ્હેસર ।

૧ અભિમાન, ૨ ખરેખર, ૩ વ્યર્થ-નકામો,

તોએ સેવક પશ્ચિ તારિઈ રે લો,

તુમહે છો ગરીબ-નિવાજ રે-વાલ્હેસર-અભિનંદન૦ ॥૪૧॥

પરમ-સનેહી સાહિબા રે લો, શરણાગત-આધાર રે-વાલ્હેસર ।

સુખ સંગતિ નિત પૂરિઈ રે લો,

કનકવિજય જયકાર રે-વાલ્હેસર-અભિનંદન૦ ॥૪૨॥

★

(૯૮૯) (૪૨-૫) શ્રી સુમતિનાથ-જિન સ્તવન
(દેશી હલૂરની)

પ્રભુ સુમતિ-જિનંદાણ, સુખ પુનિમ ચંદાણ ।

લોચન અરવિંદાણ, સાહિબ સુખ ચંદાણ ॥ ૧ ॥

મન-મોહનગારાણ, આતમ આધારાણ ।

બલિહારી કરી જઈણ, તન-મન વારી જઈણ ॥ ૨ ॥

વિનતિ અવધારોણ, નવિ અવર વિચારોણ ।

મિલિઈ ૧ વિષુ લેદઈણ, સેવું એણી ઉમેદણ ॥ ૩ ॥

રચિતિ કરુણા આણીણ, નિજ સેવક જાણીણ ।

કરો એ સુપસાયણ, ગિરુઆ જિનરાયાણ ॥ ૪ ॥

મહીમાં હઈ જે મોટાણ, તે નવિ હુઈ ખોટાણ ।

કીધી સેવા જાણુઈણ, બહુ હક નવિ જાણુઈણ ॥ ૫ ॥

હુઈ પર-ઉપગારીણ, સેવક સુખકારીણ ।

ઇમ જાણી ભગતિંણ, સેવા કરિઈ જુગતિંણ ॥ ૬ ॥

સાહિબ અંતરજામીણ, કહઈ કનકે શિર નામીણ ।

મહિમા મત વાલાણ, કરો મહિર મયાલાણ ॥૭॥

★

૧ લેદ-આતરાવિના, ૨ મનમાં

(૯૯૦) (૪૨-૬) શ્રી પદ્મપ્રભ-જિન સ્તવન

(આલો સખી મિલિ દેહરેઈ-એ દેશી)

પદ્મ-પ્રભ-જિનરાયજી, તુમ્હ સેવા કિમ કીજઈ રે ?

ફર રહ્યાંથી શી પરઈ ? ભાવ ભગતિ ફલ લીજઈ રે-

-પદ્મપ્રભ જિનરાય જી ॥ ૧ ॥

અહનિશિ સાહિબ ! તું વસઈ, અ-ગમ અ-ગોચર ઠામઈ રે !

ભારી કરમી જીવ જે, તે કિમ દરસણુ પામઈ રે ? પદ્મ પ્રભ ॥ ૨ ॥

આવી ન શકું તુમ્હ કનઈ, આપ-બલઈ અરિહંત રે ।

પણિ ખાંદા ગ્રહીનઈ તારવા,

સાહિબ છો બલવંત રે-પદ્મ પ્રભ ॥ ૩ ॥

જાણી સમરથ સવિ પરઈ, સેવા કીજઈ સાર રે ।

૧ ભેડિ-પૂંછિ ભાડુવ નદી,

કુણુ ગ્રહી ઉત્તરયો પાર રે-પદ્મ પ્રભ ॥ ૪ ॥

અવસર આણી ચિત્તમાં, એ સેવક અરદાસ રે ।

પરગટ દરસન આપીઈ,

કનકે વિજય એ આસ રે-પદ્મ પ્રભ ॥ ૫ ॥

(૯૯૧) (૪૨-૭) શ્રી સુપાર્શ્વનાથ-જિન સ્તવન

(વારી હો ભમરલાલ કુંઠઈયા-એ દેશી)

અલવેસર અરિહંતજી હો ! લાલ ! વાલહા !,

મોહન મહિમાગાર હો લાલ ।

૧ ભેડ=ઘેડું તેના પૂંછને પકડી ભાડુવ=મોટી નદી કોણ પાર ઉતરી શકે ? (ચોથી ગાથાના ઉત્તરાર્ધનો અર્થ)

સાહિબ સુપાસજિન ! ૧ બાલ જઈઈ,
 તુમ્હ હરસન સુખ ઉપજઈ હો લાલ-વાલહા ।
 જિમ મોર દેખઈ જલધાર હો લાલ,
 સાહિબ સુપાસ જિન બાલી જઈઈ
 માહરા મનડાના માન્યા-લાલ,
 ચિતડાના ચાહ્યા-લાલ,
 આંખડીના ૨ કોયા-લાલ,
 પ્રાણિયાના પ્યારા-લાલ,
 આતમાના પ્યારા લાલ,
 મિત્ત હો લાલ-

-સાહિબ સુપાસ૦ : ૧૧ ૧ ૩

ચંદ-ચકોર તણી પરઈ હો લાલ-વાલહા,
 જિમ મધુકર-અરવિંદ હો લાલ-સા૦ ।
 માનસ દેખી હંસનઈ હો લાલ-વાલહા,
 જિમ ગોપી-ગોવિંદ હો લાલ-સાહિબ સુપાસ૦ ૥૨૥

સુંદર સૂરતિ તાહરી હો લાલ-વાલહા,
 તેજ અધિક દીપંત-હો લાલ સા૦ ।
 લોચન અમિય કચોલડાં હો લાલ વાલહા,
 અતિઘણા હો ૩ જિહ્વિસંત હો લાલ-સાહિબ સુપાસ૦ ૥૩૥

પ્રભુ ! તુમ્હ હોડિ કરઈ ઘણા હો લાલ-વાલહા !,
 દેવ અવર લખ કોડિ હો લાલ-સાહિબ સુપાસ૦ ।

૧ બારી=ઓવારો-જઈએ, ૨ કીકી, ૩ ખૂન વધારે,

પશ્ચિ તે ન લહઈ ખરોખરી હો લાલ-વાલહા,

જિમ કંચન-કાચની જોડિ હો લાલ-સાહિબ-સુપાસં ॥૪૧॥

સેવો સુરમણિ સારિખો હો લાલ-વાલહા,

તું વંછિત-દાતાર હો લાલ-સાહિબ-સુપાસં ।

તું દિલજની આતમા હો લાલ-વાલહા,

કનકવિજય જયકાર હો લાલ-સાહિબ-સુપાસં ॥૪૨॥



(૯૯૨) (૪૨-૮) શ્રી ચંદ્રપ્રભ-જિન સ્તવન

(દેશી રસિયાની)

ચંદ્ર પ્રભ-જિન ચરણની ચાકરી, કીજઈ ચિત ધરી ચાહ-ઘણેરી ।

છાંડી સંગતિ દેવ અવરતણી, જે ન કરઈ ? નિરવાહ રસહી કરી-

-ભાવઈ વંદું જિનવર આઠમે ॥ ૧ ॥

જે જણુ જણુ નાહો દીસઈ કણુ વડા,

જે પડયા પરવશ દેવ-જગતમાં ।

જે સમરથ નહિ કારિજ સાધવા,

શ્યું કીજઈ ? તસ સેવ નિરંતર-ભાવઈ વંદું ॥ ૨ ॥

જે ઘર ઘરના હો ! દીસઈ પાહુડા, લોભી લંપટ જેહુ-વિશેષઈ ।

મેહ-વિહૂણા હો ! ૩ જનનઈ રીઝવઈ,

જગ ધૂતારા રે તેહ-અ-લેખઈ ભાવઈ વંદું ॥૩॥

એહવા દેવની સેવા પરિહરી, દેવના દેવ કીધ-હરખ ધરી ।

સેવ્યાં જેથી વંછિત પામીઈ,

લહીઈ જસ પરસિદ્ધ-અધિકતર ભાવઈ વંદું ॥૪॥

૧ કાર્યસિદ્ધિ, ૨ ખરેખર, ૩ લોકોને રાજી કરનારા,

ત્રિકરણ-શુદ્ધિ ઇષ્ટિ પરિ સેવતાં,

પ્રભુ ! પૂરિઈ કામિત કોડ-કૃપાનિધિ ।

નિજ-પય-પંકજ-સેવા આપીઈ,

કહઈ કેનકે વિજય કરજોડ-જયંકર ભાવઈ વંદું ॥૫॥



(૯૯૩) (૪૨-૯) શ્રી સુવિધિનાથ-જિન સ્તવન

(નીંદલડી વઈરિણી હુધ રહી-એ દેશી)

સુવિધિ જિણુંદ તુમ્હ ચાકરી,

કિમ કીજઈ ? હો ! ત્રિભુવનના નાથ ! કઈ ।

તું નિરાગી હું રાગીઓ,

૧કિમ વાજઈ હો ! તાલી એકણિ હાથ ! કઈ—

—શુણ ગિરૂઆ હો, આતમ આધાર,

અરજ સુણો મહારાજણ ॥૧॥

ઘોડો ઢોડી ઢોડી મરઈ, નવિ આણઈ હો ! મનમાં અસવાર કઈ ।

પ્રેમઈ પતંગ પડઈ સહી, નવિ જાણઈ હો !

દીવો નિરધાર કઈ-અરજ સુણો ॥૨॥

નિરખઈ ન તું રનેહઈ કરી, વલી ન ધરઈ હો !

ચિત્તમાં હઈ પ્રેમ કઈ ।

એક-પખી પ્રભુ ! પ્રીતડી, કિમ નિરવહઈ ? હો !

જિનણ અવધારિ કઈ-અરજ સુણો ॥૩॥

૧ એક હાથે તાલી કેમ વાજે ? (પ્રથમ ગાથાની ચોથી લીટીનો અર્થ) ૨ રનેહથી,

૩ અંતર-ગત તો તાહરો, સહુ સાથઈ હો !

સરિખો છઈ ને કઈ ।

તે જાણી નઈ કીજઈ, તુમ્હ સેવા હો !

સાહિબ શુભ-ગેહ કઈ-અરજ સુણો ॥૪૧॥

અધિક ન માંગું તુમ્હ કનઈ, સેવક જાણી હો !

સખો ૪ નિજ-પય પાસ કઈ ૬

કેનકવિજય નિત આપીઈ, સુખ સંપતિ હો !

ખહુ લીલ-વિલાસ કઈ-અરજ સુણો ॥૪૨॥



(૯૯૪) (૪૨-૧૦) શ્રી શીતલનાથ-જિન સ્તવન

(“ દેશી મન ભમરા રે ”)

શીતલ-જિન-મુખ-પંકજઈ-મન ભમરા રે,

લીનો દેખી સરૂપ લાલ-મન ભમરા રે ।

પરમાનંદ પદ ૧ રુઅડું-મન૦,

પરિમલ જાસ અનૂપ લાલ-મન ભમરા રે ॥૧॥

૨ જેહ પ્રકાશ રહઈ સદા-મન૦,

નવિ હુઈ કહિઈ મલિન-લાલ-મન૦

અવર પંકજ એ સમ નહી,

જે ચંદ-કિશ્કુ કરી હીન-લાલ-મન૦ ॥૨॥

૩ આધ્યાત્મિક રીતે, ૪ પોતાના પગની પાસે.

૧ સરસ, ૨ જે (પ્રભુનું) મુખકમલ) સદા ખીલેલું રહે તથા ક્યારેય મલિન ન થાય તેમજ ચંદ્રના કિરણથી શોભા વગર થતું નથી, માટે ખીલ કમલ જેવું આ કમળ નથી, (ખીલ ગાથાનો અર્થ)

રંગઈ રાગ્યો સૂઅડઈ-મન૦,

રસ વશ રસિઓ એમ-લાલ-મન૦ ।

અવર ન કેા તુઝનઈ ગમઈ-મન૦

પ્રગટ્યો પૂરણુ પ્રેમ-લાલ-મન૦ ॥૩॥

અહુનિશિ લોલામણો રહઈ-મન૦

આલસ અલગો નિવેધી-લાલ-મન૦ ।

સુમન સકલ ફરઈ તણ-મન૦,

વેધાણો ઇણિ વેધી-લાલ-મન૦ ॥૪॥

જાતા-જોય બેહુ મિત્યઈ-મન૦,

સીઝઈ વંછિત કામ-લાલ-મન૦ ।

કુનકેવિજય સુખ પામીઈ-મન૦,

પામીઈ અવિચલ-ઠામ-લાલ-મન૦ ॥૫॥



(૯૯૫) (૪૨-૧૧) શ્રી શ્રેયાંસનાથ-જિન સ્તવન

(રાજજી આયા દેશમાં રાણી મહિલ તમારો હો)"-એદેશી)

શ્રી શ્રેયાંસ જિણુંદજી! મુજ મુજરો માનો હો,

સાહિબ! તુમ્હ પય લેટવા ચિત લાગો જે તાનો હો !

અંતરજામી આતમા તે રયું તુમ્હથી છાંનો હો !,

પાર નહી તુમ્હ જ્ઞાનનો તિમ વલી મહિમાનો હો !-

-શ્રી શ્રેયાંસ૦ ॥૧॥

તુમ્હ વિણુ પ્રભુ! હવઈ 'અવરનઈ' નવિ નામું સીસ હો !,

મન-વચ-કાયા થિર કરી સેવું રવિસવાવીસ હો ! ।

૧ બીજાને, ૨ સંપૂર્ણપણે,

તન-ધન-મન માહરો તુંહી જ જગદીશ હો !,
સૂતા-જાગતાં સાંભરઈ ધક તું નિસિ-દીસ હો-

શ્રી શ્રેયાંસં ૧૨૧

મુઝ ચિત્ત તુમ્હ ચરણે વસ્યું, ઉલસ્યું મહારાજ હો !,
મહિર કરો મુજ ઉપરઈ, ગિર્યા જિનરાજ હો ! !
આપો ચરણની ચાકરી, તુમ્હે ગરીબ-નિવાજ હો !,
મામ વધારો માહરી સારો વંછિત કાજ હો—


શ્રી શ્રેયાંસં ૧૨૩

તુમ્હ સરિખો દાતા પ્રભુ ! ત્રિભુવનિ નવિ દીસઈ હો !,
૪ ધક-રંગઈ આદર કરી સેવું સુ-જગીશઈ હો ! !
પર-ઉપગારી સાહિબો દેખખઈ દિલ હીંસઈ હો !,
સેવક કહીઈ પશ્રી-મુખિં મનની બગસીસઈ હો !—

—શ્રી શ્રેયાંસં ૧૨૪

કમીનતિ કરઈ બહુ પરઈ, વિનતિ અવધારો હો !,
અલવેસર અરિહંતજી ! મનથી ન વિસારો હો ! !
કહઈ કનક-વિજય કરૂણા કરી, ભવ-પાર ઉતારો હો !,
પતિત-પાવન નિજ-નામનું પ્રભુ ! બિરુદ સંભારો હો !—

—શ્રી શ્રેયાંસં ૧૨૫



૩ શીલા, ૪ એકતાનથી, ૫ આપના મુખથી, ૬ આજીજી,

(૯૯૬) (૪૨-૧૨) શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન

(ચોગીસર ચેલ-એદેશી)

વાસુપૂજ્ય-જિનરાજજી રે, સેવક તુમ્હ દરબાર રે—
વાલ્હેસર જિનજી ।

લાખ ગમે સેવા કરઈ હો ! લાલ !

ઠંકુરાઈ તાહરી ઘણી રે કહંતા ન લહું પાર રે-વાલ્હેસર !

૧હસિત વદન શોભા ધરઈ હો લાલ,

તું ૨મહીમાં મહિમા નીલો રે

સોભાગી-સિરદાર-રે, વાલ્હેસર !,

દેવ સહુમાંહઈ દીપતો હો ! લાલ !,

મનમોહન તું સાહિબો રે; તું વંછિત-દાતાર રે વાલ્હેસર !

તેજઈ ત્રિભુવન જીપતો-હો લાલ ॥૧૧॥

તુમ્હ સુર-નર-અસુર પૂજા કરઈ રે,

ખિણુ નવિ છાંડઈ પાસ રે-વાલ્હેસર !,

અણહુંતઈ કોડિ ગમે હો લાલ,

તુમ્હ આણા સહુ અણુસરઈ રે—

ધરતા બહુ પરિ આશ રે-વાલ્હેસર ।

લગૌ લગી તુઝ પાયે નમઈ હો લાલ—

તુઝ પ્રતાપ ઈરવિ પરિતપઈ રે,—

તઈ મોદ્યા મુનિ મહંત રે-વાલ્હેસર,

તુમ્હ શુણ-પાર ન કો લહઈ હો લાલ,

૧ પ્રજ્ઞન, ૨ પૃથ્વીમાં, ૩ સૂર્યની જેમ,

તુમ્હે જશ જગમાં ગાજીઓ રે—

અલવેસર અરિહંત રે,—વાઢેસર ।

તુમ્હે ચરણે ચિત્ત લાગું રહ્યું-હો લાલ ॥૨॥

જિમ હું આહું તુમ્હનર્થ પ્રભુ રે.

તિમ તું નવિ આહ્ય મુઝ રે—વાઢેસર ।

તું સહુનર્થ સરિખા ગણ્યું હો લાલ,

અંતરગત તુમ્હે વાતડી રે—

કિમ કરિ જાણ્યું ય અ-ખુઝ રે ?—વાઢેસર !,

જે કંચન—કાંકર સમ ગિણ્યું હો લાલ !,

વિનતડી અવધારિય રે.

ઠારીય તન-મન પ્રાણ રે—વાઢેસર ।

બલિહારી તુમ્હે કીજ્યું હો ! લાલ.

સેવક કાજ સુધારિય રે,

તુમ્હે છો ચતુર-સુજાણ રે—વાઢેસર ।

દિલ ખોલી દરસણ દીજ્યું-હો લાલ ॥૩॥

પનેહ-નિજરિ કરી નિરખિય રે,

પરખિય ખિજમતિ ખાસ રે—વાઢેસર ।

દેઈ દરિસણ દિલઠારી રહો-લાલ,

સેવક જાણી આપણો રે—

રાખીય નિજ પય પાસિ રે—વાઢેસર ।

અંતર દૂર નિવારિય હો લાલ !

છાંડી અવરની ચાકરી રે,

૪ અઝાની, ૫ રાગવાળી નજરથી

માંડી તુમ્હસ્યું પ્રીતિ રે—વાલ્હેસર,
રંગ મણ્ઠ તણી પરધં હો લાલ !

લાગો રંગ ન ક પાલટઈ રે,
જીવ જિહાં લગિ ઢેહ રે, વાલ્હેસર ।
હું વારી જાઉં તુમ્હ ઉપરધં હો ! લાલ ! ॥૪૮॥
ગુણ-નિધિ ! તુમ્હ ગુણ સાંભરધં રે;
પલ-પલમાં સો વાર રે—વાલ્હેસર ।

તુમ્હ દીઠઈ દિલ ઉલ્લસઈ હો ! લાલ !,
તુમ્હ વાણી સરસ સુધા સમી રે,
સુખદાયક નિરધાર રે—વાલ્હેસર ।
ચિત્તથી નવિ દૂરધં વસઈ હો ! લાલ !,
તું તન ધન મન માહરો રે,
તું આતમ આધાર રે—વાલ્હેસર ।
જમ્હિર કરીનઈ નિવાણઈ હો ! લાલ !,
કેનકેવિજય પ્રભુ તાહરો રે,
જપિઈ જાપ ઉદાર રે—વાલ્હેસર ।
પરમાનંદ પદ દીણઈ હો લાલ ! ॥૫૦॥



(૯૯૭) (૪૨-૧૩) શ્રી વિમલનાથ-જિન સ્તવન
(દેશી ફાગની)

વિમલ વિમલ-જિન મધુરી વાણી, આણી હૃદય-મઝારિ ।
ભાવ ધરી તુમ્હે ભવિજન પ્રાણી. આરાધો કરીય ? કરાર—

ક દૂર થાય નહીં, ૭ મહેરબાની-કૃપા ૧ નિર્ણય,

રંગઘં પ્રભુ સુખ દેખી રાચીઈ હો !

અહો ! મેરે સાહિબ

ઝમાચીઈ મનિ ધરી ધ્યાન,

રંગ પ્રભુ સુખ દેખી રાચી રહો ॥ ૧ ॥

નિરમલ બ્રહ્મ થકી જે પ્રગટી, પરમહંસ જસ વાહ ।

સકલ વિગુણ-જન-મનમાં માની,

છાની નહી જે જગમાંહિ-રંગઘં ॥ ૨ ॥

૪ મોહ-અ-ખોહ મહાતમ રવિસમ, સરસ સુધા-રસ સાર ।

નૈગમ પ્રભુ-સુખ અ-ગમ નય જેહવી,

પામીય પ્રગટ ઉદાર-રંગઘં ॥ ૩ ॥

૫ ધન-ગંભીર ધીર ક્ષુનિ જેહની, ૭ કલિ-કલ્મષ-દવ-નીર ।

ભવ-ભય—તાપ—સંતાપ—નિવારણ,

શીતલ જેહ પટીર-રંગઘં ॥ ૪ ॥

ગુણ અનંતમય વચન પ્રભુજી, લાખી દીજઈ દિલાસ ।

કનકવિજય કહઈ કરજોડી નઇ,

આપીઈ સુજશ વિલાસ-રંગઘં ॥ ૫ ॥



(૯૯૯) (૪૨-૧૪) શ્રી અનંતનાથ-જિન સ્તવન

(થારા મહેલા ઉપરિ મેહ ઝરોંખધ વીજલી હો લાલ-એ દેશી)

અનંતનાથ-જિનરાજ કરું હું વિનતી

હો ! લાલ ! કરું હું વિનતી,

૨ ઉમંગ પૂર્વક, ૩ મરત થવું, ૪ મોહથી ક્ષોભ ન પામે તેવું
જેમતું માહાત્મ્ય છે, ૫ મેધની જેમ ગંભીર, ૬ ક્ષુનિ ૭ અરાધ
પાપ ૩૫ દાવાનલ માટે પાણી જેવા, ૮ અંદન

મનમોહન મહારાજ જે મુઝ મનમાં,
 હુંતી હો ! લાલ ! મુઝ મનમાં હુંતી !
 મોહ લગાડી ૧ મોહિ કઈ રહેહ ન દીજઈ,
 હો લાલ ! છેહ ન દીજઈ,
 પ્રેમ ધરી ચિત્તમાંહિ કઈ કરુણા કીજઈ,
 હો લાલ ! કઈ કરુણા કીજઈ ॥ ૧ ॥

અવર ઝઢેવ-ધર દ્વાર તણ ઈક તાહરી
 હો ! લાલ ! તણ ઈક તાહરી,
 કરઈ અહનિશિ સેવ કઈ મનિ આશ્યા ધરી
 હો ! લાલ ! કઈ મનિ આશ્યા ધરી !
 આપીઈ નિજપય-સેવ કઈ દેવ ! વિનતિ કરી
 હો ! લાલ ! કઈ દેવ વિનતિ કરી,
 માંગીઈએ નિતમેવ કઈ કર જોડી કરી
 હો ! લાલ ! કઈ કર જોડી કરી ॥ ૨ ॥

ઉત્તમ નર હુંઈ જોહ તે સેવાફલ કિઈ
 હો ! લાલ ! તે સેવા ફલ કિઈ,
 ખાલી ખિજમતી જોય કઈ અપજશ નવિ લિઈ
 હો ! લાલ ! કઈ અપજશ નવિ લિઈ
 આન્યઈ અવસરઈ સાર કરઈ, સેવક તણી
 હો ! લાલ ! કરઈ સેવક તણી,
 ઉપગારી-સિરદાર કઈ જે ત્રિભુવન-ધણી
 હો ! લાલ ! કઈ જે ત્રિભુવન ધણી ॥ ૩ ॥

૧. મને ૨. વિયોગ ૩. મંદિરોનાં આરણાં

જેહસ્યું જેહની પ્રીતિ તે ચાહઈ તેહનઈ

હો ! લાલ ! તે ચાહઈ તેહનઈ,

છાંડી અવર ૪જલ-ઠામ ચકોર જિમ મેહનઈ હો !

લાલ ! ચકોર જિમ મેહ નઈ ।

કમલ ૫મુદિત રવિ દેખિ, કુમુદ જિમ ચંદનઈ હો !

લાલ ! કુમુદ જિમ ચંદનઈ,

લાસુર સુર-ગણુ જેમ કઈ વિલસઈ નંદનઈ હો !

લાલ ! કઈ વિલસઈ નંદનઈ ॥ ૪ ॥

તિમ લાચું તુમ્હ પયઈ ચિત્ત કઈ ટાલું નવિ ટલઈ હો !

લાલ ! કઈ ટાલું નવિ ટલઈ,

સુપન માંહઈ સો વાર કઈ, તુમ્હસ્યું જઈ મિલઈ હો !

લાલ ! કઈ તુમ્હસ્યું જઈ મિલઈ ।

કનકવિજય કહઈ દેવ અરજ અવધારિઈ હો !

લાલ ! અરજ અવધારિઈ,

પરગટ આપી ભેટિ કઈ તન-મન ઠારિઈ હો !

લાલ ! કઈ તન મન ઠારિઈ ॥ ૫ ॥



(૯૯૯) (૪૨-૧૫) શ્રી ધર્મનાથ-જિન સ્તવન
(ખેડલઈ ભાર ઘણો છઈ રાજિ વાતાં કેમ કરો છો-એ દેશી)
ધર્મ-જિણેસર સાહિય, મનમાં ધરઈ, ઇંક તુમ્હ ધ્યાન ।
અલવેસર ! વાલ્હેસર ! જિનજી ! કરિઈ તુમ્હ ગુણુ-ગાન-
પ્રભુજી ! અરજ કરી જઈ રાજ ! સુઝ પર મહિર કરી જઈ ।

૪. સરોવરો ૫. ખીલેલ ૬. નંદનવનમાં.

-સેવક દિલ સંભારો રાજ ! ચિત્તમાં ચાહુ ધરી જઈ
પ્રેમ નિજર કરી ઠારો રાજ, હિયડેઈ હેજ ધરી જઈ ॥૧॥
અમ્હ મન-મંદિરમાં હઈ વસતાં, સ્યું મન વાત ન જાણો !
કૃપા કરીનઈ હરસણુ દીજઈ,

અતિધણો હઠ નવિ તાણો-પ્રભુજી ॥ ૨ ॥
તુમ્હ મુખ-પંકજ જોવા કાજઈ, જે અમ્હ લાગો તાનો !
મહિમા-નિધિ મનમોહન જિનજી !,

તે સ્યું તુમ્હથી છાનો ?-પ્રભુજી ॥ ૩ ॥
નેક-નજર કરી નેહઈ નિરખો, સેવક-જન સંભારી !
સહજ-સલૂણા અંતરજામી,

કીજઈ તુમ્હ બલિહારી-પ્રભુજી ॥ ૪ ॥
તું તન ધન મન તું દિલયાની, તું આતમ-અધાર !
જગજીવન જિનજી ! તુમ્હ નામઈ,
કનકેવિજય જયકાર-પ્રભુજી ॥ ૫ ॥



(૧૦૦૦) (૪૨-૧૬) શ્રી શાંતિનાથ જિન સ્તવનઃ
(પીછાલારી પાલિ આંખા દોઈ રાવલા મહારા રાજ એ દેશી)
અચિરા-સુત મુખકાર પ્રભુ ! તું માહરો-મહારાજ !,
ભગત-વછલ ભગવંત હું સેવક તાહરો-મહારાજ !
તુઝ વિણ અવર ન કોય કઈ મુઝ મનડું હરઈ-મહારાજ !,
તુમ્હ દીઠઈ જિનરાજ લોચન દોય મુઝ ઠરઈ-મહારાજ ! ॥૧॥
લાગી તુમ્હસ્યું પ્રીતિ તે ટાલી નવિ ટલઈ-મહારાજ !,
નેહ-વિસૂધું ચિત્ત તે અવરસ્યું નવિ મિલઈ-મહારાજ !

સૂતાં-ભગતાં એક તું અહનિશિ સાંભરઈ-મહારાજ !,
 તુમ્હ દીઠઈ મુઝ હોય, હરખ-ભર બહુ પરઈ-મહારાજ ! ॥૨॥
 તુમ્હ લોચન ^૧જલ-જ સમાન, વદન ^૨શારદશશી-મહારાજ !,
 તુઝ સોહઈ રૂપ અનૂપ, ખીળું એહવું નહી-મહારાજ ! ।
 તુઝ અભિનવ-ગુણ-સમુદાય, કહ્યો બાઈ નહી-મહારાજ ! ॥૩॥
 તુજ તેજ ઝિગમગ જોતી ^૩તરણિ જિમ ઝલહલઈ-મહારાજ !,
 પરગટ તુમ્હ ^૪પરતાપ દુરિત જેહથી ટલઈ-મહારાજ ! ।
 તુમ્હ નામઈ નવનિધિ હોય સંકટ સવિ ઉપશમઈ-મહારાજ !,
 સુર-નર-કિંનર કોડિ આવી પાએ નમઈ-મહારાજ ! ॥ ૪ ॥
 ચાહુ ધરી ચિત્ત એહ માંગું ત્રિભુવન-ધણી !-મહારાજ !,
 આપો કરી સુ-પસાય સેવા નિજ પય તણી-મહારાજ ! ।
 કનકવિજય કર જોડી કઈ ઈમ ભાવઈ કહઈ-મહારાજ !,
 જે સેવઈ પ્રભુ-પાય તે સુખ સંપત્તિ લહઈ-મહારાજ ! ॥ ૫ ॥



(૧૦૦૧) (૪૨-૧૭) શ્રી કુંથુનાથ જિન સ્તવન
 (દેશી વિણ્જનરાની)

જિનરાયાજી કુંથુ-જિણુંદ દયાલ, ^૧મહિર કરોજી મુઝ ઉપરઈ,
 -જિનરાયાજી જિનરાયાજી ।

તું પ્રભુ ! પરમ-કૃપાલ !

તું સેવક-જન સુખ કરઈ-જિનં જિનં ॥૧॥

તુમ્હ ચરણે મુઝ વાસ, દાસ અછું હું તાહરો-જિનંજિનં !

૧. કમલ, ૨. આસો સુદ પૂનમના, ૩. સૂર્ય, ૪. પ્રભાવથી
 ૧. મહેરબાની,

પલક ન છોડું પાસર,

જિમ જાણેા તિમ ઉદ્ધરો-જિનંજિનં ॥ ૨ ॥

અઉરાશી-લખયોનિ, અઉ-ગતિમાં ભમતાં લહ્યો-જિનંજિનં ।

નિરુપમ તુમ્હ^૩ હીદાર,

મુઝ મનમાં થિર થઈ રહ્યો-જિનંજિનં ॥ ૩ ॥

અવસરઈ લહી સંયોગ,

જે મૂરખ અ^૪-ફલો ગમઈ-જિનંજિનં ।

ફિરી પછિતાવઈ તેહ,

નરક-નિગોહમાંહઈ ભમઈ-જિનંજિનં ॥ ૪ ॥

અ^૫-વિહડ જિમ ફકરે-રેખ,

તિમ લાગેા નેહ તે નવિ ટલઈ-જિનંજિનં ।

પણિ પ્રભુ જો હુઈ તુમ્હ નેહ,

તો કનકેવિજય વંછિત ફલઈ-જિનંજિનં ॥ ૫ ॥

(૧૦૦૨) (૪૨-૧૮) શ્રી અરનાથ-જિન સ્તવન
(દેશી વીંછિયાની)

અર-જિન મુઝ મનમાં વસ્યો, વિહસ્યો અતિ આતમરામ રે ।
હરખ ઘણેા હિય ઉલસ્યો,

શ્રવણે સુણતાં પ્રભુ નામ રે-અરં ॥૧॥

જુગ જો જાઈ કેઈ વહી, તોહઈ ન મિટઈ જે લાગેા રંગ રે ।

વેધક વિષુ જાણુઈ નહી, પ્રીતિ રીતિ તણેા પરસંગ રે-અરં ॥૨॥

પામી સુગુણી ગોઠડી, કહો કિમ કરિ મૂકી જાય રે ।

૨. પડખું, ૩. ચેહરો, ૪. નિષ્ફળ, ૫. ન ફરે તેવી, ૬. હાથની રેખા.

સુશુણ્ણ-સાથઈ અણ્ણમિદ્યાં,

ખિણ્ણ ઇક વરસાં સો થાય રે-અર૦ ॥૩॥

સાસ-ઉસાસઈ સાંભરઈ, પલ-પલ માંહઈ સો વાર રે ।

વીસાર્યા નવિ વીસરઈ, જે હુઈ આતમ આધાર રે-અર૦ ॥૪॥

સુશુણ્ણ સનેહી વાલહો, હિયડઈ ધરતાં જસ ધ્યાન રે ।

કનકવિજય કહઈ પામીઈ,

પરમોદય-પદ સુખ થાન રે-અર૦ ॥૫॥



(૧૦૦૩) (૪૨-૧૯) શ્રી મલ્લિનાથ-જિન સ્તવન

(થાંરી આંખડી થાંરો ઠંઠો પાણી લાગણો માંજી-એ દેશી)

પ્રભુ મલ્લિ-જિણેસર ભુવન-૧દિણેસર ડેવ રે-સોભાગી,

સુર-નર-વિદ્યાધર કિંનર સારઈ સેવ રે-સોભાગી ।

નીલ-રયણ-વરણ તનુ^૧ છળિ અતિરાજઈ બહુપરઈ-સોભાગી,

જસ સુંદર^૨ સૂરતિ મોહન મૂરતિ મનહરઈ-સોભાગી ।

સોભાગી રે....

શુણ્ણરાગી રે

વૈરાગી રે

વડભાગી રે

સોભાગી. ॥૧॥

જે રુપ-૪પુરંદર શુણ્ણ-માણ્ણ-મંદિર દીપતો-સોભાગી,

છાંડી સહુ છલનઈ^૩ પરતિપતિ બલનઈ જીપતો-સોભાગી ।

૧ સૂર્ય, ૨ કાંતિ, ૩ ચહેરો, ૪ ઈંદ્ર, ૫ કામદેવ,

મિથ્યામતિ ભેદી આગમ વેદી-અભિનવો-સોભાગી,
 ભવિ ભાવ ધરીનઈ એ સાહિબના ગુણ થવો-સોભાગી૦ ॥૨૧॥
 દુઃખ-દોહડ વારણ ભવ-જલ-તારણ એ સમો-સોભાગી,
 નવિ ખીજા કેઈ જુગતઈ જોઈ એહુનઈ નમો-સોભાગી ।
 બહુ પુણ્યઈ ૬ કામ્યો નરભવ પામ્યો ૭ કાંગડો-સોભાગી,
 ભોલાજન ભમતા જણુ-જણુ નમતાં કાં ભમો-સોભાગી૦ ॥૨૩॥
 છાંડી અવરની સેવા દેવના દેવની કીજઈ-સોભાગી,
 મન ધરિય ૮ ઉમાહો અવસરઈ લાહો લીજઈ-સોભાગી ।
 નિત જે ચિત માંહઈ મનહ મનોરથ કીજઈ-સોભાગી,
 જસ ૯ પય-કજ સેવ્યાં ૧૦ નિહચઈ કર તે પામીઈ-સોભાગી ॥૨૪॥
 ઈમ જાણી આણી હિયઈ અધિક વિસવાસ રે-સોભાગી,
 ચિત ચાહ ધરી પ્રભુ-સેવા કીધી ખાસ રે-સોભાગી ।
 કહઈ કરજોડી વૃદ્ધિ વિજય-કવિ સીસ રે-સોભાગી,
 સ-સનેહા સાહિબ પૂરીઈ અમ્હ સુ-જગીશ રે-સોભાગી૦ ॥૨૫॥

~

(૧૦૦૪) (૪૨-૨૦) શ્રી મુનિસુવ્રત-જિન સ્તવન

(આજ હજારી ઢાલો પાહુણો એ-દેશી)

મુનિસુવ્રત-જિન ભેટતાં,

ઉપજ્યો હરખ અપાર-સહિયર મોરી હે ।

હેજઈ હિયડું ઉલસ્યું, મિલિયો પ્રાણાધાર-સહિયર મોરી હે-

આજ અધિક આનંદ હુયો ॥ ૧ ॥

ધર-અંગણિ સુરતરૂ રૂંચ્યો, જનમ સફલ થયો આજ-સહિ૦

૬ ઇચ્છેલ, ૭ શ્રેષ્ઠ, ૮ ઉમંગ, ૯ ચરણકમળ, ૧૦ નિશ્ચ કરી

મનહ મનોરથ સવિ કલ્યા,

પામ્યું ત્રિભુવન-રાજ-સહિં આજં ॥૨॥

રતન ચિંતામણિ કર ચઢ્યું, વૂઠો અમૃત-મેહ-સહિં ।

અષ્ટ-સિદ્ધિ નવ-નિધિ સંપળ,

જે નિરખ્યો શુભ-નિધિ એહ-સહિં આજં ॥૩॥

અંતરાય અલગ દલ્યા, પ્રગદ્યો પુણ્ય-અંકૂર-સહિં ।

ભવ-ભાવકિ સવિ ઉપશમી,

વાધ્યું અધિકું નૂર-સહિં આજં ॥૪॥

એ સાહિબની સેવના, નવિ મુકું નિરધાર-સહિં ।

જેહથી શિવ-સુખ પામીઈ,

કનકવિજય જયકાર-સહિં આજં ॥૫॥



((૧૦૦૫) (૪૨-૨૧) શ્રી નમિનાથ-જિન સ્તવન

(સાસૂ પૂછઈ હે વહૂ એ-દેશી)

નમિ-જિન-રૂપ અજળ બન્યો,

અતિ સુંદર મુખ-છબિ બરણી ન જાય-

-મનડું મોહું પ્રભુ માહરું ।

ત્રિભુવન જોતઈ એહવું,

નહીં દીસઈ જે, દીઠઈ નયણ ઠરાય-મનડું રેં ॥૧॥

જોતિ જગતમાં વિસ્તરી,

જોતિ અવર તે રેહી, સહુ એહમાં સમાય-મનં ।

ચંદ્ર-સૂરિજ ગહ જે દીપઈ,

તે પણિ લહી જસ અધિક પસાય-મનડું રેં ॥૨॥

સર્વારથ-વાસી થકી, જે અકુનિશિ સોહઈ, લેદઈ અનંત-મન૦ ।
જે દીઠઈ લોચન ઠરઈ.

વલી હેજઈ અધિકઈ હિય-ઉલસંત-મનડું ॥૩॥
જેતાં તૃપતિ ન પામીઈ, આણુંદ અતિ ઘણુ પરગટ હોય-મન૦ ।
નિત વૃત્તિ મુઝ ઘટમાં વસો,

નિરમલ રૂપી સાહિબ સોય-મનડું રે૦ ॥૪॥
મન-વચ-કાયા થિર કરી, ધરતાં અ-વિહુડ જે જિન-ધ્યાન-મન૦
કેનકેવિજય સુખ સંપદા પામીઈ.

પરમ પ્રમોદ નિદાન-મનડું રે૦ ॥ ૫ ॥



(૧૦૦૬) (૪૨-૨૨) શ્રી નેમિનાથ-જિન સ્તવન

(સહિયર પૂછઈ વાત હાં હું વારી લાલ એ-દેશી)

રાજુલ પૂછઈ વાત, હાં હું વારી લાલ !

નાહ નિહુર છોડી કયું ગયો ? ।

વિષ્ણુ-અવગુણ ઉવેખી, હાં હું વારી લાલ !

નેમિ વર્ધરાગી ઠહો કયું થયો ? ॥ ૧ ॥

સહિયર કહઈ સુષિ વાત, હાં હું વારી લાલ !

દોસ ન કોઈણુરો ન તાહરો ।

યા દુશમનઈ ઘાલી ઘાત, હાં હું વારી લાલ !

રાજુલ કહઈ, કુણુ દુશમન માહરો ? ॥૨॥

સખિ કહઈ પરગટ દેખિ, હાં હું

તઈ નયણુ હરાયો, હિરણુ તે વયરી તાહરો ।

તિણુ એ દીધો કાવ, હાં હું ટાણુ લહિયો વિવાહ રે. ॥૩॥

ખીજી સખી કહઈ વાત, હાં હું,

ઢોસ નહીં કોઈ, ઇચ્છિ હરણુરો ।
પહિલો મતો ન યોંસાય,

હાં હું ઇચ્છિ રઈજી કન્યા પરણુરો ॥૪૧॥

મન માન્યા વિણ વ્યાહ, હાં હું,

પરણવા આણ્યો 'માન્યો માન્યો' કહી ।
૧ જોરઈ ન જુડઈ પ્રીતિ, હાં હું,

૨ આંધ્યે કલંખીએ, ગામ વસઈ નહીં ॥ ૫ ॥

તિણુચું કિચ્યો રે સનેહ, હાં હું,

હેજ હિયારો જિણિ મઈ ન દેખિઈ ।

છાંની જિણુરી વાત, હાં હું

તિણિરો ભરંસો, કહો કયું લેખિઈ ? ॥૬॥

ઈમ નિસુણિ રાજુલ-નારી, હાં હું, પિ કેનઈ મનાવણુ કારણુઈ ।

પહુતી ગઠ ગિરનારિ, હાં હું,

કહઈ કનક વિજય, જાઉં હું ખારણુઈ ॥૭॥



(૧૦૦૭) (૪૨-૨૩) શ્રી પાર્શ્વનાથ-જિન સ્તવન

(રામચંદ કે આગ ચાંપો મારિ રહ્યોરી એ-દેશી)

ત્રિભુવન-નાયક પાસ, અતિ સુખ હેજ ધરીરી ।

હું આંખો પ્રભુ પય પાસ, નિરખો નેહઈ કરીરી ॥ ૧ ॥

૧ પરાણે પ્રીતિ ન જોડાય, ૨ ગધિલા=પરાણે વસાવેલા કણુખીચી
ગામ ન વસે

તું સાહિબ હું દાસ, અવર ન કોઈ ગમધરી ।

તુમ્હ દેખ્યાં હુઈ ઉલ્લાસ, મોહન મુઝ મન-મધરી. ॥૨॥

મુઝ ઈકે તાહરું ધ્યાન, તુમ્હ ગુણ-જાપ જપુરી ।

પાડીવા સાહિબ સેવ, કોડ ઉપાય ખપુરી. ॥૩॥

જો હુઈ પ્રભુનો ખ્યાર, તો વંછિત-કાજ સરઈજી ।

સફલ હુઈ અવતાર, તન-મન અધિક ઠરધરી. ॥૪॥

કરિઈ મુઝ ઉપગાર, અ-વિચલ સુખ દીજધરી ।

કનકે વિજય જય જયકાર, પરમોદય કીજધરી. ॥૫॥



(૧૦૦૮) (૪૨-૨૪) ॥ મહાવીર-જિન સ્તવન

(કપૂર હુઈ અતિ ઉજલું રે એ-દેશી)

ગોયમ કહઈ સુણો વીરજી રે, વાલ્હેસર ! ગુણ-ગેહ ! ।

વીસવાસી મુઝનઈ ઘણું રે, ઈમ કિમ તોડયો નેહરે-

વીરજી ! શ્યું કીધું તઈએહા

છટકી દીધો છેહરે-વીરજી ॥૧॥

કામ ભલાવી તઈ પ્રભુ રે, મૂકયો મુઝનઈ ફર ।

અંત-સમયઈ રાખ્યો નહી રે, સેવક ચરણ-નૂર રે-વીરજી ॥૨॥

કેડિ લાગી શ્યું તુમ્હ કનઈ રે, માંગતો કેવલ ભાગ ।

ઈમ રટાલો દેઠ મૂકો ગયા રે,

તે શ્યું ન હુતી મુગતિ મેં જાગ રે વીરજી ॥૩॥

મોહ તોડી મૂકી જાસ્યઈ રે, પહિલાં જો જાણત એહ ।

તો તુમ્હ સાથઈ એવડો રે,

૪શ્યાનઈ ઠરત સનેહ રે-વીરજી ॥ ૪ ॥

૧ વિશ્વાસમાં લઇ, ૨ બહાનું, ૩ જગ્યા, ૪ શા માટે

ગોયમા ગોયમા ઇમ કહીરે, બોલાવતા કેઈ વાર ।
 ઇણ વેલાઈ તે કિહાં ગયો રે, તમ્હ મન કેરો પ્યાર-વીરજી ॥ ૫ ॥
 પતઈ પણિ છલ જે ઇમ કયું રે, તો શી અવરની વાત ? ।
 ઇમ છલ કરતાં તુઝનઈ રે,
 નાવી શરમ તલ માત રે-વીરજી ॥ ૬ ॥
 ઇમ બોલંબા ઢેઈ કરી રે, જીતી મોહ-વિકાર ।
 ગોયમ કેવલસિરિ વરઈ રે,
 કનકવિજય જયકાર-વીરજી ॥ ૭ ॥



કલશ

(આપ કનઈ હું આવી ન શકું-એ દેશી)

ઇણિ પરિ લાવધરી જિન થુણિયા, ચઢવીસઈ સુખકારી જી ॥
 ગુણુ-મણિ-ચણાચર જે પ્રગટયા,
 ત્રિભુવન-જન-ઉપગારી જી-॥ ૧ ॥
 સંવત સત્યોત્તરા વરસઈ,
 હરખઈ આસો પૂનિમ બુધવાર જી ॥
 રહી ઔરંગાબાદ ચઉમાસઈ,
 રચીયાં સ્તવન ઉદારજી ॥ ૨ ॥

સકલ-ભટ્ટારક-ભાલતિલક સમ, શ્રી વિજયસેન સુરિશયા જી ॥
 તસ પય સેવક ધીરવિજય બુધ, સાધુ-સમૂહ સુહાયાજી ॥ ૩ ॥

૫ તમે

તસ વિનેયવર લાભવિજય બુધ, આગમ અરથઈ ભરિયાળુ ।
શિષ્ય મુખ્ય તસ વૃદ્ધિવિજય બુધ,

જ્ઞાન તણા જે કરિયાળુ ॥ ૪ ॥

તસ-પય પંઠજ વિનયઈ, કેનકવિજય કરજોડી છ ।

એ ચઉવીસી ભાવઈ ભણુતાં પામજ્યો વંછિત કોડિછ ॥૫॥

॥ ઈતિ શ્રી ચતુર્વિંશતિ જિનગીતાનિ ॥

॥ દ્વિખિતાનિ પંડિત કેનકવિજય ગણિના ॥

॥ સુશ્રાવિકા સુલસા-રેવતી સમાન- ॥

॥ શ્રાવિકા હીરાભાઈ પઠનાથમિતિ શ્રી ॥



શ્રી વર્ધમાનસ્વામિને નમઃ
શ્રી સુચિરવિમલજી-કૃત
જિનસ્તવન-ચોવીશી
(૪૩)

(૧૦૦૯) (૪૩-૧) શ્રી નૃપભદ્રેવ-જિન સ્તવન
(આબુના ગઢ ઉપરે એ-દેશી)

મરૂદેવી-સુત સુંદર,

હાં રે! કાયા કંચન-વાન રે-આદેસર વાદહો વંદિધં ।

વંછિત-પૂરણ સુરતર,

હાં રે! પ્રભુજી પરમ-નિધાન રે-આદેઠ ॥ ૧ ॥

જે ગિરુઆ ૧ગુણ-આગલા,

હાં રે! મોટા મહીયલ માંહિં રે-આદેઠ ।

ભવ-સાયર ભમતાં થકાં,

હાં રે! ઉતારે ધરી ખાંહ રે-આદેઠ ॥૨॥

અંતર્યામી તું માહરો, હાં રે! અંતરરાખો કાંચ રે-આદેઠ ।

પ્રભુજી! તુમ્હ દીઠા વિનાં,

હાં રે! રવાસર વરસ વિહાય રે-આદેઠ ॥ ૩ ॥

કોમલ દિલ કરી પૂરીધ,

હાં રે! ૩આસંગાયત આશ રે-આદેઠ !

૧ ગુણથી શ્રેષ્ઠ, ૨ દિવસ, ૩ સ્નેહવાળો,

અવશુષ્ણ ગુણ કરી લેખવો,

હાં રે ! આપો ચરણે વાસ રે-આહેં ॥ ૪ ॥

કામણ કીધું તે કીસું

હાં રે ! અહ-નિશિ દિલ તુઝ પાસ રે-આહેં ।

રચિર પ્રભુજી પય સેવતાં,

હાં રે ! સફલ ફલી મુઝ આશ રે-આહેં ॥ ૫ ॥



(૧૦૧૦) (૪૩-૧ આ) શ્રી ઋષભદેવ-જિન સ્તવન

(વિનય કરીજે બાઈ વિનય કરીજે એ-દેશી)

આદિજિણેસર કેસર ચરચિત કાયા,

મરુદેવી જાયા-પ્રભુજી ! ૧ મો મન લાયા ।

પ્રભુજી ! દરસન દીજે, નેહુ ધરીને સેવક ૨ સાર કરીજે પ્રભુજી ।

-બાંહુ ગ્રહાંની આખર લાજ વહીજે-પ્રભુજી ॥ ૧ ॥

કંચન કાયા, જન-મન મોહન માયા ।

પ્રભુ-પય-પંકજ, મો મન ભમર લોભાયા-પ્રભુજી ॥ ૨ ॥

અવર ન સેવું આ ભવમાં એણી કાયા,

પ્રભુજી પરમેસર પૂરે પુણ્યે મેં પાયા-પ્રભુજી ॥

સમરથ સાહિબ સાચા ઉસેણુ સવાયા,

આશ પૂરજ્યો માહરી શ્રી જિનરાયા પ્રભુજી ॥ ૩ ॥

છપન્ન કુંભરી, ભમરી દે હુલરાયા ।

સકલ સુરાસુર, કિન્નર જિન-ગુણ ગાયા-પ્રભુજી ॥ ૪ ॥

૧ મારા, ૨ સંભાળ, ૩ સહાયક,

નાભિ-નરેસર, નંદન શુ' લય લાયા ।

રુચિરવિમલ, પ્રભુજી, શિવ-સુખદાયા-પ્રભુજી ॥૫૫॥



(૧૦૧૧) (૪૩-૨) શ્રી અજિતનાથ-જિન સ્તવન.

(વૈદરભીશુ' મહારુ' મન વસ્યુ' એ-દેશી)

સાહિબ અજિત-જિનેસર મન વસ્યો,

ઔર ન આવૈ ૧ દાય હે !-સાહિબ૦

સુંદર મૂરતિ ચિત્ત ચઢી,

કહો કિમ છોડી જાય ! હે !-સાહિબ૦ ॥૧॥

૨ વિજયા-ઉર-વર-હંસલો,

મુઝ મન-માનસ-વાસ હે !-સાહિબ૦

કરુણા-દિલ પ્રભુજી ! કરો,

પૂરો અ-વિહડ આશ રે-સાહિબ૦ ॥ ૨ ॥

પર-ઉપગારે હો ૩ આગલા, બે ગિફઆ ગુણવંત રે-સાહિબ૦ ।

પર-દુઃખ ભાંજે ભાવસ્યુ', તે સુ-સનેહી સંત હે-સાહિબ૦ ॥૩॥

સુર-નર રાણા રાજિયા, સેવે બે કર જોડી હે-સાહિબ૦ ।

પ્રભુ-ચરણે ચાકર કરી, રાખો અંતર છોડી હે-સાહિબ૦ । ॥૪॥

સાહિબ ! લય-લંજન ભગવંત છો,

ગુણ-નિધિ ગરીબ-નિવાજ હે-સાહિબ૦ ।

રુચિર પ્રભુજીસું વિનતિ, પૂરો વંછિત-કાજ હે-સાહિબ૦ ॥૫॥



૧ અનુકૂળ, ૨ પ્રભુજીની માતાનું નામ, ૩ હોંશિયાર,

(૧૦૧૨) (૪૩-૩) શ્રી સંભવનાથ-જિન સ્તવન

(ગુણવંતાને ગુણ ચઢે)

સંભવ-સાહિબ માહરો, હું તાહરો હો ! સેવક સિરદાર કિ
મહેર કરી મુજ ઉપર,

ઉતારો હો ! ભવ-સાયર-પાર કિ-સં ॥ ૧ ॥

^૧આનન અદ્ભુત ^૨ચંદ્રો,

તેં મોહોં હો ! મુજ નયણ-ચકોર કિ ।

મનડું મિલવા તુમહું,

પ્રભુજીયું હો ! જિમ મેહાં મોર કિ-સં ॥ ૨ ॥

હું નિ-ગુણો પણ તારીએ,

ગુણ-અવગુણ હો ! મત આણો ચિત્ત કિ ।

ખાંદ્ય ગદ્યાં નિરવાહીએ,

સુ-સનેહી હો ! સયણાંની રીત કિ-સં ॥ ૩ ॥

સાર સંસારે તાહરી, પ્રભુ-સેવા હો ! સુખદાયક દેવ કિ ।

દિલ ધરી દરસણ દીલએ,

તુમ ઓલગ હો ! કીલયેં નિત્યમેવ કિ-સં ॥ ૪ ॥

ચોતીસ અતિશય સુંદર, ^૩પુરંદર હો ! સેવે ચિત્ત લાય કિ ।

રુચિર પ્રભુજી પય સેવતા,

સુખ-સંપત્તિ હો ! અતિ આણુંદ થાય કિ સં ॥ ૫ ॥



(૧૦૧૩) (૪૩-૪) શ્રી અભિનંદન-જિન સ્તવન

(ઢાલ-મારુની)

મોરા પ્રભુ ! હો ! મોરા પ્રાણ-આધાર,
 સાર કરજો હો ! પ્રભુજી માહરી જી ।
 સાહિબ મોરા હો સાહિબ મોરા જગત-આધાર,
 ચાકર ચાહે' હો ! સેવા તાહરીજી ॥ ૧ ॥
 મોટા મહીમાં મહારાજ, મોટા મહીમાં મહારાજ,
 કાજ સુધારો હો ! સેવકનાં સહીજી ।
 દયા કર હો ! મયા કર ગરીબ-નિવાજ !
 રાજ નિવાજો હો ! નિજ બાંહે ગહીજી ॥૨॥
 મોહન ! જિનજી મોહન મહી તું જલધાર,
 ચાચક ચાતક થઈ સેવું સદાજી ।
 ચૂરણ દુઃખ હો ! પૂરણ સુખ-ભંડાર,
 પામે અભિનંદન નામે સંપદાજી ॥ ૩ ॥
 સોભાગી જિન હો ! શોભા-ગુણના ભંડાર,
 અમૃત-વાણી હો ! પ્રભુજી ! મન વસીજી ।
 આણી દિલ હો ! આણી પ્રભુ ! પર-ઉપગાર,
 જાણી સેવકશું હો ! ખોલીજે હસીજી ॥ ૪ ॥
 સનેહી જિન હો ! ભવિક-જન સુખ-દાતાર,
 સાર સંસારે હો ! સાહિબ સેવ સેવનાજી ।
 સંવર-સુત હો ! સંવર-સુત રુચિર-આધાર,
 દેવ ન સેવું હો ! અવર, પ્રભુ વિનાજી ॥ ૫ ॥



(૧૦૧૪) (૪૩-૫) શ્રી સુમતિનાથ-જિન સ્તવન

(મેસ મગરાથી ઉતરી એ-દેશી)

પ્રભુ ! સુષુબ્યો રે, સુમતિ સુમતિદાઇ સદા,
સુષુબ્યો રે, સેવકની ^૧અરદાસ કિ
મુઝરો રે મહારો માનબ્યો,

પ્રભુ ! સુષુબ્યો રે, દાસ નિરાશ ન મુ'કીએ;

પ્રભુ ! પૂરોરે માહરી અવિચલ આશ કિ-મુજરોં ॥૧॥

પ્રભું જે સુર-નર મુનિ-રાજ્યા, ગુણવંતા રે,
સેવે પ્રભુના પાયકિ-મુજરોં ।

તો નિગુણો હું તાહરે, પ્રભુ હીયડેં રે,
કહો કિમ આવું ^૨દાય કિ-મુજરોં પ્રભું ॥૨॥

પ્રભું તોહે પણ છોડું નહિ, ઝગહી ગાહિય રે,
મહેં પ્રભુજની આંહ કિ, મુજરોં ।

જિમ જાણો તિમ નિરવહો, સેવકનેં રે,
આણી પ્રભુ મનમાંહિ કિ-મુજરોં પ્રભું ॥૩॥

પ્રભું તુમહ સંગતિ સમકિત લહું, બહુ હીયડેં રે,
નિશ-દિન પ્રભુજતું ધ્યાન કિ-મુજરોં ।

જિમ પામેં રે, અંદન સુરસિ સુગંધથી,
વનરાઈ રે, સહુ-એ અંદ સમાન કિ-મુજસે પ્રભું ॥૪॥

પ્રભુજં રુચિર પ્રભુજ ! ચિત્ત આહશું, પુણ્યે પાયો રે,
ગુણ-મણિ-દરિયો સ્વામિ કિ-મુજરોં

તન-ધન જીવન માહરો તુમ નામે રે,
પામું બહુ વિસરામ કિ-મુજરોં પ્રભું ॥૫॥

૧ વિનતિ, ૨ મનરૂપ, ૩ પકડી, ૪ મજાજીત,

(૧૦૧૫) (૪૩-૬) શ્રી પદ્મપ્રભ-જિન સ્તવન

(વારી હો પ્રભુ વારી હો એ-દેશી)

તુમ મૂરત મન 'માની હો, પ્રભુ ! તુમ સુરતિ મન માની !
તું મેરા સાહિબ, મેં તેરા 'મંદા,

ઓર નહિં મેં ડહિય-ઠાની હો-પ્રભુ ॥૧॥

ધર રાજ-સુત સુંદર સોહૈં,

સુસીમા રાની હો -પ્રભુ ॥

પ્રભુ 'શારદ-ચંદ દેખન કૈ,

અખીયાં અતિ 'ઉમહાંની હો-પ્રભુ ॥૨॥

કઅધર ઉવિદુમ દંત દાડિમ ઉપમા,

સુઝ મન અધિક સુહાની હો,- પ્રભુ ॥

પ્રભુજી વિના કોઈ મિત્ર ન,

તિનસું કહોએ 'અ-કહ કહાની હો-પ્રભુ ॥૩॥

અંતરયામી સ્વામી હમારો, પેં તુમ અધિક શુમાની હો-પ્રભુ ॥

પ્રભુજી ! સાર કરો અબ 'વેગેં,

સેવક ચિત્ત હિત આની હો-પ્રભુ ॥૪॥

પદ્મપ્રભુજીશું પુણ્ય પસાઈ,

અ-વિચલ પ્રીત બંધાની હો-પ્રભુ ॥

રાચર પ્રભુ ! પય સેવા દીજ્યૈ,

તુમ સમ અવર ન દાની હો-પ્રભુ ॥૫॥



૧ લાવી, ૨ સેવક ૩ હૃદયમાં રાખ્યા ૪ આસો સુદ પુનમના, ૫
ઉમંગવાળી ૬ ઓઠ, ૭ પરનાળાં, ૮ ન કહેવાય તેવી, ૯ જદ્દી,

(૧૦૧૬) (૪૩-૭૩) શ્રી સુપાર્શ્વનાથ-જિન સ્તવન
(ધમાલની દેશી.)

સુ-સનેહી સાહિબ મન વસ્યો હો, !

અહો ! મેરે ! લલના ! પ્રભુજી પરમ દયાલ; સુ૦
સેવો સુપાસ સાહિબકેાં નિશ દિન, મન ધરી રંગ રસાલ,
સુ૦ અ૦ પૂજો પૂજો પ્રભુજીકો બાલ.-સુસનેહી૦ ॥૧॥

પ્રભુજીકો મુખ-પંકજ નિરખત, મન-મધુકર હરખંત-લલના
નયન રસીલો માતું ઇંદ્રી વર,
વશ કીને સુર-નર સંત-સુસનેહી૦ ॥૨॥

સુંદર સૂરત મૂરત નિરખત, ૧નેન રહે લોભાય-લલના ।
ચિત્ત પ્રભુ-ચરન રચુબ્યો નાં ૩નીકસત,
કરો કોઈ કોડી ઉપાય-સુસનેહી૦ ॥૩॥

રચણ ચિંતામણિ ૪સો પ્રભુ પાથો,
કથેાં કરી છોડ્યો જાય-લલના ।
નવ-નિધિ-દાયક નાયક મેરો,

તુંમ બિન ઓર ન સુહાય-સુસનેહી૦ ॥૪॥
દેવ દયાનિધિ દરસન દીજ્યે, કીજો નેહ-૫નિવાહ-લલના ।
રુચિર-વિમલ પ્રભુ કે ગુણ ગાવત,
પાવત પરમ ઉચ્છાહ-સુસનેહી૦ ॥૫॥



૧ આંખો. ૨ પેઠેલાં ૩ નીકળે, ૪ જેવા; ૫ નલાવ.

(૧૦૧૭) (૪૩-૭૩) શ્રી સુપાર્શ્વનાથ-જિન સ્તવન

(રાજા રૂડા રે લલના એ-દેશી)

સહજ ^૧સલૂણા સાહિબા-જિનજી-લલારે,

સેવા સુપીસ-જિણુંદ, આણુંદશું ઘણૌ ।

જિનજી પાય પ્રણમેં પ્રભુજી તણા-જિં લં,

નરવર-સુર નાગેંદ જાઉં ^૨વારણૌ-જિં ॥૧॥

સુંદર સુરતિ તાહરી-જિં લં,

માતા પૃથ્વી કે નંદ-હું બલિહારી રે-જિં ।

મુજરો હમારો માની એ-જિં લં,

ઘો દરશન સુખ કંદ-સૂરતિ પ્યારી રે-જિં ॥૨॥

તુઝ દરબારેં ઓલણુ-જિં લં,

ઔર ન બચું દેવ, કાચું મન કરી, જિં ।

ચિંતામણિ સુર તરુ સમો-જિં લં,

પુણ્યે પામી-સેવ સેવ્યાં શિવપુરી-જિં ॥૩॥

ઉત્તમ સાથેં નેહલો-જિં લં,

નિત-નિત ઉનવલેં ^૪વાંન-મનમાં આણીએ-જિં ।

કામ પડ્યાં નિરવાહીએ-જિં લં,

બાંહ ગહી પરમાણુ-તો પ્રભુ જાણીએ-જિં ॥૪॥

મન મિલવા પડિમાહલો-જિં લં,

જિમ ચાતક જલધાર-હો તુમ લણી-જિં ।

મલકાપુર મંડણુ થુણ્યો-જિં લં,

રુચિર વિમલ સુખ-સાર-સંપત્તિ ઘો ઘણી-જિં ॥૫॥



૧ કાતિવાળા, ૨ ઓવારી, ૩ નવા ૪ રંગે, ૫ ઉત્સુક,

(૧૦૧૮) (૪૩-૮) શ્રી ચંદ્રપ્રભ—જિન સ્તવન

(“ઈડર આંખા આંખલી રે” એ દેશી)

શ્રી ચંદ્રપ્રભ વંદીએ રે, આણી અતિ ઉલ્લાસ-

-પ્રભુજી ! હે ! પૂરે માહરી આશ ।

હું તુમ ચરણે દાસ-પ્રભુ° આણી°,

સુરતરુ ચિંતામણી સમેરે, પૂરણ લીલ વિલાસ-પ્રભુ° ॥૧॥

તું ત્રિભુવન-જન-રાણ્યો, રે શુભ-નિધિ °ગહર-ગંભીર ।

કર્મ અરિ-દલ જીતવારે, તુમ સમ અવર ન વીર-પ્રભુ° ॥૨॥

હું અપરાધી તાહરો હો, તું સાહિબ ! સિરદાર ।

મુઝ અવશુષ્ઠ બાણી કરીરે, મત મુકો વિસાર-પ્રભુ° ॥૩॥

અરજ કિશી તુઝ આગલે રે, તું બાંણે મન વાત ।

અવસર રપહલે ન ચૂકીએ હો !

પ્રભુજી ! પરમ-વિખ્યાત-પ્રભુ° ॥૪॥

તુમ દરશણ દીઠા વિનાં રે, ઝખિણ યુગ ચ્યાર પ્રમાણ ।

રુચિર પ્રભુજીના નામથી હો,

નવ નિધિ કોડિ કલ્યાણ-પ્રભુ° ॥૫॥

(૧૦૧૯) (૪૩-૯) શ્રી સુવિધિનાથ—જિન સ્તવન

(ગઢ બુંદીના હાડા વાલા વાસા ચલન ન દેસ્યું એ-દેશી)

ભવ-ભય-ભંજન છો ભગવંતા;

અ°ટ-કર્મ અરિહંતા હો-સાહિબ સુવિધિ-જિનેસર ।

૧ ખૂબ, ૨ પ્રથમ, ૩ એક ક્ષણ પણ ચાર યુગ જેવડી લાગે છે.

(પાંચમી ગાથાની બીજી લીટીનો અર્થ)

સુર-નર ચરચિત કેસર, રઢોહગ-તિમિર-દિણેસર,-
-ખ્યારો ! પરમેસર-પ્રભુજી ! પરમન્ન હોજ્યો. ॥૧॥

એહવા નિહુર ન હોજ્યો હો,
રાણી રામાના જયા, સુર-નર નારી ગુણ ગાયા ।
તારણ ત્રિભુવન રાયા, મૂરતિ મોહન માયા-પ્રભુજી ॥૨॥

હું તુમ રાગી સાહિબ નિપટ ૩નિરાગી,
તો પણ મુઝ લય લાગી હો !!
હું નવિ છોડું તું સ્વામી તું, મુઝ અંતરયામી,
તુમ-સમ અવર ન ૪નામી જેહનેં સેવું સિર નામી-પ્રભુજી ॥૩॥

પછેહ ન કીજ્યો, સેવક સાર કરીજ્યો,
નિપટ નિરાશ ન કીજ્યો હો ।

સાહિબ સમરથ જાણી, પૂરણ પ્રીત બંધાણી,
પાલો નેહ-નિશાની, સેવકશું હિત આણી-પ્રભુજી ॥૪॥

નેહ નિવાહો નેહી આશ પુરીજો,
ફરગતિ ચિંતા ચૂરીજો હો ! મુરતિ મોહનગારી ।
કિમહી ન જાએ વિસારી, પ્રાણ થકી પણ ખ્યારી,
રુચિર સદા સુખકારી-પ્રભુ ॥૫॥



૧ પૂજયેલ, ૨ દૌર્ભાગ્યરૂપ અંધારા માટે સૂર્ય જેવા ૩ એકદમ, ૪ પ્રસિદ્ધ ૫ વિયોગ, ૬ અરેખર,

(૧૦૨૦) (૪૩-૧૦) શ્રી શીતલનાથ-જિન સ્તવન

(ઢાલ-યાદવજીના ગીતની)

ત્રિભુવન જન સ્વામી તું શિવ ગર્ધ ગામી દેવ રે-શીતલજી !,

પ્રભુ અંતરયામી પુણ્યે કરી પામી સેવરે-શીતલજી ।

દાયક શિવ-કામી, સેવું સિર નામી નિત રે-શીતલજી,

સુખ-સંપત્તિ ધામી, તુમ સમ નહી નામી મીતરે-શીતલજી-

શીતલજી રે, સુસનેહીરે, શુભ ગેહીરે, શીતલજી ॥૧॥

મુઝ માનસ નેહ, જ્યો લેહારે, હારિતસુ. શીતલજી,

ધરતી જિમ ત્રેહા, પાય-પાણી જિહાં હિતસુ-શીતલજી ॥

કોમલ દલ દેહા, સુભ સુગુણ-સનેહા સંતજી-શીતલજી,

રાખો રંગ રેહા, મતિ દાખો છેહા મિતજી-શીતલજી ॥૨॥

સાહિબ છો સાચા, મત ! થાઉ કાચા વાચથી-શીતલજી,

સહુધં જગ જાગૈહી રે, પ્રભુ રાચે સાચથી-શીતલજી ।

પાંચેં મન માઝૈ, કાચેં નવિ રાચે નેહથી-શીતલજી,

પ્રભુ દરસણ વાંછે મોરા જિમ નાચેં મેહથી-શીતલજી ॥૩॥

પ્રભુશું લય લાગી, સુમતિ મતિ જાગી ભાગથી-શીતલજી,

હું છું તુમ રાગી, તું નિપટ નિરાગી રાગથી-શીતલજી ।

સેવક અનુરાગી, પ્રેમ રસસું પાગી પ્રીતકી-શીતલજી ।

હરગતિ દુઃખ ત્યાગી, સાહિબ સોભાગી હીતકી-શીતલજી ॥૪॥

પ્રભુ તો પર વારી, જાઉં બાલહારી તાહરી-શીતલજી,

ન કરું ખિણ ન્યારી, જીવનથી પ્યારી માહરી-શીતલજી ।

કહે રુચિર સંભારી, ચરણે ચિત્ત ધારી રાખીએ-શીતલજી,

સુખ-સંપત્તિ સારી, દિન દિન વિસ્તારી આપીએ-શીતલજી ॥૫॥



(૧૦૨૧) (૪૩-૧૧) શ્રી શ્રેયાંસનાથ-જિન સ્તવન

(અખ સખી આયો હૈ સાવણ એ-દેશી)

શ્રી શ્રેયાંસ-જિણુંદા, પાય પ્રણમેં સુરનર વૃંદા હો ।

મુઝ ચિત્ત ગયણુ-દિણુંદા, પ્રભુ-નામે અતિ-આણુંદા હો. ॥૧॥

પ્રભુજી ! દીન-દયાલ, કીજે સેવક પ્રતિપાલ હો ।

દીજે રંગ રસાલા, અવસર કિમ દીજેં ટાલા હો !-પ્રભુ ॥૨॥

દિલ ધરી દરસણુ દીજ્યેં, સેવકની સાર કરીજે હો । ।

ધણુ પરેં છેહ ન દીજ્યૈ; નિત નવલો નેહ ધરીજે હો-પ્રભુ ॥૩॥

મૂરતિ મોહન વેલી, મુખ ચંદ છબિ અલખેલી હો ।

પૂજણુ પ્રીત પહેલી, મુઝ તન ધન જીવ સહેલી હો-પ્રભુ ॥૪॥

સુંદર મૂરતિ તોરી, મોહી મુઝ નયન ચકોર હો ।

લાગી પ્રીત ઠગોરી, તેં લીધું ચિત્તડું ચોરી હો-પ્રભુ ॥૫॥

શિવ સુખ દાયક સ્વામી, પ્રભુ-સેવા પુણ્યેં પામી !

પ્રભુજી અંતરયામી, કહે રુચિર સુખકામી હો-પ્રભુ ॥૬॥



(૧૦૨૨) (૪૩-૧૨) શ્રી વાસુપૂજ્યસ્વામી-જિન સ્તવન

(લોચન લટકડલે એ દેશી)

આજ અમીએ મેહ લુઠોજી-મુઝ ધર આંગણુડે,

પ્રભુ રાણી જયા સુત દીઠોજી-પ્રભુ મુખ લામણુડે,

સમરથ સાહિબ તુઠોજી-પ્રભુ ॥

મુજ લોચન અમીય પછોજી-પ્રભુ ॥ ૧ ॥

કોમળ વયણુ ઉચારીજી-પ્રભુ ॥

તે મોહ્યાં સુર-નર-નારીજી-પ્રભુ ॥

શ્યો અવગુણ ચિત્ત ધારીછ-પ્રભુ.

મેલો કાંચ વિસારી!-પ્રભુ. ॥ ૨ ॥

નેહ-નયણસું પેખોછ-પ્રભુ.

અવગુણ વિણ કાંચ ઉવેખોછ! પ્રભુ. ॥

સેવક સાહિબ લેખોછ-પ્રભુ.

કીજ્યે પ્રેમ-પરેખોછ-પ્રભુ. ॥૩॥

પ્રીત પરમ રસ દરીયોછ-પ્રભુ.

નિજ ચરણ-કરણ અનુસરીયોછ-પ્રભુ. ॥

તું સાહિબ ચિત્ત ધરીયોછ-પ્રભુ.

બહુ સુખ સંપત્તિ શું વરીયોછ-પ્રભુ. ॥૪॥

અંદ અકૌર જ્યો અંગીછ-પ્રભુ.

મુઝ લાગી પ્રીત સુરંગીછ-પ્રભુ. ॥

પાવન ગંગ તરંગીછ-પ્રભુ.

કહે રુચિર પ્રભુશું ઉમંગીછ-પ્રભુ. ॥ ૫ ॥



(૧૦૨૩) (૪૩-૧૩) શ્રી વિમલનાથ-જિનસ્તવન

(અરજ કરું તસ લીમછ જીખાઈ એ-દેશી)

અરજ કરું કર જોડી-પ્રભુછ હો! પાલો પૂરવ પ્રીતડીછ. ॥

પુરો મનની કોડી! પ્રભુછ-ઉત્તમ જનમન રીત તડીછ ॥૧॥

સાહિબ છો ગુણ જાણુ-પ્રભુ, રૂપ ગુણે નાણે ભર્યો છ. ॥

તું ઘન જીવન પ્રાણુ પ્રભુ, જાણે ચરણે અનુસર્યાછ ॥૨॥

તું નિઃસનેહી મિત્ત પ્રભુ, સુસનેહી સેવક અછૈછ. ॥

એક પખી કરી પ્રીત-પ્રભુ, કિમ નિરવાહ હોસ્યે પછૈછ. ॥૩॥

નીર વિનાં મરેં મીન-પ્રભુ નિરવેદ જાણે નહીછ. ॥

જે પૂરા પરવીણુ-પ્રભુ, આશ પૂરે અવસર લહીછ. ॥ ૪ ॥

શ્યામા-ઉર વરહંસ-પ્રભુ, વિમલ-જિજ્ઞેસર મન વસ્યોજી ।
રુચિર સિરૈં અવતંસ-પ્રભુ, દેખી ^૧દરશણ ઉલ્હસ્યોજી ॥૫॥

(૧૦૨૪) (૪૩-૧૪) શ્રી અનંતનાથ-જિન સ્તવન
(ઢાલ સીતાના ગીતની)

પ્રભુમી હો ! પ્રભુ ! પ્રેમે અનંત જિન સ્વામ,
નમે હો ! પ્રભુ ! નવનવી નવનિધિ નિપજૈ જી ૦ ।
પામે હો ! પ્રભુ ! પૂરણ ^૧ કામિત રક્ષામ,
સેવ્યાં હો પ્રભુ ! અલિનવ શિવસુખ સંપજૈ જી ॥૧॥
લાગો હો ! પ્રભુ ! તુમ સોં અ-વિહડ નેહ,
સમરું હો ! પ્રભુ ! નિત નિત નામ નિરંતરેં જી ।
કર્મહીન હો ! પ્રભુ ! નેહી આપે છેહ,
સજન હો પ્રભુ ! સજન જન જનમાંતરેંજી ॥ ૨ ॥
વાણી હો ! પ્રભુ ! વાણી અમૃત-રસવૃંદ;
વરણી હો ! પ્રભુ ! હરખ્યા સુરનર મોરડાંજી ।
અલિનવ હો પ્રભુ ! મુખ પૂનિમનો ચંદ્ર,
નીરખી હો પ્રભુ ! મોહ્યા ભવિક ચકોરડાંજી ॥૩॥
કીજૈ હો પ્રભુ સેવકની પ્રતિપાલ,
દીજ્યેં હો પ્રભુ ! દીજ્યે હો દરશન ચિત્ત ધરીજી ।
પાલો હો ! પ્રભુ ! પૂર્વ પ્રીત રસાલ,
ટાલો હો પ્રભુ ! દુરગતિ દુરમતિ ઝડુખ-દરીજી ॥ ૪ ॥
હાયક હો પ્રભુ ! નાયક સુખદાતાર,
તારક હો ! પ્રભુ ! જગતારક જગમાં જ્યોજી ।

૧ મુખ, ૧ ઇચ્છિત, ૨ વસ્તુઓ, ૩ દુઃખની ગુફા જેવી,

રુપેં હો ! પ્રભુ ! નિર્જિંત કામકુમાર,

ગાતાં હો ! પ્રભુ ! રુચિર-જનમ સફલો થયોલ ॥૫॥



(૧૦૨૫) (૪૩-૧૫) શ્રી ધર્મનાથ-જિન-સ્તવન

(ઉંચો ગઢ ગ્વાલેરનો એ-દેશી)

ધર્મ જિનેસર વંદીછ, હેજ હીએ હરવત-પ્રભુલ ।

સમરથ નૂર ન આ જગે,

ઉપગારી અરિહંત-પ્રભુલ-ધર્મં ॥ ૧ ॥

ગુણ-ગિર્યાશુ ગોઠડી, કરતાં અતિ ઉછાહ-પ્રભુલ ।

નીચ નિવાહી સકે નહિ,

પગ પગ હોઈ દાહ-પ્રભુલ-ધર્મં ॥૨॥

રાય લાનુ સુત પેખતાં, પાગૈ મન આરામ-પ્રભુલ ।

જિમ ગજરેવા રીતડી,

જિસ સીતા મન રામ-પ્રભુલ-ધર્મં ॥૩॥

તિમ મોરે મન તું વસ્યો, ચોર ન સેવું દેવ-પ્રભુલ ।

તુમ ચરણે ચિત રંછયું,

કરશ્યું અહનિશિ સેવ-પ્રભુલ-ધર્મં ॥૪॥

સાહિબ વિસારો રખે ! એતા દિનની પ્રીત-પ્રભુલ ।

અવસર પામી આપણો,

સેવક ધરજ્યો ચિત-પ્રભુલ-ધર્મં ॥૫॥

અપણાયત જાણી કરી. મૂકેં કાંચ નિરાશ ?-પ્રભુલ !

રુચિર, પ્રભુ પય સેવતાં,

પાગૈ અતિ ઉલ્લાસ-પ્રભુલ-ધર્મં ॥૬॥



(૧૦૨૬) (૪૩-૧૬) શ્રી શાંતિનાથ-જિન સ્તવન

(ઢાલ-ભટ્ટીયાણી રાણી)

સહજ સલૂણે હો ! સુ-સનેહી શાંતિ જિનેસર,

પ્રભુ કેસર ચરચિત કાય ।

દેવ ! દિલ-રંજન ! હો ! ગુહારું તારક આતમા

પ્રભુ દીઠાંથી મુખ થાય-સહજં ॥૧॥

સાર સંસાર હો ! અવતારે સાહિબ સેવના, દેવાધિપ પૂજે પાય ।

સુર-નર નારી હો ! મુખ વારી વારી ઇમ કહે,

તુમ્હે તારો ત્રિભુવન રાય-સહજં ॥૨॥

તન-ધન-જોવન હો ! ચંચલ અંજલિ જલ સમે,

જિમ સંધ્યા રાગ સુહાય ।

વાર ન લાગે હો ! જમવારે જાગી જોયતાં,

ખિણુમાંહિ ખેરુ થાય-સહજં ॥૩॥

અવસર પામી હો ! શિવગામી નામી થાયસ્યો,

જો તપ જપ દાન રચાય ।

સમરથ સાહિબ હો ! નિરખી પરખીને આપણો,

પ્રભુ ! કીજે નેહ લગાય-સહજં ॥૪॥

છેહ ન દેસ્યે હો ! કહસ્યે જે વાતડી,

પ્રભુ ! વાલા વિરચી ન જાય ।

રુચિર સોહાગી જિનરાગી લાગી પ્રીતડી,

પ્રભુ-ચરણાશુ ચિત લાય-સહજં ॥૫॥



(૧૦૨૭) (૪૩-૧૬આ) શ્રી શાંતિનાથ-જિન સ્તવન

(રાજાજી આયા દેસમાં, રાણી મહલ સમારે એ-દેશી)
શાંતિ જિણેસર સાહિબા, મુજરો માનીજે રે ।

હીજે દરસણુ ઠાસને, નેહં નીરખીજૈ-શાંતિં ॥૧॥

ચિતડું ચરણે તાહરૈ માહરૈ તું સ્વામી રે ।

પામી પુણ્યે સેવના, દેવ શિવગઘગામીં ॥૨॥

સેવકે બાણી આપણે, શ્યું કારજ કીધું રે ।

લીધું ચિત્ત ચોરી કરી, નેહં ચિત્ત બીધું-શાંતિં ॥૩॥

જો જગમાં બાચા અછો, સાહિબજી સાચા રે ।

તો નિજ વાચા પાલસ્યો, મત થાઉં કાચા-શાંતિં ॥૪॥

તેં તાર્યા બહુ પાપીયા, મોને કાંચ વિસારો રે ? ।

રુચિર પ્રભુજી અવસરે, સંભારી તારો-શાંતિં ॥૫॥



(૧૦૨૮) (૪૩-૧૭) શ્રી કુંથુનાથ-જિન સ્તવન

(રાજાજી ચાલૈ પરદેશ, નણ્ણદીરો વીરો મહારે પાહુણુજી એ-દેશી)

કુંથુ-જિણેસર ! સાહિબ-સેવ, સુરનર કિનર કર જોડી કરેજી ।

હીન કયાકર ઠાકુર દેવ,

પૂજી પ્રભુમીનેં સુખ સંપત્તિ વરેજી-કુંથું ॥ ૧ ॥

તારણુ-તરણુ જિહાજ, ૧રાજ સમોવડ સમરથ કો નહીંજી ।

ગુણુ-નિધિ ગરીબ-નિવાજ,

કાજ સુધારો ! મનમાં ગહગહીજી-કુંથું ॥ ૨ ॥

૧ આપના જોવો,

અષ્ટ કરમ ભડ બીમ, વીર તે જીત્યો ઉપશમ-૨૨૫ ભરેંજી ।

મહન મહા વડવીર,

ધીર હરાંયો સંજમ વ્રત-૧ શરેંજી-કુંથુ ॥ ૩૩ ॥

મહીયલ માંહિ મહિમાવંત, સંત સલ્લજો સાહિબ સેવીએજી ।

આશ પૂરજ્યો અરિહંત,

નામ તુમ્હારે પ્રભુજી ! જવીએજી-કુંથુ ॥ ૪ ॥

અંતરયામી આધાર, તન ધન જીવન પ્રભુજી ! માહરોજી ।

સાહિબ છો જી સિરદાર,

રુચિર પ્રભુજી સેવક તાહરોજી-કુંથુ ॥ ૫ ॥



(૧૦૨૯) (૪૩-૧૮) શ્રી અરનાથ-જિન સ્તવન

(દેશી હાડાની)

સાહિબ અરજિન દેવ રે,

મન મોહન મહારા, સુષુ પ્રભુજી ખ્યારા;

દરસણુ દીજ્યો ૧ દિલધરી દાસનેં રે,

સુરનર રસારે સેવ રે, મનં સુષું,

આતુર ચરણુ તુમ્હારેં વાસનેં રે. ॥ ૧ ॥

જો સેવક કરી જાણુસ્યો-મનં સુષું

અવસર જાણી આશ્યા પૂરસ્યો રે ।

૩ હેજ ૪ હીંજ જો આણુસ્યો-મનં સુષું,

તો સેવક દુઃખ ચૂરસ્યો રે. ॥ ૨ ॥

૧ આણુથી ૧ ખરેખર, ૨ કરે છે, ૩ પ્રેમ, ૪ હેયામાં

ચોખે ચિત્ત કરી આહીએ-મનં સુણું,
 સેવક સાથે નેહ પનિવાહીએ રે ।
 અવગુણ ગુણ અવગાહીએ-મનં સુણું,
 નિગુણે ૧તોહે ૭ખાંહે ૮સાંહીધ રે ॥ ૩ ॥
 જો શિવ અણ-માંગ્યા દીઓ-મનં સુણું,
 તો સમરથ પ્રભુજી માહરો રે ।
 જો તપ-જપથી પામીએ-મનં સુણું
 રથોરે ૯ભલખપણ ? પ્રભુજી ! તાહરો રે ॥ ૪ ॥
 ભવ-સાયરથી તારીધ-મનં સુણું,
 શિવમુખ દીજ્યો સેવક જાણીને રે ।
 વિનતહી અવધારીધ-મનં સુણું,
 રુચિર પ્રભુજી ચિત્તમાં આણીયે રે ॥ ૫ ॥



(૧૦૩૦) (૪૩-૧૯) શ્રી મલ્લિનાથ-જિન સ્તવન
 (પીછાલારી પાલ આંખાદોઈ રાવલા મહારા લાલ એ-દેશી)
 મલ્લો જિનેસર દેવ, સેવું ત્રિભુવન ઘણી-જિનજી !,
 પ્રભુજી પ્રાણ આધાર, આશ્યા પ્રભુજી તણી-જિનજી ! ।
 આવૈ દેખણ ૧દીદાર,
 કે સુર રમણી ઘણી, જિનજી,
 મોઢ્યાં સુરનર ૨રાણુ-વાંણી પ્રભુની સુણી જિનજી ! મલ્લિ ૦ ॥ ૧ ॥

૫ નભાવીએ, ૬ તોપણ ૭ હાથથી ૮ પકડીએ, ૯ સારાપણુ,
 ૧ ચહેરો, ૨ રાજઓ,

અરજ કરું ^૩એક ક્યાન, ન માનો વિનતી-જિનજી !

શ્યો અપરાધ અ-ગાધ ? ન જાણો ^૪મીનતી જિનજી ।
જાગી પ્રભુજીશ્યું પ્રીત જે પૂરવણી હતી-જિનજી !
કરશ્યેં ઓર ન કોય, અરજ માહરી વતી-જિનજી ! મલ્લિ ૦ ॥૨॥
મનમેં અધિક વિચાર, કરું હું શ્યા લણી-જિનજી !,

^૫આસંગાયત આશ પૂર શો ^૬આફણી ।
લાજ વહો જિનરાજ કેં બાંહ ગહ્યાં તણી-જિનજી !,
તુમ ચરણે ચિત ચાહ ઉછાહ વધામણી-જિનજી ० મલ્લિ ૦ ॥૩॥
માહરે તુંહીજ સ્વામી નહી સંઢેહડો-જિનજી !,

સાહિબ પશુ મનમાંહિ સેવક કરી ^૭તેવડો-જિનજી ! ।
સમરથ સાહિબ જાણી ચરણ આવી અડયો-જિનજી !,
જાગ્યું લાગ્યું ^૮પંડુર પ્રભુ ચિત્તમેં ચડયો-જિનજી ! મલ્લિ ૦ ॥૪॥
રાજ ! નિવાળે આજ સેવક ચિતમાં ધરી-જિનજી ! ,
શું કહીએ ^૯અવદાત જાણો માહરાં ચરી-જિનજી ! ।
એહ માહરો ઈમ જાણી તારો બાંહેં કરી-જિનજી ,
રુચિર પ્રભુજી પાય સેવા સંપત્તિ વરી-જિનજી ! મલ્લિ ૦ ॥૫॥



૩ એકચિત્તથી, ૪ પ્રાર્થના. ૫ વધુ પ્રેમવાળા, ૬ પોતાની મેળે,
૭ ગણો, ૮ નિર્ભજ, ૯ વિગત,

(૧૦૩૧) (૪૩-૨૦અ) શ્રી મુનિસુવ્રત-જિન સ્તવન

મુનિસુવ્રત ^૧સુવ્રત જિમ મન વસ્યો,

જિમ રયોરાં મન મેહ-સુહંકર ।

સુશુષ્ણા સરસી સરસી પ્રીતડી,

કિમ હો ન આપે રે છેહ-સુહંકર-મુનિ૦ ॥૧॥

જે સાચા વાચા નાતે સહી,સેવક માથેં રે નેહ ।

૩નિવાહૈ રંગ ૪પતંગ-સુરંગી રીતડી,

તે સાહિબને રે કહો ચાહૈ-મુનિ૦ ॥૨॥

જે ચાહે ચરણારી ચાકરી,

અંતર તેહ શું રે કહો કિમ કીજયે ? ।

નયણુ-સલૂણે વયણુ-રસેં કરી,

તેહ શું નિચલ રંગ રમીજૈ-મુનિ૦ ॥૩॥

સુંદર સૂરતિ સહેજે સોહતી, મોહન ગારી રે મુઝ મન માની ।

ઓર ન^૫બાયું કાયું મન કરી,

નિરખ્યો નયણું ઓર ન દાની-મુનિ૦ ॥૪॥

કાશુણુ વહી બારસ દિન કેવલી થઈ, પ્રતિબોધ્યાં રે સુર-નરનારી ।

રૂચિરવિમલપ્રભુ સુર-તરૂ સારિખો,

પ્રભુજી પ્રણમ્યાં રે સંપત્તિ સારી-મુનિ૦ ॥૫॥



૧ સારા વ્રતવાળા, ૨ મોરના ૩ નભાવે, ૪ કાચો ૫ ઇચ્છું,

(૧૦૩૨) (૪૩-૨૦આ) શ્રી મુનિસુવ્રત-જિન સ્તવન
(રાગ સિંધુડો)

મુનિસુવ્રત આગેં રે, સેવક સુખ માંગે રે ।

લય લાગી પ્રભુ ! તારો, ભવ-સાયર થકી રે ॥૧॥

સાહિબ બલવંતા રે, પ્રભુ-નામ જપંતા રે ।

તુમ ચરણ નમંતાં, ઉભા ઓલજે ? રે ॥૨॥

૨ પૂરા પ્રભુ જાણી રે, મુઝ પ્રીત બંધાણી રે,

પ્રભુ આણી ચિત્ત, સેવક રાજ નિવાળ્યે રે ॥૩॥

વાતા ઉવિલભાવેરે, કિણે કામ ન આવે રે ॥

મુહાવે તે સાહિબ, કહો કિમ કેહને રે ? ॥૪॥

દુઃખ દેખીને નાસેં રે, સુખ આઁયા યવાસે રે ।

તે દાસની આશ, કહો કિમ પૂરસ્યો રે ॥૫॥

હો દરશણ દેવા રે ! આપો શિવ-મેવા રે ।

કહે રચિર પ્રભુ-સેવા, લેવા લગી લગી રે ॥૬॥



(૧૦૩૩) (૪૩-૨૧અ) શ્રી નમિનાથ-જિન સ્તવન

(રાગ મહાર-મેઢયા ઉપરમેહ ઝળુકે વીજલી હો લાલ

એ-દેશી)

નમિ-જિનચંદનરિંદ સુરિંદ નમૈ સદા હો લાલ-સુરિંદ૦,

વિજયરાય-સુત નામે કિં પામૈ સંપદા-હો લાલ-કિં પામૈ૦ ।

તું ત્રિભુવન-જન જન દેવા કિ સેવ સુધારીએ-

હો લાલ-કિ સેવ૦ ।

મહેર કરો મહારાજ, ભવોદધિ તારીએ-હો લાલ-ભવો૦ ॥૧॥

૧ સેવા કરે છે, ૨ શક્તિશાળી, ૩ લોભાવે ૪ પાછળ,

જે મોહ્યા નર નારી, ^૧મોહ-મદ ધારમાં-હો લાલ-કિ-મોહ૦,
 તે લાર્યા તેં નેહ ધરી એક તારમાં-હો લાલ-ધરી૦ ।
 જો નવિ પૂરો આશ આપણી વારમાં-હો લાલ-આપણી૦,
 તો ફેાકટ અભિમાન વહો છો ભારમાં-હો લાલ-વહો૦ ॥૨॥
 હરિ-હર બ્રહ્મા દેવ સહૂ જગ કારમાં-હો લાલ-સહૂ૦ ,
 ઓર ન સેવુ દેવ કિ આ અવતારમાં-હો લાલ-કિં આ૦ ,
 જ્યોં ^૨કતવારી-ચિત્ત વસે છે તારમાં હો લાલ-વસે છે૦,
 ત્યોં ચાહે મુઝ ચિત્ત પ્રભુ મનોહારમાં હો લાલ-પ્ર૦ ॥૩॥
 દીજ્યે દરિસણુ દેવ ! દયા કરી ડમો પરે-હો લાલ-દયા૦,
 ચિત્ત રહ્યો લલચાય પ્રભુજી ! ^૪તો પરે હો લાલ-પ્રભુ૦ ।
 પૂરો સેવક આશ નિરાશ ન મૂકીએ-હો લાલ-નિરાશ૦,
 રાજ ! નિવાજો આજ કિં વાય ન ચૂકીએ-હો લાલ-વાચ૦ ॥૪॥
 સુરતરુ ચિત્રાવેલિ ચિંતામણિ તું જ્યો-હો લાલ-ચિંતા૦,
 ગાતાં શ્રી જિનરાજ ! જનમ સફળો થયો-હો લાલ-જનમ૦ ।
 રુચિર પ્રભુ અવધાર આધાર તું માહરો-હો લાલ-આધાર૦,
 તું સાહિબ-સિરદાર હું સેવક તાહરો-હો લાલ-સેવક૦ ॥૫॥



(૧૦૩૪) (૪૩-૨૧આ) શ્રી નમિનાથ-જિન સ્તવન

(હાલ બાગ તું જાજ્યે રે ભમરા એ-દેશી)

વપ્રા-નંદન હો ! જિનજી !, સુર-નર વંદન-હો જિનજી ।

કાયા ^૧કુંદન હો ! જિનજી !, રચિત ચંદન હો જિનજી ! ॥૧॥

૧ મોહ-મદના પ્રવાહમાં, ૨ કાંતનાર-રેંટિયાવાળી બાઈનું મન તાર=
 ૩ની જાતમાં હોય, ૩ મારા પર, ૪ તારા પર, ૫ વચન,
 ૧ સોના જેવી,

ભવ-ભય-વારક હો ! જિનજી !, શિવ-સુખકારક-હો જિનજી ! ।
તું સુઝ તારક હો ! જિનજી !,

ગુણ-મણિ-ધારક-હો જિનજી ! ॥૨॥
પ્રાણુ-આધાર હો ! જિનજી, ! પ્રભુજી પ્યારા-હો જિનજી ! ।
નાણુ-આગારા હો ! રજિનજી !,

મોહનગારા-હો જિનજી ! ॥૩॥
તપ-મણિ ^૩આગર હો ! જિનજી ! તું સુખ સાગર-હો જિનજી ! ।
તેજે ^૪દિવાકર હો જિનજી,

ભવિ-જન ઠાકુર-હો જિનજી ॥ ૪ ॥
વિજય-રાયા-જયા હો જિનજી,
નમિ-જિન મન ભાયા-હો જિનજી ! ।
સુખ-સંપત્તિ ઢાયા-જિનજી !,
રુચિર-વિમલ ગાયા-જિનજી ! ॥ ૫ ॥



(૧૦૩૫) (૪૩-૨૨) શ્રી નેમિનાથ-જિન સ્તવન
(ઢાલ-ચંદ્રાયણાની)

યાદવ જન લેઈ કરો રે, આયા મંડપ ^૧ખારે,
પશુચ પુકારે રથ વાલીને, વલીયા નેમિ કુમાર ।

(ચાલ)

વલીયા નેમિ કુમાર ઈમ જાણી, રાજીમતી રાણી ^૨મુરઝાણી ।
માત-પિતા સહીયર વિલખાણી,

ખોલે આંસુ ભરાણી વાણી-જી નેમીસરજી રે ॥૧॥

૨ સ્થાન-ધર જેવા. ૩ ખાણ, ૪ સૂર્ય, ૧ ખારણે ૨ ખેદ પામી.

અબલાં-અવગુણ ઉવાહરી રે, યમુકો કાંચ વિસારી ! ।
આઠ ભવાંતર પ્રીતડી રે, આવો પવેજે સંભારી ॥

(ચાલ)

આવો વેગ સંભારી, મુકો કાંચ વિસારી ? ખાલા ।
યોવન જુગતિ વેષ રસાલા, નિહુર નાહ ! નવિ દીજ્યે ટાલા-
-૭૨ઠિ છાંડી આવો રહીયાલાણ, નેમીં ॥૨૧॥

ના પીચુડો પાપી ભવે રે, અમલસ લાવે ૧૦ મોર ।
પીઠ વિણ ખીણ એક દોહિલો રે, કંત છે નિપટ કઠોર ॥

(ચાલ)

કંતણ ! નિહુર ન કીજે હાંસી, છું તુજ પૂરવ-ભવની દાસી ।
અબલા અવસર કાં ગયો નાસી,
કંત ન છોડો નારો, નિરાસી-જી નેમીં ॥૨૨॥

રૂપ-ગુણે રંગે ભરી રે, છોડી રાજકુમારી ।
બહુ મૈત્રી લાલચ ભરી રે દીપ્તી શિવ તે પ્યારી ॥

(ચાલ)

શિવ ધૂતારી નામ કહાવૈ, રાગ વિના સહુ જગ ભરમાવે ।
પરનારી શું ચિત્ત લલચાવે,
વલી બ્રહ્મચારી નામ ધરાવે-જી નેમીં ॥૨૩॥

નિ-સનેહીસુ નેહલો રે, કાં કીધો કરતાર ! ।
પીઠ પૂઠે ચાલી સતી રે, પહૂંતી ગઠ ગિરનાર ॥

૩ આગળ કરી, ૪ મને, ૫ જલ્દી, ૬ વિયોગ, ૭ આગ્રહ, ૮ સુંદર,
૯ આમળો=દુઃખ, ૧૦ મને,

(ચાલ)

ગિરનારે સંજમ-વ્રત ધરી, પીઠ પહેલી શિવ-પંથ સીધારી ।
 ધન ધન નેમિશ રાજુલ નારી,
 રુચિરવિમલ પ્રભુ જય-જયકારી-શ્રી નેમીં ॥૫૫॥



(૧૦૩૬) (૪૩-૨૨આ) શ્રી નેમિનાથ જિન સ્તવન
 (રાગ-સોરઠ-કાનુડા તુમસો લાગી મોરી પ્રીત એ-દેશી)
 શામલીયા તુમશું લાગો મોરો નેહ,
 લાગો મોરો નેહરે શામળીયા ।

શિવાદેવી સુત સુંદર સોહે, નેમીસર ગુણ ગેહ રે-શામં ।
 વિષુ-અપરાધે, છોકરવાદે, 'છયલ ! ન દીજ્યે છેહરે-શામ ॥૧॥
 રયણી અંધારી બિજ ચમકે, ઝરમર વરસે મેહ રે-શામં ।
 રપાવસ ઋતુ પદમનીસું પીઠડા,

રાખીજ્યે રંગ રેહ રે-શામં ॥૨॥

સોવનવરણી લાલ સુરંગી, કામિની કોમલ દેહ રે-શામં ।
 શિવ ધૂતારીને વિસારી, આવો માહરે ગેહ રે-શામં ॥૩॥
 આંહું ગદ્યાંની લાજ ન જોડને, નિગુણ નિહુર નર તેહ રે-શામં ।
 પારસ-સંગે લોહ કંચન જ્યો,

હોવે સંપતિ એહ રે-શામં ॥૪॥

પ્રભુશ સાર કરો અખ મેરી, હું તુમ ચરણની ઝજેહ રે શામં ।
 રુચિર નેમિ-રાજુલ ગુણ ગાવે,
 પાવે સુખ અ-છેહ રે શામં ॥ ૫ ॥



૧ હાવલાસા, ૨ ચોમાસું, ૩ ધૂળ.

(૧૦૩૭) (૪૩-૨૨૩) શ્રી નેમિનાથ-જિન સ્તવન
(ફૂલડાની ઢેરી)

માત શિવાદેવી જાયા-રાજ ! સુર નર નારી ગુણ ગાયા-રાજ ! ।

ઘર આવે રે હઠીલા હઠ છોડી,

મહેં તો અરજ કરાં કર જોડી-રાજ ! ઘર૦

જીવ દયા મન આણી-રાજ !,

કાંચ છોડો જી ! રાજુલ રાણી-રાજ ! ઘર૦ ॥૧॥

થેંતો યાદવ-કુલરા હીરા-રાજ !,

રથ ફેરો રે નણુદીરા વીરા-રાજ !, ઘર૦ ।

છેહ છયલ ! નવિ દીજે-રાજ !,

ધણુ-ચૌવન લાહો લીજે-રાજ !-ઘર૦ ॥૨॥

ઘર છોડ્યાં જગ હાંસો-રાજ !,

ઘર આવી કરો ઘરવાસો-રાજ !-ઘર૦ ।

સખી ! કટક કીડી કાજઈ-રાજ !,

કરતાં કિમ કંત ! ન લાજે-રાજ !-ઘર૦ ॥૩॥

થેં તો મ્હાંમુંજી પ્રીત ઠગોરી-રાજ !,

કરી ચિત્તડું લીધું ચોરી-રાજ !-ઘર૦ ।

થેં તો મ્હાંમુંજી પ્રીત ઉતારી-રાજ !,

થાંનેં અવર મિલી ધૂતારી-રાજ !-ઘર૦ ॥૪॥

પીઠ થેં છોજી કામણુગારા-રાજ !,

અબલારા પ્રાણુ-આધારા-રાજ !-ઘર૦ ।

નયણાં નિંદ ન આવે-રાજ !,

શામલીયો સેંજી સુહાવે-રાજ !-ઘર૦ ॥૫॥

ધમ પીઉનેં ઝોલ્લાં લા દેતી-રાજ !,
 પીઉ પાસે સંજમ લેતી-રાજ !-ધર૦ ।
 રુચિરવિમલ સુખદાયા-રાજ !
 નેમિ-રાજૂલ શિવ-સુખ પાયા-રાજ !-ધર૦ ॥૬૧॥

(૧૦૩૮) (૪૩-૨૨૬) શ્રી નેમિનાથ-જિન સ્તવન
 (હાલ-“લાલુડાની”)

મહારા નેમિ પિયારા લો નેમજી !,
 શામલીયો શામલીયો કરતી સાદ કડં રે લો-
 -મહારા નેમ પીયારા લો-નેમિજી ॥
 ખિણુ-ખિણુ ઉણી નેમિ વિહુણી કેમ કડં રે લો-મહારા-નેમિ ॥
 ગોખૌ બૈઠી પીઉ દુખ પૈઠી વાટ જોડં રે લો-મહારા-નેમિ ॥
 પિઉ વિણુ સાસો દિન વરસ સામે કેમ જોડં રે ? લો-
 મહારા-નેમિ ॥૧૧॥

શામલીયો ૧વરસાલે સાલે સાલ સમે રે-મહારા નેમિ
 રાજમહેલમાં રાજ-રાણી સંગ રમે રે લો-મહારા નેમિ ।
 પરિહરિ તરુણી ધરણી પર ઘર કાંચ ભમે રે લો-
 મહારા નેમિ ॥

યૌવન-વય પામીને ફાકટ કાંચ ગમે રે લો-
 મહારા નેમિ ॥૨૧॥

પશુચ પુકાર સુણીને, દુણી રીસ ચડી રે લો-મહારા નેમિ,
 સોઠડલીને કાળે મારને માર પડી રે લો-મહારા નેમિ ।
 અન્ન ન ભાવે નાૌ નયણાં નીંદડી રે લો-મહારા નેમિ,

૧ ચોમાસામાં,

કામ સતાવૈ ભાવૈ તુમરૈ પ્રીતડી રે લો-

મહારાં નેમિં ॥૩૧॥

આમૂષણ અંગારા અંગના રે લો-

કોઈક બોલ કુ-બોલ ન સાલ્યા રંગના રે લો-મહારાં નેમિં ।

કીડી ઉપર કટકી ત્રટકી કાંચ કરો રે લો-મહારાં નેમિં,

વિણ અપરાધે કોષ હીયામાં કાંચ ધરો રે લો-મહારાં નેમિં ।

ચોલી ચરણ ચીરને કાઢે કાંચ ડરો રે લો-

મહારાં નેમિં ॥૩૨॥

નિહુર-હીયાના નાહ ન આપો છેહલો રે લો, મહારાં નેમિં,

અબલા સાથે જોડી અવિહડ નેહલો રે લો-મહારાં નેમિં ।

મૂંછાલા બૂપાલા કેટાલા કાંચા દીઓ રે લો-મહારાં નેમિં,

ખિણ ઘરમાં ખિણ આંગણ કાંમણ સ્થો કીઓ રે લો-

મહારાં નેમિં ॥૩૩॥

ઇમ વિલવંતી પદમિની પ્રેમે પરવડી રે લો-મહારાં નેમિં,

રહનેમિ પડિબોહી ઉજલ શુંગ ચડી રે લો-મહારાં નેમિં ।

નેમ સમીપે સંયમ લેઇ મોક્ષ ગઇ રે લો-મહારાં નેમિં,

રૂચિરવિમલ પ્રભુ ગાતાં આશા સફલ થઇ રે લો-

મહારાં નેમિં ॥૩૪॥



(૧૦૩૯) (૪૩-૨૩અ) શ્રી પાર્શ્વનાથ-જિન સ્તવન
(રાગ-સોરઠ “રંગ બુટી હો! સાહિબા! રંગરી બુટી એ-દેશી
અશ્વમેન-સુત સુંદર સોહે, પાસ પરમ હિતકારી-
વાઢેસર માનો વીનતડી; અરે કીજઈ છે રમીનતડી, વાઢેં

૩ આજી,

પ્રભુજી ! પરમ દયાલ દયા કરી, કીજે રસાર સંભારી હો-
સાહિબ ! માનો વિનતડી ॥૧૧॥

પ્રભુજી ! મૂરતિ પ્રાણથી પ્યારી હયાથી ન રહે ન્યારી-વાં ।
ઉત્તમ કેરી પ્રીત વિચારી,

મત મૂકો વિસારી-હો સાહિબ ॥૨૨॥
જનવલન જલંતો નાગ ઉગાર્યો,

પરમ ધરમ ચિત્ત ધારી-વાંહે ।
ચરણ-કમલકી દીજે સેવા,

ભવ-જળહિ પાર ઉતારી-હો સાહિબ ॥૩૩॥
પ્રભુજી ! ચરણ-નહવણ-જલ જોગે,

યાદવ જરા નિવારી-વાંહે ।
નાગાભુજન યોગી-સિદ્ધિ-સાધક,

એલગ કુબટ સંહારી-હો સાહિબ ॥૪૪॥
અબટ મહાભય દૂરિ નિવારી, દીજે સંપત્તિ સારી ।

રચિર પ્રભુજી મેરા સાહિબ, તુમ હો પર-ઉપગારી-
-હો ! સાહિબ ! માનો વિનતડી ॥૫૫॥



(૧૦૪૦) (૪૩-૨૩આ) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન

(મહા૩ મન મોહ્યું દરિયાખાંનસુ-એ-દેશી)

અશ્વસેન-જાતક પ્રતિ, કહું અતિ અરદાસ ।

દાસ કરી હવે જાણજયો, પૂરજયો આશ-

મહા૩ મન મોહ્યું વામા-નંદશું ॥૧૧॥

૨ સંભાળ, ૩ ધ્યાન દષ્ટ, ૪ અગ્નિ ૧ પુત્ર,

ગુણુ-અવગુણુ પ્રભુ ! માહરા, હીયડે મત રતાક ! ।
 મેહ ન જોએ હો ! વરસતો, એ અંબ ને આક-મ્હારું ॥૨૧॥
 તે સજ્જન શ્યું કીણ્યો ? હીયો હેજ ન જાસ ।
 અવસર પામી આપણો, મુકે સહાય નિરાશ-મ્હારું ॥૨૨॥
 ટવાર વડતે આપણે, વિલભાવે આમ ।
 અવસર આલે નિગમૈં, તે ફ્રાકટ સ્વામ-મ્હારું ॥૨૩॥
 ઉપર રંગ સુરંગ જે, હીયો રંગ ન રેહ ।
 કણેયર ફૂલ સમોવડે, લેખવીઈં તેહ-મ્હારું ॥૨૪॥
 રુચિર પ્રભુલુપું વિનંતી, માનો મહારાજ ।
 કાજ સુધારો દાસનાં, વધારીઈં લાજ-મ્હારું ॥૨૫॥



(૧૦૪૧) (૪૩-૨૩૬) શ્રી પાર્શ્વનાથ-જિન સ્તવન

(અજળ સૂરંગી હો હંજ માર લોવડી એ-દેશી)

સૂરતિ ખ્યારી હો ! પ્રભુલ !, તાહરી દીઠાં ૧ દોલત થાય ।
 રાજ ! રનિવાળે હો ! આજ મયા કરી,

તુમ વિષ્ણુ ખિણુ ન સુહાય-સૂરતિ ॥૧॥

સુર-નર કોડિ હો ! કર જોડી નમે, ગોડી ગરીબ-નિવાજ ।
 દેવ ન સેવું હો !, અવર ઇણે ભવે,

માહરે પ્રભુલુપું કાજ-સૂરતિ ॥૨॥

૨ વિચારો, ૩ પોતાની ચક્તી કળાએ ટટલાવે અને અવસર વીત્યે
 આપે તે શું સ્વામી કહેવાય ! (ચોથી ગાથાનો અર્થ)

૧ લક્ષ્મી, ૨ મહેરબાની કરો,

સાહિબ સાચા હો ! વાચા મુજશું પાલન્યો,

પ્રભુજી પ્રાણુ-આધાર ।

સાર કરન્યો હો ! દેન્યો ચરણાં ચાકરી,

મત મૂકો વિસાર-સૂરતિ ॥૩૥

ચાતક ચાહે ! ઝડમાહો જિમ મેહનો,

જિમ મધુકર-અરવિંદ ।

નયણુ-ચિકોરી હો ! ઝડોરી પંજેરી નેહસું,

ચાહે દુમ મુખ ચંદ-સૂરતિ ॥૪૥

સહજ-સુરંગા હો ! ચંગા સેગલ-ફૂલ જ્યો,

કામ પડયાં કુમલાય ।

ભીડ ન ભાંગે હો ! ભીડ પડયાં થકાં,

તે પ્રભુ નાવે દ્વાય-સૂરતિ ॥૫૥

નેહ ન તોડો હો ! જોડો પૂરવ પ્રીતડી, સુગુણાં સરસ સનેહ ।

ખાંડ અદ્યાની હો ! લાજ નિવાહીએ,

ઈમ કિમ દીજે છેહ-સૂરતિ ॥૬૥

અિજમતગારાં હો ! ખ્યારાં અવશુણુ ૭છાવરે,

તે મહી મોટા મિત્ત ।

અવશુણુ જાણી હો ! તાણી તોડે પ્રીતડી,

એ નિગુણાંની રીત-સૂરતિ ॥૭૥

નેહ સંભાલો હો ! ટાલો મનનો આમલો, પ્રભુજી દીન-દયાલ ।

નયણુ રસીલો હો ! વયણુ વિનોદસ્થું,

કોન્યો રંગ રસાલ-સૂરતિ ॥૮૥

૩ ઉત્સુક, ૪ દોરી, ૫ જોડી, ૬ અનુકૂળ, ૭ ઢાંકે,

ચરણ ન છોડું હો પ્રભુજી ! હું તાહરા,
 ‘ભ’ લગિ ઘટમાં સાસ ।
 રૂચિર ગોહીચા હો ! સાચા સાહેબ સેવતાં,
 સફલ ફલી મુઝ આશ-સૂરતિ ॥૬॥



(૧૦૪૨) (૪૩-૨૪) શ્રી મહાવીર-જિન સ્તવન
 (રાગ-મહાર “હીટારનાની” દેશી)

સિદ્ધારથ-કુલ કમલ-^૧દિણ્યર, સાચર પેરે ગંભીર,
 નમિત વર-સુર-અસુર-કિન્નર, વર વિદ્યાધર વીર ।
 કુમતિ-રંગજન ભવિક-રંગન, કંચન જેમ શરીર,
 કમ^૩-રિપુદલ-બલ-વિનાશન, શાસન-ભાસન ધીર-
 -અહો ! મેરે સાહિબ ! જૂલત શ્રીવર્ધમાન ॥
 કંચન-ખંભ સુરભ દોનુ ^૪પાચ-^૫પટલી ચંગ,
 હીટાર જોર જરા વસુંજરી, હીરા લાલ સુરંગ ।
 કંકેલિહરે પ્રભુકો જૂલાવતી, ગાવતી ગીત સુરંભ,
 છપ્પન કુમરી દેત ભમરી,
 અમરી અતિ-ઉછરંગ-અહો ! મેરે ॥૨॥

એક છત્ર ધારે ચમર ઢારે, કરે રાગ મહાર,
 એક ^૭વીન ^૮વાએ મુજશ ગાએ, ^૯વાએ ^{૧૦}વાંશ ઉદાર ।

૮ જ્યાં સુધી.

૧ સૂર ૨ દૂર કરનાર, ૩ કર્મ શત્રુના સૈન્યના બળને નાશ કરનાર,
 ૪ પાયા ૫ ઉપરની પાટલી, ૬ કંકાવરમાં ૭ વીણા, ૮ વગાડે
 ૯ વગાડે, ૧૦ વાંસલી,

એકે નાટક કરતી રંગ ધરતી, નેહ નિરખતી નાર,
ચિરંજીવ સામી યુગતિગામી નામથી નિસ્તાર-અહો મેરેં ॥૩૧॥
ઈમ ભાવ ભાવી માય મનાવી, સુરી ગર્થ નિજધામ,
ચોસઠ સુરવર મેરુ ગિરિવર, વીર જનમ વિધાન ।
વિધિ કરી શુભમતિ સુરપતિ, કરત જિન ગુણ ગાન,
નિરખીઈ નિત નવલ-નેહે અમલ વાધે વાન-અહો મેરેં ॥૩૨॥
આદર કરી ધરી હેજ હીયસું, દીજઈ સન્માન,
તારીએ સેવ સુધારીએ વારીએ દુરિત-નિદાન ।
તુંડું તન-ધન-ધન જીવન મેરો, તુંડી પરમ નિધાન,
રુચિરાવમલ પ્રભુજી ચરણશુ,
લાગો મો મન ધ્યાન-અહો મેરેં ॥૩૩॥



કળશ

સકલ સુહંકર જિનવર, પાય નમ્યાં હો !
અતિ આણુંદ થાય કિ ।
ત્રકપલ અજિત સંભવ પ્રભુ,
અભિનંદન હો ! સુમતિ જિનરાય કિ-અકળ૦ ॥૧॥
ચંદ્રપ્રભ સુવિધ પ્રતિ,
શીતલ શ્રેયાંસ નમું નિસિ દિન કિ-અકળ૦ ॥૨॥
વાસુપૂજ્ય વિમલ અનંત ધર્મ શાંતિ,
કુંથુ અર હો ! મલિલ સુનિ સુવત કિ ।
નમિ નેમિ પાસ ત્રિશલાસુત હો !
મહાવીર મહંત કિ-અકળ૦ ॥૩॥

ચોવીસ જિણુંદ સુ-ચોવીશી હો !

પ્રભુજીની ગાઈએ ચંગ કિ ।

જે લણુશે ભવિ ભાવશું,

તે લહશે હો ! નવ નિધિ રિદ્ધિ રંગ કિ-અકળ૦ ॥૪॥

સંવત સતર એકસઠે,

દશગુણ સુદિ હો ! દશમી ગુરુવાર કિ ।

ભોજવિમલ કવિરાજનો, સીસ પલણી હો !

રુચિર જયકાર કિ-અકળ૦ ॥૫॥

॥ ઇતિ શ્રીચોવીસ જિન સ્તવન સંપૂર્ણ. ॥

॥ પં. શ્રી નિત્ય વિજય ગણી લિખિતં ॥

॥ સુ-શ્રાવિકા તેજ કુંઝર પઠનાથ. ॥

॥ સંવત ૧૭૮૨ વર્ષે ॥ છ ॥



શ્રી વર્ધમાનસ્વામિને નમઃ
શ્રી ભાવપ્રભ સૂરિ કૃત
સ્તવન-ચોવીસી

શ્રી મહિમાપ્રભ-સૂરિ ગુરુશ્ચો નમઃ

(૧૦૪૩) (૪૪-૧) શ્રી ઋષભનાથ જિન સ્તવન
(પંથીડા સંદેશો પૂજ્યજી નંદી વિનવે રે એ દેશી)

આદિ જિજ્ઞેસર ! હાસનૌ વિનતી રે,

મુઝ ચિત્ત-આંગણીઈ પધાર રે ।

ચરણ-કમલની ૧આલો ! આકરી રે,

જીવન કર સફલો અવતાર રે-આદિ૦ ॥૧॥

હાથ ન ૨સાહ્યા આવઈ હાથીયા રે,

પણિ તુલશયુ' મહારઈ સુખ પ્રીતિ રે ।

જો આવો તો મુઝ મોટો કરો રે,

૩દાળઈ દુશમન પામું જીત રે-આદિ૦ ॥૨॥

મનઈ નાણો સેવક ધરિ દુખલો રે,

તુમ નામઈ મુઝ ઋદ્ધિ અ-પાર રે ।

સાહિબ પણિ ભૂખ્યા આદર તણા રે,

આવ્યાં ઉપજઈ ધરમ ૪કરાર રે-આદિ૦ ॥૩॥

મન ૫નાહવું છાતુ નહી રહે રે,

૧ આપો, ૨ પકડયા, ૩ દઆવવાથી, ૪ સંતોષ, ૫ નાતું,

જાણુસ્યે આઠ્યા મહારા સ્વામિ રે ।
 આદર-દર્શનઈ હું આપશ્યું રે,
 ભક્તિ સોપારી-પાન પણામ રે-આદિં ॥૪૮॥
 આ શી વાત ? કંધણી મહારઈ ઘરઈ રે,
 આઠ્યા મરુદેવીના નંદ રે ।
 શ્રી ભાવપ્રભુસૂરિ સુખ ઉપજઈ રે,
 દેખી આદીશ્વર-મુખ-ચંદ રે આદિં ॥૪૯॥



(૧૦૪૪) (૪૪-૨) શ્રી અજિતનાથ-જિન સ્તવન
 (રાગ રસીયાની)

૧ વિજયા-નંદન મુગનઈ વાહલો,
 જીવ-સમો જિનરાજ-મોરા વાલમા ! ।
 પંથ દેખાડઈ મુગતિનો રે પાધરો,
 કરઈ મન વંછિત કાજ-મોરાં ॥૧॥
 મુગ રંગ લાગો અજિત-જિણુંદસ્યું,
 હીયડઈ ઝેહું રે હેજ-મોરાં ।
 ઝકહીઈ ન વાલો ૪ વિસારઈ પડઈ,
 નિત વસઈ ચિત્તનઈ રે સેજ-મોરાં ॥૨॥
 જોહવો ખાદિર-રૂપઈ પકૂટરો, તેહવા ગુણ અંતરંગ-મોરાં ।
 નય વ્યવહાર-નિશ્ચય ઝેહું ૬ પરીકઈ,
 નિરૂપણ ગુણ-સંગ-મોરાં મુગં ॥૩॥

૬ માલિક, ૧ પ્રભુજીની માતાનું નામ, ૨ સીધો, ૩ ક્યારેય પણ-
 ૪ ભૂલાતા નથી, ૫ સુંદર, ૬ આધાર,

કાચની ઁકરચીઠ તે રાચઈ નહી,

જે 'હલ્યુ' હીરે રે ચિત્ત-મોટાં ।

ગુણ દેખીનઈ જે 'ગહિલુ' થયું,

બીજઈ ન બાંધઈ તે પ્રીત-મોરાં મુઝાં ॥૪૥॥

જિમ ચાંદાથી ન જુદી ચાંદણી,

જિમ વલી કૂલથી બિંટ-મોરાં ।

તિમ જિનરાજથી જૂદી નવિ રહે,

રૂડી મહારી મનડાની મિંટ-મોરાં મુઝાં ॥૫૥॥

સ્વાસ્થવિષ્ણુ ઉપગારી સહજથી, ત્રિણુ ભુવનનો રે તાલ-મોટાં ।

શ્રીભાવપ્રભસૂરિ જિનરાજનું,

ધ્યાન ધરઈ દિન-રાત-મોરાં મુઝાં ॥૬૥॥

(૧૦૪૫) (૪૪-૩) સંભવનાથ-જિન સ્તવન

(રાગ હમરાની)

સંભવ-જિનસ્યું ચિત્ત વસ્યું, લાગી લોકોત્તર-પ્રીતિ-રંગીલે ।

પુણ્ય-દલાલ પાસે રહી,

મેલવ્યો ત્રિભુવન મીત-રંગીલે ! સંભવ ॥૧॥

સૂતાં સંભવ-જિનસ્યું, હિંડતાં સંભવ નામ-રંગીલે ! ।

બઘઈતાં બિઠતાં સંભવ,

સંભવ કરતાં કામ-રંગીલે સંભવ ॥૨॥

લોક ગણે 'ગહિલો' થયો, હું ગણું 'ગહિલો' લોક-રંગીલે ! ।

૭ નાના કકડાથી, ૮ લળ્યું ૯ ઘેલું. ૧ ઘેલો,

પરમેસર શ્યું^૨ આશકી,

૩રિંગા ન જાણુઈ^૪ થોક-રંગીલે ! સંભવ૦ ॥૩૥

હું મતવાલો નાથનો, જે-પરવાહી દાસ-રંગીલે ।

આશ ધરું એક નાથની,

ચરણ-સેવાની ખ્યાસ-રંગીલે ! સંભવ૦ ॥૪૥

આગમ-પંથઈ ચાલતાં, ગુણીશ્યું^૫ ધરતા રાગ-રંગીલે ! ।

શ્રીભાવપ્રભસૂરિ કહે,

પામીઈ જગિ સોભાગ-રંગીલે ! સંભવ૦ ॥૫૥



(૧૦૪૬) (૪૪-૪) શ્રી અભિનંદનજિન સ્તવન

(રહો રે રહો રે વાલહા એ-દેશો)

અભિનંદન-ચંદન નવો, શીતલ સહજ સુવાસ-લાલ રે ।

ગુણ^૧ પરિમલઈ મોહી રહ્યા,

સુર-નર જેહના દાસ-લાલ રે-અભિ૦ ॥૧૥

કાલ અનાદિની કામના, વિષય-કષાયની આગિ-લાલ રે ।

એહ^૨ શમાવાઈ મૂલથી,

જે સેવઈ^૩ પય લાગિ-લાલ રે-અભિ૦ ॥૨૥

^૪ જ્ઞાન-દર્શન-ચારિત્ર જલે, સરસ રહે જે સદાય-લાલ રે ।

મધમાખી બઈસે નહી,

^૫ અરઈ^૬ નખેરુ થાય-લાલ રે-અભિ૦ ॥૩૥

૨ ગાદપ્રીત, ૩ અજ્ઞાનમૂદ, ૪ ધણા,

૧ સુગંધથી, ૨ શાંત કરે, ૩ ચરણે સેવક થઈ, ૪ જ્ઞાન, દર્શન,

ચારિત્ર પાણીથી, ૫ ઉકરડે ૬ ગમે તેટલી વ્યાકુળ,

અ-વિનાશી ગુણ એહના, સેવ્યા સુખ એક તાર-લાલ રે ।
જે ભવી ધરમના ભોગીયા,

તે ધરધ એહશું પ્યાર-લાલરે-અભિં ॥૪॥

જે ટાલઈ કર્મતાપને, તેહજ ચંદન શુદ્ધ લાલ રે ।

શ્રીભાવપ્રભસૂરિ કહઈ,

જાણે જેહ વિબુધ-લાલ રે-અભિં ॥ ૫ ॥



(૧૦૪૭) (૪૪-૫) શ્રી સુમતિનાથ-જિન સ્તવન

(ઇંડર આંખા આંખલી રે એ દેશી)

મેઘ-રાયા કુલ ચંદલો રે-લાલા, મંગલા માત મહાર ।

પ્રભુ તીર્થ"કર પાંચમેા રે લાલા, કરઈ જગત-ઉપગાર-

મહારે મન માન્યો-

સુમતિજિન-નાહ,

દેખાડઈ ધર્મરાહ,

ચોલવઈ અંતરદાહ,

-આજ આંગણીઈ ઉત્સાહ-મહારે ॥૧॥

મુજ પુણ્ય રેઉજલ પક્ષમઈ રે-લાલા, ચટકી ચાંદરણી ઝંજેર ।

દેખી જિન-સુખ-ચંદલો રે-લાલા

નાચઈ ચિત્ત ચકોર-મહારે ॥૨॥

કુણ હીરા ! કુણ કાંકરા રે ! લાલા

જૂદા ન જાણતો જેહ ।

૧ મુજવે, ૨ ચટકી કલાએ છે, ૩ ફેલાઈ છે, ૪ વધુ.

હિવર્ધ સમઝયુ મુઝને થઈને રે-લાલા,

નાથશ્યુ^૧ લાગેા નેહ-મ્હારે^૨ ॥૩॥

નિર્ગંધ^૩ પ આઉલ-કૂલડાં રે-લાલા, સુંધે ન^૪ જૂઝ-ભુંગ^૫ ।

તિમ ગુણ-હીણશ્યુ^૬ હિવર્ધ રે લાલા,

મ્હારો ન બધસિઈ રંગ-મ્હારે^૭ ॥૪॥

સાચઈ મન સેવ્યા થકું રે લાલા, જે પ્રભુ પૂરઈ આશ ।

શ્રીભાવપ્રભસૂરિ ઠહે રે-લાલા,

તેહશ્યુ^૮ પ્રેમ-પ્રકાશ-મ્હારે^૯ ॥ ૫ ॥



(૧૦૪૮) (૪૪-૬) શ્રી પદ્મપ્રભ-જિન સ્તવન

(આ છે લાલ—એ દેશી)

પદ્મપ્રભ જિનરાય, રાતી જેહની કાય,

જિનવર લાલ ! હું પણિ^૧ રાતો પ્રેમઈ ગ્રહ્યો ।

રયણ સિંહાસન સાર, અતિશય ગુણે^૨ અંખાર

જિનવર લાલ ! રુપઈ તો વરસી રહ્યો. ॥૧॥

મસ્તકઈ છત્ર ઢલાય, આમર સાર વિંઝાય,

જિનવર લાલ ! અપચ્છરા આગલિ નાચતી ।

સોહઈ અશોકનો છાય, ધર્મધ્વજ લહિકાય

જિનવરલાલ ! હૌં હૌં ફુંડુભિ વાજતી. ॥૨॥

યોજન ગામિની વાણી, દેશના અમીય સમાણી

જિનવર લાલ ! ભવિક-વન સંશય હરઈ ।

૫ આવવના કૂલ ૬ જૂઝ નામના સુગંધી કૂલના ભમરા.

૧ આસક્ત, ૨ શોભા;

ઇંદ્રાણી ગુણ ગાય, હીયડઈ હરખ ન માય,
 જિનવર લાલ ! ઇંદ્ર ચઉસઠિ સ્તવના કરઈ. ॥૩॥
 ઓ સાયું કઈ સુણ, પ્રભુ-સરૂપ કેલઈ કુણ,
 જિનવર લાલ ! મુખ પુનિમ ચંદો હરઈ ?
 દર્શન ઇંદ્ર લોભાય, અણુ દીઠાં-દુઃખ થાય,
 જિનવર લાલ ! રાતિ દિવસ હીયડઈ વસઈ ॥૪॥
 ચંદને ચાહે ચકોર, જિમ મેહાને મોર,
 જિનવર લાલ ! તિમ વિસાડું નહી ઘડી ।
 કહઈ ભાવ-પ્રભસૂરીશ, તુંહીજ મહારઈ ઇશ,
 જિનવર લાલ ! તુમ્હસ્યું પ્રીતિ રૂડઈ જડી ॥૫॥



(૧૦૪૯) (૪૪-૭) શ્રી સુપાર્શ્વનાથ-જિન સ્તવન
 (મન સરોવર હંસલો એ-દેશી)

શ્રી સુપાર્શ્વજિન વાલહો, જઈ લોકાંતઈ વસીઓ રે ।
 દિવઈ ઇહાં આવઈ નહીં,
 સાસય-સુખનો રસીઓ રે-શ્રી૦ ॥૧॥
 કુણ ભાંતિ કરૂં ચાકરી, જેહનું મિલવું દોહિલું રે ।
 સુણિ શિષ્ય તવ સુગુરૂ કહઈ,
 એહનું સેવવું સોહિલું રે-શ્રી૦ ॥૨॥
 શુદ્ધ-સ્વભાવ જિહુંદના, ચ્યાર નિખેપ છે સાચા રે ।
 ત્રિભુવનને તારઈ સદા, માનઈ નહી નર કાચા રે-શ્રી૦ ॥૩॥

૩ કળી શકે = ઓળખી શકે.

સચંભૂરભણુ-સચુદ્રમાં, માછલું સમકિત પામઈ રે ।

જિનખિંબ-સમ અન્ય માછલઈ રે

સાતિ સમરણુ જામઈ રે-શ્રી૦ ॥૪૮॥

જે જે નિખેપે સેવીઈ, દિલ-ભર દિલ નઈ ઉલ્લાસઈ રે ।

શ્રી ભાવપ્રભસૂરિ કહઈ, વેગલા તે પિણુ પાસઈ રે-શ્રી૦ ॥૪૯॥

(૧૦૫૦) (૪૪-૮) શ્રી ચંદ્રપ્રભ-જિન સ્તવન
(નણદલની દેશી)

સજની ! હે ! સજની ! ચંદ્રપ્રભ ચિત્ત વસ્યો,

દૂજો ન એહવો દેવ-સજની૦ ।

આહિર-અંતર ઉજલો,

કીજઈ એહની સેવ-સજની ! ચંદ્રપ્રભ૦ ॥૧॥

આહિર સ્ફટિક-સ્યા ઉજલા, મનના મેલા જેહુ-સજની૦ ।

કીધા ગુણુ જાણુ નહી,

તેહરયું ન કીજઈ નેહુ-સજની૦ ચંદ્ર૦ ॥૨॥

જે આચારઈ ઉજલો, પર-ઉપગારી સદાય-સજની૦ ।

તે સાથઈ મન મેલીઈ,

જન્મ-મરણુ દુઃખ જાય-સજની૦ ચંદ્ર૦ ॥૩॥

અનુભવઈ એહજ ઉજલો, કથની કરણીઈ શુદ્ધ-સજની૦ ।

પણિ મનમાં નવિ ધારીઈ, ઉજલું એતલું દૂધ-સજની૦ ॥૪॥

પ્રભુનો પગ-રજ ફરપ્રતાં, ઉપજે પરમ કરાર-સજની૦ ।

શ્રીભાવપ્રભસૂરિ કહે,

એહને તું ન વિસાર-સજની૦ ચંદ્ર૦ ॥૫॥



(૧૦૫૧) (૪૪-૯) શ્રી સુવિધિનાથ-જિન સ્તવન

(વીંછીયાની દેશી)

મુજ સુવિધિ-જિણેસર મન વસ્યો, અંતરયામી અરિહંત રે ।
દેહમાં દૂષણ દીસઈ નહી, શુણુ-સ્તનાઠર ભગવંત રે-મુજ ॥
૧ પાણીવલ ૨ પડખે નડે પ્યાર રે,

વલી નવો જગાંવઈ નેહલો,

સંભરાવઈ વારોવાર રે-મુજ ॥ ૧ ॥

હુંતો એહની આણુ શિરે ધરું, શુદ્ધ-વિધિ કરું એહની સેવ રે ।
ચિંતામણિથી અધિકો ગણું,

દેસ્યે શુભફલ એ દેવ રે-મુજ ॥ ૨ ॥

જેહ સમક્ષિત-ધારી સ્વામીના, સેવા-રસ-સ્વાદના જાણુ રે ।
તે વિષયારસ રીઝઈ નહી,

જાણુઈ એતો છે છાણુ રે-મુજ ॥ ૩ ॥

જેહને ઘટમેં અનુભવ રમઈ, તેહને પ્રભુશ્યું ખડું પ્રીતિ રે ।
સફલી પૂજ તેહની કહી, લોકોત્તર એ છે રીત રે-મુજ ॥ ૪ ॥

જિન-સેવા તપ જપ જાણીઈ, જિન-સેવા અરિત શીલ રે ।
ધમ શ્રીભાવપ્રભસૂરિ કહે,

જિન-સેવા અધ્યાતમ ઈલ રે-મુજ ॥ ૫ ॥



૧ પાણીદાર=મર્વ-શુણુ-સંપત્ત આપ જેવા, ૨ વિના, ૩ પ્રેમ,
૪ જીવનમાં

(૧૦૫૨) (૪૪-૧૦) શ્રી શીતલનાથ-જિન સ્તવન
(ગિરિથી નદીયાં ઉતરઈ રે લો-એ દેશી)

શીતલજિન તુઝ મૂર્તિ રે લો,

લોભાણાં મુઝ નયણ રે-સ-સનેહી નાથ ! ।

શાંત-મુદ્રા શેલે ઘણી રે લો,

પ્રભુ સયણાંને સયણ રે-શીતલ ॥૧॥

કચિ જાગી તુઝ શાસનઈ રે લો !

તુંહીજ મહારે સ્વામ રે-સ-સનેહી ! ।

આપો સમકિત-સુખડી રે લો !,

જે ન પમાડે નામ રે-સ-સનેહી ! ० શીતલ ॥૨॥

હું આંચો આશા-બર્યો રે લો !

ન કરો મુઝને નિરાશ રે-સ-સનેહી ! ।

આપો અમ્હ રયોગ ચાકરી રે લો !,

કરો હજૂરી દાસ રે-સ-સનેહી ! ० શીતલ ॥૩॥

હું છડીદાર સ્વામી તણો રે લો !,

કુણ કરઈ ! મુજસ્યું જોર રે-સ-સનેહી ! ।

ત્રાસ પામઈ તુમ્હ તેજથી રે લો !,

વિષય-કષાય જે ચોર રે-સ-સનેહી ! ० શીતલ ॥૪॥

એહ ઉપસાદ જિણુંદનો રે લો !

જિહાં જાણું તિહાં લહું માન રે-સ-સનેહી !

શ્રી ભાવપ્રભસૂરિ કહઈ રે લો !

શિવ-સુખ આપો પ્રધાન રે-સ-સનેહી ! શીતલ ॥૫॥



૧ દુઃખ, ૨ લાયક, ૩ મહેરબાની,

(૧૦૫૩) (૪૪-૧૧) શ્રી શ્રેયાંસનાથ-જિન સ્તવન

(પ્રથમ ગોવાલા તણે ભવેજી એ દેશી)

ઘર બધીં આવી મિલ્યાજી, શ્રી શ્રેયાંસ -જિણુંદ ।

^૧બધીં હું ઉભો થયોજી, દીકું રૂપ ^૨અ-મંદ,-

જિનેસર ! તઈ મોહીઉં મુઝ મન ।

ઝડ લાગી નેહ-નયણલેજી, હૃદયસ્થો પાઉસ તન-જિને૦ ॥૧૧॥

સમકિત આપો મહોરીયોજી સેવા પાકી દ્રાખ ।

દીપ્ત્યું અનુભવ આંગણુંજી, પૂરાણો અભિલાષ-જિને૦ ॥૨૧॥

નિર્મલ ચિત્ત-સિંહાસણુધંજી, બેસારું જિતરાય ।

ધર્મ-રંગ કંકુ-રસધંજી, પૂજું પ્રભુના પાય-જિને૦ ॥૩૧॥

ઉપશમ નિર્મલ મોતીધંજી, વધાવું જગનાથ ।

ભલઈ દર્શન દીધું તુમહેજી, વિનવું જોડી હાથ-જિને૦ ॥૪૧॥

તુમને તો ઈમજ ઘટધંજી, ^૩લેખવો મુઝને દાસ ।

શ્રીભાવપ્રભસૂરિ કહેજી, પૂરી મુઝ મન આસ-જિને૦ ॥૫૧॥



(૧૦૫૪) (૪૪-૧૨) શ્રી વાસુપૂજ્યસ્વામી-જિન સ્તવન

(ચતુર રુનેહી મોહનાં-એ દેશી)

વાસુપૂજ્ય મુઝ તારીઈ, ^૧ઘઈ ^૨હોયાવ તું મુઝનઈ રે ।

બલ ઈ બાંહિ પસારીને,

તારક કહે સહુ તુઝનઈ રે-વાસુ ॥૧૧॥

^૧ ચકિત થઇને. ^૨ અપૂર્વ, ^૩ માની લો,

^૧ આપો, ^૨ હૃદયનો પ્રેમ,

૩ ભવ-હરીઉ દુઃખ-ગાજતો, ચો-ગતિ ચ્યાર જ્યાં આરા રે ।
 ૪ કૂટરો લાગઈ ફેરસતાં, જેહના અનુભવ આરા રે-વાસુ ॥૨૧॥
 આશા પવેલ જિહાં ઉછરે, જન્મ-મરણ જલ ઉડાં રે ।
 કામ-કપાય-મદ માછલાં,

લક્ષણ કરઈ જિહાં ભૂંડા રે-વાસુ ॥૨૨॥
 તારુ જે અભિમાનથી, એ માંહે પડઈ ઉડી રે ।
 પામઈ ડુબકી નીકલા, આપડા રહે તે ખૂડી રે-વાસુ ॥૨૩॥
 તારણ-તરણતણી કલા, તે એક તું ૧ અવધારઈ રે ।
 ભાવપ્રેમ કહે તું જ્યો, ૭ તટઈ ખમ્મો જે ૮ તારઈ રે-વાસુ ॥૨૪॥



(૧૦૫૫)(૪૪-૧૩) શ્રી વિમલનાથ-જિન સ્તવન

વિમલ-જિણુંદ સુખકારી,

સાચો જે શીલ-વ્રતધારીરે-જિનવર બ્રહ્મચારી ।

૧ કામ-ગજ જિણે મૂલથી ગાલ્યો,

વેદ-તાપ અનાદિનો ટાલ્યો રે-જિન ॥૧॥

મનમાં શ્યું જુઓ? અધિકાર, પામી અતિશય ઠંકુરાઈ રે-જિન ॥

જિહાં જાગ્યું ૨ સહજનું શીલ,

કુણ લોપઈ? તેહની લીલ રે-જિન ॥૨॥

નવ વાડી જે શીલ-૩ રખોયું,

વ્યવહારથી તે આરોપું રે-જિન ॥

૩ સંસારરૂપ દરીયો, ૪ સુંદર, ૫ ભરતી ૬ જાણે છે, ૭ કિનારે,

૮ તારે છે. ૧ કામરૂપ હાથી, ૨ અંદરનું સ્વાભાવિક, ૩ રક્ષણ,

જિહાં કમં તણી થિતિ પાકી,

વ્યવહારની યદુડી ત્યાં થાકી રે-જિનં ॥૩૭॥

કોઈ સ્ત્રી-લય સ્ત્રી-લય ભાખઈ,

રાંક આંખ પાટો રાખઈ રે-જિનં ॥

કોઈ ધારઈ વજ-ઠછોટો,

મૂઠ-મતિનો પંથ એ ખોટો રે-જિનં ॥૪૦॥

વિષય-લાલસા જેહને છીપી,

તિહાંહી જ શીલ-દૌલત દાપી રે-જિનં ॥

ભાવપ્રભ કહે ગુણ ગેહા,

મુઝ વિમલ-જિણ્દસ્થું નેહા રે-જિનં ॥૪૧॥



(૧૦૫૬) (૪૪-૧૪) શ્રી અનંતનાથ-જિન સ્તવન

(માલી કેરે બાગમેં-એ દેશી)

અનંતનાથ ભગવંતની, ^૧ખાંહિ હું વલગો લો-અહો રે ખાંહિં ॥

રહેહ છાયા તણી પરિં, થાઉં નહીં અલગો લો-અહો રે થાઉં ॥

-મનડાનો માને પ્રભુજી રે લો ॥૧॥

કાલ અનાદિ ^૩મિથ્યામતિં, ઘણું મુઝલે લમાવ્યો લો-મનનાં ॥

ધાંચી ઘર જિમ બલદીયો, તેહી પાર ન આવ્યો લો તેહીં ॥

ઔઠરાજના ઔકમેં, તુમહે દષ્ટિ આવ્યા લો-તુમહેં ॥

આજ થયાં વધામણાં,

મુઝને પ્રભુ ભાવ્યા લો-મુઝનેં મનડાનો ॥૩॥

૪ દોડ,

૧ નિઆએ, ૨ શરીરનો પડવાયો ૩ મિથ્યાત્વની બુદ્ધિએ,

કલ્પતરુની છાંહડી, જેહવી સુખદાઈ દો-જેહવીં ।

તેહવી સંગતિ સ્વામીની,

મીઠી યમઈ પાઈ દો-મઈં મનડાનોં ॥૪॥

આપ-મેલે સુખ આલસ્યે, કુણુ પ્રભુને કહેસ્યે દો,-કુણું ।

ભાવપ્રભ કહે દાસ જો,

તુમ્હ ચરણે દહિસ્યે દો-તુમ્હં મનડાનોં ॥૫॥

★

(૧૦૫૭) (૪૪-૧૫) શ્રી ધર્મનાથ-જિન સ્તવન

(વીરે વખાણી રાણી ચેલણાજી-એ દેશી)

હું જાણું ¹હિવણાં જઈજી, નાથનઈ ઠંગસ્યું રનિહાલ ।

³માલિમ નાથનઈ નહી પડઈજી,

વિરુઠં માયા તણું જાલ-હુંં ॥૧॥

દીન ઘણું જઈ ભાખસ્યુંજી, નાથ છઈ પરમ-કૃપાલ ।

આપસ્યે નિજ-સુખના ⁴લવાજી,

ફલસ્યે મનોરથ-માલ-હુંં ॥ ૨ ॥

વિષય-સ્વાદનૈ વિલસતાંજી, આખસ્યું એ પણિ ચીઝ ।

નાથ તો સર્વ જાણી રહ્યાજી,

દાસના કપટનું ખીજ-હુંં ॥ ૩ ॥

કાન ફેડી રહ્યો ખારણેજી, ⁵ભિક્ષુ ⁶પરિ ઠંગ દાસ ।

નાથ તો રહે સમભાવમેંજી,

કરઈ ન સુ-દૃષ્ટિ-પ્રકાશ-હુંં ॥ ૪ ॥

⁴ મેં,

¹ હમણાં, ² જોઈને, ³ ખબર, ⁴ કોળીયા, ⁵ ભીખારી, ⁶ જોય

અમૃત સરસ લવા લહૈણ, સેવક તેહ સુખણ ।

કહે ભાવપ્રભ જે શિર ધરઈણ,

ધરમ જિણંદની આણુ-હું ૦ ॥ ૫ ॥



(૧૦૫૮) (૪૪-૧૬) શ્રી શાંતિનાથ-જિન સ્તવન

(ધર આવોણ આંખો મુહરીઓ-એ દેશો)

સખી ! સેવીઈ શાંતિ-જિણેસરુ, વિશ્વસેન રાય-કુલ^૧-ભાણુ ।

સખી ! સફલી સેવા એહની,

સખી ! છે સેવાનો એ જાણુ-સખી ! સેવીઈ ૦ ॥૧॥

સખી ! રતૂસ્યા અને ડુસ્યા તણુ,

સખી ! દીસઈ ન કોઈ ચિન્હ ।

સખી ! હરિ-હરશદ્ધિક દેવથી,

સખી ! એહનું લક્ષણ બિન્ન-સખી ! સેવીઈ ૦ ॥૨॥

સખી ! સ્વારથ કો એહનઈ નહી, સખી ! ઉપગારીમેં મહંત ।

સખી ! ધન વિણ ઠકુરાઈ ધરઈ,

સુર-નર સેવ કરંત-સખી ! સેવીઈ ૦ ॥૩॥

સખી ! એહની સહજ કૃપા થકી,

સખી ! કરીએ કરમને જગેર ।

સખી ! ૫ ડોકલીઈ ફરિઓ ૭ મઉ,

સખી ! મુંઠીમાં ધરું મેર-સખી ! સેવીઈ ૦ ॥૪॥

૧ સૂર્ય, ૨ ખુશી, ૩ નારાણ, ૪ નિર્જળ, ૫ નાના વાસણથી, ૬ સમુદ્ર, ૭ માપું.

સખી ! બાજુ તિણુને નવિ સેવીઈ,

સખી ! કરિ એહસ્યું તું કીડી

સખી ! ભાવપ્રભ કહૈ એ પ્રભુ,

સખી ! સેવ્યો ભાંજસ્યે પીડ-સખી ! સેવીઈં ॥૫૫॥



(૧૦૫૯) (૪૪-૧૭) શ્રી કુંથુનાથ જિન સ્તવન

(ઢાલ-કુંબખડાંની)

કુંથુનાથ કરુણા કરો, હું છું તમારો ઢાલ-જિણેસર વાલહા ।

દયા-પાત્ર મુઝ જેહવું તેહવું ન ખીજે વિમાસિ-જિણેં ॥૧॥

મોહ મહા-અજ્ઞાનના, વીંટી વદ્યા છે ચાર-જિણેં ।

નહી સિંગડું નહી પુંછડું, એહવો અપૂરવ ઢાર-જિણેં ॥૨॥

૧ બોલ ન ૨ ઉપજે બોલતાં, સીખવો તેહ જ આપ-જિણેં ।

૩ ભલે ! ૪ ખિ ૫ લાડી લણાવતો,

બાલકને જિમ આપ-જિણેં ॥૩॥

કરતાં મુઝને નાવડે, વિનતડી તુમ્હ લાગ-જિણેં ।

આપણો જાણી ઉદ્ધરો, લહેશ્યો જગિ સોભાગ-જિણેં ॥૪॥

કૃપા-દષ્ટિ તેહવી કરો, જેહથી લહું નિસ્તાર-જિણેં ।

ભાવપ્રભ કહે માહરે, ફલઈ વંછિત-સહકાર-જિણેં ॥૫॥



૮ જેવા તેવાને

૧ શબ્દો, ૨ આવડે, ૩ સારા, ૪ પાદપૂર્તિ, ૫ લાડથી

(૧૦૬૦) (૪૪-૧૮) શ્રી અરનાથ-જિન સ્તવન

(મન મોહનાં લાલ-એ દેશી)

અર-જિષ્ઠંદ આરાહીઈ રે-ચિત્ત શોધના-લાલ ।

નિરમલ સૂત્ર-વિધિ પેખ રે-પાપ-રોધના લાલ ।

મન વચન કાય ધિરઈ રે-ચિત્ત૦,

ઉલ્લસિત ભાવ-વિશેષ રે-પાપ૦ ॥૧॥

વિષય-કષાય શમાવતો રે-ચિત્ત૦,

ન કરઈ આશાતન એક રે-પાપ૦ ।

શુદ્ધ દ્રવ્ય-સુગંધથી રે-ચિત્ત૦,

પૂજઈ પ્રભુને વિવેક રે-પાપ૦ ॥૨॥

વશ્ચિદ્-કલા નવિ કેલવઈ રે-ચિત્ત૦,

મોટું ધરઈ મન ઉદાર રે-પાપ૦ ।

શુભ અનુષ્ઠાન હોય ઉજલાં રે-ચિત્ત૦,

પૂજનઈ અધિકાર રે-પાપ૦ ॥૩॥

ભાવ-પૂજનું હેતુ એ રે-ચિત્ત૦,

છે દ્રવ્ય-પૂજા વિશુદ્ધ રે-પાપ૦ ।

ત્રિવિધ અ-વંચક યોગથી રે-ચિત્ત૦,

મુગતિ કહે છે વિબુધ રે-પાપ૦ ॥૪॥

જિન-મારગ માંહિ આણુવારે-ચિત્ત૦,

પહેલું પગથીઉં એહ રે-પાપ૦ ।

શ્રી ભાવપ્રભ સેવઈ સદા રે-ચિત્ત૦,

સમકિત-દષ્ટિ જેહ રે-પાપ૦ ॥૫॥



(૧૦૬૧) (૪૪-૧૯) શ્રી મલ્લિનાથ-જિન સ્તવન

(ધન ધન શ્રી ઋષિરાય અનાથી-એ દેશી)

ધર્મ કરતાં પાપ જ વલણું, એ ઉખાણો સાચો રે ।

મલ્લિ-જિણેસર વયણુ મુણીને,

ખાહિર-દષ્ટિ ન રાચો રે-ધર્મં ॥૧॥

પૂરવ-લવ માયા તપ કીધો, સ્ત્રી-વેદ તિહાં ઉપજાવ્યું રે ।

તપ-જપ ચારિત્ર કિરિયા વિચિત્રમં,

ખલ માયાનું ક્ષાંત્યું રે-ધર્મં ॥૨॥

માયા તો જગ મીઠી પાલી, પ્રાણુનં રહ્યઈ ઉલ્લાલી રે ।

કોધાદિક તો ચઢ્યા જણાઈ,

એ ન જણાઈ સુઆલો રે-ધર્મં ॥૩॥

સરસ આહાર-પૂજના વાંછક, તે મુખઈ માયા ધોલઈ રે ।

મુગધ-નરનંદ ઝાંમઈ પાડી,

બઈકા પેટ પંપોલઈ રે-ધર્મં ॥૪॥

તપ-જપ વ્રત તેહનાં શુદ્ધ કહીઈ, જે માયા નવિ ધરસ્યઈ રે ।

શ્રી ભાવપ્રભ કહે તે તરસ્યઈ,

મલ્લિ-જિનનું કહિઈ કરસ્યે રે-ધર્મં ॥૫॥

(૧૦૬૨) (૪૪-૨૦) શ્રી મુનિસુવ્રત-જિન સ્તવન

(એલીની ગેહી કરું-એ દેશી)

મુનિસુવ્રત જિન શામલો,

ચેતન સહજ-વિલાસ-મોરા લાલ ।

૧ વચ્ચે, ૨ લે, ૩ અવ્યવસ્થિત, ૪ ભ્રમણમાં

ઉજ્જવલ ધ્યાને ધ્યાઈઈ,

અનુભવ-રસમેં ઉલ્લાસ-મોરાં મુનિં ॥૧॥

પુદ્ગલથી ન્યારો રહ્યો, જોલઈ આતમરામ-મોરાં ।

નિરમલ ગુણ-પરજયની,

જાગતી જ્યોતિ ઉદ્દામ-મોરાં મુનિં ॥૨॥

જ્ઞાન અનંતું જેહનઈ, દરસણ દીપઈ અનંત,-મોરાં ।

સુખ અનંતું કુણુ ૧મવઈ,

અનંત વીરજ ઉલ્લસંત-મોરાં મુનિં ॥૩॥

બૂઝાણા દીવા સમો, ગુણુનો નાશ અશેષ-મોરાં ।

મુગતિ લક્ષણ કહે મૂઠ એ,

પામઈ જગમેં કલેશ-મોરાં મુનિં ॥૪॥

છઈ અ-વિનાશી આતમા, સત્તા શુદ્ધ-સ્વરૂપ-મોરાં ।

શ્રી ભાવપ્રભ તેહનઈ લજે,

જે ચિદાનંદ અનૂપ-મોરાં મુનિં ॥૫॥



(૧૦૬૩) (૪૪-૨૧) શ્રી નમિનાથ-જિન સ્તવન

(નીંદલડી વચરણ હોઈ રહી-એ દેશી)

નમિ-જિનવર એકવીસમો,

મન મોહન હો ! દરશન સુખદાય કિ ।

ચિત્ત પ્રભુને ચરણે રહું,

૧ પ્રાણી-વાલહો અળગું નવિ થાય કિ-નમિં ॥૧॥

૧ માપે ? ૧ જીવોને પ્રિય

કાન તો કાનસૂરાં કરઈ,

નયણે જઈ હો ! કર્યો પહેલાં નેહ કિ ।

નિસ્વહિવું મનને પડયું,

અણ દીઠાં હો ! અવટાય જેહ કિ-નમિં ॥૨૧॥

ગુણ-રતનાકર સાહિબા, હીયડાથી હો ! ઊતાર્યો ન જાય કિ ।

સંગમ શીતલ જેહનો,

સેવ કરતાં હો ! દુઃખ-તાપ રહૃહાય કિ-નમિં ॥૨૨॥

પ્રભુ બાંહિ વલગી રહું, કિમ મુકું ! હો ! મીઠી જે દ્રાખ કિ ।

અ-ચિંત-ચિંતામણિ-સંગથી,

મુઝ ડેપુહયઈ હો ! પૂરો અભિલાષ કિ-નમિં ॥૨૩॥

સુખ આપઈ પ્રભુ સાસતાં,

જો ધરીઈ હો ! એહનું શુભ ધ્યાન કિ ।

ભાવપ્રભસૂરિ કહે,

એ જાણો હો ! શિવ-પુરનું નિહાન કિ-નમિં ॥૨૪॥



(૧૦૬૪) (૪૪-૨૨) શ્રી નેમિનાથ જિન સ્તવન

(સાસુ પૂછઈ હે વહૂ-એ દેશી)

રાજુલ કહે સુણિ હે ! સખી !,

માહરો ? નાહલીયો નેમિ રીસાણો-કાંઈ ? ।

તોરણથી પાછો વહ્યો, નવ લવ નેહ નિવારી જાઈ,

નેમિ રનગીનો માહરો સાહિબો ॥૧॥

૨ ઓળવાય ૩ પહેચે ૧ પ્રેમી, ધણી. ૨ શ્રેષ્ઠ,

પશુ-વયણે તણ નારીને, એ સમઝણ રૂડી નહીં-રાય ! ।
ટલવલઈ અ-બલા તુઝ વિના,

ડગોરી ખોખો ધાન ન ખાય-નેમિં ॥૨૧॥
યોગ તુમ્હે જો આદર્યો, મુઝને તે ય આલો ! પ્રિય સાર ।
હવઈ હું ધરમની ભારજ,

તું મુઝ ધરમ-તણે ભરથાર-નેમિં ॥૨૨॥
પહિર્યો આરિત્ર-ચૂડલો, રાગુલો રાખ્યો અ-વિહડ રંગ ।
બ્રહ્મચારી પિયુ નેમિશ્યું,

લોક-લોકોત્તર છંડયો ન સંગ-નેમિં ॥૨૩॥
જિનવર ત્રિણ કલ્યાણ કે, દીપાવ્યો ડુગર ગિરનારિ ।
ભાવપ્રભ નેહે કરી, રાગુલ પામી ભવનો પાર-નેમિં ॥૨૪॥



(૧૦૬૫) (૪૪-૩૩) શ્રી પાર્શ્વનાથ-જિન સ્તવન
(સિદ્ધારથનારે નંદન વિનવું-એ દેશી)

૧વાદહપણું જિનરાજશ્યું માહરઈ, એવું ન ખીજઈ રે ઠાણ ।
પ્રભુ-નામઈ હું પ્રાણુનઈ પાથરું,

૨અલવઈ ન લોપું રે આણુ-વાદહં ॥૨૧॥
કારણ વાલ્યપણાનું રશ્યુ હસ્યઈ ? ઈમિ મનિ રૂં રે સંભાલિ ।
કારણ મોહન ! પ્રભુ ! ડપ્રીછઈ નહી,

નહી સંસારનો ખાલ-વાદહં ॥૨૨॥

૩ ખરેખર તમારા વિના રાગુલરૂપ સ્ત્રી ખોખો અનાજ ખાઈ
શકતી નથી. બીજી ગાથાની ચોથી લીટી, ૪ આપો,
૧ અંતરનો પ્રેમ-ઉમળકો, ૨ કદી પશુ. ૩ ઓળખાતું,

અણદ્રીઠાં મન માહરં ટલવલઈ, જં ૪તુઈ પનવલઈ રેંજંપ ।
ખીજો ન એહવો રે ૭જગમઈ જેહવો,

સહજ સ-ભાવસ્યું સંપ-વાલ્હ૦ ॥૩॥

શુણુ-રતનાકર મૂરતિ જિન તણી, ચિહું દિશિ દીપઈ રે તેજ ।
ભીંટો-મિંટઈ રે મુખડું નિહાલતાં,

હીયડે-ઝગઈ રે હેજ-વાલ્હ૦ ॥૪॥

પાસ-જિણેસર અલવેસર ધણી, ભવ-દુઃખ-ભંજણુહાર ।
વાલ્હો કહીઈ રે મનથી ન વીસરઈ,

શ્રી ભાવપ્રભ આધાર-વાલ્હ૦ ॥૫॥



(૧૦૬૬) (૪૪-૨૪) શ્રી મહાવીરસ્વામી-જિન સ્તવન
(રાજુલ કહે રે મુણો નેમિજી-એ દેશી)

મહાવીર જિનરાજજી !

પ્રભુ ! થેં છો જગરા તાત !-શાસન-રાયા ! હે ! ।

સુર-નર થારા શુણુ ગાવઈ, દેખત નયણે સોહાત-શાસન૦
-આજ ભલઈ થાનઈ ભેટીયા ॥૧॥

થારી મૂરતિ લગાવઈ મોહની,

મહેં તો રમેલહાં ન પ્રભુરો સંગ-શાસન૦ ।

અહુનિશિ ડસેવામઈ રહાં,

લાગો ચોલ-મજીઠરો રંગ-શાસન૦ આજ૦ ॥૨॥

૪ તારાથી, ૫ બહલથી, ૬ શાંતિ, ૭ જગમાં, ૮ આંખોઆંખ.

૧ છોડીએ, ૨ સેવામાં,

સાહિબા ! ધ્યાનરા નાયક થેં અછો,

પ્રભુ ! ચારિત્ર તપ શણ્ણગાર-શાસન૦ ।

મનથી ઉતારાં મહેં નહી,

જ્યું ગોરી હીયારો હાર-શાસન૦ આજ૦ ॥૩॥

મહારા અંતરયામી થેં પ્રભુ !,

મહારધ થેં ખાસી ઁમીરાતિ-શાસન૦ ।

સહજ-ચિદાનંદ થેં પ્રભુ,

થેં તો ટાલી અઃ-વિદ્યાડરાતિ-શાસન૦ આજ૦ ॥૪॥

પમ્હાં કઈ મુંહગી મોહણુ-વેલ થેં,

સેવકારી થેં પૂરો આસ-શાસન૦ ।

શ્રી ભાવપ્રભસૂરિ કહે ચારધ,૭

નામધ લીલ-વિલાસ-શાસન૦ આજ૦ ॥૫॥



કલશ

(સુણિ બહિની ! પિયુડા પરદેશી-એ દેશી)

આજ દિવસ ધન ધન માહરો ! ત્રકલ-પ્રમુખ જિન ગાયા રે ।

વર્તમાન ચોવીસ તીથ^૧કર, ત્રિભુવનના જે રાયા રે-આજ૦ ॥૧॥

ચિંતામણિ સમ સયલ જિણેસર, સેવતાં મુખ લહે પ્રાણી રે ।

જિન-સ્તવના કરી ઉલ્લટ આંણી,

સફલ થઈ મુઝ વાણી રે-આજ૦ ॥૨॥

સંવચ્છર ઁરતન પ્રવચન^૨-માતા,

લેહ ૧૭સંયમના ધારો રે (૧૭૮૩) ।

૩ સંપત્તિ-ઐશ્વર્ય, ૪ અજ્ઞાનાદિ દુશ્મનો ૫ મારા માટે ૬ મોઘી ૭ તારી

કાશુણ્ય સુદિ તિથિ ત્રીજ અનુપમ,

વાર રેનક્ષત્ર-પતિ સારો રે-આજઠ ॥ ૩ ॥

પુનિમ ગચ્છ ગુરુરાજ વિરાજઈ, શ્રી મહિમાપ્રભ સૂરીંદા રે ।

જગમઈ જોહની કીરતિ મોટી,

અહનિશિ ગાય રાજેન્દા રે-આજઠ ॥ ૪ ॥

તસુ પાટઈ ભાવપ્રભસૂરીસર, મન હરખે ધમિ-ભાખઈ રે ।

જિનગુણ સાંભલઈ ભાવઈ પભણઈ,

તે અખય સુખ આખઈ રે-આજઠ ॥ ૫ ॥

સંવત ૧૭૮૩ મિતે કાશુણ્ય સુદિ ચતુર્દશ્યાં ચાંદ્રિ વારે

શ્રીમતિ અણુહિલ્લ-પત્તને ઢંઢેર-પાટકે કૃત ચાતુર્માસકેન

પૂર્ણિમા-પક્ષીય શ્રી ભાવપ્રભસૂરિણા લિપીકૃતાનિ

શ્રી તેજસ્વત્ત નામધેય પઠનકૃતે ॥

॥ શુભં ભવતુ ॥ શ્રીસ્તુ ॥



૧. ચન્દ્રવાર (સોમવાર) અથવા શુક્રવાર

॥ श्रीसकल-पंडित-शिरोमणि-यक-शकुसम-
पं. श्री कीर्तिविमल-चरणकुमलेभ्यो नमः ॥

श्रीवर्द्धमान-स्वामिने नमः

पं. श्री कीर्तिविमल-गण्णी-विरचित
स्तवन-योविशी
(४५)

(१०६७) (४५-१) श्री ऋषलदेव जिन स्तवन

(महाविद्विष भेत्र सोढामण्डं अ-देशी)

मनमोहन ! तुं साहिबो, भरुदेवी-मात महार-लाल रे ।
नाबिराया-कुल-यंदलो, लरतादिके सुत १सार-लाल रे-
-मनमोहन तुं साहिबो ॥१॥

जुगला-धरम-निवारणो, तुं मोटो महाराज-लाल रे ।

जगत-हालिद्र-चूरणो,

२सारि हविं मुज काज-लाल रे-मन० ॥२॥

वृषल लंछन सोढामणो, तुं जगनो आधार-लाल रे ।

लवलय-लीता प्राणिनछ,

शिव-सुभनो दातार-लाल रे-मन० ॥३॥

अनंत-गुण-मणि-आगरु, तुं प्रभु ! दीन दयाल-लाल रे ।

सेवक-जननी वीनति,

जनम-मरण-हुःअ टालि-लाल रे-मन० ॥४॥

१ श्रेष्ठ, २ करी हो,

સુરતરુ-ચિંતામણિ સમો, જે તુમ સેવઈ પાય-લાલ રે ।
ઋદ્ધિ અનંતી તે લહે,

વલી કીરતિ અનંતી થાઈ-લાલ રે.-મન૦ ॥૫૦॥



(૧૦૬૮) (૪૫-૨) શ્રી અજિતનાથ-જિન સ્તવન

(વાસુપૂજ્ય જિન વંદિઈ એ-દેશી)

અજિત-જિણુંદ અવધારીઈ, સેવકની ૧અરહાસો રે ।
તું સાહિબ સોહામણો, હું છું તોરો હાસો રે-અજિત૦ ॥૧॥
જિતશત્રુ-રાય-કુલ-તિલો, વિજયા માત મહારો રે ।
નયરી અયોધ્યાઈ અવતર્યો,

ગજ લંછન અતિ સારો રે-અજિત૦ ॥૨॥

જગ-જીવન જગના ધણી, તું છઈ જગ-પ્રતિપાલો રે ।
નામ તુમારું જે જપઈ,

તે પામે સુખ વિશાલો રે-અજિત૦ ॥૩॥

સુરતરુ સુરમણિ સુરલતા, વંછિત પૂરે એહો રે ।
તેહથી તુમહ સેવા લલી,

શિવ-સુખ આપઈ જેહો રે-અજિત૦ ॥૪॥

જે લવી તુમહ સેવા કરઈ, તે લહે કોડિ કલ્યાણો રે ।
ઋદ્ધિ-સિદ્ધિ-કીરતિ ઘણી,

તસ ધરિ રશુભ મંડાણો રે અજિત૦ ॥૫॥



૧ અરજી, ૨ સારી ચીજોનું મંડાણ,

(૧૦૬૯) (૪૫-૩) સંભવનાથ-જિન સ્તવન

(સંભવ જિનવર વિનતી એ-દેશી)

સંભવ-જિન અવધારીધં, સેવકની અરદાસો રે ।

તું જિનજી સોહામણો, પુણ્યે પામ્યો ખાસો રે-સંભવ૦ ॥૧॥

જિતારિ-કુલ-ચંદ્રલો, સેના-માત મલ્હારો રે ।

મન-વંછિત પ્રભુ પૂરણો,

અશ્વ-લંછન સુખકારો રે-સંભવ૦ ॥૨॥

સાવચ્ચી નયરી ભલી, જિહાં જનમ્યા શ્રી જિનરાયો રે ।

ધાન્યના સંભવ નિપન્યા,

તેણિ સંભવ નામ ઠરાયો રે-સંભવ૦ ॥૩॥

દુરિતારિ શાસન સુરો, યક્ષ ત્રિમુખ સેવધં પાયો રે ।

સંધના વંછિત પૂરવધં,

વલી સંકટ દૂરિ પલાયો રે-સંભવ૦ ॥ ૪ ॥

નામિ નવનિધિ સંપન્નધં, ઘરિ કમલા પૂરધં વાસો રે ।

ઋદ્ધિ-સિદ્ધિ કીરતિ ઘણી,

તુમ્હ ક્યાને શિવ-સુખ-વાસો રે-સંભવ૦ ॥૫॥



(૧૦૭૦) (૪૫-૪) શ્રી અભિનંદનજિન સ્તવન

(શ્રી અરજિન ભવજલનો તારુ એ-દેશી)

શ્રી અભિનંદન જગનો તારુ,

સુઝ મન લાગે વારુ રે-તું અંતરયામી ।

તુઝ સેવામાં જો પ્રભુ રહધં,

તો મન-વંછિત લહીધં રે-તું અંતરયામી ॥ ૧ ॥

પ્લવગ-લંછન પાર્થે સોઢે,

લવિજનના મન-મોહિં રે-તું અંતરં ।

જે પ્રભુ તુઝ આણ્યા શિર વહીધં,

તો નિરમલ સુખ લહીધ રે-તું અંતરં ॥૨॥

વિનિતા-નગરી જખ પ્રભુ આયા,

સંવર-કુલ દીપાયા રે-તું અંતરં ।

ધન્ય સિધારથા માતા જયા,

ઇંદ્ર-ઇંદ્રાણી લડાયા રે-તું અંતરં ॥૩॥

નાયક યક્ષ તુમ્હે સેવા સારધં,

કાલિ-સુરી હુઃખ વારધ રે-તું અંતરં ।

ધન્ય જિહાં જે તુમ્હે શુભ ગાવધં,

ધન્ય મન જે તુમ્હે ધ્યાવધ રે-તું અંતરં ॥૪॥

જે ભવી તુમ્હે અરણ્યાંબુજ સેવધં,

કામધેનુ સો લેવધ રે-અંતરં ।

સુરતરૂ-ચિંતામણિ ધરિ આવધં.

ઋદ્ધિ-કીરતિ અનંતી થાવધ રે તું અંતરં ॥૫॥



(૧૦૭૧) (૪૫-૫) શ્રી સુમતિનાથ-જિન સ્તવન

(દરશન દીજધ પ્રભુ પાસણ હો લાલ એ-દેશી)

સુમતિ જિણેસર સેવીધ હો લાલ,

સુમતિ તણે દાતાર-સાહિબણ ।

બહુ-દિનનો ઉમાહલો હો !-લાલ,

દરશન આપો સાર-સાહિબણ-સુમતિં ॥૧॥

મેઘરાય કુલ ચંદ્રો હો ! લાલ,

મંગલા-માત મહાર-સાહિબજી ।

ભવ-ભયથી ઉભગો હો ! લાલ,

તું મુઝ શરણું સાર-સાહિબજી-સુમતિં ॥૨॥

પાયે કોંચ સેવઈ સદા હો ! લાલ,

તુંબરું સારઈ સેવ-સાહિબજી ।

મહાકાલી સુરી સદા હો ! લાલ,

વિઘ્ન દાલિં નિત્યમેવ-સાહિબજી-સુમતિં ॥૩॥

નયરી કોશલાઈ અવતર્યા હો ! લાલ,

તવ વરયો જ્યજ્યકાર-સાહિબજી ।

ઘરિ ઘરિ હરખ વધામણાં હો ! લાલ,

ધવલ-મંગલ દ્વિધં નાર-સાહિબજી-સુમતિં ॥૪॥

અનંત ગુણુ છઈ તાહરા હો ! લાલ,

કહેતાં નાવધ પાર-સાહિબજી ।

દિન દિન તુમહ સેવા થકી હો ! લાલ,

ઋદ્ધિ-કીરતિ અનંતી સાર-સાહિબજી-સુમતિં ॥૫॥

★

(૧૦૭૨) (૪૫-૬) શ્રી પદ્મપ્રભ-જિન સ્તવન

(શ્રી ચંદ્રપ્રભ જિનરાજ રાજે એ-દેશી)

શ્રી પદ્મપ્રભ-જિનરાજ શોભઈ, વદન ૧શારદ ચંદ રે ।

ભવિક-ભવ-ચક્રો નિરખી,

પામઈ પરમાનંદ રે-શ્રી પદ્મ ॥ ૧ ॥

૧ આસો સુદ પૂનમનો,

તુઝ રુપ-કાંતિ અતિ વિરાજઈ, મોહઈ સુર-નર-વૃંદ રે ।

તુઝ ગુણ-કથા રવ્યથા સેવી લંબઈ,

ધ્યાન-સુરતરુ-કંદ રે-શ્રી પદ્મ ॥ ૨ ॥

પદ્મવરણી કાયા શોભઈ, પદ્મ સેવઈ પાપ રે ।

પદ્મપ્રભ-જિન સેવ કરતાં,

અ-વિચલ-ઉપદ્રા થાય રે-શ્રી પદ્મ ॥૩॥

ધન્ય સુસીમા-માત-બયો, ધરરાય-કુલ-મંડાણ રે ।

નયરી કૌશાંબી ધન્ય જિહાં,

હુઓ જનમ-કલ્યાણ રે-શ્રી પદ્મ ॥૪॥

જનમ પાવન આજ હુઓ, જિનરાય તારઈ ધ્યાન રે ।

હવિ ઋદ્ધિ-કીરતિ અનંતી આપી,

થાપો સુખ નિરવાણ રે-શ્રી પદ્મ ॥૫॥



(૧૦૭૩) (૪૫-૭) શ્રી સુપાર્શ્વનાથ-જિન સ્તવન

(શ્રી અનંતુ જિનશ્યું કરો સાહેલડીયાં એ-દેશી)

શ્રી સુપાસ-જિનશ્યું કરો-સાહેલડીયાં,

અતિ અનોપમ રંગ-ગુણ-વેલડીયાં ।

એક રંગ ૧ હીણો નહી-સાહેલડીયાં,

બીજો હીણો સંગ-ગુણ-વેલડીયાં ॥૧॥

તું સાહિબ સોહામણો-સાહેલડીયાં,

બીજો નાવઈ ૨ દ્વાય-ગુણ-વેલડીયાં ।

૨ પીડા ૩ લક્ષ્મી, ૧ હલકો, ૨ અતુકૂળ.

એહ રંગ સદા હોજે-સાહેલડીયાં,
 જા' લગિં શિવ-પદ થાય-ગુણ-વેલડીયાં ॥૨૧॥
 ભવ અનંત ભમતાં થકાં-સાહેલડીયાં,
 પુણ્યેં પામ્યા આજ-ગુણ-વેલડીયાં ।
 તેા મુઝ મન-વંછિત ફલ્યો-સાહેલડીયાં,
 સીધાં સઘલાં કાજ-ગુણ-વેલડીયાં ॥૨૩॥
 રાગ-રહિત પ્રભુ ! તું કલ્યો-સાહેલડીયાં,
 મુઝનઈ તુઝસ્યુ' રાગ-ગુણ-વેલડીયાં ।
 સરિખા વિણુ પ્રભુ ! ગોઠડી-સાહેલડીયાં,
 કિમ બનિ આવઈ યલાગ-ગુણ-વેલડીયાં ॥૨૪॥
 કૃપા-નજર સાહિબતણી-સાહેલડીયાં,
 સેવકના દુઃખ જાય-ગુણ-વેલડીયાં ।
 અનંત ઋદ્ધિ-કીરતિ ઘણી-સાહેલડીયાં,
 જગમાં જશ બહુ થાય-ગુણ-વેલડીયાં ॥૨૫॥



(૧૦૭૪) (૪૫-૮) શ્રી ચંદ્રપ્રભ-જિન સ્તવન
 (“કંત તમાકુ પરિહરો” એ-દેશી)
 ચંદ્રપ્રભ-જિન સાહિબા, તું છઈં ચતુર સુબલ્ય-મહારાજ ।
 સેવક-જનની વિનતિ,
 એ તું દિલમાં આણુ-મહારાજ-ચંદ્રં ॥૧॥
 કાલ અનાદિક હું ભમ્યો, કહેતાં નાવઈ પાર-મહારાજ ।
 એકેન્દ્રની જાતિમાં,
 અનંત કાલ અવધાર-મહારાજ-ચંદ્રં ॥૨॥

૩ અનુકૂળ,

એમ વિગલેંદ્રીની જાતિમાં, વસીઓ કાલ હું સંખ-મહારાજ ।
છેદન-ભેદન-વેદના,

સહિયાં તેહ અ-સંખ-મહારાજ-ચંદ્રં ॥૩૧॥
પુણ્ય-યોગિ વલી પામીઓ, પંચેંદ્રીની જાતિ-મહારાજ ।
તે માંહિ અતિ-ઠોહિલી,

માનવની ભલી જાતિ-મહારાજ-ચંદ્રં ॥૩૨॥
હવં તુમ સેવા પામીઓ, તો સરિયાં મુઝ કાજ-મહારાજ ।
ઋદ્ધિ-કીરતિ અનંતી થાપીનધં,
આપો શિવનું રાજ-મહારાજ-ચંદ્રં ॥૩૩॥



(૧૦૭૫) (૪૫-૯) શ્રી સુવિધિનાથ-જિન સ્તવન

(રાજનગરના રાજા સાહિબ સાંભલો-એ દેશી)

શ્રી સુવિધ-જિણેસર સામીજી-સાહિબ સાંભલો,
તુમે રિદ્ધી અનંતી પામીજી-સાહિબ સાંભલો ।
જે ઋદ્ધિનો હું છું કામીજી-સાહિબ સાંભલો;

તે વિનતી કરું શિરનામીજી-સાહિબ સાંભલો ॥૧॥

ત્રિણુ ગઢમાં બંધેં સોહેંજી-સાહિબં

ભવિ-જનના મન તિહાં મોહયંજી-સાહિબં ।

શિર ઉપર છત્ર વિરાજયંજી-સાહિબં

ત્રિણુ જગના સંશય ભાંજયંજી-સાહિબં ॥૨॥

વાજિંત્ર કોડાકોડીજી-સાહિબં,

સવિ પરવઠા રહિં કરજોડીજી-સાહિબં ।

વાણી તિહાં અમીય-સમાણીજી-સાહિબં,

સાંભલઇ સવિ ઇંદ્ર-ઇંદ્રાણીજી-સાહિબં ॥૩૧॥

બિહૂ પાસઇ ચામર લહેકેજી-સાહિબં

પંચવરણી કુસુમ બહુ મહેકેજી-સાહિબં ।

ઇમ જે તુઝ ઋદ્ધિના રસિયાજી-સાહિબં

તસ પાપ-બંધ સવિ ખસિયાંજી-સાહિબં ॥૩૨॥

ઇમ વિનતિ કરઇ પ્રભુ તુઠાજી-સાહિબં

શ્રી સુવિધિ જિણેસર તુઠાજી-સાહિબં ।

ઋદ્ધિ-કીરતિ અનંતી આપીજી-સાહિબં

શિવ-પદવી મુજને થાપીજી-સાહિબં ॥૩૩॥



(૧૦૭૬) (૪૫-૧૦) શ્રી શીતલનાથ-જિન સ્તવન

(સિદ્ધારથના રે નંદન વિનવું-એ દેશી)

શીતલ-જિનવર સાહિબ વિનવું, વિનતડી અવધાર ।

ભવ-મંડપમાં રે ફિરી ફિરી નાચતાં,

કિમીય ન આબ્યો રે પાર-શીતલં ॥૧॥

લાખ ચોરાશી રે જોણીમાં વલી, લીધા નવ-નવ વેશ ।

ભમત ભમંતાં રે પુણ્યે પામીઓ,

આરય માનવ-વેશ-શીતલં ॥૨॥

તિહાં પણિ દુલ્લભ જ્ઞાન-દિશા ભલી,

જેહથી સીઝઇ રે કાજ ।

તે પામીનઇ રે ધરમ જે નવિ કરઇ,

તે માણસને રે લાજ-શીતલં ॥૩॥

જ્ઞાન-દરશન-ચારિત્ર ભલું, જે એહ પામઈ રે સાર ।

તેહ ભવિક-જન નિશ્ચય પામસ્યઈ,

વેહલો ભવનો રે પાર-શીતલ ॥૪૧॥

તુમ સેવાથી સાહિબ પામીઓ, અ-વિચલ-પદ-નિવાસ ।

ઋદ્ધિ-અનંતી રે કીરતિ થાપીઈ,

આપો શિવપુર-વાસ-શીતલ ॥૪૨॥



(૧૦૭૭) (૪૪-૧૧) શ્રી શ્રેયાંસનાથ-જિન સ્તવન

(મુનિ માન સરોવર હંસલો-એ દેશી)

શ્રી શ્રેયાંસ ! કૃપા કરો તું, જગ-બંધવ તાતો રે ।

અલખ-નિરંજન તું જયો,

તું છઈ જગમાં વિખ્યાતો રે-શ્રી શ્રેયાંસ ॥૧॥

ધન-ધન ! નર ભવ ! તેહનો, જેણઈ તુઝ દરશન પાચો રે ।

માતું ચિંતામણિ સુરતર,

તસ ધરિ ચાહી આયો રે-શ્રી શ્રેયાંસ ॥૨॥

ધન્ય તે ગામ-નગર-પુરા, જે ધરિ તું પ્રભુ આયો રે ।

ભગતિ ધરી પ્રતિલાભીઓ,

તેણિં બહુ સુકૃત કમાયો રે-શ્રી શ્રેયાંસ ॥૩॥

જિહાં જિહાં ધમિ તું ગયો, તસ બહુ પાપ પલાયો રે ।

તુઝ મુરતિ નિરખી ભલિં,

જેણિં તું દિલમાં ધાયો રે-શ્રી શ્રેયાંસ ॥૪॥

હવઈ મુઝ પ્રભુલ ! દીછઈ, તુઝ ચરણ-ઠમલ-નિવાસો રે ।

ઋદ્ધી અનંતી આપીઈ,

કીરતિ અનંતી આવાસો રે-શ્રી શ્રેયાંસ ॥૫॥



(૧૦૭૮) (૪૫-૧૨) શ્રી વાસુપૂજ્યસ્વામી-જિન સ્તવન

(અષ્ટ કરમ ચૂરણ કરી રે લાલ-એ દેશી)

વાસુપૂજ્ય-જિન વંદિછં રે-લાલ,

વાસવ સારથી સેવ-મેરે ખ્યારે રે ।

વંછિત હીછ નિત્યમેવ-મેરે ખ્યારે રે-વાસુ ॥૧॥

વસુપૂજ્ય-કુલ-ચૂડામણિ રે-લાલ,

જયા-માતનો નંદ-મેરે ખ્યારે રે ।

તું ઢાની-સિર-સેહરો રે-લાલ,

તુઝ નામિ નિત્ય આણુંદ-મેરે ખ્યારે રે-વાસુ ॥૨॥

તુઝ ધ્યાને-સુખ-સંપદા રે-લાલ,

સેવે સુર-નર પાય-મેરે ખ્યારે રે ।

રોગ-સોગ ઉપદ્રવા રે-લાલ,

દ્ધરિં સર્વ પલાય-મેરે ખ્યારે રે-વાસુ ॥૩॥

ચંપા નયરી અતિ ભલી રે-લાલ,

જિહાં ઉપના જિનરાય-મેરે ખ્યારે રે ।

ઓછવ રંગ વધામણાં રે-લાલ,

ઘરિ ઘરિ મંગલ ગાય-મેરે ખ્યારે રે-વાસુ ॥૪॥

આરમા જિનવર ! સાંભલો રે લાલ,

સેવકની અરદાસ-મેરે ખ્યારે રે ।

ઋદ્ધિ-કીરતી અનંતી હીછં રે-લાલ,

પૂરો એ મુઝ આસ-મેરે ખ્યારે રે-વાસુ ॥૫॥



(૧૦૭૯) (૪૫-૧૩) શ્રી વિમલનાથ-જિન સ્તવન

(તુંગીઆગિરિ શિખરે સોહે-એ દેશી)

વિમલ-જિનવર વિમલ જિનવર, વિમલ તાહરું નામ રે ।

વિમલ-જિનવર ધ્યાન ધરતાં,

વિમલ લહીધું કામ રે-વિમલ ॥૧॥

વિમલ જ્ઞાનિ તુહ શોભઈ, વિમલ મતિ-વિસ્તાર રે ।

વિમલ મૂરતિ નિરખતાં પ્રભુ,

પામઈ ભવનો પાર રે-વિમલ ॥૨॥

વિમલ-મહાવ્રતનો ધણી તું, વિમલ-પ્રભુની વાણિ રે ।

વિમલ લેશ્યા તુઝ પાસઈ,

વિમલ શુકલ-ધ્યાન રે-વિમલ ॥૩॥

વિમલ તેજે તુહ સોહઈ, વિમલ દરશન તુઝ રે ।

વિમલ સૂરતિ તાહરી પ્રભુ,

વિમલ કરે હવઈ મુઝ રે-વિમલ ॥૪॥

ગુણ અનંતા તાહરા પ્રભુ ! કિમ કહું હું મતિ-મંદરે ।

ઋદ્ધિ-કીરતિ અનંતી છઈ,

જિહાં તે, આપો શિવ સુખ કંઠ રે-વિમલ ॥૫॥

(૧૦૮૦) (૪૫-૧૪) શ્રી અનંતનાથ-જિન સ્તવન

(ઘણુરા ઢાલા-દેશી)

શ્રી અનંતજિન સાહિબા રે,

તુમે છો દીન દયાલ-મનના માન્યા ।

ત્રિણ જગત જોતાં થકાં રે,

પામ્યો પ્રભુજી રમયાલ-મનના માન્યા. ॥૧॥

૧ ચહેસે, ૨ દયાળુ,

-આવો આવો ઉત્તમ ગુણ રાગી,

-પ્રભુ ગુણ ગાવા મતિ જાગી;

-હું પામ્યો આણુંદપૂર-મનના માન્યાં ॥૧૧॥

સિંહસેન-કુલ-દિનમણી રે,

સુજસા-માત-ઉર-હંસ-મનના માન્યાં ।

અન્નેઽયા નગરીનો રાજ્યો રે,

સયલ-ગુણી અવતંસ-મનના માન્યા-આવો ॥૧૨॥

વરસીદાન દેઈ કરી રે, ટાલી દારિદ્ર દુઃખ-મનના માન્યા ।

ચારિત્ર લેઈ સહસ-ભૂપસ્યુ' રે,

દેતા જીવનઈ' સુખ-મનનાં આવો ॥૧૩॥

કેવલજ્ઞાન પામી કરી રે, દેઈ ભવિનઈ' ઉપદેશ-મનના માન્યા ।

દાન-શીલ-તપ-ભાવના રે,

કરો ભવિ શુભ-લેશ-મનનાં આવો ॥૧૪॥

ચઉદમઈ' ગુણઠાણઈ' ચઢી રે,

ચઉદમઈ' તિં શિવ લોદ્ધ-મનના માન્યા ।

ઋદ્ધિ-કીરતિ પદ થાપિનઈ' રે,

આપો અમૃત-સિદ્ધ-મનનાં આવો ॥૧૫॥



(૧૦૮૧) (૪૫-૧૫) શ્રી ધર્મનાથ-જિન સ્તવન

(રંગી લે આતમા-એ દેશી)

ધરમ જિણેસર પનરમા, અવધારો અરદાસ-રંગીલે આતમા ।

શરણાર્થે હું આવીઓ,

રાખો ચરણિ' દાસ-રંગીલે આતમા ॥૧૬॥

ક્રોધ-પાવક ઉઠઈ થકઈ, ખાલેં પુણ્યનું ખેત્ર-રંગીલે આતમા ।
માન-મતંગજ જે ચઢયા,

તેહને કીધો દુઃખ-સંકેત-રંગીલે આતમા ॥૨૧॥

માયા-સાપણ જે ડસ્યા,

તે ન ગણિં મિત્ત-અમિત્ત-રંગીલે આતમા ।

લોભ-પિશાચઈ જે ઘસ્યા,

તે નિશદ્દિન આહઈ વિત્ત-રંગીલે આતમા ॥૨૨॥

ખિમા માઈવ આજ્ઞવ ગુણઈ,

સંતોષ મુલટ કરો હાથ-રંગીલે આતમા ।

ક્રોધાદિક ચ્યાર નવિ રહઈ,

સિંહનાઈઈ ગજસાથ-રંગીલે આતમા ॥૨૩॥

ધરમિ સેવઈ ધર્મનાથ નઈ,

ન્યાયિં સેવઈ જિમ ન્યાય-રંગીલે૦ ।

ઋધિ-કીર્તિ અનંતી આપજે,

જિમ અમૃત-પદ મુઝ થાય-રંગીલે ॥૨૪॥



(૧૦૮૨) (૪૫-૧૬) શ્રી શાન્તિનાથ-જિન સ્તવન

(૭ રે ૭--એ દેશી)

૭ રે ! માહરે શાંતિ-જિનેસર દેવ,

અરજ સુણો પ્રભુ ! માહરી-૭ રે ૭ ।

૭ રે ! માહરે ! ભવમાં ભમતાં સાર,

સેવા પામી તાહરી-૭ રે ૭૦ ॥૧॥

જ રે ! માહરે ! માનું સાર હું તેહ,
 હરિ-હર દીઠા લોયણે-જ રે જ ।
 જ રે ! માહરે દીઠેં લાગેા રંગ,
 તુમ્હ ઉપર એકે મને-જ રે જ ॥૨॥
 જ રે ! માહરે ! જિમ પંથી મન ધામ,
 સીતાનું મન રામચું-જ રે જ ।
 જ રે ! માહરે ! વિષયી ને મન કામ,
 લોભીનું ચિત્ત દામચું-જ રે જ ॥૩॥
 જ રે ! માહરે ! એહવો પ્રભુચું રંગ,
 તે તો તુમ્હ કૃપા થકી-જ રે જ ।
 જ રે ! માહરે ભવ-નિરવેદ અત્યંત,
 નિત્યેં જ્ઞાન દિશા થકી-જ રે જ ॥૪॥
 જ રે ! માહરે શાંત કરો શાંતિનાથ,
 શાંતિ તણો અરથી સહી, જ રે જ ।
 જ રે ! માહરે ઋદ્ધિ-કીરતિ તુમ્હ પાસ,
 અમૃત-પદ આપો વહી-જ રે જ ॥૫॥



(૧૦૮૩) (૪૫-૧૭) શ્રી કુંથુનાથ જિન સ્તવન
 (નદી યમુના કે તીર ઉડઈ દોઈ પંખીયા એ-દેશી)
 કુંથુ જિનેસર ! દેવ ! સેવા પ્રભુ ! તુમ તણી રે-કે સેવા૦ ,
 કીજઈ આતમ એક મના થઈ, તે ઘણી રે-કે એક મના૦ ।
 ચિંતામણિ કામધેનુ પ્રભુ ! નિતેં ખરી રે-કે પ્રભુ૦ ,
 કલ્પવૃક્ષ કામકુંભ સમાણી ચિત્ત ધરી રે-કે સમાણી૦ ॥૧॥

તેહથી અધિકી સેવ સ્વામિની જાણીયે રે-કે સ્વામીં ,
 તેમાં નહી સંદેહ કે મનમાં આણીય રે-કે મનમાંં ।
 તુમ્હ સેવાથી રાજ-ઋદ્ધિ સંપદ સવી રે-કે ઋદ્ધિં ,
 વલી સુરાસુર ઇદ્રાદિક પદવી હવી રે-કે ઇદ્રાદિક પદવીં ॥૨॥
 તીર્થ"કર પદવી લહઈ સેવાથી જના રે-કે સેવાથીં ,
 જિમ શ્રેણિકે-નરનાથ પામ્યા પ્રભુ નામનાં રે-કે પામ્યાં ।
 રાવણુ નામ નરેન્દ્ર અષ્ટાપદ આવીઆ રે-કે અષ્ટાપદં ,
 તે પામ્યા જિન-પદવી નાટક ભાવિઓ રે-કે નાટકં ॥૩॥
 જિહાં નહી રાગ ને શોગ જનમ મરણુ નહી રે-કે જનમં ,
 અનંત જ્ઞાન-દરશન-સુખ-વીરજ તે સહી રે-કે વીરજં ।
 સિદ્ધપુરી એને નામે લોકાંતે અતિ-ભલી રે-કે લોકાંતેં ,
 પ્રભુ-ચરણ-સેવાથી આતમ !

પામીશ ! તે ભલી રે-કે પામીશં ॥ ૪ ॥

સૂર રાજ જસ તાત શ્રી માતા જાણીયે રે-કે શ્રીમાતાં ,
 દેહ કંચણમય પાંત્રીસ ધનુષ વખાણીયેં રે-કે ધનુષં ।
 છાગ-લંછન સુખકારક ગજપુરિં રાજ્યો રે-કે ગજપુરિં ,
 ઋદ્ધિ-કીરતિ સુખ આપી,

સેવક હુઃખ ભાજ્યો રે-કે સેવકં ॥ ૫ ॥



(૧૦૮૪) (૪૫-૧૮) શ્રી અરનાથ-જિન સ્તવન

(સુણી પશુયાં વાણી રે-એ દેશી)

નાગપુર નરેન્દ્ર રે, સેવઈ સવિ ઇદ્રા રે ।

મુખ સોહઈ ચંદા, ભવિ-મન સોહતો રે ॥૧॥

રાય સુદરશણ તાત રે, દેવી રાણી માત રે ।

તસ કુલે સુજાત, જિસ્યો તું દિનમણિ રે. ॥૨૦॥
સુવર્ણ જિસે કાયા રે, નહી મમતા માયા રે ।

તુમ્હ શુભ સવિ ગાવિ, દેવી થોકે મલી રે. ॥૩૦॥
હું તો પ્રભુ ધ્યાજિં રે, શુભ તારા ગાઉં રે ।

સુખી તો થાઉં, જો મુઝ મન વસઈ રે. ॥૪૦॥
અરનાથ જિણંદા રે, સુખ-સુરતરુ-કંદા રે,
ઋદ્ધિ-કીરતિ આપિંદા, સેવકને સહી રે. ॥૫૦॥



(૧૦૮૫) (૪૫-૧૯) શ્રી મલ્લિનાથ-જિન સ્તવન

(લલનાની દેશી)

મલ્લિનાથ મુઝ ચિત્ત વસ્યો, જિમ કુષુમમાં વાસ-લલના,
ઉત્તમ નર જિહાં કિણ વાસઈ,

તિહાં થાઈ સહી ઉલ્લાસ-લલના-મલ્લિન ॥૧॥
સૂરજ વિના જિમ દિન નહી,

પુણ્ય વિના નહી શર્મ-લલના ॥
પુત્ર વિના સંતતિ નહી,

મન શુદ્ધિ વિના નહી ધર્મ-લલના-મલ્લિન ॥૨॥
શુદ્ધ વિષ્ણુ ગુરુ વિષ્ણુ નહી, ધન વિના નહી માન-લલના ॥
દાન વિના જિમ યશ નહી,

કંઠ વિના નહી ગાન-લલના-મલ્લિન ॥૩॥
સાહસ વિષ્ણુ સિદ્ધિ નહી, ભોજન વિના નહી દેહ-લલના ॥

વૃદ્ધિ વિના સુલિધ નહી,

રાગ વિના નહી નેક-લલના-મલ્લિં ॥ ૪ ॥

તિમ પ્રભુની સેવા વિના, મોક્ષ ન પામઇ કાય-લલના ।

મેંતો તુમ્હ આણા વહી,

જિમ ઋદ્ધિ ને કીરતિ હોય-લલના-મલ્લિં ॥ ૫ ॥



(૧૦૮૬) (૪૫-૨૦) શ્રી મુનિસુવ્રત-જિન સ્તવન

(હો નણ્હલ-એ દેશી)

મુનિસુવ્રત જિન વીસમા,

એ તો વીસે વસા છઇં શુદ્ધ-જિનવર ।

એ પ્રભુને જે ચિત્ત ધરઇં,

તે થાઇ ત્રિભુવન બુધ-જિનવર-મુનિં ॥ ૧ ॥

મુમિત્ર નૃપ કુલ શોભતો, પદ્મા રાણી ઉર-હંસ-જિનવર ।

રાજગૃહી નગરીનો રાજ્યો,

ગુણ ગાજ્યો ગુણી-અવતંસ-જિનવર-મુનિં ॥ ૨ ॥

કૂર્મ લંછન પાયે ભલું, લક્ષણ શોભિત અંગ-જિનવર ।

ઉત્તમ સહસ રાજનશ્યુ,

ચારિત્ર લીધે મન રંગ-જિનવર-મુનિં ॥ ૩ ॥

તીસ સહસ સાધૂ ભલા, મહાસતી સંખ્યા બાણ-જિનવર ।

પચાસ સહસ ગુણે ભરી,

તસ ધ્યાન હૃદયમાં આણ-જિનવર-મુનિં ॥ ૪ ॥

શ્યામ વરણ ઉજલ કરઇં,

જિહા રહઇં પ્રભુ ગુણ-ખાણી-જિનવર ।

સમેત શિખર મુગતિં ગયા,

ઋદ્ધિ-કીરતિ અમૃત વાણી-જિનવર-મુનિ ॥૫૧॥



(૧૦૮૭) (૪૫-૨૧) શ્રી નમિનાથ-જિન સ્તવન

(નાભિરાયા કે બાગ-એ દેશી)

વપ્રા-નંદન એક નાથ, મસ્તક એહ કર્યોરી ।

કરધં યોગ ને ખેમ, તેહજ નામ ખરોરી ॥૧॥

જ્ઞાન દરશન ચારિત્ર, પામ્યો નહીં કહિધરી ।

દરશન જ્ઞાન ચારિત્ર, આપવેં યોગ હોયેરી ॥૨॥

પામવી વસ્તુ જે સાર, અનુભવકેરે શુણેરી ।

તે રાખ્યો લલિ ભાંતી, બાણે ખેમ મનેરી ॥૩॥

સાચો તેહજ નાથ, આપસમે જેહ કરધરી ।

જે ન કરધ આપ-સમાન, તે મન કુણુ ધરેરી ? ॥૪॥

નમિનાથને નામે રાચો, માચો લવિરી ।

ઋદ્ધિને કીરતિ સાર, અમૃત પહવી હવીરી ॥૫॥



(૧૦૮૮) (૪૫-૨૨) શ્રી નમિનાથ-જિન સ્તવન

(શ્રી વર્ધમાન જિન રાણ્યા રે-એ દેશી)

નેમિ-જિણેસર વાહો રે,

રાણુદ કહધં એમ વાણિ રે-મન વસિયા ।

એહજ મેં નિશ્ચય કીયો રે,

સુખદાયક-શુણુખાણિ-શિવ રસીયા ॥૧॥

કૃપાવંત-શિરોમણિ રે, મેં સુણ્યો ભગવંત રે-મન વસિયા ।
હરિણ-શશાઢિક જીવનેં રે,

જીવિત આપ્યું સંત રે-શિવ રસિયા ॥૨॥

સુઝ કૃપા તેં નવિ કરી રે,

જાણું સહી વીતરાગ રે-મન વસિયા ।

યાચક દુઃખિયા-દીનને રે,

દીધું ધન મહાભાગ રે-શિવ રસિયા ॥૩॥

માંગુ હું પ્રભુ ! એટલું રે,

હાથ ઉપરિ ઘો હાથ રે-મન વસિયા ।

તે આપી તુમ્હે નવિ શકયા રે,

આપો ચારિત્ર ૧આથ રે-શિવ રસિયા ॥૪॥

ચારિત્ર-આથ આપી કરી રે,

રાજીલ નિજ સમ કીધ રે-મન વસિયા ।

ઋદ્ધિ-કીરતિ પામી કરી રે,

અમૃત-પદવી લીધ રે-શિવ રસિયા ॥૫॥

(૧૦૮૯) (૪૫-૨૩) શ્રી પાર્શ્વનાથ-જિન સ્તવન

(રાજના મિલે-એ દેશી)

વામા-નંદન પાસ-જિણુંદ,

પામ્યા પૂરવ-પુણ્યે મુણિંદ-પ્રભુ ! એ ભલો ।

પામી નરભવ જે ભજઈ પાસ,

પોહયઈ સદહી તેહની આશ-પ્રભુ ! એ ભલો ॥૧॥

રોગ-શોગ ન હોઈ મારિ,

હરિનખી નાવઈ પાસઈ કુનારિ-પ્રભુ ॥

પાસ-પ્રભુનો જે કરઈ જાપ,

નાવઈ પાસઈ અરિ-કરિ-સાપ-પ્રભુ ॥૨૧॥

આધિ વ્યાધિ ન થાય દુકાલ,

જે પાસ-જાપ કરઈ ત્રિકાલ-પ્રભુ ॥

શાકિણી ડાકિણુ-ભૂત-પરેત,

જઈ નાઠા દુષ્ટ-સંકેત-પ્રભુ ॥૨૨॥

કામ-કુંલ ને જે સુર-રતન,

વશ્ય થાઈ પાસ-ધ્યાન નેં યતન-પ્રભુ ॥

વિદ્યા-દેવી વશ પાસનેં નામ,

રાય-રાણા સવિ કરઈ પ્રણામ-પ્રભુ ॥૨૩॥

ત્રેવીસમો શ્રી પારસનાથ,

સાચો લહો મઈ મુગતિનો સાચ-પ્રભુ ॥

ઋદ્ધિ-કીરતિ પ્રભુથી થાય,

અમૃત-પદનો એહ ઉપાય-પ્રભુ એ લલો ॥૨૪॥



(૧૦૯૦) (૪૫-૨૪) શ્રી મહાવીર-જિન સ્તવન

(દીઠો દીઠો રે મેં વામાકો નંદન દીઠો-એ દેશી)

ગાયો ગાયો રે મેં ત્રિશલા-નંદન ગાયો ॥

હરખ બહુમાન આણંદ પામી,

એ સમકિતનો ઉપાયો રે-મેં ॥૨૫॥

તું કૃપાનિધિ ! તું સમતાનિધિ ! તું મુઝ માત ને જ્ઞાતા ।
જ્ઞાતા ત્રાતા શાતા કરતા,

મુઝ ભવ-ભવનો હરતા રે-મે'ં ॥૨॥

શૂલપાણીનઘ સમકીત દીધું, ચંડકૌશિકને તાર્યો ।

સેવક ને પ્રભુ ! કાંઈ વિસારો !,

અબ પ્રભુ મુઝને તારો રે-મે'ં ॥૩॥

તુમ્હ-સરિજો શિર સાહિબ પામી, જે કરસ્યે પ્રમાદો ।

તે દુઃખિયો થાશઘ નહી સંશય,

ભવમાં પામઈ વિખવાદો રે-મિ'ં ॥૪॥

મુકી પ્રમાદને પ્રભુ પદ સેવો, એ નર-ભવનો મેવો ।

ઋધિ-કીર્તિ દેવે વીરદેવા,

અમૃત પદ હરખિં લેવો રે-મિ'ં ॥૫॥

ઈતિ શ્રી ચતુર્વિંશતિ-જિન સ્તવન સંપૂર્ણ

સંવત ૧૭૯૭ વર્ષે શ્રાવણ માસે શુકલ પક્ષે

પૂર્ણિમા ૧૫ દિને શુક વાસ રે લિપી કૃતં

રાજનગરે સાં લાલચંદ નિહાલચંદ ॥ બાઈ તેજકુંઅરી

પાઠનાથે ॥ શ્રી શુભં ભવતુ ॥ કલ્યાણમરતુ ॥

શ્રી વર્ધમાનસ્વામિને નમઃ
શ્રી રતનવિજયજી કૃત
જિન સ્તવન-ચોવીસી
(૪૬)

(૧૦૯૧) (૪૬-૧) શ્રી ઋષભદેવ-જિન સ્તવન
(સિદ્ધચક્ર વર સેવા કીજે, નર-ભવ-લાહો લીજીએ-એદેશી).
ઋષભ-જિનેસર વંછિત-પૂરણ, ^૧પૂરણ જાણું વિશવા વીશ ।
ઉપગારી અવનિતલે મોટા,
જેહની ^૨ચડતી જગીશ-જગગુરૂ પ્યારો રે ।
પુણ્ય થકી મેં દીઠો ! મોહનગારો રે
સરસ સુધાથી મીઠો-જગ૦ ॥૧॥
નાભિ-નંદન નજરે નિરખ્યો, પરખ્યો પૂરણ-ભાગ્યે ।
નિર્વિકારી સુદ્રા જેહની, દીઠે અનુભવ જાગે-જગ૦ ॥૨॥
આતમ-સુખ ગ્રહવાનું કારણ, દર્શન જ્ઞાન ચારિત્ર ।
ઉતેને ભય વહી મિથ્યા અજ્ઞાન,
અવિરતિ જેહ વિચિત્ર-જગ૦ ॥૩॥
સઠલ જીવ છે સુખના કામી, તે સુખ અક્ષય મોક્ષ ।
કર્મ-જનિત સુખ તે દુઃખ રૂપ,
સુખ તે આતમ ઝાંખ-જગ૦ ॥૪॥

૧ સંપૂર્ણ રીતે=ખરેખર, ૨ ખોલખાલા, ૩ દર્શનાદિ ત્રણે,

નિરૂપાધિક અક્ષય-પદ કેવલ, અ-વ્યાખાધ તે થાવે ।

પૂરણાનંદ-દશાને પામે, રૂપાતીત-સ્વભાવે-જગ૦ ॥૫૥॥

અંતરજામી સ્વામી મારો, ધ્યાન-રૂચિમાં લાવે ।

જિન-ઉત્તમ પદને અવલંબી,

સ્તવનવિજય ગુણ ગાવે-જગ૦ ॥૬૥॥



(૧૦૯૨) (૪૬-૨) શ્રી અજિતનાથ-જિન સ્તવન

(એક દિન પુંડરીક ગણધરૂ રે લાલ-એ દેશી)

અજિત-જિનેસર વાલહા ! હો ! રાજ !

આતમના આધાર-મોરા સાહિબા !

શાંત-સુધારસ-દેશના હો ! રાજ !

ગાળે જેમ જલધાર-મોરા૦-અજિત૦ ॥૧૥॥

ભવિજન-સંશય લાંજવા હો ! રાજ !

તસ અભિપ્રાયનો જાણુ-મોરા૦ ।

મિથ્યા-તિમિર ઉચ્છેદવા હો ! રાજ !,

ઉગ્યે અભિનવ-ભાણુ-મોરા૦-અજિત૦ ॥૨૥॥

સારથવાહ શિવ-પંથનો હો ! રાજ !,

ભવોદધિ-તારણુહાર-મોરા૦ ।

કેવલજ્ઞાન-દિવાકરૂ હો ! રાજ !,

ભાવ-ધરમ-દાતાર-મોરા૦-અજિત૦ ॥૩૥॥

ક્ષાયિક-ભાવે ભોગવે હો ! રાજ !,

અનંત-ચતુષ્ટય સાર-મોરા૦ ।

ધ્યેયપણે હવે ધ્યાવતાં હો ! રાજ !,

ધ્યાયક થાયે નિસ્તાર-મોરા૦-અજિત૦ ॥૪૥॥

વસ્તુ-સ્વભાવને જાણુવે હો ! રાજ !,

આતમ-સંપદ ઇશિ-મોરાં ।

અષ્ટ-કરમના નાશથી હો ! રાજ !,

પ્રગટયા ગુણ એકત્રીશ-મોરાં-અજિતં ॥૫॥

વિજયા-નંદન એમ થુણ્યા હો ! રાજ !

જિતશત્રુ-કુલ-દિનકાર-મોરાં ।

કંચન-કાંતિ સુદૃઢ હો ! રાજ !,

ગજ-લંછન સુખકાર-મોરાં-અજિતં ॥૬॥

સમેતશિખર સિદ્ધિ વર્યા હો ! રાજ !,

સહસ-પુરૂષની સાથ-મોરાં ।

ઉત્તમ-શુર-કૃપા-લહેરથી હો ! રાજ !

રતન થાસે સ-નાથ-મોરાં-અજિતં ॥૭॥



(૧૦૯૩) (૪૬-૩) શ્રી સંભવનાથ-જિન સ્તવન

(અષ્ટાષ્ટક-ગિરિ જાત્રા કરણકું-એ દેશી)

સંભવ જિનવર સાહિજ સાચો, જે છે પરમ-દયાલ ।

કરૂણા-નિધિ જગમાંહિ મોટો, મોહન ગુણ-મણિ-માલ;

ભવિયાં ! ભાવ ધરીને લાલ ! શ્રી જિન સેવા કીજે ।

દૂરમતિ દૂર કરીને લાલ ! નરભવ સફલો કીજે, ॥૧॥

એહ જગત-શુર જુગતે સેવો, ષટ-કાયા-પ્રતિપાળ ।

દ્રવ્ય-ભાવ-પરિણતિ કરી નિરમલ,

પૂજે થઈ ઉજ્જમાલ-ભવિયાં ॥૨॥

કેશર ચંદન મૃગમદ લેળી, અરચો જિનવર-અંગ ।

દ્રવ્ય-પૂજા તે ભાવનું કારણ,

કીજે અનુભવ રંગ-ભવિયાં ॥૩૩॥

નાટક કરતાં શવણ પામ્યો, તીર્થંકર-પદ સાર ।

દેવપાલાદિક જિન-પદ ધ્યાતાં,

પ્રભુ-પદ લહું શ્રીકાર-ભવિયાં ॥૩૪॥

વીતરાગ-પૂજથી આતમ, પરમાતમ પદ પાવે ।

અ-જ અ-ક્ષય-સુખ જિહાં શાશ્વતાં,

રૂપાતીત સ્વભાવે-ભવિયાં ॥૩૫॥

અ-જર અ-મર અ-વિનાશી કહીયે, પૂરણાનંદ જે પામ્યા ।

લોકા-લોક-સ્વભાવ-વિભાસક,

ચઉ-ગતિનાં દુઃખ વામ્યા-ભવિયાં ॥૩૬॥

એહવા જિનનું ધ્યાન કરતાં, લહીયે સુખ નિરવાણુ ।

જિન-ઉત્તમ પદને અવલંબી,

રતન લહે શુભાશુ-ભવિયાં ॥૩૭॥



(૧૦૯૪) (૪૬-૪) શ્રી અભિનંદનજિન સ્તવન

(પાપનું સ્થાનક હો કે, ચૌદમું આકરું-એ દેશી)

ચોથો જિનપતિ હો ! કે, સેવો ચિત ૧ખરે,

શુભ-મણિ-હરીયો હો ! કે પરખો ૨શુભ-પરે ।

વંછિત-દાતા હો ! કે, પ્રગટયો સુરતરૂ,

મોહન મૂર્તિ હો ! કે, રૂપ મનોહર. ॥૧॥

૧ સાચા, ૨ સારી રીતે.

સૂરતિ સારી હો ! કે, ભવિ-જન-ચિત્ત-વસી,
 મુખ-કંજ સોહે હો ! કે, જાણે પૂરણ-શશી ।
 લોચન મુલગાં હો ! કે, નિરૂપમ જગદણી,
 ભાવે વંદો હો ! કે, પ્રત્યક્ષ સુરમણિ. ॥૨॥

જગ-ઉપગારી હો ! કે, જગ-ગુરુ જગ-ત્રાતા,
 જસ ગુણ ગુણતાં હો ! કે, ઉપજે અતિ શાતા ।
 નામ-મંત્રથી હો ! કે, આપદા સવિ ખસે,
 ક્રોધાદિક અજગર હો ! કે, તેહ નવિ ડશે. ॥૩॥

પરમેસર પૂરણ હો ! કે, જ્ઞાન-દિવાકર,
 ચઉ-ગતિ-ચૂરણ હો ! કે, પાપ-તિમિર-હર ।
 સહજ-વિલાસી હો ! કે, અડ-મદ શોષતા,
 નિષ્કારણ-વતસલ હો ! કે, વૈરાગ્ય પોષતા, ॥૪॥

૪નિજ-ધન પરમેશ્વર હો ! કે, સ્વ-સંપદ-ભોગી,
 પર-ભાવના ત્યાગી હો ! કે, અનુભવ-ગુણ-યોગી ।
 અ-લેશી અણાહારી હો ! કે, ક્ષાયિક-ગુણધરા,
 અક્ષય અનંતા હો ! કે, અ-વ્યાખાધ વરા ॥૫॥

ચાર નિક્ષેપે હો ! કે, જે નિજ ચિત્ત ધરે,
 એ લહી અવલંબન હો ! કે, પંચમ-ગતિ વરે ।
 શ્રી જિન-ઉત્તમની હો કે, સેવા જે કરે,
 તે રતન અમૂલક હો ! કે, પામે શુભ પરે ॥૬॥



(૧૦૯૫) (૪૬-૫) શ્રી સુમતિનાથ-જિન સ્તવન

(મોહનગારા હો ! રાજ ! રૂડા-મારા સાંભળ ! સુગુણ ! સૂડા)

સુમતિ-જિનેશ્વર સાહિબોજી, સુમતિ-તણો દાતાર ।

ચક્ર-ગતિ-મારગ ચૂરતોજી, ગુણ-મણિનો લંડાર કે-

-જિનપતિ જુગતે લાલ, વંદીજે ! ગુણ-આણી ॥૧॥

સહજનંદી સાહિબોજી, પરમ-પુરૂષ ગુણધામ ।

અક્ષય-સુખની સંપદાજી, પ્રગટે જેહને નામ કે-જિન૦ ॥૨॥

નાથ નિરંજન જગ-ધણીજી, નિરાગી ભગવાન ।

જગ-ખંધવ : જગ-વત્સલુજી,

કીજે નિરંતર ધ્યાન કે-જિન૦ ॥૩॥

ધ્યાન-ભુવનમાં ધ્યાવતાંજી, હોવે આતમ શુદ્ધ ।

સાધે સંવર-નિર્જરાજી, અ-વિરતિનો કરી રોધ કે-જિન૦ ॥૪॥

જ્ઞાનાદિ-ગુણ સંપદાજી, પ્રગટે ઝાકઝમાલ ।

ચિદાનંદ-સુખ-રમણુતાજી, પામે ગુણ-મણિ-માલ કે-જિન૦ ॥૫॥

પંચમ-જિન-સેવા થકીજી, પાપ-પંક ક્ષય થાય ।

દ્રવ્ય-ભાવ ભેદે કરીજી, કારજ સઘલો થાય કે-જિન૦ ॥૬॥

મંગલા-સુત મનોહરૂજી, કુલમાં તિલક સમાન ।

પંડિત ઉત્તમવિજય તણોજી,

રતન ધરે તુમ ધ્યાન કે-જિન૦ ॥૭॥

(૧૦૯૬) (૪૬-૬) શ્રી પદ્મપ્રભ-જિન સ્તવન
(તુજ મુજ રીઝનો રીત, અટપટ એહો ખરીરી-એ દેશી)
પદ્મપ્રભ જિનરાજ, સુરનર સેવ કરેરી ।

પુખ્તાલંબન દેવ, સમરે દુરિત હરેરી ॥૧॥
ટાલે મિથ્યા-દોષ, સમકિત-પોષ કરેરી ।

ભવિ-કમલ-પડિઓહ, દુરગતિ દૂર હરેરી ॥૨॥
ત્રિગટે ત્રિભુવન સ્વામી, એસી ધર્મ કહેરી ।

શાંત-સુધારસ વાણુ, સુષુતાં તત્ત્વ ગ્રહેરી ॥૩॥
કોધાદિકનો ત્યાગ, સમતા સંગ સળેરી ।

મન આણી સ્યાદ્વાદ, અવિરતિ સર્વ તળેરી ॥૪॥
અનુભવ ચારિત્ર જ્ઞાન, જિન-આણુ શિર ધરેરી ।

અક્ષય-સુખનું ધ્યાન, કરી ભવ-જલધિ તરેરી ॥૫॥
રક્તવણું તનુ-કાંતિ, વર્ણુ-રહિત થયેરી ।

અ-જર-અમર નિરૂપાધિ, લોકાંતિક રહ્યોરી ॥૬॥
નિરાગી પ્રભુ-સેવ, ત્રિકરણુ જેહ કરેરી ।

જિન-ઉત્તમની આણુ, રતન તે શિર ધરેરી ॥૭॥



(૧૦૯૭) (૪૬-૭) શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન

(શ્રી અનંત જિન શું કરો. સાહેલડીયાં-એ દેશી)

પૃથ્વી-સુત પરમેસર-સાહેલડીયાં !

સાતમેા દેવ સુપાસ-ગુણુ-વેલડીયાં !

ભવ-ભવ-ભાવઠ-ભજણુ-સાં,

પૂરતો વિશ્વની આશ ગુણુ ॥૧॥

સુરમણિ-સુરતરૂ સારીખો-સાં, કામકુંભ સમ જેહ-ગુણં
તેહથી અધિકતર તું પ્રભુ-સાં તેહમાં નહિ સંદેહ-ગુણં ॥૨॥
નામ-ગોત્ર જસ સાંભળે-સાં, મહા નિર્જરા થાય-ગુણં ।
રસના પાવન સ્તવનથી-સાં,

ભવ-ભવનાં દુઃખ જાય-ગુણં ॥૩॥

વિષય-કષાયે જે રતા-સાં, હરિ-હરાદિક દેવ-ગુણં ।
તેહ ચિત્તમાં નવિ ધરું-સાં,

ન કરું તેહની સેવ-ગુણં ॥૪॥

પરમ-પુરૂષ પરમાતમા-સાં, પરમાનંદ-સ્વરૂપ-ગુણં ।

ધ્યાન-ભુવનમાં ધારતાં-સાં, પ્રગટે સહજ-સ્વરૂપ-ગુણં ॥૫॥

તૃષ્ણા-તાપ શમાવતો-સાં, શીતલતાયે ચંદ-ગુણં ।

તેજે દિનમણિ દીપતો-સાં, ઉપશમ-રસનો કંદ-ગુણં ॥૬॥

કંચન-કાંતિ સુંદર-સાં, કાંતિ-રહિત કૃપાલ-ગુણં ।

જિન-ઉત્તમ પદ સેવતાં-સાં,

રતન લહે ગુણમાલ-ગુણં ॥૭॥

(૧૦૯૮) (૪૬-૮) શ્રી ચંદ્રપ્રભ-જિન સ્તવન

(તુમે બહુ-મૈત્રી રે સાહિબા-એ દેશી)

ચંદ્રપ્રભ જિન સાહિબા, શરણાગત-પ્રતિપાલ ।

દર્શન દુર્લભ તુમતણું, મોહન ગુણ-મણિમાલ-ચંદ્રં ॥૧॥

સાચો દેવ કયાળવો, સહજનંદનું ધામ ।

નામે નવ-નિધિ સંપન્ને, સીઝે વાંછિત કામ-ચંદ્રં ॥૨॥

ધ્યેયપથે રે ધ્યાવતાં, ધ્યાતા ધ્યાન પ્રમાણુ ।
 કારણે કારજ નિપજે, એહવી આગમ-વાણુ-ચંદ્રં ॥૩॥
 પરમાતમ પરમેસર, પુરૂષોત્તમ પરધાન ।
 સેવકની સુણી વિનતિ, કીજે આપ-સમાન-ચંદ્રં ॥૪॥
 શ્રદ્ધા-ભાસન-રમણતા, આણી અનુભવ અંગ ।
 નિરાગીશું રે નેહલો, હોયે અ-ચલ અ-ભંગ-ચંદ્રં ॥૫॥
 ચંદ્રપ્રભ-જિન ચિત્તથી, મુકું નહિ જિનરાજ ! ।
 મુજ તનુ-ધર માંહે ખેંચીયો,
 લકતે મેં સાત રાજ-ચંદ્રં ॥૬॥
 ગુણનિધિ ગરીબ-નિવાજ છો !, કરૂણા-નિધિ કિરપાલ ।
 ઉત્તમ વિજય-કવિરાજનો,
 રતન લહે ગુણમાલ-ચંદ્રં ॥૭॥



(૧૦૯૯) (૪૬-૯) શ્રી સુવિધિનાથ-જિન રતવન

(જ્ઞાન-પદ લજીયે રે ! જગત-સુહંકર-એ દેશી)
 સુવિધિ-જિનેસર ! સાહિબ ! સાંભળો,
 તુમે છો ચતુર સુબણોજી ।
 સાહેબ ! સનમુખ-નજરે જોવતાં,
 વાધે સેવક-વાનોજી-સું ॥૧॥
 ભવ-મંડપમાં રે ભમતાં જગશુર !, કાળ અનાદિ અનંતોજી ।
 જનમ-મરણનાં રે દુઃખ તે આકરાં,
 હજીય ન આંચો અંતોજી-સું ॥૨॥

છેદન-ભેદન-વેદન આકરી, શુષ્કનિધિ ! નરક-મોઝારોળ ।
 ક્ષેત્ર કુંભી વૈતરણી વેદના, કથતાં નાવે પારોળ-સું ॥૩॥
 વિવેક-રહિત વિગલપણે કરી, ન લહ્યો તત્ત્વ-વિચારોળ ।
 ગતિ તિયંચમાં રે પરવશપણે કરી,

સહ્યાં દુઃખ અ-પારોળ-સું ॥૪॥

વિષયા-સંગે રે રંગે રાચીયો, બંધાણો મોહ-પાશોળ ।
 અમરી-સંગે રે સુર-ભવ હારિયો,

કીધા દુરગતિ-વાસોળ-સું ॥૫॥

પુણ્ય-મહોદય જગશુર ! પામીયો; ઉત્તમ-નર-અવતારોળ ।
 આરજ ક્ષેત્ર રે સામગ્રી ધર્મની,

સદ્ગુરૂ-સંગતિ સારોળ-સું ॥૬॥

જ્ઞાનાનંદેરે પૂરણ પાવનો, તીર્થપતિ જિનરાજોળ ।
 પુષ્ટાલંબન કરતાં જગશુર !,

સીધ્યાં સેવક-કાજોળ-સું ॥૭॥

નામ જપંતા રે સવિ સંપત્તિ મળે, સ્તવતાં કારજ સીધોળ ।
 જિન-ઉત્તમ પદ-પંકજ સેવતાં,

રતન લહે નવ-નિધોળ-સું ॥૮॥



(૧૧૦૦) (૪૬-૧૦) શ્રી શીતલનાથ-જિન સ્તવન
 (શ્રી સુપાસ-જિન વંદીએ, સુખ સંપત્તિનો હેતુ-લલના)
 શીતલ-જિનપતિ સેવીયે, દશમે દેવ દયાલ-લલના ।
 શીતલ નામ છે જેહનું.

શરણાગત-પ્રતિપાલ-લલના-શીં ॥૧॥

બાહ્ય-અભ્યંતર શીતલું, પાવન પૂરણાનંદ-લલના ।
 પ્રગટ પંચ-કલ્યાણકે, સેવે સુર-નર-વૃંદ-લલના-શીંગારા ॥
 વાણી સુધા-રસ-જલનિધિ, વરસે જયું જલધાર-લલના ।
 ત્રિગટે ચક્રમુખ દેશના,

કરતા ભવિ-ઉપગાર-લલના-શીં ॥૩૥

મિથ્યા-તિમિર ઉચ્છેદવા, તીવ્ર-તરણિ સમાન-લલના ।
 સમકિત-પોષ કરે સદા, આપે વાંછિત-દાન-લલના-શીંગારા ॥
 અધ-મોચન અલવેસર, મુજ માનસ-સર-હંસ-લલના ।
 અવલંબન ભવિ-જીવને,

દેવ માનું અવતંસ-લલના-શીં ॥૪૦

અબ્દાદશ-દોષે કરી, રહિત થયો જગદીશ-લાલના ।
 યોગીશ્વર પશુ જેહનું,
 ધ્યાન ધરે નિશદીશ-લલના-શીં ॥૪૧

ધ્યાન-ભુવનમાં ધ્યાઈએ, તો હોય કારજ-સિદ્ધ-લલના ।
 અનુપમ અનુભવ-સંપદા,

પ્રગટે આતમ-ઋદ્ધ-લલના-શીં ॥૪૨

કોડ-ગમે સેવા જેહની, દેવ કરે કર-જોડ-લલના ।
 તે નિર્જંરાનું ફલ લહે,

કુણ કરે એહની હોડ ?-લલના-શીં ॥૪૩

જિન-ઉત્તમ-અવલંબને, પગ-પગ ઋદ્ધિ રસાળ-લલના ।
 રતન અમુલ્ય તે લહે, પામે મંગળ-માળ-લલના-શીં ॥૪૪



(૧૧૦૧) (૪૬-૧૧) શ્રી શ્રેયાંસનાથ-જિન સ્તવન

(જગજીવન જગ વાલહો-એ દેશી)

શ્રી શ્રેયાંસ-જિજીવંતી, સુંદર સુરતિ દેખ-લાલ રે ।

૩૫ અનુત્તર-દેવથી, અનંત-શુભું તે પેખ-લાલ રે-શ્રી૦ ॥૧॥

^૧અંગના અંકે ધરે નહિ, હાથે નહિ ^૨કરવાલ-લાલ રે ।

વિકારે વર્જિત જેહની,

મુદ્રા અતિ રસાળ-લાલ રે-શ્રી૦ ॥૨॥

વાણી સુધારસ-સારિખી, દેશના દિયે જલધાર-લાલ રે ।

ભવ-દવ-તાપ શમાવતા,

ત્રિભુવન-જન-આધાર-લાલ રે-શ્રી૦ ॥૩॥

મિથ્યા-તિમિર-વિનાશતો, કરતો સમક્રિત-પોષ-લાલ રે ।

જ્ઞાન-દિવાકર દીપતો, વર્જિત સઘળા દોષ-લાલ રે-શ્રી૦ ॥૪॥

પરમાતમ પ્રભુ સમરતાં, લહીયે પદ નિવારણ-લાલ રે ।

પામે દ્રવ્ય-ભાવ સંપદા,

એહવી આગમ-ત્રાણ-લાલ રે. શ્રી૦ ॥૫॥

જૈનાગમથી જાણીયું, વિગતે જગજીવ ! દેવ !-લાલ રે ।

કૃપા કરી મુજ દીજીએ.

માંશું તુમ ^૩પદ-સેવ-લાલ રે-શ્રી૦ ॥૬॥

તુમ દરિસણથી પામીયો, શુભ-નિધિ આનંદ-પૂર-લાલ રે ।

આજ મહોદય મેં લહ્યો,

દુઃખ ગયાં સર્વ દૂર-લાલ રે-શ્રી૦ ॥૭॥

૧ સ્ત્રી, ૨ તલવાર, ૩ ચરણની,

વિષ્ણુ-નંદન ગુણુનીલો, વિષ્ણુ માત-મહાર-લાલ રે ।
 અંકે ૪ખડગી હીપતો, ગુણુ-મણિનો ભંડાર-લાલ રે-શ્રી૦ ॥૮૧॥
 સમેતશિખર સિદ્ધિ વર્યા, પામ્યા ભવોદ્ધિ પાર-લાલ રે ।
 જિન-ઉત્તમ-પદ-પંકજે,

રતન-૫મધુપ-ઝંકાર-લાલ રે-શ્રી૦ ॥૮૨॥

(*)

(૧૧૦૨)(૪૬-૧૨) શ્રી વાસુપૂજ્યસ્વામી-જિન સ્તવન

(એ તીરથ તાડ-એ દેશી)

વાસુપૂજ્ય-જિન અંતરજામી,
 હું પ્રણમું શિરનામી રે-મારા અંતરજામી ! ।
 ત્રિ-કરણ-જોગે ધ્યાન તુમાડું,
 કરતાં ભવ-ભય વાડ રે-મારા૦ ॥૧॥

ચોત્રીશ અતિશય શોભાકારી,
 તુમચી જાઉં બલિહારી રે-મારા૦ ।
 ધ્યાન-વિન્નાણે શક્તિ-પ્રમાણે,
 સુરપતિ ગુણુ વખાણે રે-મારા૦ ॥૨॥
 દેશના દેતાં તખત બિરાજે,
 જલધરની પેરે ગાજે રે-મારા૦ ।

વાણી સુધા-રસ-ગુણુ-મણિ-ખાણી,
 ભાવ ધરી સુણે પ્રાણી રે-મારા૦ ॥૩॥
 દુવિધ ધરમ દયાનિધિ ભાખે, હેતુ જુગતે પ્રકાશે રે-મારા૦ ।

૪ ગેડો, ૫ ભમરો

લેહ-રહિત પ્રભુ નિરખો મુજને,

તો શોભા છે તુજને રે-મારાં ॥૪૮॥

મુદ્રા સુંદર હીપે તાહરી, મોહ્યા અમર નર-નારી રે-મારાં ।

સાહેબ સમતા-સસનો દરીયો,

માર્દવ-ગુણથી ભરીયો રે-મારાં ॥૪૯॥

સહજનંદી સાહિબ સાચો, જેમ હોયે હીરો જાયો રે-મારાં ।

પરમાતમ પ્રભુ-ધ્યાને ધ્યાવો,

અક્ષય-લીલા પાવો રે-મારાં ॥૫૦॥

રક્ત-વર્ણુ દીપે તનુ-કાન્તિ, જેતાં ટળે ભવ-બ્રાંતિ રે-મારાં ।

ઉત્તમવિજય-વિજયને શોથ,

રતનવિજય સુ-જગીશ રે-મારાં ॥૫૧॥



(૧૧૦૩) (૪૬-૧૩) શ્રી વિમલનાથ-જિનસ્તવન

(ખીજી ચંદન-પૂજના રે-એ દેશી)

વિમલ-જિનેસર સુંદર રે

નિરૂપમ છે તુમ નામ-જિનેસર સાંભરે ।

પૂરણાનંદી પરમેસર રે, આતમ-સંપદા-સ્વામ-જિનેં ॥૧॥

નિ-રાગીશું નેહલો રે, મુજ મન કરવા ભાવ-જિનેં ।

નિષ્કારણુ-જગ-વચ્છલુ રે, ભવોદ્ધિ-તારણુ-નાવ-જિનેં ॥૨॥

સારથવાહુ શિવ-પંથનો રે, ભાવ-ધરમ-દાતાર-જિનેં ।

જ્ઞાનાનંદે પૂરણો રે, ત્રિભુવન-જન-આધાર-જિનેં ॥૩॥

અષ્ટ-કરમ હેલા હણી રે, પામ્યા શિવપુર વાસ-જિનેં ।

ક્ષાયિક-ભાવે ગુણ વર્ચા રે,

હું સમરું સુ-વિલાસ-જિનેં ॥૪॥

શુભ ગાતાં ગિર્યા-તણા રે, જિહ્વા પાવન થાય-જિનેં ।
નામ-ગોત્ર જસ સાંભળી રે,

ભવ-ભવનાં દુઃખ જાય-જિનેં ॥૫॥

મન-મોહન મુજ-નાથશું રે,

અવર ન આવે દાય-જિનેં ।

પામી સુરતરૂ પરવડો રે, કોણ કરીરે જાય ?-જિનેં ॥૬॥

સહજનંદી સાહિબો રે, વર્જિત સકલ-ઉપાધ-જિનેં ।

જિન-ઉત્તમ અવલંબને રે,

રતન હુએ નિરાખાધ-જિનેં ॥ ૭ ॥



(૧૧૦૪) (૪૬-૧૪) શ્રી અનંતનાથ-જિન સ્તવન

(લઘુ પદ્ય હું તુમ મન નવિ માણું રે-એ દેશી)

અનંત-જિનેસર ! સાહિબ માહરો રે,

પુણ્યે પામ્યો દરિસણ તહારો રે ।

પ્રભુ-સેવા લાગે મુજ ખ્યારી રે,

તુમચા શુભની જાડં બલિહારી રે ॥૧॥

કેવલ-જ્ઞાને જગતને જાણે રે, લોકાલોકના ભાવ વખાણે રે ।

સમ્યગ્-જ્ઞાન તે ભવદુઃખ કાપે રે,

જ્ઞાન વિના ક્રિયા ફલ નવિ આપે રે ॥૨॥

સામાન્યે વસ્તુ પદારથ જેહ રે, એક સમયમાં જાણે તેહ રે ।

કેવલ-દર્શન વિગતે જાણે રે,

જૈનાગમથી ચિત્તમાં આણે રે ॥૩॥

નિરૂપાધિક નિજ શુભ છે જેહ રે,

નિજ સ્વભાવમાં સ્થિરતા તેહ રે ।

ક્ષાયિક ચારિત્ર તે જગ સાર રે,
 જેહુ આપે ભવોદ્ધિ-પાર રે ॥૪૧॥
 વિલસે અનંત-વીર્ય ઉદાર રે,
 એ ભાખ્યાં અનંતા ચાર રે ।
 એ ગુણુના પ્રભુ છો ભોગી રે,
 ગુણુઠાણાતીત થયા અ-ભોગી રે ॥૪૨॥
 ત્રિકરણુ-યોગે ધ્યાન તમારું રે,
 કરતાં સીઝે કાજ અમારું રે ।
 પુષ્ટાલંબન દેવ ! તું મારો રે,
 હું છું સેવક ભવોભવ તારો રે ॥૪૩॥
 સિંહસેન-નૃપવંશ સુહાચો રે,
 સુજસા-રાણીનો તું જયો રે ।
 ઉત્તમવિજય-વિણુધનો શિષ્ય રે,
 રતનવિજયની પૂરો જગીશ રે ॥૪૪॥



(૧૧૦૫) (૪૬-૧૫) ધર્મનાથ-જિન-સ્તવન
 (વિમલ-જિન ! દીઠાં લોચણુ આજ-એ દેશી)
 ધર્મ-જિનેસર ધ્યાઈએ રે, આણી અધિક સનેહ ।
 ગુણુ ગાતાં ગિરૂઆ તણા રે, વાધે બમણો નેહ-
 -જિનેસર ! પૂરો માહરી આશ !
 જિમ પામું શિવપુર-વાસ-જિન ॥૧॥
 કાલ અનાદિ-નિગોહમાં રે, ભર્યો અનંતીવાર ।
 કર્મ નટાવે રાજવ્યો રે, સેવ્યા પાપ અઢાર-જિને ॥૨॥

પ્રાણાતિપાત મૃષા ઘણું રે, ત્રીજું અદ્વૈતાદાન ।
 વિષયા-રસમાં રાચીયો રે, કીધું બહુ દુરધ્યાન-જિને ॥૩૩॥
 નવવિધ પરિશ્રદ્ધ મેળવ્યો રે, કીધો ક્રોધ અપાર ।
 માન-માયા-લોભે કરી રે,

ન લાલ્યો તત્ત્વ-વિચાર-જિને ॥૩૪॥
 રાગ-દ્વેષ-કલહ કર્યા રે, દીધાં પરને આળ ।
 પૈશુન્ય-રતિ-અરતિ વળી રે,

સેવતાં દુઃખ અસરાળ-જિને ॥૩૫॥
 પાપ-સ્થાનક સેવી જીવડો રે, રૂઢ્યો ચઉ-ગતિ-મોઝાર ।
 જન્મ-મરણાદિ વેદના રે,

સહી તે અનંત અપાર-જિને ॥૩૬॥
 એહ વિડંબન આકરી રે, ટાળો શ્રી જિનરાજ
 બાંહ શ્રદ્ધીને તારજો રે, સારો સેવક કાજ-જિને ॥૩૭॥
 ધર્મ-જિણ્દ સ્તવતાં થકાં રે, પોહોતી મનની આશ ।
 જિન-ઉત્તમ પદ સેવતાં રે,

રતન લહે શિવ-વાસ જિને ॥૩૮॥



(૧૧૦૬) (૪૩-૧૬) શ્રી શાંતિનાથ-જિન સ્તવન.

(ઠંઠણ-ઋષિજીને વંદના હું વારી-એ દેશી)

અચિરા-નંદન વંદિયે-હું વારી,

શુશ્રુણિધિ શાંતિ-જિણ્દરે-હું વારી લાલ ।

અભય-દાન-શુશ્રુ-આગર-હું વારી,

ઉપશમ-રસનો કંઠરે-હું વારી લાલ-અચિરા ॥૧॥

મારી-મરકી વેદના-હુંં,

પસરી સઘલે દેશ રે-હુંં વારી લાલ ।

હુઃખ-દાયક અતિ-આઠરી, હુંં,

પામે લોક કલેશ રે-હુંં અચિરાં ॥૨॥

પુણ્યાનુબંધિ-પુણ્યથી હુંં ઉપન્યા ગર્ભ-મોઝાર-હુંં ।

શાંતિ પ્રવર્તી^૧ જનપદે-હુંં,

હુઓ જયજયકાર રે-હુંં અચિરાં ॥૩॥

દોય પદવી એકે ભવે-હુંં, પોડશમે જગદીશ રે-હુંં ।

પંચમ-ચક્રી ગુણ-નીલો-હુંં,

પ્રહ ઉઠી નામું શીશ રે-હુંં અચિરાં ॥૪॥

દીક્ષા ગ્રહે તે દિન થકી-હુંં,

ચઉ-નાણી ભગવાન રે-હુંં ।

ઘાતી-કરમના નાશથી-હુંં

પામ્યા પંચમ-જ્ઞાન રે-હુંં અચિરાં ॥૫॥

તીર્થપતિ વિચરે જિહાં-હુંં ત્રિગડું રચે મુરરાય રે-હુંં ।

સમવસરણુ દિયે દેશના-હુંં,

સુણુતા ભવ-હુઃખ બાય રે-હુંં અચિરાં ॥૬॥

૨પણુવીસ-ઉસય ને આગલે-હુંં,

જોયણુ લગે નિરધાર રે-હુંં ।

૪૨વ-ચક્ર-૫પરચક્રનાં-હુંં,

ભય થાયે^૬ વિસરાળ રે-હુંં અચિરાં ॥૭॥

૧ દેશમાં, ૨ પંચીશ, ૩ સોની ઉપર-એટલે ૧૨૫ ચોજનામાં,
૪ પોતાના દેશનો, ૫ બીજાના દેશ=દુરમનનો, ૬ દૂર થાય તેવા.

જીવ ધણા તિહાં ઉદ્ધરી-હુંં,
 શિવ-પુર સનમુખ કીધ રે-હુંં ।
 અક્ષય-સુખ જિહાં શાસ્વતાં-હુંં ,
 અ-વિચલ-પદવી લીધ રે-હુંં અચિરાં ॥૮॥
 સહસ-મુનિ સાથે વર્યા-હુંં,
 સમેત-શિખર-ગિરિ સિદ્ધ રે-હુંં ।
 ઉત્તમ ગુરુ-પદ સેવતા-હુંં,
 રતન લહે નવ-નિધ રે-હુંં અચિરાં ॥૯॥



(૧૧૦૭) (૪૬-૧૭) શ્રી કુંથુનાથ-જિન સ્તવન

(નાણુ નમો પદ સાતમે-એ દેશી)

કુંથુ-જિનેસર સાહિયો, સદ્ગતિનો દાતાર-મેરે લાલ ।
 આરાધો કામિત-પૂરણો, ત્રિભુવન-જન-આધાર-મેરે લાલ-
 -સુગુણ સનેહી ! સાહિયો ! ॥૧॥

દુરગતિ પડતા જંતુને, ઉદ્ધરવા દીયે હાથ-મેરે ।

લવોદધિ-પાર પમાડવા,

ગુણ-નિધિ ! તું સમસ્થ-મેરે-સું ॥૨॥

લવ ત્રીજેથી બાંધીયું, તીર્થ'કર પદ સાર-મેરે ।

જીવ સવિની કરૂણા કરી,

વલી સ્થાનક-તપથી ઉદાર-મેરે-સું ॥૩॥

ઉપગારી અરિહંતજી, મહિમાવંત મહંત-મેરે ।

નિ'કારણુ-જગ-વચ્છલુ, ગિરૂઓ ને ગુણવંત-મેરે-સું ॥૪॥

જ્ઞાનાનંદે પૂરણો, ભાષે ધરમ ઉદાર-મેરેં ।
 સ્યાદ્વાદ-સુધારસે, વરસે જ્યું જલ-ધાર-મેરેં-સું ॥૫૥॥
 અતિશય-શુષ્ક-ઉદયે થકી, વાણીનો વિસ્તાર-મેરેં ।
 ખારે પરષદા સાંભળે, જોયણુ લગે તે સાર-મેરેં-સું ॥૬૥॥
 સારથવાહ શિવ-પંથનો, આતમ-સંપદ-દર્શિ-મેરેં ।
 ધ્યાન-ભુવનમાં ધ્યાવતાં,
 લહીએ અતિશય-જગીશ-મેરેં-સું ॥૭૥॥
 છટો ચક્રી દુઃખ હરે, સત્તરમો જિન-દેવ-મેરેં ।
 મોટે પુણ્યે પામીયો, તુમ પદ-પંકજ-સેવ-મેરેં-સું ॥૮૥॥
 પરમ-પુરૂષની ચાકરી, કરવી મનને કોડ-મેરેં ।
 ઉત્તમ-વિજય-વિબુધ-તણો,
 રતન નમે કર-જોડ-મેરેં-સું ॥૯૥॥



(૧૧૦૮) (૪૬-૧૮) શ્રી અરનાથ-જિન સ્તવન
 (સંભવ-જિનવર વિનતિ-એ કેશી)

અર-જિનવર દીયે દેશના, સાંભળજો ભવિ પ્રાણી રે ।
 મીઠી સુધા-રસ-સારિખી, સુણીયે અનુભવ આણી રે-અર૦ ॥૧૥॥
 આળસ-મોહ-અજ્ઞાનતા, વિષય-પ્રમાદને છંડી રે ।
 તન્મય-ત્રિકરણ-જોગશું, ધરમ સુણો ચિત્ત મંડી રે-અર૦ ॥૨૥॥
 દશ-દ્રષ્ટાંતે દોહિલો, નર-ભવનો અવતાર રે ।
 સુર-મણિ સુર-ઘટ સુર-તર,
 તેહથી અધિકો ધાર રે-અર૦ ॥૩૥॥

એહ અસાર-સંસારમાં, લભીયો ચેતન એહ રે ।
ધર્મે વરજિત દિન ગયા,

હજીય ન આંચો છેહ રે-અર૦ ॥૪॥

જ્ઞાન-દર્શનમય આત્મા, કર્મ-પાંકે અવરાણો રે ।
શુદ્ધ-દશા નિજ હારીને,

અતિશય-દોષે ભરાણો રે-અર૦ ॥૫॥

દોષ-અનાદિથી ઉદ્ધરે, જૈન-ધર્મ જગ સાર રે ।

સકલ-નયે જો આદરે, તો હોય ભવોદ્ધિ-પાર રે-અર૦ ॥૬॥

જિન-આણુ જે આરાધતા, વિધિ-પૂર્વક ઉજમાળ રે ।

સાધે તે સંવર-નિર્જરા, પામે મંગળ-માળ રે-અર૦ ॥૭॥

અકી ભરતે સાતમો, અઠારમો જિન રાય રે ।

ઉત્તમવિજય-કવિ રાજનો,

રતનવિજય ગુણ ગાય રે-અર૦ ॥૮॥

(૧૧૦૯) (૪૬-૧૯) શ્રી મલિનાથ-જિન સ્તવન
(જગપતિ નાયક નેમિ જિજ્ઞંસ એ દેશી)

જગપતિ ! સાહેબ મલિ-જિજ્ઞંસ,

મહિમા મહિઅલ ગુણ-નીલો ।

જગપતિ ! દિનકર જયું ઉદ્યોત-કારક વંશે કુલતિલો ॥૧॥

જ૦ પ્રમલ પુણ્ય-પસાય, ઉદ્યોત નરકે વિસ્તરે ।

જ૦ અંતરમુદૂરત તામ, શાતા-વેદની અનુસરે ॥૨॥

જ૦ શાંત-સુધારસ-વૃષ્ટિ, તુજ મુખ-ચંદ્ર થકી ઝરે ।

જ૦ પડિમોહે ભવિ-શુભ, મિથ્યા-તિમિર દૂરે કરે ॥૩॥

- જ૦ ભવ-સાગરમાં જહાજ, ઉપગારી-શિર-સેહરે ।
 જ૦ તુમ દરશનથી આજ, કાજ સર્યો હવે માહરે ॥૪૧॥
 જ૦ દીઠે સુખ-કળ તુજ, નાઠા ત્રણ પ્રભુ માહરે ।
 જ૦ દારિદ્ર્ય-પાપ-દુર્ભાગ્ય, પુટાલંબન તાહરે ॥૪૨॥
 જ૦ ભવ-ભવ-સંચિત જેહ, અઘ નાઠાં ટળી આપદા ।
 જ૦ જાયું નહિ કીશો દામ, માયું તુમ પદ-સંપદા ॥૪૩॥
 જ૦ શુણીઓ મન ધરી નેહ, યોગણીસમો જિન સુખ-કર ।
 જ૦ નીલ-રચણ તનુ-કાંતિ, દીપતી રૂપ મનોહર ॥૪૪॥
 જ૦ જિન-ઉત્તમ-પદ-સેવ, કરતાં સવિ સંપદ મલે ।
 જ૦ રતન નમે કરજોડ, ભાવે ભવોદધિ ભય ટળે ॥૪૫॥



(૧૧૧૦)(૪૬-૨૦) શ્રી મુનિસુવ્રત-જિન સ્તવન

(વીર-જિણુંદ જગત ઉપગારી-એ દેશી)

મુનિ સુવ્રત-જિન અધિક દિવાજે,

મહિમા મહિયલ છાજેછ ।

ત્રિ-જગ-વંદિત ત્રિભુવન-સ્વામી,

ગિર્યો શુણ-નિધિ ગાજેછ-મુનિ૦ ॥૧॥

જન્મ વખત વર-અતિશય-ધારી,

કદપાતીત-આચારીછ ।

ચરણ-કરણભૂત મહાવ્રત-ધારી,

તુમચી જાઉં બલિહારીછ-મુનિ૦ ॥૨॥

જગ-જન-રંજન ભવ-દુઃખ-ભંજન,

નિરૂપાધિક-શુણભોગીછ ।

અ-લખ નિરંજન દેવ હયાળુ,

આતમ-અનુભવ-જોગીજી-મુનિં ॥૩૮॥

જ્ઞાનાવરણીય-ક્ષયથી પ્રગટયું,

અનુપમ કેવળ-નાથજી ।

લોકાલોક-પ્રકાશક ભાસક,

ઉદ્યો અભિનવ-ભાણુજી-મુનિં ॥૪૧॥

વરસી વસુધા પાવન કીધી, દેશના સુધા-રસ સારજી ।

ભવિક-કમલ પ્રતિબોધ કરીને,

કીધા બહુ ઉપકારજી, મુનિં ॥૪૫॥

સંપૂરણ તેં સિદ્ધતા સાધી, વિરમી સકલ-ઉપાધિજી ।

નિરૂપાધિક-નિજ-ગુણને વરીયા,

અ-ક્ષય-અ-વ્યાબાધજી-મુનિં ॥૬૧॥

હરિ-વંશે વિભૂષણ દીપે, રિષ્ટ-રતન તનુ-કાંતિજી ।

સુખ-સાગર પ્રભુ નિરમળ-જયોતિ,

જોતાં હોય ભવ-શાંતિજી-મુનિં ॥૭૧॥

સમેત-શિખર-ગિરિ સિદ્ધિ વરીયા,

સહસ-પુરૂષને સાથજી ।

જિન-ઉત્તમ-પદને અવલંબી,

રતન થાયે સ-નાથજી-મુનિં ॥૮૧॥



(૧૧૧૧) (૪૬-૨૧) શ્રી નમિનાથ-જિન સ્તવન

(સોના રૂપાકે સોગઠે સાંયાં ખેલત બાળ-એ દેશી)

નિરૂપમ નામ-જિનેસરૂ, અક્ષય-સુખ-દાતા ।

અતિશય-ગુણ અધિકથી, સ્વામી જગત-વિખ્યાતા ॥૧॥

બાર ગુણો અરિહંતથી, ઉંચો વૃક્ષ અ-શોક ।

ભવ-દવ-પીડિત જંતુને, જોતાં જાય શોક. ॥૨॥

પીત વરણ-સિંહાસને, પ્રભુ બેઠા છાજે ।

દિવ્ય-ધ્વનિ દીપે દેશના, નાદે અંબર ગાજે. ॥૩॥

છત્ર ધરે ત્રણ સુરવરા, ચામર વીંજાય ।

ભામંડલ અતિ દીપતું, પૂઠે જિનરાય. ॥૪॥

યોજન-માને સુર કરે, વૃષ્ટિ કુસુમ-કેરી ।

ગગને ગાજે દુંદુભિ, કરે પ્રદક્ષિણા ફેરી. ॥૫॥

અઠ મહા-પાડિહારથી, દીપે શ્રી જગદીશ ।

અઠ-કરમ હેલા હણી, પામ્યા સિદ્ધિ જગીશ ॥૬॥

નામે નવ-નિધિ સંપન્ને સેવતાં દુઃખ જાય ।

ઉત્તમવિજય-વિબુધનો, સ્તવનવિજય ગુણ ગાય. ॥૭॥



(૧૧૧૨) (૪૬-૨૨) શ્રી નેમિનાથ-જિન સ્તવન

(હાં રે! મારે! ધર્મ-જિણંદશું લાગી પૂરણ-પ્રીતજે-એ દેશી)

હાં રે! મારે! નેમિ-જિનેસર અલવેસર આધાર જો,

સાહિબ રે સોભાગી ગુણ-મણિ-આગરૂ રે લો ।

હાં રે! મારે! પરમ-પુરૂષ પરમાતમ દેવ પવિત્ર જો,

આજ મહોદય દરિસણ પામ્યો તાહરૂં રે લો ॥૧॥

હાંરે ! મારે ! તોરણુ આવી પશુ છોડાવી નાથ જો,
 રથ ફેરીને વળીયા નાયક નેમજી રે લો ।
 હાં રે ! મારે ! દૈવ રઘટારે એ શું કીધું ? આજ જો,
 ઝરઘીઆળી વર રાજુલ છોડી કેમજી રે ? લો ॥૨૦॥
 હાં રે ! મારે ! સંયોગી-ભાવ વિ-યોગી જાણી સ્વામી જો,
 એ સંસારે ભમતાં કો કેહવું નહિ રે ! લો ।
 હાં રે ! મારે ! લોકાંતિકને વયજી પ્રભુજી તામ જો,
 વરસી દાન દીયે તિજી અવસર જિન સહી રે લો ॥૨૧॥
 હાં રે ! મારે ! સહસાવનમાં, સહસ-પુરૂષની સાથ જો,
 ભવ-દુઃખ-છેદન-કારણુ ચારિત્ર આદરે રે લો ।
 હાં રે ! મારે ! વસ્તુ-તત્ત્વે રમણ કરંતા ૪સાર જો,
 ચોપનમે દિન કેવલ-જ્ઞાન-દશા વરે રે લો ॥૨૨॥
 હાં રે ! મારે ! શિવા-પનંદ વરસે સુખકર વાણી જો,
 આસ્વાદે ભવિ ભાવ ધરીને સુંદર રે લો ॥૨૩॥
 હાં રે ! મારે ! દેશના નિસુણી બુઝયાં રાજુલ નાર જો,
 નિજ-સ્વામીને હાથે સંયમ આદરે રે લો ।
 હાં રે ! મારે ! અષ્ટ-ભવોની પાળી પૂરણુ-પ્રીત જો,
 પિયુ પહેલાં શિવ-લક્ષ્મી રાજિભતી વરે રે લો ॥૨૪॥
 હાં રે ! મારે ! વિચરી વસુધા પાવન કીધી સાર જો,
 જગ-ચિંતામણિ જગ-ઉપગારી ગુણુ-નિધિ રે લો ।
 હાં રે ! મારે ! જિન-ઉત્તમ-પદ-પંકજ-કેરી સેવ જો,
 કરતાં રતનવિજયની કીરતિ આત વધી રે લો ॥૨૫॥

૧ ભાગ્યે ૨ ખરાબ ૩ સુંદર ૪ શ્રેષ્ઠ ૫ પુત્ર

(૧૧૧૩) (૪૬-૨૩) શ્રી પાર્શ્વનાથ-જિન સ્તવન

(૫૧^૧ પશુસણુ આવીયાં રે લાલ-એ દેશી)

ત્રિભુવન-નાયક વંદીયે રે લો,

પુરિસાદાણી પાસ રે-જિનેસર ! ।

સુરમણિ-સુરતરૂ-સારીખો રે લો,

પૂરતો વિશ્વની આશરે-જિને

-જ્યો જ્યો પાસ-જિનેસરૂ રે લો ॥૧॥

^૧વાસવ-પૂજિત વંદીયે રે લો,

આણી ભાવ-ઉલ્લાસ રે-જિને જ્યો ॥૨॥

શ્રી જિન ! તુજ દરિયણુ વિના રે લો,

ભમીયો કાલ અપાર રે-જિને ॥

આતમ-ધર્મ^૧ ન ઓળખ્યો રે લો,

ન લહ્યો તત્ત્વ-વિચાર રે-જિને જ્યો ॥૩॥

પ્રવચન અંજન જે કરે રે લો,

પામી સદ્ગુરૂ-સંગ રે-જિને ॥

શ્રદ્ધા-ભાસન પ્રગટતાં રે લો,

લહીએ ધર્મ-પ્રસંગ રે-જિને જ્યો ॥૪॥

સાધન-ભાવે ભવિકને રે લો,

સિદ્ધને ક્ષાયિક હોય રે-જિને ॥

પ્રગટ્યો ધર્મ^૧ તે આપણો રે લો,

અ-ચલ અ-ભંગ તે જોય રે-જિને જ્યો ॥૫॥

તુજ ચરણાં મેં લેટીયા રે લો,

ભાવે કરી જિનરાજ રે-જિને ॥

નેત્ર-યુગલ જિન નિરખતાં રે લો,

સિધ્યાં વંછિત-કાજ રે-જિનેં જ્યોં ॥૬॥

નીલ-વરણ નવ-રંકર લલુ' રે લો,

દીયે તનુ સુ-કુમાર રે-જિનેં ।

જિન-ઉત્તમ-પદ સેવતાં રે લો,

રતન લહે ગુણ-માળ રે-જિનેં જ્યોં ॥૭॥



(૧૧૧૪) (૪૬-૨૪) શ્રી મહાવીર જિન સ્તવન

(આવો આવો જસોદાના કંથ-એ દેશી)

ચોવીશમે શ્રી મહાવીર સાહિબ સાચો રે ।

રતનત્રયીનું પાત્ર, હીરો જાચો રે ॥૧॥

આઠ-કરમનો લાર કીધો ફરે રે ।

શિવ-વધૂ સુંદર નાર. થઈ હનુરે રે ॥૨॥

તુમે સાર્યાં આતમ-કાજ, દુઃખ નિવાર્યાં રે ।

પહોતા અ-વિચલ ઠામ, નહિ ભવ ફેરા રે ॥૩॥

જિહાં નહિ જન્મ-મરણ, થયા અ-વિનાશી રે ।

આતમ-સત્તા જેહ, તેહ પ્રકાશી રે ॥૪॥

થયા નિરંજન નાથ, મોહને ચૂરી રે ।

છોડી ભવ-ભય-કૂપ, ગતિ નિવારી રે ॥૫॥

અ-તુલ-બલ અરિહંત, કોધને છેદી રે ।

ફરસી ગુણનાં ઠાણુ થયા અવેદી રે ॥૬॥

એહવા પ્રભુનું ધ્યાન, ભવિયણુ કરીએ રે ।

કરીએ આતમ-કાજ, સિદ્ધિ વરીએ રે ॥૭॥

સેવે થઈ સાવધાન, આળસ મોડી રે ।

નિદ્રા-વિકથા ફર, માયા છોડી રે ॥૮॥

મૃગપતિ-લંછન પાય, સોવન-કાયા રે ।

સિદ્ધારથ-કુલ આય, ત્રિશલાએ જાયા રે ॥૯॥

બહોંતેર-વરસનું આય, પૂરણ પાળી રે ।

ઉદ્ધરીયા જીવ અનેક, મિથ્યાત્વ ટાળી રે ॥૧૦॥

જિન-ઉત્તમ-પદ સેવ, કરતાં સારી રે ।

રતન લહે ગુણ-માળ, અતિ-મનોહારી રે ॥૧૧॥

✽

કલશ

(આતમ-લક્ષિત મળ્યા કેઇ દેવા-એ દેશી)

ચોવીશ-જિનેસર જીવન-^૧દિનેસર, નિરૂપમ-જગ-ઉપગારીજી ।

મહિમા-નિધિ મોટા તુમે મહીયલ,

તુમચી જાઉં બલિહારીજી ॥૧॥

જન્મ કલ્યાણક વાસવ આવી, મેરૂશિખર નવરાવેજી ।

માનું અક્ષય-સુખ લેવા સુર, આવી જિન-ગુણ ગાયજી ॥૨॥

ગૃહ-વાસ છંડી શ્રમણપણું લઈ ઘાતી-કરમ ખપાયાજી ।

ગુણ મણિ-આકર જ્ઞાન-દિવાકર, સમવસરણ સુહાયાજી ॥૩॥

દુવિધ ધરમ દયા-નિધિ ભાળે, તારે ગ્રહીને હાથેજી ।

વાણી-સુધા-રસ વરસી વસુધા, પાવન કીધી નાથેજી ॥૪॥

ચોત્રીશ અતિશય શોભાકારી, વાણી ગુણ પાંત્રીશજી ।

અષ્ટ-કરમ-મલ ફર કરીને, પામ્યા સિદ્ધિ જગીશજી ॥૫॥

૧ સૂર્ય,

ચોવીશ-જિનનું ધ્યાન ધરંતાં, લહીયે ગુણ-મણિ-ખાણુજી ।
 અનુકંમે પરમ-મહોદય પદવી, પામે પદ નિરવાણુજી ॥૬॥
 તપગચ્છ-૨અંબર ઉદયો ઝલાનુ, તેજ-પ્રતાપી છાજેજી ।
 વિજયદેવ સૂરીશ્વર-રાયા મહિમા મહિયલ ગાજેજી ॥૭॥
 તાસ પાટ-પ્રભાવક સુંદર, વિજયસિંહ-સૂરીશજી ।
 વડ-ભાગી વૈરાગી ત્યાગી સત્યવિજય-મુનીશજી ॥૮॥
 તસ પદ-પંકજ-મધુકરસરીખા, કપુરવિજય-મુણિંદાજી ।
 ખીમાવિજય તસ આસન-શોભિત,

જિનવિજય-ગુણ ચંદાજી ॥૯॥

ગીતારથ સારથ સોભાગી, લક્ષણ-લક્ષિત દેહાજી ।
 ઉત્તમવિજય-ગુરૂ જયવંતા, જેહને પ્રવચન-નેહાજી ॥૧૦॥
 તે ગુરૂની બહુ મહેર-નજરથી, પામી અતિ-સુપસાયાજી ।
 રતનવિજય-શિષ્ય અતિ-ઉછરંગે,

જિન ચોવીશ ગુણ ગાયાજી ॥૧૧॥

સુરત-મંડન પાસ-પસાયા ધર્મનાથ-સુખદાયાજી ।
 વિજય ધર્મસૂરીશ્વર-રાજ્યે, શ્રદ્ધા-બોધ વધાયાજી ॥૧૨॥
 અદારશે ચોવીશ વરસે, સુરત રહી ચોમાસજી ।
 માધવ માસે કૃષ્ણ-પક્ષમાં, ત્રયોદશી-દિન ખાસજી ॥૧૩॥



શ્રી વર્ધમાનસ્વામિને નમઃ
શ્રી માણેકમુનિ-કૃત
જિન-સ્તવન ચોવીશી
(૪૭)

(૧૧૧૫) (૪૭-૧) શ્રી ઋષભદેવ-જિન સ્તવન

(માનીતી કાગલ મોકલે-એ દેશી)

પ્રથમ-જિનેસર પ્રાહુણા-જગવાહલા વારુ,

આવો અમ મન-ગેહ-મન મોહનગારુ ।

ભગતિ કરું ભલી ભાંતિસ્યું-જગ૦,

સાહિબજી સ-સનેહરે-મન૦

-મોહી રહ્યો મનડો દેખવા હો રાજ ॥૧॥

આંખડીમાં ૧અલજો ઘણો-જગ૦,

દેખજી તુમ્હ ૨દીકાર દે-મન૦

ઘડી ઘડી નિત સાંભળો-જગ૦

સાસોસાસમાં સો વાર દે-મન૦ મોહી૦ ॥૨॥

મુરતિ મોહનવેલડી-જગ૦ સોહઈ અધિક સ-નૂરદે-મન૦ !

ભવિ જન વંછિત પૂરવા-જગ૦,

કલ્પતરુ અંકૂર દે-મન૦ મોહી૦ ॥૩॥

ટેક ધરી એકતારસ્યું-જગ૦, કરતાં તુમ્હશું પ્રીતદે-મન૦ ।

૧ ઉત્સુકતા, ૨ દર્શન.

નિર્મલ હોવઈ આતમા-જગ૦,

લહિઈ સુયશ સુ-રીત રે-મન૦ મોહી૦ ॥૪॥

પરમ-પુરુષ પરમેસર રે-જગ૦,

જગ-ખંધવ જગનાથ રે-મન૦ ।

કહે માણિકું કર જોડીને-જગ૦,

જય જય જિન શિવ-સાથ રે-મન૦ મોહી૦ ॥૫॥



(૧૧૧૬) (૪૭-૨) શ્રી અજિતનાથ-જિન સ્તવન

(નવા નગરનઈ ગુંદરઈ રે પોઠી પડયા પંચાસ-એ દેશી)

અજિત-જિણુંદનઈ^૧ ઓલગું રે, ^૨ ઓલગડી અવધારિ-વાલ્હા-

તું સાહિબ ભલે ભેટીઓ રે ।

ભવ-અટવીમાં હું ભમ્યો રે,

ભૂલો ભરમ-અંધાર-વાલ્હા ! તું ॥૧॥

ચાર વિષમ વન તેહમાં રે અતિ-મોટાં અસરાલ-વાલ્હા ! તું ॥

લાખ-ગમે દુઃખ-રૂખડાં રે,

જન્મ-મરણ જંજાલ-વાલ્હા ॥ તું ॥૨॥

લાખ ચોરાશી જીવ ખાણમાં રે,

ભમતાં નાવે પાર-વાલ્હા ! તું ॥

મોહે છાયો મારો પ્રાણીઓ રે,

ન લહું મારગ સાર-વાલ્હા ! તું ॥૩॥

કરુણા કરી હવે કીજઈ રે, દીન તણો ઉધાર-વાલ્હા ! તું ॥

ચરણે રાખો આપણો રે, જીવન જગ-આધાર-વાલ્હા ! તું ॥૪॥

૧ સેવા કરે, ૨ સેવા

ભગત-વછલ ભગવંતજી રે, પ્રભુજી ! પરમ-કૃપાલ-વાદહા !
 માણિક સુનિ ઇમ વિનવધરે,
 દીજે મંગલ-માલ-વાદહા ! તું° ॥૫૦॥



(૧૧૧૭) (૪૭-૩) શ્રી સંભવનાથ-જિન સ્તવન
 (ઉંચાં તે અંબાવણનાં માલીયાં રે-એ દેશી)

સંભવનાથ સોહામણા રે, શરણાગત-પ્રતિપાલ રે-રાજ !
 લળી લળી લાગું પાયલે રે,
 સાહિબ ! નિજર નિહાલ રે-રાજ ! ॥૧॥
 મુજરો જિનેસર ! માનજ્યો રે, માતા સેના નંદ રે-રાજ !
 ચાહે નયન-ચકોરડાં રે,
 તુઝ મુખ શારદ ચંદ રે-રાજ ! મુજરો° ॥૨॥
 આજ સફલ દિન માહરો રે, દીઠો દેવ દયાલ રે-રાજ !
 દુઃખ નાઠો સવિ દેહનો રે,
 મીઠો અમીત્ત રસાલ રે-રાજ ! મુજરો° ॥૩॥
 મન માન્યાની પ્રીતડી રે, છં જગમર્થ જિનરાય રે-રાજ !
 એક દીઠઈ દિલ ૧ઉલટાઈ રે,
 એક દીઠઈ ઉલાસ રે-રાજ ! મુજરો° ॥૪॥
 સુરતિ તોરી મન વસી રે, સુરતિ કે મનોહાર રે-રાજ !
 વલી વલી લેઉ ઓવારણાં રે,
 તીન ભુવન શિષુગાર રે-રાજ ! મુજરો° ॥૫॥

રંગ લાગેા જિનરુપશુ' રે, જેહવેા ચોલ મણક રે-રાજ ! ।

માણિક મુનિ ઈમ વિનવઈ રે,

સુખ હોવઈ તુમ દીઠ રે-રાજ ! મુજરોં ॥૬॥

(૧૧૧૮) (૪૭-૪) શ્રી અભિનંદન-જિન રેતવન
(બીલી રાણીની-એ દેશો)

પ્રભુજી અભિનંદન જિનરાજ !

મોરા પ્રભુજી ! અભિનંદન-જિનરાજ રે ।

હૃદય-કમલમાં તું વસઈ રે જી રે જી !

પ્રભુજી ! દૂર વસતિ-વાસ-

મોરા પ્રભુ ! દૂર વસતિ-વાસ રે,

તુમ નામઈ ચિત્ત ઉલ્લસઈ-જી રે જી ॥૧॥

...પ્રભુજી ! જિમ રકૈરવ જલવાસ,

મોરા ! પ્રભુ ! જિમ કૈરવં રે-

ગયણું ગણુ ચંદો રહે-જી રે જી,

પ્રભુજી ! વિકસિત થાય સહેજ મોરા પ્રભુ વિકસંત રે,

દિનકર તાપ દિવસે સહે-જી રે જી. ॥૨॥

પ્રભુજી ! જલધર-વાસ આકાશ-મોરા ! પ્રભુ ! જલધરં રે,

મોર મહીતલ સંચરઈ-જી રે જી,

મોરા પ્રભુ ! નિસુણઈ ગરજત ઘોર મોરા પ્રભુ ! નિસું રે

નાચિ નૃત્ય કલા કરેજી-રે જી. ॥૩॥

પ્રભુજી ! તુજશ્યું ધરમ સનેહ-મોરા પ્રભુ તુઝં રે,

મેં કીધું...ધશ્યું,-જી રે જી,

૧ રહેઠાણુ ર ચંદ્ર વિકાશી કમલ,

પ્રભુજી ! અવર ન ચાહુ ચિત્ત-મોરા પ્રભુ ! અવર નં રે,
 તુંહિજ તુંહિ બુધસ્યુ-જી રે જીં ॥૪૧॥
 પ્રભુજી ! તું મુજ આતમરામ-મોરાં તું મુજં રે,
 માહરઈ ઈક તુમ આસરો-જી રે જીં ।
 પ્રભુજી ! માણિકે મુનિ અરદાસ-મોરા પ્રભુ ! માણેકં રે,
 સાહિબજી ચિત્ત મેં ધર્યો-જી રે જીં ॥૪૨॥



(૧૧૧૯) (૪૭-૫) શ્રી સુમતિનાથ-જિન સ્તવન
 (દાલ-લાજવા જિંબુ બોયડી રે,
 કહેને લેઈ ગયા ચોર-વાલ્હા-એ દેશી)
 સુમતિ-જિનેસર સેવઈ રે,
 સુમતિ તણે દાતાર-મુજરો માનો રે !
 મિહિર જ કરી, અંતર જાણી મી આપણે રે-
 આતમા આધાર-મુજરોં ॥૧॥
 મેઘરાયા સુત સુંદર રે, મંગલ્લા માત મલ્હાર-મું ।
 મંગલ-વેલ વધારવા રે, ઉદયો નવ જલધાર-મું ॥૨॥
 રૂપ અનોપમ રાયનું રે-કંચનનઈ ^૧અણુહાર-મું ।
 સોવનવાન સોહામણો રે, ઈક્વાગ વંશ ઉદાર-મું ॥૩॥
 દાન સંવચ્છરી દેઈને રે, લીધો સંજમ ભાર-મું
 અષ્ટ કર્મ-અરિ જીતીને રે, પોહતા મુગતિ મઝાર-મું ॥૪॥
 પૂરવ લાખ જ્યાલીસનું, જીવિત જોહનું સાર-મું ।
 માણિકે મુનિ મન રંગશું રે, ચાહે સુમતિ-^૨દીદાર-મું ॥૫॥



૧ જેવું, ૨ દર્શન,

(૧૧૨૦) (૪૭-૬) શ્રી પદ્મપ્રભ-જિન સ્તવન
(હાલ-લવિંગ સોપારી એલચી વા કાંઈ બીડ લેવા-એ દેશી)
પદ્મપ્રભ જિન પેખતાં, મારા લોચન અમીય ભરાય રે-
સુખકર કિ સાહિબ સેવીઈ !

પુણ્ય-પ્રભાવિ પામીઈ,

પ્રભુ-૧લેટ ભલી ફલદાય રે-સુખ૦ સાહિબ૦ ॥૧॥
નયરી કોશાંબી નરવરુ, ધર નંદ મો મન લાય રે-સુખ૦ ।
માત સુસીમા જેહની,

૨સુર-નાયક-સેવિત પાય રે-સુખ૦ ॥૨॥
પંકજ લંછન પ્રેમ-શુ' રે,

જિન નમતાં પાતિક બાય રે-સુખ૦ ।
દીનબંધુ દુઃખ વારણો,

જહ સુ-વિદુમ વરણી કાય રે-સુખ૦ ॥૩॥
ભવિજન વાંછિત પૂરવા,

પ્રભુ ! સુરુ-તરુ કંદ સચાય રે-સુખ૦ ।
કેવલ-કમલા ભોગવી,

જિજ્ઞુષી સિદ્ધિ-વધૂ વરી ધાય રે-સુખ૦ ॥૪॥
તે ગુણુ-સાગર ગાયતાં,

સ્વામી ઉદ્ધરિત દૂર પલાય રે-સુખ૦
માણિક્ય મુનિ મન-મંદિરઈ,

એહ રંગ રમો જિનરાય રે-સુખ૦ ॥૫॥



૧ પ્રભુનો સંયોગ, ૨ ઈદ્ર, ૩ પાપ,

(૧૧૨૧) (૪૭-૭) શ્રી સુપાર્શ્વનાથ-જિન સ્તવન

(ઝરમર વરસઈ ઝીંણા મેહુ કિ, છવાયેરે છાંટણારે-એ દેશી)

અંદ્રમુખી ૧મૃગ-લોચણી નારિ કિ,

ટોલઈ સહુ મલો રે-કિ ટોલઈં ।

અપચ્છરની ૨ પરી કરી શિશુગાર કિ,

રાસ રમે ચલી રે-રમે ચલી રં ॥૧॥

પ્રથવી-નંદનને દરબાર કિ, આવી મલપતીરે કિ-આવીં ।

ગાયે ગાયે ગીત ઉદાર કે, મનમે હરખતી રે-મનં ॥૨॥

નાચે નાચે બહુવિધ ઝબાલ કિ, રંગઈ રાજતી રે-કે રંગં ।

શુંજે શુંજે ૪માદલ તાલ કે,

વીણા વાજતી રે-કિ વીણાં ॥૩॥

ફિરી ફિરી નૈ ભમરી હેત કિ,

પ્રભુજી આગલઈ રે-કિ પ્રભુજીં ।

લળી લળી ૫ભાંમણલાં લે ૬તાલ કિ,

પાતિ નર ૭દલેં રે-કિ પાતિં ॥૪॥

કર જોડીને શુણીયા સુપાસ કિ,

જિનવર સાતમે રે-કિ જિનં ।

માણિક કેા પ્રભુ પૂરે આશ કિ,

ભવિયાં નિત નમે રે-કિ ભવિં ॥૫॥



૧ હરણુ જેવીઆખોવળી, ૨ જેમ, ૩ છોકરીઓ, ૪ મૃદંગ-ટોલના તાલ, ૫ ઓવારણાં, ૬ તાલબદ્ધ પદ્ધતિસર, ૭ દૂર કરે,

(૧૧૨૨) (૪૭-૮) શ્રી ચંદ્રપ્રભ-જિન સ્તવન
(દાલ-સાહિબો તે ચાલઈ ચાકરીરે, સાહિબા અલખેલો એ-દેશી)

ચંદ્રપ્રભ જિન ચાકરી રે,

સાહિબા કરતાં કોડિ કલ્યાણ !-પ્રભુની ચાકરી રે ।

દેવ અદેવ સહુ કરે રે, સાહિબા !

સેવે ચતુર સુખણ-પ્રભુ ॥૧॥

કનક-કમલ ઠવી ચાલતાં રે સાહિબા !

જિહાં આપે જિનરાય-પ્રભુ ॥

છત્ર ધરે શિર ઉપરિ રે, સાહિબા ! ચામર ઢાલે વાય-પ્રભુ ॥૨॥

અહુ-સુગંધ જલ-છાંટણાં રે, કુસુમ-વૃષ્ટિ વરસંત;-પ્રભુ ॥

કૃષ્ણાગરનાં ધૂપણાં રે, સાહિબા !

સમોસરણે વિરચંત-પ્રભુ ॥૩॥

ચયણ-સિંઘાસણ બેસણાં રે,

સાહિબા ! જિહાં બેસે જગદીશ-પ્રભુ ॥

ઇંદ્ર કરે ઓવારણાં રે, સાહિબા ! ઈંદ્રાણી આસીસ-પ્રભુ ॥૪॥

અપચ્છરા આવી આગલે રે, સાહિબા ! ગાવિ સરલે સાદ-પ્રભુ ॥

નાટક નાચે નવ નવાં રે, સાહિબા !

વાજે દુંદભિ-નાદ.-પ્રભુ ॥૫॥

કોડિ ગમે તિહાં કિંકરુ રે, સાહિબા ! દેવ ખડા દરબાર; પ્રભુ ॥

દેઈ જિનેસર દેશનારે, સાહિબા !

નિસુણુઈ પરવદા બાર.-પ્રભુ ॥૬॥

ચોત્રીશ અતિશય શાહનારે,

સાહિબા ! વાણી ગુણ પાંત્રીશ-પ્રભુ ॥

કેવલ-કમલા શ્રીપતિરે, સાહિબા !

ત્રીન ભુવનનો ઈશ.-પ્રભુ ॥૭૧॥

તીર્થ'કર-ઋદ્ધિ લોગવે રે, સાહિબા !

પામ્યા અવિચલ ઠામ;-પ્રભુ ॥

માણિકુની પ્રભુ પૂરે રે સાહિબા !

સકલ આશા હિત કામ-પ્રભુ ॥૮૧॥



(૧૧૨૩) (૪૭-૯૪) શ્રી સુવિધિનાથ-જિન સ્તવન

(ઢાલ "હું" તો પાણિડાં ગઈતી રે હો વનમાલીડાં"

સુવિધિ-જિનસર સાચો રે, હો ! ભવિ પ્રાણીડા,

એ તો હીરલો જાચો રે, હો !

હરિહર મત રાચો રે, હો !

તે તો 'જેહવા કાચો રે-હો ! સુવિધિ ॥૧॥

રંગ રપતંગ તે કાચો રે-હો !

એ તો ચોલનો સાચો રે-હો !

પ્રભુના ગુણ વાંચો રે-હો !

પુણ્ય ભંડાર તે સાચો રે-હો ! સુવિધિ ॥૨॥

ઝસૂકે સહુ ખલ-ખાંચો રે-હો !

પૂજથી મન માંચો રે-હો !

આગઈ' નાટિક નાંચો રે-હો !

કરજોડી નઈ જાંચો રે-હો ! સુવિધિ ॥૩॥

૧. કાચ જેવા, ૨ હલદરનો, ૩ સહુ દુષ્ટ સંયોગો સૂકાઈ જાય,
(ત્રીજી ગાથાની પ્રથમની લીટીનો અર્થ)

પ્રભુ ! અવિચલ વાચો રે-હો !

દુરગતિનો ઉવાચો રે-હો ! !

કર્મનં નિકાચિત યતાચો રે, હો !

ભવકૃપથી ખાંચો રે-હો ! સુવિધિં ॥૪॥

અલ્પી ઉપગારી રે-હો, જગમે જયકારી રે-હો ! !

સુખ ઘો શિવગામી રે-હો !

માણિક કહિ હિતકામી રે-હો ! સુવિધિં ॥૫॥

(૧૧૨૪) (૪૭-૯આ) શ્રી સુવિધિનાથ-જિન સ્તવન

(હાલ—“ઊંચો ગઢ ગિરનારનો”—એ દેશી)

આજ સુવિધિ-જિન આગલઈ,

કરું ચોલગડી કર જોડી હો !

ઉભગી ચિંહુ ગતિ-ગમનથી,

મોરા કડિન કરમ-ખલ તોડી હો ! આજં ॥૧॥

મોહની કર્મે મોહીઓ, કરી મિથ્યા-મતિની^૧ ખોડિ-હો !

નરય-નિગોદમાં હું ભમ્યો,

ગમ્યો કાલ અનંત તે છોડિ હો ! આજં ॥૨॥

દશ દૃષ્ટાંતે દોહિલો, પામ્યો માનવ ભવ વિષ્ણુ^૨ પોડિ હો !

નર આરજ દેશમાં અવતર્યો,

ધર્યો જૈન-ધર્મનું સુજોડ હો-આજં-૥૩॥

દેખ્યો દરશણ તાહરો, હવે પૂરો મનનાં ઝકોડિ હો !

૪ દૂર કરો.

૧ ઘટાડો, ૨ ખોડ વિમાનો=સંપૂર્ણ ૩ ઉમંગ.

જોડિ ન આવી જોહનઈ,

વર હરિ-હઃ દેવની કોડિ હો ! આજઁ ॥૪૮॥
સમકિત-જ્યોતિ પ્રકાશરયું,

ધન^૪-પાપ-તમો-ભર તોડિ હો ! ।

તાન કલા ધન વાસીઈ,

બહુ મોહનો^૫ દલ મચકોડિ હો ! આજઁ ॥૫૦॥
પર ઉપગારી-શિરોમણિ, કરેં કવણુ તુમ હોડિ હો ! ।

માણિકે પ્રભુ-પદ-સેવના,

નિત માગઈ બિ કર જોડિ-હો ! આજઁ ॥૬૧॥



(૧૧૨૫) (૪૭-૧૦) શ્રી શીતલનાથ-જિન સ્તવન

(ઢાલ-હમીરીઆની-દેશી)

શીતલ સાહિબ ! તુઝ દેશના, શીતલ ચંદન^૧ પાહિ-જિણુંદા, ।
સાંભલતાં સુખ ઉપજે, ભવિઅણુના મન માંહિ-જિણુંદા !

-રહો રહો સેવક ચિત્તમેં ॥૧॥

સમતા રંધીયૂષ-૩સારિણી, વારણી મમતા જલ-જિં ।

ભવ-જલ-પાર ઉતારણી,

કારણી મંગલ માલ જિણુંદા ! રહો ॥૨॥

વિવિધ ભાવ અવતારણી, ધારણી અરથ અનંત-જિણુંદા !

વિનય-વિવેક-વધારણી,

વારણી દુરિત દુરંત-જિણુંદા !-રહો ॥૩॥

૪ ધણા પાપ રૂપ અંધકારનો સમૂહ ૫. સૈન્ય

૧ જેમ, ૨ અમૃત, ૩ નીક

૨૬

પાંચ-પ્રમાદ નિવારણી, દોરણી પુણ્ય પવિત્ર-જિણુંદા ! ।
દુરગતિ-દુઃખ-વિહારણી,

ઠોરણી સબજન-ચિત્ત જિણુંદા !-રહો ॥૪॥

અમૃત વાણી એહવી, ભાખી શ્રી ભગવંત-જિણુંદા !

માણિકે મુનિવર મન વસી,

વિમલ-શુભે કરી કંત-જિણુંદા-રહો ॥૫॥



(૧૧૨૬) (૪૭-૧૧) શ્રી શ્રેયાંસનાથ-જિન સ્તવન
(ઢાલ-હાડાની, દશમદિ હાડા મુને છંછાડિરે જોરાવર હાડા
એ-દેશી)

તું તો સમરથ શ્રેયાંસનાથ રે, જોગીસર જિનજી,
સિરણુઈ આયો તોરઈ હું સહી રે !

તું તો મુગતિપુરીનો સાથ રે-જોગીં

-હો સોભાગી જિનજી,

હો મન મોહન જિનજી !

જગજીવન જિનજી !

સમતાના રાગી,

મમતાના ત્યાગી,

એહવો ન દીઠો ખીજો ઠો નહી રે ॥૧॥

તું તો દીન-દયાલ સનાથ રે-જોગીં

કાં ન કરો રે ! ચિંતા માહરી રે ।

તુંને પ્રણમે સુસ્ત-નરનાથ રે,

જોગીં સોજાં મનં જગં સમં મમતાં

-સીસ વહેરે આણુ તાહરી રે ॥૨॥

તું તો સાંધ અ-નાથનો નાથ રે-જોગીં,
 આઠો ન ચાલું મેં તો નાથ સ્યું રે ।
 મુજને ભવ-જલ પડતાં બાંધ રે,
 જોગીં સોભાં મનં જગં સમં મમતાં
 -આડિ ન ધરો બહુ હાથસું રેં ॥૩॥

તું તો શરણાગત-સુલતાન રે-જોગીં,
 ચરણે માઈ કાં ન રાખો ! સામી આપણે રે ।
 તું તો ભગત-વચ્છલ ભગવાન રે,
 જોગીં સોભાં સમં જગં સમં મમતાં
 બૂંટો નિ ભલો પાલો તો પણિ રેં ॥૪॥

હું તો ભવ-ભવ તારો દાસ રે-જોગીં,
 કરુણા કરો રે દરિસણુ દીજીયં રે ।
 એ તો માણેક મુનિ અરદાસ રે,
 જોગીં સોભાં મનં જગં સમં મમતાં
 -સુણિને સોભાગી મુજરો લીજીયં રેં ॥૫॥

(૧૧૨૭)(૪૭-૧૨) શ્રી વાસુપૂજ્યસ્વામી-જિન સ્તવન
 (હાલ-સોના લોટા જલ ભર્યા ગુણુ માહરા રે-એ દેશો)
 વાસુપૂજ્ય જિન બારમા-પ્રભુ માહરા રે,
 હો સાહિબ ! ચિત્ત અવધાર-બહુ ગુણુ તાહરા રો
 સહસ પુરુષ જો ? હરિ સ્તવે-પ્રભું
 તો હઈ તુમ ગુણુ અ-સંખ અ-પાર-બહું ॥૧॥

જિમ રચણાયર-રચણનો-પ્રભું,
 કેણુ ગણિં કરઈ ^૩અવધાર-ખહું ।
 તો મૂરખ મતિહીણ હું-પ્રભું,
 તુમ ગુણનો પામું કિમ ! પાર ? ખહું ॥૨૧॥
 ધન્ય ચંપા નગરી જિહાં-પ્રભું,
 તુમ પંચ કલ્યાણક સાર-ખહું ।
 ધન વસુપૂજ્ય ઋવસુધા-ધણી-પ્રભું,
 જસ ઘર તુમ અવતાર-ખહું ॥૨૨॥
 ધન ધન માતા જ્યા સતી-પ્રભું,
 જેણુઈ જાયો જગ આધાર-ખહું ।
 તેહી જ ધન પદમાવતી સુંદરી-પ્રભું,
 જેહનો તું ભરતાર-ખહું ॥૨૩॥
 તુમ દરિશણુ જેણિ દેખીઉ-પ્રભું,
 અહો ધન ધન તે નરનારી-ખહું ।
 સેવક માણિક નિત નમઈ-પ્રભું,
 તુમ ચરણ-કમલ સુખકાર-ખહું ॥૨૪॥

★

(૧૧૨૮) (૪૭-૧૩) શ્રી વિમલનાથ-જિન સ્તવન
 (હાલ-મિત્રી રાજેલો-એ દેશી)

વિમલનાથ-મુખ-ચંદ્રલો રે,
 સોહિ અભિનવ-ચંદ્ર-મનકું મોહેણુ ।

૨ સમુદ્રના રત્નનો, ૩ ચોક્કસ નિર્ણય, ૪ રાજ

મોહે તે સુર-નર દેખીને રે,

૧સારે મોહ્યા ઇન્દ્ર-નરિંદ-દુખડું ખોહેછું ॥૧॥

નહી કલંક નહી ખોણતા રે, નહી રાહુ દુઃખ-દંદ-મન ॥

સકલ કલાઈ શોભતા રે, નહિ રવાસર હુંતી મંદ-દુઃખ ॥૨॥

વિમલ-પ્રભાઈ વિશ્વનો રે, કરતો ઇતિમિર-૪નિકંદ-મનડું ॥

ભવિજન-નયન-ચક્રોર ને રે, દેતો દતિ આનંદ-દુઃખ ॥૩॥

નયન અમી-રસ વરસતો રે, લસત સદા સુખકંદ-મન ॥

સખલ તાપન ધન-કર્મનો રે, હરતો તેહનો કંદ-દુઃખ ॥૪॥

ત્રિભુવન-ભાવ પ્રકાશતો રે, રમતો પરમાનંદ-મન ॥

માણેકે સુનિ કહઈ ભાવશું રે,

પ્રભુમું એહ જિણુંદ-દુઃખ ॥૫॥

(૧૧૨૯) (૪૭-૧૪) શ્રી અનંતનાથ-જિન સ્તવન

(હાલ-મથુરાની સેરી રે અતી રણીયામણી રે-એ દેશી)

પર-ઉપગારી રે પ્રભુજી પેખીઓ રે, દેવ અનંત-જિનરાજ ॥

અ-મલ અનંતા રે, ગુણ વયરાગરુ રે,

સમતાવંત શિરતાજ-પર ॥૧॥

તુમ સુર સેવઈ રે ચ્યાર નિકાયના રે,

અણ હુંતઈ એક કોડિ ॥

અપચ્છર નાચે રે નવ-નવ રંગસું રે,

નાટિક હોડા હોડિય-પર ॥૨॥

તુમ નિરલોભી રે, ત્રિભુવન રાણીઓ રે, મહિમાવંત મહંત ॥

૧ બધા, ૨ દિવસ, ૩ અંધારું, ૪ નાશ

તુજ વ્યવના રે જગહિત-કારણે રે,

અલવેસર અરિહંત-પરં ॥૩૧॥

પ્રભુ નિરમાયી રે ! કરુણા-સાગરુ રે, મહિર કરો મહારાજ ।

નજર નિહાલો રે સેવક આપણો રે,

ગિરુઆ ગરીબ-નિવાજ-પરં ॥૩૨॥

ઉત્તમ ન જુએ પાત્ર કુ-પાત્રને રે,

મેઘ તણી પરિ સ્વામિ ।

ઈમ મન આણી રે અનુગ્રહ કીજીઈ રે,

કહિ માણિક સિર નામિ-પરં ॥૩૩॥



(૧૧૩૦) (૪૭-૧૫) શ્રી ધર્મનાથ-જિન સ્તવન

(હાલ ધાએ ધાએ ગોગ ચહુઆણુ,

ધણ વાલ્યા લાછીતણાં-એ દેશી)

ધરમી પ્રાણી ધાય ધરમ-જિનેસર ધ્યાઈએ ।

ધ્યાતાં આણુંદ થાઈ, હરખિ જિન ગુણ ગાઈએ. ॥૧॥

પ્રહ ઉઠા પ્રભુ પાય, એક મન આરાધીઈએ ।

અશુભ ઉપાધિ મિટ જાય, મન વંછિત ફલ સાધીએં એ ॥૨॥

જપતાં જિનવર નામ વિષમ વિભોગ વિદારીઈએ ।

કરતાં પ્રભુ-ગુણ આમ, પાપ-સંતાપ નિવારીઈએ. ॥૩॥

પૂજતાં પરમ-કૃપાલ, શુચિ સુરપદ સિદ્ધિ લઈએ ।

આપઈ મંગલ માલ, ઋદ્ધિ સિદ્ધ નિધાનઈએ. ॥૪॥

માણિકમુનિ અરદાસ, સાહિબાણ ! ચિત ધરીઈ રે ।

કીજે સુમતિ પ્રકાશ, કુમતિ કદાચહ તારીઈએ. ॥૫॥



(૧૧૩૧) (૪૭-૧૬) શ્રી શાંતિનાથ-જિન સ્તવન

(ઢાલ-કાવની મેહલો નધં કાનજી રે,
રથું માગો છો દામ એ-દેશી)

શાંતિ જિનેસર સેવતાં રે રાજ ! ઘરમિં હુધં શુભ શાંતિ કે ।
ભાંતિ ભલી આરાધતા રે,
અતિહી ૧વ્યસન ઉપશાંતિ કિ-સહજ સલૂણા શાંતિજી રે ॥૧૪

ગજપુર નયર નરેસરુ રે, અચિરા માત મદહાર કિ ।
વિશ્વસેન નૃપ-કુલ-તિલો રે,
૨વિશ્વ-રમા-ભરતાર કિ-સહજ ॥૨૥

નયણ-કમલ-દલ સારિખાં રે, કેશર વરણી કાય કિ ।
મુખ મટકે મન માફં ઓરે.
સૂરતિ અજળ મુહાય કિ-સહજ ॥૩૥

મસ્તક મુગટ સોહામણો રે, કાને કુંડલ સાર કિ ।
કર કડલી રતને જડી રે,
ગલે મુગતાફલ-હાર કિ-સહજ ॥૪૥

જિનવર-ચક્રી સંપદા રે, ભોગવીને ભગવંત કે ।
મુગતિમાં ૪હેલે પધારીયો રે,
માણિકે મુનિ પ્રણમંત કે-સહજ ॥૫૥



૧ દુઃખ, ૨ સધળી લક્ષ્મી, ૩ તારા, ૪ જલદી

(૧૧૩૨) (૪૭-૧૭) શ્રી કુંથુનાથ-જિન સ્તવન

(ઢાલ-કો વાવી જર-બાજરી રે અમલિ ડાલીવા ભાંગ રે
અમલી અમલાં પઈ રંગ છોતરા રે-એ દેશી)

કુંથુ-જિનેસર ૧કામનો રે, પૂરો પરમ દયાલ રે-જિનજી ।
રાત-દિવસ રહું ધ્યાન માંહી રે,

છોડી આસ-જંગલ રે-જિનજી સુણો વિનતી રે ॥૧॥

૨વાર વડાની ચાકરી રે, અવસર આવઈ કામ રે-જિનજી ।
આપદથી જે ઉધરઈ રે,

આપઈ સંપદ કામ રેજિનજી ॥૨॥

ઉધરતાં પ્રભુ દાસને રે,

શ્યું તુમ્હ લાગઈ વિત્ત રે?-જિનજી ! ।

વાધે કીરતિ વિશ્વમે સહી રે,

હરખઈ સેવક ચિત્ત રે-જિનજી ॥૩॥

મહેર મોટાની ચાહીઈ રે, કરીઈ ઉત્તમ-સંગ રે-જિનજી ।

ચોલ મજીઠના જેહવો રે,

જેહનો અ-વિહડ રંગ રે-જિનજી ॥૪॥

સહસ અઠોત્તર સુંદર રે,

લક્ષણ શોભિત અંગ રે-જિનજી ! ।

રૂપઈ કામ હરાવતો રે,

સોવન ઓવાન ૪સુ-ચંગ રે-જિનજી ! ૦ ॥૫॥

૫હરિત-નિકંદન નેહસ્યું રે,

શ્રી-નંદન અવધાર રે-જિનજી ! ।

૧ ઉપયોગી, ૨ ચારી, ૪ કાંતિ, ૪ સારી સુંદર, ૫ પાપનો નાશ,

જગવંદન નિત વંદના રે,

માણિકુકી મનોહાર રે-જિનજી ॥૬॥

○

(૧૧૩૩) (૪૭-૧૮) શ્રી અરનાથ-જિન સ્તવન
(કિ રાયજી ! અમે નિ હિંદુઆણી રાજ-ગરાસીયા રે લોલ,

કિ માહરા લાલજી રે લો-એ દેશી.)

કિં સાહિબા ! ચિત્તમેં નંધં સંભારું,

રાહલા નામને લો ! કિં-માહરા નાયજી રે લો ।

કિં સાહિબા ! જિમ મનધં,

સંભારઈ સીતા રામને રે લો-કિં માહરાં

કિં સાહિબા ! અમે રતઈ સંભારી,

રાજ જિણેસરુ રે લો-કિં સાહિબાં ॥૧॥

કિં સાહિબા ! અલજો નંધં આંખડી,

પ્રભુજી પેખવા રે લો-કિં માહરાં ।

જિમ તિ ચકોર દેખતા રે લો !,

કિં માહરાં કિં સાહિબાં ॥ ૨ ॥

કિં સાહિબા ! અલગાં થકી મનડું ઉલસઈ રે લો-કિં માહરાં ।

મેહ-ઘટાસ્યું આતક જ્યું હસિ રે લો !

કિં માહરાં કિં સાહિબાં ॥ ૩ ॥

અંગઈ ઉમાહિ અતિહિ ભેટવા રે લો-કિં માહરાં ।

પૂજા કરીનંધં પાતક મિટવા રે લો !

કિં માહરાં કિં સાહિબાં ॥૪॥

૧ રાજ, ૨ તેમ.

કિં સાહિબા ! મહિર કરીનઇ,
 મુજરો માનીઇ રે લો-કિં માહરાં ।
 અરજ સુણીનઇ ઉરમંઇ આણીઇ રે લો !
 કિં માહરાં કિં સાહિબાં ॥૫૫॥

માત દેવીનો નંદન ગાવતાં રે લો !-કિં માહરાં ।
 સુખડાં પામીજે મનનઇ ભાવતાં રે લો !
 કિં માહરાં કિં સાહિબાં ॥૬૫॥

રાય મુદર્શન કુંઅર દીપતો રે લો ! કિં માહરાં ।
 કિં સાહિબા ! માણિક મુનિ સિર પર છાજતો રે લો !
 કિં માહરાં કિં સાહિબાં ॥૭૫॥



(૧૧૩૪) (૪૭-૧૮) શ્રી મલિનાથ-જિન સ્તવન
 (હાલ-સીરોહિઆ સેહરો હો કિ ઉપરિ જોધપુરી-એ દેશી)
 મલિલ-જિનેસર હો કિ, લવિયાં ભાવ ધરી,
 પ્રણુમો પરમેસર હો ! કિ મહન-ગતિ રંગહરી ।
 મન વંછિત પૂરિ-હો કિ આપદિ ઉધરી,
 દુઃખ-સંકટ ચૂરઈ હો કિ આપિ અવલલ ધસિરી ॥૧॥
 ઘસી કેસર ચંદન હો ! કિ કસ્તૂરી ય ખરી,
 અંખર મનરજન હો કિ માંહિ મલયાગિરી ।
 પચરચો કરી મજજન હો ! કિ કનક કચોલી ભરી,
 ભાવકિ લય-લંજન હો કિ, ચુણીઈ વિવિધ પરી ॥૨॥

૩ મનમાં, ૧ કામતી ગતિ, ૨ ગંભીર. ૩ શ્રેષ્ઠ, ૪ લક્ષ્મી, ૫
 વિવેચન કરો, ૬ પ્રક્ષાલ, ૭ જ મણુ,

કરી આરતી મંગલ હો ! કિ, દીપક હોડિ કરી,
 હરો અરતિ અમંગલ હો, કિ મંગલ લચ્છી વરી ।
 બહુ અગર કપૂરઈ હો ! કિ ધૂપ ન સાદરી,
 કરતાં તિહાં દૂરિ હો કિ-દુરગતિ જાય ડરી ॥૩૥
 જિમ જનમ-મહોત્સવ હો ! કિ, સુરગિરિ ઉપરિ,
 મલી દેવ ! નિ દાનવ હો ! કિ, પૂજઈ સકલ હરી ।
 તિમ એ જિન ચરચો, હો કિ-ભવ-જલરાશિ તરી,
 બહુ કરમ-દલ ખેરવી ! હો કિ વશઈ મુગરી ॥૪૥
 પંચમ-ગતિ-ગામી હો કિ-સ્વામી ચાકરી,
 કીજઈ સિર નામી હો ! કિ આલસ પરો ।
 માણિકમુનિ ભાવઈ હો ! કિ-ગાવઈ રંગભરી,
 સુખ સંપદ પાવઈ હો ! કિ ક્યાવિ દિવસ ધુરી ॥૫૥



૧૧૩૫) (૪૭-૨૦) શ્રી મુનિસુવ્રતસ્વામી-જિન સ્તવન
 (ઠાલ દેરાણી-જેઠાણી વાદ વાદી આપણ કુણજર વીશા
 વાળે રે કવણ જરીયા એ-દેશી)
 મુનિસુવ્રત-જિન નામ જપતાં,
 જનમ તણા ફલ લીજે રે ।
 પ્રાણીડા ! પર-ઉપગારી પર-હિત-કારી રે,
 પરમ-પુરુષ પ્રણમીજે રે-પ્રાણીડા ॥૧॥
 પરમ-પવિત્ર મુ-ચરિત્રઈ,
 જેહને ત્રિભુવન પાવન કીજે રે-પ્રાણીડા !

૮ ઈંદ્ર, ૯ સવારે,

રાય સુમિત્ર સુ-પુત્ર નમતાં,

જગ જશ-વાદ લહીજઈ રે-પ્રાણીડાં ॥૨॥

૧કામિત-પૂરણ કામગવી સમ,

સુર-સમુદાય સુણીજઈ રે-પ્રાણીડાં ! ।

વીશ ધનુષ-માનઈ તનુ-૨વાનઈ,

મરકત-મણિ હારીજઈ રે-પ્રાણીડાં ॥૩॥

ત્રીશ સહસ સંવચ્છર સુંદર,

જીવિત જાસ સુણીજઈ રે-પ્રાણીડાં ! ।

ઠગ્ગપ-લંછન જેને જે ઝનિલંછન,

નિરમલ ધ્યાન ધરીજઈ રે-પ્રાણીડાં ! ॥૪॥

અ-જરામર અ-ક્ષય અ-વિનાશી,

અ-કલ-સરૂપ લખીજઈ રે-પ્રાણીડાં ! ।

માણિક્ય મુનિ કહઈ પ્રભુ ગુણ માલા,

હૃદય-કમલ રાખીજઈ રે-પ્રાણીડાં ! ॥૫॥



(૧૧૩૬) (૪૭-૨૦) શ્રી નમિનાથ-જિન સ્તવન

(હાલ-કુણઈ વાવી ખોદાવી હો રાણી કવણ પાણીડા સંચરી
એ-દેશી)

નમિ જિન નયણ નિહાલિ હો !

પ્રભુજી ! ચાહ ધરી કરિ ચાકરી એ. ॥૧॥

ત્રિકરણ-શુદ્ધિ ત્રિકાલ હો ! પ્રભુજી !

ચાહ ધરી કરિ ચાકરી એ. ॥૧॥

૧ ઈચ્છા, ૨ રંગથી, ૩ દૂષણ વિનાના

પ્રભુમીજઈ નિશદીસ હો ! પ્રભુજી,

આણુ અખંડિત ધારીઈએ ।

કીજે તસ બગસીસ હો પ્રભુજી !,

લીમ લવોદધિ તારીઈએ. ॥૨॥

પામી તુમ દીદાર હો ! પ્રભુજી અવર ન સેવા ચાહિઈએ ।

કદપતર લહી સાર હો પ્રભુજી !,

ખાઉલ બાધિ ન ચાહિઈએ. ॥ ૩ ॥

ટેક ધરી રહિ જેહ હો ! પ્રભુજી !, સાચા સાહિબ શું સદાએ ।

પામી તે ગુણ-ગેહ હો,

પ્રભુજી ! સકલ-સમીક્ષિત-સંપદા એ. ॥૪॥

વિજય-નરેશર-જાત હો પ્રભુજી !, વિજયવંત સુકંકર એ ।

વપ્રા રાણી માત હો ! પ્રભુજી !,

માણિક્કમુનિ મંગલ-કરુએ. ॥૫॥



(૧૧૩૭) (૪૭-૨૨) શ્રી નેમિનાથ-જિન સ્તવન

હાલ-બાદરીયાની-બેટી કાગલ મોકલે જો-એ દેશી)

સૌરીપુરી નગર સોહામણું જો,

તિહાં સમુદ્રવિજય નૃપ સાર જો ।

શિવાદેવી રાણી તેહનઈ જો, રૂકી રંભા તણે ^૧આણુદાર જો-

નેમ નગીનો સુજનઈ વાલહો જો ॥૧॥

તાસ કૂખિ કમલ-હંસલો જો, અવતરોયા નેમ-કુમાર જો ।

બ્રહ્માચારી શિર-સેહરો જો, સત્વવંતમાં સિરદાર જો-નેમ ॥૨॥

૧ જેવી,

કેલિ કરંતાં જળમાં ગોપીઓએ,

૨કબુલાવ્યો પ્રભુ ઘરખાર જે,

ઉચ્ચસેન-રાય બેટડી જે,

કીએ તેસ્યું લગ્ન-વિચાર જે-નેમં ॥૩॥

જાન લેઈ ંસબ લઈ સાજશું હો !,

પ્રભુ ! આવ્યો તોરણ ખારજે ।

પશુઅ પોકાર મુણી ચાલીયા જે,

જિન લેઈ સંચમ-ભાર જે-નેમં ॥ ૪ ॥

રાજુલ રાણી પુંડિ સંચરી જે,

જઈ પોહતી ગઢ ગીરનારિ જે ।

મુગતિ-મહોલમેં મોઢલ્યાં જે,

પ્રભુ માણિક મોહનગાર જે-નેમં ॥૫॥

✽

(૧૧૩૮) (૪૭-૨૩) શ્રી પાર્શ્વનાથ-જિન સ્તવન

(ઠાલ-મોહ તો તે મુખા શહિર નો રે-એ દેશી)

પુરિસાદાણી પાસજી, પ્રભુ-પાય નમું નિત મેવા રે ।

પ્રત્યક્ષ પરચા પૂરણ, સુર-નાયક સારે સેવા રે-પુરિસાં ॥૧॥

પૂરવ-પુણ્ય પસાઉલો, તુમ દુરલભ દરિસણ દીકું રે ।

હીયડા-કુંપલ ઉલસ્યાં,

મુજ લોચન અમીઅ પમકું રે-પુરિસાં ॥૨॥

રોગ-શોગ-ચિંતા સહુ, દુઃખ ઘણિદ્ર સંકટ નીકું રે ।

૨ પરાણે-છલથી મનાવ્યો, ૩ ધણા,

ધતિ-ઉપદ્રવ આપદા ગઈ,

અ-શુભ કર્મ અતિ-ધીકું રે-પુરિસાં ॥૩॥

અમૃત-પાન થકી ભલૂં રે, પ્રભુ દરિસણુ લાગે મીકું રે ।

પુણ્યદશા પ્રગટી હવિં, પાતિક ચકચૂર પીકું રે-પુરિસાં ॥૪॥

વંછિત-કમલા મઈ વરી, એ તો પામી મંગલ-માલો રે ।

શંખેસર પ્રભુ ભેટતાં માણિક-રંગ રસાલો રે-પું ॥૫॥



(૧૧૩૯) (૪૭-૨૪) શ્રી મહાવીરસ્વામી-જિન સ્તવન

(ગારા મારા પાણીડા મળ તું પાલિષે તો રાણા ઉતર્યા
એ-દેશી)

પ્રભુ મારા પરમ-કૃપાલ, મહિર કરી મુઝરો લીઓ,

સમરથ દીન-દયાલ અરજ સુણી દરિસણુ દીઓ. ॥૧॥

રાય સિદ્ધારથ નંદ, મુખ દેખી આણુંદીઈ ।

ચરણુ-કમલ સુખ-કંદ, પેખીઈ પાપ નિકંદીઈ ॥૨॥

કેશરી-લાંછન બાસ, કેશર વરણુ વિરાજતો ।

મંગલ-લગ્ન-નિવાસ, સેવકને નિવાજઓ. ॥૩॥

ત્રિશલા-સુત વડવીર, ધીરગુણે સુરગિરિ જિસ્યો ।

જલનિધિ જિમ ગંભીર, મુનિ-જનને મનમેં વસ્યો ॥૪॥

સાંપ્રત-શાસન-ઈશ, ચરમ જિનેસર વાંદીઈ ।

શ્રીખમાવિજય બુધ શીસ,

કહિ માણિક ચિર નંદીઈ ॥ ૫ ॥

॥ ઈતિ સ્તવન-ચોવીશી સમાપ્ત ॥

॥ સં. ૧૭૬૬ વર્ષ આષાઢ સુદિ ૧૦ વાર સ્ત્રી

ગણી રૂપવિમલ લિખિતં ॥

શ્રીવર્દ્ધમાન-સ્વામિને નમઃ

પં. શ્રી દીપવિજયજી કૃત

જિન-સ્તવન ચૌવિશી

(૪૮)

(૧૧૪૦) (૪૮-૧) શ્રી ઋષભદેવ-જિન સ્તવન

(લીલાવંત કુંભર ભલો-એ દેશી)

શ્રી વજ્રનાભ મુનિ ભલો, સરવારથ સિદ્ધ અમંદ-મુષ્ટિંદ
સુર-મુખ ભોગવી ઉપનો,

વિનીતામે' પ્રથમ નરિંદ રે-મુષ્ટિંદ-
ઋષભદેવ પ્રભુ જગ-તિલો ॥૧॥

ઉત્તરાષાઢાર્ધ જનમીયા, ધનશશિ જગદાનંદ રે-મું ।
નકુલ જ્ઞેનિ માનવગણ,

મહી મંડલમે' મુખકંદ રે-મું ॥ ૨ ॥

દશ શત વર્ષ મુનિવ્રત, વિરમી ધન-કર્મના વૃંદ રે-મું ।
વડતરુ હેઠલ પામીયા,

વર કેવલજ્ઞાન-દિણુંદ રે-મું ઋં ॥૩॥

ધન-ધાતી-કર્મને ખેરવી,

દસ સહસ સંગે મુનિ ચંદ્રે-મું ।

સાદિ-અનંત પદને વર્ષા,

ટાલી સવિ ભવના ફંદ રે-મું ઋં ॥૪॥

અઢાર કોડાકોડી સાગરે, પ્રકાશક ધર્મ-જિણુંદ-મું ।

દીપ કહે ભવિ પૂજઈ,

સુખદાઈ પદ-અરવિંદ રે-મું ॥૫૫॥



(૧૧૪૧) (૪૮-૨) શ્રી અજિતનાથ-જિન સ્તવન

(સિદ્ધાચલ વંદો રે નરનારી એ દેશી)

અજિતજિન ! તેરી રે ખલીહારી !

ખલીહારી ! ખલીહારી-અજિત જિન૦ ।

છિનમેં મોહુ-કરમ-દલ જીવી,

નામ અ-જિત જયકારી-અજિત૦ ।

નામ જિસ્થા ગુણ અતિશય ધ્યારે,

ઇતિ-તતિ ઉપદ્રવ વારી-અજિત૦ ॥૧૧॥

વિમલ જીવ વર થાનક સેવી,

લહું વિજય-વિમાન સુખ ભારી-અજિત૦ ।

જગ અનુકંપા ધરી અયોજગા મેં,

થયો નરવર દેવ-અવતારી-અજિત૦ ॥૨॥

જનમ્યા રોહિણીએ વૃષરાશિ,

ત્રિભુવન-જનકે ઉપગારી-અજિત૦ ।

માનવગણ છાજેં અહિ જોનિ,

અડ-સહસ-લક્ષણ તન ધારી-અજિત૦ ॥૩॥

બાર વરસ છદ્મમય વિભુજી,

પાલી મોનપણે અ-વિકારી-અજિત૦ ।

સખતપણું તરુ હેઠલ પાથો,

નિરમલ કેવલ સુખકારી-અજિત૦ ॥૪॥

એક હજાર મુનીસર સંગે,

વરી નિરલંછન શિવ નારી-અજિત૦ ।

અઊઠ રાજ લોકંતરે દીપેં,

આતમ-શુણુ ઋદ્ધિ ભોગે સારી-અજિત૦ ॥૫॥



(૧૧૪૨) (૪૮-૩) શ્રી સંભવનાથ-જિન સ્તવન

(ટેકરી રહીરે સહેર તરુઅરકે મેદાન-એ દેશી)

સુવિહિત કારીરે શ્રી સંભવ જિનરાય,

સહજ સલુણો રે સાચો શિવ સુખદાય,

વિમલવાહન નામે મુનિરાય, શમ-સંવેગે ચિત્ત લગાય-

-વીસ થાનક સેવી નિરમાય ।

જિન નામ આંધ્યુ રે આતમ વીર્ય સહાય,

અંતિમ ત્રિકેરે સાતમે ગ્રેવેયકે થાય-

-^૧સુખમા ત્યાગી રે ચવી નરલોકમેં આય-સુવિ૦ ॥૧॥

ધર્યો સાવત્રીમાં અવતાર, મૃગશિરે જન્મ્યા જગદાધાર

રુપેં હરાયો રતિ રંભરતાર,

દેવગણુ જ્ઞેનિ રે અહિ થેનિ હરનાર,

મિથુન વરરાશિ રે ત્રિભુવન પ્રાણુ આધાર,

મેહનગારો રે જન-મન-રંજન હાર-સુવિ૦ ॥૨॥

^૧ સુખ સાલમી, ^૨ રતિનો ધર્મ=કામદેવ

અવધિ જ્ઞાને જોવે સુ-વિનીત,

ભોગ કરમ ખીણુ બાણી મીત ।

વરસીદાન જગત સુ-પ્રતીત,

અવસર જોઈ રે મલીયા સુરવર ૩૭૮ ।

નિયનિય સાધે રે દીક્ષા મહોચ્છવ રીત,

જિન ગુણુ ગાવે રે સુરનર-વધૂ એક ચિત્ત-સુવિં ॥૩૭॥

સંજમ લેઈ જિન વિચરંત, સમભાવેં રતિ-અરતિ ગણુંત ।

આર વરસ છદ્મસ્થ ધરંત,

ધ્યાનની શ્રેણી રે કર્મરિપુ પ્રજલંત ॥

સાલ વૃક્ષ હેઠે રે કેવલ-લચ્છી વરંત,

સહુ જીવ કેરા રે મનોગત ભાવ લહંત-સુવિં ॥૪૦॥

મુનિવર સહસ્ર સંઘાતે સ્વામ,

ચઢીયા સમેત શિખર શુભ ઠામ ।

જખેરવી ગોત્ર-કરમ તિમ નામ,

સિદ્ધિ ગતિ પામ્યા રે, અનંત-ચતુષ્ઠય તામ,

અ-જ અવિનાશી રે શિવ વાસી અભિરામ,

હીપ કહે પ્રાણી રે કરો જિન ભકિત ઉદામ-સુવિં ॥૪૧॥

(૧૧૪૩) (૪૮-૪) શ્રી અભિનંદન-જિન સ્તવન

(સયણાં થઈ જીરે એ-દેશી)

પરમ-નિરંજન પરમ-સનેહી, પરમ પુરુષ શિરતાજી જી રે ।

અનંત-કલાધર જ્ઞાન-દિવાકર, અભિનંદન જિન રાજ-

-સુગુણ જિન ભણ્યે જી રે.

ચોથા શ્રી અરિહંત, ભજી દૂષણ તણ્યે જી રે. ॥૧૧॥

ધર્મસિંહ જયંત વિમાને, થઈ સુર ચવી ઉછાહીજી રે ।

જગ-અનુકંપાયે જિન ભયા,

પુનર્વાસુ રિક્ષા માંહિ-સુગુણ ॥૧૨॥

નગરી અજોધ્યા રૂપ રાજેસર,

દેવગણ ભેષિ મોઝાર જી રે ।

મિથુન રાશિય હુ તપ અનુસરતા,

વિચર્યા વરસ અઢાર-સુગુણ ॥૧૩॥

ધ્યાન અનલ અંગીઠીયે ઘાતી, કર્મ દારણ પરબલજી રે ।

રાબદની તરૂ હેઠે પાયા,

વિમલ નાણુ સુ-વિશાલ-સુગુણ ॥૧૪॥

સહસ્ર સુનિશ્ચય પ્રભુજી વરીયા,

અવિનાશી વધૂ ન્યારીજી ।

દીપ કહે આતમ-સિદ્ધિ વિલસે,

સિદ્ધ ગતિને કરી ન્યારી-સુગુણ ॥૧૫॥



(૧૧૪૪) (૪૮-૫) શ્રી સુમતિનાથ-જિન સ્તવન

(રુડી ને રહીયાળી રે વાલા તારી વાંસળી રે-એ દેશી)

સુગુણ સોભાળી રે સુમતિ-જિણેસરૂ રે,

સોહે પ્રભુ ! તિન ભુવનનો નાથ ।

સમરથ જાચો શિવપુર સાથ,

પ્રભુ ! અલખેલો રે શરણાગત સહી રે-સુગુણુ ॥૧॥

મુનિ સુદર્શન જયંત વિમાન,

દેવ ભવ તણ ચવીયો અચાંન-

-જગ જયકારી રે અયોજાએ ઉપનો રે-સુગુણુ ॥૨॥

મધા સુ-નક્ષત્રે જન્મ્યો અરિહંત,

મૃગપતિ રાશિ અતિ ખલવંત ।

મૂષકની જોનિ રે રાક્ષસ ગણુ ભલો રે-સુગુણુ ॥૩॥

સંજમ વિનીતા વરી જગદીશ,

ઉગ્ર વિહારી થયા વરસ વીશ ।

પ્રિયંશુ તરુ હેઠે રે નાણુ પંચમ લહ્યું રે-સુગુણુ ॥૪॥

દશ શત સંજમીશ્યુ ભગવંત,

છેલ છખીલે કરી ભવ-અંત ।

શિવ-વધૂ સંગે રે, અભંગ કીડા કરે રે-સુગુણુ ॥૫॥

કરૂણા-સાગર ગરીબ-નીવાજ,

આપ-સમા કરે દેઈ શિવ-રાજ-

કહે દીપ સેવો રે સુમતિ મુહંકરૂ રે-સુગુણુ ॥૬॥



(૧૧૪૫) (૪૮-૬) શ્રી પદ્મપ્રભ-જિન સ્તવન
 (જિનપતિ ! પદ્મરાગ-સોહામણો રે,
 શુચિ સ્વયં પ્રભુ સુવિલાસ રે-જિનપતિ !)
 જલથી પદ્મ ન્યારો રહેં રે,
 વાલો મારો તિમ વિચરે ઘર વાસ રે-
 જિનપતિ ! ધિંગ ધણી રે ॥૧॥
 નવમા ઐવેયકથી ચંચો રે,
 સુરવર ધર્મ મિત્ર અણુગાર હો-જિન૦ ॥
 કૌશાંબી નગરી ધણી રે,
 જનમ્યો ચિત્રામે સુખકાર હો-જિન૦ ॥૨॥
 રાક્ષસ ગણ જ્ઞેનિ ધોરી રે,
 નિરૂપમ કન્યા રાશિ વડ ભાગ હો-જિન૦ ॥
 જગ-હિત-વચ્છલ કારણે રે,
 વરસીદાન દેઈ વીતરાગ હો-જિન૦ ॥૩॥
 ચાર મહાવ્રત ઉચરી રે,
 ખટ માસ ઉચ કરી વિહાર હો-જિન૦ ॥
 છત્રાલ તરૂવર હેઠલે રે,
 ઉદયો નાણુ અ-મલ દિનકાર હો-જિન૦ ॥૪॥
 ત્રિણુ અધિક શત આઠશ્યૂં રે,
 વરીયા નિર્વેદી પદ ધામ હો-જિન૦ ॥
 સાસય અનંત સુખ ભોગવે,
 સેવક દીપ કરેં ગુણુ ગ્રામ હો-જિન૦ ॥૫॥



(૧૧૪૬) (૪૮-૭) શ્રી સુપાર્શ્વનાથ-જિન સ્તવન
(લાલ પીયારીના સાહિબો રે-એ દેશો)

ત્રિભુવન-નાયક-શેહરોરે, અનુભવ રાગનો રંગ-લાલ ।

પરમ-સુગુણ નર સાહિબો રે,

આતમ-તત્ત્વનો સંગી-લાલ૦ ॥૧॥

શ્રીપુરિસોતમ સેવિયે' રે, શ્રી સુપાસ ઉમંગ-લાલ ।

ગુણી સેવ્યાં ગુણ સંપન્ને રે,

જિમ જલ ગંગ-પ્રસંગ-લાલ-શ્રી૦ ॥૨॥

સુંદર બાહુ ઋષિ છડે' રે, ઐવેયકે સુર થાય-લાલ ।

ચવી થયો ભૂપ વણારસી રે,

પ્રણમે' સુરપતિ પાય-લાલ-શ્રી૦ ॥૩॥

તુલા વિશાખાયે' જનમીયા રે, વૃષભ જોનિ સુ-વિલાસ ।

રાક્ષસ ગણ છદ્મસ્થમાં રે,

તપ તપીયા નવ માસ-લાલ-શ્રી૦ ॥૪॥

શિરીષ તરૂંએ કેવલ લહું રે, ચઉદ લવન સોહાવી-લાલ ।

પંચ-સયાં પરિવારશું રે.

મહાનંદ પદવી દીપાવી-લાલ-શ્રી૦ ॥૫॥



(૧૧૪૭) (૪૮-૮) શ્રી ચંદ્રપ્રભ-જિન સ્તવન
(સોના રુપાનું મારું બેડલું રે લો-એ દેશી)

શિવ તિલક પતિ વંદીયે' રે લો,

ત્રિવિધિ' શ્રી મુનિચંદ-મારા વાલા રે. લો ।

અંદ્ર વહન રક્ષીયામણું રે લો,

ભવિ-જન નયણાનંદ-મારા વાલા રે લો. ॥૧॥

ખલિહારી જાઉં નામની રે લો,

નામે કોડ કલ્યાણ-મારાં ।

છટ સંજ્ઞા ન મલે નામથી રે-લો,

નામે સફલ સુ-વિહાણ-મારાં ખલિં ॥૨॥

ખીજા વિમાન થકી ચવી રે લો,

દીહખાહુ નિર્ઞંથ-મારાં ।

અંદ્રપુરીમેં ઉપનો રે લો,

સાધવા મુગતિનો પંથ-મારાં ખલિં ॥૩॥

૧અલી અનુરાધાયે જ્યો રે લો,

દેવ ગણ જોનિ રમૃગરાજ-મારાં ।

મહાવ્રત ગ્રહી ત્રણ માસનું રે લો,

મૌન ગ્રહું શિરતાજ-મારાં ખલિં ॥૪॥

નાજ વૃક્ષે થયા કેવલી રે લો,

મુનિવર સાથે હજાર-મારાં ।

૧પરમાનંદ પહને વરી રે લો,

દીપાવી શિવ-નાર-મારાં ખલિં ॥૫॥



(૧૧૪૮) (૪૮-૯) શ્રી સુવિધિનાથ-જિન સ્તવન

(પ્યારા શરદ પૂનમની રાત,
રંગભર રમીયેં લેલાં રે-એ દેશી)

સુખકર પ્યારો સુવિધિ-જિણુંદ,
શાત સુધારસમેં લીનો રે ।

મુનિ-મન-માન-સરોવર-હંસ,
ગુણ-મુગતાફલશ્યૂં લીનો રે ॥૧॥

જુગબાહુ ધગ્યારમો સુરલોક,
તજી માનવ ભવ આઠરે રે ।

કાકંદી નગરી અવતાર, ધનરાશિ જગદીસરુ રે૦ ॥૨॥

શ્વાન જોનિ રાક્ષસ ગણુ સાર, મૂલ નક્ષત્રે જગધણી રે ।
લેઈ દીક્ષા વિચરીય મહી માંહિ,

અષ્ટ કરમ-રિપુને હણી રે ॥૩॥

મૌનપણું ધારી વરસ ચ્યાર, ધ્યાન શુકલ મન ભાવતા રે ।
મલ્લીતરૂ હેઠે વર જ્ઞાન,

પામીયું ગુણુ નર તારતા રે ॥ ૪ ॥

મોહન સહસ્ર મુનિ સંઘાત, સહજનનંદ-પદ પરણીયા રે ।
દીપે રમણીક શિવવર રાજ,

જોતિ અનંત સુખ ભાવીયા રે ॥૫॥



(૧૧૪૯) (૪૮-૧૦) શ્રી શીતલનાથ-જિન સ્તવન

(સખી મારી ગરબે રમવા આવો રે, રાણીઓ ટાલે
મલી રે લો-એ દેશી)

જગત જિનેસર અંતરજામી રે, જાની સુહંકરુ રે લો,
અલવેસર લાખીણો સ્વામી રે, ગુણ રચણાયરુ રે લો ।
પ્રાણેસર પ્રભુ ચેતન રામી રે, શીતલ જગધણી રે લો,
ચંદન ચંદ થકી અધિકેરી રે, શીતલતા ઘણી રે લો ॥૧॥
લકુ બાહુ પ્રાણુત સુરલોક રે, લોગવીને લીયો રે લો,
ભદ્રિલપુરમાંહિ અવતાર રે, કુલ દીપાવીયો રે લો ।
પૂરવાષાઠા માનવ ગણુ છાજે રે, વાનરની જ્ઞેનિ રે લો,
ધનરાશિ પ્રભુજીયેં નિવારી રે, ચિહું ગતિની જ્ઞેનિ રે લો ॥૨॥
જગ ગુરૂ પરણ્યા અતિ ઉછરંગે રે, સંજમ સુંદરી રે લો,
પ્યારો રમણુ કરેં તસ સંગે રે, મન મેલી કરી રે લો ।
ચરણ-કરણુ રચી ચિત્ર શાલી રે, ધ્યાન પલંગડી રે લો,
જુગતિ પ્રભુજી નિત્ય રઆરોગેં રે,

અનુભવ સુખડી રે લો ॥૩॥

વિચરતા ત્રીન વરસ વતીત રે, સુખ-સમાધિમાં રે લો,
ખેઠા પ્રીયંગુ તરુનેં હેઠે રે,

સુનિપતિ શુચિ ધ્યાનમાં રે લો ।

ભવન-દીપક સમ અતિ સુખકારી રે, અપૂરવ જે કહ્યું રે લો,
અનંત-પદાર્થ-પ્રકાશક તેહ રે,

નાણુ અ-ચલ લહ્યું રે લો ॥૪॥

૧ પલંગ, ૨ વાપરે

તવ મહી ચ્યાર નિકાયના દેવ રે, સરવસરણુ રચે રે લો,
 ગીત-સંગીત અનેક બળવે રે સુરરામા નચેં રે લો ।
 તારી તોન જગતના જીવ રે, મુગતિ પધારીયા રે લો,
 તપોધન સહસ તણેં પરિવારેં રે,
 દીપેં વધાવીયા રે લો. ॥૫૧॥



(૧૧૫૦) (૪૮-૧૧) શ્રી શ્રેયાંસનાથ-જિન સ્તવન
 (પરમાતમ પરમેસર-એ દેશી)

સમીહિત-ઠાયક સુરમણિ, શ્રી શ્રેયાંસ મહારાજ ।
 માહમાવંત મહંત અનંત-કલાનીલો,
 કરુણાવંત જિહાજ ॥૧૧॥

દિનન મુનિસર તપ તપી, અચ્યુત વિમાનથી તેહ ।
 સિંહપુરીનો નરિંદ ૧અ-મંદ, ચંદન સમો,
 પ્રગટ-પ્રભાવી ૨અ-છેહ. ॥૧૨॥

૩શ્રવણે ૪વિસંહર જનમીયા, મકર રાશિ ગણુ દેવ ।
 વાનર જોનિ જિણુદં દિણુદં જોગીસરુ,
 સુર-નરપતિ પ્રણુમેવ. ॥૧૩॥

શ્રી જિન સંવર આહરી, મૌન પણેં દોય માસ ।
 પાલી પ્રજાલી કુ-કર્મ તિંદુક-તર-હેઠલેં,
 ઉદયો જ્ઞાન પ્રકાશ. ॥૧૪॥

સહસ વાયંજમ ૫પરિકરેં, વરીયા પદ નિરવાણુ ।

૧ ઉત્તમ, ૨ અક્ષય, ૩ શ્રવણ નક્ષત્રમાં, ૪ પ્રભુજી, ૫ પરિવારસાથે

સાદિ-અનંત વિલસંત દીપે' શિવનગરમેં,

વરત્યા કેડ કલ્યાણ. ॥૫૧॥



(૧૦૫૧)(૪૮-૧૨) શ્રી વાસુપૂજ્યસ્વામી-જિન સ્તવન

(શીતલ જિન સહેજનંદી-એ દેશી)

વાસુપૂજ્ય ચિદાનંદકારી, ક્ષાયિક ભાવે' સુવિચારી ।

આતમ નિજ ઋદ્ધિ સમારી, પ્રભુ અ-લખ' રૂપ અવતારી,
સનેહી મિત ! જગત-ઉપગારી,

પ્રભુ ! મિથ્યા-મોહ નિવારી-સનેહી૦ ॥૧॥

ધંદ્રદત્ત જિતેન્દ્રિયવંત, પ્રાણુતે સુર ઉપજંત ।

ઢોગંદુક-સુખ વિલસંત,

^૧અ-વિનાશીની લક્ષિત કરંત-સનેહી૦ ॥૨॥

શિવરાહ વિચે' શુભ ઠામ, ચંપામાં કર્યો વિશ્રામ ।

કુંભ-શતલિષા અભિરામ,

અપ્રવ જ્ઞેનિચે જનમ્યા સ્વામ-સનેહી૦ ॥૩॥

ગણુ રાક્ષસ સંજમ પ્યારી, વરી શિવ-રામા-અધિકારી ।

મૌન એક વરસનું ધારી,

ઘાતી અ-શુભ કરમને વિદારી-સનેહી૦ ॥૪॥

વર પાડલે કેવલ પામી, પટસય પંચમ-ગતિગામી ।

સુખ વિલસેં અનંત-શુભ-ધામી,

શિવ-ગેહે' દીપે' વિસરામી-સનેહી૦ ॥૫॥



(૧૧૫૨) (૪૮-૧૩) શ્રી વિમલનાથ-જિનસ્તવન

(માલા કયાં છે રે-એ દેશી)

વિમલ જિણુંક શુકલ-પખધારી,

ઠહાલા મારા ! ઇન્દ્ર કિરણ સમ દીપે રે ।

કર્મ સ્યામલતા છંડીઈ રે, રુપેં અનંગને શુષે રે-

લાગેં જિન મનમેં ગમતો !

અનુલવ માંહિ મગન, ચિદાનંદ મેં રમતો. ॥૧૧॥

ગુણસુંદર તપ-અભ્યાસી, ઠહાલાં આઠમેં સુખના થોક રે ।

લોગવી કપિલપુર અવતરીયો,

શણ્ણગાર્યો નરલોક રે-લાગેં જિનં ॥૧૨॥

ઉત્તરા-ભાદ્રપદે જ્યવંતો,

ઠહાલાં માનવ ગણુ મીન રાશિ રે ।

છાગ જોનિ સોહે અરિહંત,

જગ જનનેં સુખ વરસી રે-લાગેં જિનં ॥૧૩॥

બાહ્ય-અભ્યંતર તપ અનુસરતા,

ઠહાલાં દોય વરસ મીન રાખી રે ।

કેવલ દર્શન-નાથુ સોહાવ્યો,

જંખૂ તરુ યેઈઅ શાખી રે-લાગેં જિનં ॥૧૪॥

૫૮ હજાર મુનિશું પરણ્યા,

ઠહાલાં મુગતિ સુંદરી વરરાજ રે ।

જ્યોતિ થેં જ્યોતિ અનોપમ દીપેં,

સાધ્યાં આતમ-કાજ રે-લાગેં જિનં ॥૧૫॥

૧ કેવલ જ્ઞાનનું વૃક્ષ

(૧૧૫૩) (૪૮-૧૪) શ્રી અનંતનાથ-જિન સ્તવન
(કયાના તે આઠ્યા બીડલાં મોતી વાલા રે ભમરજી-એદેશી)

અનંત કલાધર મોહના-અલભેલા રે જિનવરજી,

શ્રીઅનંત ભગવંત રે, મોહનગારો ખ્યારો રે, જિનવરજી ।

અનંત અનંત દોય સોહતાં, અલ૦ ।

દંસણુ-નાણુ વિલસંત-મોહન૦ ॥૧॥

માહેંદ્ર વીશયાનક ભજી-અલ૦,

પ્રાણુતેં ધર્યો દેવ રૂપ-મોહન૦ ।

ચવી અભેધ્યા રતિપતિ-અલ૦,

જીતી થયો વર જૂપ રે-મોહન૦ ॥૨॥

જનમ્યા રેવતી શિવ-ગતિ-અલ૦,

મીન રાશિ મુનિચંદ રે-મોહન૦ ।

ગય જોનિ જિનરાજની-અલ૦,

દેવ ગણુ સુખ-કંદ રે-મોહન૦ ॥૩॥

ત્રણુ વરસ છદ્મસ્થમાં-અલ૦,

ન દિયેં દેશના દાન રે-મોહન૦ ।

પીપલ પાઢપેં ઉપનં-અલ૦,

કેવલ રચણુ નિધાન રે-મોહન૦ ॥૪॥

સાત હજાર શું મુનિપતિ-અલ૦,

થયા રમણિક શિવ કંતરે-મોહન૦ ।

સુખજર દીયેં સિદ્ધિ મેં-અલ૦,

કરી સંસારનો અંતરે-મોહન૦ ॥૫॥



(૧૧૫૪) (૪૮-૧૫) શ્રી ધર્મનાથ-જિન સ્તવન

(આરજી નીંદડલી નયણાં ખીચ ઘોલ રહી-એ દેશી)

સજની ! ધર્મ-જિણેસર સોહતો,

પરમ-ધરમનું નિધાન હો-અ-કલ-સરૂપી ।

સજની ! સારથવાહુ શિવ-નગરનો,

ત્રિભુવન-તિલક સમાન હો-અ-કલ-સરૂપી-

-સજની ! ધર્મનાયક જિન વંદીયે. ॥૧॥

સજની ! વિજય-વિમાનથી આવીયો,

સિંહબાહુ અણુગાર હો-અકલં ।

સજની ! રતનપુરેં સુરમણિ થયો,

લીધો નર-અવતાર હો-અકલં સજનીં ધરમં ॥૨॥

સજની ! જિન જનમ્યા પુણ્ય રીખમે,

કર્કશશિ સિરદાર હો-અકલં ।

સજની ! દેવગણુ છાગજોનિ લહી,

વરતાવ્યો જયકાર હો-અકલં સજનીં ધરમં ॥૩॥

સજની ! દોય વરસ સંજમ ગ્રહી.

વિચર્યા દીન-દયાલ હો-અકલં ।

સજની ! દધિપણું હેઠલ કેવલી,

થયા કર્મ પ્રબલ હો-અકલં સજનીં ધરમં ॥૪॥

સજની ! આઠસેં મુનિ રાજશુ,

અ-વિનાશી-પદ લીધ હો-અકલં ।

સજની ! ધર્મ અનંત સુખ મેં ભલ્યા,

દીપાવી નિજ રીઢ હો-અકલં સજનીં ધરમં ॥૫॥



(૧૧૫૫) (૪૮-૧૬) શ્રી શાંતિનાથ-જિન સ્તવન

(રાધાજી કે કર ચઢ્યો રે,

કાનુડો ગોવાલ પ્રીત શામલીયારે-એ દેશી)

શાંતિનાથ ધર્મ-મનોહર રે,

શાંતિ-કરણ સુ-વિલાસ-મોહન શિવ-રસીયા રે ।

ધર્મચક્ર પ્રભાવથી રે, સર્વ-કલેશનો નાશ-મોહન ॥૧॥

ગર્ભાવાસમાંહિ થકાં રે, જગ વરતાવી શાંતિ-મોહન ॥

મેઘરથ પાંચમા અનુત્તર માંહે,

સુખ વિલસી ચવંત-મોહન ॥૨॥

હસ્તિનાગપુર વર તણો રે, થયો ચક્રી અરિહંત-મોહન ॥

૧અજ રાશિ ભરણી ભદ્રું રે,

માનવ ગણુ ગુણવંત-મોહન ॥૩॥

ગજ જોનિ સંજમ વર્યા રે,

જિનજી વરસને અંત-મોહન ॥

નંદી તરૂવર હેઠલેં રે, કેવલજ્ઞાન વરંત-મોહન ॥૪॥

પ્રભુ નવસેં પરિવાર શું રે, પામ્યા પદ નિર્વાણ-મોહન ॥

સિદ્ધ સભામાં દીપતો, તીન જગતનો ભાણુ-મોહન ॥૫॥



(૧૧૫૬) (૪૮-૧૭) શ્રી કુંથુનાથ-જિન સ્તવન

(જઈનેં કહેજયો મારા વાલાને રે-એ દેશી)

કુંથુ ક્યાલ-શિરામણિ-જયકારીજી રે,

માર ગુણેં અરિહંત, અતિશયવંત-મનોહારીજી ॥

પર-પુદ્ગલ-સુખને તણ-જય૦,

આતમ-સત્તા ભજંત, નહીં તસ અંત-મનો ॥૧૧॥

૩૫ી સુંદર આતમા-જય૦,

^૧લવ-સત્તમા સુર થાય, સુકૃત-પસાય-મનો ૧

ચયવી ગજપુરવર રાજવી-જય૦,

જનમ્યો હરખ ન માય-નમે ^૨હરિ પાય-મનો ॥૨૧॥

રાક્ષસગણ ઉકાતિંકા ^૪રીખે-જય૦,

વૃષ રાશિ જોનિ છાગ, કર્યો લય ત્યાગ-મનો ૬

^૫સુપરં સોલ વરસ લગે-જય૦,

મૌન ધયું ધરી રાગ, દે કમ ^૩માગ-મનો ॥૩૧॥

આતમ-જ્ઞાનની શ્રેણિશું-જય૦

ધ્યાનની તાલી લગાય, શ્રી જિનરાય-મનો ૧

^૭તિલક-તલે સૂરજ સમો-જય૦,

કેવલ જ્ઞાન ઉપાય, કમ ^૪ક્ષય થાય-મનો ॥૪૧॥

શૈલેશી-કરણું કરી-જય૦,

સહસ્ર મુનિવર સાથ, થયા શિવ નાથ-મનો ૧

દીપ કહે લવિ પૂજ્યે-જય૦,

આવો અ-નાથનો નાથ, શિવપુર-સાથ-મનો ॥૫૧॥



૧ અનુત્તર વિમાનમાં દેવ, ૨ ઈંદ્ર, ૩ કૃતિકા, ૪ નક્ષત્રમાં, ૫ સારી રીતે, ૬ રસ્તો, ૭ ગ્રાહનું નામ છે

(૧૧૫૭) (૪૮-૧૮) શ્રી અરનાથ-જિન સ્તવન

(કંતજી કામિની કાં તજી રે-એ દેશી)

શ્રી અરનાથ પ્રાણેશરુ રે, જીવ-જીવન જગમિત્ત ।

આતમ-ધ્યાનની લહેરમાં રે, રમણ કરે સુપવિત્ત-

-સુગુણ-શિરોમણિ સાહિબો રે ॥૧॥

સુદર્શન સ્વર્ગમાં રે, ભોગવી અમરની ઋદ્ધ ।

નાગપુરે આવી ઉપનોંરે, અરિહંત-રૂપી પ્રસિદ્ધ-સુગુણ ॥૨॥

૧મયગલ જોનિ વિશ્વંલરુ રે, સુ-વિલાસી ગણુ દેવ ।

જગ-હિત-વચ્છલ રેવતી રે,

મીન-રાશિ સુખમેવ-સુગુણ ॥ ૩ ॥

તિન વરસ છદ્મસ્થમાં રે, અવલંબી શુભ ધ્યાન ।

રહેવતરુ-ૐઅધ પામીયારે, નિરમલ કેવલ નાણુ-સુગુણ ॥૪॥

નામ-જોત્ર કર્મ ભોગવી રે, વરીયા અખય પદ સાર ।

સહસ્ર મુનિ શું દીપેં વિભુ રે,

શિવપુર-નગર-મોઝાર-સુગુણ ॥ ૫ ॥



(૧૧૫૮) (૪૮-૧૯) શ્રી મદિલનાથ-જિન સ્તવન

(જોધપુર જાજ્યો લાલ ઝરી લાવજ્યો જોધપરી રે,

જોધપૂર રાજનું જુનું ગામ રે

લાવો રંગ જોધપરી રે-એ દેશી)

મદિલ-જિણુંદ દયાલ રે, સેવો લાલ જોગીસરુ રે ।

પ્રાણુ-જીવન-પ્રતિપાલ રે, આછો રંગ જોગીસરુ રે ॥

૧. હાથી, ૨ જાડનું નામ છે, ૩. નાચે

પૂરવલવ ખટ મિત્ર સલૂણે, પ્રતિબોધ્યા તે રાજાન રે-

-આછોં મદિલં સેવોં પ્રાણું ॥ ૧ ॥

ધ્યાયક દાયક મોક્ષ સલૂણે, કરે-તવ આપ-સમાન રે ।

થયો જગે પવિત જયંત વિમાનેં,

નંદન દેવ રમણિક રે-આછોં ।

ત્યાંથી ચવીને રહ્યો મિથિલામેં, મુગતિ કરવા નણક રેં

-આછોં મદિલં સેવોં પ્રાણું ॥ ૨ ॥

અશ્વિની અશ્વ-જેની જિન જાયા,

દેવ-ગણુ સુર ગુણુ ગાય રે-આછોં ।

૧ અજરાશિ ૨ પદ કુંભ વિરાજેં સરસ ૩ પીયંશુદસમકાય-

-આછોં મદિલં સેવોં પ્રાણું ॥ ૩ ॥

સંજમ નારી કરી પ્રભુ ખ્યારી,

અહો રાત્રિ તસ ધ્યાન રે-આછોં ।

યોગ ટલેં અશોક તરું હેઠેં ઉદયો કેવલ-નાણુ રેં

-આછોં મદિલં સેવોં પ્રાણું ॥ ૪ ॥

સમવસરણુ ખેસી જિનરાજેં,

કેઈ તાર્યા નર નાર રે-આછોં ।

અ-વિચલ ધામ દીપેં અ-વિનાશી, પંચ સયાં-પરિવાર રે-

આછોં મદિલં સેવોં પ્રાણું ॥ ૫ ॥



૧ મેષ, ૨ જંતન, ૩ પ્રિયંશુની લત્તા જેવી લીલી કાયા

(૧૧૫૯)(૪૮-૨૦) શ્રી મુનિસુવ્રત-જિન સ્તવને
(માથે મહુકીને મહીયની ગારી તો-એ દેશી)

શ્રી મુનિસુવ્રત જિનવર સોહતો, સ્નાન અનંત દિવાકરુ-
-અંતરજામી ચતુર રે, લેંહરી રે મોહના ।

માયને સુવ્રત પાલવા થયો મન,

નામ ઠંચુ' તિમ સુંદર-અંતર૦ ॥ ૧ ॥

સિંહગિરિ અપરાજિત વિમાનમાં,

સુર-પદવી તે ભોગવી-અંતર૦ ।

ચવી થયો રાજગૃહીનો નરેશર,

સકલ ધરાને' સોહવી-અંતર૦ ॥ ૨ ॥

શ્રવણ નક્ષત્રે' જનમીયા જિનજી,

તિન લોક જયકારી રે-અંતર૦ ।

મકર રાશિ કપિ જોનિ વિરાજતા,

સુંદર-ગુણ-ગણ-ધારી રે-અંતર૦ ॥૩॥

કમ' નિજરવા, ધયુ' ચિત્તથુ,

મૌન તે માસ ઇંચાર રે-અંતર૦ ।

અંપક હેઠલ કેવલ મહોચ્છવ,

અમર કરે ધૌંકાર રે-અંતર૦ ॥ ૪ ॥

ધ્રુવ-પદ એક હજારશયુ' વરીયા,

તોડી અનાદિ જંજાલ રે-અંતર૦ ।

સિદ્ધ મંડલમાંહિ અ-વિચલ દીપે,

રંગ અ-લંગ રસાલ રે-અંતર૦ ॥ ૫ ॥

ૐ

(૧૧૬૦) (૪૮-૨૧) શ્રી નમિનાથ-જિન સ્તવન

(આજ મયા અલવેલા-એ દેશી)

શ્રી નમિરાજ રાજેસરુ રે-માણીગર અલખેલ ।

પ્રભુ ચિદાનંદ-ધન રૂપ રે-માણી૦ ।

શિવ-આકર્ષણ કારણે રે-માણી૦

ધર્મ ચરમ શરીર અનૂપ રે-માણી૦ ॥૧॥

કરે ચરણાં તુઝ સેવના રે-માણી૦

પ્રભુ આપે મુગતિનું દાન રે-માણી૦ ।

સુરતરુ કામિત પૂરવા રે-માણી૦

તુંહી નીચો પ્રગટ નિધાન રે-માણી૦ ॥ ૨ ॥

અ-દીણશત્રુ શૂર-શેહરો રે-માણી૦

અનુભવીને દશમે' સ્વર્ગ' રે-માણી૦ ।

ચવી આયો નરલોકમાં રે-માણી૦

પ્રભુ સાધવાને' અ-પવર્ગ' રે-માણી૦ ॥ ૩ ॥

જનમ લીયો મિથિલા પુરી રે-માણી૦

પ્રભુ અશ્વ જ્ઞેનિ વડવીર રે-માણી૦ ।

અશ્વિની મેષ રાશિ લલી રે-માણી૦

વર દેવ ગણ ગુણ-ગંભીર રે-માણી૦ ॥ ૪ ॥

નવ માસંતર કેવલી રે-માણી૦

થયા બકુલ તલે' નિરધાર રે-માણી૦ ।

વાસ કર્યો શિવ શહેરમાં રે-માણી૦

મુનિ દીપે' સાથે હજાર રે-માણી૦ ॥૫॥



(૧૧૬૧) (૪૮-૨૨) શ્રી નેમિનાથ-જિન સ્તવન

(મારી સઘં રે સમાણી રે એ દેશી)

નેમિ નવલદલ અંતરજમી,

શામલીયો સિરદાર રે-મન મોહન મેરે ।

ખાલ-ખદ્ધાચારી નિરંજન નીકો,

યાદવ કુલ શણુગાર રે-મન ॥૧॥

અપરાજિત વિમાનમાં હરખે,

મુનિ શંખ નામે સુખ લાયો રે-મન ॥

તે સુખ છંડી શોરીપુર આવી,

ચિત્રા નક્ષત્ર સોહાયો રે-મન ॥૨॥

સુંદર વ્યાઘ્ર જોનિ જિન જનમ્યા,

કન્યા રાશિ સુખદાય રે-મન ॥

રાક્ષસગણુ પરમાતમ કેરા કર્મ દુરંત લેદાય રે-મન ॥૩॥

મહાવ્રત આદરી આદ્યુ" મૌન, ચોપન વાસર ખાસ રે-મન ॥

વેતસ-તરૂ હેઠલ વર-નાણુ, પામ્યા પરમ-ઉલાસ-મન ॥૪॥

પાંચસે છત્રીશ મુનિગણુ સંગે, સિદ્ધમાં જયોત જગાવી-મન ॥

રૂપાતીત અનંત શુણુ દીપેં, એ અચરિજ કહાવી-મન ॥૫॥

★

(૧૧૬૨) (૪૮-૨૩) શ્રી પાર્શ્વનાથ-જિન સ્તવન

(જેશી બેટી રૂપેં આગલી બનડાજી-એ દેશી)

પ્રગટ પૂરેવા મન કામના જિનવરજી,

અ-વિહુડ કલ્પતરુનો છોડ ॥

અ-કલ-સરૂપી વિરાજે અલિનવ-દિનમણિ,

છે અધિકારી લાયક મોક્ષનો-જનન
 કુણુ કરે પુરિસાદાણી હોડ ? અકળનં ॥ ૧ ॥
 સુદર્શન દશમા કદપથી-જનનં
 ૧અ-નિમિષ આયો અવીનેં ઉદર-અકળનં ।
 કાશી વણારસીમાંહિ ઉપનો-જનનં,
 જનમ નક્ષત્ર વિશાખા સાર-અકળનં ॥ ૨ ॥
 રાક્ષસ ગણુ વાઘ જોનિ કહી-જનનં,
 તુલા રાશિ સોહં શ્રી વીતરાગ-અકળનં ।
 નવપદ્મવ રમણિક દેહડી,
 ૨હરીત લંછન ચરણે નાગ-અકળનં ॥ ૩ ॥
 ધરી અનુકંપા થઈ સંજમી-જનનં
 સાધ્યો ચોરાશી જોગારંભ-અકળનં ।
 ઉજ્જવલ ધ્યાન ઉધવતરુ હેઠલે-જનનં
 પામીયા કેવલ જ્ઞાન સુરંભ-અકળનં ॥૪॥
 રૂંધી જોગ ૪અલે-શ્રી પદ વર્યા-જનનં
 સાથેં તેત્રીશ મુનિ પરિવાર-અકળનં ।
 અ-ંયાખાધ અ-ક્ષય અ-ભંગ-જનનં
 દીપેં શિવ રામા શિષુગાર-અકળનં ॥૫॥



૧ દેવ, ૨ લીલો રંગ, ૩ આકૃતિ નામ છે, ૪ ઉત્તમ

(૧૧૬૩) (૪૮-૨૪) શ્રી મહાવીર-જિન સ્તવન

(તોરણથી રથ વાલીયા રે—એ દેશી)

ત્રિશલા-નંદન વંદિયે રે, સિદ્ધારથકુલ-અંદ-સલુણે !

દશમા કલ્પ થકી ચંચો રે,

નંદન નામેં મુણિંદ-સલુણે ! ત્રિશલાં ॥૧॥

ઉત્તરા કાલગુને જનમીયા રે, સેવે સુર-નર વૃંદ-સલુણેં ।

વૃષભ જોનિ સોહામણી રે,

માનવ ગણ નિ-સપંદ-સલુણે ! ત્રિશલાં ॥ ૨ ॥

કન્થા રાશિ લંછન હરી રે, હેમ-વરણ સુખકંદ-સલુણેં ।

બાર વરસ મન સંવરી રે,

વિરમી કર્મના કંદ-સલુણે ! ત્રિશલાં ॥૩॥

ઉદયો શાલિ-તરુ તલે રે, કેવલ જ્ઞાન દિણુંદ-સલુણેં ।

સુંદર-સુખ-વર-પદ્મથી રે,

પ્રસર્યો ગુણ-મકરંદ-સલુણે ! ત્રિશલાં ॥૪॥

સાગર સમ ગંભીરતારે, ધીરજેં મેરુ-ગિરિંદ-સલુણેં ।

સેવકને પ્રતિ પાલવા રે,

સાચો સુ-રમા-કંદ-સલુણે ! ત્રિશલાં ॥૫॥

દીપવિજય કવિ કૃષ્ણનો રે, કહે ટાલો ભવ-કંદ-સલુણેં ।

તુમ પદ-પદ્મની આકરી રે,

આપજ્યો વીર-જિણુંદ-સલુણે ! ત્રિશલાં ॥૬॥



શ્રી વર્ધમાનસ્વામિને નમઃ
શ્રી ધર્મકીર્તિગણીજી કૃત
જિનસ્તવન-ચોવીસી
(૪૯)

વિ. સં. ૧૧૭૪માં રચાયેલી આ ચોવીસીમાં નીચેના
ચોવીસ (૨૪) બોલોની કૂલ-ગૂંથણી થયેલી છે.

૧ અયવન સ્થાન	૧૩ દીક્ષાતપ
,, નગરી	૧૪ પારણાસ્થાન
૩ પિતા નામ	૧૫ કેવળજ્ઞાન
૪ માતા નામ	૧૬ કેવળજ્ઞાન વૃક્ષ
૫ જન્મ નક્ષત્ર	૧૭ ગણુધર સંખ્યા
૬ શરીર ઉંચાઈ	૧૮ સાધુ ,,
૭ લંછન	૧૯ સાધ્વી ,,
૮ રાશિ	૨૦ શ્રાવક ,,
૯ આયુષ્ય	૨૧ શ્રાવિકા ,,
૧૦ શરીરવર્ણ	૨૨ શાસનદેવ
૧૧ દીક્ષા	૨૩ શાસન દેવી
૧૨ અંતર	૨૪ સિદ્ધિસ્થાન

બેકે સ્તવનોમાં ઉપરની વાતો છંદ-રચનાની અનુકૂળતા
કે બીજા કારણે આડી-અવળી ગૂંથાઈ છે.

ઉપક્રમ

જીગવર શ્રી જિન-ચંદ્ર નમી, કવિયણ કેરી માય ।

ચઉવીસે જિનવર તણા બોલ કહું ધરી ભાવ. ॥૧॥

કહિશું બોલ સુહામણા, જિન પ્રતિ ચઉવીશ ।

આગમ-અરથ-વિચારથી, સુણજ્યો ધરો જગીશ. ॥૨॥

ચવણ-ઠાણ(૧) નગરી(૨) પિતા(૩) જણુણી(૪) ૧રિખ(૫)

૨પમાણ(૬) ।

૩અંક (૭) રાશિ (૮) જીવિઅ (૯) વરણ (૧૦) વય (૧૧)

૪અંતર (૧૨) તવ-માણ (૧૩) ॥૩॥

પારણ (૧૪) કેવલઠાણ (૧૫) તરુ (૧૬) ગણુહર

(૧૭) સાહુ મહંત (૧૮) ।

સાહુણી (૧૯) સાવય (૨૦) સાવિયા (૨૧) દેવ (૨૨) દેવી (૨૩)

ગુણવંત. ॥ ૪ ॥

સિદ્ધિઠાણ (૨૪) ચઉવીસમડ, ઇણિ પરિ જિન ચઉવીશ ।

સમકિત-નિરમલ કારણુઈ, સંથુણિય જગદીશ. ॥૫॥



(૧૧૬૪) (૪૯-૧) શ્રી ઋષભદેવ-જિન સ્તવન

(પ્રભુ પ્રણમું રે-ઠાળ)

જિન પહિલઉરે આદિ જિણિંદ વખાણિયઈ,

સરવાઈ રે (૧) નયરી વિનીતા જણીયઈ (૨) ।

૧ જન્મ નક્ષત્ર, ૨ શરીરની ઉંચાઈ, ૩ લંછન,

૪ બે તીર્થકર વચ્ચેનું આંતરં,

મરૂદેવા રે (૩) નાભિ ^૧ધરણી માતા (૪) ભલી,
 ધણુ રાશિ રે (૫) ઉત્તરખાઠા રરિખ વલી (૬) ॥૧॥
 વલી કાય ધણુ સર્ધ પંચ (૭) ચુલસી
 લખ પુન્વહં આઉચ (૮) ।
 દસ આઠ કોડાકોડી અચરે ધમ્મ મગ્ગુ પવત્તિય (૯) ।
 ઉસાકેત દીક્ષા (૧૦) છઠં તપ કરી (૧૧)
 ઘરિ સેયંસહ પારણઉ (૧૨)
 પુરિ પુરિમતાલર્ધ નાણુ પામ્યું,
 (૧૩) ૪ચેઈ તરૂવર વડ ભડચઉ (૧૪) ॥૧૫॥
 ચઉરાશી રે ગણુહર પ્રભુને ભાખિયા (૧૫)
 તિમ ચુલસી રે સહસ સાધુ સવિ દાખિયા (૧૬)
 વર સાહુણી રે, તિગ લખ (૧૭) સાવચ સુહ કરા ।
 તિગ લખારે સહસ પંચહિય વ્રતધરા (૧૮) ॥૧૮॥
 વ્રતધારી સાવિય સહસ ચઉપન લખપંચ સુહામણી,
 (૧૮) ચક્રકેસરી સુરી (૨૦)
 જખ ગોમુહ કરઈ સેવા જિનતણી (૨૧) ।
 સોવન્ન-વન્ન-^૫સવન્ન કાયા (૨૨)
 વસહ લંછણુ ગુણુ ભરી (૨૩)
 અઘ્ટાપદઈ પ્રભુ મુગતિ પહૂતા (૨૪)
 અડ કરમનઉ ખચ કરી ॥૧૯॥



૧ પત્ની, ૨ જન્મનક્ષત્ર ૩ અયોધ્યા, ૪ કેવળ જ્ઞાન વૃક્ષ, ૫ જેવી.

(૧૧૬૬) (૪૯-૨) શ્રી અજિતનાથ-જિન સ્તવન

હિવ ખીજઉ રે, અજિત જિણેસર સંથુણ્યે,

ચવી આયો રે, વિજય વિમાણુ થકી લણુઉ (૧)

અઉજાપુરી રે (૨) જિયસત્તુ રાજિયઉ (૩)

સિરિ વિજયા રે (૪) રોહિણી રિખઈ જનમિયઉ (૫) ॥૧૦॥

(૫) જનમિયઉ જિન વષ રાશિ (૬) લંછણુ

હથિ સેવઈ પાઉય (૭),

સય રસદ્વયઉ ધણુ તણુ (૮) બહુતરે લાખ પુવ્વહં

આઉય (૯) ।

લાખ કોડિ ઉપન્ના ૪અયર અંતર આદિ-અજિત

જિણુદુય (૧૦),

પહેમંગ (૧૧) દીક્ષા (૧૨) છઠ તપ કરી,

અયોધ્યા આણુંદુય (૧૩) ॥૧૧॥

સત્તવન્નઉ રે ચેધિય ઈતરુવર (૧૪)

ગણુહર પંચાણુ રે (૧૫) કેવલ સાકેતઈ વસુ (૧૬),

ઈગ લખારે સાહુ (૧૭) સાહુણી ધમ કહીતી,

સહી સહસ રે લખ તિગ (૧૮) ગહગટી

॥૧૨॥

સાવય દુન્નિ લખા સહસ અઠાણુ લલા (૧૯),

ઉનિવથંલ દત્તઈદિયઉ પારણુ સુખ પામ્યા નિરમલા (૨૦) ।

૧ નક્ષત્રમાં, ૨ સાડા ચારસો, ૩ પચાસ, ૪ સાગરોપમ, ૫ કંચન
વર્ણુ શરીર ૬ સપ્તપર્ણુ નામનું ઝાડ, ૭ અયોધ્યામાં, ૮ રાગઓમાં
સ્તંભસમાન=શ્રેષ્ઠ

પણ્યાલ સહસા પંચ લખા સાવિત્રી શુર સંપયા (૨૧)

મહ જફળ (૨૨) અજિત્યા દેવી સેવિત્ર (૨૩)

સિદ્ધ સંમેતઘ (૨૪) થયા ॥૧૩॥



(૧૧૬૭) (૪૯-૩) શ્રી સંભવનાથ-જિન સ્તવન
સાવત્રી રે નગરી (૧) સંભવ મગસિરઘં (૨)

સેષ્ટા ઉદરિરે (૩) ^૧ઉવરિમહિ તુમ અવતરઘં (૪),

હય અંકઘં રે (૫) મિહુષ્ટ રાસિ (૬) કંચણ તણું (૭)

પૂરવ લખ રે સાઠિ આઠ (૮) ચઉસય ધણું (૯) ॥૧૪॥

સિત્ર દેહ તીસઘ લાખ સાગર કોડિય ।

અંતર અજિત-સંભવ હં,

(૧૦) સેવઘં તિમુહ યે કર જોડિય (૧૧) ।

દો લક્ષ્મ સાહુ (૧૨) છત્તીસ સહસા સાહુણી તિગ લાખુ ય

(૧૩) હુગ લખ ત્ર્યાણું સહસ સદા (૧૪) સાલ તરવર

દાખુંએ (૧૫) ॥૧૫॥

દુર્ધ ઉત્તર રે ગણહર સય (૧૬) સાવત્રિઘં,

વય (૧૭) છઠઘં (૧૮) રે કેવલ વલી તિહાં

ભાવિઘં (૧૯) ।

છગ લક્ષ્મી રે, સહસ છત્તીસ મણોહરં,

વરસાવિત્ર રે ખારહ પ્રત ધરમુખ કઘં (૨૦) ॥૧૬॥

સુખ કરુ નિત દુરિયારિ દેવી કરઘં જાસુ પ્રશંસુય (૨૧)

વિજિતારિવાર જિતારિ નૃપતિ વિમલ કુલ અવતાંસુય (૨૨) ।

૧ નવમા ત્રેવેયકનું નામ, ઉવરિમ નામના વિમાનથી,

પારણ કરાયું એક ચિત્તહૂ સુરિંદ દનર્થ

સામિનર્થ (૨૩),

સંમેત શિખરર્થ મુગતિ પામી ચૈત્ર સુદિ પંચમી

દિનર્થ (૨૪) ॥૧૭॥



(૧૧૬૮) (૪૯-૪) શ્રી અભિનંદન-જિન સ્તવન

(ઠાલ-વીવાહલાની સાસણ દેવી અ પહની)

હિવ અભિનંદણ નયણ-આણુંદણ જયંત-વિમાણ

થકી ચવીય (૧),

અઉજા પુરી (૨) સંવર (૩) સિદ્ધતા તણુય (૪)

અંક વાનર (૫) કંચણ છવી સોહે ।

મિહુણ રાશિર્થ (૭) રિખ પુણુવંસુ (૮)

જીવિઅ લાખ પચાસ પૂરવ ૧ખટક ચ (૯)

સંભવ-શિવ અભિનંદણ સાગર

લાખ દસ કોડઅ અંતરઉય (૧૦),

અંતરઉ જિનતણુઅ ૨ઊઠ ધણુસય (૧૧)

અઉજા પુરી ચારિત્ત લિયઉ (૧૨),

છઠ તવ કરી નર્થ (૧૩) પુહવિ વિહરર્થ

ઇંદ્રદંતિ પારણ દિયઉ (૧૪)

સાકેત કેવલ લચ્છી પામી વિમલ તર સુહ અણિત્તિ (૧૫)

પદલવ-વિશાલ પિયાલ નામર્થ

ચૈત્ય તરુવર જાણિય (૧૬) ॥ ૧૨ ॥

૧ ખરેખર, ૨ સાડાત્રણશો

તિગ લખ સાહુ (૧૭) તથ છગ લખ સાહુણી

ઉપરિ સહસ તીસઈ અહીય (૧૮),

સાવય હુગ સહસ અડસીસહિઅ (૧૯)

ઈસર જફળ સેવઈ સહીય (૨૦) ।

સાવિઅ લખ પણ સહસ સગવીસય (૨૧)

જફિખણી કાલીઅ અતિ ભલીય (૨૨)

ગણહુર રસોલસહિય ઇગસય જાણિયઈ (૨૩)

મુગતિ સંમેતગિરિ સાંભલીય (૨૪)

સાંભલી દિન પ્રતિ ભગતિ જુગતઈ જગત નંદન વંદિયઈ

ચિરકાલના સ્ત્રિ પાપ નાશઈ સુખ સમાધઈ નંદિયઈ ।

સુરગિરિતાણી પરિ સુધીર જિનનઉધ્યાન લેહિઅ ડઈ ધરઈ

સુર સુખ પામી તેહ ધામી ભવ સમુદ લહે લઈ તરઈ ॥૧૩॥



(૧૧૬૯) (૪૯-૫) શ્રી સુમતિનાથ-જિન સ્તવન
અસિનંદણુ-સુમતિ જિણુ અંતરઉ કોડિ

લખ સાયર તવ હૂઅઉય (૧)

સિંહરાશઈ (૨) મઘા (૩) ચવિઅ જયંતથી (૪)

ગણહુર ઇગ સય સંજઅઉય ॥૫॥

કોશલા નયરિયઈ (૬) મેઘ (૭) ધરિ મંગલા (૮)

કૌંચ લાંછન પ્રભુ જનમિઅઉય (૯)

તિગ સય ધણુ તણુ (૧૦) ?અઉજિજવરણુ ગુણુ (૧૧)

તિહાંઈ ઠેવલ પામિય ઉય (૧૨);

પામિયઉ સંજમ એકભત્તધં (૧૩)

....મકરિ લોજન લીયધં (૧૪)

સાવિઆ લખ પંચ અહિઆ સોલ, સહસ સલાહિયધં (૧૫)

લખ ચત્તા પૂરવ આઉ (૧૬)

ચધં પિઅંગુ તરુવર સોહધં (૧૭)

સંમેત સિખરધં મોક્ષ પામ્યાઉ (૧૮)

હેમ રુચિ મન મોહધં (૧૯) ॥૧૪॥

“હુહા”

સાવય સહસ પકાસિઆ ઉપરિ દુગ લખ હોધં (૨૦)

સાહુણી લખ પાંચે કહી,

સહસ તીસ વલિ જોધં (૨૧) ॥૧૫॥

મુણિવર સહસા વીસ તહ તીનિ લાખ ગુણવંત (૨૨)

(૨૨) દેવી મહાકાલી ભલી (૨૩)

તુંખર જદ્ધખ મહંત (૨૪) ॥૧૬॥



(૧૧૭૦) (૪૯-૬) શ્રી પદ્મપ્રભ-જિનં સ્તવન

(આવ્યઉ તિહાં નરહર પહની ઢાલ)

પઉમપ્પહ ઠાઈસિય ધણું (૧) વિદ્દુમ કાય (૨)

કોશંખી પતિ ધર (૩) (૪) દેવી મુસીમા જાય (૫) ॥

ઉડુ ચિત્તા (૬) કન્તા (૭) કમલ અલંકિઆ ઢેહ (૮)

પૂરવ લખ તીસે જીવિઅમ ગુણુ ગેહ (૯)

ગુણુ ગેહ નવમ ગેવિજજહં ચવિયઉ

(૧૦) સોમદેવ આહાર (૧૧)

કેવલ પામ્યઉ કોસંખીયધ (૧૨) છઠ તપધ (૧૩)

વ્રત ભાર (૧૪),

સત્તોતર સય ગણુદર કહીયધ (૧૫)

તરૂ છતાહ વખાણુઉ (૧૬)

અંતર નવકોડિ સહ સાયર સુમતિ

પદમવિચિ જ્ઞાણુઉ (૧૭) ॥૧૭॥

ઉત્તમ મુણિ લખ તિગ સહસતીસ ગુણુ ધામ (૧૮),

સાહુણી લખ ચઉતિમ સહસ વીસ અભિરામ (૧૯)।

છહતર સહસાહિઅ સાવય દુગ લખ સંખ (૨૦),

સાવિઅ પણુ સહસાહિય, પણુ લખ ગય કંખ (૨૧) ।

ગય કંખ કુસુમ ભત્તિખર સેવધ અંજલિ જોડી (૨૨),

તિમ અચ્યુઅ દેવી જિણુ-પય-પંકજ પણુમધ

મચર છોડી (૨૩) ।

મુગતિ-રમણી સંમેતધ પામી (૨૪) જિણુ-શાસણિ શિણુગાર ।

ધરમકીરતિ ગણી એમ પયંપધ પણુમુ વારંવાર ॥૧૮॥



(૧૧૭૧) (૪૯-૭) શ્રી સુપાર્શ્વનાથ-જિન સ્તવના

હિવ રાત્રી સુપાસહ ધણુ દુગ-સયતણુ માણુ (૧),

મજ્જિમ ઉવરિમથી ચવિયઉ સુંદર નાણુ (૨)

જસુ પઈઠ નરેસર (૩) ધરણી પુહવી માત (૪)

તુત્રા રાશિ (૫) વિસાહા (૬) સત્થિઅ અંક વિખ્યાત (૭)

વિખ્યાત સુ-કોમલ કંચણુ કાયા (૮) પંચાણુ ગુણુધાર (૯)

વલી તિગ લક્ષ્મી સાહુ કહીને (૧૦) ખાણારસિ

અવતાર (૧૧)

તીસ સહસ સહિઅ લખ ચઉ સાહુણિ (૧૨)

સેવઈ જખખ માતંગ (૧૩)

વીસ લખ પૂરવ જીવિઅ (૧૪)

જિન આપઈ મુખ અભંગ. ॥૧૯॥

છઠ-તવિ (૧૫) કાશીયઈ ચરણ (૧૬) નાણુ મુપહાણુ (૧૭)

સાવય દુગલક્ષ્મી સહસ સત્તાવન માણુ (૧૮)

સાવિય ચઉ લક્ષ્મી ત્રાણુ સહસ ઉદાર (૧૯)

પારણિવશિ વૂઠી મહિંદ-દત્ત વસુધાર (૨૦)

વસુધાર સહસ કોડી નવ સાયર અંતર પઉમ-સુપાસ (૨૧)

સાંનિધિકારી શાંતા દેવી (૨૨) મહકઈ જગિ જસ વાસ

નામ શિરીષ મહા ચેઈઅ તરુ (૨૩)

સંમેતઈ સિધિ પામી, (૨૪)

સત્તામ સામી ઈણિ પરિ યુષ્ઠીયઈ

મો મનિ અંતરજામી. ॥૨૦॥



(૧૧૭૨) (૪૯-૮) શ્રી ચંદ્રપ્રભ-જિન સ્તવન

ચંદ્રપદ ચંદ્રપદ (૧) ગ્યાણુ ગણુધાર (૨),

સસિલંછન (૩) પૂરવ દસ લખ જીવિઅ સાર (૪) ।

વર સાવિઅ ચઉ લક્ષ્મ ઉપરિ સહસ ઈકાણુ (૫),

સાહુણી તિગ લક્ષ્મી સહસ અસીઈ વખાણુ (૬) ॥

વખાણું ચારિ તિઆ લખ ૧કુગ સહસ ૨પન્ન સંજીવ (૭),
 વૈજયંતથી ચવિયઉ સામી (૮) આણુરાધા નકખત્ત (૯) ॥
 ચંદ્રપુરી (૧૦) મહસેણુ નરાહિવ (૧૧) દેવી

લક્ષ્મણા નંદ (૧૨),

સોમદત્ત ઘરિ પારણુ હૂચઉ (૧૩) સુર-નર-મનિ

આણુંદ. ॥૨૧॥

દઉદસય ધણુ (૧૪) ઓસિય નિરુપમ-લકખણુ દેહ (૧૫),
 સેવઈ જવાલાસુરી (૧૬) વિજય જકખ સસનેહ (૧૭) ।
 તહ સાવય કુગ લખ ઉપરિ સહસ પંચાસ (૧૮),
 વૃશ્ચિક રાશિઈ (૧૯) પ્રણુ ગુણુ ગણુ મહિમા વાસ ॥
 મહિમા વાસ કરમ હણી જગણુ સંમેતઈ શિવપત્ત (૨૦),
 ચંદ્ર પુરીયઈ કેવલ પામ્યઉ (૨૧) છઠ તવઈ ચારિત્ત (૨૨) ।
 સિરિ સુપાસ ચંદ્રપહ અંતર, સાયર નવસય કોડી (૨૩),
 નાગ ચૈત્યતરૂ (૨૪) સોહઈ,

ચઉવિહ સુર પણુમઈ કરજોડી. ॥૨૨॥

(૧૧૭૩) (૪૯-૯) શ્રી સુવિધિનાથ-જિન સ્તવન

(હાલ ઉલાલાની-પરણી જરા કુમારી પહની)

સુવિધિ સુગીવહં નરવર (૧)

૧રામા ૨રામા માણિય સુખકર (૨)

જનમ નયરી કાકંદી (૩) આણુય કપ્પ આણુંદી (૪) ॥૨૩॥

૧ ખે, ૨ પચાશ, ૩ સફેદ, ૪ પચાશ,

૧ પત્ની, ૨ પ્રણુની માતાનું નામ,

અંક મકર પ્રભુ સોહઈ (૫) ઈંગસય ધણું તણુ મોહઈ (૬)
મૂલ રિખખ (૭) જિન તરુવર માલતી (૮)

સેવઈ સુરનર ॥૨૪॥

લખ હુઈ પૂરવ આય (૯) ધણુ રાશિઈ (૧૦)

સિઅજકાય (૧૧)

કોહિ અયર જિણાણું, ચંદ-સુવિહિ વિચિ જાણું ॥૨૫॥
છઠઈ (૧૩) કાકંદી વ્રતધર (૧૪) લખ હુઈ સાવય સુંદર ૧
ઉપરિ સહસ ગુણુ તીસ (૧૫),

હુગ લખ સાધુ જગીશ (૧૬) ॥૨૬॥

ચઉ લખ સહસિ પગહંતરી સાવિઅ (૧૭)

અજિતહ જખવર (૧૮) ૯

ગણુહર જાસુ અ અઠયાસી (૧૯)

પારણ પુસ્સઅ કાશી (૨૦) ॥૨૭॥

ઈંગ લખ સહસ વીસ સરા, સાહૂણી (૨૧)

દેવી સુતારા (૨૨)

પંચમ નાણુ કાકંદી (૨૩),

સુગતિ સંમેતિ આણુંદી (૨૪) ॥૨૮॥



(૧૧૭૪) (૪૯-૧૦) શ્રી શીતલનાથ-જિન સ્તવન

શીતલ શીતલ ચંદ, દદરહુ નરવર નંદ (૧)

પાણુચથી ચવિ આયઉ (૨),

લહિલ પુરી (૩) નંદા જાયઉ (૪) ॥૨૯॥

૧ ઉરુ-ગુગર્ધ સિરિવચ્છ (૫),

ભદ્રિલ નાણુ ૨ હંસ ચ્છ (૬) ।

ધણુ રાશિધ (૭) રિકખ પુન્વ (૮),

આઉચ ઇગ લખ પુન્વ (૯) ॥૩૦॥

વાવનિચો (ધણુ નેઉ) (૧૦) હેમ વરણુ (૧૧)

છઠ્ઠ (૧૨) ભદ્રિલ ચરણુ (૧૩) ।

ઈગસીધ જસુ ગણુહર (૧૪),

પ્રભુનંધ ઇગ લખ મુણિવર (૧૫) ॥૩૧॥

ઠપિલંખહ ચેઈબરુકખ (૧૬)

છ અહિચ સાહૂણી ઇગ લખ (૧૭) ।

ચઉ લખ સહસ અઠાવન,

સાવિચ (૧૮) ૪ પુણવસુ પારણુ (૧૯) ॥૩૨॥

અંતર નવ કોટી સાયર (૨૦), શીતલ-સુવિધિ ગુણાયર ।

હુગ લખ સહસ નિવ્યાશી, સાવય (૨૧)

ખંલ જખ લાસી (૨૨) ॥૩૩॥

સેવધ દેવી અશોગા (૨૩), સંમેતઈ શિવ-જોગા. (૨૪) ।

દશમઉ શીતલ જિણુવર, વંછિત પૂરણુ સુરતર જે ॥૩૪॥



૧ બંને આયલમાં, ૨ હંસ જેવું નિર્માળ, ૩ પલ્લ નામનું ઝાડ,
૪ પ્રથમ પારણું કરાવનારનું નામ,

(૧૧૭૫) (૪૯-૧૧) શ્રી શ્રેયાંસનાથ-જિન સ્તવન

(સામી સુહાકર શ્રી સેરીસ ખાહની ઢાલ)

શ્રી સેયંસહ અચ્યુત-કપ્પય (૧),

સીહપુર (૨) લંછણ ખગ્ગી પાય (૩) ।

પિઅ-માય વિણ્હુ (૪-૫) મયર-રાસિ (૬),

આઉય લખ સમ ચુલસી (૭) કંચન કાય એ (૮) ।

કાયા જેહનઈ ધનુષ અક્સી (૯),

છાહુત્તરિ ગણુધર હુઆ (૧૦) ।

સિંહપુરઈ પ્રભુ દિકખ (૧૧),

છઠઈ (૧૨) કેવલ નાણીઈ મુણિ જુઆ (૧૩) ।

ઇગ લખખા તીને સહસ સાહુણી (૧૪),

સાહૂ સહસ ચઉરાસિઆ (૧૫) ।

ચેઈઅ તિહુંગ (૧૬) નંદ પારણુ (૧૭),

સંમેત શિવ વાસી (૧૮) ॥૩૫॥

હુગ લખ સાવય સહસ ઇશુણસિઆ (૧૯),

ચઉ લખ સાવીયા સહસ અડતાલીઆ (૨૦) ।

ઈગ કોડિ સાયરૂ અંતર જાણિયઈ,

સહસ છવીસે છાસઠિ લખ ઉણીયઈ ।

ઉણીયઈસય અચર શીતલ-સેઅંસ (૨૧) સવણુ રિક્ખય (૨૨),

મન સુદ્ધિ સેવઈ પાય પંકય

મણુય સુરવર જક્ખય (૨૩) ।

સિરિ વચ્છ દેવી સામિ કેરી (૨૪) લાવ ધરી ગુણુ ગાવય,

ઈચારમઉ જિનરાજ સેવઈ તેહના હુઃખ જાવઈ ॥ ૩૬ ॥

(૧૧૭૬)(૪૯-૧૨) શ્રી વાસુપૂજ્યસ્વામી-જિન સ્તવન

વાસુપૂજ્ય પ્રાણુત ૧૪૬૫ (૧) ૨ પ્રસૂ જયા (૨),

વસુપૂજ્ય નરવર (૩) અરુણ વરણુ ૩૮૫૫ (૪) ।

સયલિષ રિખખહ (૫) સિરિ ચંપાપુરી જનમ (૬),

કેવલ પણિ (૭) સંજમ સિરિવરી ઉપવાસ ઈર્ધ (૮) ।

સુનંદ ઘરિ પારણુ કરધ (૧૦) ચેઈઅ પાડલ (૧૧),

છાસઠા ગણુહર (૧૨) ધણુહ સત્તરિ તણુ ધરધ (૧૩) ।

આઉઅ હુસત્તરિ લખખ વરસહ (૧૪),

સહસ બહતરિ સાહૂય (૧૫) ઈગ લાખ સાહૂણી,

દોષ ટાલધ (૧૬) આણુધરધ જિનનાહુ ય ॥૩૭॥

શ્રી સેયંસહ-વાસુપૂજ્ય આંતરઉ,

ચઉપન સાગર ૪મત કોઈ ૫પાંતરઉ (૧૭)

લંછન મહિષહ (૧૮) ભવિઅણુ મનિ ગમધ,

પવરા દેવી (૧૯) પ્રણુનઈ નિત નમઈ

નિત નમઈ જેહનઈ ચિત્ત ભાવઈ દેવ સુર કુમાર ય (૨૦)

હુગ લખખ સાવય સહસ પનરઈ (૨૧)

રાસિ કુંલ વિચાર ય (૨૨)

સાવિઆ સહસ છતીસ ચઉ લખ (૨૩) ચંપ પુરી

સિવ સંગ ય (૨૪)

જિણુ રાજના ગુણુગણુ પલણુઈ ધરમ કીરતિ રંગ ॥૩૮॥

★

૧ દેવલોક, ૨ માતા, ૩ ચામડી, ૪ નહી, ૫ અવિશ્વાસ કરો,

(૧૧૭૭) (૪૬-૧૩) શ્રી વિમલનાથ-જિન સ્તવન

(લઉ ચડીયઉ ઘણુ માણુ ગળે-એહની ઢાલ)

વિમલ-જિણેસર તેરમઉ એ, અઠમ સુર લોક સાર (૧),
તઉ કંપિલ પુરી (૨) શ્યામા ધરણી (૩)

કયવમ્મા ભરતાર (૪) ।

તનુ ધણુંહ સરિહ તણુંઉ પહા (૫)

પ્રભુ લંછણુ વારાહુ (૬) તઉ,
સાઠિ લાખ ^૧સમ આઉવ ઉ (૭)

અઠસઠિ સહસ સાહુ (૮) ॥૩૯॥

તઉ ^૨અચર તીસ અંતર કહિઅ વિમલ

અનંધ વાસુપુજજ (૯),

કંપિલલં છંછં (૧૦) ચરણુ (૧૧) જય કરિ

પારણુ ^૩હુજજ (૧૨) ।

તઉ ઉત્તર ભદ્રવ (૧૩) ^૪સરૂઢ વલી સહસ

અઠ લાખ હોઈ (૧૪),

લજ્જિઅગ સય, અઠ સાહુણીઅ (૧૫)

કંપિલલં નાણુ હોઈ (૧૬) ॥૪૦॥

તઉ કણુય કાય (૧૭) સાવિઅ સહસ ચઉવીસાંઉ લજ્જા (૧૮)

તઉ મીન રાશિ (૧૯) જંખૂ^૫વિહવિ (૨૦)

સેવઈ ^૬ખણુમુહ જદ્ધા (૨૧)

૧ વર્ષ, ૨ સાગરોપમ, ૩ થયું ૪ શ્રાવકો, ૫ વૃક્ષ, ૬ છ મુખ વાલો
પણુમુખ નામનો,

તઉ સત્તાવન પ્રભુ ગણુહરુય (૨૨) પણુ ત્યાં સીઝઈ કાજ,
 તઉ જ્યા દેવી (૨૩) વિમલ
 જિન સંમેતઈ શિવરાજ (૨૪) ॥૪૧॥



(૧૧૭૮) (૪૯-૧૪) શ્રી અનંતનાથ-જિન સ્તવન

તઉ અનંત નાહ પાણુ ય ચવિઅ (૧)
 ૨અઉજિઝ (૨) રાય સીહસેણુ (૩),
 તઉ સુજશા માત (૪) પંચાસ ધણુ (૫)
 મીન રાશિ (૬) ૩અંક ૪સેણુ (૭) ।
 તઉ વરસ તીસ લખ આઉ વર (૮) નવ સાયર પરિમાણુ,
 વિમલ-અણુત જિણુ વિચિ સહી (૯)
 પ્રભુ રિખ દેવઈ જાણુ (૧૦) ॥૪૨॥
 તઉ અઉજિઝ નાણુ (૧૧) વય (૧૨) છઠ તપિ (૧૩)
 (૧૩) વિજય ભિકખ (૧૪) હેમંગ (૧૫),
 તઉ ગણુહર પન્ના (૧૬) સાહુ તહ, બાસઠિ સહસ
 અલંગ (૧૭) ।
 તઉ પીંપલ તરુ (૧૮) સુરી અંકુશા (૧૯)
 અજજા બાસઠિ સહસ (૨૦) ।
 તઉ દુગ લખ સાવય છગ સહસ (૨૧)
 સંમેતઈ સિવ વાસ (૨૨) ॥૪૩॥

૧ દશમે દેવલોક, ૨ અયોધ્યામાં ૩ લંછન, ૪ રથેન સીંચાણાનું
 ૫ નક્ષત્ર,

કુંડા

ચ્યારિ લાખ સાવિચ અહિચ સહસ ચઉદ્દહ જાણુ (૨૩),
જખખ પાયાલહ (૨૪) અહનિસધ,
સીસ ધરધ જિન આણુ. ॥૪૪॥

★

(૧૧૭૯) (૪૯-૧૫) શ્રી ધર્મનાથ-જિન સ્તવન.
(જંખૂદીવ મઝા વિદેહની હાલ)

ધરમનાહ^૧પિચ ભાણુ (૧) માતા સુવયા (૨),
વિજય વિમાણુ થકી ચવીચ (૩) ।

રચણુ પુરધ ઉવચ (૪) છઠિ (૫) જન્મને (૬) કેવલ,
(૭) ધણુ^૪ ૪પણુ ચત્તા (૮) કંચણુ છવીચ (૯) ॥૪૫॥

ચ્યારિ અચર અનંત-ધરમ વિચાલધ (૧૦)
હસ લખ વરસાં આઉપચ (૧૧)

પવધર અંક (૧૨) રિખ (પુકખ) (૧૩)
હહિવણુતરવર (૧૪) તેયાલા ગણુધર નમઉ ચ (૧૫) ॥૪૬॥

ધરમસીહ આહાર (૧૬) દેવી પન્નતી (૧૭)
તિમ પણુમધ જક્ખ કિન્નરાચ (૧૮) ।

સહસ ચ્યારિ દુગ લખખ સાવચ જાણીયધ (૧૯)
કક^૨ રાશિ (૨૦) પ્રભુ ગણુધરા ચ ॥૪૭॥

ચઉસઠિ સહસ મુણિંદ (૨૧) સાવિચ ચઉ લખખ,
સહસ તેર ઉપરિ ધરીચ (૨૨) ।

સાહુણી સહસ ખાસઠિ, સાહિચ ચઉસચ (૨૩),
સંમેતધ શિવસિરિ વરીચ (૨૪) ॥૪૮॥

○

૧ પિતા, ૨ રત્નપુરીમાં, ૩ દીક્ષા, ૪ પિસ્તાલીશ, ૫ વજ્રનું.

(૧૧૮૦) (૪૯-૧૬) શ્રી શાંતિનાથ-જિન સ્તવન

શાંતિનાથ સંવદ્ધ ચવી કરી (૧) ગજપુરી (૨)

૧ અર્ધશિ (૩) ૨ વિસસેણ કુલિ ઉપજીય (૪) ।

આઉષકિ લખ વાસ (૫) છત્તીસ ગણાધિપ (૬)

ગરુડ જખખ (૭) ૪ ધજ હરિણુલય (૮) ॥૪૯॥

ભરણી રિખખઈ જન્મ (૯) છકઈ (૧૦) સંજમ (૧૧),

નાણાવટ્ટી (૧૨) ૫ ગજપુરિ લદ્યા ય,

સાહુણી સહસિગસકિ, છગ સય ઉપર (૧૩)

સહસ બાસઠા મુનિ કદ્યા ય ॥૫૦॥

નવઈ સહસ ઈગ લખખ સદ્ધ (૧૫)

તરુવર નંદી (૧૬) અજરાશિ નિરમલી ય । (૧૭)

તેણું સહસ તિઅ લખખ સાવિઅ (૧૮)

પારણુ સુમિત્ર (૧૯) સંમેતઈ સિદ્ધિ મિલીય (૨૦) ॥૫૧॥

દુહા

ધણુ ચાલીસ સુહામણુકિ (૨૧) કનકવરણી પ્રભુકાય (૨૨),

નિરવાણી દેવી સદા (૨૩) ગુણુ ગાવઈ નિરમાય ॥૫૨॥

ધમ્મ-સંતી જિણુ આંતરકિ, પદલતણા ચકિ ભાગ,

ઉણુ તિ-ભાગે અચરતિય (૨૪) જિનવચને ધરી રાગ ॥૫૩॥



૧ અચિરા, ૨ વિશ્વસેન, ૩ વર્ષ, ૪ લાંછન, ૫ હરિતનાપુર

(૧૧૮૧) (૪૯-૧૭) શ્રી કુંથુનાથ-જિન સ્તવન

(અહ પોસ પઠમ પખિ-એહની ઠાલ)

હિવ કુંથુ જિણેસર હથિણાઉરિ (૧) સુરરાય (૨)

સંવક વિમાણુહં (૩) વૃષ રાશિઈ (૪)

સિરિમાય (૫) ૧અજ ૨અંકહ (૬) છઠ તપિ (૭)

ગજપુરી સંજમ લીધ (૮),

સોવન તણું (૯) ગણુદર પૈતીસે સુપસિધ (૧૦) ॥૫૪॥

આઉઅ પંચાણું સહસ (૧૧) ૩તીસ પણ ૪માણ (૧૨)

પદ્મોવમ આધ ઉ સંતિ કુંથુ વિચિ જાણુ (૧૩)

તહ કંતિઅ રિખખહિં (૧૪) ગજપુરિ કેવલ-લાણુ (૧૫)

વગ્ધસીહ ધરિ પારણુ (૧૬)

૫એઈઅ તિલક પહાણુ (૧૭) ॥૫૫॥

છગ સય સાઠ સહસા સાહુણી (૧૮) સહસસદી સાહુ (૧૯)

સાવય તહ લખ ઇગ સહસ ગુણ્યાશી સનાહુ (૨૦)

લખ તીને સાવિઅ સહસ ઇકાસી (૨૧) જખખ ગંધવ (૨૨)

અચ્છુતા દેવી (૨૩) સંમેતઈ મુખખ (૨૪) ॥૫૬॥



(૧૧૮૨) (૪૯-૧૮) શ્રી અરનાથ-જિન સ્તવન

અરનાથ સુદંસણુ પિઅ (૧) તહ રાણી દેવી (૨),

મીન રાશઈ (૩) લાંછણુ નંદાવત્ત પયસેવી (૪) ।

હથિણાઉરિ જાણુઉ જન્મ (૪) નાણુ (૬) વલી દિક્ષખ (૭)

૧ બકરો. ૨ લાંછન, ૩ ત્રીશ અને પાંચ-૩૫ ૪ પ્રમાણુ (શરીરની ઉંચાઈનું) ૫ ચૈત્ય (કેવળજ્ઞાન) ૬ ક્ષ

સવિ સહસ્રા સાહુણી (૮)

સાહુ તિમ ^૧અથ લકખ (૯) ॥૫૭॥

તેતીસે ગણુહર (૧૦) તીસ ધણુ (૧૧) કણુયંગ (૧૨)

ચેઈ તરુ અંગગ (૧૩) અપરાજિત ધરી રંગ (૧૪)

રેવઈ રિક્ષ (૧૫) વરિસહ આઉઅ સહસ ચઉરાશી (૧૬)

છડિ સંજમ (૧૭)

લખ ઇંગ સાવય સહસ ચઉરાશી (૧૮) ॥૫૮॥

સિરિ કુંથુ-અરંતર કોડિ સહસ વાસ ઉણું,

પદલ ભાગ ચઉ તિહાં ભાગ એક વિચિ બાણું (૧૯)

સંવત્ય વિમાણુહં (૨૦) જઠ્રિખંદહ જિણુજકખ (૨૧)

ધરણી તહ દેવી (૨૨) સંમેતઈ શિવ સુકખ (૨૩) ॥૫૯॥

સાવિઅ લખખતિન્નિ અ સહસ ખિસત્તરિસા (૨૪)

તિત્યંકર અરજિન સેવઈ સુર નર વીર

તુમ્હ નામ ઈ પામઈ લખમી લીલ-વિલાસ,

ગણી ધરમ કીતી^૧ પ્રભુ પુરઈ મનની આસ. ॥૬૦॥



(૧૧૮૩) (૪૭-૧૯) શ્રી મલિનાથ-જિન સ્તવન

(વીર જિણુસંર ચરણુ કમલ-એહની હાલ)

મિથિલા નયરી અ (૧) કુંભરાય (૨) પ્રભાવતી રાણી (૩)

જ્યંત વિમાણુહં (૪) રાશિ મેષ (૫) લંછન કુંભ બાણી

(૬) પંચ વીસ ધણું (૭) તણુ અધિક મીલ (૮) જિન

રુકખ અસોગ (૯) મિહિલાયઈ સંજમ લીયઉ ય (૧૦)

૧ અર્ધોલાખ=પચાસ હમર

અકુમ તપ જોગ (૧૧) ॥૬૧॥

જીવિઅ ૧પણુવન સહસરવાસ (૧૨) વિસસેષુ આહાર (૧૩)
મિહિલા નયરી નાણુ ગેહે (૧૪) વીસ અડ ગણુહાર (૧૫)
અર-મદ્દા જિન અંતરઉ ય કોડિ સહસા વાસ (!)
મુનિ વર સહસા ચત્ત (૧૭)

તેમ રિખ અસ્સિણિ બસ (૧૮) ॥૬૨॥

સાહુણી સહસા પંચ (૧૯) સાવય ઈગ લાખ,
સહસતિઆસી ઉપરા ય (૨૦) સાવિઅ તિનિ લખખ ।
સત્તરિ સહસ (૨૧) કુખેર જખખ (૨૨) વધરૂકાદેવી (૨૩)
સિધિ પામી સંમેત સિહરિ (૨૪) પણુમું નિત મેવી. ॥૬૩॥

૧૧૮૪) (૪૯-૨૦) શ્રી મુનિસુવ્રતસ્વામી-જિન સ્તવન
(ઠાલ-ભમારુલીની)

મુનિ-સુવચ જિન વીસમઉ-તઉ ભમારુલી,
અપરાજિતથી ચવી (૧) ।

રાજગૃહી (૨) સુમિત્ર ધરિ (૩)-તઉ ભમારુલી,
પદમાવતી કૂખી આવિ, (૪) ॥૬૪॥

સવણુ રિકખ (૫) અકકાછવઉ (?) (૬) તઉ ભમારુલી,
મકર રાશિ (૭) ધણુ વીસ (૮)

સામ અંગ (૯) અઠારહુ ગણુહરુ (૧૦)-તઉ ભમારુલી,
વરરૂવ સહસ આઉતીસ (૧૧) ॥૬૫॥

૧ પંચાવન, ૨ વર્ષ

મદલી સુવય અંતરઉ-તઉ ભમારુલી,

ચઉપન વરસહુ લખખ (૧૨) ।

રાજગૃહી (૧૩) વય-નાથુ વલી (૧૪)-તઉ ભમારુલી,

છઠ તપિ (૧૫) અંપગ રુકખ (૧૬) ॥૬૬॥

ખંભદત-ધરિ પારણુક (૧૭)-તઉ ભમારુલી,

સાહુણી સહસ પંચાસ (૧૮) ।

તીસ સહસ વર સાધુજી (૧૯)-તઉ ભમારુલી,

જખખ વરૂણુ નિત પાસિ (૨૦) ॥૬૭॥

તિગ લખ સહસ પંચાશ સાવિઆ (૨૧)-તઉ ભમારુલી,

ખહુતરિ સહસ ઇગ લખ ।

સાવય (૨૩) દેવી અચ્છુતા (૨૩)-તઉ ભમારુલી,

સંમેતઇ શિવ દાખ. (૨૪) ॥૬૮॥



(૧૧૮૫) (૪૯-૨૧) શ્રી નમિનાથ-જિન સ્તવન

(ઢાલ-નણુદલની)

મિહિલા નચરી (૧) નમિ જયઉ વખા (૨)

વિજય (૩) માય તાત-હો ! જિણુવર ।

અજરાશઇ (૪) પ્રાણુત ચવી (૫),

નીલુપ્પલ અંક જાત (૬)-હો ! જિનવર ! મિહિલા ॥૬૯॥

કનક વરણુ (૭) પનરહુ ધણુ (૮),

દસ સહસા ૧સમ આય (૯) હો ! જિણુવર ! ।

છગ લખ વાસંતર કહ્યું,

સુવય નમિ જિણુરાય (૧૦) હો ! જિણુવર ! મિં ॥૭૦॥
અસ્સિણિ રિખખહ (૧૧) છઠ તપઈ (૧૨),

ગણુહર સતરહ સાર (૧૩)-હો ! જિણુવર !

ચરણુ (૧૪) નાણુ મિહિલા હુઅઉ (૧૫)

સહસ વીસ દીખધાર (૧૬)-હો ! જિણુવર ! મિહિલા ॥૭૧॥

બકુલ ચેઇઅ (૧૭) દિત્ત પારણુક (૧૮)

સાહુણી સહસ ઇંગતાલ (૧૯)-હો ! જિણુવર !

લખખગ સાવય સત્તરી સહસ (૨૦),

મિહિરિ રખપાલ (૨૧)-હો ! જિણુવર ! મિહિલા ॥૭૨॥

સાવિઅ સહસડતાલીયા,

ઉપરિ લખખા તીનિ (૨૨)-હો ! જિણુવર !

દેવીગંધારી જિન તણી (૨૩)

સંમેતઈ શિવ લીન (૨૪)-હો ! જિનવર ! મિહિલા ॥૭૩॥



(૧૧૮૬) (૪૯-૨૨) શ્રી નેમિનાથ-જિન સ્તવન

(વીરે વખાણી રાણી ચેલણાજી-એહની ઢાલ)

નેમિ અપરાજિતથી ચંચઉજી (૧) સમુદ્ર વિજય (૨)

શિવાદેવી (૩) રાશિ કન્યા (૪) રિખ ૧ચિત ભલીજી (૫)

શંખ લંછણ પય સેવી (૬)-નેમિં ॥૭૪॥

જીવિઅ સહસ ઈક વાસનુંજી (૭) ઈંગ દશ ગણુહર ચંગ (૮)

ધણુ દસ (૯) શામ તણુ અગમગે જી (૧૦) વરદત્ત પારણુ

રંગ (૧૧)-નેમિં ॥૭૫॥

૨ ખારવર્ધ વખ (૧૩) છઠ તપર્ધણ (૧૩)

વેતસ તરૂ (૧૪) મુનિમાલ ૧

સહસ અઠ દસ (૧૫) સુરી અંખિકાણ (૧૬),

ગોમેધ (૧૭) જિજ્ઞુ-રખવાલ-નેમિં ॥૭૬॥

નમિનાથ-નેમિનાથનંધ વિચર્ધણ,

લાખ વરસ પંચ બાણુ (૧૮) ૧

સહસ ચત્તા વળી સાહુણીણ (૧૯)

૫૩ જલગિરિ સિરિનાણુ (૨૦)-નેમિં ॥૭૭॥

જન્મ શૌરીપુરી (૨૧) સહસ છત્તીસ તિગ લખખા (૨૨) ૧

સાવય સહસ કશુણહત્તરાણ, લખ ઇંગ (૨૩)

ઉજલિ મુખ (૨૪) નેમિં ॥૭૮॥



(૧૧૮૭) (૪૯-૨૩) શ્રી પાર્શ્વનાથ-જિન સ્તવન

(દાસ-ચંદ્રાણુપુરની, અથવા જિણુ અતિસય કરિય કંઈ બાયણિ
એહની દાસ)

વાણારસીનયરી (૧) આસસેણા (૨),

વામા ઉઅરધ હંસ સમાણા (૩)

તુલરાસી (૪) અંક નાગો (૫)

પાણુય કપ્પ ચક્રી અવતરીયઉ (૬)

ખાણારસિ વય (૭) કેવલ વરીયકી (૮)

ધવ ચેઇઆ (૯) નીલજો (૧૦) ॥૭૯॥

૨ દારિકા, ૩ આઠ અને દશ મંત્રી ૧૮, ૪ ચાલીશ, ૫ ગિરનાર
પર્વત ૬ ઓગણ્યોતેર

રિખખ વિસાહા (૧૧) નવ કરા દેહો (૧૨),

અકુમ તપ સંજમ ગુણુ-ગેહો (૧૩)

આઉ સય વાસયકો (૧૪)

ધન ધરિ પારણુ (૧૫) દહ ગણુધાર (૧૬)

અનન અડતીસ સહસ અપાર (૧૭)

સહસ સોલ સાહુ છેકો (૧૮) ॥૮૦॥

નેમિ-પાસ વાસંતર વાત,

ત્યાસી સહસ સરૂઠ સય સાત (૧૮)

૧૫ઉમા (૨૦) રવામન જખખ (૨૧)

તિગ લખ સાવિઅ, ઇગ ચત સહસા (૨૨)

સાવય લખ ઇગ ચહિઠિ સહસા (૨૩)

સિહરિ સંમેતઈ મુખખ (૨૪) ॥૮૧॥



(૧૧૮૮) (૪૯-૨૪) શ્રી મહાવીરસ્વામી-જિન સ્તવન

(રાગ-ધન્યાસિરિ-ભરાઉલિ પુર મંડણ સામી સલહિયઈરી
એહની ઢાલ)

મહાવીરુ જિણુવર ચઉવીસમઉલ, તિસલા રાણી માત (૧) ।

જનમ્યઉલ જનમ્યઉલ સિદ્ધારથ કુલ

કલથ સિઉલ (૨) ॥૮૨॥

કન્યા રાશિઈ (૩) સિંહ લંછન (૪)

છઠ તપઈલ (૫) ખત્તિઅકુંડઈ ।

૧ પદ્માવતીદેવી, ૨ પાર્શ્વદેવ

જન્મ (૬) સંજમલીઈ (૭) સંજમલીઈ,
 કેવલસિરિ ઋગ્ગુવાલિઅ નદીજી (૮) ॥૮૩॥
 ગંગાણી ઇગ્યારહ (૯) બહુલધરિ પારણ કરઈજી (૧૦),
 ચેઈઅ તરુવર સાલ (૧૧) ।
 ચવદહજી, ચવદહજી, સહસ સાધુ સુહામણાજી (૧૨) ॥૮૪॥
 પાણ્ય દેવલોકિ (૧૩) ઉત્તર ક્ષગ્ગુણઈજી (૧૪),
 સોવન (૧૫) અંગ કર સાત (૧૬) ।
 સાહુણીજી, સાહુણીજી સહસ છતીસે
 ગુણનીલીજી. (૧૭) ॥૮૫॥
 પાસ વીર સરૂહ દુગસય શિવ અંતરઉજી (૧૮),
 ગુણસઠિ સહસિગ લખખ ।
 સાવયજી (૧૯) સાવયજી, સાવિઅ દુગુણી
 બાણીયઈજી (૨૦) ॥૮૬॥
 સિદ્ધા દેવી (૨૧) જફખ માતંગ મનોહરુ જી (૨૨),
 કહિયજી કહીયઈજી, રદુઈ સત્તરિ રસમ
 આઉવઉજી (૨૪) ॥૮૭॥
 સંવત ૪વેદ-૭મુનિ-૬રસ-રાજા (૧૬૭૪)
 વચ્છરઈજી, લાદ્રવઅ કુળજી પફિખ ।
 યુષ્ણિયાજી યુષ્ણિઆજી ૪કવિવારઈ
 પૂનિમ દિનઈજી. ॥ ૮૮ ॥

૧ ગણ, ૨ બે અને સીત્તર મળી બોતેર, ૩ વર્ષ ૪ શુક્રવાર,
 અ સ્તુતિ કરે,

ચઢવીસ ઠાણુઉ રંગઈ ઉધયુ'ઉજી ભવિઆણુ નઈ હિતકાણુ ।
 રાજઈજી રાજઈજી શ્રી જિનસિંહ સૂરીશનઈજી ॥૮૯॥
 જિનવર ચઢવીસે યોલે સફલ્યાણુ, જેસલમેરૂ મઝારિ ।
 હરખઈજી હરખઈજી ચવદહ ઠાલે ગાઈયાણુ. ॥૯૦॥



કલશ

ધર્મ સુખકારી વિધન વારી યોલ ચઢવીસે કરી,
 સાફલ્ય જિણુવર અધિક હરખઈ પાય પંકજ અણુસરી ।
 ગણી ધરમ કીરતિ કરઈ તવના થાઈજીયે સવિ સંપદા,
 અનુકેમઈ શિવ-સુક્રખ પામઈ જે ^૧તવઈ
 ભવિઆણુ મુદા ॥ ૯૧ ॥

ઈઅ રિસહ જિનવર પમુહ સુખકર સંથુણુયા

તિહુઅણુ-ધણી,

જુગ પ્રવર જિનચંદ્રસૂરિ

સફગુરુ ગચ્છ ખરતર દિનમણિ ।

ઉવઝાય ધરમ નિધાન ગણિવર કુમત-વારણુ-કેશરી,

તસુ સીસ પભણુઈ ધરમ કીરતિ

એક-ચિત્તઈ ગુણુ ધરી ॥૯૨॥

“ઈતિશ્રી ચઢવિશ-સ્થાન ગર્ભિત

ચતુર્વિંશતિ-જિન વૃદ્ધ સ્તવન સમાપ્ત ।

॥ શ્રી ધર્મ કીર્તિ ગણી શિખ્ય ।

શુભમરતુ કલ્યાણુ અસ્તુ શ્રી શ્રી શ્રી શ્રી ॥



શ્રીવર્દ્ધમાન-સ્વામિને નમઃ

પં. શ્રી સ્વરુપચંદ્ર કૃત

જિન-સ્તવન ચોવિશી

(૫૦)

(૧૧૮૯) (૫૦-૧) શ્રી ઋષભદેવ-જિન સ્તવન

(ખેડલે ભાર ઘણા છે રાજ, વાતાં કેમ કરો છા-એદેશી)

ઋષભ-જિણેસર દરિસણુ દીજે, મુઝ પર કરણુ કીજે ।

સેવકને મન વંછિત હેજે અ-જર-અ-મર પદ દીજે-

-વંછિત પૂરો રે સાહિબજી ! સેવકનો. ॥૧॥

તુઝ મુખ દરિસણુ મુઝ મન હરખ્યો,

મુઝને પ્રભુજી મલીઓ ।

શિવ-સુખ-વંછા-પૂરણુ માનો,

અંગણુ સુરતરૂ ફલિઓ-વંછિતં ॥૨॥

આદિ-પુરૂષ શ્રીઆદિ-જિણેસર, યુગલા-ધર્મ નિવારી ।

ત્રિભુવન માંહે જિનજી સરખો,

નહિ કોઇ ઉપગારી-વંછિતં ॥૩॥

વિનીતા નગરી શોભે રૂઢી, કુલકર નાભિ ખિરાજે ।

રાણી મરૂદેવી કૂખેથી,

જનમ પ્રભુજીનો છાજે-વંછિતં ॥ ૪ ॥

ચાવન-વય સમરથ ગુણુ-સંપદ, પ્રથમ રાય કહાયા ।

દાન સંવચ્છરી દેઈ જનને,

સંજમ લીએ સુખદાયી-વંછિતં ॥ ૫ ॥

લાખ ચોરાશી પૂરવ આયુ, પાલી સિધાબ્યા યુગતે ।

કેવલ-કમલા-લીલ-વિલાસી,

સ્વરૂપચંદ્ર-સુખ યુગતે-વંછિતં ॥૬॥



(૧૧૯૦) (૫૦-૨) શ્રી અજિતનાથ-જિન સ્તવન

(શ્રી પંચાસરો પાસજી રે લાલ-એ દેશી)

શુભ-ભાવે કરી સેવઈ રે લાલ,

ખીજ અજિત-જિણુંદ-ભવિ પૂજે રે ।

મંગલ-માલા જેહથી રે લાલ,

હોવે અતિ-આણુંદ-ભવિ પૂજે રે-

-વંદન માહરી જાણુજ્યો રે લાલ ॥૧॥

અયોધ્યાનગરી ભલી રે લાલ,

જિતશત્રુ નૃપ તાત-ભવિં ।

અજિત જિણુસર જનમીયા રે લાલ,

વિજયા રાણી માત-ભવિં વંદનં ॥૨॥

દક્ષિણ-વંશે ઓપતા રે લાલ, દેવ સકલ-સિરદાર-ભવિં ।

પૂરવ દિશે જીમ ભગીઓ રે લાલ,

દિનકર તેજ અપાર-ભવિં વંદનં ॥૩॥

દેવ દૂજે નહી એહવો રે લાલ,

સમોવડ ઇણે સંસાર-ભવિં ।

તસ પદ-લકિત ભક્તી પરેરે લાલ,

લાવ સહિત ચિત્ત ધાર-ભવિં વંદનં ॥૪૧॥

૧ લટ લાવથી ભમરી હુવે રે લાલ,

ભમરી-ભય સંભાર-ભવિં ।

મન સમરણ મહારાજનું રે લાલ,

કરતાં લહે ભવ પાર-ભવિં વંદનં ॥૪૨॥

જિનજીયં જિમ જીતીઆરે લાલ,

રાજ-રોષ રિપુ-સેન-ભવિં ।

જીતીયં તાસ સહાયથી રે લાલ,

લહિયં શિવ-સુખ-ચૈન-ભવિં વંદનં ॥૪૩॥

ધમ બાણી જિનરાજની રે લાલ, દ્રવ્ય-લાવ ભરપૂર-ભવિં ।

પૂજા પરમાતમ તણી રે લાલ,

આપે સુખ સ-રસનૂર-ભવિં વંદનં ॥૪૪॥

નિજ-પદ-દાયક જિન તણી રે લાલ,

ધારે અખંડિત આણુ-ભવિં ।

સ્વરૂપચંદ્ર ભાવે કરી રે લાલ,

એમ પયંપે ઠાણુ-ભવિં વંદનં ॥૪૫॥

ૐ

(૧૧૯૧) (૫૦-૩) શ્રી સંભવનાથ-જિન સ્તવન

(રાજા જો મિલે-એ દેશી)

સંભવ સુખકર ત્રીજા દેવ,

જેહની સુર-નર સારે સેવ-જિન વંદીય ।

૧ ધ્યેય. ૨ સંપૂર્ણ.

અંતરગત જિન દરસી દેવ,

જાણે જીવ તણા સવિ ^૧લેવ-જિન૦ ॥૧॥

શિવ-ગતિ સમરણ કીજે નિત,

સેના-સુત ધ્યાવે નિજ ચિત્ત-જિન૦ ।

અતિશય અરજિત વર્જિત પાપ,

સમતા ગુણ ટાલે ભવ-તાપ-જિન૦ ॥૨॥

ભવ-જલ-તારણ ભુવન-પ્રદીપ,

નેહશું રહઈ નિત્ય સમીપ-જિન૦ ।

ક્ષમા વિનય ઋણુતા સંતોષ,

ધારીને કીજે ગુણનો પોષ-જિન૦ ॥૩॥

તપ-સંજમ સત્ય શૌચ વિશેષ,

અ-કંચન બ્રહ્મચર્ય અશેષ-જિન૦ ।

પાલી દશવિધ-ધર્મનો સાથ,

ટાલી કર્મ તર્યો ભવ-રૂપાથ-જિન૦ ॥૪॥

પુત્ર જિતારિ પુત્ર ભવાંત,

પામ્યાં શિવ-રમણી સુખકાંત-જિન૦ ।

પુણ્ય પૂરા તે નરભવ લધ,

સ્વામી-ભજન કરી કરો શુદ્ધ-જિન૦ ॥૫॥

ધરમ અરથ કામ એ ત્રીન વર્ગ,

સાધનથી લહઈ અપવર્ગ-જિન૦ ।

સૌભાગ્યચંદ્ર મુનીન્દ્ર સુ-શીસ,

સ્વરૂપચંદ્ર નમે જગદીશ-જિન૦ ॥૬॥



(૧૧૯૨) (૫૦-૪) શ્રી અભિનંદનજિન સ્તવન
(દેશી છીડીની)

હિમવંત ગિરિ રસિરિ પદમદ્રહથી,

સુર રતટિની પ્રગટી છે ।

પૂરવ એક દિશિ પાવન કરતી, પૂરણ-જલ ઉમટી છે રે-
-ભવિકા ! જિનમુખ વાણી સુણજો !

તુમે ત્રિપદીનો વિસ્તાર ગણજો રે-ભવિકા ॥૧॥

ઝસુર-નદીએ દિશિ ત્રણ ઉવેખી, અભિનંદન જિન દેખી ।
ત્રિગટે મધ્ય-સિંહાસન પેખી,

ચિહ્ન દિશિ સરખી લેખી રે-ભવિ ॥૨॥

કંચન-તનુ હિમગિરિ મન આણો,

મુખ પદમદ્રહ જાણો રે ।

ચિહ્ન-મુખે તેહ દ્રહ તટથી વાણી,

ગંગા-પ્રવાહ વખાણો રે-ભવિકા ! જિન ॥૩॥

પૂર્વાદિ-દિશિ ક્રીધ પવિત્રા, કરવા વચન-વિલાસ ।

નય-ગમ-ભંગ-પ્રમાણ સ-કારણ,

હેતુ આરણ્ય ઉલ્લાસ રે-ભવિકા ! જિન ॥૪॥

ચઉ-ગતિ-વારણ્ય શિવ-સુખ-કારણ, જાણી સુર-નર તરિયા ।

ભાવ-કલૌલમાં સ્નાન રમણતાં,

કરતાં ભવ-જલ તરીઆરે-ભવિકા ! જિન ॥૫॥

તે જિન-વાણી અમીય-સમાંણી, પરમાનંદ-નિશાની ।

સૌભાગ્યચંદ્ર-વચનથી જાણી,

સ્વરૂપચંદ્ર મન આણી રે-ભવિકા ! જિન ॥૬॥



(૧૧૯૩) (૫૦-૫) શ્રી સુમતિનાથ-જિન સ્તવન

(શ્રી મોહના મોતી છા હમારા-એ દેશી)

અતુલ-બલ અરિહંત નમીજે,

મન-તનુ-વચન-વિકાર વમીજે ।

શ્રી જિન કેરી આણુ વહીજે,

તો મન-વંછિત સહેજે લીજે,

સેવીધ ભવિ સુમતિ-જિણુંદા

જે ટાલધં ભવ-ફંદા-સેવીધં ॥૧॥

અ-શુભાશ્રવનો સંગ ન કીજે,

સમકિત શુદ્ધ સુધારસ પીજે ।

અ-ભય-સુપાત્ર દાન દોય દીજે,

નિજ-શુરુની ભલી ભક્તિ વહીજે-સેવીધં ॥૨॥

સુમતિ-જિણેસર સુમતિ જો આપે,

જિન દરિશણથી દુરગતિ કાપે ।

નામ જપો અહોતર-શત જાપે,

મોહ-તિમિર હરે તપ-રવિ-તાપે-સેવીધં ॥૩॥

ત્રિકરણુ-શુદ્ધ નવ-વિધ નિર્દૂષણ,

એહીજ શીલ-સલીલ વિભૂષણ ।

સંશયથી નિત રહીધં લૂખા,

જખ લગે નભ અવગાહે પૂખા-સેવીધં ॥૪॥

ધર્મનું કામ તે ભાવશું કીજે,

શુરુ-સુખ વચન વિનય કરી લીજે ।

ભવ-સમુદ્ર તર્યે વાંછીજે,
 જડ ચેતન બિહું ભિન્ન લેખીજે-સેવીઈં ॥૫૫॥
 પંચમ-ગતિ-ગામી પ્રભુ-પાયા,
 સર્વી કારજ સિધ્યા દિલ ભાયા ।
 સૌભાગ્યચંદ્ર ગુરુ સુપસાયા,
 સ્વરુપચંદ્રે જિનના ગુણ ગાયા-સેવીઈં ॥૫૬॥



(૧૧૯૪) (૫૦-૬) શ્રી પદ્મપ્રભ-જિન સ્તવન
 (શ્રી શીતલજિન લેટીઓ-એ દેસી.)

શ્રી પદ્મપ્રભ જિનરાજજી, તનુ રકત-કમલ-સમ વાન-હો !
 જ્ઞાન અનંત સુ-જાણુતા,^૧

દગ્ધ કરુણા-ગેહ સમાન હો ! શ્રી પદ્મ ॥૧॥
 કેવલ દર્શન દેખીને, કહે' લોક-અલોકની વાત-હો !
 સમયાંતર ઉપયોગથી,

સાકાર-અનાકાર જાત-હો ! શ્રી પદ્મ ॥૨॥
 ભાવી-ભૂત-ભવિષ્યની, ભવિ આગલ કહે જગનાથ-હો !
 ચઉ-મુખે વાણી પ્રરુપતાં,

તારણ-કારણ રભવપાથ-હો ! શ્રી પદ્મ ॥૩॥
 પુષ્કર-મેઘ થકી ભલો, બોધિ-અંકુર રોપણુદાર-હો !
 શ્રદ્ધા ભાસન રમણુતા,

મૂલ કંઠ ખંડ નિરધાર-હો ! શ્રી પદ્મ ॥૪॥
 શમ-સંવેગ-નિરવેદતા, અનુકંપા અને આસ્તિક્ય-હો !

૧. દષ્ટિ ૨. ભયરૂપ અમુક.

શાખા ચાર અને લલો,

ઊર્ધ્વ શાખા તે વિડિમ અધિકા-હો ! શ્રી પદ્મ ૦ ૥૫૥
પત્ર-સંપત્તિ સુખ રૂપીઆ, સુર સુખ છે તેહમાં ફલ-હો ! ।
ફલ શિવ-સુખ પામે લવી,

જિહ્વાં અક્ષય-થિતિ અનુકૂલ-હો ! શ્રી પદ્મ ૦ ૥૬૥
ભાવ મેઘ બહુ ગુણે જાણીધં, જિન-વાણી સકલ મલ શોધ-હો ! ।
વાણી ભવ-નિસ્તારણી,

તે સુણી પામ્યો પ્રતિબોધ-હો ! શ્રી પદ્મ ૦ ૥૭૥
તે ઉપગારી ત્રિલોકને, આપેં અ-વિચલ સુખ-વાસ-હો ! ।
સૌભાગ્યચંદ્ર પસાયથી,

કહે સ્વરૂપચંદ્ર ગુણ ભ.સ-હો ! શ્રી પદ્મ ૦ ૥૮૥



(૧૧૯૫) (૫૦-૭) શ્રી સુપાર્શ્વનાથ-જિન સ્તવન

(દક્ષિણ દોહિલો હો રાજ-એ દેશી)

શ્રી જિન સાતમે રાજ ! સ્વામી સુપાસજી રાજ !,

તેહનો દરિસણ હો લહિધં પૂરણ-પુણ્યથી ।

પ્રભુ શુભ-ધ્યાની હો ! રાજ ! સમકિત દાની હો ! રાજ !,

શોભા અધિકી હો કહીધં સુર-નર અન્યથી ૥૧૥

જગત શિરોમણિ રાજ ! વાસ જિજ્ઞાસનો રાજ !,

નમીધં તેહને રેં શુદ્ધ ભાવિત લક્ષિતથી ।

જિન-પ્રતિમાનેં હો ! રાજ ! રૂપ-વિધાનેં હો રાજ !,

પૂજે-પ્રણમે હો ! ધ્યાવો શુભ વર યુક્તિથી ૥૨૥

વંછિત-ઠાજે હો ! રાજ ! સ્વામી નિવાજે' હો ! રાજ !,
 તે જિન આપે હો ! રૂડી શિવપુર-સંપદા ।
 જસ મુખ દીઠે હો ! રાજ ! પાતિક નિઠે હો ! રાજ !,
 નામે નાવે ! હો ! દરિદ્ર દોહગતા કદા ॥૩૧॥
 બાદ્ય-અભ્યંતર હો રાજ ! શુભ ગુણે શોભતા હો ! રાજ !,
 સહસ અઠોતર હો ઓપે' અનંત ગુણાકરા ।
 દોષ ન દીસે હો ! રાજ ! અઠાર અનેરા રાજ !,
 નિજ ગુણ નિરમલ હો ! ભાસે જેમ-નિશા કરા ॥૩૨॥
 નગરી બણારસી હો રાજ ! રયણે' ઉલ્લસી હો ! રાજ !,
 તિહાં પ્રભુ જનમ્યા હો ! સ્વામી નર-સુર-ઇંદના ।
 સૌભાગ્યચંદ્રનો રાજ ! સેવક બોલેછુ ! રાજ !,
 સ્વામી સાચા ! હો ! માનો સ્વરુપની વંદના ॥૩૩॥



(૧૧૯૬) (૫૦-૮) શ્રી ચંદ્રપ્રભ-જિન સ્તવન
 (દેશી આછેલાલની)

ચંદ્રપ્રભ જિનરાજ, મનમોહના માહારાજ-આછે લાલ !
 અતિશય-પતિ જિન આઠમોછુ ।
 સકલ-કુશલની વેલ તન મંગલ કેલ-આછે લાલ !
 વર પુષ્કર જલધર સમોછુ ॥૧॥
 દુરિત-તિમિર-વિધ્વંસ, નિરમલ ગયણે 'હંસ-આછે લાલ !
 જ્ઞાનાવરણ નિવારવાછુ,

સાગર કોડા કોડ, ત્રીસ વળી થિતિ જોડ-આછે લાલ !

ખચ કરી કેવલ ધારવાળ. ॥૨૧॥

સુરતરૂવર ઓપમાન, આપણુ મોક્ષ નિદાન-આછે લાલ !

નર-સુર સુખ અનુક્રમે લહીલુ ।

ભવ જલ સાયર તાર ! પોહોચાવણુ પરંપાર-આછે લાલ !

મુક્તિ-ગમન રૂપવહણુ સહીલુ. ॥૨૩॥

સુખ-સંપતિ ગુણ હેત, શશી-લંછન તનુ શ્વેત-આછે લાલ !

ચંદ્ર પ્રભ જિન જગતપતિ લુ ।

મન-તનુ-વચન એકત્વ, કરી ધ્યાને નિજ તત્વ-આછે લાલ !

જિમ પામ્યો પંચમ ગતિલુ. ॥૨૪॥

તાપ હરણુ જિમ ચંદ્ર,

જિમ તમ-હરણુ ઝહિણુંદ-આછે લાલ !

તિમ ભવહર જિન સંભવેલુ ।

સૌભાગ્યચંદ્ર ગુરુરાય, પામી તાસ પસાય-આછે લાલ !

સ્વરૂપચંદ્ર ઇમ વિનવેલુ. ॥૨૫॥

★

(૧૧૯૭) (૫૦-૯) શ્રી સુવિધિનાથ-જિન સ્તવન

(હવે ન જાઉં મહી વેચવા રે લો-એ દેશી)

સાહિબ સુવિધિ-જિણુંદની રે લો.

પૂજે ધરી મન ખંત શુભ ભાવથી રે-
—ચાલો જઈ એ જિન વંદવા રે લો ।

૨ વહાણુ, ૩ સર્પ,

ઉજમ આણી અંગમાં રે લોલ,
 આલસ મૂકો દિગંત-સુવિધિં ચાલોં ॥૧॥
 ચરણ પાવન થાઈ ચાલતાં રે લોલ,
 દરિસણે નયન પવિત્ર-સુવિધિં ।
 પંચાલિગમન સંભારીને રે લોલ,
 નિસીહિ-ત્રિકરણ વિચિત્ર-સુવિધિં ચાલોં ॥૨॥
 શિર નામી કરજોડીને રે લોલ,
 વંદન કરો ઇંક ચિત્ત-સુવિધિં ।
 દ્રવ્ય-ભાવ તવ સાચવી રે લોલ,
 શુદ્ધ કરો સમકિત-સુવિધિં ચાલોં ॥૩॥
 જિન-પ્રતિમા જિન સારખી રે લોલ,
 એહમાં નહિ સંદેહ-સુવિધિં ।
 તેહથી લકિત કર્યા થકી રે લોલ,
 લહિઈ સુખ અ-છેહ-સુવિધિં ચાલોં ॥૪॥
 શોભન વિધિ સુવિધિ પ્રભુ રે લોલ,
 મકર લંછન મહારાય-સુવિધિં ।
 દીજે સૌભાગ પદ સેવતાં રે લોલ,
 આત્મ સ્વરૂપ પસાય-સુવિધિં ચાલોં ॥૫॥



(૧૧૮૮) (૫૦-૧૦) શ્રી શીતલનાથ-જિન રતવન્

(ઘોડી તો આઈ થારા ફેસમાં મારુજી-એ દેશી)

શીતલ-જિનને સેવીયે ભવિ પ્રાણી,

૧તાથેં બહુત સુખ હોય હો-મન માન્યો,

જિણુંદ મેરે ! એહ ! હો ! સુખદાની,

બાર ભાંતકી નિજંરા ભવિ.

કરીકે રલવ-તોય હો-મન ॥૧॥

સાદિ-અનંત ભાંગે રહ્યો-ભવિં,

જયોતિમયી ગત-દેહ હો-મન ૧

કેવલ-યુગ સુખ-વીર્યનો-ભવિ,

અનંતપણાથી અ-છેહ હો-મન ॥૨॥

જિનકે વચન સખહી સુને-ભવિં,

ખીરોદધિ કે તરંગ હો-મન ૧

જયો પશ્ચિ ઘટ-જાલ લેઈકે-ભવિં,

રાખેં નિજ-ઘટ-સંગ હો-મન ॥૩॥

વરણા-વરણી જલ લયો-ભવિં,

સ્તવન ગ્રહે કોઈ નૂર હો-મન ૧

ત્યો વાણી જિન-સુખ વદી,-ભવિં,

ધારેં સખ મત ચોર હો-મન ॥૪॥

આપ-આપણા મત થાય કે-ભવિં,

ન્યારે-ન્યારે કહે લેઈ હો-મન ૧

૧. તેથી. ૨. સંસારરૂપ પાણી.

કરણી ન્યારી ખતાય કે-ભવિં,

નય ખટ ન્યારે વેઠ હો-મનં ॥૫૫॥

અધરેઈ છત સીધકો-ભવિં,

જો ભૂલે નગરકો પંથ હો-મનં ।

ત્યાહિમેં જીવહયા છંડી-ભવિં,

જો ખરનત નિશ્રંથ હો-મનં ॥૬૫॥

તાથેં જિન પદ પાછઈ-ભવિં,

દશમ જિણુંદ કે ભકત હો-મનં ।

સૌભાગ્યચંદ્ર દયા ભખેં-ભવિં

સ્વરૂપચંદ્ર સુખ-યુક્ત હો-મનં ॥૭૫॥



(૧૧૯૯) (૫૦-૧૧) શ્રી શ્રેયાંસનાથ-જિન સ્તવન

(હે! હલધરજી! હવે કેમ કરવું તેમ પરાક્રમ મોહું-એ દેશી)

હો! જિનવરજી! નિજ દરિશણ દેખાડી પ્રીત સુધારીઈ ।

તુમ કરસણ છે ભવ ભય હરણો,

આઠં કરમ જલધિ તારણ તરણો-

સંસારીને શિવ સુખ કરણો હો! જિનવરજી! નિજં ॥૧૫॥

મુનિ-શ્રાવક ધર્મ કુવિધ બાખ્યો,

તે ભવ્ય જનતા આગલ દાખ્યો ।

તેણેં મુજ વચનેં અમૃત ચાખ્યો-હો! જિનવરજી!

નિજવાણી સંભલાવી સમકિત આપીઈ ॥૨૫॥

જે હુતા તાપ તણા કારી, તે તેં તાર્યા બહુ નર-નારી,

તુઝસમ નહિ કોઈ ઉપગારો-હો ! જિનવરણ !

નિજ-કર અવલંબાવી તારક તારીઈ ॥૩॥
તું અધ્યાતમ-સૂરજ ઉદયો, તબ મોહાદિક-તમ દૂર ગયો,
ભવિ-મન-માંગ્યાં ન પ્રકાશ થયો-હો ! જિનવરણ !

મન ઉદયાચલ બેસી મિથ્યાત નિવારીઈ ॥૪॥
તુઝ વદન-કમલ દરિસણુ પ્યારો,

તહાં મન-મધુકર મોહ્યો માહરો,
ક્ષણ ધકિ તિહાંથી ન રહે' ન્યારો-હો ! જિનવરણ !

આલોકન નિત તેહનો મુઝને' હીજઈ ॥૫॥
ધરણેંદ્ર સહસ-મુખશુ' ભાખે,

તારા ગુણુ નિત નવલા દાખે',
તોઈ પાર ન લહે' ગુણુનો લેખો-હો ! જિનવરણ !

અનંત ગુણાત્મક ! તું સોડે' ગુણુ તાહરા. ॥૬॥
સૌભાગ્યચંદ્ર ગુરૂનો સીસ,

કહે સ્વરૂપચંદ્ર અહો ? જગદીશ !
શ્રેયાંસ પછો દીઓ મુ-જીશ-હો ! જિનવરણ !

નામ શ્રેયાંસ તુમારુ સમરુ' ધ્યાનમાં. ॥૭॥



(૧૨૦૦)(૫૦-૧૨) શ્રી વાસુપૂજ્યસ્વામી-જિન સ્તવન

(ધોળીરી બેટી તિપાહેને' નારોં પાણી લાગણો,
મારુડોરે હાં રે લોભાય-એ દેશી)

જિણુંદરાયા મુગુણુ મુખાકર મુંદરુ,

કેવલ જ્ઞાન ભંડાર-જિણુંદરો .

મોહ-અંધાર નિવારવા, સમરથ તું દિનકર હો-જિણુંદ૦
 વાસુપૂજ્ય મુઝ વાલહો, દહ-મન રહ્યો રે લોભાય ॥૧॥
 ધર્મ-ધુરંધર ધર્મ તું ભરત ક્ષેત્ર-મઝાર જિણુંદ૦ ।
 બોધિ બીજ વાવેં વચનશું,

ભવિ-મન-કયાશ ઉદાર-જિણુંદ૦ ॥૨॥

સુમતિ-સહસ્ર સહુ સમકિતી,
 પાલે નિજ મત સાર-જિણુંદ૦ ।

સંવર-વાડી ભલી કરે,
 રહે અપમત આચાર-જિણુંદ૦ ॥૩॥

આશ્રવ-શ્યાપદ વારતાં, ધારતા જિનવર આણુ-જિણુંદ૦ ।
 શીલ-સુધારસ સિંચતાં, લહે ચેતન ગુણુ-આણુ-જિણુંદ૦ ॥૪॥



(૧૨૦૧) (૫૦-૧૩) શ્રી વિમલનાથ-જિનસ્તવન
 (ઢાલ કુબલડાની-એ દેશી)

૧ વિમલ વિમલ રાજતા,
 બાહ્ય-અભ્યંતર ભેદ-જિણુંદ૦ જુહારીઈ ।
 સૂચીપૂલા દષ્ટાંતથી.

મન-વચ-કાય નિર્વેદ-જિણુંદ૦ જુહારીઈ ॥૧॥

૧ શ્રી વિમલનાથપ્રભુ બાહ્ય-અભ્યંતર બંને રીતે નિર્મળ શોભી રહ્યા
 છે. સૂચીપૂલા દષ્ટાંત એટલે ચઢતી ખીચડીની દોણીમાં એક દાણો સીંચ્યો
 કે કેમ? તે જોવાથી બધા સીંચ્યા ગણાય છે, તેમ વિમલનાથજીનો
 બાહ્ય શરીરનો કંચનવર્ણ નિર્મલ દીપ્તો હોય અંદરથી પણ પ્રભુજી
 વેદની મલિનતા રહિત જણાય છે. (પ્રથમ ગાથાનો અર્થ)

સ્પૃહ-બદ્ધ-નિધત્ત તે, નિકાચિત્ત અ-વિશેષ-જિણુંદ૦ ।

આત્મ-પ્રદેશ માંહે મિદ્યાં,

મલ્લ તે કર્મ-પ્રદેશ-જિણુંદ૦ ॥૨॥

અ-સંજય-પ્રદેશી ચિન્મયી, ચેતન-ગુણ સંભાર-જિણુંદ૦ ।

પ્રદેશે પ્રદેશે રમી રહી,

વર્ગણા કર્મ અ-પાર-જિણુંદ૦ ॥ ૩ ॥

રપંચ-રસાયણ-ભાવના-ભાવિત આત્મ-તત્ત્વ-જિણુંદ૦ ।

ઉપલતા છાંડી કનકતા પામે ઉત્તમ સત્ત્વ-જિણુંદ૦ ॥૪॥

પ્રથમ ભાવના શ્રુત તણી, બીજી તપ ભય સત્ત્વ-જિણુંદ૦ ।

તુરીય એકત્વ-ભાવના,

પંચમ ભાવ સુ-તત્ત્વ-જિણુંદ૦ ॥ ૫ ॥

છંમ કરી સર્વ પ્રદેશને રે, વિમલ ક્યાં જિનરાય-જિણુંદ૦ ।

નામ યથારથ વિચારીને,

નમેં સ્વરૂપ નિત પાય-જિણુંદ૦ ॥ ૬ ॥

★

(૧૨૦૨) (૫૦-૧૪) શ્રી અનંતનાથ-જિન સ્તવન

હાં રે ! લાલ ! ચતુર-શિરોમણિ-ચૌદમે,

જિનપતિ નામ અનંત-મેરે લાલ ।

ગુણ અનંત પરગટ કર્યા,

કર્યો વિ-ભાવનો અંત મેરે લાલ-

૨ રસાયણ જેવી શ્રુતઆદિ પાંચ ભાવના (જે પાંચમી ગાથામાં છે) ના બળે આત્મતત્ત્વ ઉત્તમતાને વરે છે, જેમકે રસાયણથી અન્ય ધાતુ પણ સોના રૂપે પરિણમે છે. (ચોથી ગાથાનો અર્થ).

-ચતુર-શિરોમણિ ચિત્ત ધર્યો. ॥૧॥

હાં રે! લાલ! ચાર અનંતા જેહનાં,

આતમ-ગુણ અભિરામ-મેરેં ।

જ્ઞાન-દર્શન-સુખ-વીર્યતા,

કર્મે કંઠ્યા ઠામ-મેરેં ચતુરં ॥ ૨ ॥

હાં રે! લાલ! ચતુર ધરો નિજ ચિત્તમાં,

એ જિનવરતું ધ્યાન-મેરેં ।

અરથી અર્થ નિવાસનેં,

સેવે ધરી બહુ માન-મેરેં ચતુરં ॥૩॥

હાં રે! લાલ! જ્ઞાનાવરણી ક્ષય કરી,

લહ્યું અનંત-જ્ઞાન-મેરેં ।

દર્શનાવરણ નિવારતા,

દર્શન અનંત વિધાન-મેરેં ચતુરં ॥ ૪ ॥

હાં રે! લાલ! વેદનીય-વિગમેં થયું,

સુખ અનંતા-વિસ્તાર-મેરેં ।

અંતરાય ઉલંઘતાં,

વીર્ય અનંત ઉદાર-મેરેં ચતુરં ॥ ૫ ॥

હાં રે! લાલ! ઇમ અનંત નિજ-નામની,

થિરતા થાયી દેવ-મેરેં ।

જિમ તરસ્યા સરવર ભળેં,

તિમ રવરૂપ જિન-સેવ-મેરેં ચતુરં ॥૬॥



(૧૨૦૩) (૫૦-૧૫) શ્રી ધર્મનાથ-જિન સ્તવન

(શત્રુંજા ગિરિના વાસી રે મુજરો માનજો રે-એ દેશી)

ધરમ-જિણુંદને ધ્યાવો ધ્યાનમાં રે,

જાસ વડાઈ છે કેવલ જ્ઞાનમાં રે ।

જિનજીઓ ભાખ્યા ભાવ અનેક,

તે સાંભલતાં આવેં હૃદય-વિવેક-

-ભકત-વચ્છલ પ્રભુ અમને ભવ-જલ તારશે રે ॥ ૧ ॥

ધર્મ કહ્યો છે રે વસ્તુ-સ્વભાવનો રે,

વસ્તુ પ્રકાશે રે દ્રવ્ય બનાવને રે ।

ચર-થિર-અવગાહન પરિવત્તિરે,

પૂરણ-ગણણ ચેતન ગુણ કીર્તિ-

-એહવા ભાવને ધર્મ વખાણીઓ રે-ભકત ॥૨॥

પાંચ અનેરા રે આતમ-દ્રવ્યથી રે,

તેહનો જ્ઞાતા રે ચેતન ભવ્યથી રે ।

તસ પરિચય કરતાં સત્વ, પામે પરમાર્થિક નિજ તત્વ

-તેહનો રે લાભ અપાર સુખંઠરૂ રે-ભકત ॥૩॥

જીવ સંસારી તે નિજ-ધર્મને રે,

નિજ ચિંતતો રે લહે શિવ-શર્મને રે ।

દ્રવ્યથી ગુણ-પર્યાય વિશેષ, તનમય થાતાં કાર્ય અશેષ-

-સાધક સાધે રે સાધને સાધ્યને રે-ભકત ॥૪॥

ચેતના ઢોય સાકાર નેં પરા રે,

અનાકાર અવગમ દગ આગરા રે ।

પરતક્ષ ભાસે લોક-અલોક, નાશે ભવ-બ્રમણાનો શોક-
 -જિનજી નેં સેવ્યા રે સવિ સુખ-સંપન્ને રે-ભક્ત૦ ॥૫॥
 એહવા અતિશય ધૃમ્-જિણુંદના રે,
 તે અનુમોદે રે વૃંદ મુણિંદના રે ।
 તે લહે સુખ-સ્રીભાગ્ય સહેંજે,
 અભિનવ ચંદ્રકલા સમવેત-
 -આપો આતમ-શક્તિ સરૂપને રે-ભક્ત૦ ॥૬॥



(૧૨૦૪) (૫૦-૧૬) શ્રી શાંતિનાથ-જિન સ્તવન
 (ગારી ણિન અવગુણ કિમ છારીઈ-એ દેશી)
 સેવો ભવી શાંતિ જિણુંદ સનેહા,
 શાંત રસ ગેહા, શમામૃત-ગેહા,
 -સેવો ભવિ શાંતિ જિણુંદ સનેહા ॥
 રાગ-દ્વેષ-ભવ પાપ-સંતાપિત,
 ત્રિવિધ તાપહર મેહા-સેવો૦ ।
 માયા-લોભ રાગ કરી-બળો,
 દ્વેષ-ક્રોધ મદ રેહા-સેવો૦ ॥ ૧ ॥
 અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની,
 પચ્ચક્ષ્ણાણુ સંજલન છેહા-સેવો૦ ।
 નિજ અન્યોન્ય-સદૃશથી ચહસકિ,
 સંખ્યા-વાસિત-દેહા-સેવો૦ ॥ ૨ ॥
 નો-કષાય નવ હાસ્ય અરતિ રતિ,
 શોક-જુશુષા ભય વેહા-સેવો૦ ।

મન વચન કાય તપાવત તાથે,

કહિયેં તાપ અછેહા-સેવોં ॥ ૩ ॥

જેસે વનદવ તરૂ-ગણ બાલે, ત્યેં અંતરગત એહા-સેવોં ।

ખમ શમ દમ ઉપશમ શીતલતા,

કરી જલ-લહરી-લેહા-સેવો ॥૪॥

આતમ-રાય રાજ્ય અભિસિંચ્યો,

પૂજિત ત્રિભુવન-ગેહા-સેવોં ।

તુમ શિર-છત્ર કી છાહ અમશિર,

દો સ્વરૂપ અનુપેહા-સેવોં ॥૫॥



(૧૨૦૫) (૫૦-૧૭) શ્રી કુંથુનાથ જિન સ્તવન

(ઋષભ જિજ્ઞેસર પ્રીતમ માહારા રે-એ દેશી)

કુંથુનાથ સત્તરમા જિનપતિજી. કુંથુ તણા પણ નાથ ।

તે જિન અંતર-સામગ્રીવંતનેંજી,

સાચો શિવપુર-સાથ. ॥ ૧ ॥

શ્રીદેવી-સુત ગુણ-સંભારીઈજી, મન-કજ-કેશ નિવાસ ।

મન-મધુકર જિનપદ-કજ-કર્ણિકાજી,

વાસી લહો સુખવાસ-શ્રી દેવીં ॥૨॥

યોગ-ખેમંકર ગુણ છે નાથમાંજી, કુંથુ ઉપર પણ એમ ।

અ-પ્રાપિતનેં પ્રાપક જોગ છેં જી,

પ્રાપ્ત-રક્ષણ-ગુણ ખેમ-શ્રી દેવીં ॥૩॥

લૌકિક નાથ મહીપતિને કહ્યોજી, તે એ અરથ પ્રમાણ ।

લોકોત્તર જ્ઞાનાદિક-ગુણ તથોત્ત,

દાયક રક્ષણ જાણુ-શ્રીં ॥ ૪ ॥

તે ગુણનો અભિલાષી આતમાત્મ, સેવો શ્રી જગનાથ ।

જિનત્ત તેહને મધુ-માધવ પદેત્ત,

આપે અદ્ભુત આથ-શ્રીં ॥૫॥

તિમ હું કુંથુ-જિનેન્દ્ર ઉપાસનાત્ત, કરી માંત્ર ગુણ દોય ।

ભવ-પરિહાર મુગાત-સંપાદનાત્ત,

સત્-સ્વરૂપ સુખ હોય-શ્રીં ॥૬॥



(૧૨૦૬) (૫૦-૧૮) શ્રી અરનાથ-જિન સ્તવન

(દેઉ દેઉ રે નણુંદ હીલી-એ દેશી)

અરનાથ અરજ અવહારો,

નિજ-ભક્તનાં કાજ સધારો રે-મન મોહના મહારાથા ।

સંસાર-પારાવારે,

જલ-ધોલના ન્યાય વિચારો રે-જગ સોહના જિનરાયા ॥૧॥

પુદ્ગલ-પરિવર્ત અનંતા,

થયાં ભવ-કલ્લોલ ભમતાં રે-મનં ।

મનુજ ક્ષેત્ર કુલ આર્ય,

ગુરુ-શ્રુતિ-સદ્ગુણા સુકાર્ય રે-જયં ॥ ૨ ॥

એહવી-સામગ્રીને અ-ભાવે,

જિનધર્મ ન લાધો સુભાવે રે-મનં ।

નિયતે લઘુ-કર્મા યર્ધને,

અનુક્રમે ગુણ-ઠાણુ લેઈને રે-જગં ॥૩॥

જિનધર્મ કલ્યાણક દેખી, તિહાંથી કુશુર કુદેવ ઉવેખી-મન૦ ।

વહી સુશુર સુદેવ ઉપાસી,

થયો સૂધો જિનમત વાસી રે-જગ૦ ॥ ૪ ॥

ધર્મ વ્યક્ત-મિથ્યાત્વને વાચ્યો,

અ-વ્યક્ત-નિવારણ કામે રે-મન૦ ।

ષદ્ બાંધ-જેતાર જિણુંદા,

જિસા અંતર ષટ રિપુ વૃંદા રે-જગ૦ ॥૫॥

નિજ-તુલ્ય-કરણ તુમ શક્તિ,

તુમે મુઝ કામે કરો વ્યક્તિ રે-મન૦ ।

શુરુ સૌભાગ્યચંદ્ર પસાયા,

લહી, સ્વરૂપચંદ્ર શુણ ગાયા રે-જગ૦ ॥૬॥



(૧૨૦૭) (૫૦-૧૯) શ્રી મલિનાથ-જિન સ્તવન

(જી રે સફલ દિવસ થયો આજનો-એ દેશી)

જી રે! મહિમા મલિ-જિણુંદનો માની માહરે મન ।

મોહ-મહીપતિ છૂટીઓ, વહી તસ પુત્ર મહન ॥૧॥

નિત નમીધ નિરાગતા, નમતાં હો એમ ભવ છેહ ।

હુઃખ-દોહગ દૂરેં ટલેં એહમાં નહી સંદેહ-નિત૦ ॥૨॥

જી રે! મલિ-જિણુંદની સાદ્યખી, દેખીને રતિ-પ્રીત ।

વચન કહેં કંતને, પ્રતિ પ્રમદાની રીત-નિત૦ ॥૩॥

જી રે! નાથ! કહો એ કુણ અછેં કહે એ જિનદેવ ।

જિન તે કિ મનુજ વશ નહિં,

કહો ધર્મ સત્યમેવ-નિત૦ ॥ ૪ ॥

છ રે ! નહિં પ્રતાપ ઇહાં માહરો, તો વૃથા પૌરુષ તુઝ ।
હરાબ્યો મોહ માહરો પિતા,

તો શ્યો આસરો મુઝ ? નિતં ॥ ૫ ॥

છ રે ! સાંભલી રતિ-પ્રીતી એં ત્રીજો કામ-સ-ખાણુ ।

મલી મદલી જિણંદની, શિર ધારી છેં આણુ-નિતં ॥૬॥

છ રે ! તે માટે મુજ વિનવું, વારો તેહ અશેષં ।

ઘો સૌભાગ્ય-સ્વરૂપને સુખ લખ્યે વિશેષ-નિતં ॥૭॥



(૧૨૦૮)(૫૦-૨૦) શ્રી મુનિસુવ્રત-જિન સ્તવન

(હાં રે તાહરે ખંગલેરી ખડકી ખોલ હો નણુદીરા વીરા-
ખાહિર ભીંજે મારુ ડીલ એકલી અહો યાં રે ખંગલે-એ દેશી)

હાં રે ! થારો સમવસરણુ દેખાડ હો, મુગતિરા હીરા ।

૧આગણિ ઉભો સેવક સામું હો રે !

થાહરે મુજરે હાંરે-થારો સમવસરણુ દેખાડ હો-મુગતિં ।

હાં રે સુર સંવત્ક-પવનેં કરી રે લો,

૨જ હરી કરે શુભ જલ સિત્ર હો-મુગતિં ।

૩કુસુમોત્કર જલ-થલ જાતિનાં રે લો,

પંચવરણુ ૩ભાતુ-પ્રમિત્ત હો-મુગતિં ॥૧॥

આગળ ઉભો હાં રે થારો સમવસરણુ ॥

હાં રે ! જિહાં વૃક્ષ અશોક-વિરાજતો રે લો,

તિહાં દિવ્ય-ધ્વનિ સુરવાહ હો-મુગતિં ।

૧ સન્મુખ, ૨ ફળનો ઢગલો, ૩ દીપ્ત સુધીના,

હાં રે સિંહાસન બેઠા પ્રભુ તુમે રે લો,

તવ વાજત કુંકુભિ નાદ હો-મુગતિં ॥૨॥

હાં રે ચિંહુ દિશી સિત-ચામર વીંઝતા રે લો,

મુર સફલ કરે નિજ શક્તિ હો-મુગતિં

ભામંડલ યસિત-દ્યુતિ શોભતો રે લો,

ત્રિભુ છત્ર ધરી કરે ભક્તિ હો-મુગતિં ॥૩॥

હાં રે ! પ્રાતિહાય અતિશયે પરિવર્યા રે લો,

શ્રીમુનિમુખત-જિનરાય હો-મુગતિં ।

જિતશત્રુ અન્ધ ઉદ્ધરવા રે લો,

આવ્યા પંભરુઅન્ધ મુર સમુદાય હો-મુગતિં ॥૪॥

હાં રે ! રાય જગન કરંતો રે વારીઓ રે લો,

તારીઓ હય ધરી હેત હો-મુગતિં ।

વાધીઓ જશ ત્રિહુ લોકમાં રે લો,

તીરથ ઈષ્ટ સંકેત હો-મુગતિં ॥ ૫ ॥

હાં રે ! તમે એહવા ઉપગારી પ્રભુ રે લો !

દીઓ અ-વિચલ રાય પસાય હો-મુગતિં ।

તુમ તુઠે સવિ સુખ પામીઈ રે લો,

સ્વરૂપ-અન્દ્રોદય થાય હો-મુગતિં ॥

આગલિં ॥ હાં રે થાહરો સમવં ॥૬॥



(૧૨૦૯) (૫૦-૨૧) શ્રી નમિનાથ-જિન સ્તવન
(સોલમા શ્રી જિનરાજ ઓગગ સુણે અમ તણી
-લલના એ દેશી)

મહ વારી નમિનાથ-જિનેશ્વર વંદિધં-લલના,
લવ અનેકના સંચિત પાપ નિકંદીધં-લલના ।
જિત્યાનેં શરણેં જીતિ લહીજેં એ ન્યાય છે-લલના,
રિપુ જીત્યાનો એ પશુ એક ઉપાય છે-લલના ॥૧॥
દ્રવ્ય શત્રુ જિણે ગર્ભ થકી સહેજે દમ્યા-લલના,
માન મુકીને તે સઘલા આવી નમ્યા-લલના ।
નામ નમિ ઇમ સાર્થક મનમાં ક્યાઇધં-લલના,
તો મન વંછિત ઇહ-પરલવ સુખ પાઇધં-લલના ॥૨॥
જીવ-કરમનો વૈર અનાદિ-નિબદ્ધ છે-લલના,
કિહાં એ જીવ કિહાં કર્મ સમર્થ સંનદ્ધ છે-લલના ।
જો-સ્તનથી પયખાણુથી કનકોપલ પરે-લલના,
મિથ્યા આઠ્યા પશુ તાસ વિભાવ અગનિ હરે-લલના ॥૩॥
તિમ પ્રભુ સમકિત-લાભથી પંડિત વીર્યને-લલના,
ધારી વારી પ્રમાદ ધરી મન ધીર્યને-લલના ।
જીતી ભાવ વિપક્ષ સુપક્ષ વિચારીને-લલના,
સર્વ ઘાતી-દેશ ઘાતી અઘાતી નિવારીનેં-લલના ॥૪॥
લાઘો કેવલ-યુગલ નિધાન સુ-લકિતનો લલના,
જિનપદ લોગ સંયોગ મિલા એ વિમુક્તિનો-લલના ।
ઇમ બહિર-તર શત્રુ નમાવી નમિ-જિને-લલના ।
ભદ્ર દર્શન કેઈ દેશ-સર્વ વિરતિ લે-લલના ।

જિમ તુમે જીત્યા રે તેમ જીતાવેા માહરા-લલના,
કહે સ્વરૂપ હવે ચરણ શરણ છે તાહરા-લલના ॥૬॥

○

(૧૨૧૦) (૫૦-૨૨) શ્રી નેમિનાથ-જિન સ્તવન

(અપને પીયાજીકી વાત રેં હું કેહને પુછું-એ દેશી)
નેમિ-જિણુંદનું જ્ઞાન રે, જગમાં જયકારી,
જગત જંતુની રક્ષા કરવા, પ્રભુ અતિશય ઉપગારી રે-
-વંદો નરનારી-નેમિં ॥

જય સમુદ્રવિજયાંગ-ભૂ, શિવા દેવીના બાયા,
શંખ લંછન અંજન-છવિ, દસ ધનુષની કાયા-નેમિં ॥૧॥

અલયદાન શ્યાપદ ભણી, દીધું વરસી જનનેં ।
સંયમી બ્રહ્માચારી પછે, સાધ્યું નિજ મનમેં-નેમિં ॥૨॥

પ્રતિપદ પૃથવી પાવન કરી, સહસાવને સ્વામી ।
મૌનપણે ચોપન દિને, કેવલસિરિ પામી-નેમિં ॥૩॥

પૂછે પ્રભુને કૃષ્ણજી, સુણો ! ત્રિભુવન રાય ! ।
ત્રિગુણ તીર્થ રૈવતપતિ, હરિવંશ સસવાય-નેમિં ॥૪॥

ઉત્તમ સ્ત્રી-ગુણે પરિવરી, રાજમતી કન્યા ।
તુમ ચિત્તમાં કિમ નવી વસી ?

અતિ-તન્વી ધન્યા-નેમિં ॥ ૫ ॥
તવ સુરપતિ કહે કૃષ્ણને, જિન-ચિત્ત અ-ભંગે ।

જ્ઞાન ગર્ભ વૈરાગને, ઉત્તરંગને રંગે-નેમિં ॥૬॥
ન મિલેં પ્રવેશ અનંગને, કૃથાંગીની શી વાત ?

તે સુણી રાજમતી કહે, સુર-નર વિખ્યાત-નેમિં ॥૭॥

ચિદ્દાનંદ ચિત્તમાં તિહાં, નહિં કોઈ નો નામ ।

ચિદ્દાનંદ-સંયુત પ્રભુ, ધરું મુઝ મન ધામ-નેમિં ॥૮॥

ઇમ કહી જિન-દીક્ષા ગ્રહી, કરી સંયમ-લીલા ।

રહનેમિ પ્રતિબોધીઓ, સતી પરમ-સુશીલા-નેમિં ॥૯॥

ઇમ અનંત ગુણ-રાશિનો, પર પાર ન આવે ।

સાભાગ્યચંદ્ર સ્વરૂપચંદ્રને,

જિન-ધર્મ શીખાવે-નેમિં ॥ ૧૦ ॥



(૧૨૧૧) (૫૦-૨૩) શ્રી પાર્શ્વનાથ-જિન સ્તવન

(સખી આજ આસાદો ઉગ્યો,

સખી ઝરમર વરસે મેહ-એ દેશી)

છ રે ! આજ દિવસ ભલેં ઉગીયો છ રે,

આજ થયો ૧સુ-વિહાણ ।

પાસ-જિણેસર ભેટીયા, થયા આનંદ-કુશલ-કલ્યાણ હો-

-સાજન સુખદાયક જાણી સદા,

ભવિ પૂજે પાસ જિણુંદ ॥ ૧ ॥

છ રે ! ત્રિકરણ-શુદ્ધિં ત્રિહું સમે છ રે,

નિસિદ્ધી ત્રિણ સંભારિ ।

ત્રિહું દિશિ નિરખણ વરણનેં,

દીજેં ખમાસમણ ત્રીન વાર હો-સાજનં ॥ ૨ ॥

છ રે ! ચૈત્યવંદન ચોવીસનો છ રે,

સ્વર-પદ-વર્ણ વિસ્તાર ।

૧ સુપ્રભાત,

અર્થ-ચિંતન ત્રિહું કાલનાળ રે,

જિનનાથ ! નિખેપા ચાર હો-સાજન૦ ॥ ૩ ॥

શ્રી જિન પદ ફરસે લહે,

૨કલિ-મલીન તે ૩પદ ૪કલ્યાણ ૧

તે વટ્ટી અ-જર-અ-મર હુવે,

અ-પુનર્ભવ શુભ નિર્વાણ હો-સાજન૦ ॥ ૪ ॥

જી રે ! લોહલાવ મુકી ૫પરોજી રે, પારસ-ફરસ-પસાય ૧

થાયે ૭કલ્યાણ કેઠ ૮ધાતુથી,

તિમ જિન-પદ મોક્ષ ઉપાય હો-સાજન૦ ॥ ૫ ॥

જી રે ! ઉત્તમ નારી-નર ઘણાજી રે,

મન ધરી ભક્તિ ઉઠાર ૧

આરાધી જિન પદ ભલો,

ચાર્ધ જિન કરે જગ ઉપગાર હો-સાજન૦ ॥ ૬ ॥

જી રે ! એહવો મન નિશ્ચલ કરી જી રે,

નિશિ દિન પ્રભુને ક્યાય ૧

પામે સૌભાગ્ય સ્વરૂપને,

૯નિવૃત્તિ ૧૦કમલાવર થાય હો-સાજન૦ ॥ ૭ ॥



૨ પાપથી મલિન, ૩ રથાન, ૪ આરં ૫ દૂર, ૬ પારસ મણિના
સ્પર્શથી ૭ સોનું ૮ લોખંડમાંથી, ૯ મોક્ષ રૂપી, ૧૦ લક્ષ્મીના ઘણી.

(૧૨૧૨) (૫૦-૨૪) શ્રી મહાવીર-જિન સ્તવન

(રાજુલ પુછે રે સખી પ્રતે,
રાજુલ પુછે રે વાત રે; સુણો સજની અમારી વાત)

હું તુમ પુછું રે પરમશુર !
હું તુમ પુછું વાય રે,
કહો પ્રસન્નો ઉત્તર સાચ ।

હું એક માંગું રે પરમ શુર !
હું એક માંગું વાય રે,
હીઓ નામ તુમારનો સાચ ॥

નામ તુમારો રે જગત શુર,
નામ તુમારો વીરજી રે,
તેહનો અદ્ભુત બાવ ।

મનશું વિચારી બેઠઈ, તવ ઉપજે વિવિધ બનાવ રે ॥૧॥
સુણો સદ્ગુર માહરી વાય રે, હું તુમં ॥

નવ રસ માંહે રે જગત શુર !
નવ રસ માંહે પાંચમેા રે,
રસનો નામ છે વીર ।

તે વહી ત્રિવિધ વખાણિઈ, તેના નામ કહ્યા ત્રણ ધીર રે,
સુણો સદ્ગુર હું તુમં ॥૨॥

એ જ દાનમાં રે જગતશુર !
એ જ દાન તિમ ધરમમાં રે
સમરથ કહીઈ વીર ।

તન-ધન-મન શંકા નહી, મન મોહ રોમાંચ શરીર-

સુષોભું હું તું ॥૩૥

એ લક્ષણ રસ રે જગતગુરુ,

એ લક્ષણ રસ વીરના રે

છે તુમને પરતક્ષ ।

ગુણ-સેનાની તે છતાં,

બહિરંતર લક્ષણ લક્ષ રે-સુષોભું હું તું ॥૪૥

સત્વ પરીક્ષક રે જગતગુરુ,

સત્વ પરીક્ષક સુર દમ્યો રે,

એ જી વીર તુમે એમ

લોક ઉચ્ચ પૂરણ કર્યો,

દાન વીર સંવચ્છર પ્રેમ રે-સુષોભું હું તું ॥૫૥

કરમને જીતી રે જગતગુરુ,

કરમને જીતી કેવલી રે,

વાસ્થો ભવ ભય મર્મ ।

સત્તા ધર્મ બતાવીઓ,

એહવો ધર્મ વીર શિવ શર્મ રે-સુષોભું હું તું ॥૬૥

વીર ત્રિવિધ ગુણ રે જગતગુરુ,

વીર ત્રિવિધ ગુણ રાજતા રે,

સેવું ચરણ-જુગ તુચ્છ ।

સૌભાગ્યચંદ્ર સ્વરૂપ તે,

દીઓ વીરજી વીરતા મુઝ રે-સુષોભું હું તું ॥૭૥



ચતુર્વિંશતિ-જિન સાધારણ સ્તવન

(ઢાલ-તે તરીઆ રે ભાઈ તે તરીયા-એ દેસી)

ધણિ અવસર્પિંણીધ જિનરાયા, સુર-નર પ્રણુમીત પાયાળ ।
સેવક જન-મન વંછિત-દાયા,

નિજપદ કરણ પસાયાળ-ધણિં ॥ ૧ ॥

માતા પિતા ધન્ય જિહાં જિન જાયા,

ધન્ય કુલ પુર જિહાં આયાળ ।

છાપન દ્વિશિ-કુમરી હૂલરાયા,

શયી ઉત્સંગ રમાયાળ-ધણિં ॥ ૨ ॥

ચોસઠ ઇંદ્ર તણે મને લાયા, અપછર-ગણ ગુણ ગાયાળ ।

સધુ વય મેરુ-શિખર પધરાવ્યા,

તીર્થ-જલે નહવરાયાળ-ધણિં ॥ ૩ ॥

ભુક્ત-ભોગી સંજમ મન લાયા, નિશ્ચલ મન-વચ-કાયાળ ।

પરમ-પુરૂષ ગુણ આતમ ધ્યાયા,

કેવલે સિદ્ધિ સધાયાળ-ધણિં ॥ ૪ ॥

ગુરુ પસાય જિન-આગમ પાયા, સૂત્ર અરથ વંચાયાળ ।

પંચ કારણ વ્યવહાર ઉપાયા,

જાણી જગત નમાયાળ-ધણિં ॥ ૫ ॥

ધન્ય ગુરુજી જિનમાર્ગ દિખાયા, રાખી ભાંડની છાયાળ ।

દુરિત-દોહડા દુઃખ દૂર ગમાયા,

નિજપદ પાઠ પઠાયાળ-ધણિં ॥ ૬ ॥

તાસ પસાયે મન ઉદ્ધસાયા, ભાવદીપ પ્રગટાયાળ ।

ઉન્મારગ-તમ-દુરિત નસાયા,

મુગતિ મારગ મન ધાયાળ-ધણિં ॥ ૭ ॥

જિન ચઉવીશ તણા ગુણ ગાયા, ઉપશમ-અમૃત ન્હાયા ॥
ગુરુ સૌભાગ્યચંદ્ર સુપસાયા,

સ્વરૂપચંદ્ર સુખ દાયાળુ-ઈશ્વિં ॥ ૮ ॥

કલશ

ઈમ ન્દપભ-જિન ધુરી વીર-જિન લગેં,
ચઉવીસેં તીર્થંકરા,
તસ ભક્તિ કરતાં ધ્યાન ધરતાં ત્રિવિધ મલ નાશે પરા ।
સુખ-સંપદા ધરી સુથિર થાઈ જગત જન જસ અનુસરે,
સૌભાગ્યચંદ્ર ગુરુ પ્રસાદે સ્વરૂપચંદ્ર ઈમ ઉચરે ॥૬૫॥

॥ ઈતિશ્રી સ્વરુપચંદ્રકૃત ચોવીશી સંપૂર્ણ ॥

શ્લોક

યાદશં પુસ્તકં દષ્ટં, તાદૃશં લિખિતં મયા ।

યદિ શુદ્ધમશુદ્ધં વા, મમ દોષો ન દીયતે ॥૧૫॥

ભક્ત પૃષ્ઠિં કટિ ગ્રીવા, બદ્ધ મુઠી અધો મુખં ।

કળ્પેન લિખિતં શાસ્ત્રં, યત્નેન પરિપાલયેત્ ॥૨૫॥

સંવત ૧૯૨૬ વર્ષે શ્રાવણ વદી ૪ ને વાર સોમ-દિને
સમાપ્ત પઠનાથે ચેલાળ ગલાબચંદ્ર

અમરત વીજેળ અથે લિખાપિતા ॥

લિપિ કૃત લહીયા તરલોવન કલ્યાણદાસ ॥

શ્રી વિદ્યાશાલા મધે બેસીને લખી છે

શ્રી વર્ધમાનસ્વામિને નમઃ
 શ્રી ખિમાવિજયણ શિષ્ય
 શ્રી જશવિજયણ મં કૃત
 જિન-સ્તવન ચોવીશી
 (૫૧)

[દેવ-ગુરુ કૃપાએ અનેક ભંડારોમાંથી મેળવેલ આ ચોવીશી-સંગ્રહમાં આ ચોવીશી અ-પૂર્ણ જ મળી છે. શરૂ-આતના પાના ન મળવાથી શ્રી ત્રકષલદેસ્વામીથી શ્રી પદ્મ પ્રભ સ્વામી સુધીનાં સ્તવનો મળ્યાં નથી. તેથી અપૂર્ણ પણે આ ચોવીશી સુરક્ષિત જળવાઈ રહે તે આશયથી પ્રકટ કરી છે.]

(૧૨૧૩) (૫૧-૭) શ્રી સુપાર્શ્વનાથ-જિન સ્તવન
 (અજિત-જિણુંદ-શુ પ્રીતડી-એ દેશી)

શ્રી સુપાસ-જિન સાહિબા,
 સુણો! વિનતિ હો! પ્રભુ! પરમ-કૃપાલ! કે ।
 સમકિત-સુખડી આપીયે,
 દુઃખ કાપીયે! હો! જિન! દીન દયાલ! કે-શ્રીં ॥૧॥
 મૌન ધરી બેઠા તુમે,
 નિ-ચિંતા હો! પ્રભુ! થઈને નાથ! કે ।

હું તો આતુર અતિ-ઉતાવલો,

માગું છું હો ! જોડી દોય હાથ કે-શ્રીં ॥૨૦॥
સુશુભ સાહિબ તુમ વિના,

કુણ કરશે ? હો ! સેવકની સાર કે ।
આખર તુમહી જ આપશે,

તો શાને હો ! કરો છો ! વાર કે-શ્રીં ॥૨૩॥
મનમાં વિમાસી શું રહ્યા,

અંશ ઓછું હો ! તે હોય મહારાજ કે ।
નિરગુણને ગુણ આપતાં,

તે વાતે હો ! નહિ પ્રભુ ! લાજ કે-શ્રીં સું ॥૪॥
મોટા પાસે માગે સહુ, કુણ કરશે ? હો ! ખોટાની આશ કે ।
ઘાતાને દેતાં વધે ઘણું,

કૃપણને હો ! હોય તેહનો નાશ કે-શ્રીં સું ॥૫॥
કૃપા કરી સામું જો ગુણો,

તો લાંબે હો ! મુજ કર્મની બલ કે ।
ઉત્તર-સાધક ઉભા થકાં,

જિમ વિદ્યા હો ! સિદ્ધ હોય તત્કાલ-શ્રીં સું ॥૬॥
બાણ આગળ કહેવું કિશ્યું ?

પણ અરથી હો ! કરે અરદાસ કે ।
શ્રી ખિમાવિજય-પય સેવતાં,

જશ લહીએ હો ! પ્રભુ નામે ખાસ કે-શ્રીં સું ॥૭॥



(૧૨૧૪) (૫૧-૮) શ્રી ચંદ્રપ્રભ-જિન સ્તવન
 (અંતરજામી હો કે શિવપુરી-ગામી, મારા લાલ-એ દેશી)
 ચંદ્રપ્રભની હો ! કે સેવા કીજે-મારા લાલ,
 અવસર પામી હો ! કે લાહો લીજે-મારા લાલ ।
 દિલભર-દિલશુ હો ! કે સાહિબ રીઝે-મારાં,
 વેગે વંછિત હો ! કે કારજ સીઝે-મારાં ॥૧॥

દશ-દશાંતે હો ! કે દુરલભ જાણી-મારાં,
 પુનરપિ સુલભ હો ! કે નહિ ભવિ-પ્રાણી-મારાં ।
 મણુય-જનમ છે હો ! કે ગુણની ખાણી-મારાં,
 પ્રભુ-પદ સેવી હો ! કે કરો કર્મ-હાણી-મારાં ॥૨॥

શ્રદ્ધા સાચી હો ! કે ચિત્તમાં આણી-મારાં,
 કષ્ટ-રકચોલે હો ! કે પીઓ જિન-વાણી-મારાં ।
 જિન-ગુણ-ગાણી હો ! કે મુગતિ-સેનાની-મારાં,
 ભગતિ જુગતે કરી હો ! કે લીજે તાણી-મારાં ॥૩॥

ભવ-ભવ ભમતાં ! હો ! કે પ્રભુ ! મુજ મલીયો-મારાં,
 આજ મનોરથ હો ! કે સવિ મુજ ફલીયો-મારાં ।
 કર્મ-પ્રબલથી હો ! કે થયો હું પગલીયો-મારાં,
 હવે તુમ-સાહ્યો હો ! કે હોઈશ બલીયો-મારાં ॥૪॥

દુર્શ્મન દૂરે હો ! કે પ્રભુ ! વારો-મારાં,
 ભય-સાગરથી હો ! કે સાહિબ ! તારો-મારાં ।

૧ ઉમંગવાળા ચિત્તથી, ૨ ખાલીથી, ૩ સ્તુતિ, ૪ સેનાપતિ, ૫ ઢીલો
 ૬ પકડ્યે થકે,

શ્રી ખિમાવિજય-ગુરુ હો ! કે દિલમાં ધારો-મારાં ।

કહે જશ વહેલે હો ! કે પાર ઉતારો ! મારાં ॥૫૥



(૧૨૧૫) (૫૧-૯) શ્રી સુવિધિનાથ-જિન સ્તવન

(દુનિયામાં કેવ ન દુલેજી, જિનવર જયકારી-એ દેશી)

સુષો સુવિધિ-જિજ્ઞેસર ! સામીજી-સાહિબ સાંભલો,

તું મુજ અંતરભામીજી-સાહિબં ।

આજ અવસર એ પામીજી-સાં

હું અરજ કરું શિર નામીજી-સાં ॥૧॥

કાલ અનંતો ભમીયોજી-સાં,

હુઃખ અનંતા ખમીયોજી-સાં ।

હું તો મોહરાય-વશ પડીયોજી-સાં,

મિથ્યા-મંત્રી મુજ નડીયોજી-સાં ॥૨॥

પ્રમાદ-મદિરા-પાન પાયોજી-સાં

ચિહું-ગતિ-માંહે ભમાયોજી-સાં ।

તિહાં હુઃખ હું ખહુ પાયોજી-સાં

ન મલ્યો કે ! શરણુ સખાયોજી-સાં ॥૩॥

રાગ કેશરીએ હું ઘેર્યોજી-સાં

કેવ-ગજેન્દ્ર હું ફેર્યોજી-સાં ।

તૃણા-તરૂણીએ વગોયોજી-સાં,

વિષયા-દાસી હું મોહ્યોજી-સાં ॥૪॥

કામ-કોટવાળે હુઃખ દીધોજી સાં,

વિકથા-ભ્રગણુનો કહેણ કીધોજી-સાં ।

શતિ-અરતિ મળી ધુતારીજી-સાં,

તેણે દાખી દુરગતિ-ખારીજી સાં ॥૫૫॥

હવે તુમ ચરણે હું આયોજી-સાં,

એ દુઃખ દૂરે ગમાયોજી-સાં ।

સેવકને શરણે રાખોજી-સાં,

તુમથી અધિકે કુણુ ? દાખોજી-સાં ॥૫૬॥

હવે લવોલવ તુમ સેવાજી-સાં

માયું હું દેવાધિદેવાજી-સાં

શ્રી ખિમાવિજય-શુર-રાયજી-સાં

જશ વાધે સેવતાં પાયજી-સાં ॥૫૭॥



(૧૨૧૬) (૫૧-૧૦) શ્રી શીતલનાથ-જિન સ્તવન

(જી હો વિમલ જિનેસર સુંદર-એ દેશી)

જી હો ! શ્રી શીતલ-જિન ભેટતાં,

જી હો ! ઉલટ અંગે ન માય ।

જી હો ! રોમ-રોમ તનુ ઉલસે,

જી હો ! હિયડે હરખ ભરાય,

જિનેસર ! ભેટયો લલે તું આજ,

મુજ સારો વંછિત કાજ-જિં ॥૧॥

જી હો ! ધન વેલા ધન તે ધડી,

જી હો ! ધન મુજ જીવિત એહ ।

જી હો ! વિકસિત વદન રહે સદા,

જી હો ! જ્યું આપીયડા મેહ-જિં ॥૨॥

જી હો ! આજ અપૂરવ દિન લલો,

જી હો ! નયણુ નિરખો નાથ ।

જી હો ! પરમ-પુરૂષ મેં પરખીયો,

જી હો ! મલીયો શિવપુર-સાથ-જિં ॥૩૧॥

જી હો ! જાગી ભાગ્ય દશા હવે,

જી હો ! પ્રગટયો પુણ્ય-અંકૂર ।

જી હો ! ચિત્ત ચમકે તિમ માહરૂં,

જી હો ! દેખી ચંદ ચકોર-જિં ॥૪૧॥

જી હો ! પ્રભુ-દરિસણુ લહી પ્રાણીયા,

જી હો ! આલસ આણે રે જેહ ।

જી હો ! તેહ પછે પસ્તાયશે,

જી હો ! પંથ-ચીલે રહ્યો છેહ-જિં ॥૫૧॥

જી હો ! ભદ્રિપુર-નયરી-ધણી,

જી હો ! દ્રઢરથ-રાયનો નંદ ।

જી હો ! માત નંદાએ જનમીયો,

જી હો ! પ્રગટયો સુરતરૂ-ઠંદ-જિં ॥૬૧॥

જી હો ! શ્રીવચ્છ-લંછન શોભતું,

જી હો ! સોવન-વરણી કાય ।

જી હો ! શ્રી ગુરૂ-ખિમાવિજય તણો,

જી હો ! જસ પ્રભુમે નિત પાય-જિં ॥૭૧॥

(૧૨૧૭) (૫૧-૧૧) શ્રી શ્રેયાંસનાથ-જિન સ્તવન

શ્રી શ્રેયાંસ-જિન અગીયારમા,

સુષો સાહિબ ! જગદાધાર-મોરા લાલ !
ભવ-ભવ ભમતાં જે કર્યાં,

મેં પાપસ્થાન અઠાર-મોરા લાલ-શ્રીં ॥૧॥
જીવ-હિંસા કીધી ઘણી, બોલ્યા મૃષા-વાદ-મોરા લાલ !
અદત્ત પરાયાં આદર્યાં,

મૈથુન સેવ્યાં ઉન્માદ-મોરાં શ્રીં ॥૨॥
પાપે પરિગ્રહ મેલીયો, બલ્યો ક્રોધ-અગનની જાળ-મોરાં !
માન-ગજેન્દ્ર હું ચઢ્યો,

પડીયો માયા-વંશ-જાળ-મોરાં શ્રીં ॥૩॥
લોભે થોભ ન આવીયો, રાગે ત્યાગ ન કીધ-મોરાં !
દ્વેષે દોષ વાઢ્યો ઘણો, કલહ કર્યો પરસિદ્ધ-મોરાં શ્રીં ॥૪॥
કૂડાં આળ દીયાં ઘણાં, પર-ચાડી માનનું મૂળ-મોરાં !
છંટ મળે રતિ ઉપની,

અનિષ્ટ અરતિ પ્રતિકૂળ-મોરાં શ્રીં ॥૫॥
પરનિંદાએ પરિવર્યો, બોલ્યો માયામોક્ષ-મોરાં,
મિથ્યાત્વ-શલ્યે હું ભારીયો,

નાણ્યોં ધરમનો સોક્ષ-મોરાં શ્રીં ॥૬॥
એ પાપ થકી પ્રભુ ! ઉદ્ધરો ! હું આલોઉં તુમ સાખ-મોરાં,
શ્રી ખિમાવિજય-પદ સેવતાં,

જશને અનુભવ દાખ-મોરાં શ્રીં ॥૭॥



(૧૨૧૮)(૫૧-૧૨) શ્રી વાસુપૂજ્યસ્વામી-જિન સ્તવન

(જગજીવન જગ વાલહો-એ દેશી)

વાસુપૂજ્ય ! જિન ! વાલહા !,

અરજ સુણો મુજ એક-લાલ રે ।

અવર દેવ ઇચ્છું નહિ,

એ મુજ મોટી ટેક-લાલ રે-વાસુ ॥૧॥

હરિ-હરાદિક ^૧દીઠડે, ગુણનું કારણ જોય-લાલ રે ।

૨પરતક્ષ દેખી ૩પટંતરો,

પ્રભુ-ગુણ-૪પરતીત હોય-લાલ રે-વાસુ ॥૨॥

શૂલ-^૫ચાપ-ચક્ર નવિ ધરે,

નવિ ધરે ગદા-શંખ ^૬પાણિ-લાલ રે ।

ક્રોધ અઠાર-વરજિત સહી,

તેહની શિર આણુ-લાલ રે-વાસુ ॥૩॥

અંતરંગ રિયુ હણે, તોય સમતાવંત કહેવાય-લાલ રે ।

ક્રોધ વિના હણવું કિશ્યું ?

એ અચરિજ મુજ થાય-લાલ રે-વાસુ ॥૪॥

એહ ભેદ સાચો સાહી, શીતલતા ગુણ હોય-લાલ રે ।

વિષ્ણુ વનિહયે વન દહે,

શીત-કાલે ^૭હિમ સોય-લાલ રે-વાસુ ॥૫॥

વિષ્ણુ-ભણ્યે વિદ્યા ઘણી, ^૮અનલંકાર ઓપે દેહ-લાલ રે ।

^૯દ્રવ્ય-રહિત પરમેસર, ઉપમા નાવે કેહ-લાલ રે-વાસુ ॥૬॥

૧ જોયાથી, ૨ સાક્ષાત્, ૩ આંતરં, ૪ ખાત્રી, ૫ ધનુષ્ય, ૬ હાથમાં

૭ ઠાર, ૮ વગર ધરેણાએ. ૯ પૈસા વગર,

પ્રભુ-ગુણ-પાર ન પામીએ, સહસ-મુખે કહે કૌય-લાલ રે ।

શ્રી ગુર-ખિમાવિજય પય,

પ્રભુમ્હે જગ જશ હોય-લાલ રે-વાસુ ॥૭૭॥



(૧૨૧૯) (૫૧-૧૩) શ્રી વિમલનાથ-જિન સ્તવન

(સંભવ જિનવર વિનતિ-એ દેશી)

વિમલ-જિનેસર વંદિયે, ૧કંદીયે મિથ્યા મૂલો રે ।

આનંદીયે પ્રભુ-મુખ દેખીને,

તો લહીયે મુખ-અનુકૂલો રે-વિમલ ॥૧૧॥

વિમલ નાથુ છે જેહનું, વિમલ હંસણુ સોહે રે ।

વિમલ ચારિત્ર-ગુણે કરી,

લવિયણનાં મન મોહે રે-વિ ॥ ૨ ॥

વિમલ બુદ્ધિ તો ઉપજે, જો વિમલ-જિનેસર ધ્યાય રે ।

વિમલ-ચરણ પ્રભુ સેવતાં,

વિમલ પદારથ પાય રે-વિમલ ॥ ૩ ॥

૨વિમલ-કમલ-દલ-લોયણાં, વદન વિમલ-શશી સોહે રે ।

વિમલ વાણી પ્રભુની સુણી,

ભવ્ય-ભવ પડિમોહે રે-વિમલ ॥ ૪ ॥

વિમલ જીહ્વા તસ જાણીયે,

જે વિમલ-જિણુંદ ગુણ ગાવે રે ।

શ્રી ખિમાવિજય-પય સેવતાં,

વિમલ જશ બહુ પાવે રે-વિમલ ॥ ૫ ॥



૧ ઉપેડી નાખીએ, ૨ નિર્મળ,

(૧૨૨૦) (૫૧-૧૪) શ્રી અનંતનાથ-જિન સ્તવન
(શ્રી સુપાસ જીનરાજ-એ દેશી)

અનંત પ્રાણીનો નાથ, ^૧અનંત-ગુણ-મણિ-આથ,
આજ હો ! નામ રે ^૨પરિણામે જુગતું જેહનેજી ॥૧॥
દરિસણુ-નાણુ અનંત, તિમ વળી સુખ અનંત,
આજ હો ! વીચું વિરાજે અનંતું જેહનેજી ॥૨॥
આણી કર્મનો અંત, એ લહી ચાર અનંત,
આજ હો ! રાજે રે, શિવ-પદવી છાજે જેહનેજી ॥૩॥
ભમતાં ભવ અનંત, જો મિલીયો ભગવાંલ,
આજ હો ! હરખો રે, પરખ્યો ^૩પુણ્ય-પટંતરો ॥૪॥
દરિસણુ દુર્લભ દેવ, વળી તુમ ચરણની સેવ,
આજ હો ! સ્વામી રે, મેં પામી પ્રેમે તે ભલીજી ॥૫॥
કૃપા કરો ! ભગવાંત, જિમ લહું ! કર્મનો અંત,
આજ હો ! જાચું રે, નવિ રાચું અવરને દેખીનેજી ॥૬॥
શ્રી જિમાવિજય-ગુરૂ-નામ, જાણે ક્ષમા-ગુણ ધામ,
આજ હો ! પામી રે, શુભ-કામી જશ લહીયે ઘણોજી ॥૭॥



(૧૨૨૧) (૫૧-૧૫) શ્રી ધર્મનાથ-જિન સ્તવન
(નારી તે પિયુને વિનવે હો લાલ-એ દેશી)

ધર્મ-જિનેસર ધ્યાવતાં હો ! લાલ, મુજ મન વરે ^૧રૂહાડ-
સલુણા સાહિબા ।

૧ અનંત ગુણરૂપ સંપત્તિવાળા, ૨ છેવટે, ૩ પુણ્યનું આંતરું,

૧ રહ=૫૪૩,

પણ આઠ અરિ આડા ફરે હો લાલ,

જેહની મોટી ધાડ-સલુણાં ॥ ૧ ॥

પહેલો અજ્ઞાન-પટ આડો ધરે હો લાલ,

તો કિમ દેખું રૂપ-સં ૧

ખીંને રાખે રોકીને હો ! લાલ,

મિલવા ન દીયે જિન ભૂપ-સં ॥ ૨ ॥

મધુર-ખડગ-ધાર ચાટવી હો ! લાલ,

ત્રીંને દેખાડે સુખ-સં ૧

જીલ-છેદથી વેદના હો ! લાલ,

તિમ ભોગવાવે દુઃખ-સં ॥ ૩ ॥

ચોથે મદિરાપાન પાઇને હો ! લાલ !

વિકલ કરે મુજ બુદ્ધ-સં ૧

યથા-તથા પશું બોલતાં હો ! લાલ,

પાછળ ન રહે શુદ્ધ-સં ॥ ૪ ॥

હોડે ઘાલે પાંચમો હો ! લાલ, રાખે ભવ પયંત-સં ૧

જનમ મરણ કરાવે ઘણાં હો ! લાલ,

નાન્યો ભવનો અંત-સં ॥ ૫ ॥

છઠો વિવિધ-રૂપ દાખવે હો ! લાલ,

ચિતારા સમ તેહ-સં

ગતિ-નતિ નામે કરી હો ! લાલ,

બોલાવે બહુ એહ-સં ॥ ૬ ॥

ઉંચ-નીચ કુલ ઉપજવતો હો ! લાલ,

ઘે હેલના-બહુમાન-સં

કુલાલ સમ તે જાણીયે હો ! લાલ,
 સાતમાનું અભિધાન-સં ॥૭॥
 દાન દેતાં રાજ પ્રતે હો ! લાલ,
 રાખે રખવાલ જિમ-સં ૧
 દાન-લાભાદિક-લખિને હો ! લાલ,
 આઠમે વારે તિમ-સં ॥૮॥
 એ અરિને અલગા કરે હો ! લાલ,
 વિનવું વારેવાર-સં ૧
 શ્રી ગુરૂ ખિમાવિજય સેવતાં હો ! લાલ,
 જશને ઘો લવ-પાર-સં ॥૯॥



(૧૨૨૨) (૫૧-૧૬) શ્રી શાંતિનાથ-જિન સ્તવન

(વિનાતિ અવધારે રે, પુર માંહે પધારે રે-એ દેશી)

સુણો શાંતિ-જિણુંદારે, તુમ દીઠે આણુંદારે,
 દૂર ટળે ભવકુંદા દરિસણુ દેખતાં રે, ॥૧॥
 મુદ્રા મનોહારી રે, ત્રિભુવન-ઉપધારી રે,
 પ્યારી વળી લાગે સહુને પેખતાં રે ॥૨॥
 સૌમ્યતાએ શશી નાસી રે, ભમે ઉદાસી રે,
 આળ્યો મૃગ પાસે, અધિકાઈ જોવતો રે ॥૩॥
 તેજે ૧લાણુ ભાગો રે, આકાશે જઈ લાગો રે,
 ધરે ૨વજી રાગો, રૂપે ચોહતો રે, ॥૪॥

પરમાણુ જે શાંત રે, નિપની તુમ કાંત રે.

ટળી મન બ્રાંત, પરમાણુ ઐટલા રે. ॥૫૫॥
દેવ જોતાં કોડી રે, નાવે તુમ હોડી રે.

નમે કર જોડી, સુર જે લલા રે. ॥૬૥॥
જનમે ઝઘટિ વારી રે, ખટ-ખંડ ભોગ ધારી રે,

થયા વ્રત-ધારી, નારી પરિહરી રે. ॥૭૥॥
વરસી-દાન વરસી રે, સંજમ-શ્રેણી ફરસી રે.

કઠિન કરમની રાશિ, તુમથી તે થરહરી રે. ॥૮૥॥
ધ્યાના-નલ-જોગે રે, આતમ-ગુણ ભોગે રે.

રોગે ને સોગેથી, તું ફરે રહે રે. ॥૯૥॥
પ્રભુમે પ્રભુ-પાયા રે, ખિમાત્રિજય-શુરરાયા રે.

તુમ ગુણ પ્રતિ, ભાયા જશ તે લહે રે. ॥૧૦૥॥



(૧૨૨૩) (૫૧-૧૭) શ્રી કુંથુનાથ-જિન સ્તવન
(ત્રિસજ્જાનંદન ચંદન શીત-એ દેશી)

કુંથુ-જિનેસર સાચો દેવ,

ચોસઠ ઇંદ્ર કરે જસ સેવ-સાહિબ સાંભળો ।
તું સાહિબ ! જગનો આધાર,

ભવ ભમતાં મુજ નાબ્યો પાર-સાં
કહું મુજ મનની વાત, મૂકી આંખલો-સાં ॥૧॥
પરશંસા ઉપર મુજ રીઝ, નિંદા કરે તે ઉપર ખીજ-સાં ।

એ જે તુમને છે સમભાવ,

તે માથું છું પામી દાવ-સાં ॥ ૨ ॥

પુદ્ગલ પામી રાથું રે હું, તે નવિ ઈચ્છે પ્રભુજી તું-સાં ।

એ ગુણ મોટો છે તુમ પાસ,

તે ઢેતાં મુખીયો હોય દાસ-સાં ॥૩॥

વિષય-^૧વેરી સંતાપે જોર, કામે વાહ્યો ફરું જિમ ઢોર-સાં ।

વલી વલી દુઃખ હીયે ચાર ચોર,

તુમ વિના કુણુ આગળ કરું ! રસોર-સાં ॥૪॥

તુમથી ભાગ્યા ભાગ્યા મુજ કેડ,

ચિંહુ ગતિની કરાવે ખેડ-સાં ।

બાણી તુમારો ઢે મુજ માર,

તો કિમ ન કરો ! પ્રભુજી ! સાર-સાં ॥૫॥

સેવક-સન્મુખ જુઓ ! એકવાર,

તો તે ઉભા ન રહે લગાર સાં ।

મોટાની ઝમીટે કામ થાય,

^૪તરણિ-તેજે પતિમિર પલાય-સાં ॥૬॥

કરુણાવંત અનંત-બળ-ધણી,

વાર ન લાગે તુમ તારવા બાણી-સાં ।

શ્રીગુરૂ-ખિમાવિજયનો શીશ,

જશ પ્રેમે પ્રણમે નિશદિન-સાં ॥૭॥

★

૧ દુરમન, ૨ પોકાર, ૩ નજરથી, ૪ સૂર્ય, ૫ અધકાર

(૧૨૨૪) (૫૧-૧૮) શ્રી અરનાથ-જિન સ્તવન

(મારો મુજરો લોને રાજ-એ દેશી)

મારા સાહિબ ! શ્રીઅરનાથ ! અરજ સુણો એક મારી ।

પ્રભુજી ! પરમ કૃપાલ, ચાકરી ચાહું તોરી ।

ચાકરી ચાહું પ્રભુ-ગુણ ગાઉં,

સુખ અનંતા પાઉં-મારાં ॥ ૧ ॥

જિન-ભગતે જે હોવે રાતા, પામે પર-ભવ શાતા ।

પ્રભુ-પૂજાએ આગસુ થાતા,

તે દુઃખીયા પર-ભવ જાતા-મારાં ॥ ૨ ॥

પ્રભુ-સહાયથી પાતક ધૂળે, સારી શુભ મતિ સૂઝે ।

તે દેખી ભવિયજી પ્રતિ-ખૂઝે,

વળી કર્મ-રોગ સવિ રૂઝે-મારાં ॥૩॥

સામાન્ય-નરની સેવા કરતાં, તો પણ પ્રાપતિ થાય ।

તો ત્રિભુવન-નાયકની સેવા,

નિશ્ચય નિષ્કળ ન જાય-મારાં ॥ ૪ ॥

સાચી સેવા જાણી પ્રાણી જે જિનવર આરાધે ।

શ્રી ખિમાવિજય પય પામી પુણ્યે,

જરા-સુખ લહે નિરાખાધે-મારાં ॥૫॥



(૧૨૨૫) (૫૧-૧૯) શ્રી મલ્લિનાથ-જિન સ્તવન

(સિદ્ધારથના રે નંદન વિનવું-એ દેશી)

સેવો મલ્લિ-જિનેસર મન ધરી, આણી હલટ અંગ ।

નિત નિત નેહ નવલ પ્રભુશું કરો,

જેહવે^૧ ચોલનો રંગ-સેવો ॥૧૧॥

જિણે પામી વહી નરભવ દોહિલો, નવિ સેવ્યા જગદીશ ।
તે તો દીન-દુઃખી ઘર-ઘર તણાં,

કામ કરે નિશદ્વિશ-સેવો ॥ ૨ ॥

પ્રભુ સેવ્યે સુર સાંનિધ્ય ઇહાં કરે, પર-ભવ અમરની રિદ્ધ ।
ઉત્તમ કુલ આરજ-ક્ષેત્ર લહી,

પામીયે અ-અવિચલ સિદ્ધ-સેવો ॥૩॥

પ્રભુ-ઠરિસણુ દેખી નવિ ઉલ્લસે, રોમાંચિત જસ દેહ ।
ભવ-સાગર ભમવાતું બાણીયે,

પ્રાપ્તે કારણુ તેહ-સેવો ॥ ૪ ॥

જિન-મુદ્રા દેખીને જેહને, ઉપજે અભિનવ હર્ષ ।
ભવ-દવ તાપ શમે સહી તેહનો,

જિમ વૂઠે રપુક્રખર-વર્ષ^૨ સેવો ॥૫॥

તુમ ગુણુ ગાવા રે જિહ્વા ઉલ્લસે,

પુણ્ય-પંદૂર હોય જસ ।

ખીજ કલેશ-નિંદા-વિકથા-ભર્યાં,

કરે પરની અરદાસ-સેવો ॥૬॥

ગિર્યો સાહિબ સહેજે ગુણુ કરે, આપે અ-વિચલ કામ ।
શ્રીગુરૂ ખિમાવિજય-પય સેવતાં,

સકલ ફલે જશ-ઉકામ સેવો ॥ ૭ ॥

૧ વાટેલી મજાઠ, ૨ પુષ્કરાવર્તનો વરસાદ, ૩ ઇચ્છા,

(૧૨૨૬) (૫૧-૨૦) શ્રી મુનિસુવ્રત-જિન સ્તવન

(આતમ ભક્તિ મિલ્યા કેઈ દેવા-એ દેશી)

શ્રી મુનિસુવ્રત-શ્યામી હો ! જિનજી, સુણ સેવકની વિનતી,
આ ભવ-સાગરથી તાર હો ! જિં,

કરું તુજને બહુ ^૧મીનતિ ।

તુજ સમ અવર ન કાય હો ! જિં,

જે આગળ જઈ ભચીએ ।

જે નવિ પામ્યા પાર હો ! જિં,

તે દીઠે કિમ રાચીએ ?-શ્રીં ॥૧॥

જે હોવે ધનવંત હો ! જિં તે અવરને ઉદ્ધરે,

આપ હોવે નિરધન હો ! જિં કિમ બીજને સુખ કરે ! ।

પામી સુરતરૂ સાર હો ! જિં,

કુણ જઈ આવલ બાથ ભરે ?

સ્તન ચિંતામણિ છાંડ હો ! જિં,

કહો કુણ કાય કરે ધરે ! શ્રીં ॥૨॥

રશાલ-દાલ લહી ઠસાર હો ! ^૪કુકસ-લોજન કુણ જમે ?,

ગંગા-જલ ઉવેખ હો ! જિં છિલ્લર-જલ કે કિમ ગમે ?,

પરિહરી ^૫પાધરો પંથ હો ! જિં ^૬ઉવટ-^૭વાટે કુણ ભમે ?,

તિમ તુજ આદરી સેવ હો ! જિં

અવર દેવ જઈ કુણ નમે ? શ્રીં ॥૩॥

૧ આજીજી-પ્રાર્થના ૨ ઉત્તમ ચોખા, ૩ શ્રેષ્ઠ ૪ હલકું, ૫ સીધો,

૬ ઉજજડ, ૭ રસ્તે,

હવે મુજ વાંછિત આપ ! હો ! જિં,

આશા ધરી હું આવીયો,

તાહરે તો બહુ દાસ હો ! જિં,

મુજ ચિત્ત જુંહીજ લાવીયો ।

આપશો ! આખર દેવ હો ? જિં તો શી ઢીલ કરો ? તમે,

માગવા ચોટી મોજ હો ! જિં,

કિમ અવસર લહેશું ? અમે-શ્રીં ॥૪॥

માટે થઈ મહેરબાન હો ! જિં વેગે મુઝને તારીયે,

કુમતિ પડી છે કેડ હો ! જિં તેહને સાહિબ વારીયે ।

વિષ-ધર ચાર કપાય હો ! જિં તેહનો ભય નિવારીયે,

શ્રીખિમાવિજય-પય-સેવ હો ! જિં

લહી જશ કહે કિમ હારીયે ? શ્રીં ॥૫॥



(૧૨૨૭) (૫૧-૨૧) શ્રી નમિનાથ-જિન સ્તવને

(સુમતિનાથ ગુણશું મિલીજી-એ દેશી)

એકવીશમા જિન આગલેજી, અરજ કરું કર જોડ ।

આઠ અરિએ મુજ બાંધીયોજી, તે ભવ-બંધન-તોડ-

-પ્રભુ ! પ્રેમ ધરીને અવધારો અરદાસ ॥૧॥

એ અરિથી અલગા રહ્યાજી, અવર ન દીસે દેવ ।

તો કિમ તેહને જાચીયેજી ?

કિમ કરું તેહની સેવ ?-પ્રભુ ॥૨॥

હાથ-વિલાસ વિનોદમાંજી, લીન રહે સુર જેહ ।

૧ આપે અરિ-ગણુ વશ પડયાળ,

અવર ઉગારે કિમ તેહ ?-પ્રભુ ॥૩૩॥

૨ છત હોય તિહાં જાયીયેલ, અ-છતે કિમ સરે કાજ ? ।

ચોગ્યતા વિષુ જાયતાંલ,

પોતે ગુમાવે લાજ-પ્રભુ ॥ ૪ ॥

નિશ્ચય છે મન માહુરેલ, તુમથી પામીશ પાર ।

પણુ ભુખ્યો ભોજન-૩ સમેલ.

૪ લાણે ન ટકે લગાર-પ્રભુ ॥ ૫ ॥

તે માટે કહું તુમ લણીલ, વેગે કીજે સાર ।

આખર તુમહીજ આપશેલ,

તો શી કરો હવે વાર ?-પ્રભુ ॥૬૬॥

મોટાનાં મનમાં નહીલ, ૫ અરથી ઉતાવળો થાય ।

શ્રી ખિમાવિજય-ગુરુ નામથીલ,

જગ જશ વાંછિત થાય-પ્રભુ ॥૭૭॥



(૧૨૨૮) (૫૧-૨૨) શ્રી નેમિનાથ-જિન સ્તવન

(કુંથુ જિનેસર જાણુ જોરે લાલ-એ દેશી)

શૌરીપુર સોહામણું રે-લાલ,

સસુદ્રવિજય નૃપ-નંદ રે-સોલાગી ।

શિવાદેવી માતા જનમીયો રે-લાલ,

હરિસણુ પરમાનંદ રે-સો

૧ પોતે, ૨ ચીજની છૂટ, ૩ સમયે, ૪ જમવા બેઠા પછી, ૫ ગરબ વાળો.

—નેમિ-જિનેસર વંદિયે રે લાલ ॥૧॥

જોખન વય જખ જિન હુઆ રે-લાલ,

આયુધ-શાળા આય રે-સોં ।

શંખ શખ્દ પૂર્યો જઠા રે-લાલ,

ભય-ભાંત સહુ તિહાં થાય રે-સોં નેમિં ॥૨॥

હરિ હર્ષે એમ ચિંતવે રે-લાલ,

એ બલિયો નિરધાર રે-સોં ।

કેવ-વાણી તખ ધંમ હુએ રે લાલ,

બ્રહ્મચારી વ્રત-ધાર રે-સોં નેમિં ॥૩॥

અંતેઉરી સહુ લેલી થઈ રે-લાલ,

જલ-શ્રૃંગી કર લીધ રે-સોં ।

મૌન પછે જખ જિન રહ્યા રે-લાલ,

“માન્યું-માન્યું” એમ કીધ રે-સોં નેમિં ॥૪॥

ઉત્રસેન -રાય તણી સુતા રે-લાલ,

જેહનું રાજુલ નામ રે-સોં ।

જાન લેઈ જિતવર ગયા રે-લાલ,

ફલ્યો મનોરથ તામ રે-સોં નેમિં ॥૫॥

પશુય પોકાર સુણી કરે રે-લાલ.

ચિન્ત ચિંતે જિનરાય રે-સોં ।

ધિત્ર ! વિષયા-સુખ કારણે રે-લાલ,

ખહુ જીવનો વધ થાય રે-સોં નેમિં ॥૬॥

તોરણથી રથ ફેરીયો રે-લાલ, ઢેઈ વરસી ઢાન રે-સોં ।

સંજમ-મારમ આદર્યો રે-લાલ,

પામ્યા કેવળ-જ્ઞાન રે-સોં નેમિં ॥૭૧॥

“અવર ન ઈચ્છું ઈચ્છુ લવે” રે-લાલ,

રાજીલો અભિગ્રહ લીધ રે-સોં ।

પ્રભુ પાસે વ્રત આદરી રે-લાલ,

પામી અ-વિચળ રિદ્ધ રે-સોં નેમિં ॥૮૧॥

ગિરનાર ગિરિવર-ઉપરે રે-લાલ,

ત્રણ કલ્યાણક જોય રેં ।

શ્રીગુરૂ ખિમાવિજય તણો રે-લાલ,

જશ જગ અધિકા હોય રે-સોં નેમિં ॥૯૧॥



(૧૨૨૯)(૫૧-૨૩) શ્રી પાર્શ્વનાથ-જિન સ્તવન

(શ્રીઅરજિન ભવજળનો તાર-એ દેશી)

પાસ-જિનેસર પુણ્યે મલીયો, રહેજો સુરતરૂ ફલીયો રે-

-પ્રભુ પુરિસાદાણી,

અનંત ગુણ-મણિખાણી-પ્રભુ પુરિસાદાણી ।

-ધન્ય દિવસ ! મુગ આજથી વલીયો,

જિન શાસનમાં ભલીયો રે-પ્રભું ॥૧॥

સમર્યો સંકટ સહુના ચૂરે, સાચો વાંછિત પૂરે રે-પ્રભું ।

પ્રભુ-પદ પામી જે રહે દ્રરે,

તે તો પરભવ ઝુરે રે-પ્રભું ॥૨॥

કષ્ટ કરંતા ઉઘઠને વારી, નાગને થયા ઉપગારી રે-પ્રભું ।

અં ૧-સમય નવકાર-ઠાટારી,

તિથે હુઓ સુર અવતારી રે-પ્રભુ ॥૩૧॥

છાંડી ભોગ-સંભોગ અસાર, આદરે મહાનત-ભાર રે-પ્રભુ ॥
કમઠે કોપે મૂકે જળધાર,

ધ્યાનથી ન ચડ્યા લગાર રે-પ્રભુ ॥૪૧॥

ઘાતી-કર્મ તણા કરી નાશ, કેવળ લહી ઉલ્લાસ રે-પ્રભુ ॥
અણહુતે કોટી એક એક પાસે,

દેવ કરે અરદાસ રે-પ્રભુ ॥૫૧॥

આઠ મહા-પ્રાતિહાય જિરાજે,

ઉપમા અવર ન છાજે રે-પ્રભુ ॥

પાંત્રીશ ગુણ વાણીયે ગાજે,

ભવિના સંશય ભાજે રે-પ્રભુ ॥૬૧॥

અનેક જીવને પાર ઉતારી,

આપ વર્યા શિવનારી રે-પ્રભુ ॥

શ્રી ખિમાવિજય-પય-સેવા સારી,

જશ લેવા દિલ ધારી રે-પ્રભુ ॥૭૧॥



(૧૨૩૦) (૫૧-૨૪) શ્રી મહાવીરસ્વામી-જિન સ્તવન

(તાર હો તાર પ્રભુ ! મુજ સેવક ભણી-એ દેશી)

વીર વડ-ધીર મહાવીર મોટો પ્રભુ,

પેખતાં પાપ સંતાપ નાશે ॥

જેહના નામ ગુણ-ધામ બહુ માનથી,

અ-વિચલ લીલ હૈયે ઉલ્લાસે-વીર ॥૧૧॥

કર્મ-અરિ હુપતો હીપતો વીર ! તું,
 ધીર પરિવહ સહે મેરૂ-તોલે ।
 સુરે બલ પરખીયો રમત કરી નિરખીયો,
 હરખીયો નામ મહાવીર ઓલે-વીર૦ ॥૨॥
 સાપ ચંડકોશીયો જે મહા-શૈલીયો,
 પોષીયો તે સુધા-નયન-પૂરે ।
 એવડા અવશુષ્ક શા પ્રભુ મેં કર્યા ?
 તાહરા ચરણથી રાખે દૂરે-વીર૦ ॥૩॥
 શૂલપાણિ-સુરને પ્રતિબોધીયો,
 ચંદના ચિત્ત ચિંતા નિવારી ।
 મહેર ધરી ઘેર પહોતા પ્રભુ જેહને
 તેહ પામ્યા લવ-હુઃખ પારી-વીર૦ ॥૪॥
 ગૌતમાદિકને જઈ પ્રભુ તારવા
 વારવા યજ્ઞ મિથ્યાત્વ ખોટો ।
 તેહ અગિયાર પરિવારશું બુઝવી,
 રૂઝવી રોગ-અજ્ઞાન મોટો-વીર૦ ॥૫॥
 હવે પ્રભુ ! મુજ લણી તું ત્રિભુવન-ધણી,
 દાસ-અરદાસ સુણી સામું જોવે ।
 આપ-પદ આપતાં આપદા કાપતાં,
 તાહરે અંશ ઓછું ન હોવે-વીર૦ ॥૬॥
 ગુરૂ-ગુણે રાજતા અધિક દિવાજતા,
 છાજતા જેહ કલિકાલમાંહે ।

શ્રીખિમાવિજય-પય-સેવ નિત્યમેવ લહી,
પામીયે' શમરસ સુજશ ત્યાંહે-વીર૦ ॥૭॥

કલશ

જિન ભગતિ જાણી ગુણખાણી, હરખ આણી જે ગાવશે ।
સિદ્ધિ-રિદ્ધિ-સુ-લદ્ધિ-લીલા,

તેહ જગ જસ પાવશે ॥ ૧ ॥

તપગચ્છ-તિલક સમાન સોહે,

સત્યવિજય ગુરુ ગુણ-નીલો ।

તસ સીસ સોહે કપુરવિજય,

કપૂર પરે જગ જસ લલો ॥ ૨ ॥

તસ ચરણ-સેવી નિત્યમેવી, ખિમાવિજય ગુરુ-રાણ્યો ।

શ્રી નારંગ-પાસ-પસાય ગાતાં,

જશ મહિમા જગ છાણ્યો ॥૩॥

સંજમ-લેહે^{૧૭} સંવતનેજાણી, પ્રવચન આંકજ જાણીયે,

ધરમલેહે^૪ જુગતે જોડી,

વરસ (૧૭૮૪) સંજ્યા વખાણીયે ॥ ૪ ॥

અદ્વપમતિ યથાશક્તિ, રહી પાટણુ રયો જિન સ્તુતિ ।

ભાદ્રવા વદી પાંચમ દિને, ગુરુવારે હુઈ પ્રાપતિ ॥૫॥

શ્રી જશવિજયજી કૃત ચોવિંશી સંપૂર્ણ

શ્રી વર્ધમાનસ્વામિને નમઃ
 શ્રી જ્ઞાનવિમલ સૂરીશ-રચિત
 જિન-સ્તવન ચોવીશી
 (અપૂર્ણ*) (૫૨)

(૧૨૩૧) (૫૨-૧) શ્રી આદીશ્વર-જિન સ્તવન.
 (રાગ-રામકલી)

તુમ દરિસણુ ભલે ! પાયો ! પ્રથમજિન ! તુમં ॥
 નાભિ-નરેસર-નંદન નિરૂપમ,

માતા મરૂદેવી-ભયો-પ્રભું ॥૧૧॥

આજ અમીયરસ જલધર ઘર વૂંઠ્યો,

માનું ગંગા-જલ નાહ્યો ।

સુરતરૂ-સુરમણી-પ્રમુખ અનોપમ,

તે સવિ આજ મેં પાયો-પ્રભું ॥૧૨॥

જુગલા-ધર્મ-નિવારણુ ! તારણુ, જગ-જન મંડપ-વાહ્યો ।

પ્રભુ ! તુજ શાસન-વાસન-શકતે,

અંતર વૈરી હરાયો-પ્રભું ॥૧૩॥

* આ ચોવિશીમાં ૪, ૬, ૭, ૮, ૧૨મા પ્રભુનું સ્તવન નથી મળ્યું,
 પણ સંગ્રહની દૃષ્ટિએ અપૂર્ણ પણે ચોવિશી અહીં પ્રકાશિત કરી છે.
 ૧ જગતના જીવો માટે મંડપ તુલ્ય,

કુશુર-કુદેવ-કુધર્મ-કુવાસન, કાલ અનંત વહાયો ।

મેં પ્રભુ ! આજથી નિશ્ચય કીનો,

સો મિથ્યાત ગમાયો-પ્રભુ ॥૪॥

ઘેર-ઘેર વિનતી કરું ઈતની, તુમ સેવા-રસ પાયો ।

જ્ઞાનવિમલ-પ્રભુ સાહિબ સુ-નજરે,

સમકિત પૂરણ સવાયો-પ્રભુ ॥૫॥



(૧૨૩૨) (૫૨-૨) શ્રી અજિતનાથ-જિન સ્તવન

અજિત-જિન ! તુમ શું પ્રીતિ બંધાણી-અજિત ॥

જિતશત્રુ-નૃપ-નંદન ૧નંદન,

ચંદન-શીતલ વાણી-અજિત ॥ ૧ ॥

રમાત-ઉદર વસતે પ્રભુ ! તુમથી, અચરિત એક કહાણી ।

સોગઠ-પાશે રમતે જીત્યો,

પ્રીતમ વિજયા-રાણી-અજિત ॥ ૨ ॥

તુંહી નિરંજન રંજન-જગ-જન,

તુંહી અનંત-ગુણ-ખાણી ।

પરમાનંદ પરમ-પદ-દાતા,

તુજ-સમ કેા નહિં નાણી !-અજિત ॥૩॥

ગજ-લંછન કંચન-વાન-અનુપમ, માનું સોવન^૩-[પંગાણી ।

તુજ વહન પ્રતિબિંબિત શોભિત,

વંદત સુર ઇદ્રાણી-અજિત ॥૪॥

૧ મનને પ્રસન્ન કરનાર, ૨ ગર્ભાવાસમાં રહ્યા, ૩ સોનાથી રંગ્યા હોય તેમ,

અજિત - જિનેશ્વર ! કેશર-૪ ચરચિત,

કેમલ કમલ-સમ-પાણી ।

જ્ઞાનવિમલ-પ્રભુ-ગુણ-ગુણ લણ્ણતાં,

શિલ-સુખ-રચણી ખાણી-અજિત ॥૫૧॥



(૧૨૩૩) (૫૨-૩) શ્રી સંભવનાથ-જિન સ્તવન

સાહિબ ! સાંભળો રે ! સંભવ ! અરજ અમારી,

ભવો-ભવ હું ભમ્યો રે, ન લહી સેવા તુમારી ।

નરક-નિગોદમાં રે તિહાં હું બહુ-ભવ ભમિયો,

તુમ વિના દુઃખ સહ્યાં રે,

અહો નિશ ક્રોધે ધમધમિયો-સાહિબ ॥૧॥

ઇન્દ્રિય-વશ પડ્યો રે, પાલ્યાં મત નવિ સૂસે,

ત્રસ પણુ નવિ જણ્યા રે, હણીયા થાવર રહુંશે ।

મત ચિત્ત નવિ ધર્યાં રે ખીજું સાચું ન બોલ્યું,

પાપની ગોઠડી રે,

તિહાં મેં હર્ષહર્ષ બોલ્યું-સાહિબ ॥ ૨ ॥

ચોરી મેં કરી રે, ય્યકવિહ અદત્ત ન ટાલ્યું,

શ્રીજિન-આણુધું રે, મેં નવિ સંજમ પાલ્યું ।

૪ મધુકર તણી પરે રે, શુદ્ધ ન આહાર ગવેખ્યો,

રસના-લાલચે રે, નીરસ-પિંડ ઉવેખ્યો-સાહિબ ॥૩॥

૪ પૂગ્નએલ-વિલેપાયેલ,

૧ ખંત રાખી, ૨ હોંશથી, ૩ સ્વામી અદત્ત, તીર્થંકર અદત્ત,

૭વ અદત્ત, ગુરુ અદત્ત, ૪ ભમરો, ૫ આહાર,

નરભવ દોહિલો રે, પામી મોહ-વશ પડિયો,
 પરમી દેખીને રે, મુજ મન તિહાં જઈ અડિયો ।
 કામ ન કો સર્યાં રે, પાપે કપિંડ મેં ભરીઓ,
 સૂધ-બુધ નવિ રહી રે,
 તેણુ નવિ આતમ તરીઓ-સાહિબં ॥૪૧॥

લક્ષ્મીની લાલચે રે, મેં બહુ દીનતા દાખી,
 તો પણુ નવિ મલી રે મલી તો નવિ રહી રાખી ।
 જે જન અલિલપે રે, તે તો તેહથી નાશે,
 તુણુ-સમ જે ગણે રે,
 તેહની નિત રહે પાસે-સાહિબં ॥ ૫ ॥

ધન ધન તે નરા રે, એહનો મોહ વિછોડી-
 વિષય નિવારીને રે, એહને ધર્મમાં જોડી ।
 અભક્ષ્ય તે મેં ભખ્યાં રે, રાત્રિભોજન કીધાં-
 વ્રત નવિ પાળીયાં રે, જેહવાં મૂળથી લીધાં-સાહિબં ॥૬૧॥

અનંત ભવ હું ભમ્યો રે, ભમતાં સાહિબ મલીયો-
 તુમ વિના કોણુ દિયે રે, બાધિ-રચણુ મુજ બલિયો ।
 સંભવ ! આપજો રે ચરણુ-કમલ તુમ સેવા-
 નય એમ વિનવે રે,
 સુણજો દેવાધિદેવા !-સાહિબં ॥ ૭ ॥



(૧૨૩૪) (૫૨-૫) શ્રી સુમતિનાથ-જિન સ્તવન

તુમ હો બહુ-ઉપગારી ! સુમતિ-જિન ! તુમ હો ૦ ।

મેઘ-નૃપ-નંદન આનંદન,

મંગલા-માત તુમારી-સુમતિ ૦ ॥ ૧ ॥

પંચમ-જિન પંચમી-ગતિદાતા પંચ-મહાવ્રતધારી ।

પંચ-વિષય-વિકારરહિત જિન,

પંચમ-નાણુ-વિચારી-સુમતિ ૦ ॥ ૨ ॥

પ્રભુ ! તુમ દરિસણુ નિશ્ચય કીનો, સેવું સેવા તુમારી ।

સુમતિ-સુવાસ વસી મન-ભીતર,

કયા કરે કુમતિ બિચારી ?-સુમતિ ૦ ॥ ૩ ॥

જથું ઘૃત દૂધ સુવાસ કુસુમમેં, પ્રીતિ બની એક-તારી ।

દિલ ભરી દેખી મેરે સાહિબકો,

રવિસરે કોણુ અ-વિચારી ?-સુમતિ ૦ ॥ ૪ ॥

સુરતરૂ-સુરમણિથી તુમ આણુ, અધિક લગી મોહે ખ્યારી ।

જિણુથી દૂરે ગઈ ભવ-ભવકી,

દુરગતિ-હમસે અટારી-સુમતિ ૦ ॥ ૫ ॥

તીન ભુવન મનમોહન સાહિબ, સેવે સુર-નરનારી ।

જ્ઞાનવિમલ-પ્રભુ-ચરણુ શરણુકી,

બડેં મૈં બલિહારી સુમતિ ૦ ॥ ૬ ॥



(૧૨૩૫) (૫૨-૮) શ્રી ચંદ્રપ્રભ-જિન સ્તવન

(રાગ-મુજરો નયણારો-એ દેશી)

શ્રીચંદ્રપ્રભ-જિનરાજજી, ચંદ્રપુરી જસ વાસ ।

ચંદ્રકિરણથી ઉજલો રે, કાંઈ! પ્રસર્યો જગે જશવાસ,

મુજરો છે મહારો-સુણુ જિનરાજ !

-સવિ શિરતાજ

-સવિ મુજ કાજ

-સીધલા આજ-મુજરો ॥૧॥

ચંદ્રલંછન ચંદ્ર-રૂચિ વાન,

કાંઈ! ચંદ્ર-શીતલ દીદાર-મુજરો ॥

સૂરતિ સુંદર સોહિએ રે,

ત્રિભુવન-મોહનગાર-મુજરો ॥ ૨ ॥

જિણુ દિનથી તુમને શિર ધર્મા રે,

કાંઈ! તિણુ દિનથી જયકાર-મુજરો ॥

કલ્પતરુ ધર-આંગણે રે,

કાંઈ તિહાં નહિ દુઃખ-સંસાર-મુજરો ॥૩॥

જિણે કાનને રહે કેશરી રે,

કાંઈ તિહાં નહિ દુષ્ટ-પ્રચાર-મુજરો ॥

જિહાં દિનકર-કર વિસ્તરે રે,

કાંઈ તિહાં નહિ તિમિર-વિકાર-મુજરો ॥૪॥

ભુજંગ-પરાભવ તિહાં નહિ રે,

કાંઈ તિહાં પુષ્કર-જલધાર-મુજરો ॥

તિષ્ઠ-પરે પ્રભુ ! તુમ્હે ચિત્ત વસે રે,

કાંઈ ન રહે પાપ લગાર-મુજરોં ॥૫॥

મહસેન-નૃપ-કુલ ચંદ્રો રે,

કાંઈ લક્ષ્મણા-માત-મદહાર-મુજરોં ।

અદમ-ચંદ્ર સવિ સુખ કરે રે,

કાંઈ અચરિજ એહ ઉદાર-મુજરોં ॥૬॥

.....

.....-મુજરોં ।

નયન-ચકોરા ઉલ્લસ્યા રે,

કાંઈ નિરખી તુમ દિદાર-મુજરોં ॥૭॥

જ્ઞાન-વિમલ ચઢતી કળા રે,

કાંઈ તાહરી અ-ક્ષય અ-પાર-મુજરોં ।

અનુભવ-સુખ સહેજે મિલે રે,

કાંઈ એહ પ્રભુ-ઉપગાર-મુજરોં ॥૮॥



(૧૨૩૬) (૫૨-૧૦) શ્રી શીતલનાથ-જિન સ્તવન

શીતલ-જિન ! સોહામણો-માહરા બાહુડા !

હુલારાવે નંદા-માય-માહરા નાનડીયા ।

રત્ન-સમોવડી તું અછે-મારાં,

દીઠે અમ સુખ થાય-મારાં ॥૧॥

મુખડે ચંદ હરાવિયો-માહરા બાહુડા,

તેજે સૂરજ કોડી-મારાં ।

રૂપ અનોપમ તાહરું-મારાં,

અવર ન તાહરી જોડી-મારાં ॥૨॥

આંખડી કમલની પાંખડી-મારાં, ચાલે હાર્યા હંસ-મારાં ।
તુજથી અમ સોલાગીયા-મારાં,

પવિત્ર કર્યો અમ વંશ-મારાં ॥૩૩॥

જે ભાવે તે સુખડી-મારાં, લિયો આપું ધરી નેહ-મારાં ।
ખોલામાંહી બેસીયે-મારાં,

તું અમ મનોરથ-મેહ-મારાં ॥ ૪ ॥

અમીય-સમાણે બોલડે-મારાં, બોલે ચતુર-સુજાણ-મારાં ।
ભામણડે હું તાહરે-મારાં,

તું અમ જીવન-પ્રાણ-મારાં ॥૫૫॥

ખમા-ખમા મુખે ઉચરે-મારાં,

જીવે કોડિ-વરિસ-મારાં ।

જ્ઞાનવિમલ-જિન માવડી મારા,

દિયે એમ નિત આશીષ-મારાં ॥૬૬॥



(૧૨૩૭) (૫૨-૧૧) શ્રી શ્રેયાંસનાથ-જિન સ્તવન

(નીંદલડી વેરણ હુઈ રહી-એ દેશી)

શ્રીશ્રેયાંસ-જિણુંદનું, મેં નિરખ્યું હો ! અપૂરવ મુખ-ચંદ તો ।
નયન-ચકોરા ઉલ્લસ્યા,

સુખ પામ્યા હો ! જિમ સુરતર-કંદ તો-શ્રીં ॥૧૧॥

૧બિહુ-પખે પૂરણ સર્વદા,

ત્રિભુવનમાં હો ! એ પ્રગટ પ્રકાશતો ।

૧ પ્રભુજી જાને પક્ષે=માતૃપક્ષ અને પિતૃપક્ષ, અગર વ્યવહારથી
નિશ્ચયથી, ચંદ્ર તો શુક્લપક્ષમાં પૂર્ણ થાય-કૃષ્ણપક્ષમાં ઘટે ।

ઉદયકરણ અહનિશ અછે,

વળી કરતો હો ! લવિ-કુમુદ-વિકાશતો-શ્રીં ॥૨॥

રદોષાકર કદીએ નહિં,

નિ-કલંકી હો ! નહિં જલધિ-પ્રસંગ તો !

અમિત્ર ઉદય કરે અતિ ઘણો,

૪ પક્ષપાતી હો ! નહિ જેહ અ-સંગ તો-શ્રીં ॥૩॥

તેજ થકી સવિ પતમ હરે,

નવિ રૂંધે હો ! વાહલ જસ છાયતો !

શુર-બુધ જન સેવે સદા,

શુભ-કામે હો ! ધરે તાસ સહાયતો-શ્રીં ॥૪॥

અનુભવ^૬-જલનિધિ-ઉદલસે,

આનંદિત હો ! હોઈ ! લવિજન^૭-કોકતો !

સરસ-સુધારસ-વયણથી,

વળી નાશે હો ! મિથ્યા-મત-શોક તો-શ્રીં ॥૫॥

જ્ઞાનવિમલ-પ્રભુતા ઘણી,

જસ નામે હો ! હોઈ અધિક આણુંદતો !

વિષ્ણુ-નૃપતિ-કુલ-દિન^૮-મણિ,

અગીઆરમે હો ! વંદુ જિનચંદ તો-શ્રીં ॥૬॥

★

૨ દોષાકર=ચંદ્ર પણ પ્રભુજ દોષના, આકર=ખાણ નથી, ૩ ચંદ્ર તો મિત્ર=સૂર્યનો અસ્ત થાય ત્યારે ઉગે, પણ પ્રભુજ તો મિત્રભાવે અહુનો ઉદય કરનારા છે, ૪ ચંદ્ર તો પક્ષ=કૃષ્ણપક્ષમાં પાતી=પડવા-વાળો, ક્ષીણ કલાવાળો, પણ પ્રભુજ પક્ષપાતી=રાગ-દ્વેષવાળા નથી, ૫ અંધકાર, ૬ સમુદ્ર, ૭ ચક્રોરપક્ષી, ૮ સૂર્ય.

(૧૨૩૮) (૫૨-૧૩) શ્રી વિમલનાથ-જિન સ્તવન
(દેશી-મોતીડાની)

વિમલ-જિનેશ્વર જગતને પ્યારો,

જીવન-પ્રાણુ આધાર હમારો ।

સાહિબા ! મોહ વિમલ-જિણુંદા,

મોહના ! ૧શમ-સુરતરૂ-કંદા-સાહિબાં ॥૧॥

સાત રાજ અલગો જઇ વસીયો,

પણ મુજ ભક્તિતણો છે રસીયો-સાહિબાં ॥૨॥

મુજ રચિત અંતર કયું કરી મસી,

સેવક સુખીએ પ્રભુ-શાખાસી-સાહિબાં ॥૩॥

આલસ કરશે ને સુખ દેવા,

તો કુણ કરશે ? તુમચી સેવા-સાહિબાં ॥૪॥

મોહાદિક-ઘેલથી ઉગારો,

જન્મ-જરાના દુઃખ નિવારો-સાહિબાં ॥૫॥

સેવક-દુઃખ ને સ્વામી ન લાંબે,

પૂરવ-પાતિક નહી મુજ યમંબે-સાહિબાં ॥૬॥

તો કુણ ખીને આશા પૂરે,

સાહિબ કાંઇ ઇચ્છત પૂરે-સાહિબાં ॥૭॥

જ્ઞાનવિમલસૂરિ જિનગુણ ગાવે,

સહેજે સમકિત-ગુણ બહુ પાવે-સાહિબાં ॥૮॥



૧ સમતા ૩૫ કલ્પવૃક્ષના મૂળ સમા, ૨ ચિત્તમાંથી, ૩ દુરમન
સેનાથી, ૪ દુર થાય.

(૧૨૩૮) (૫૨-૧૪) શ્રી અનંતનાથ-જિન સ્તવન

(જિન રશ્મિ વડા રે-એ દેશી)

અનંત-જિણુંદશું રે, કીધો અ-વિહુડ નેહ,

ખિણુ-ખિણુ સાંભરે રે, જિમ ચાતક-મન મેહ ।

તે તો સ્વારથી રે, આ પરમારથ હોય,

અનુભવ-લીલમાં રે,

૧લીણ્યો ૨ભેદ ન હોય-અનંતં ॥ ૧ ॥

સહજ-સ્વભાવથી રે, સહુના છો રે ! આધાર,

કિમ કરી પામીયે રે ? મોટા દિલતણો પાર ।

પણ એક આશરો રે, પામ્યો છે નિરધાર,

સુ-નજરે જોયતાં રે, કીધા બહુ ઉપગાર-અનંતં ॥૨॥

જિન ! ગુણ તાહરા રે, લખીયા કિમહિ ન જાય !,

ભવ ને ભવાંતરે રે, ઉપાઠે પણ ન કહાય,

આતમ-દર્પણે રે, પ્રતિજિંખ્યા સવિ તેહ ।

ભક્તિ-પ્રભાવથી રે અચરિજ મોટું છે, એહ-અનંતં ॥૩॥

કે કોઈ હાણી છે ! રે, કે કોઈ બેસે છે ? દામ,

એક ગુણ તાહરો રે, હેતાં કહું કિશું સ્વામી ।

ખોટ ન તાહરે રે, થાશે સેવક-કામ,

યશ તુમ વાધશ્યે રે, એક-ક્રિયા દોઝ-કામ-અનંતં ॥૪॥

અરજ સુણી કરી રે, સુ-પ્રસન્ન થઈ હવે સ્વામી,

એક ગુણ આપીઓ રે, નિર્મલ તત્વ-શ્રદ્ધાન ।

૧ દૂબેલાને, ૨ આંતર, ૩ બોલી જવા રૂપે,

શક્તિ-સ્વભાવથી રે, નાઠા દુશ્મન દૂરિ,
વાંછિત નીપન્યા રે,

ઇમ કહે જ્ઞાનવિમલ સૂરિ. ॥ અં ॥ ૫ ॥

(૧૨.૩૯) (૫૨-૧૫) શ્રી ધર્મનાથ-જિન સ્તવન
(રાગ-રામગિરિ)

ધર્મ-જિન વરદ-દરસણુ પાચો, પ્રબલ-પુણ્યે આજ રે ।
માતું ભવ-જલ^૧રાશિ તરતાં,

જડયું જંગી-જહાજ રે-ધર્મ^૦ ॥૧॥

સુકૃત-સુરતરૂ સહેજે કૃણીયો, રૂઢિત ટલ્યો વેગરે ।

ભુવન-પાવન સ્વામી મિશ્યો,

ટાલ્યો સકલ ઉદ્દેગ રે-ધર્મ^૦ ॥ ૨ ॥

નામ સમરૂં રાત-દિહા, પવિત્ર જિહાં હોઈ રે ।

ફરી ફરી મુજ એહ ઓહા,

નેહ-નયણે જોઈ રે-ધર્મ^૦ ॥ ૩ ॥

તુંહિ માતા તુંહિ ત્રાતા, તુંહિ બ્રાતા સયણ રે ।

તુંહિ સુરતરૂ તુંહિ સદૃશરૂ,

નિમુણી સેવક-વયણ રે-ધર્મ^૦ ॥૪॥

આપે વિલસો મુખ અનંતા, રહ્યા દુઃખથી દૂર રે ।

ઇષ્ટ પરે કિમ શોભા લેશો,

કરો દાસ યહજુર રે-ધર્મ^૦ ॥ ૫ ॥

એમ વિચારી ચરણ-સેવા, દાસને ઘો દેવ રે ।

૧ સમુદ્ર, ૨ પાપ, ૩ ઇચ્છા, ૪ સેવામાં,

જ્ઞાન-વિમલ જિણુંદ-ધ્યાને,

લહે સુખ નિત્યમેવ રે-ધર્મં ॥ ૬ ॥



(૧૨૪૦) (૫૨-૧૬) શ્રી શાંતિનાથ-જિન સ્તવન

(રાગ-ધન્યાશ્રી-કડખો)

તાર ! મુજ તાર ! મુજ તાર ! જિનરાજ ! તું,

આજ મેં તોહિ દીદાર પાચો ।

સકલ સંપત્તિ મિલ્યો આજ શુભ દિન વલ્યો,

સુરમણિ આજ ૧ અણચિંત આયો-તારં ॥૧॥

તાહરી આણ હું રશેવ પરે શિર વહું,

ઝનિરતો સદા હું રહું ચિત્ત-શુદ્ધિ ।

ભમતાં ભવ-કાનને સુરતઝની પરે,

તું પ્રભુ ! ઓળખ્યો ! દેવબુદ્ધિ-તારં ॥૨॥

અથિર-સંસારમાં સાર ! તુજ સેવના,

દેવના દેવ ! તુજ સેવ સારે ।

શત્રુને મિત્ર સમભાવી બેહું ગણ્યે,

લકત-વત્સલ સદા બિરુદ ધારે-તારં ॥૩॥

તાહરા ચિત્તમાં દાસ-બુદ્ધિ સદા

હું વસું, એહવી વાત ફરે ।

પણ મુજ ચિત્તમાં તુંહિ જો નિત વસે,

તો કિશું કીજીયે મોહ શૂરે ? તારં ॥૪॥

૧ અચાનક, ૨ પ્રસાદીની જેમ, ૩ તારી આગમાં રક્ત,

તું કૃપા-કુંભ ! ગતદંભ ! ભગવાન ! તું,
સકલ-વિદોષને સિદ્ધિ-દાતા ।

ત્રાણુ મુજ ! પ્રાણુ મુજ ! શરણુ આધાર તું,
તું સખા ! માત ! ને તાત ! બ્રાતા !-તાર૦ ૧૫૫

આતમરામ અભિરામ અભિધાન તુજ,
સમરતાં જન્મનાં દુરિત જાવે ।

તુજ વદન-ચંદ્રમા નિશ-દિન પેખતાં,
નયન-ચક્રાર આનંદ પાવે-તાર૦ ૧૬૫

શ્રી (વિશ્વસેન-કુળ-કમલ-દિનકર જિશ્યો,
મન વસ્યો માત અચિરા મહાથો ।

શાંતિ જિનરાજ ! શિરતાજ દાતારમાં,
અભયદાની શિરે જશ ગવાયો-તાર૦ ૧૭૫

લાજ-જિનરાજ ! અખ દાસની યતો શિરે,
અવસરે મોહશ્યું લાજ પાવે ।

પંડિતરાય કવિ-ધીરવિમલ તણે,
સીસ ગુણ જ્ઞાનવિમલાદિ ગાવે-તાર૦ ૧૮૫



(૧૨૪૧) (૫૨-૧૭) શ્રી કુંથુનાથ જિન સ્તવન
(રાગ-જીહોની દેશી)

જી હો ! કુંથુ-જિણંદ ! દયા કરી,
જી હો ! દાસતણી અરદાસ ।

જી હો ! સુણીયે સુ-પ્રસન્ન-હેજથી,

૪ તમારા માથે,

ૐ હો ! વિગતે વચન-વિલાસ-
કૃપાનિધિ ! સાહિબ ! કુંથુજિણુંદ !

ૐ હો ! તું શમ-સુરતરૂ-કંદ-કૃપાં ॥૧॥

ૐ હો ! ^૧શૂરતણા કુલે ઉપ-ન્યો,

ૐ હો ! જીતે દુશ્મન-વર્ગ^૨ !

ૐ હો ! તેહમાં અચરિજ કો નહીં,

ૐ હો ! પામ્યા જે ^૨અપવર્ગ^૧-કૃપાં ॥૨॥

ૐ હો ! ^૩શ્રી નંદનપણે રૂપનો,

ૐ હો ! પાર ન પામે કાચ !

ૐ હો ! ^૪ધૈર્ય સવિ સેવા કરે,

ૐ હો ! એહી જ અચરિજ જ્ઞેય-કૃપાં ॥૩॥

ૐ હો ! સંગ કરે સવિ ભાવનો,

ૐ હો ! તોડે તું નિસ્સંગ !

ૐ હો ! અ-ક્ષય અ-રૂપી તું સદા,

ૐ હો ! આતમ-ભાવ અ-સંગ-કૃપાં ॥૪॥

* ૐ હો ! ^૫અણુધીતા મલ-સીલ છે,

ૐ હો ! અણુ-તેડયો સુ-સહાય !

ૐ હો ! ભવ-વિષ્ણુ તુંહિ મહેશ છે,

ૐ હો ! અ-શરણુ-શરણુ કહાય-કૃપાં ॥૫॥

૧ પ્રભુજીના પિતાતું નામ છે, ૨ મોક્ષ, ૩ પ્રભુજીની માતાતું નામ શ્રીદેવી છે, તેમના પુત્ર પણે, ૪ શક્તિશાળી દેવો,

* આ ગાથા શ્રીવીતરાગ સ્તોત્ર (પ્રકાશ ૧૩ ગા. ૨ અને ૪ની ગાથા)નાં કેટલાંક પદોને યાદ કરાવે છે.

૫. વગર ધોયે પણ નિર્મળ શીલવાળા,

જી હો ! અણુ-ચિંતિત-ચિંતામણિ,

જી હો ! કરતો અધિક પસાય ।

જી હો ! સકલ સુરાસુર તાહરા,

જી હો ! પ્રણમે ! પ્રેમે પાય-કૃપાં ॥૧॥

જી હો ! સમતા-ચક્ર સાધિયા,

જી હો ! કાંતરખટ-અરિ વર્ગ ।

જી હો ! પરિસહ-સેના ઝનિર્દલી,

જી હો ! એહ સ્વભાવ નિસર્ગ-કૃપાં ॥૭॥

જી હો ! છઠો ચક્રી જે અણે,

જી હો ! સત્તરમેા જિનરાય !

જી હો ! અ-કળ સરૂપ છે તાહરે,

જી હો ! કીમહિ ન કળ્યું જાય-કૃપાં ॥૮॥

જી હો ! ધ્યાયક ભેદ થકી લહે, તુમરો સહજ સભાવ ।

જી હો ! ધ્યાનાદિક હેતે કરી,

જી હો ! પ્રગટે એકી ભાવ-કૃપાં ॥૯॥

જી હો ! અજ-લંછન કંચનવને,

જી હો ! ગજપુર નગરી જાસ ।

જી હો ! એક-ભવે પદ બિહુ તણા,

જી હો ! પામ્યા ભોગ-વિલાસ-કૃપાં ॥૧૦॥

જી હો ! જ્ઞાન-વિમલ-જિનરાજની,

જી હો ! સેવા સુરતરૂ છાય !

જી હો ! જે સેવે ભાવે સદા,

જી હો ! દર્શન-ફલ તસ થાય-કૃપાં ॥૧૧॥



૬ અંતરના, ૭ હઠાવા દીધી, ૮ બકરો,

(૧૨૪૨) (૫૨-૧૮) શ્રી અરનાથ-જિન સ્તવન

(તુજ સાથે નહીં બોલું ઋષભજી ! તેં મુજને
વિસારીજી. એ દેશી)

શ્રી અરનાથ ! સ-નાથ કરો-મુજ જાણો સેવકભાવેજી,
ભવ-ભવ-સંચિત બહુ પાતિકડાં,

જિમ તે અલગાં જાવેજી ।

કાલ અનાદિ-અનંત વહ્યો એમ, તુમ સેવા નવિ થાવેજી,
કોઈક કર્મ-વિવર-સુપસાથે,

શુભ-રૂચિ શુભ પ્રગટાવેજી ॥ ૧ ॥

તુમ શુભ-અનુભવ ધવલ-^૧વિહંગમ, લીલા કરતો આવેજી,
મુજ ^૨માનસ માનસ-સરમાંહિ, જો કબહી રતિ પાવેજી ।
વાણી-ચંચુતણે સુપસાથે, તત્વ-ખીર પ્રગટાવેજી,

નીરપરે જો અલગા દાખે, દંભ-સ્વભાવ-વિભાવેજી ॥૨॥
દર્શન પ્રીતિ ^૩સશુભ-મુકતાફલ કંઠે હાર બનાવેજી,

સહજ સંતોષ લહે તવ સમતા, વૃદ્ધરી-નાદ બજાવેજી ।
શુભમતિ-પરિણતિ હંસી સાથે ^૪કેલી કરી રતિ પાવેજી,
શુદ્ધ-હંસ-સંતતિ-નિર્માપણ,

કારણ શુભ ઉપજાવેજી ॥ ૩ ॥

કુમતિ-કમલિની-કંદ ઉખેડે શુદ્ધ-સુભૂમિ જગાવેજી,

નિશ્ચયનય-વ્યવહારે બિહુ-પખ, શોભા સમુદય થાવેજી ।
^૫કલુષ દુકુશાસન જલ નવિ સેવે, ધરતો સમતા ભાવેજી,

૧ પક્ષી, ૨ મનરૂપ માનસરોવરમાં, ૩ સારા ગુણવાળા ૪ ક્રીડા,
૫ ખરાબ, ૬ જૈનેતર દર્શન રૂપ પાણીમાં

જિન શાસનમાં રાજહંસ-સમ,

આતમ-નામ ધરાવેજી ॥ ૪ ॥

એવો અનુભવ-હંસ તે પરખે, જે પ્રભુ ધ્યાને ધ્યાવેજી,

બાહ્યાચરણ ૭ છારોદક-સરિખાં તેહને દાય ન આવેજી ।

ગુણી-જન-સેવા ને તુમ આણી, હેજે રસ ચિત્ત ધ્યાવેજી,

જ્ઞાનવિમલસૂરિ નૂર-મહોદય,

દિન-દિન અધિકો થાવેજી ॥ ૫ ॥



(૧૨૪૩) (૫૨-૧૯) શ્રી મલ્લિનાથ-જિન સ્તવન

લાછલદે-માત-મલ્હાર-એ દેશી)

મલ્લિજિનેસર-દેવ ! સારે સુર-નર સેવ,

આજ હો ! જેહનો રે મહિમા મહિમાંહે ગાજતોજી ॥૧॥

નીલવરણ જસ છાય, પણવીશ ધનુષ્યની કાય-

આજ હો ! આયુ રે પંચાવન વરસ સહસનુંજી ॥

કુંભ-નરેસર તાત, પ્રભાવતી જસ માત,

આજ હો ! દીઠે રે આનંદિત હોયે ત્રિભુવન-જનાજી ॥૩॥

લંછન-મિથે રહ્યો કુંભ, તારક ગુણથી અ-દંભ,

આજ હો ! એહવા રે ગુણ વસીયા આવીં તેહમાંજી ॥૪॥

જ્ઞાનવિમલ-ગુણ-નૂર, વાધે અતિ-મહપૂર-

આજ હો ! પાવે રે મનવંછિત પ્રભુના નામથીજી ॥૫॥



૭ ખારા પાણી,

(૧૨૪૪) (૫૨-૨૦) શ્રી મુનિસુવ્રત-જિન સ્તવન

મુનિસુવ્રત-જિનવર વીશમા,

ભરૂચ બંદર ગુણ-મણિ-મંદિર ।

ભવિ-જન ચિત્તે વિસમ્યા,

મુનિસુવ્રત જિનવર વીશમા ॥ ૧ ॥

જિનમુદ્રા જિનવરને સરિખી, અવર નહિ કોઇ ઉપમા ।

શામલ-વરણ શરણ ત્રિહુ' જગને,

એહ સુભગતા મનોરમા-મુનિ૦ ॥૨॥

કુમતિ-કુસંગતિ કુ-અહ-બુદ્ધિ,

જેણે તુમહ પદ નવિ નમ્યા-

કાલ અનાદિ-અનંત લગે તે,

નરક-નિગોદમાંહિ ભમ્યા-મુનિ૦ ॥૩॥

તે ધન્ય તે કૃત્યપુણ્ય ભવિક-જન,

જસ ચિત્તે પ્રભુ-ગુણ રમ્યા ।

જ્ઞાન-વિમલ ગુણ નવનિધિ-સંપદા,

જેણે દુશ્મન સવિ દમ્યા-મુનિ૦ ॥૪॥



(૧૨૪૫) (૫૨-૨૧) શ્રી નમિનાથ-જિન સ્તવન

(આજ સખી સંખેસરો-એ દેશી)

નમિએ શ્રી નમિનાથને જે શિવ-સુખદાતા,

નેહ ધરીને અહનિશે જે ભવભયત્રાતા ।

વિજય-ભૂપનો ઘેટડો વપ્રાનો બાયો,

નીલ-કમલદલ-લંછનો; સુરનરપતિ ગાયો ॥૧॥

મન મોહું છે માહરું તુઝ મૂરતિ-દેખી,

સુંદરી એવી કેા નહિ તુજ સૂરતિ-સરખી ।

ઉપશમ-રસનો કુંડ છે નિરૂપમ તુઝ નયણું,

જગ-જનને હિતકારિયા જેહનાં છે વયણું ॥૨॥

વદન-પ્રસન્નતા અતિઘણી નિર્મળતા રાજે,

નિત્ય-વિરોધી જીવનાં વયરાદિક ભાજે ।

શત્રુદિક જેહને નહિ, નહિ કામવિકાર,

વાહન-પ્રમુખ ન જેહને, નહિ દોષ અઢાર ॥૩॥

પદ્માસન ઘેઠા થકાં ભવિયણુ પડિઘોઢે,

અનુપમ ગુણુ કાંઇ એહવેા સવિ જગજન મોઢે ।

વીતરાગ-ભાવે મિદ્યા રુધિરાદિક અંગે,

દૂધ-ધારપરે ઉજલા નિર્મોહ પ્રસંગે ॥ ૪ ॥

સુરભિ-ગંધ સવિ અંગના અવયવ ભલ જેના,

કમળતણા પરિમલપરે શ્વાસાદિક તેહનાં ।

લોકોત્તર-ગુણથી લલ્લો લોકોત્તર દેવ,

જ્ઞાન વિમલ-ગુણનો ઘણી જે તુમને સેવે. ॥૫॥



(૧૨૪૭) (૫૨-૨૨) શ્રી નેમિનાથ-જિન સ્તવન
રહો ! રહો રે ! ચાહવરાય ! હો ઘડીયાં,
હો ઘડીયાં હો-ચાર ઘડીયાં;
-રહો૦

૧ મોહ-મહિરાણ શિવાદેવી જાયા !

તુમે છેા આધાર અડવડીયાં-રહો૦ ॥૧૥
નાહ ! વિવાહ ચાહ કરીએ,
કયું જાવત ? ફિર રથ ચડીયાં-રહો૦ ।
પશુય પોકાર સુણીય કિય કરૂણા,
છોડી દીયે પશુ-પંખી ચડીયાં-રહો૦ ॥૨૥
ગોદ બિછાઉં મેં વારી જાઉં,
કરું વિનતિ ચરણે પડીયાં-રહો૦ ।
પીયુ વિષુ દીહા તે વરિસ-સમોવડ,
ન જમે રસેનને ડસેજડીયાં-રહો૦ ॥૩૥
વિરહ-દિવાની વિલપતી જોવન,
વાડી-વન ઘર સેરડીયાં-રહો૦ ।
અઘટ-લવાંતર નેહ નિવાહત,
નવમે લવ તે વિછડીયાં-રહો૦ ॥૪૥
સહસાવન માંહે સ્વામી સુણીને,
રાજુલ રૈવતગિરિ ચડિયાં-રહો૦ ।
પીયુજનો નિજ-શિરે હાથ દેવાવત,
ચાખે ચારિત્ર-શેલડીયાં-રહો૦ ॥૫૥

૧ મોહના ઉપક્રમમાં, ૨ સુવાતું, ૩ પલંગ,

આદ્ય-વંશ-વિભૂષણ નેમજી, શબ્દુલ મીઠી વેલડીયાં-રહોં ।
જ્ઞાનવિમલ-ગુણે કંપતી નિરખત,
હરખત હોત મેરી આંખડીયાં-રહોં ॥૧॥



(૧૨૪૮) (૫૨-૨૩) શ્રી પાર્શ્વનાથ-જિન સ્તવન
(રાગ-કડખો)

વિમલવર સકલ-ગુણ-ચયણાયડ,
પાસ સુખસાગર દરિસ પાયો ।
સહજ-આનંદ સુખકંદ અતિ ઉલ્લસ્યો
૧ઐન જિનવચન-સુખ-ચેન આયો-વિમલ ॥૧॥
શુદ્ધ ૨અનિદાન તુઝ ધ્યાન ગુણ-જ્ઞાનથી,
મુઝ ઉપાદાન પ્રભુતા પ્રકાશી !
વિકટ-મિથ્યાત્વની બાંતિ ઝનિકટે નહિ,
દૂર રહી લૌક્યતા દીન-ઠાસી-વિમલ ॥૨॥
એક સુ-વિવેક પ્રભુ નેક-નજરે કરી,
નિરખતાં હાસના દુરિત જાવે ।
૪તરણિ-કિરણે કરી કમલ વિકસિત થઈ,
૫ખહલ-પરિમલ યથા પ્રગટ થાવે-વિમલ ॥૩॥
એક મુજ ટેક અતિરેક ગુણ-ઉલ્લસી,
તુજ વિના અવર નવિ ચિત્ત ચાહું !

૧ સાક્ષાત્, ૨ નિયાણાવગરના, ૩ પાસે ન આવે, ૪ સૂર્ય, ૫ વધુ
સુગંધવાળું,

એહ પરતીત-વિધિ નીતિ ત્રિ-ઠરણ થકી દેવ !

તુમ્હ સેવ ભવે-ભવે ૬આશ હું-વિમલ ॥૪॥

દીપ નિશિ દીપ ભવ-૭સિંધુમાં બુડતાં,

ઠવપતર જેમ ૮થલે ૯અનલ ૧૦શીતે ।

તપતિ ૧૧ તરસ્યો સુધાપાન જિમ ઉલસે,

તેહયો અધિક તુમ્હ દરિસન પ્રીતે-વિમલ ॥૫॥

સિદ્ધ સુખ ૧૨ આશિકા બ્રાંતિ નિઝાશિકા,

જિહાં થકી શિર ધરી આણુ તોરી ।

૧૩અપર-પરિણુતિ ગઈ આપ-પરિણુતિ ભઈ,

જ્ઞાન-અનુભવ ૧૪ક્રિયા દોર ૧૫જોરી-વિમલ ॥૬॥

સહજ-ભકિત કરી બુગતિ હોય કમંની,

તેહનો હેતુ પ્રભુ-પાસસામી ।

કુંવર અધ્યસેન નૃપ માત વામાતણો,

પરમ આનંદ-કામી અ-કામી-વિમલ ॥૭॥

ચિત્તમાં રાખીયે યોગ્યતા-શુભ થકી,

દાસને આપનો લેખવીજે ।

જ્ઞાનવિમલાદિગુણ સુ-જસ-મહોદય હુવે,

૧૬લેદના ૧૭લેદ એકતાન કીજે-વિમલ ॥૮॥



૬ આશાવાળો, ૭ સુમુકર્મા, ૮ જમાન પર, ૯ આસ, ૧૦ ઠડીમાં, ૧૧ ઉતાળામાં ૧૨ ઉલંઠા, ૧૩, બીજાં દ્રવ્યોનો, ૧૪ ક્રિયાની દોરી, ૧૫ જોડી, ૧૬ જુદાઇનો, ૧૭ નાશ.

(૧૨૪૯) (૫૨-૨૪) શ્રી મહાવીરસ્વામી-જિન સ્તવન

(રાગ ધન્યાશ્રી)

(આજ ગઈતી હું સમવસરણમાં-એ દેશી)

વંદો વીર-જિનેસર-રાયા, ત્રિશલા-માતા-જાયાળુ ।

હરિ-લંછન કંચન-વન કાયા,

મુઝ મન-મંદિર આયાળુ-વંદો ॥૧॥

દુષમ-સમયે શાસન જેહનું, શીતલ ચંદન-છાયાળુ ।

જે સેવંતાં ભવિજન-૧મધુકર,

દિન-દિન હોત સવાયાળુ-વંદો ॥૨॥

તે ધન પ્રાણી સદ્ગતિ ખાણી, જસ મનમાં જિન આયાળુ ।

૨વંદન-પૂજન સેવા ન કીધી,

તે કાં જનની જાયાળુ ૧-વંદો ॥ ૩ ॥

૩કર્મ કટક-લેદન બલવત્તર, વીર-ખિરક જેણે પાયાળુ ।

એકલ-મદલ અતુલી-બળ અરિહા,

દુશ્મન દૂરે ગમાયાળુ-વંદો ॥૪॥

વાંછિત-પૂરણ સંકટ-ચૂરણ, તું માત-પિતા સહાયાળુ ।

સિંહ પરે આરિત્ર આરાધી,

સુજસ-નિશાન-બજાયાળુ-વંદો ॥૫॥

ગુણ અનંત ભગવંત વિરાજે, વધે માન-જિનરાયાળુ ।

ધીરવિમલ-કવિ-સેવક નય કહે,

શુદ્ધ સમક્તિ-ગુણ દાયાળુ-વંદો ॥૬॥

૧ ભમરાઓ, ૨ જેમણે આવા પ્રભુજીનું વંદન, પૂજન કે સેવા ન કરી તેઓને તેમની માતાએ જન્મ શા માટે આપ્યો ? અર્થાત્ તેમનું જીવન નકામું છે, (ત્રીજી ગાથાના ઉત્તરાર્ધનેા અર્થ) ૩ કર્મ રૂપ સૈન્યને બેદવામાં અત્યંત બળવાન

શ્રોવદ્ધમાન-સ્વામિને નમઃ

૫. શ્રી ગુણવિલાસજી કૃત

જિન-સ્તવન ચોવિશી

(૫૩)

૧૨૫૦) (૫૩-૧) શ્રી ઋષભદેવ-જિન સ્તવન

(રાગ-દેવ ગંધાર)

અખ મોહીજે તારો દીનદયાલ ।

સખહી મતમેં દેખ-૧જિત તિતર

તુમહિ નામ રસાલ-અખ૦ ॥૧॥

આદિ-અનાદિ પુરૂષ હો ! તુમહી, તુમહી વિષ્ણુ ગોપાલ ।

શિવ બ્રહ્મા તુમહીમેં સરજે,

લાંછ ગયો બ્રમ-બલ-અખ૦ ॥૨॥

મોહ-વિકલ બૂદ્યો ભવમાંહી, ફિર્યો અનંતો કાલ ।

ગુણવિલાસ શ્રી ઋષભ-જિનેસર !

મેરી કરો પ્રતિપાલ-અખ૦ ॥૩॥



(૧૨૫૧) (૫૩-૨) શ્રી અજિતનાથ-જિન સ્તવન

(રાગ-વિલાસ)

સુષુ ત્રિભુવનકે રાય ! અજિત-જિનેસર સ્વામી ।

૧ જેટલા, ૨ તેટલા. ૩ મોહથી પીડિત,

પ્રભુ! મોઢે તારો દુઃખ નિવારો,

કીજે શિવપુર ગામી-સુણુ ॥૧॥

કાલ અનાદિ ભમત મેં ન લહ્યો, નિજ-અનુભવ હિતગામી ॥

૧ પર-પરિણતિસોં માચી રહ્યો નિત,

જણ્યો ન અંતરજામી-સુણુ ॥૨॥

પરમ-પુરૂષ તુંહી પરમેસર, પુન્યે તોરી સેવા પામી ।

અખ ૨ ભ્રમભાવ-ઉમિટાવ કરો સખ,

ગુણવિલાસ જસ નામી-સુણુ ॥૩॥

(૧૨૫૨) (૫૩-૩) શ્રી સંભવનાથ-જિન સ્તવન

(રાગ-વેલાઉલ અહિયા)

સાર જગ શ્રીજિનનામ સંસાર-શ્રીં ॥

શ્રીજિન-નામ તેં વંછિત પાવે,

રિદ્ધિ સિદ્ધિ નિધિ વિસ્તાર-સારં ॥૧॥

૧ ધર ચિત્ત બાઉ ? દાઉ હૈ નીકે, લહી માનવ અવતાર ॥

મેરી વિભાવ-દશાકી પરિણતિ,

જિન-સુમિરન ચિતધાર-સારં ॥૨॥

શ્રીજિનનામ-ભજન તેં ભવિજન, બહુત-જન ઉતરે પાર ॥

ગુણવિલાસ સંભવજિન જપી લે,

સુખ આનંદ જયકાર-સાં ॥૩॥

★

૧ પુરૂષભાવની પરિણતિ સાથે, ૨ ભ્રમણાના વિચારો, ૩ દૂર.

૧ હે બાઈ! સારો દાવ છે એ ચિત્તમાં ધાર ! (ખીજી ગાથાની પ્રથમ લીટીનો અર્થ)

(૧૨૫૩) (૫૩-૪) શ્રી અભિનંદન-જિન સ્તવન

(રાગ-કાફી)

તારો મોહો સ્વામી, શરન તિહારે આયો ।

કાલ અનંતાનંત ભમંતે,

અબ મેં દરિશન પાયો-તારો ॥૧॥

તુમ શિવદાયક સબ ગુણુ-જ્ઞાયક, તારક બિરુદ ધરાયો ।

લાયક બની આણી મન ભાવન,

પાયકમલ ચિત લાયો-તારો ॥૨॥

તુમ હો નિરંજન જન-મન-રંજન, ખંજન નેન સુહાયો ।

ગુણુવિલાસ પ્રભુ જિન અભિનંદન, વંદનકો લલચાયો ॥૩॥



(૧૨૫૪) (૫૩-૫) શ્રી સુમતિનાથ-જિન સ્તવન

(રાગ-હોરવ)

તેરી ગતિ તુંહી બને, મેરે મન તુંહી હૈ ।

ઝોર સર્વ ભર્મ ભાવ, મોહબલ ચુંહી હૈ-તેરી ॥૧॥

જ્ઞાનમેં બિચાર ઠાની, શુદ્ધ બુદ્ધિ ગહી હૈ ।

આપકી પ્રસાદ પાઇ, સુઠુ દષ્ટિ લહી હૈ-તેરી ॥૨॥

ચંદ જ્યેાં ચકોર પ્રીતિ, એસી રીતિ ગ્રહી હૈ ।

આદિ-અંત એક રૂપ, તોસોં હોઇ રહી હ-તેરી ॥૩॥

૧ ખંજન પક્ષીની જેવી સુંદર આખો શોભે છે. (ત્રીજી ગાથાની બીજી લીટીનો અર્થ)

એ કયાલ બહુત ખાત, કહી બત નહી હે ।

તાર હો ! સુમતિનાથ ગુણવિલાસ વહી હૈ-તોરી ॥૪॥



(૧૨૫૫) (૫૩-૬) શ્રી પદ્મપ્રભ-જિન સ્તવન

(રાગ-આસાઉરી દેવગંધાર)

પ્રભુજી ! તુમારી અ-કથ કહાની ।

દાન બિના સખ જેર કીએ હૈ,

સુર-નર જગકે પ્રાની-પ્રભુ ॥ ૧ ॥

૧નિર-અંબર સુંદર સહજહી, બિનુ સંપતિ રખધાની ।

ક્રોધ બિના સખ કર્મ વિનાશે,

અ-પઠિત બડે વિજ્ઞાની-પ્રભુ ॥૨॥

રાગ બિના સખ જગત-જન તારે, શુદ્ધ અક્ષર સુવાની ।

ગુણવિલાસ પ્રભુ પદ્મજિનેસર,

કીજે આપ-સમાની-પ્રભુ ॥૩॥



(૧૨૫૬) (૫૩-૭) શ્રી સુપાર્શ્વનાથ-જિન સ્તવન

(રાગ-રામકલી)

પૂર મનોરથ સાહિબ મેરા,

અહનિશિ સુમરન કરું હું તેરા-પૂર ॥૧॥

૧અંતરાય અરિ રદ્ધો ઘેરી,

તાકો તતધીન ૨કરહું નિવેરા-પૂર ॥૨॥

૧ કપડાં વિના ૧ અંતરાય રૂપી શત્રુ, ૨ નાશ,

ભવ-વન માંહે ભર્યો બહુ તેરા,
 પુણ્ય-સંભોગે લલ્યો તુમ ઝડેરા-પૂરં ॥૩॥
 ગુણવિલાસ પ્રભુ ટારો ફેરા,
 દીજે મુપાસણ યપાસ બસેરા-પૂરં ॥૪॥



(૧૨૫૭) (૫૧-૮) શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન

(રાગ-રામકલી)

ચંદ્ર પ્રભ ઉર આન હો ! ભવિકજન ! ચંદ્રં ।
 દરસન-ચંદનતે અતિ-શીતલ,
 ઉજવલ ચંદ્ર સમાન હો-ભવિકં ॥૧॥
 ચંદ્ર સરાગી પ્રભુ નિરાગી,
 જાગત-જ્યોતિ અમાન હો-ભવિકં ॥૨॥
 રાહુ મલિન કરે નિત રાશિકો,
 સોયે ધરે પ્રભુ-ધ્યાન હો-ભવિકં ॥૩॥
 સદા ઉદિત સંપૂરણ સ્વામી,
 વાકે કલા વરૂદ-હાનિ હો-ભવિકં ॥૪॥
 નિરખત અનુપમ અમૃત વરસે,
 મોહ-તિમિર-હર ભાન હો-ભં ॥૫॥
 ગુણવિલાસ પ્રભુકે ચરનાંબુજ, સેવે સુરરાજન હો-ભં ॥૬॥



૩ આશરો ૪ પાસ રહેવાનું. ૧ ચંદ્રને,

(૧૨૫૮) (૫૩-૯) શ્રી સુવિધિનાથ-જિન સ્તવન.

(રાગ-વિલાહલ સુહજ)

ઇહવિધ સુવિધિ-જિનંદકા, લખી રૂપ ઉદારા ।

હૃદય-કમલમેં ધ્યાઈયે, લહિયે ભવપારા-ઈહીં ॥૧॥

અશન-વસન બાંકે નહી, નહિ મદન-વિકારા ।

ભય-વરજિત આયુધ ખિના, કરનીસોં ન્યારા-ઈહીં ॥૨॥

લિંગ નહિ સંજા નહી વરણ-વિચારા ।

નિરંજન પરમાત્મા, સો દેવ હુમારા-ઈહીં ॥૩॥

બ્રહ્મા વિષ્ણુ મહેસરો, પરમેસર પ્યારા ।

ગુણવિદ્યાસ શ્રીજિનરાજસેં, જિન રાગ નિવારા-ઈહીં ॥૪॥



(૧૨૫૯) (૫૩-૧૦) શ્રી શીતલનાથ-જિન સ્તવન.

(રાગ-ગાડી)

આજ મેં પુણ્ય-ઉઠે પ્રભુ દીઠો ।

શીતલ ચિત્ત ભયો અબ મેરો,

પ્રશમ્યો મોહ ૧અંગીઠો-આજ ॥૧॥

ઐસો રંગ લાગ્યો જિનજીસોં, જૈસો ચોલ મજીઠો ।

ના બાનું કબ નૈનનકે પથ,

હૃદયમેં આનંદ પઈઠો-આજ ॥૨॥

સો નિજ-રૂપ મેં આજ પિછાન્યો, જો અમૃતે મીઠો ।

ગુણવિદ્યાસ શીતલ જિન નિરખત,

પાતક-પંક શું ૨નીઠો-આજ ॥૩॥



૧ બઢી ૨ આવી રીતે દુર થયો;

(૧૨૬૦) (૫૩-૧૧) શ્રી શ્રયાંસનાથ-જિન સ્તવન

(રાગ-મહાર)

મહિર કરેા માહારાજ, હમ પર-મહિર૦ ।

તુમ બિન સુખ-દુઃખ અંતરગતકી,

કિસ આગે કહો જાય ?-હમ૦ ॥ ૧ ॥

અપને સેવકકું સખ ચાહે, તુમ કયેાં રહે હો ? બુલાય ।

જો કછુ ચૂક પરી 'હે હમપે',

તો દીજે રખકસાય-હમ૦ ॥ ૨ ॥

તુમ હો ! સખલ નિખલ હમ સ્વામી ! જોર કછુ ન બસાય ।

સોઈ ભાત કરો તુમ સાહિબ !

જો કછુ આવે દામ-હા૦ ॥ ૩ ॥

એસો કૌન સંદેશેા શિવપુર, જો આવે પહુંચાય ।

ગુણવિલાસ શ્રેયાંસ કૃપા કરી,

દીજે પાસ બુલાય-હમ૦ ॥ ૪ ॥



(૧૨૬૧) (૫૩-૧૨) શ્રી વાસુપૂજ્યસ્વામી-જિન સ્તવન

(રાગ-સોરઠ તથા સામેરી)

પ્રભુજી ! તેરી પરતીત ન જાની ।

૧મીનતિ વીનતિ કરી થાકયો,

તુમ મનમે' કછુ રના'ની-પ્રભુજી૦ ॥ ૧ ॥

૧ થઈ હોય, ૨ માફી આપો, ૧ આજીજી, ૨ ન આપી,

ઔર અનેક વિવેક-રહિત જે, ૩માંસભખી ૪મદપાની ।
ખિનુ વિચાર સંસાર-ઉદ્ધિતે,

પાર ઉતારે પ્રાની-પ્રભુજી ॥ ૨ ॥

મેરી ઘેર કહા ભયે સાહીબ, આજ-કાલકે ઠાની ।
તારક બિરૂદ ધરાઈ જગતમે,

કૌન ૫સયનપ ઠાની-પ્રભુજી ॥ ૩ ॥

અબ તો તારોહી બની આવે, ઔર વાત સબ ૬કાની ।
ગુણવિલાસ શ્રી વાસુપૂજી,

દ્યો શિવપુર-રજધાની-પ્રભુજી ॥ ૪ ॥



(૧૨૬૨) (૫૩-૧૩) શ્રી વિમલનાથ-જિન સ્તવન
(રાગ-જેજેવંતી)

વિમલ વિમલ મલ-રહિત સકલ કલ ।

અમલ કમલ-દલ, સમ વપુ વાસકી-વિમલ ॥૧॥

નયન વિશાલ ભાલ, પલકન હિલચાલ ।

અચરિજ નાહી ખ્યાલ, લોકલોક ભાસકી-વિમલ ॥૨॥

તેહકી ન રેહ બાકે, લચનસુ દેહ વાકે ।

સમતાકો ગેહ વાકે, નાહી વાસ આશકી-વિમલ ॥૩॥

સુરપતિ આપ આઈ, શુતિ કરે ગાઈ ગાઈ ।

કહા લોં બખાની બય, સુગુણ-વિલાસકી-વિમલ ॥૪॥



૩ માંઆહારી, ૪ મદિરા પીનારા, ૫ શાણપ-હોંશિયારી, ૬ નકામી

(૧૨૬૩) (૫૩-૧૪) શ્રી અનંતનાથ-જિન સ્તવન
(રાગ-વસંત)

મેરે હૃદય કમલ કુલ્યો વસંત,
જખતેં મેં જાન્યો જિન અનંત-મેરેં ॥૧॥
જાકે જસ-પરિમલહ મહંત,
મેરો મન-મધુકર તહાં રૂન ઝુનંત-મેરેં ॥૨॥
કરૂણા કરી તારો જગજંત,
નિજ-રસમેં રાચે શુદ્ધ સંત-મેરેં ॥૩॥
સુખ દરસન જ્ઞાન સુશક્તિવંત,
શ્રી ગુણુવિલાસ શિવ-રમણીકંત-મેરેં ॥૪॥



(૧૨૬૪) (૫૩-૧૫) શ્રી ધર્મનાથ-જિન સ્તવન
(રાગ-સારંગ)

મન ધ્યાન સદા જિનકો ધરં ।
પ્રીતિ-પ્રતીતિ ધરી ચિત અંકર,
એક તુંહી તુંહી કરં-મનં ॥૧॥
જગકે મૂલ ચેતનકો, રાગાદિક-અરિ પરહરં ।
સ્તનત્રય ગુણુનિરમલ કરકે,
હરગતિ હુખમેં નાપરં-મનં ॥૨॥
જિનવર નામ ધ્યાન-નાવા ચઢી,
૧અ-ગમ ૨અ-તર ભવજલ તરૂ ।

૧ ન સમજી શકાય તેવો, ૨ ન કહી શકાય તેવો

ગુણવિલાસ ધર્મનાથ કૃપા કર,

શિવ-કમલા હેલા વરૂં મન૦ ॥૩૥



(૧૨૬૫) (૫૩-૧૬) શ્રી શાંતિનાથ-જિન સ્તવન

(રાગ-લલિત)

ભવિજન ! સેવો શાંતિ-જિનંદ ।

કંચન-ખરન મનોહર મૂરતિ,

દીપત તેજ ૧દિષ્ટકં-ભવિ૦ ॥ ૧ ॥

પંચમ ૨ચક્રધર સોલમ જિનવર,

વિશ્વસેન-નૃપ-કુલ-ચંદ-ભવિ૦ ॥ ૨ ॥

ભવ-દુઃખભંજન જન-મન-રંજન,

લંછન મૃગ સુખકંદ-ભવિ૦ ॥ ૩ ॥

ગુણવિલાસ પદ-પંકજ ભેટત,

પાયો પરમાનંદ-ભવિ૦ ॥ ૪ ॥



(૧૨૬૬) (૫૨-૧૭) શ્રી કુંથુનાથ-જિન સ્તવન

(રાગ-ટોડી)

અખ મેરી પ્રભુશું પ્રીત લગીરી ।

ઘનસૌ મોર ચકોર શશિ જ્યૌ,

કમલ મધુપ જ્યૌ પુષ્પ પગીરી-અખ૦ ॥૧॥

૧ સૂર્ય, ૨ ચક્રવર્તી,

હિનકરકો ચકવી જ્યોં આહે, ત્યોં ચેરે મન આન જગીરી ।
 ગુણુવિલાસ કુંથુજિન દેખત,
 દિલકી દુવિધા દૂર જગીરી-અખ૦ ॥૨૧॥



(૧૨૬૭) (૫૩-૧૮) શ્રી અરનાથ-જિન સ્તવન
 (રાગ-શ્રીરાગ)

ભજ ભજ રે મન અર-ચરનં ।
 ભવ-જલ પતિત ઉધારન ભવિકો,
 ૧ તરની જ્યોં તારન-તરનં-ભજ૦ ॥૧॥
 નમિત-અમર-ગણુ શીશ મુકુટ મણી,
 તાકીર ઘુતિ આધકી ધરન ।
 વિપતિ-વિદારક સંપતિ-કારક,
 પૂરવ-સંચિત ૩ અઘહરનં-ભજ૦ ॥૨॥
 ૪ ધતિ અનીતિ ૫ ઉદંગલ વારક,
 નિત નવનવ મંગલકરનં ।
 ગુણુવિલાસ મુર-કિન્નર વંદિત,
 ૬ ભીતજનાં અસરન-સરનં-ભજ૦ ॥૩॥



૧ વહાણની પેઠે, ૨ કાંતિ, ૩ પાપ હરનાર, ૪ ઉપદ્રવ, ૫ ઉત્પાત
 ૬ ડરેલા મનુષ્યો અથવા જેને કોઈનું શરણ નથી એવા તે આપ
 શરણ ૩૫ છો.

(૧૨૬૮) (૫૩-૧૯) શ્રી મલિલનાથ-જિન સ્તવન

(રાગ-કનરો)

મેરે તુમહી હો સ્વામ ! ધ્યાવતહું^૧ વસુ જનમ-મેરે ॥૧॥

અન્યદેવ જે હરિ-હરાદિક,

નહી તિનસોં કછુ કામ-મેરે ॥૨॥

તુમ સુખ-સંપતિ શાતાહાતા,

તુમહી હો ગુણગ્રામ-મેરે ॥ ૩ ॥

ગુણવિલાસ મલિલજિન કિરપા કર,

૨જીઅ પાવે વિસરામ-મેરે ॥૪॥



(૧૨૬૯) (૫૩-૨૦) શ્રીમુનિસુવ્રતસ્વામી-જિન સ્તવન

(રાગ-યમન-કલ્યાણ)

સુણુ મોરે સ્વામી અંતરજામી,

જનમ જનમ તુમ દાસ કહાઉં-સુણુ ॥૧॥

અન્ય દેવકી શરન ન કરી હો,

તુમ ચરનકી સેવા ચિત ધરી હો-

શ્રીમુનિસુવ્રત તુમ ગુન ગાઈ-સુણુ ॥૨॥

ગુણવિલાસ નિહચે કરી માનો,

સાચો સેવક અપનો જાનો,

જો કહું સો વંછિત ફલ પાઈ-ગણુ ॥૩॥



૧ આઠ પહોર, ૨ જીવ.

(૧૨૭૦) (૫૩-૨૧) શ્રી નમિનાથ-જિન સ્તવન

(રાગ-નદ)

હો નમિજિન ! મેં નિજ રૂપ ન જાન્યો ।

^૧અ-વિકલ્પી ^૨અ-જ ^૩અ-જર ^૪અ-જલ્પી,

અ-ચલ -અ-મલ મન માન્યો-હો નમિં ॥૧॥

પરકો રૂપ સરૂપ નિહારત, મનમેં અતિ હરખાન્યો ।

પુલ્કલસોં સળ દેખી પસારો,

તાહીમેં ભરમાન્યો-હો નમિં ॥૨॥

નરભવ પાય ^૫અકારથ જોયો, જોયો ખીજ અ-જાન્યો ।

જ્ઞાનદષ્ટિ ધરી રૂપ ન જોયો

સોયો નિંદ અ-યાન્યો-હો નમિં ॥૩॥

કાલ અનાદિ અવિદ્યા-સંગતિ, નિજ-પરભાવ ન ઠાન્યો ।

ગુણવિદ્યાસ પર અળ કિરપા કરી,

જયોં સુધ પરત પિછાન્યો-હો નમિં ॥૪॥



(૧૨૭૧) (૫૩-૨૨) શ્રી નમિનાથ-જિન સ્તવન

(રાગ-માર)

નેમિ ! મોહે ^૧આરત તેરી હો !

તુમ દરસન ણિતુ ચિહુંગતે,

સહી પીઠ ઘનેરી હો-નેમિં ॥૧॥

^૧ વિકલ્પરહિત, ^૨ જન્મ-મરણ વગરનો, ^૩ જેને ઘડપણ આવે નહિ એવો, ^૪ કલ્પના-ખોલવાના ચાળા રહિત, ^૫ નકામો.

^૧ ચિંતા,

૩૬

કરમ-અરિ મિલ્લી એકઠે, રાખ્યો હું ઘેરી હો ।

અહુવિધ નાચ નચાવીયો,

મન^૨હુવિધા ઘેરી હો-નેમિં ॥ ૨ ॥

અનંત પરાવર્તન કીયે, ભમતે ભવ ફેરી હો

ગુણવિલાસ જિન સામીજી,

અળ ખખર લો ! મેરી હો-નેમિં ॥૩॥



(૧૨૭૨) (૫૩-૨૩) શ્રી પાર્શ્વનાથ-જિન સ્તવન

(રાગ-કેદારો)

પ્રભુ ! મેરે ! કર એસી ^૧બકસીસ !

દ્વાર દ્વારન પર ના ભટકો,

^૨નાઉં કીસહી ન સીસ-પ્રભું ॥ ૧ ॥

શુધ આતમ-કલા પ્રગટે, ઘટે રાગ અરૂ રીસ ।

૩મોહ ફાટક ખુલે ^૪છીનમે,

રમે જ્ઞાન અધીસ-પ્રભું ॥ ૨ ॥

તુમ અન્નર્ધળ પાસ સાહિબ, જગપતિ જગદીશ ।

ગુણવિલાસકી આશ પૂરો, કરો આપ સરીસ-પ્રભું ॥૩॥



૨ ગૂંચ.

૧ વરદાન આપો, ૨ નમાવું, ૩ મોહ કમાડ-ઝાંપો, ૪ ક્ષણમાં,

(૧૨૭૩) (૫૩-૨૪) શ્રી મહાવીર-જિન સ્તવન
(રાગ-જૈતસીરી)

મનમેં નિરમલ ભાવ ગહી ।

સુર-નર-કિન્નર કોટિ નિસેવિત,

૧સો જિન રસેકેં ૩ સહી.-મન૦ ॥૧॥

અદ્ભુત કાંતિ શાંતિરસ રાજિત, ૪વસુરસ સંગ નહીં ।

નિરદ્વપણ ભૂષણ બિનુ ભૂષિત,

૫રવિછમી લાજત સહી.-મન૦ ॥૨॥

ભવિજન-તારક શાસન જાકો, જાને સકલ મહી ।

ગુણવિલાસ મહાવીરકી મહિમા,

કિસપેં જાન કહી ?-મન૦ ॥ ૩ ॥



કલશ

(રાગ-ધન્યાસીરી)

ઇષ્ટ વિધ ચૌવીસે જિન ગાયે ।

ઋષભ-અજિત-સંભવ-અભિનંદન,

સુમતિ-પદમપ્રભુ ધ્યાયે-ઇષ્ટ૦ ॥૧॥

સુપાસ-ચંદ્રપ્રભ-સુવિધિ-શીતલ-શ્રેયાંસ,

વાસુપૂજ્ય-મન લાયે ।

વિમલ-અનંત-ધર્મ-શાંતિ-કુંથુ-અર,

મસ્તિ-મુનિસુવત લાયે-ઇષ્ટ૦ ॥૨॥

૧ તે, ૨ સેવું, ૩ નક્કો, ૪ ધનનો રાગ. ૫ સૂર્યની કાંતિ,

શ્રીનમિ-નેમિ-પાસ-વીરજી, ગુણ કરી એક મિલાયો ।

નિજ-નિજ તીરથકે સખ કરતા,

યાતે' મિનન કહાયો-છણું ॥૩૧॥

સંવત સત્તર ૧૭૬૭ સતાણવે વરસે,

માઘ શુકલ દુતિઆયો ।

જેસલમેર નયરમે' હરથે,

કરી પુરન સુખ પાચો-છણું ॥ ૪ ॥

પાઠક શ્રી સિદ્ધિવર્ધન સદ્ગુર,

જિહિ વિધિ રાગ ખતાયો ।

ગુણવિલાસ પાઠક તિહિ વિધસોં,

શ્રી જિનરાજ મદ્દહાયો-છણું ॥૫૧॥



શ્રી વર્ધમાનસ્વામિને નમઃ
 શ્રી જગજીવનકૃત ચોવીશી
 જિન-સ્તવન ચોવીશી
 (અપૂર્ણ*) (૫૪)

(૧૨૭૪) (૫૪-૧) શ્રી ઋષભદેવ-જિન સ્તવન
 વિમલ નયરી વિનીતા વર વંદીયે, ઇંદ્રપુરી-અનુહારી ।
 નાલિનરેશ નરપતિ રનીકા,
 જિનપદ જન જયકારી. ॥ ૧ ॥
 ઝમો મન મોહ્યો રે લાલ, પ્રભુ ! પ્રભુતાર્યે' લટકે ।
 આદીશ્વર અનુલવનો રક્ષીયો,
 વલ્લભ મનડે' વસીયો-મો મન૦ ॥૨॥
 ૪વિબુધ-ભુવન સુખ વિલસીને' વરદ,
 આઇ-જિણુ' અવતરીયા ।
 ઇંદ્ર આદેશ થકી સુર પધનદે,
 રથણુ ઈનિકેતન લરીયા-મો મન૦ ॥૩॥
 પ્રથમ વૃષભ સુપનો પેખીને', હૃદય નૃપતિ નિરધારી ।
 ધરમ-ધરાદિક કારય ધરચ્યે',
 ઋષભ-કુંઆર સુખકારી-મો મન૦ ॥૪॥

૧ અનુસરતી=જેવી, ૨ સુદર, ૩ મારા, ૪ દેવોનું લવન=સ્પર્શ.
 ૫ કુખેરે, ૬ ધર.

જગનાયક યૌવન વય જાણી, સુનંદા-સુમંગલા રાણી ।

૭૦૫ાહુ ભઘવા કરી જિનવર વરીયા,

સુખ વિલસેં શુભ-ખાણી-મેા મન૦ ૥૫૥

દેવ લોકાંતિક અવસર દેખી, જઇ જિનવર વિનવીયા ।

ધર્મધોરી કરુણારસ-સાગર,

તારક વૃતરી જિન ભવિયાં-મેા મન૦ ૥૬૥

પઠમ-જિજ્ઞેસર પઠમ-નરેસર, પઠમ-સ્થિતિકારી ।

પઠમ-તીરથપતિ પઠમ-૧૦મથનરતિ,

પઠમ પ્રતી પ્રતધારી-મેા મન૦ ૥૭૥

વરસીદાન દેઇ જિન લીની, નિરૂપમ સંયમ-નારી ।

મુનિ-મારગ તારક મન સુધેં,

કરમ હરન લય વારી-મેા મન૦ ૥૮૥

પરમ-શુકલ શુભ ધ્યાનથી પ્રભુજી, પામ્યા કેવલ કમલા ।

અમરપતિ આદરશું ઓલગે,

વિબુધ વદે શુભ વિમલા-મેા મન૦ ૥૯૥

અપૂર્વ ચોરાસી લખ પૂરવ આયુ, પાલી પહોતા મુગતે ।

જન જાણે જિનવર જિન-તાને,

તો જિન પદ જિન શુભ ભગતે-મેા મન૦ ૥૧૦૥

પેરખિંદર સંઘ-સુખકરુ સોહે, શુરમક્તિ કરેં ભક્ત ભાવે ।

સંવત અઠાર સીધી શ્રાવણ માસેં,

ગણી જગજીવન શુભ ગાવેં-મેા મન૦ ૥૧૧૥



૭ વિવાહ, ૮ ઈંદ્ર, ૯ નાવ, ૧૦ રતિ=વિષમ વાસનાના મથન=દૂર કરનારા.

(૧૨૭૫) (૫૪-૨) શ્રી અજિતનાથ-જિન સ્તવન

અજિત-જિનેસર સેવીયેં રે-પ્રભુ વાલાણ,

તું તો અજિતકરણ જગદેવ-જિન લટકાલાણ ।

લવબ્રાંતિ લમતાં થકાં રે-પ્રભુ વાલાણ,

શુભ લાધી જિનવર-સેવ-જિન લટકાલાણ. ૥૧૥

મનમોહન મહારાજશું રે-પ્રભુ વાલાણ,

મુઝ મિલવા મનોરથ થાય-જિન લટકાલાણ ।

નિ-રાગીસૂં નેહલો રે-પ્રભુ વાલાણ,

કહો કિણિ પરિ કીધો જાય ?-જિન લટકાલાણ. ૥૨૥

પતિત-પાવન જિન જાણીયે રે-પ્રભુ વાલાણ,

લવ-તારણ-તરણ-જિહાજ-જિન લટકાલાણ ।

ચાકર ચૂકે ચાકરી-રે પ્રભુ વાલાણ,

જિન ખાંહિ ગ્રહાની લાજ-જિન લટકાલાણ-૥૩૥

૧ વિષય-વિ-મન ૨ રૂપ વાસીયા રે-પ્રભુ વાલાણ,

૩ અલિ ! લીઠા દેવ અનેક-જિન લટકાલાણ ।

તુઝ વિણ મન માંને નહી રે-પ્રભુ વાલાણ,

એહવી લવ-લવ મુઝ મન-ટેક-જિન લટકાલાણ. ૥૪૥

ખીર સાગર^૪વન ક્વાદીઓ રે-પ્રભુ વાલાણ,

૫ દધિ ^૬લવણુ ભુવન ન સુહાય-જિન લટકાલાણ ।

નંદનવન રમ્યા આનંદશું રે-પ્રભુ વાલાણ,

થિર મન ન કરીર-વન થાય-જિન લટકાલાણ ૥૫૥

૧ વિષયોથી વિચિત્ર છે મન જેતું, ૨ રૂપથી ખેંચાએલ, ૩ હે સખિ !

૪ પાણી, ૫ સમુદ્ર, ૬ ખારો ૭ કેરડાતું વન,

વિનય યુગતિ કરી વિનતી રે-પ્રભુ વાલાજી,
 કૃપાનિધિ બાણી વયણ કંઠાય-જિન લટકાલાજી ।
 પોર ચોમાસું અતિ ઉમંગે રે-પ્રભુ વાલાજી.
 ગાણી જગજીવન ગુણ ગાય-જિન લટકાલાજી. ॥૬॥



(૧૨૭૬) (૫૪-૩) શ્રી સંભવનાથ-જિન સ્તવન

સકલ સુરાસુર-^૧સંકર, કિંકર જસ નરરાયાજી ।
 સંભવ સમ્યક્ શિવ-સુખ-દાયક.
 લાયક જિન મન ભાયા-સંભવ સ્વામીજી ॥૧॥
 ભવ-ભય-ભંજન ^૨અઘ-મલ-મંજન,
 ગંજન અરિહલ કર્મજી ।
 જ્ઞાન-દિવાકર જગત-પ્રભાકર,
 ધારક જગમાં ધર્મ-સંભવ સ્વામીજી ॥૨॥
 પતિત-ઉદ્ધારણ ભવોદ્ધિ-તારણ,
 કારણ તું જિન પાચોજી ।
 હીનદયાલ ઓમયાલ કૃપાનિધિ,
 ધ્યાન ધરી મન દયાથો-સંભવ સ્વામીજી ॥૩॥
 તું ૪વિધિ તું ૫બુધ તું આદેશર, પુરસોત્તમ પદ રામીજી ।
 ઈત્યાદિક ભવિ નામ જપંતા,
 પરમ યુગતિગતિ પામી-સંભવ સ્વામીજી ॥૪॥

૧ સમૂહ ૨ પાપ ૩પ મેલને દૂર કરનાર, ૩ કૃપાળુ, ૪ બ્રહ્મા, ૫ બુદ્ધ

પ્રભુ ગુણ ગરુડ તથો રવ સુષિનેં,

કુરિત પન્નમ ભય નાસેછ ।

સૌન્ય ચતુરવિધિ નાવેં અરથે,

ગંધહસ્તિને પાસે-સંભવ સ્વામીછ ॥૫૫॥

નગરી સાવશ્યી નરપતિ નિરૂપમ, છતાંરિ જસ ધારીછ ।

સોના ઉર આયુ વીવેકથી,

ત્રિભુવન-ભવ-હિતકારી-સંભવ સ્વામીછ ॥૬૬॥

દીવ ખંદર દયાનિધિ દાની, સંધ સકલ સુખકારીછ ।

સંવત અઢાર મુનિ આસો માસે,

ગણી જગભવનજયકારી-સંભવ સ્વામીછ ॥૭૭॥



(૧૨૭૭) (૫૪-૪) શ્રી અભિનંદનજિન સ્તવન

(ઢાલ બારમાસ સુરતીની)

અભિનંદન જગવંદન, જનતારક જિનરાજ ।

એકલુ-ચિત્તો આરાધતાં, હાયક શિવમુખરાજ ॥૧॥

સાયક લાયક અનંતગુણ, ક્યાયક જગજસ આણુ ।

ધરમ ધારક અધ-વારક, ઠારક અમૃત વાણુ ॥૨॥

૧ આશ્રવ-રૂપ અનાદિનો, જિન રજીપક ઉભડ જેહ ।

નાણુ નિર્મલ-ખડ્ગે કરી, દુરજન કીઓ સખ દ્વરિ ॥૩॥

૬ પાપ રૂપ સાપ, ૫ મહોન્મત્ત હાથી પાસે ચતુર્વિધ સૌન્ય પણ ગણત્રીમાં નહિ, તેમ પ્રભુ ગુણ આગળ અધા નિષ્કળ (પહેલી ગાથાના ઉત્તરાધારો અર્થ)

૧ આશ્રવરૂપ દુર્જન (ચોથા પાદમાં છે) ૨ છતાડનાર, ૩ શૂરવીર,

તું પ્રભુ ! તાત જગતતણે, ભયવારક ભગવાન ।

મિથ્યાત-તિમિર-નિવારણે, તારણે નાવ-સમાન ॥૪॥

અનંત ગુણાતમ જ્ઞાનનો, ભરીયો રચણ-નિધાન ।

જગજીવન કરુણા કરી, નાથ ! દો નિરમલ નાણ ॥૫॥



(૧૨૭૮) (૫૪-૫) શ્રી સુમતિનાથ-જિન સ્તવન.

સુમતિ સુમતિદાયક સદા-જગત ગુરુ દીવો,

રનવલ કુનિ દેવ હો !

અખય ૩અવય સુખ-સાગર-જગતગુરુ દીવો.

નીતિ નમતાં તતખેવ હો-

-મનનો મોહન શુભ ગુણનો સોહન, જિન જનપતિ

પ્રભુ મારા ! સાંભલો અમ અરદાસ હો ! ॥ ૧ ॥

દેવ સકલ મેં દેખીયા-જગત૦ કારિમા કપટના કંદ હો ।

દંભરહિત તિમ ૪દિનમણિ-જગત૦

નીકો મંગલાદેવી-નંદ હો ! ॥ ૨ ॥

આદિ અનંત સુખ સંપનો-જગત૦

આતિમગુણ શુભ કામ હો ।

૫અઠ-સહસ-લક્ષણે ઓપતો-જગત૦

ધરમધારક ગુણ ધામ હો ! ॥૩॥

વટકાય-લોકને આંતિશું-જગત૦,

અભયદાયક અભિરામ હો ।

૧ વિશિષ્ટ, ૨ વળી, ૩ શાશ્વત, ૪ સૂર્ય, ૫ આઠ અધિક હજાર
એક હજાર ને આઠ.

મન-મનોરથ ફલે' જગ મહી-જગત૦,

સમરતાં તુઝ મુઝ સ્વામ હો ॥૪૮॥

નાણુ નિર્મલ નિધિ જાણીયે-જગત૦,

ક્યાવે ધરી શુભ ધ્યાન હો ।

શિવ-રમણી લહે તે સહી-જગત૦,

નાથ અનંત તુઝ જ્ઞાન હો ॥૪૯॥

અલવેસર અવધારીયે-જગત૦, તારીયે' પાર સંસાર હો ।

ગણી જગજીવન શુણુ સ્તવે-જગત૦,

જિન જપતાં જયકાર હો ॥૫૦॥



(૧૨૭૯) (૫૪-૬) શ્રી પદ્મપ્રભ-જિન સ્તવન

(ઠાણ-મારો પ્રભુ બ્રહ્મચારી-એ દેશી)

પદ્મપ્રભ-પદ-પંકજ-સેવા,

મન મધુકર નિત હેવા રે-જિનવર ઉપગારી ।

રક્તોપલ સમ ક્ષોહિત દેહા,

ભવિમન આતક મેહારે-જિનવર ઉપગારી ॥૧॥

દોષ અઠાર રહિત પ્રભુ રાજે,

બાર શુણુ' કરી ગાજે રે-જિન૦ ।

ત્રીન ભુવનમેં આણુંદકારી,

મુમતિ વધૂ તુઝ ખ્યારી રે-જિનવર ઉપગારી ॥૨॥

તું વરદાયી શિવપદ-ગતિનો,

દાયક મુગતિ-શુપતિનો રે-જિનવર૦ ।

૧ ટેવ, ૨ લાલ પાપાણુ, ૩ શેલતું,

સરવ ભગતિને જિન ઉર ધારો,

કરુણા કરી ભવ તારો રે-જિનવર ઉપગારી ॥૩૥

તુમ ચરણેં મન જે જન આંધે,

તે આતમ સત્તા સાધે રે-જિન૦ ।

અનંત નિર્મલતા તાહરી નિરખી,

શાસ્ત્ર થકી જિન પરખી રે-જિનવર ઉપગારી ॥૪૥

નિજ આતિમ-કારજ જે સાધે,

તે જન તુમ આરાધેં રે-જિનવર૦ ।

ગુણ ગાવેં નિત ગણી જગજીવન,

પ્રભુ ! તું છે ચિંતામણિ રે-જિનવર ઉપગારી ॥૫૥



(૧૨૮૦) (૫૪-૭) શ્રી સુપાર્શ્વનાથ-જિન સ્તવન

(રાગ-ઘોડી તે આઈ થારા દેશમાં મારુજ એ-દેશી)
વણારસીનગરી વખાણીયે-તારકજી,

^૧અલકાપુરી ^૨અનુહારિ હો ।

શ્રી સુપાસ જિજ્ઞેસર સેવીયેં

નવ ઐવેયક થકી ચવી-તારકજી,

વિશાખા નક્ષત્રેં નિરધારી હો-શ્રી સુપાસ૦ ॥૧૥

રાજ કરે રક્ષીયામણો-તારકજી૦

પ્રતિઠિઠત નામે બૂપ હો-શ્રી સુપાસ૦ ॥૨૥

પૃથવી રાણી તસ જાણીયે-તા૦.

ઇદ્રાણી સમ રૂપ હો-શ્રી સુપાસ૦-

૧ કુબેરની નગરી, ૨ જેવી,

તસ ઉરે આવી ઉપના-તારકણ,

સુપન લહ્યાં દશ-ચાર હો-શ્રીં ૧

હંસ-ગમની મૃગલોચણી-તારકણ,

જઈ વીનંચો ભરતાર હો-શ્રી સુપાસં ॥૩૧॥

ભુધિ-વિન્નાણે કરી જાણીને-તારકણ,

ઉત્તર દીધો નરેશ હો-શ્રીં ૧

૩રજજવઈ રાજા જનમસ્યે-તારકણ,

સુપન તણે સુવિસેસ-હોંશ્રી સુપાસં ॥૪૧॥

૪પ્રાત સેવક પતેડી કપ્રેરીયા તારકણ,

સુપનપાઠકનેં જૂપાલ હો-શ્રીં ૧

૭વિષ્ણુ વઢે વર શાસ્ત્રથી-તારકણ,

ચક્રી વા લોક-દયાલ હો-શ્રી સુપાસં ॥૫૧॥

માસ સવાનવે જનમીયા-તારકણ,

મિથ્યા તિમિર^૮ કિરનાલ^૯ હો-શ્રી સુપાસં ૧

સંયમ લેઈ પ્રભુ પામીયા-તારકણ,

કેવલપદવી વિશાલ હો-શ્રી સુપાસં ॥૬૧॥

જિનવર જન કેઈ તારતા-તારકણ,

ઉપદેશ સંપત્તિ સવાય હો-શ્રીં ૧

વિહાર કરંતા આવીયા-તારકણ,

સમૈતશિખર ગિરિયા હો-શ્રી સુપાસં ॥૭૧॥

૨ ચૌદ, ૩ રાજ્યનો માલિક, ૪ સવારે. ૫ મોકલી, ૬ ખેલાવ્યા,
૭ પંડિતો, ૮ અંધારું ૯ સૂર્ય,

અણુસણુ કરી સિદ્ધિ પામીયા-તારકજી,

જ્યોતિ અનંત જગાય હો-શ્રી૦ ।

પોર અઠાર આઠ ફાલ્ગુને-તારકજી,

જગજીવન ગુણ ગાય હો-શ્રી સુપાસ૦ ॥૮૧॥



(૧૨૮૧) (૫૪-૮) શ્રી ચંદ્રપ્રભ-જિન સ્તવન

(અરણીક મુનીવર ચાલ્યા ગાયરી-એ દેશી)

ચંદ્રપ્રભ જિન જગ-જન-ભયહરુ, ચંદ્રવરણુ જગતાતોજી ।

પરમ વિવેકી ^૧પરમાગમપતિ,

કઠિણુ કરમ કરી ઘાતોજી-ચંદ્રપ્રભજિન૦ ॥૧॥

કાલ અનંતો ભમતાં પામીયો,

મનુજ-જનમ અવતારોજી ।

દશ દૃષ્ટાંતે રે દુર્લભ તે સહી,

^૨મુક્તિગમન ગતિ વારોજી-ચંદ્રપ્રભ૦ ॥૨॥

પરમાનંદી ^૩શ્રોત્રે સાંભલ્યો, દૃષ્ટિ વિલોકન જાણ્યોજી ।

અંતરગતિથી રે એક ચિત્તે કરી,

લક્ષિતવચ્છલ્લતા નાણોજી-ચંદ્રપ્રભ૦ ॥૩॥

તે ધન કરમે' રે કરીને' જગતમાં,

બ્રમણુ કરી દીન પ્રાણી જી ।

આણુંદ ધનનો રે ^૪અવગમ આપનો,

લણીયો નહી તે જાણો જી-ચંદ્રપ્રભ૦ ॥૪॥

૧ શ્રેષ્ઠ શાસ્ત્રોના સ્વામી, ૨ મોક્ષ ગમન દ્વારા સંસાર ટાળો, ૩ કાનથી, ૪ જ્ઞાન,

પતિત-પાવન જિન બિરુદ વહો તુમે,

પતિત પતે ભવ તારો છ ।

ધ્યાનારુઠેં રે જિનપદ પામશે,

તે ઉપગાર તમારો છ-ચંદ્રપ્રભ ॥૫૥॥

અરજ કરી પઅધ-ધન-પટલ ટાલવા,

[અવયવ] (વાયુસમ) સુખનો સાથી છ ।

નિશ્ચયે નયથી રે જે જન જાણુશ્યે,

હૃદયભિંતર નિજ નાથો છ-ચંદ્રપ્રભ ॥૫૬॥

વિનતી કીધી રે વિનય-વિવેકસું,

જગજીવનજિન સ્વામી છ ।

સંપતિ કરજ્યો હરજ્યો આપદા,

નાથ ! નમું શિર નામી છ ॥૫૭॥



(૧૨૮૨) (૫૪-૯) શ્રી સુવિધિનાથ-જિન સ્તવન

(વીર સમોસર્યા-એ દેશી)

જિન શાસન-થાપક પ્રભુ રે, કેવલજ્ઞાન-દિષ્ટદં ।

ભવ-ભય-ભંજન ગુણનિધિ રે,

તીરથનાથ જિણુંદો રે-સુવિધિજિનેસરૂ ।

પૂર્ણનિદં પ્રધાનો રે-જગ જિન ભયહર ॥૧॥

નાથ સુણી તુઝ સંપદા રે, ગાયો અનુભવ કાજ ।

સ્વ-સત્તા જાણુણુ ભણી રે,

સેવો ઓધિદ-શિરતાળે રે-સુવિધિ ॥૨॥

અ પાપ રૂપ ગ્રાહ વાદળના સમૂહને,

બાહ્ય-નિમિત્તથી સંપદા રે, પુણ્યાશ્રવણી રે બાણી ।

અંતર અંતર લેહવા રે,

ધર્મ શુદ્ધ શુભ આણુ રે-સુવિધિં ॥૩॥

તુજ વિષ્ણુ સેવક તણી રે, સાંભળે જન અરદાસ ।

ભવ-ભીરુ ભવ્ય-જીવડા રે,

ચરણ શરણ નિજ વાસ રે-સુવિધિં ॥૪॥

પર ઉપગારી જિનપતિ રે, પરમારથનો રે બાણી ।

પ્રાણ વલ્લભ મન માહરે રે,

સાહિબ તુંહિ સુબાણુ રે-સુવિધિં ॥૫॥

તાહરા ગુણ ગિરુઆ તણા રે, સુરગુરુથી ન કહાય ।

પણુ બાહ્યિક નિજ સૂઝ થકી રે,

જલધિ પ્રમાણુ કહાય રે-સુવિધિં ॥૬॥

આશ કરેં પ્રભુ ! તુમ તણી રે, અન્ય ન ધારેં દેવ,

જગજીવન ગણી ગુણુ સ્તવે રે,

ભય-ભંજન જિન-સેવ રે-સુવિધિં ॥૮॥



(૧૨૮૩) (૫૪-૧૦) શ્રી શીતલનાથ-જિન સ્તવન

(કસીયાને કાંઠ તંબૂ એ દેશી)

તું સુગણાકર સ્વામી

ઘનનામી, જિનવર સેવીયે રે-મહારા નાથજી,

સુખકર શીતલદેવ જિણુંદ

તુઝ ગુણુનેા હું રાગી,

સોભાગી જિનવર મારા નાથજી,

જગપતિ ધ્યાનથી પરમાણુંદ-તુઝ ગુણુનેા ॥૧॥

ચઉ સંપત્તિનો ધારી નિરધારી,
સંપતિ શિવ તણી હો મારાં !

કેવલ કમલા વિમલાકંત

ભગતજનનો બ્રાતા

સુદાતા જ્ઞાતા લોકને હો ! મારા નાથલ !

તુઝ મુખ વલ્લભ સંકર સંત-તુઝ ગુણનોં ॥૨૧॥

અનંત ગુણી ગુણ-આગર,

સાગર નાગર નેહશું હો-મહારા નાથલ !

ધ્યાનથી ધ્યાવેં પાવેં સીધે ।

ધ્યાતા ધ્યેયનો કારક,

ભયવારક, તારક ભવ તણો હો ! મહારા નાથલ !

નામથી પામે પ્રાણી નવનિધિ-તુઝ ગુણનોં ॥૨૩॥

તુઝ પદ પંકજ છંડી,

મન મંડી વસથી

મોહથી નેહો મહારા નાથલ !

કિલ ધર્મા લૌકિક દેવ દયાલ,

વંછિત મુખ મન ભાવક,

વરદાયક લાયક લોકને હો ! મહારા નાથલ !

જિણે તુઝ વાણી જાણી રસાલ-તુઝ ગુણનોં ॥૨૪॥

અદ્ધા અનંતનો કિરતા,

ભવ ધરતાં સાહિબ સાંભળ્યા હો ! મહારા નાથલ !

તું પ્રભુ ભકત-વરછલ જિનરાજ,

મુઝ મનવંછિત પૂરો,

અથ ચૂરો જિનવર સ્વામીજી હો ! મહારા નાથજીં ! ।

જગ જસ સાધે વાધે જ્ઞાન-તુઝ શુણુનોં ॥૫૫॥

અનંત પ્રભુતા નીરખી,

મન હરખી, આગમ સાંનિધે હો ! મહારા નાથજી ! ।

મુઝ મનમોહન સોહન સ્વામી,

ગણી જગજીવન ગાવે,

સુખ પાવે, ભગતે ભાવતાં હો ! મહારા નાથજી ! ।

મુનિ-મનરંજન શીતલ નામ-તુઝ શુણુનોં ॥૬૫॥



(૧૨૮૪) (૫૪-૧૧) શ્રી શ્રેયાંસનાથ-જિન સ્તવન

(પ્રીતડી ન કીજેં રે નારી પરદેશીયા રે-એ દેશી)

શ્રી શ્રેયાંસ-જિનેસર સાહિબા રે સુખ-સંપત્તિ દાતાર ।

આણુંદકારી નાથ નિરંજનો રે, કરુણાકર કિરતાર-

-મુજ મન મોહ્યું રે શુણુ સાંભલી રે ॥૧॥

માનવભવની સંપત્તિ દોહિલી રે, તે વલી આરજ દેશ

ઉત્તમ કુલ મર્યાદા ધરમની રે,

સદ્ગુરુ નિકટ વિશેષ-મુજં ॥૨॥

મન શુધ ભાવેં ૧ જિનવચ ધાર તું રે, વરતવું તેહ વિચાર ।

ચિત્ત ચંચલ જિન ધિર નહિ તિહાં રહે રે,

મગ મિથ્યાત અપાર-મુજં ॥૩॥

મારગ તે ઉલંધી આવીયા રે, જે પ્રભુ વાણી પાસ ।

૧ ભગવાનની વાણી,

મહેર કરી મન-મોહન તેહની રે,

જિન ! તારો નિજ દાસ-મુજ૦ ॥૪॥

પંચમ આરે ઇહાં ભવિ-ભવને' રે, તુમ રંગિરનો આધાર ।

જગજીવન જિન વચણ સાંભલી રે,

અક્ષય-નિધિ દાતાર-મુજ૦ ॥૫॥



(૧૨૮૫)(૫૪-૧૨) શ્રી વાસુપૂજ્યસ્વામી-જિન સ્તવન
(દાલ કડખાની)

વાસુપૂજ્ય જિનવરા જગતજન-ભયહર,

ગુણ અ-વ્યાભાધ કરી પ્રભુજી ગાજે ।

અતિશય ચોત્રીશ કરી વાણી પાંત્રીસ ગુણ,

આઠ પ્રતિહારજીશું વરદ રાજે-વાસુ૦ ॥૧॥

આશ કરી આવીયા જે સમીપ તુઝ તણે,

હરિત હરિદ્ર તસ દ્વરિ કીધો ।

મેટીઓ અનાદિનો દ્વરિ મિથ્યાતને,

સમ્યક્ રચણ તેણે દીધો-વાસુ૦ ॥૨॥

તેહ જાણી કરી સ્તવન રચના રચી,

મનશુધ લાવના એહ તેરી ।

જગજીવન પ્રભુ-નામ જપતાં થકાં,

સચલ સંપત્તિ મિલે અલખ કેરી-વાસુ૦ ॥૩॥



૨ વાણીનો,

(૧૨૮૬) (૫૪-૧૩) શ્રી વિમલનાથ-જિન સ્તવન

જિન વિમલ જિજ્ઞેસર, જગ પરમેસર,

અંતર જ્યાં મીલો-જિન મનમોહનજી રે લો ।
લલો લાવ ધરી મન ગાવા તુઝ, ગુણ અવસર પામી-લો ।

જિન-વિમલ૦ ॥૧૧॥

કરુણાકર જાણી શિવ 'સેનાણી, ઉલટ આણી લો-જિન૦ ।

પ્રભુ ! મુઝ લવ તારો વિઘન નિવારો,

વિશુ ગુણ ખાણી લો-જિન૦-વિમલ૦ ॥૧૨॥

લવસાગર ફિરતાં ધમિ લવ ધરતાં,

નિમિત્ત અલાવે લો-જિન૦ ।

રઆપ-પર જાણે નય પરમાણે,

સનમુખ ધાવેરે લો-જિન૦-વિમલ૦ ॥૧૩॥

મુઝ પુણ્ય-સંજોગે દુરિત-વિજોગે,

તુઝ ગિર પામી લો-જિન૦ ।

જિન ! તું ઉપગારી ઉદમ ભારી,

સમવાયની ખામી લો-જિન૦-વિમલ૦ ॥૧૪॥

સુખ અ-વ્યાખાધે, તુઝ આરાધે, સંપતિ સાધે લો-જિન૦ ।

ગુણ-વેલડી વાધે, સમ્યક્ લાધે,

તુઝ ગુણ લાધે લો-જિન૦ વિમલ૦ ॥૧૫॥

વિનતડી ધારો, સેવક તારો, પાર ઉતારો લો-જિન૦ ।

તુજ ઓલગ કીધી,કામના સીધી,

પીર મમ વારો લો-જિન૦ વિમલ૦ ॥૧૬॥

૧ નિશાની ૨ સ્વ અને પરતુ,

મન ધ્યાન ધરીને, ત્રિકરણ કરીને,

જે જન ધ્યાવેં હો-જિન૦ ।

ગણી જગજીવન ગાવેં, નિજ સદ્ભાવેં

વંછિત તે પાવેં હો-જિન૦ વિમલ૦ ॥૭૧॥



(૧૨૮૭) (૫૪-૧૪) શ્રી અનંતનાથ-જિન સ્તવન

(ઠાલ માવતણીની-એ દેશી)

અનંત-જિણેસર, જ્ઞાન-દિનેસર,

તારક જગમાંદિ જાણી રે ।

જિન જગ સ્વામી, ધનનામી, ગાસ્યું અનંત-જિણુંદો ।

પૂર્ણાનંદ પદ પાવન કરવા, ધરવા કેવલ નાણી રે ।

જિન જગસ્વામી ધનનામી ગાસ્યું અનંત જિણુંદો ॥૧૧॥

આનંદકારી વિધન-નિવારી,

અનંત અનંત ધરમધારી રે-જિન૦ ।

સમ્યક્ દાયક લાયક જિનવર,

ખિરુદ ધરે તું અઘ વારી રે-જિન૦ ॥૨॥

શિવ-સુખ-સાગર નાગર નીરખી,

હરખી લગતિ-વિશેષે રે-જિન૦ ।

શુદ્ધ નિમિત્ત જિન-શુધાતમનો,

અતુલવ ભાવ-વિશેષે રે-જિન૦ ॥૩॥

તુઝ વાણી વલ્લભ જાણી,

હૃદયે ધરેં ભવિ પ્રાણી રે-જિન૦ ।

તે જિન તારક નિજ આતમનો,

પામે યુગતિ પદ આણી રે-જિન૦ ॥૪૧॥

મહેર કરી જગ-મન-મોહનજી,

અ-અય અ-વ્યય નિધિ કીજે રે ।

ગણી જગજીવન તુમ ગુણુ ગાવેં,

દયાનિધિ સમક્તિ દીજે રે-જિન૦ ॥૪૨॥



(૧૨૮૮) (૫૪-૧૫) શ્રી ધર્મનાથ-જિન સ્તવન
(દીઠો સુવિધિ જિણુંદ-એ કેશી)

ધરમ-જિણેસર દેવ અનંત ધર્મ, ધારણો હો લાલ-

-અનંત૦ ।

પર પર વાદ ઉપાધિ મિથ્યાત-નિવારણો હો લાલ-

-મિથ્યાત૦ ॥૧॥

આગમ યુગતિ વિવેક અ-શેષ હીયેં ધરો હો લાલ-

-અ-શેષ૦ ।

તે જન શ્રી જિનરાજ સંસાર થકી તરો હો-

-સંસાર૦ ॥ ૨ ॥

લકત વસલ પ્રતિપાલ દયાલ દયા કરી હો-દયાલ૦ ।

પરમ પાવન તુઝ નામ તારક,

જગમાં તરી હો-તારક૦ ॥ ૩ ॥

તે માટે પ્રભુ ધ્યાન નિધાન ધરી મુદા હો-નિધાન૦ ।

આશ્રવ દુરિ ?ઓથેલી સમાધિ ધરો સદા હો-સમાધિ૦ ॥૪॥

અવધારો અરદાસ પ્રકાશક જ્ઞાનનો હો-પ્રકાશક૦ ।

જગજીવન જિનરાજ ધીરજ

તુઝ ધ્યાનનો હો-ધીરજ૦ ॥ ૫ ॥



(૧૨૮૬) (૫૪-૧૬) શ્રી શાંતિનાથ-જિન સ્તવન

અહો ! મેરે ! નાથ શાંતિ જિણેસર સેવીયે,

સુખદાયક હો સોલસમો જિણુંદ
નામથી નવનિધિ સંપન્ને,

જસ જપતાં હો ! જસ જપતાં હો ! થાયે પરમાણુંદ

-જગવદસલ જિન શાંતજી-અહો૦ ॥૧॥

હતિષ્ણાઉર પૂર શોભતો,

નીતિ પાલક હો ! નીતિ પાલક હો !

વિશ્વસેન ભૂપાલ

રમણી રતિ રામા જિસી અમિય ગુણ હો !

અચિરા સુવિશાલ-જગ૦ અહો૦ ॥૨॥

પ્રભુપદ અનુકંમે પામીયા,

જગ સ્વામીયા હો ! જગસ્વામીયા હો !

વારી વિષય કષાય,

સુરપતિ પદ સેવિત સદા ।

ભવભીતા હો ! ભવભીતા હો !

જપતાં દૂરી ભય-જગ૦ અહો૦ ॥૩॥

તુઝ ^૧હૃદય-દ્રહે ગંભીરથી,

વરદાયક હો ! વરદાયક હો !

^૨વરવાહિની સાર

૧ હૃદય ૩૫ કુંડમાંથી, ૨ શ્રેષ્ઠ નદી,

પ્રાણી ભવ્યામૃત પોષથી

પોષથી શ્રુતસિંધુ મઝાર-જગ૦ અહો૦ ॥૪॥

જિન પ્રભુતા ઝગિરથી ગ્રહી,

વિનવીયા હો વિનવીયા હો !

વિભુ ! તારક દેવ ।

પરમાત્મ નિધિ સંપન્ને,

જયકારી હો ! જયકારી હો !

જિનવર નિતમેવ-જગ૦ અહો૦ ॥૫॥

જિન-ગુણ ગાતાં ભવિ લહે,

નિજ સંપદા હો ! નિજ સંપદા હો !

પ્રગટે ગુણ તાસ ।

ગણી જગજીવન ગુણ સ્તવે,

ભવ્ય ભગતી હો ! ભવ્ય ભગતી હો !

ધરી હૃદય ઉદ્દાસ-જગ૦ અહો૦ ॥૬॥



(૧૨૯૦) (૫૪-૧૭) શ્રી કુંથુનાથ જિન સ્તવન

(રાગ રતનગુરુની)

કુંથુ જિણેશર સાહિબારે મનમોહન મહી આહૃ ।

આતિમ રામી મુંઝઈ રસજી રે,

આપો આણુંદ ઉદ્દાસ-કુંથુ ॥૧॥

એક ગિરાયે અનેકનારે ડહેલા, સંશય ચૂરણ હાર ।

તારક જગમાં તું તાતજી રે, ધર્મમંડળ જગ આધાર-કુંથુ ॥૨॥

૩ વાણીથી

૧ કહેવાય, ૨, જલ્દી, ૩ તુર્ત,

અ-વિનાશી પદ પામીયારે, જગસ્વામીયા શ્રી જિનરાજ ।
 મોહમાયા-લોન માનવી રે, ધિર તુમ ચરણે ધિર થાય-કુંથુ ॥૩॥
 વરહ ભગતિ હીયડે વસીરે, મુઝ યપ્રેખતે પ્રતિપાલ !
 વાહ્યો મુઝ મન વાલહોરે, દેવ સ્તવીયો દીન દયાલ-કુંથુ ॥૪॥
 પરમ નિરમલ ગતિ નાથજી રે, નિધિ પામી તે નિરધાર !
 વંછિત દાયક લાયક વીનતી રે, અવધારો પ્રાણાધાર-કુંથુ ॥૫॥
 પોર બંદર સંઘ શોભતો રે, શુધ શ્રાવક ધર્મ^૧સ-ધીર !
 દાન-દયાદિ ગુણે દીપતારે,

ચિત નિરમલ ગંગ ૭સ-તીર-કુંથુ જિણે ॥૬॥
 સંવત અઢાર આઠમાં રે, ગુણ ગાયા કુંથુ જિણે ॥૭॥
 જગજીવન ગણી ગુણ સ્તવે રે, પ્રભુ !

આપો અધિક આનંદ-કુંથુ ॥૮॥



(૧૨૯૧) (૫૪-૧૮) શ્રી અરનાથ-જિન સ્તવન
 (રાગ-વસંત ધમાલ)

સકલ પ્રાણી સુખ-ઠારણો હો, તારણો ત્રિભુવન સ્વામ ! ।
 સુરપતિ-પદ-સેવિત સદા હો, મનમોહન જ્ઞાન-ગુણ ધામ-
 -અરનાથ જિણેસર સેવીયે હો !
 અહો મેરે જિનજી શિવ-સંપત્તિ દાયક દેવ-અરનાથ ॥૧॥
 ગજપુર નયર વખાણીએ હો, સુદરસણ જિન તાત ! ।
 દેવીમાતા-મુત શોભતાં હો,
 જિન ત્રાયક જિન જગ ત્રાત-અર ॥૨॥

૪ જૂઓ, ૫ હે પાલન કરનાર ! ૬ નિપુણ, ૭ જેવા,

જનમ જાણી સુરસુંદરી હો, આવી હરખ અપાર !

ઓરછવ કરત ઉલટ ધરી હો,

વિભુધ-સૌ પોહતી ?નિજગાર-અરં ॥૩૧॥

અનુકંષે ખટ ખંડ સાધીયા હો, આવીયા ગજપુર ગેહ !

લોકાંતિક ઉપદેશથી હો ! નાથ,

સંયમ લીધો ધરી નેહ-અરં ॥૩૨॥

અષ્ટકરમ જે અનાદિના હો, અરિયણ તેહ અપાર !

ધ્યાનાનલ કરી તે દમ્યા હો,

વરદાયક કીયા ખણુવાર-અરં ॥૩૩॥

કેવલ લહી શિવ પામીયા હો, તીરથનાથ દયાલ !

સાદિ-અનંત સુખસંપદા હો,

લહી મોહન દેવ કૃપાલ-અરં ॥૩૪॥

સંવત અઠાર દશ સોભતા હો, કાશુણ માસ પ્રધાન

કંઠોરડે સંઘ-સુખકર હો,

ધર્મધોરી વસે દયા-નિધાન-અરં ॥૩૫॥

શ્રી સંઘના આગ્રહ થઈ હો, સ્તવિયા અરજિનરાય !

નવનિધિ-દાયક નાથના હો,

ગણી જગજીવન ગુણ ગાય-અરં ॥૩૬॥



(૧૨૯૨) (૫૪-૧૯) શ્રી મલ્લિનાથ-જિન સ્તવન
(હાલ-ગરબાની)

મલ્લિક જિજ્ઞેશર સાહિબારે લો,

સિધિસાધ્ય કરુણ જગસ્વામ રે-છ રે જયો-

-જયો જયો કેવલ દિનમણિ રે લો

વિષય કલુષાય દુઃખ વારવા રે લો,

જગ જપતાં મલ્લિક જિન નામ રે-છ રે જયો ॥૧૧॥

પ્રભુછ ! ભવદુઃખ-^૧આવત^૧ ભંજવા રે લો,

^૨લહુ ^૩ગંજવા ^૪મોહમયંદરે-છ રે જયો ॥

એકગિરાયેં અનેકનેં રે લો,

કરુણા-કર હો સુખકંઠ રે-છ રે જયો ॥૨૧॥

દુરગતિ દૂરિ નિવારણો રે લો,

^૫તરી તારણો ^૬નીર સંસાર રે-છ રે જયો ॥

અતિશય ચોત્રીશ ઓપતાં રે લો,

શુદ્ધ વાણી પાંત્રીસ શુણ સાર રે-છ રે જયો ॥૩૧॥

વારક મિથ્યાતમ ભવ તણો રે લો,

દૃઢ ધારક શુદ્ધ સ્વભાવ રે-છ રે જયો ॥

ધ્યાનાલંબી ધીરથી રે લો,

વશિ કીધો ^૭વિષ-સ-વિભાવ રે જયો ॥૪૧॥

અનુભવ-આગર સાહિબારે લો,

સુખસાગર કેવલ ધામ રે-છ રે જયો !

૧ સંસારના ખોટા-ચક્કર, ૨ જલદી, ૩ વશકરવા, ૪ મોહરૂપસિંહ,
૫ નાવ, ૬ અમુદ, ૭ એર જેવા વિભાવને

જસ ભજતાં કુગતિ નસે રે લો,

મહી વાષે' સુજસ જસ ગામ રે-જી રે જયો ॥૫૫॥

વડોદરા નગર સોહામણો રે લો,

જિહાં સંઘ સકલ સુખકાર રે-જી રે જયો !

ગુરુની ભગતિ કરે' બલી ભાવસૂં રે લો,

હીયે' આણી હરખ અપાર રે;-જી રે જયો ॥૬૫॥

સંવત અઢાર ચઉઠે સમે' રે લો,

ગુણ ગાયા મલિક જિણંદ રે; જીરે-જયો !

ગણી જગજીવન ગુણ સ્તવે' રે લો,

દેવ આપો અધિક આણંદ રે-જી રે જયો ॥૭૫॥



(૧૨૯૩)(૫૪-૨૦) શ્રી મુનિસુવ્રત-જિન સ્તવન

(ઢાલ-રામચંદ્ર કે બાગ)

મુનિસુવ્રત જિનરાજશું મુઝ પ્રીતિ બલેરી રે લો મુજ ॥

મધુકર ચાહે કેતકી ચિતચંદ ચકોરી રે લો-ચિત્ત ॥૧॥

કમલ હસે રવિ પેખીને', મેઘ ચાહે' મયૂરી રે લો-મેઘ ॥

વીંઝગ ચંહાં વલ્લહો, સુર ચાહે જ્યોરી રે લો-સુર ॥૨॥

સૌમ્ય સુરતિ જિન તાહરી,

દેખી પ્રીતિ ઘનેરી રે લો-દેખી ॥

શાંતિ સુધારસ સાધતી નહી,

તુમિ અનેરી રે લો-નહી ॥૩॥

અન્વય-પદની પૂરણી, સુખ સારણિ સહેજે' રે લો-સુખ ॥

ભગતિ તારક ભય-ભંજણી,

મોહ-ગંજણી હેજે' રે લો-મોહ૦ ॥૪॥

એહવી ભગતિ હીયડે' વસી, જિનરાજ તિહારીરે-જિન૦ ।

રત્નત્રયી ગુણ રાશિની,

ફલી આશ અમારી રે. લો-ફરી૦ ॥૫॥

હીવખિંદર સંઘ શોભતો, ધરમી દઢ ભાવે' રે, લો-ધરમી૦ ।

અઢાર ચોવીસે' માસ ચૈતરેં,

ગણી જગજીવન ગાવે' રે લો-ગણી૦ ॥૬॥



(૧૨૯૪) (૫૪-૨૧) શ્રી નમિનાથ-જિન સ્તવન

(ઢાલ-મધુકરની)

નમીશ્વર જિનવર ગાસ્થું,

આતમ રમણ પૂરણ પાસ્થું,

વરદ ગુણે મુઝ મન વાસ્થું રે-નમી૦ ॥૧॥

વપ્રાદેવી સુત મુઝ વાદહો,

સાહિબ પંચ સુમતિ વાલો,

ભવ-ભવ-બ્રમણ થકી ટાલો રે-નમી૦ ॥૨॥

અબ્દ-કરમ-હલ જિન ફૂઝો,

પ્રભુસમ દેવ નહીં ફુલો,

બુધ બોહિઅપ્પા ધરમ બુઝો રે-નમી૦ ॥૩॥

જિનવર મુઝ અંતરભામી

મનચોહન વર ગુણ ધામી,

શિવસુખદાયક શિવ ગામી રે-નમી૦ ॥૪॥

અંતર અંશે ગુણ થાયેં

લોકાકાશેં નવિ માયેં,

તો સુરગુરુ ગિરથી કિમ ગાયેં રે-નમીં ॥૫૫॥

વાલેસર વાંછિત કીજેં,

હુ ખ-અબ-દાટ શિવ દીજેં,

પ્રભુગુણુ-શ્રવણુ પરમ પીજેં રે-નમીં ॥૫૬॥

દીવાખંદર સંઘ સુખદાતા,

ધરમી ધનો આગમ-જ્ઞતા;

દાની દૌન પ્રતેં ત્રાતારે-નમીં ॥૫૭॥

સંવત અઢાર પચવીસ વાસેં

જિન ગુણુ સ્તંયા આશ્વિન માસેં,

ગણી જગજીવન ઉદ્દાસેં રે-નમીં ॥૫૮॥



(૧૨૬૫) (૫૪-૨૨) શ્રી નેમિનાથ-જિન સ્તવન

સમુદ્રવિજય સુત નેમ નિરાગી,

રાણી શિવાદેવી નંદ આનંદકારી હો-યાદવ કૈસેં ચલે !

દિલ જાની અમલારી હો-યાદવં ! !

કૃષ્ણ-નરિંદકો આયુધશાલા,

તિહા જિનજી કોઈ ખલ ભારી હો !-યાદવં ॥૫૯॥

શંખ શબ્દ સુણી કંપ્યો મુકુંદા,

કોઈ નારાયણ ભયો અહંકારી હો-યાદવં ।

રાજ-સલાજન તુઝ ખલ દેખી,
 રહુરી વિચાર્યો પરણાઉં એક નારી હો-યાદવ ॥૨॥
 પુત્રી ઉઘસેન ભૂપતિ કી,
 રૂપે રંભા રાજમતી પ્યારી હો-યાદવ !!
 વ્યાહે આએ સખ યાદવ જુગતેં,
 મૃગી દેખ કેં ઝખરદપે પુકારી હો-યાદવ ॥૩॥
 અવધિ કરી સખ મનોગતિ જાની,
 દીનાનાથ દયા મનિ નિરધારી-હો-યાદવ ॥૪॥
 ખેચર ભૂચર ખંધ નિવારી,
 રથ ફેરી ગયો ગિરનારી-હો-યાદવ ॥૫॥
 એસેં ન કીજેં નાહ ! ઝનિ-હેજા,
 અષ્ટ-જનમકી પ્રીતિ વીસારી હો-યાદવ ॥૬॥
 દીન-દયાલા નામ પતુસાડા,
 નાથ ! અનાથકી દયા ન વિચારી હો-યાદવ ॥૭॥
 છોરી ચલે જિનમે નહીં બોલું,
 તુમ ચરન સરનકી ભઈચેરી હો-યાદવ ॥૮॥
 સંયમ લીનો જિન સમીપેં,
 પ્રભુ-પ્રીતિકી જાનું બલિહારી હો-યાદવ ॥૯॥
 કઠિણ કરમ ચૂરી શિવપદ પાએ,
 ભવિલોક જીવ જિનહિતકારી-હો-યાદવ ॥૧૦॥
 શિવ-સુખ-સાગર નેમિ-જિણુંદા,
 ગણી જગજીવન જયકારી હો-યાદવ ॥૧૧॥



૨ શ્રીકૃષ્ણ, ૩ અંતરથી ૪ સ્નેહ રહિતપણું ૫ તમારું,

(૧૨૯૬) (૫૪-૨૩) શ્રી પાર્શ્વનાથ-જિન સ્તવન

વિમલ વરદાથી હે પારસ જિન વંદીયે,

વંદિત સુરનર વૃંદ ।

કરમ અનાદિ હે ૧ દુહૃદ જિણે વશિ ક્રીયા,

સાધક શિવ-સુખ-કંઠા-

ગુણ સોભાગી હે ! પરમ નિરાગી હે ! પારસ જિન વંદીયે ॥૧॥

અશ્વસેન-૨ કુલાંબર હે, ૩ ભલાહક ઉમહયો,

અભય કરણ ભવિસુર ।

૪ સિત-૫ શુભ ૬ પ્રમોદ હે,

સર્માર સોહિં સદા, પાવન ભાવન પુર-સુગુણ ॥૨॥

૭ આપ માધવ હે ગગન તાણ્યો તદા,

જેગ ત્રિક શુભ ભક્તિ ભાવ ।

જિન ગુણ સ્તવે હૈ, ૮ ધની ૯ ધન-ગરજના,

૧૦ બહિર તૃણા તાપ અભાવ-સુગુણ ॥૩॥

લેશ્યા શુકલ હે, સરૌવર, પંકજ ધ્યાન શ્રેણિસર-કાઠંબ ।

(અંતિ મુનિસર ગર્ધ ચક્ર મગ હે, બંધે ભવિ ઘર વશ્યા

સુમતા સ્ત્રી સંગ રમે પુર.) સુગુણ ॥૪॥

માર્ગાનુસારી હૈ શિખંડી હરખિત થયા.

પ્રભુ વાણી સુણી ધન ઘોર ।

દ્વાદશાંગી વહે સ-જલ-ધારા-વહી,

ધર્મરૂચિ ચિત ભૂમિ જેર-સુગુણ ॥૫॥

૧ દુરભન ૨ કુલરૂપ આકાશ, ૩ બગલા જેવા, ૪ નિર્મળ ૫ સારી

૬ પ્રમોદ ભાષા, ૭ ઇન્દ્ર ધનુષ, ૮ ખૂબ, ૯ મેઘ ગર્જના, ૧૦ બહારના

પદાર્થોની તૃણાના તાપનો અભાવ,

ચાતક મુનિ હે, કરે તવ પારણું,

અનુભવ સ્વાદ રસ રંગ ।

અ-શુભાચાર હે ૧૧ નિંદણુ તુષ્ટ ૧૨ નીગમ્યા,

૧૩ વ્રતી-પ્રણમણુ બીજ અભંગ-સુગુણ ॥૬॥

૧૪ પંચ-જામ ધર્મ હે, ૧૫ કરસણુ નીપનો,

સાધ્ય-ભાવે નિજ થાય ।

રતનવર્ધ હે ક્ષાયિક ગુણ ઉપનો, પરમાતમ ભઈટાય-સુગુણ ॥૭॥

મૂલ સ્વભાવ હે, પ્રબલ ૧૬ શક્ય સંપનો।

આતમ-ધર સુ-વિશેષ ।

પ્રભુ-ઉપદેશે હે, ધારાધરથી થયો,

પરમ-સુલિક્ષ મુઝ દેશ-સુગુણ ॥૮॥

જિન ગુણ લાંબી હે જે જિનને ભજે,

દરશણુ શુદ્ધ થાયે કામ ।

જ્ઞાન ચરણ હે, વીર્ય પ્રમોદથી,

કર્માભાવે વસે શિવ ધામ-સુગુણ ॥૯॥

દીવ બંદર હે, સકલ સંઘ-સુખ કરે,

રસ-ખ-ગજ-શશિ વર્ષ પ્રમાણ ।

જિન ગુણાલંબી હે, જે જન જિનને ભજે,

શુભ પોષ માસે હે, પારસ જિન ગુણ સ્તવ્યા,

ગણી જગજીવન શુભ વાણુ-સુગુણ ॥૧૦॥



૧૧ નીંદવા લાયક, ઉખેડવા લાયક, નકામા, ૧૨ દૂર થયા, ૧૩ વિરતિધારીઓને પ્રણામરૂપ સુંદર બીજ, ૧૪ પંચ મહાવ્રત, ૧૫ ખેતી. ૧૬ અનાજ.

(૧૨૯૭) (૫૪-૨૪) શ્રી મહાવીરસ્વામી-જિન સ્તવન

(હાળ-ગરબાની)

(હાં રે મુંને ધરમ જિણુંદશું ઝે દેશી.)

હાં રે વાલો ! વીર-જિણેસર શિવસુખનો દાતાર જો,

અનુલવ-રસનો સાગર ત્રિભુવનનો ધણી રે લો ।

હું તો કાલ અનંતો ભમતો ભવનિધિ માંહિ જો,

પૂરણ સુકૃતે ભણી વાણી જિનતણી રે લો. ॥૧॥

હાં રે પ્રભુ ! જિન નિરખ્યાથી નાવેં બીજ દાયજો,

હરિ-હર બ્રહ્મ પુરંદર દેવા ઇશુ મહી રે લો ।

પ્રભુ વીર-ગુણ રચણેં રીઝયું માહડું મનજો,

દેવ અનેરા મન ભિંતર રાચેં નહી રે લો. ॥૨॥

શુદ્ધ-ધરમ ન બાણે નય-ઠાણે પરિભાણજો,

વાતલડી વિગતા લીયેં જગ-જન લોલખ્યા રે લો ।

જિન પરમ-અહિંસક ભાર વિના નહિ સિદ્ધિ જો,

બાહ્ય-નિમિત્તો રાચી આતિમ રેલવેં રે લો. ॥૩॥

પ્રભુ પંચમ-આરે દક્ષિણ ભરત મઝારિ જો,

તે નરનેં સમકિતની સંપત્તિ દોહિલી રે લો ।

જો જિન ગુણ રાચેં મન સાચેં મહારાજ જો,

તે જનને શિવ સંપત્તિ પ્રાપતિ સોહિલી રે લો. ॥૪॥

સંઘ સુખકરા શ્રાવક દીવતણા દાતાર જો,

સદગુરૂં સેવા સારેં મન સુધેં ભલી રે લો ।

અઢાર ચોવીસ કહે ગણી જગજીવન ગણુ ધારજો,
વીર જિજ્ઞંસ વિનવતાં મન આસ્થા ફલી રે લો. ॥૫॥

સંવત ૧૮૨૬ના ચૈત્ર વદિ ૧૩ ને વાર ચંદ્રે
શ્રી ઋષિ શ્રી રૂપદેવજી તત્ શિષ્ય પૂ. ઋષિ શ્રી પ. ।
વાલ્હીજી જી તત્ શિષ્ય લિખિતં
ઋ. સોમચંદ્ર ભાવનગરે બિંદરે ॥



શ્રીવર્દ્ધમાન-સ્વામિને નમઃ

૫. શ્રી જિનહર્ષણ કૃત
જિન-સ્તવન ચોવિથી
(૫૫)

(૧૨૯૮) (૫૫-૧) શ્રી ઋષભદેવ-જિન સ્તવન

(રાગ વેલાવડ)

રે જીવ ! મોહ મિથ્યાતમે, કયું મુંઝયો ? અજ્ઞાની ! ।
પ્રથમ-જિણુંદ ભજે ન કયું, શિવ-સુખકો દાની-રે ॥૧॥
ઐર દેવ સેવે કહા, વિષયી કે માની ।

તરી ન શકે તારે કહા, દુરગતિ-નીશાની-રે ॥૨॥
તારણ તરણ જહાજ હૈ, પ્રભુ ! મેરો જાની ।

કહે જિનહર્ષ મુતારીયે, ભવ-સિંધુ સુજાની-રે ॥૩॥



(૧૨૯૯) (૫૫-૨) શ્રી અજિતનાથ-જિન સ્તવન

(રાગ ભૈરવ)

સ્વામી અજિત-જિન સેવે ન કયું,
જો તું ચાહે શિવ-પટશાળી ।

ઐર સકલ તણ ૧કથા ૨વિરાળી,
અહનિશ કીજીયે પ્રભુજીકી કહાણી-સ્વામી ॥૧॥

૧ વાતો ૨ અથુલ,

ભવ-વન ^૩સઘન અગની પ્રજ્જલાણી,
મિથ્યા-રજ-^૪વ્રજ પવન ઉડાણી ।

જેસે તેણ પીલનકું ઘાણી,
તેસે કરમ પીલણ પ્રભુ-વાણી-સ્વામીં ॥૨॥

ક્રોધ-હાવાનલ ^૫પાવસ પાણી,
ઉન્નવલ નિરમલ ગુણ-મણિ-ખાણી ।

કહે જિનહર ^૬ભગતિ મન આણી,
સાહિબ ! ઘો અપની ^૬સહીનાણી, સ્વામીં ૩



(૧૩૦૦) (૫૫-૩) શ્રી સંભવનાથ-જિન સ્તવન
(રાગ-ગોડી)

અખ મોહે આપણે પદ લીજે ।

કરૂણા-સાગર કરુણા કરકે,
નિજ ભગતકી અરજ સુણી જે-અખં ॥૧॥

તુમ હો ! નાથ ! અ-નાથ કે ^૧પીહર,
અપણે લવથે તારીજે ।

તુમ સાહિબ હું ફિરું ઉદાસી,
પ્રભુકી પ્રભુતા કયા કીજે ?-અખં ॥૨॥

તુમ હો ! ચતુર ચતુર્ગતિ કે હુઃખ,
મેટો અખ સેવક હિત કીજે ।

કહે જિનહર ^૬સંભવ જિનનાયક !
દાસ નિવાળ જગત જસ લીજે-અખં ॥૩॥



૩ ગાઠ, ૪ સમૂહ, ૫ ચોમાસાનું, ૬ નિશાની. ૧ રક્ષક,

(૧૩૦૧) (૫૫-૪) શ્રી અભિનંદન-જિન સ્તવન

(રાગ-નટ)

મેરો પ્રભુ ! સેવકકું સુખકારી ।

બકે દરશને વાંછિત લહીયે,

સો કૈસે દીજે વારી-મેરો ॥ ૧ ॥

હૃદયે ધરીયે સેવા કરીયે, પરિહરી માયા ૧મતવારી ।

તું ભવ-દુઃખ-સાયરથી તારે,

પરમાતમ આતમ-ઉપકારી-મેરો ॥ ૨ ॥

એસો પ્રભુ તજી ચોર બજે જો,

કાચ ભજે સો હી મણિ હારી ।

અભિનંદન જિનહર્ષ ચરણ ગ્રહી,

ખરી કરી મનસેં એક-તારી-મેરો ॥ ૩ ॥



(૧૩૦૨) (૫૫-૫) શ્રી સુમતિનાથ-જિન સ્તવન

(રાગ-કેઠારો)

જીવે રે ! પ્રભુ-ચરને ચિત્ત લાય ।

સુમતિ ચિત્ત ધરી સુમતિ-જિનકો,

ભજન કરી દુઃખ ભય-જીવે ॥ ૧ ॥

મોહ-માયાકી મહા-બલમેં, કયું રહ્યો ? તું મુંઝાય ।

અંતે જમ જળ આર્ધ પકરે,

રઠાહું યે ન રહાય-જીવે ॥ ૨ ॥

૧ પ્રબળ, ૨ કોષ પથ્ય રીતે

ભવ અનંત હુખ ટારવેકું, કયું ન ગ્રહે ઉપાય ? ।

જિનહર્ષ પ્રભુ મુક્તિકો દાયક,

પ્રીતિ અચલ બનાય-છૃદિ૦ ॥૩॥



(૧૩૦૩) (૫૫-૬) શ્રી પદ્મપ્રભ-જિન સ્તવન

(રાગ-કનકા)

હો ! જિનવર ! અથ તો મહેર કીજે,

નિજ-પદ-સેવા દીજે ।

દરસણુ દેહુ દયાલ ! કયા કરી, ૧ધીકું મન ૨ધીજે-હો૦ ॥૧॥

હો ! ૩એકતારી ધારી મેં તુમશું, અપનો કરી જાનીજે ।

ઓર સહી સુર નટ વિટ જાણી,

નિરખી-નિરખી મન ખીજે-હો૦ ॥૨॥

અંતરજામી અંતરગતકી જાણો કહા કહીજે ? ।

પદ્મપ્રભ ! જિનહર્ષ તુમારી,

૪સોમ-નજરશું છુજે-હો૦ ॥૩॥



(૧૩૦૪) (૫૫-૭) શ્રી સુપાર્શ્વનાથ-જિન સ્તવન

(રાગ-દેવગંધાર)

કૃપા કરી સ્વામી ! સુપામ ! નિવાજે ।

તુમ સાહિબ હું ખીજમતગારી,

એહી જ સગપણુ તાજે-કૃપા૦ ॥૧॥

૧ નિરાશ થયેલ, ૨ પ્રસન્ન થાય, ૩ ઉત્કટ પ્રીતિ, ૪ પ્રસન્ન,

તુમહી ? છોરી અવર શું ધ્યાઈ, તો પ્રભુ ! તુમહી લાજે ।
ભગત-વત્સલ ભગતનકે સાહિબ,

તા કારણ હુઃખ લાજે-કૃપા ॥૨॥

પ્રભુ મધુર-કર સખરસ કે નાયક હો, સહુદય કમલ વિરાજે ।
ચરણ શરણ જિનરાજ કીયે મેં,

ભયે નિરભય અખ ગાજે-કૃપા ॥૩॥



(૧૩૦૫) (૫૫-૮) શ્રી ચંદ્રપ્રભ-જિન સ્તવન

(રાગ-સામેરી)

ચંદ્રપ્રભ અઠ-કરમ-ક્ષય-કારી ।

આપ તરી ઓરનકું તારે,

આપણો બિરુદ વિચારી-ચંદ્ર ॥૧॥

જિન-ચુદ્રા સુપ્રસન્ન પ્રભુલકી, ઉલસત નયનાં નિહારી ।

સુંદર સુરતિ મૂરતિ ઉપરે,

બઈ હું બલિહારી-ચંદ્ર ॥૨॥

ઐસી તનકી છબી ત્રિભુવન મેં, ઓર કિસી નહિ ધારી ।

તોહી ચરણ જિનહર્ષ ન તણયે,

દુખીયનકું ઉપગારી-ચંદ્ર ॥૩॥



(૧૩૦૬) (૫૫-૯) શ્રી સુવિધિનાથ-જિન સ્તવન

(રાગ જય જયવંતી)

નાથ ! તેરે ચરણ ન છોડું, જો છુરાવે કોઈ ।

પકરી રહું જૈસે, બાલ માં કે ^૧અંચરા-નાથ૦ ॥૧॥

બહુત દિવસ ભયે, પ્રભુ કે ચરણ લહે ।

અપની કરણ સેવા, મન ભયા અંચરા-નાથ૦ ॥૨॥

કૃપા-જલ સીંચે દાસ, વૃદ્ધિવંત હુએ ઉલ્લાસ ।

ઉદકમું સીંચે જૈસે, વધેરી રક્તઅંચરાશ-નાથ૦ ॥૩॥

સુવિધિ-જિણુંદ ગુણ-ગેહ, ન દેખાવે છેહ ।

સેવક ઉપર નિજ, હોય સુ-કૃપાપરા-નાથ૦ ॥૪॥

એસો પ્રભુ પાય કે, ચરન ગ્રહું ધાયકે^૨ ।

પાયે જિન હરખ, હરખ સુખ સંચરા-નાથ૦ ॥૫॥



(૧૩૦૭) (૫૫-૧૦) શ્રી શીતલનાથ-જિન સ્તવન

(રાગ-માઝણી)

શીતલ લોચણ હો, જોવો શીતલનાથ ।

ભવ-દુઃખ તાપ મિટે સખી,

થઈએ પ્રભુજી સ-નાથ-શીતલ૦ ॥૧॥

તુમ સમરથ સાહિબ છતાં હો !, હું તો ફીડું અનાથ ।

સેવક સુખ દેતા નથી,

તો શી લહી તુમ ^૧આથ-શીતલ૦ ॥૨॥

પોતાનો જાણી કરી હો !, ઘો મુજ પૂંઠે હાથ ।
કહે જિનહર્ષ મીલ્યો હવે,

સાચો શિવપુર-સાથ-શીતલ ॥૩॥

❖❖

(૧૩૦૮) (૫૫-૧૧) શ્રી શ્રેયાંસનાથ-જિન સ્તવન.

(રાગ-કાફી)

શ્રેયાંસ-જિનેસર મેરો અંતરજામી ।

ઝોર સુરાસુર ઢેખી ન રીઝું,

પ્રભુ-સેવા જો પામી, -શ્રેયાંસ ॥૧॥

રંકનકો કુણુ આણુ ધરે ? શિર, તણ ત્રિભુવનનો સ્વામી ।
દુઃખ ભાંજે છિનમાંહી નિવાજે,

શિવ-સુખ ઘો શિવગામી-શ્રેયાંસ ॥૨॥

કયા કહીયે ? તુમશું કરુણા-નિધિ !, ખમજો મેરી ખામી ।
કહે જિનહર્ષ પરમ-પદ ચાહું,

અરજ કરું શિરનામી-શ્રેયાંસ ॥૩॥



(૧૩૦૯) (૫૫-૧૨) શ્રી વાસુપૂજ્યસ્વામી-જિન સ્તવન.

(રાગ-મલ્હાર)

હો ! જિનવરણ ! અખ મેરે બની આઈ ।

ઝોર સકલ સુરકી સેવા તણ,

એકશું લય લાઈ-હો ॥૧॥

વાસુપૂજ્ય-જિનવર વિહુ ચિત્ત મેં, ધારું ઝોર ન કાંઈ ।

પરમ-પ્રમોદ ભયો અખ મેરે,

જો તુમ સેવા પાઈ-હો ॥૨॥

ત્રિભુવન-નાથ ધર્મી શિર ઉપર, જાકો બહુત વડાઈ ।

કહે જિનહર્ષ અવર ન માંશું,

દો ભવપાશ છુરાઈ,-હો ॥૩॥

૦

(૧૩૧૦) (૫૫-૧૩) શ્રી વિમલનાથ-જિન સ્તવન

(રાગ-પૂરવી-ગાડી)

મેરો મન મોહ્યો પ્રભુકી મૂરતિયાં ।

સુંદર ગુણ-મંદિર છળિ દેખત,

ઉલ્લસિત હોઈ મેરી છતીયાં-મેરો ॥૧॥

નયન-ચક્રેર વદન-શશી મોહે,

જાત ન જાણું દિન-રતીયાં ।

પ્રાણ-સનેહી પ્રાણ-પિયાકી લાગત હૈ,

યે મીઠી વતીયાં^૧ મેરો ॥૨॥

અંતરજામી સખ જાણુત હૈ,

કયા લીખ કે લેખું રપતીયાં ।

કહે જિનહર્ષ વિમલ-જિનવરકી,

ભકિત કરું હું બહુ-ઉલતીયાં-મેરો ॥૩॥

૦

૧ વાતો, ૨ કાગળો, ૩ રીતે

(૧૩૧૧) (૫૫-૧૪) શ્રી અનંતનાથ-જિન સ્તવન

(રાગ-પરજયેા)

ઠાલા થારા મુખડી ઉપર વારી ।

અરજ સુણજે એક મારી,

કાંઈ તુમને કહું છું વિચારી-ઠાલા૦ ॥૧॥

આઠ પહોર ઉભો થકો રે, સેવા કરું તુમારી ।

અંતરજામી ! સાહિબા ! કાંઈ,

લેજે ખખર હમારી-ઠાલા૦ ॥૨॥

સુંદર સુરતિ તાહરી રે, લાગે પ્રેમે પિયારી ।

સાત ધાત લેલી કરી,

કાંઈ પેઠી હૈયા-મોઝારી-ઠાલા૦ ॥૩॥

સ્વામી અનંત તુમારડા રે, ગુણ અનંત અપારી ।

કહે જિનહર્ષ સંભારજે,

કાંઈ મત સુકો ! વિસારી-ઠાલા૦ ॥૪॥

(૧૩૧૨) (૫૫-૧૫) શ્રી ધર્મનાથ-જિન સ્તવન

(રાગ-વસંત)

ભજ ભજ મન ! પન્નરમો જિણુંદ,

ભવ-ભવકે નિવડે ફંદ, -ભજ૦ ।

જાકું સેવે સુર-નર ઈંદ, દરસન દેખે પામે આનંદ ।

ઉલ્લસે મન જોસે ચકોર ચંદ

કાટે હુઃખ કઠોર કરમ ફંદ-ભજ૦ ॥૧॥

સમકિત-દાયક સુખકો નિધાન,

સખ પ્રાણી કું દીયે અભયદાન ।

અજ્ઞાન-મહાતમ-ઉદયભાન,

સો પ્રભુ કું ધરી હૃદય ધ્યાન-ભજ૦ ॥૨॥

લહીયે જાથે સંસાર-પાર, અ-વિચલ સુખ-સંપત્તિ દેણહાર ।

નિશધારનો તુંહી આધાર,

જિનહર્ષ નમીજે વારંવાર-ભજ૦ ॥૩॥



(૧૩૧૩ (૫૫-૧૬) શ્રી શાંતિનાથ-જિન સ્તવન,

(રાગ-જયંતસીરી)

પ્યારો પ્રેમ કો મેરો સાહિબ, ઇસી રીત જપીયે,

પ્રભુ દરિસણ મન ઉલ્લસેરે, ૧કેકી ૨ધન-ગાજ૦ ।

ઔર સકલ મેં પરહરી,

મેરે એક જીવન શું કાજ-પ્યારો ॥૧॥

પ્રીતમ આયા પ્રાહુણા રે, મો દિલ-મંદિર. આજ ।

ભગતિ કરું બહુ તેરીયાં,

અબ છોરી સકલ ભય લાજ-પ્યારો ॥૨॥

હિલી મિલી સુખ-હુઃખ કી કહુંરે,

સાહિબ (જિનહર્ષ) ઘો સુખ રાજ ।

અંતરજામી સોળમો, તાશું પ્રીત કરું જિનરાજ-પ્યા ॥૩॥



૧ મોર ૨ વાદળ ૩ ગર્જના,

(૧૩૧૪) (૫૫-૧૭) શ્રી કુંથુનાથ-જિન સ્તવન
(સગ-સોરઠ)

જ્ઞાની વિષ્ણુ કિષ્ણુ આગળ કહીયે ।

મનકી મન મેં બાણી રહીયે-જ્ઞાની૦ ॥

ભુંડી લાગે ૧જણુ-જણુ આગે,

કહેતાં કાંઈ ન રવેદન લાગે હો-જ્ઞાની૦ ॥૧॥

અપનો ભરમ ગમાવે રસાજન,

૪પરજન કામ ન આવે-હો-જ્ઞાની૦ ॥૨॥

હુરજન હોઈ ૫સુપરે કરે ૬હાસા,

બાણી પડ્યા મુહ-માઘ્યા પાસા હો-જ્ઞાની૦ ॥૩॥

તાથે મોન લહું મન આણી,

ધરી મન ધીર રહે નિજ-પાણી હો-જ્ઞાની૦ ॥૪॥

કહે જિનહર્ષ કહેજો પ્રાણી,

કુંથુ-જિણુંદ આગે કહેવાણી-જ્ઞાની૦ ॥૫॥



(૧૩૧૫) (૫૫-૧૮) શ્રી અરનાથ-જિન સ્તવન
(રાગ-ગુજરી)

અરજિન નાયક સ્વામી હમારો ।

આઠ કરમ અરિયાણુ બલવંતે,

જીતે સુલટ ૧અટારો-અર૦ ॥૧॥

૧ દરેકની આગળ, ૨ દુઃખ ૩ કુટુંબી, ૪ બીજા માણસો, ૫ સારી રીતે, ૬ મશ્કરી,

૧ પ્રખળ=ખરાબ,

ઐસો કોઈ ઔર ન હોઈ, પ્રભુ સરીખો બલધારો ।

મદન લયો જિણુ લય અ-શરીરી,

કહા કરે સુ-વિચારો-અર૦ ॥૨॥

દોષ-રહિત ગુણ પાર ન લહીયે, તાકી સેવા સારો ।

કહે જિનહુષં દોષ કર જોડી,

અખ સેવકકું તારો-અર૦ ॥૩॥



(૧૩૧૬) (૫૫-૧૯) શ્રી મલ્લિનાથ-જિન સ્તવન

(રાગ-ગ્રી રાગ)

મલ્લી-જિણુંદ સદા નમીયે ।

પ્રભુ કે ચરણ-કમલ-રસ લીણે,

મધુકર જયું હૂઈ રમીયે-મલ્લિ૦ ॥૧॥

નિરખી વદન-શશી શ્રીજિનવર કે,

નિશિ-વાસર સુખમેં ગમીએ-મલ્લિ૦ ॥૨॥

ઉજવલ-ગુણ-સમરણ ચિત્ત ધરીયે,

કબહું ન લવ-સાયર લમીયે-મલ્લિ૦ ॥૩॥

સમતા-રસ મેં જયેં ઝીલીજે,

રાગ-દ્વેષકે ઉપશમીયે-મલ્લિ૦ ॥૪॥

કહે જિનહુષં મુગતિ-સુખ લહીયે,

કઠિન-કર્મ નિજ ૧ અપકમીયે-મલ્લિ૦ ॥૫॥



૧ ઓછા કરીયે દુર કરીયે,

(૧૩૧૭) (૫૫-૨૦) શ્રી મુનિસુવ્રત-જિન સ્તવન
(રાગ-તોડી)

આજ સફલ દિન લયે સખીરી ।

મુનિસુવ્રત-જિનવરકી મૂરતિ,

મોહનગારી જે નિરખીરી-આજ ॥૧૧॥

આજ મેરે ઘર સુરતરૂ ઉગ્યે,

નિધિ પ્રકટ લઇ આજ સખીરી ।

આજ મનોરથ સકલ ફલે મેરે,

પ્રભુ દેખત દિલ હરખીરી-આજ ॥૨૧॥

પાપ ગયે સખી લવ-ભવ કે,

હરગતિ હરમતિ હર નખીરી ।

કહે જિનહર્ષ મુગતિ કે દાતા,

૧શિર પગરી તાકી આણુ રખીરી-આજ ॥૩૧॥



(૧૩૧૮) (૫૫-૨૧) શ્રી નમિનાથ-જિન સ્તવન
(રાગ-કલ્યાણ)

નમિ-જિનવર નમીયે ચિત્ત લાઈ ।

બકે નામે નવ-નિધિ લહીયે,

વિપતિ રહે નહિ બહિ-ઘરમે' કાંઈ-નમિ ॥૧૧॥

૧ માથા પર પાધડીની જેમ તેમની આજ્ઞા રાખી (ત્રીજી ગાથાની ચોથી લીટીનો અર્થ)

હરીસણુ ઢેખતહી હુઃખ છીજે,

પાતિક-કુલટાઈ જ્યું તણુ બાઈ ।

સુખ-સંપત્તિકે કારણુ પ્રભુણુ !

તાકે સમરણુ કરહુ સદાઈ-નમિં ॥૨॥

કહા બહુ તેરે જગ સુર સેવે,

જિણુતે કારજકી સિદ્ધિ ન પાઈ ।

કહે જિનહર્ષ એક પ્રભુ ભણ્યે,

ભાધિ-બીજ શિવ-સુખ દાઈ-નમિં ॥૩॥



(૧૩૧૯) (૫૫-૨૨) શ્રી નેમિનાથ-જિન સ્તવન

(રાગ-રામગિરિ)

નેમિ-જિન બદવ-કુળ તાર્યો ।

એકહી એક અનેક ઉધારે,

કૃપા-ધરમ મન ધાર્યો-નેમિં ॥૧॥

વિષય-વિષોપમ હુઃખ કે કારણુ,

બાણી સખી સુખ છાયો ।

સંજમ લીનો પશુહિત-કારન,

મદન-સુભટ-મદ ગાર્યો-નેમિં ॥૨॥

આપ તરી રાબુલકું તારી, પૂરવ પ્રેમ સમાર્યો ।

કહે જિનહર્ષ હમારી કિરપા,

કયા મનમાંહી વિચાર્યો?-નેમિં ॥૩॥



(૧૩૨૦) (૫૫-૨૩) શ્રી પાર્શ્વનાથ-જિન સ્તવન

(રાગ-લક્ષિત)

માન તજ મેરે પ્રાણી, ઘેર ઘેર કહું વાણી ।

કાહે મૂઠ લજનકો, આલસ કરે હે-માન૦ ॥૧॥

ઐર કોઈ નાવે કામ, ૧સગે ૨સયણુ ઇદામ ૪ધામ ।

નામ એક પ્રભુલોકે, કામ સખ સરે હે-માન૦ ॥૨॥

ભવકો ભંજનહાર, સુખકો દેવણુહાર ।

તાકું હીયે ધાર, જો તું કરમસેં ડરે હે-માન૦ ॥૩॥

જય જય જગનાથ, એહી હૈ મુગતિ-સાથ ।

ભકો દરિસણુ દેખી, અખીયાં ઠરે હે-માન૦ ॥૪॥

એસો પ્રભુ કોઈ ઐર, દેખ્યો હે અપર પઠાર ।

જ્ઞાનકો ભંડાર તણ, કાહે બૂલે પરે હે-માન૦ ॥૫॥

તેવીસમો પ્રભુ પાસ, પૂરે હે સકલ આશ ।

કહે (જિનહર્ષ) દાસ, જન્મ દુઃખ હરે રે-માન૦ ॥૬॥



(૧૩૨૧) (૫૫-૨૪) શ્રી મહાવીર-જિન સ્તવન

(રાગ-કેદારો-બિહાગડો)

મેં ભણ્યું નહિ ભવ-દુઃખ એસો રે હોઈ ।

મોહ-મગ્ન માયામેં ખૂંતો,

નિજ-ભવ હારે કોઈ-મેં ॥ ૧ ॥

૧ વહાલા, ૨ કુટુંબી, ૩ પૈસો, ૪ મકાન, ૫ જગ્યાએ,

જન્મ-મરણ ગર્ભ-વાસ અશુચિમેં, રહેવો સહેવો સોઈ ।

જૂખ-તૂષા પરવશ-ખંધન ટાર શકે ન કોઈ,-મેં ॥૨॥

છેદન-લેદન કુંખીપાચન, ખર વૈતરણી તોઈ ।

કોઈ છુરાઈ શકયો નહિ વે દુઃખ,

‘મેં’ સર ભરીયાં રોઈ-મેં ॥૩॥

સખહી સગાઈ જગત ઠગાઈ, સ્વારથકે સખ કોઈ ।

એક જિનહપ્ અરમ જિનવરકો,

શરણ હિયામેં ઢોઈ-મેં ॥૪॥



૧ મેં રોઈને સર=તળાવો ભર્યાં, એટલે તળાવ ભરાય એટલા
આંસુથી હું રોયો. (ત્રીજી ગાથાની ચોથી લીટીનો અર્થ).

પ્રભુ ભક્તિ

“પરમાત્માની ભક્તિ એટલે તેમના ગુણના
આદર્શને સામે રાખી તેવું જીવન ઘડવું.”

શ્રી વર્ધમાનસ્વામિને નમઃ
 પૂ. ઉપા. શ્રીયશોવિજયજી મ. કૃત
 જિન-સ્તવન ચોવીશી
 (અપૂર્ણ*) (૫૬)

(૧૩૨૨) (૫૬-૧) શ્રી ઋષભદેવ-જિન સ્તવન
 (રાગ-રામકલી)

ઋષભદેવ હિતકારી જગતગુરુ ! ઋષભદેવ હિતકારી ।
 પ્રથમ તીર્થકર પ્રથમ નરેસર,

પ્રથમ યતિ બ્રહ્મચારી-જગત ॥૧॥
 વરસીદાન દેઈ તુમ જગમેં, ધૃતિ ઇતિ નિવારી ।
 તૈસી કાહી કરતું ! નાહી કરના

સાહિબ ! બેર હમારી-જગત ॥૨॥
 માંગત નહી હમ હાથી-ઘોરે, ધન-કષ્ટ-કંચન નારી ।
 દિવ્યો મોહિ ચરન-કમલકી સેવા,

ચાહિ લગત મોહે પ્યારી-જગત ॥૩॥
 લવલીલા-વાસિત સુર હારે, તુમ પર સખહી ઉવારી ।
 મેં મેરો મન નિશ્ચલ કીનો,

તુમ આણ્યા શિર ધારી-જગત ॥૪॥

૧ ઉપદ્રવ, ૨ અનાજ

એસો સાહિબ નહિ કોડે જગમેં, યામું હોય ઝલિદારી ।
દિલ હી દલાલ પ્રેમકે બિચે,

તિહાં હક ખેચે ગમારી-જગત ॥૫૦॥

તુમહી સાહિબ મૈ હું ઝબંદા, યા મત દિઓ વિસારી ।

શ્રી નયવિજય વિબુધ સેવકકે,

તુમ હો પરમ ઉપકારી-જગત ॥૫૧॥



(૧૩૨૩) (૫૬-૨) શ્રી અજિતનાથ-જિન સ્તવન

(રાગ-કાફી)

અજિતદેવ મુજ વાલહા ! જયું મોરા મેહા ।

જયું મધુકર મન માલતી,

પંથી મન ગેહા-અજિત ॥ ૧ ॥

મેરે મન તુંહી રૂચ્યો, પ્રભુ કંચન-દેહા ।

હરિ-હર-બ્રહ્મ-પુરંદરા, તુજ આગે કેહા ?-અજિત ॥૨॥

તુંહી અ-ગોચર કો નહીં, સજ્જન ગુન રેહા ।

આહે તાકું આહિચે, ધરી ધર્મ-સ્નેહા-અજિત ॥૩॥

ભગત-વચ્છલ જગતારનો, તું બિરુદ વહે હા ।

વીતરાગ હું વાલહા, કયું કરી દો છેહા ?-અજિત ॥૪॥

જે જિનવર હૈ ભરતમેં, ઐરવત વિદેહા ।

જસ કહે તુજ પદ પ્રણમતેં,

સમ પ્રણમે તેહા-અજિત ॥૫॥



૩ મનમેળ, ૪ સેવક,

(૧૩૨૪) (૫૬-૩) શ્રી સંભવનાથ-જિન સ્તવન

(રાગ-ગાડી)

સંભવ જિન જળ નયન મિલ્યો હો ॥

પ્રગટે પૂરવ પુણ્યકે અંકુર,

તખથેં દિન મોહી સફલ વલ્યો હો ।

અંગનમેં અમિય-મેહ વૂઠે,

જન્મ-તાપકો ૧૦યાપ ગલ્યો હો !-સંભવ૦ ॥૧॥

જૈસી ભક્તિ તૈસી પ્રભુ કરૂના,

સ્વેત શંખમેં દૂધ લલ્યો હો ।

દરશનથેં નવનિધિ મેં પાછ,

દુઃખ-દોહગ સવિ દૂર ટલ્યો હો !-સંભવ૦ ॥૨॥

ડરત ફિરત હે દૂર હી ફિલથેં,

મોહમલ્લરજિણે જગત્રય છલ્યો હો !-સંભવ૦ ॥૩॥

સમક્તિ રતન લહું દરિસણ થે,

અળ નવિ ભઠં કુગતિ રૂલ્યો હો !-સંભવ૦ ॥૪॥

નેહ નજર-ભર નિરખતહી મુઝ,

પ્રભુશું હિયડો હેજ હલ્યો હો ।

શ્રી નયવિજય વિપ્રુધ સેવકકું,

સાહિબ મુરતરૂ હોઈ રૂલ્યો હો !-સંભવ૦ ॥૫॥



૧ ફેલાવો, ૨ જે મોહરાગએ

(૧૩૨૫) (૫૫-૪) શ્રી અભિનંદન-જિન સ્તવન
(સગ-નટ)

પ્રભુ ! તેરે નયનથી હું બલિહારો ।

૧યાકો શોભા-વિજિત તપસ્યા, કમલ કરતુ હૈ જલચારો ।

વિધુકે શરણુ ગયો મુખ-સરિખે,

વનથે' ગગન હરિણુ હારો-પ્રભુ ॥૧૧॥

૨સહજ હી અંજન મંજુલ નિરખત,

ખંજન ગર્વ' હીયો દારો ।

છીન લહો હિ ચક્રોરકી શોભા,

અગ્નિ લખે સો દુઃખ ભારી-પ્રભુ ॥૧૨॥

ચંચલતા ગુણ લીધો મીનકો,

અલિ જ્યુ' તારા હે કારી ।

૧ જેમના નેત્રોથી શોભાથી જીતાએલ કમળ પાણીમાં રહીને તપસ્યા કરે છે,

વળી પ્રભુના નેત્રોની શોભાથી હાર પામેલ હરણુ જંગલ-માંથી પ્રભુના મુખ જેવા ચંદ્રના શરણે આકાશમાં ગયો (૧ લી ગાયાનો અર્થ)

૨ સ્વાભાવિક રીતે જાણે અંજન આંજેલા સુંદર પ્રભુજીનાં નેત્રો જોઈ ખંજન પક્ષી એ પોતાની સુંદર આંખોનો ગર્વ ખોઈ નાખ્યો.

તેમ જ પ્રભુના નેત્રોની શોભા જોઈ ચક્રોર પક્ષી પોતાની હાર કપૂલી ભારે દુઃખથી અંગારાતું ભક્ષણ કરે છે. (બીજી ગાયાનો અર્થ)

૩ માછલીની ચંચળતાનો ગુણ પ્રભુનાં નેત્રોએ લીધો, અતે ભ્રમરાની જેમ કીકી કાળી છે. પ્રભુનાં નેત્રોની સુભગતાનાં કેટલાં વખાણુ કરે ? (ત્રીજી ગાયાનો અર્થ)

કહું સુભગતા કેતી ઇનકી ?

મોહે સખહી અમરનારી-પ્રભુ ॥૩૧॥

૪ ધૂમત હે સમતા-રસ-માતે, જેસે ગજ ભર-મદવારી ।

તીન ભુવનમાં નહી કોઇનકો,

અભિનંદન જિન અનુકારી-પ્રભુ ॥૩૨॥

મેરે મન તો તુંહી રચત હે, પપરે કુણુ ? પરકે ભારી ।

તેરે નયનકી મેરે નયનમેં,

જસ કહે દીયો છબી અવતારી-પ્રભુ ॥૩૩॥



(૧૩૨૬) (૫૬-૫) શ્રી સુમતિનાથ-જિન સ્તવન

(રાગ-માર)

સુમતિનાથ સાચા હો ।

પરિપરિ પરખતહી ભયા, જૈસા હીરા જાયા હો ।

ઘોર દેવ સવિ પરિહર્યા, મેં જાણી કાચા હો-સુમતિ ॥૧॥

તૈસી કિરિયા હૈ ખરી, જૈસી તુજ વાચા હો ।

ઘોર દેવ સવિ મોહે ભર્યા,

સવિ મિથ્યા માચા હો-સુમતિ ॥૨॥

૪ મદમસ્ત બનેલ હાથીની જેમ સમતારસથી પુષ્ટ પ્રભુની આંખો ધૂમી રહી છે. ત્રણ ભવનમાં શ્રી અભિનંદન પ્રભુને બરાબર કોઈ નથી, જાણે આ વાત ઘોળાતી આંખો કહી રહી છે. (ચોથી ગાયાનો અર્થ)

૫ ખીજની પાછળ કોણ પડે (પાંચમી ગાયાની ખીજ લીટીનો અર્થ)

૬ ઉતારી.

ચઉરાસી લાખ વેષમાં, હું ૧ બહુ પરિ નાચા હો ।

સુગતિ દાન દેઇ સાહિબા,

અખ કરહો ૨ ઉવાચા હો-સુમતિ ॥૩॥

લાગી અગ્નિ-કષાયકી, સખ ઠોરહી આંચા હો ।

રક્ષક બાણી આદર્યા,

મૈં તુમ શરન સાચા હો-સુમતિ ॥૪॥

પક્ષપાત નહિં કોઈસું, નહિ લાલચ-લાંચા હો ।

શ્રી નયવિજય સુ-શિષ્યકો,

તોમું દિલ રાચા હો-સુમતિ ॥૫॥

(૧૩૨૭) (૫૬-૬) શ્રી પદ્મપ્રભ-જિન સ્તવન

(રાગ પૂરવી)

ઘડી ઘડી સાંભરે સાંઇ સલૂના-ઘડી ઘડી ॥

પદ્મપ્રભ જિન દિલસે ન વિસરે,

માનું કિયો કછુ ગુનકો દૂના ।

દરિસન દેખતહી સુખ પાઉં,

તો બિન હોત હું ૧ ઉના-દૂના-ઘડી ॥૧॥

પ્રભુ ગુન જ્ઞાન-ધ્યાન વિધિ રચના, પાન સુપારી કાથા ચૂના ।

રાગ ભયો દિલમેં આયોગેં,

રહે છિપાયા ના છાના-છૂના-ઘડી ॥૨॥

પ્રભુ ગુન ચિત્ત બાંધ્યો સખ સાખે,

કુન પઈસે લેઈ ઘરકા ખૂના ।

૧ બહુ રીતે, ૨ વરદાનથી તુષ્ટ,

૧ ઉંચોનીચો,

રાગ જગા પ્રભુશું મોહિ પરગટ,

કહો ! નયા કાઉ કહો જૂના ?-ઘડીં ॥૩૩॥

લોક-લાજસે જે ચિત્ત ચોરે, સો તો સહજ વિવેકહી સૂના ।

પ્રભુ- ગુણ ક્યાન વિગર ભ્રમભૂલા,

કરે કિરિયા સો રેરને રૂના-ઘડીં ॥૩૪॥

મૈં તો નહ કિયો તોહાં સાથે,

અખ નિવાહો તો ડોચેઈ ઝૂના ।

જસ કહે તો બિનુ ચોર ન સેવું,

અમિય ખાઈ કુન ચાખે લૂના ?-ઘડીં ॥૩૫॥

★

(૧૩૨૮) (૫૬-૭) શ્રી સુપાર્શ્વનાથ-જિન સ્તવનં

(રાગ-યમન કહ્યાણ)

ઐસેં સામી સુપાર્શ્વ સેં દિલ લગા ॥

કુઃખ ભગા ! સુખ જગા ! જગ-તાસણા ! ।

રાજહંસકું માનસરોવર, રેવા-જલ જયું રવારણા ।

ખીર-સિંધુ જયું હરિકું પ્યારો,

જાનીકું તત્વ-વિચારણા-ઐસેં ॥૧॥

મોરકું મેહ ચકોરકું ચંદા,

ઉમધુ યમનમથ ચિત્ત-ઠારના ।

ફૂલ અમૂલ ભમરકું પઅંબહી,

કોકિલકું સુખ-કારના-ઐસેં ॥૨॥

૨ જંગલમાં રોવું, ૩ તમારાથી, ૪ થશે.

૧ નર્મદાનું પાણી, ૨ હાથી, ૩ વસંત, ૪ કામદેવ, ૫ આખો,

સીતાકું રામ કામ જ્યું રતિકું, પંથીકું ઘર-ધારના ।
દાનીકું ત્યાગ ઈયાગ બંભનકું,

ચોગીકું સંયમ ધારના-ઐસેં ॥૩૧॥

નંદન વન જ્યું સુરકું વદલબ, ન્યાયીકું ન્યાય નિહારના ।
ત્યું મેરે મન તુંહો સુહાચો,

ઝોર તો ચિત્તથે ઉતારના-ઐસેં ॥૩૨॥

શ્રી સુપાર્થ દરિશન પર તેરે, કીજે કોડિ ઉવારના ।

શ્રી નયવિજય વિબુધ સેવકકું,

ક્રિયો સમતારસ પારના-ઐસેં ॥૩૩॥



(૧૩૨૯) (૫૬-૮) શ્રી ચંદ્રપ્રભ-જિન સ્તવન

(રાગ-રામગ્રી)

શ્રી ચંદ્રપ્રભ જિનરાજ રાજે, વદન પુનમ ચંદ રે ।

ભવિક દોઝ-ચકોર નિરખત,

લહે પરમાનંદ રે-શ્રી ચંદ્રં ॥૧૧॥

મહમહે મહિમાયેં જસભર, સરસ જિમ અરવિંદરે ।

રણુઝણે કવિજન લમર રસિયા,

લહી સુખ મકરંદરે-શ્રી ચંદ્રં ॥૨૧॥

જસ નામે હોલત અધિક હીચે, ટલે 'દોહન-દંદરે ।

૬ યસ

૧ દુઃખનાં જોડલાં, (માન-અપમાન, ઠંડી-ગરમી, બૂખ-તસ્સ આદિ)

જસ ગુણ-કથા ભવર-વ્યથા ભાંજે,

ધ્યાન શિવતરૂ-કંદરે -શ્રી ચંદ્રં ॥૩૭॥

વિપુલ હૃદય વિશાલ ભુજ-યુગ, ડચલતી ચાલ ગયંદરે ।

અ-તુલ્ય અતિશય મહિમ-મંદિર,

પ્રભુત સુરનર-વૃંદરે-શ્રી ચંદ્રં ॥૪૭॥

મૈં હૂં દાસ આકર પ્રભુ ! તેરો, શિષ્ય તુજ ઋક્ષજંદ રે ।

જસવિજય વાચક ઈમ વિનવે,

ટાલો મુજ ભવ-ફંદરે-શ્રી ચંદ્રં ॥૫૭॥



(૧૩૩૦) (૫૬-૯) શ્રી સુવિધિનાથ-જિન સ્તવન

(રાગ કેદારો)

મૈં કીનો નહી ૧તો જિન ૨ઔરશું રાગ ॥

દિન દિન ઉવાન ચઢત શુન તેરો, જયું કંચન પર-૪ભાગ ।

ઔરન મેં હૈ કષાયકી કાલિમા,

સો કયું ? સેવા ૫-ભાગ; મૈં ૦ ॥૧॥

રાજહંસ તું માન-સરોવર, ઔર અશુચિ-રૂચિ કાગ ।

વિષય-ભુજંગમ ગરૂડ તું કહિયેં,

ઔર વિષય-વિષનાગ-મૈં ૦ ॥૨॥

ઔર દેવ જલ-છીલર સરીખે, તું તો સમુદ્ર અથાગ ।

૨ સંસારની પીઠા, ૩ ગતિ, ૪ હૈયા સંબંધ વાળો,

૧ તમારા વિના, ૨ ખીજથી, ૩ તેજ, ૪ અંદર ખાસીયત,

૫ સેવાને યોગ્ય;

તું સુરતર જગ-વંછિત-પૂરન,
 ઔર તો સૂકે સાગ-મૈં ॥૩૧॥
 તું પુરુષોત્તમ તુંહી નિરંજન, તું શંકર વડભાગ ।
 તું બ્રહ્મા તું બુદ્ધ મહાબલ,
 તુંહી દેવ વીતરાગ-મૈં ॥૩૨॥
 સુવિધિનાથ તુજ ઈશુન-ફૂલનકો, મેરો દિલ હૈ ૭ભાગ ।
 જસ કહે ભમર-રસિક હુઈ તામેં,
 લીજેં ભકિત-પરાગ-મૈં ॥૩૩॥



(૧૩૩૧) (૫૬-૧૦) શ્રી શીતલનાથ-જિન સ્તવન.
 શીતલ-જિન મોહિ પ્યારા !

સાહિબ ! શીતલ જિન મોહિ પ્યારા ॥
 ભુવન વિરોચન પંકજ-લોચન, જિઉકે જિઉ હમારા-
 સાહિબ ॥૧॥
 જયોતિશું જ્યોત મિલત જળ ધ્યાવેં,
 હોવત નહિં તબ ન્યારા ॥

બાંધી સુઠી ખુલે જળ માયા,
 મિટે મહા બ્રમ-ભારા-સાહિબ ॥૨॥
 તુમ ન્યારે તબ સખહી ન્યારા, અંતર-કુટુંબ ઉદારા ।
 તુમહી નજીક નજીક હૈ સખહી
 ઋદ્ધિ અનંત અપારા-સાહિબ ॥૩॥

૬ ગુણરૂપી ફૂલ માટે, ૭ બગીચો,
 ૧ સૂર્ય,

વિષય રસગનકી અગનિ બુઝાવત,

તુમ ગુણ અનુભવ-ધારા ।

ભઈ મગનતા તુમ ગુણ-રસની,

કુણ કંચણ ! કુણ દારા ! સાહિબં ॥૪॥

શીતલતા ગુણ ડહોર કરત તુમ, ચંદન કાળં બિચારા ।

નામ હી તુમ તાપ હરત હૈ

૪વાકું ઘસત ઘસારા-સાહિબં ॥૫॥

કરહું કબટ જન બહુત હમારે, નામ તિહારો આધારા ।

જસ કહે જનમ-મરણ-ભય ભાગે,

તુમ નામે ભવપારા-સાહિબં ॥૬॥



(૧૩૩૨) (૫૬-૧૧) શ્રી શ્રેયાંસનાથ-જિન સ્તવન

શ્રી શ્રેયાંસનાથ જિણંદજી ! અવધારો ૧અરદાસ-લાલ રે ।

દાસ કરી જો રહેખવો,

તો પૂરો મન-આશ-લાલ રે-શ્રીં ॥૧॥

મોટા-નાના અંતરું, લેખવે નહિ દાતાર-લાલ રે ।

સમ-વિષમ-સ્થલ નવિ ગણે,

વરસંતો જલધાર-લાલ રે-શ્રીં ॥૨॥

નાનાને મોટા મિલ્યા, સહી તે મોટા થાય-લાલ રે ।

ઝવાહુલીયા ગંગા મિલ્યા,

ગંગ-પ્રવાહ કહાય-લાલ રે-શ્રીં ॥૩॥

૨ તૃણા. ૩ હોડ=ખરાખરી, ૪ તેને

૧ વિનતિ, ૨ માનો, ૩ નાનાં બહેણો,

મોટાને મોટા કરો, એ તો જગતની રીત-લાલ રે ।

નાના ને મોટા કરો,

તો તુમ્હ પ્રેમ-પ્રતીત-લાલ રે-શ્રી૦ ॥૪॥

ગુણ-અવગુણ નવિ લેખવે, અંગીકૃત ને અ-મંદ-લાલ રે ।

૪ કુટિલ ૫ કલંકી જિમ વહ્યો,

૬ ધશ્વર શીષે ચંદ-લાલ રે-શ્રી૦ ॥૫॥

અવગુણીએ પણ ઓળખ્યો, ગુણવંત તું ભગવંત-લાલ રે ।

નિજ સેવક બાણી કરી,

દીને સુખ અનંત-લાલ રે-શ્રી૦ ॥૬॥

ઘણી શી વિનતી કીજીયે ?, જગજીવન જિનનાહ-લાલ રે ।

નયવિજય સેવક કીજીયે,

અંગીકૃત-નિરવાહ-લાલ રે-શ્રી૦ ॥૭॥



(૧૩૩૩) (૫૬-૧૫) શ્રી ધર્મનાથ-જિન સ્તવન

(એક દીન પુંડરીક ગણધરુ-રે લાલ-એ દેશી)

સ્તનપુરી નગરી હુઓ રે લાલ,

લંછન વજ ઉદાર-મેરે ખ્યારે રે ।

ભાનુ-નૃપતિ કુળ-કેશરી રે લાલ,

સુવતા-માત મહુદાર-મેરે ખ્યારે રે-

-ધર્મ જિનેસર ધ્યાઇયે રે લાલ ॥૧॥

આયુ વરસ દશ લાખનું રે લાલ,

ધનુ પશુપાલ પ્રસિદ્ધ-મેરે ખ્યારે રે ।

૪ વાંઝા, ૫ કલંક વાળો, ૬ મહાદેવના માથે,

કંથન વરણુ વિરાજતો રે લાલ,

સહસ સાથે વ્રત લીધ-મેરે ॥૨૧॥

સિદ્ધિ-કામિની કર ગ્રહે રે લાલ,

સમેતશિખર અતિરંગ-મેરે પ્યારે રે ॥૨૨॥

સહસ ચોસઠ સોહામણુ રે લાલ,

પ્રભુના સાધુ અલંગ-મેરે ॥૨૩॥

બાસઠ સહસ સુસાહુણી રે લાલ,

વળી ઉપરી શત ચ્યાર-મેરે પ્યારે રે ।

કંદર્પા શાસન-સુરો રે લાલ,

કિન્નર સુર સુવિચાર-મેરે ॥૨૪॥

લટકાળે તુજ લોચણે રે લાલ,

મોહ્યા જગ જન ચિત્ત-મેરે પ્યારે રે ।

શ્રીનયવિજય વિબુધ તણે રે લાલ,

સેવક સમરે નિત્ય-મેરે ॥૨૫॥



(૧૩૩૪) (૫૬-૧૬) શ્રી શાંતિનાથ-જિન સ્તવન

હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં,

ધ્યાનમેં ધ્યાનમેં ધ્યાનમેં-હમ ॥

બિસર ગઈ ૧દુવિધા તન-મનકી,

અચિરા સુત ગુણ ગાનમેં-હમ ॥૧॥

હરિ-હર-બ્રહ્મ-૨પુરંદરકી ઋદ્ધિ, આવત નાહં કોઈ માનમેં ।

ચિદાનંદકી મોજ મચી હે, સમતા-રસકે પાનમેં-હમ ॥૨॥

૧. પીડા ૨. ઇંદ્રની.

ઇતને દિન તુમ નાહિં પિછાણ્યો, મેરો જનમ ગયો અ-જાણ્યો ।
અળ તો અધિકારી હોઇ ખેઠે.

પ્રભુ ગુણ અ-ખય-ખજનમેં-હમ ॥૩૭॥
મિટ ગઈ દીનતા સખહી હમારી,

પ્રભુ ! તુજ સમકિત-દાનમેં ।

પ્રભુ-ગુણ-અનુલવ-રસકે આગે,

આવત નહિ કોઉ માનમેં-હમ ॥૪૦॥

જિણ્હી પાયા તિણ્હી છીપાયા, કહત નહિ કોઉ કાનમેં ।
તાણી લાગી જખ અનુલવકી,

તખ સમજે કોઉ સાનમેં-હમ ॥૪૧॥

પ્રભુ-ગુણ-અનુલવ-રચન્દ્રહાસ જ્યોં,

સો તો ન રહે મ્યાનમેં ।

વાચક જશ કહે મોહ મહા-અરિ,

જીત લીયો હૈ મેદાનમેં-હમ ॥૪૨॥



(૧૩૩૫) (૫૬-૧૭) શ્રી કુંથુનાથ-જિન સ્તવન
(હાલ-મરકલડાની)

ગજપુરનગરી સોહીયેં જી-સાહિબ ગુણીલો,

શ્રી કુંથુનાથ મુખ મોહીયેં જી-સાહિબ ગુણીલો ।

સૂર-નૃપતિ કુલચંદલોજી-સાં,

શ્રી-નંદન લાવે વંદોજી-સાં ॥૧॥

જાતે નામની શ્રેષ્ઠ લક્ષ્મી,

અજ-લંછન વંછિતપૂરેજી-સાં,

પ્રભુ સમરીઓ સંકટ ચૂરે જી-સાં ।

પાંત્રીસ ધનુષ તનુ માનેજી-સાં,

પ્રત એક સહસ્ર અનુમાનેજી-સાં ॥૨૧॥

આયુ વરષ સહસ્ર પંચાણુજી-સાં,

તનુ સોવન-વાન વખાણુજી-સાં ।

સમેતશિખર શિવ પાયાજી-સાં,

સાઠ સહસ્ર મુનીશ્વર-રાયાજી સાં ॥૨૨॥

ખટ શત વળી સાઠ હજારજી-સાં,

પ્રભુ-સાધ્વીનો પરિવારજી-સાં ।

ગંધર્વ બળા અધિકારી જી-સાં,

પ્રભુ શાસન-સાન્નિધ્યકારીજી-સાં ॥૨૩॥

મુખદાયક મુખને મટકેજી-સાં

લાખેણે લોચણ લટકેજી-સાં ।

મુખ શ્રી નમવિજય મુણીકનોજી-સાં,

સેવકને હીઓ આણુંદોજી-સાં ॥૨૪॥

ૐ

(૧૩૩૬) (૫૬-૧૮) શ્રી અરનાથ-જિન સ્તવન

(સમર્યા રે સાદ દીઓ રે દેય-એ દેશી)

અરજિન ગજપુર વર શિષ્યગાર,

તાત મુદશન દેવી મલ્હાર-

સાહિબ સેવીયે ।

ત્રીશ ધનુષ પ્રભુ ઉંચી કાય,

વરષ સહસ્ર ચોરાશી આય-સાહિબ ॥૨૫॥

નંદાવતી વિરાજે ૧અંક,

ટાળે પ્રભુ ભવ-ભવના આતંક-સાહિબં ।

એક સહસ્રશ્યું સંયમ લીધ,

કનક-વરણ તતુ જગત પ્રસિદ્ધ-સાહિબં ।

સમેતશિખર ગિરિ સખળ ઉછાહ,

સિદ્ધિ વધૂનો કર્યો રે વિવાહ-સાહિબં ।

પ્રભુના મુનિ પચાસ હજાર,

સાઠ સહસ સાધ્વી પરિવાર-સાહિબં ॥૩૩॥

યક્ષેન્દ્ર પ્રભુ સેવાકાર,

ધારિણી શાસનની કરે સાર-સાહિબં ।

રવિ ઉચ્ચે નાસે જિમ ચોર,

તિમ પ્રભુના ધ્યાને કરમ કઠોર-સાહિબં ॥૪॥

તું સુરતરે ચિંતામણી સાર,

તું પ્રભુ-ભગતે મુગતિ કાતાર-સાહિબં ।

બુધ જશવિજય કરે અરદાસ,

દીઠે પરમાનંદ વિલાસ-સાહિબં ॥૫॥



(૧૩૩૭) (૫૬-૧૯) શ્રી મલ્લિકનાથ-જિન સ્તવન

(પ્રથમ ગોવાળ તણે ભવેલ-એ દેશી)

મિથિલા નગરી અવતર્યોલ, કુંભ નૃપતિ-કુળ ૧ભાણ ।

રાણી પ્રભાવતી ઉર ધર્યોલ, પચવીશ ધનુષ પ્રમાણ-

-ભવિક જન વંદે મલ્લિકજિણુંદ ।

જિમ હોયે પરમ આનંદ-ભવિક જન૦ વંદો૦ ॥૧૧॥
 લાંછન કલશ વિરાજતોજી, નીલ-વરણ તનુ કાંતિ ।
 સંયમ લીયે શત ત્રણશ્યુંજી,
 ભાંજે ભવની બ્રાંતિ-ભવિ૦ વંદો૦ ॥૧૨॥

વરપ પંચાવન સહસનુંજી, પાળી પૂરણ આય ।
 સમેતશિખર શિવપદ લહ્યુંજી,
 સુર-કિન્નર ગુણ ગાય-ભવિ૦ વંદો૦ ॥૧૩॥
 સહસ પંચાવન સાહુણીજી, મુનિ ત્યાલીશ હજાર ।
 વૈરોટયા સેવા કરે જી,
 યક્ષ કુમેર ઉતાર-ભવિ૦ વંદો૦ ॥૧૪॥

મૂરતિ મોહન-વેલડીજી, મોહે જગજન જાણુ ।
 શ્રી નયવિજય સુશિખ્યનેજી,
 હીયો પ્રભુ કોડિ કલ્યાણ-ભવિ૦ વંદો૦ ॥૧૫॥



(૧૩૩૮) (૫૬-૨૦) શ્રી મુનિસુવ્રત-જિન સ્તવન

શ્રી મુનિસુવ્રત હરિકુલ ચંદા, દુરનય પંથ નસાયો ।
 સ્યાદ્વાદ રસ ગભિંત બાની, તત્ત્વ સ્વરૂપ જનાયો-
 સુણ જ્ઞાની ! જિન બાની ! રસ પીળે અતિ સન્માની ॥૧૧॥
 બંધ-મોક્ષ એકાંતે માની, મોક્ષ-જગત ઉછેદે ।
 ઉભય-નયાત્મક ભેદ ગ્રહીને, તત્ત્વ પદારથ વેદે-સુણુ૦ ॥૧૨॥
 નિત્ય અનિત્ય એકાંત કહીને, અરથ ક્રિયા સમ નાસે ।

ઉભય સ્વભાવે વસ્તુ ખિરાળે,

સ્વાદ્વાદ ઇમ ભાસે-સુણુ ॥૩॥

કરતા ભોગતા બાહિર દબ્દે, એકાંતે નહીં થાવે ।

નિશ્ચય શુદ્ધ નયાતમ રૂપે,

કુણુ કરતા ભુગતાવે ?-સુણુ ॥ ૪ ॥

રૂપ વિના ભયો રૂપસ્વરૂપી, એક નયાતમ સંગી ।

તન વ્યાપી વિભુ એક-અનેકા,

આનંદધન દુઃખરંગી-સુણુ ॥૫॥

શુદ્ધ અશુદ્ધ નાશો અવિનાશી, નિરંજન નિરાકારો ।

સ્વાદ્વાદ મત સધરો નીકો,

દુરનય પંથ નિવારો-સુણુ ॥૬॥

સપ્તસંગી મતદાયક જિનજી, એક અનુગ્રહ કીજો ।

આતમરૂપ જિસો તુમ લીધો,

સો સુજશકું દીજો-સુણુ ॥૭॥

(૧૩૩૬) (૫૬-૨૨) શ્રી નેમિનાથ-જિન સ્તવન

તુજ દરીશન દીકું અમૃત મીકું લાગે રે-યાદવજી !

ખિણખિણ સુજ તુજશું ધર્મ-અનેકો જાગે રે-યાદવજી !

તું ઢાતા વ્રાતા બ્રાતા માતા તાત રે-યાદવજી ।

તુજ ગુણના મોટા જગમાં છે અવદાત રે-યાદવજી ॥૧॥

૧ કાયે રતિ માંડો સુરમણિ છાંડે કુણુ રે ?-યાદવજી !,

૧ કાયની સાથે પ્રેમ કરી સુરમણિ=ચિતામણિને કાણુ છોડે ?

(ખીજ ગાયાની ૧લી લીટીનો અર્થ)

મીઠી સાકર મૂઝી ખાથે કુણુ વળી લુણુ રે ? યાદવજી ! ।
 મુજ મન ન સુઢાથે તુજ વિણુ ખીજે દેવ રે-યાદવજી !,
 હું અહનિશી ચાહું તુજ,

પય-પંકજ-સેવ રે-યાદવજી ॥૨૦॥

રસુર નંદન હે બાગ જ જિમ રહેવા સંગ રે-યાદવજી !,
 જિમ પંકજ ભુંગા શંકર ગંગા રંગ રે-યાદવજી !,
 જિમ ચંદ ચકોરા મેહા મોરા પ્રીતિ રે-યાદવજી !,
 તુજમાં હું ચાહું તુજ ગુણુને

જોગે તે છતી રે-યાદવજી ! ॥૨૧॥

મેં તુમને ધાર્યા વિસાર્યા નવિ જાય રે-યાદવજી !,
 દિન રાતે ઝલાતે ધ્યાઈ તો સુખ થાય રે-યાદવજી !,
 દિલ ઠરણા આણો જો તુમ જાણો રાગ રે-યાદવજી !,
 દાખો એક ધવેરા પભવજલ કેરો દતાગ રે-યાદવજી ! ॥૨૨॥

હુઃખ ટલીયો મિલીયો આપ મુજ જગનાથ રે-યાદવજી !,
 સમતા રસ ભરીયો ગુણુગણુ-હરીયો શિવ સાથ રે-યાદવજી !,
 તુજ મુખડું હીઠે હુઃખ નીઠે સુખ હોઈ રે-યાદવજી !,
 વાચક જસ યોલે તુજ તોલે ન કોઈ રે-યાદવજી !

વૈરાગી રે, સોભાગી રે-યાદવજી ! ॥૨૩॥



૨ જેમ દેવો નંદન બગીચામાં રહેવા તત્પર હોય, (ત્રીજી ગાથાની
 ૧ લી લીટીનો અર્થ) ૩ વિવિધ રીતે, ૪ એકવાર ૫ સંસારરૂપ
 સમુદ્રનો ૬ પાર.

(૧૩૪૦) (૫૬-૨૩) શ્રી પાર્શ્વનાથ-જિન સ્તવન

મેરે સાહિબ તુમહી હો। પ્રભુ પાસ-જિણુંદા ।

ખજમતમાર ગરીબ હું મં તેરા બંદા-મેરે ॥૧॥

મેં ચકોર કડં ચાકરી, જબ તુમહી ચંદા ।

ચકવાક પરે હુછં રહું, જબ તુમહી દિણુંદા-મેરે ॥૨॥

મધુકર પરે મેં રણબણું, જબ તુમ અરવિંદા ।

ભક્તિ કડં ખગયતિ પરે,

જબ તુમહી ગોવિંદા-મેરે ॥ ૩ ॥

તુમ જબ ગર્જિત ઘન ભયે, તબ મેં ૧શિખિ-નંદા ।

તુમ સાયર જબ મેં તદા,

સુર-રસરિતા અ-મંદા-મેરે ॥ ૪ ॥

દૂર કરો દાદા પાસે !, ભવ-દુઃખકા ફંદા ।

વાચક જશ કહે દાસકું,

દીઝો પરમાનંદા-મેરે ॥ ૫ ॥



(૧૩૪૧) (૫૬-૨૪) શ્રી મહાવીર-જિન સ્તવન

(રાગ-કાફી હુસેની)

(રાગ કાનડો-યા ગતિ કોન હે સખી ! તોરી-એ કેશી)

સાહિબ ધ્યાયા મન-મોહના !

જગ-સોહના, ભવિ મોહના-સાહિબ ધ્યાયા ।

૧ મોર, ૨ ગંગા,

આજથેં સફલ મેરે, માનું ચિંતામણિ પાયા ।

ચોસઠ ઇન્દ્ર મિલ્લીય પૂજ્યો,

ઇંદ્રાણી શુભ ગાયા-સાહિબં ॥૨॥

જનમ મહોત્સવ કરે દેવ, મેરૂ-શિખર લે આયા ।

૧હરિ કે મન સંદેહ જાની,

ચરણેં મેરૂ ચલાયા-સાહિબં ॥ ૩ ॥

અહિ-વેતાલરૂપ દાખી, દેવે ન વીર ખોલાયા ।

પ્રગટ ભયે પાય લાગી, વીર નામે બુલાયા-સાહિબં ॥૪॥

ઇંદ્ર પૂછે વીર કહે, વ્યાકરણ નીપાયા ।

મોહથેં નિશાલ-ઘરનેં ચુંહી વીર પઠાયા-સાહિબં ॥૫॥

વરસી દાન દેઈ ધીર, લેઈ વ્રત સુઢાયા ।

સાલ-તલેં ધ્યાન ધ્યાતાં ઘાતી વ્રન ખપાયા-સાહિબં ॥૬॥

લહી અનંતજ્ઞાન આપે, રૂપે ઝગમગાયા ।

જશ કહે હમ સોઈ વીર,

જયૈતિસું જયૈતિ મિલાયા-સાહિબં ॥૭॥



॥ श्री वर्धमानस्वामिने नमः ॥

સંપાદક-સંકલિત વિશિષ્ટ ઉપયોગી

જિન-સ્તવન ચોવીશી

(૫૭)

(૧૩૪૨) (૫૭-૧અ) શ્રી આદિનાથ-જિન-સ્તવન

(રામ કહો રહેમાન કહો એ-દેશી)

‘તારન તરન’ કહાવત હો, જ્યું આપ તરે હમહીકો તારો ।
આદિનાથ પ્રભુ તુમહારી કીરતિ,

તાહીકો તુમ અથ^૧ જિયારો ॥૧॥

પહેલે તારક આપ કહાવત, તાકે પીછે તરહ ઉવારો ।

સો તુમ આપ તરે પહેલહી,

^૧ અજહુતો પ્રભુ ! મોહે ન સંભારો ॥૨॥

‘દીનદયાલ’ ઉચિત યુંહીથી,

દીન સહિત શિવ માંહી સિદ્ધારો ।

ઉચિત કહા ! તુમ અર્જ^૨કે શિવમે^૩

હમ જગમાંહી કરત પુકારો ॥૩॥

તુમ તો ‘જગ નાયક’ ‘શિવલાયક,’ દેખો કોઉ દિન ગવારો ।

પહેલે પાર કરો ગરીબનકું, આપ હુતે સમ પીછે પારો ॥૪॥

૧ હજ સુધી,

જો કીની સો ૨આછી કીની, અમ મોરી બિનતી અવધારો ।
ચરન અહી તુમહી તારોજે,

સેવક જશ લહો શરન તુમારો ॥૫૫॥

❧

(૧૩૪૩) (૫૭-૧ આ) શ્રી ઋષભદેવ-જિન સ્તવન

(આજ જિનરાજ મુજ કાજ સિધ્યાં સવે-એદેશી)

ઋષભ જિનરાજ, મુજ આજ દિન અતિ લલો,

શુભનીલો જેણે? તુજ નયણ દીઠો ।

હઃખ ટળ્યાં સુખ મળ્યાં સ્વામિ । તુમ નિરખતાં,

સુકૃત-સંચય હુઓ પાપ^૨નીઠો-ઋષભ ॥૧॥

૩કલ્પશાખી ફળ્યો કામઘટ મુજ મળ્યો,

આંગણે અમિયનો મેહ વૂઠો ।

મુજ ૪મહીરાણ ૫મહી-ભાણ તુજ દર્શને,

ક્ષય ગયો કુમતિ-અધાર બૂઠો-ઋષભ ॥૨॥

કવણ નર કનકમણિ છોડી તૃણ સંગ્રહે, ?

કવણ કુંજર^૬તણ^૭કરહ લેવે ? ।

કવણ મેસે તણ કલ્પતરૂ બાઉલે ? ,

તુજ તણ અવર સુર કોણ સેવે ?-ઋષભ ॥૩॥

એક મુજ ટેક સુવિવેક સાહિબ સદા,

તુજ વિના દેવ હુજો ન 'ધહું' ।

૨ સારી,

૧ જે કારણથી, ૨ દૂર થયું, ૩ કલ્પવૃક્ષ. ૪ વેરાન જેવી, ૫ પૃથ્વીના સૂર્ય જેવા ૬ હાથી, ૭ ઉંટ, ૮ ઇંધું,

તુજ વચન-રાગ સુખ-સાગરે ઝીલતો,

કર્મ ભર ભ્રમ થકી હું ન બોહું.-ઋષભ ૥૪૥

કોઠી છે કાસ વિભુ ! તારૂં ભલભલા,

માહરે દેવ ! તું એક પ્યારો !

પતિત-પાવન સમે જગત-ઉદ્ધાર-કર, ?

મહેર કરો મોઢે ભવ જલધિ તારો-ઋષભ ૥૫૥

મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી,

જેહશું સખલ પ્રતિબંધ લાગો !

ચમક-પાષાણુ જિમ લોહને ખેંચશે,

મુક્તિને સહજ તુજ ભક્તિ-રાગો-ઋષભ ૥૬૥

ધન્ય ! તે કાય જેણે પાય તુજ પ્રભુમિથે,

તુજ થુણે જેહ ધન્ય ! જિહા !

ધન્ય ! તે હૃદય જેણે તુજ સદા સમરતાં,

ધન્ય ! તે રાત ને ધન્ય ! દીહા-ઋષભ ૥૭૥

ગુણ અનંતા સદા તુજ ખળને ભર્યા,

એક ગુણ દેત મુજ શું વિમાસો ? !

રચણુ એક દેત શી હાણુ રચણાયરે ?

લોકની આપદા જેણે નાસો-ઋષભ ૥૮૥

ગંગ સમ રંગ તુજ કીર્તિ-કલ્પલોહિની,

રવિથકી અધિક તપ-તેજ તાને !

નયવિજય વિભુધ સેવક હું આપરો,

જસ કહે અખ મોઢે ભવ ? નિવાળો-ઋષભ ૥૯૥



(૧૩૪૪) (૫૭-૧૩) શ્રી ઋષભદેવ-જિન સ્તવન

(રાગ-ઓધવલ ! સંદેશો કહેજો મારા શ્યામને)

ઋષભ-જિનેશ્વર ! સ્વામી એ અરલ માહરી,

અવધારો કંઈ ત્રણ ભુવનના દેવ જો ।

કરુણાનંદ અખંડ રે જ્યોતિ-સ્વરૂપ છો,

એહવા જોધને મેં આદરી તુમ સેવ જો ॥૧॥

લાખ ચોરાશી યોનિ રે વારોવાર હું ભમ્યો,

ચોવીશ દંડકે ઉભયું માફ મન જો ।

નિગોઠાદિક ફરસી રે સ્થાવર હું થયો,

એમ રે ભમતો આવ્યો વિગલેન્દ્ર ઉપન્ન જો ॥૨॥

તિય'અ-પંચેન્દ્રી તણારે ભવ મેં બહુ કર્યા,

ફરસી ફરસી ચોદ રાજ મહારાજ જો ।

દશ-દૃષ્ટાન્તે ઢોહિલો મનુષ્ય-જન્મ અવતર્યો,

એમ રે ચઢતો આવ્યો શેરીએ શિવરાજ જો ॥૩॥

જગતતણા બંધવ રે જગ સથવાહ છો,

જગત-ગુરુ જગરૂખણુ એ દેવ જો ।

અજરામર અ-વિનાશી રે જ્યોતિ-સ્વરૂપ છો,

સુર-નર કરતા તુજ ચરણની સેવ જો ॥૪॥

મરૂદેવીના નંદન રે વંદના માહરી,

અવધારો કંઈ પ્રભુલ ! મહારાજ જો ।

ચોદ રાજનો ઉચ્છિષ્ટ હું પ્રભુલ ! તારીયે,

લીલ્યે રે કોઈ વાંછિત-ફળ જિનરાજ જો ॥૫॥

વંદના નિસુણી રે પરમ-સુખ દીલ્યે,
 કીલ્યે રે કંઈ જન્મ-મરણ દુઃખ દૂર જો, ।
 પદ્મવિજયજી સુપસાયે રે ઋષભ-જિન ભેટોયા,
 જિન વંદે કંઈ પ્રહ ઉગમતે સૂર જો ॥૬॥



(૧૩૪૫) (૫૭-૧ રૂ) શ્રી ઋષભદેવ-જિન સ્તવન
 (શ્રી સુપાસજિનરાજ)

શ્રી જિન જગ-આધાર, મરૂદેવી-માત-મલ્હાર ।
 આજ હો સ્વામી રે ! શ્રીઋષભ જિનેશ્વર સેવીયેજી શ્રીં ॥૨॥
 શત્રુજયગિરિ છત્ર, નાભિનરેશર પુત્ર ।
 આજ હો ! જીયે રે, જગદીસર તેજે ભાણુનેજી શ્રીં ॥૨॥
 આંચો હું પ્રભુ પાસ, સેવક ઘો શાખાસ ।
 આજ હો ! આશા રે, સાહિબ વિષ્ણુ કેહની દાસનેજી-શ્રીં ॥૩॥
 મન માને અરદાસ, માને મોટિમ જાસ ।
 આજ હો ! તોડે રે, મન મોડે નયન પસાડવેજી-શ્રીં ॥૪॥
 નામ ધરી જે નાથ, લે સહુના દિલ હાથ ।
 આજ હો ! નેહી રે, સ્થિતિ એહી મોટા મેઘનીજી-શ્રીં ॥૫॥



(૧૩૪૬) (૫૭-૧ રૂ) શ્રી ઋષભદેવ-જિન સ્તવન

તું ત્રિભુવન-સુખકાર-ઋષભજિન ! તું ત્રિભુવનં ॥

શત્રુજય-ગિરિ-શણુગાર-ઋષભં,

ભૂષણુ ભસ્ત્ર-મઝાર-ઋષભં

આદિ-પુરુષ અવતાર-ઋષભં ॥

તુમ ચરણે પાવન કયું રે, પૂર્વ નવાણું વાર ।
 તેણે તીરથ સમરથ થયું રે, કરવા જગત ઉદ્ધાર-ઋષભ ॥૧॥
 અવર તે ગિરિ પર્વતે વડોરે, એહ થયો ગિરિરાજ ।
 સિદ્ધ અનંત ઈહાં થયા રે,

વલ્લી આળ્યા અવર જિનરાજ-ઋષભ ॥૨॥

સુંદરતા સુર-સદનથી રે, અધિક જિહાં પ્રાસાદ ।
 બિંબ અનેકે શોભતો રે, દીઠે ટળે વિખવાદ-ઋષભ ॥૩॥
 ભેટણુ કાળે ઉમદ્યા રે, આવે સવિ ભવિ-લોક ।
 કલિ-મલ તસ અડકે નહિ રે,

રજયું સોવન ઘન રોક-ઋષભ ॥૪॥

જ્ઞાન વિમલ-પ્રભુ જસ શિરે રે, તસ કિસી ભવ-પરવાહ ? ।
 કર-તલ-ગત શિવ-સુંદરી રે,

મિલે સહજ ધરી ઉચ્છાદ-ઋષભ ॥૫॥



(૧૩૪૭) (૫૭-૨અ) શ્રી અજિતનાથ જિન-સ્તવન

(સુત સિદ્ધારથ-ભૂપનો રે)

અજિત-જિજ્ઞંસ કયા કરો રે, આણી અધિક પ્રમોદ ।

જાણી સેવક આપનો રે, સુણીયે વચન વિનોદ રે-

જિનજી સેવના ।

-ભવોભવ તાડુરી હોળે રે, એ મન-કામના ॥૧॥

૧. દેવ વિમાન, ૨ જમ રોકડા સોના આદિ ધનને કાટ ન લાગે
 (ચોથી ગાથાની ચોથી લીટીનો અર્થ)

કર્મશત્રુ તુમિ જિતીયા રે, તિમ મુજને જિતાડ ।

અ-જિત થાઈં દુશ્મન થકી રે,

એ મુજ પુરો ૧૩૬ાડ રે-જિન૦ ॥૨॥

જિતશત્રુ-નૃપ-નંદનો રે, જીપે વચરી જેહ ।

અચરિજ થઈં કષ્ટે કો નહિ રે,

અવધારો ગુણુ-ગેહ રે-જિન૦ ॥૩॥

સકલ પદારથ પામીએ રે દીઠે તુમ રહિદાર ।

સોભાગી મહિમા નીલો રે,

વિજયા-માતા મદ્દાર રે-જિન૦ ॥૪॥

જ્ઞાન વિમલ સુ-પ્રકાશથી રે, ભાસિત લોકલોક ।

શિવ-સુંદરીના વાલહા રે,

પ્રણમે' લવિજન થોક રે-જિન૦ ॥૫॥



(૧૩૪૮) (૫૭-૨આ) શ્રી અજિતનાથ-જિન સ્તવન

(દેશી-ઝરયાની)

અજિત-જિનેશ્વર સાહિબા રે ! હો !,

વિનતડી અવધાર-મ્હારા વહાલાણ ! હો ! ।

તું મનરંજન માહરો રે હો !,

દિલડાનો જલ્મુદાર-મ્હારા બહાલાણ ! હો-

-હવે નહિં છોડું ત્હારી ચાકરી રે હો....॥૧॥

લાખ ચોરાશી હું લખ્યો રે હો !,

કાળ અનંતો અનંત-મ્હારા બહાલાણ હો !,

૧ મનની ધારણા, ૨ ચહેરો

૧ ઓળંગ કીધી પ્રભુ ! તાહરી રે લો !,

ભાંગી છે ભવતણી બ્રાંત-મહારા ંહાલાળ ! હો !....હવેનારા
કરો સુ-નજર હવે સાહિબા રે ! લો !,

દાસ ધરો દિલ માહે-મહારા ંહાલાળ ! હો ! !
લાખ રંગુને પણ તાહરો રે-લો !

સેવક છું મહારાજ-મહારા ંહાલાળ ! હો !....હવેનારા
અવગુણ ગણતાં માહરા લો,

વિજય ઉર-સર-હંસ-મહારા ંહાલાળ ! હો ! !
પણ જિન ! પ્રવહણી પરે રે લો !,

તુમે છો તારણહાર-મહારા ંહાલાળ ! હો !....હવેનારા
નગરી અયોધ્યાનો ધણી રે લો

વિજય ઉર સર-હંસ-મહારા ંહાલાળ હો !
જિતશત્રુ રાયનો નંદલો રે લો !,

ધન્ય ધક્વાકુનો વંશ-મહારા ંહાલાળ હો !....હવેનારા
ધનુષ સય સાડા ચારની રે લો !,

દેહડી-રંગ ઝલનૂર-મહારા ંહાલાળ ! હો ! !
બહોંતેર પૂરવ લાખનું રે લો !

આયુ અધિક સુખપુર-મહારા ંહાલાળ હો....હવેનારા
પાંચમે આરે તું મલ્યો રે લો !,

પ્રગટયા છે પુણ્ય-નિધાન-મહારા ંહાલાળ ! હો !
સુમતિ સુગર પદ-સેવતાં રે લો !

રામ અધિક ગુણવાન-મહારા ંહાલાળ ! હો !....હવેનારા



૧ સેવા, ૨ ગુન્હા=અપરાધોએ ૩ સુંદર,

(૧૩૪૯) (૫૭-૩) શ્રી સંભવનાથ-જિન સ્તવન

(હાં રે મારે ઠામ ધરમના...એ દેશી)

હાં રે ! પ્રભુ ! સંભવસ્વામી ત્રીજા શ્રીજગનાથજી,
લાગી રે તુજથી દૃઢ ધર્મની પ્રીતડી રે લો ।

હાં રે ! સરસ સુકોમળ સુરતરુ દીધી બાથજી,
જાણું રે એ જૂએ લીધી સુખડી રે લો ॥૧॥

હાં રે સકલ-શુણે કરી ગિરુઓ તુંહી જ એક જી,
દીઠો રે મન-મીઠો પંઠો રાણુઓ રે લો ।

હાં રે તુજશું મિલતાં સાચો મુજશું ભવેક જી,
હું તો રે ધણીઆતો થઈને ગાણુઓ રે લો ॥૨॥

હાં રે નહિ છે માહરે હવે કેહની પશ્વાહજી,
જેતાં રે રસાહી મુજ હજે બાંહડી રે લો ।

હાં રે તુજ પાસેથી અળગો ન રહું નાહ ! જી
દોડે રે કુણુ તાવડે ષ્ઠાંડી છાંયડી રે લો ॥૩॥

હાં રે ! ભાગ્યે લહીયે તુજ સરીખાનો સંગજી,
આણુ રે જમવા રે ફિરી ફિરી દોહલો રે લો ।

હાં રે ! જીતિ-મનોહર ચિંતામણીનો નંગજી,
જેતાં રે કિમે નહીં જગમાં સોહિલો રે લો ॥૪॥

હાં રે ! ઉતારો મત ચિતરાથી નિજ દાસ જી,
ચિંતા ન ચૂરતાં પ્રભુ ! ઇજ્જત જશે રે લો ।

હાં રે ! પ્રેમ વધારણુ કાંતિ તણી અરદાસ જી,
ગણુતાં રે પોતાનો સર્વિ લેખે થશે રે લો ॥૫॥



૧ ષ્ઠ-વહાલો, ૨ પકડી, ૩ છોડી,

(૧૩૫૦) (૫૭-૪૭) શ્રી અભિનંદન-જિન સ્તવન

(પાસજી મુને નૂઠા-એ દેશી)

સમવસરજી જિનરાજ વિરાજેં;

ચઢીતીસ અતિસય છાજેં-રે જિનવર જયકારી ।

પાંત્રીસ ગુણ વાણીઈ ગાજેં;

ભવિ-મન સંશય ભાજે રે-જિન૦ ॥૧॥

ખાર પરખદા આગળ ભાખેં;

તત્તવ-રૂચિ ફલ ચાખે રે-જિન૦ ।

કાર્ય-કારણ નિશ્ચય-વ્યવહાર,

ભાખ્યા જિનપતિ સાર રે-જિન૦ ॥૨॥

ગણધરકું ત્રિપદી વલી દાખી,

સાધન શિક્ષા ભાખી રે-જિન૦ ।

પુદ્ગલ-ભાવથી રાગ ઉતારો,

નિજ આતમને તારો રે-જિન૦ ॥૩॥

સંવર સુત ઈમ દેશના લીધી,

સંઘ ચતુર્વિધેં પીધી રે-જિન૦ ।

અનુક્રમે વિચરી પોહતા સ્વામી,

સમેતશિખર ગુણ ધામે રે-જિન૦ ॥૪॥

સકલ પ્રદેશનો ધન તિહાં કીધો,

શિવ-વધૂનો સુખ લીધો રે-જિન૦ ।

પૂણીનંદ-પદને પ્રભુ વરીયા.

અનંત ગુણેં કરી ભરીયા રે-જિન૦ ॥૫॥

એહવા અભિનંદન જિન ધ્યાઈ,
 જિમ શિવમુખને પાઈ રે-જિન૦ ।
 જશવિજય ગુરૂ મનમાં લાવો,
 સેવક શુભદ્ભ પાવો રે-જિન૦ ॥૬॥



(૧૩૫૧) (૫૭-૪આ) શ્રી અભિનંદન-જિન સ્તવન
 (રાગ-પંચડા નિહાળું રે બીજા જિન તણા રે)
 આણા વહીયે રે ચોથા જિન તણી રે,
 જિમ ન પડો સંસાર ।
 આણા વિણ રે કરણી શત કરે રે,
 નવિ પામે ભવ-પાર-આણા ॥૧॥
 જીવ લાખો પૂર્વ સંયમ તપ કરે રે,
 ૧ઉર્ધ્વ-તુંડ આકાશ ।
 શીતલ પાણી રે હિમ-૨ઋતુએ સહે રે,
 સાથે યોગ-અભ્યાસ-આણા ॥૨॥
 દેવની પૂજા રે ભક્તિ અતિ ઘણી રે,
 કરતાં દીસે વિશેષ ।
 આણા લોપી રે જિન મત સ્થાપના રે,
 ન લહે આતમ લેશ-આણા ॥૩॥

૩

..... ।

૧ ઉર્ધ્વ મ્હોં કરી, ૨ શિયાળામાં, ૩ ચોથી ગાથાની પહેલી એ લીટી મળી નથી.

આણા તાહરી રે ઉભય સ્વરૂપની રે,

ઉત્સર્ગ ને અપવાદ-આણાં ॥૪૮॥

સુંદર જાણી રે નિજ મતિ આચરે રે,

નહિ સુંદર નિરધાર ।

ઉત્તમ પાસે રે મનીષા યપાધરી રે

જોજો ગ્રંથ-વિચાર-આણાં ॥૪૯॥

ધન તે કહીયે રે નરનારી સદા રે

આસન્ન-સિદ્ધિક જાણુ ।

જ્ઞાતા શ્રોતા રે અનુભવી સંવરી રે

જે માને તુજ આણુ-આણાં ॥૫૦॥

દોય કર જોડી માંશું એટલું રે

આણા લવ-લવ લેટ ।

વાચક દીજે રે કીર્તિ શુચિ પ્રભુ રે,

આણા શિવ-લચ્છી એટ-આણાં ॥૫૧॥



(૧૩૫૨) (૫૭-૫) શ્રી સુમતિનાથ-જિન સ્તવન

(મનમોહન તું સાહિબો)

સમકિત તાહરું સોહામણું,

વિશ્વ-જંતુ-આધાર-લાલ રે ।

કૃપા કરી પ્રકાશીએ,

મિટે તે મોહ-અધાર-લાલ રે-સમ ॥૧॥

૪ સરળ,

નાણુ-દંસણુ આવરણુની, વેચણી મોહની જાણુ-લાલ રે ।
નામ ગોત્ર વિધનની સ્થિતિ,

એક કોડાકોડી માન-લાલ રે-સમ૦ ॥૨॥

યથા-પ્રવૃત્તિ-કરણુ તે, ફરસે અનંતીવાર-લાલ રે ।
દરિશન તાહરું નવિ લહે,

દુરલભ્ય અભવ્ય અ-પાર-લાલ રે-સમ૦ ॥૩॥

શુદ્ધ ચિત્ત ¹મોઝર કરી, લેલી અનાદિની ગંઠ-લાલ રે ।
નાણુ-વિલોચને દેખીયે,

સિદ્ધિ-સરોવર-²કંઠ-લાલ રે-સમ૦ ॥૪॥

લેદ અનેક છે તેહના, જૃહત-ગ્રંથ વિચાર-લાલ રે ।
સુ-સંપ્રદાય-અનુભવ થકી,

ધરમેં શુદ્ધ આચાર-લાલ રે-સમ૦ ॥૫॥

અહો ! અહો ! સમકિતનો સુષુયો,

મહિમા અનોપમ સાર-લાલ રે ।

શિવ-શર્મ-દાતા એહ સમો,

અવર ન કો સંસાર-લાલ રે-સમ૦ ॥૬॥

શ્રી સુમતિ-જિનેસર સેવથી,

સમકિત શુદ્ધ કરાય-લાલ રે ।

કીર્તિવિમલ-પ્રભુની કૃપા,

શિવ-લચ્છી ઘર આય-લાલ રે-સમ૦ ॥૭॥



(૧૩૫૩) (૫૭-૫) શ્રી સુમતિનાથ-જિન સ્તવન

૩૫ ૧અનૂપ નિહાળો સુમતિ જિન ! તાહરું,

છંડી ચપળ સ્વભાવ ઠંધુ^૧ મન માહરું ।

૩૫ી અ૩૫ી ન હોત જો જગ તુમ દીશતું,

તો કુણુ ઉપર મન કહો હમ રેહીંસતું ? ॥૧॥

હીંસ્યા વિણુ કિમ શુદ્ધ સ્વભાવને ઇચ્છતા,

ઇચ્છ્યા વિણુ તુજ ભાવ પ્રગટ કિમ ? પ્રીંછતા ।

પ્રીંછ્યા વિણુ કિમ ? ધ્યાન-દશામાંહી લાવતા,

લાવ્યા વિણુ રસાસ્વાદ કહો ? હમ પાવતા ? ॥૨॥

ભક્તિ વિના નવિ મુક્તિ હોયે કોઈ ભગતને,

૩૫ વિના નવિ તેહ હોયે કિમ યોગતને ।

નહવણુ-વિલેપન-સ્નાન-પ્રદીપને ધૂપણા,

નવ નવ ભૂષણુ ભાવ-તિલક-શીર પખૂંપણા ॥૩॥

અમ સત્-પુણ્યને યોગે તુમે ૩૫ી થયા,

અમૃત-સમાણી વાણી ધરમની કહી ગયા ।

તેહ આલંબીને જીવ ઘણાંયે યુઝીયા,

ભાવી-^૨ભાવના-જ્ઞાને અમે પણુ રંજીયા ॥૪॥

તેહ માટે તુજ તુજ પીંડ^૩ ઘણા ગુણુ કારણો,

સેંચો ધ્યાયો હુએ મહાભય-વારણો ।

શાંતિવિજય બુધ શિષ્ય કહે ભવિક જના,

પ્રભુજીનું પિંડસ્થ ધ્યાન કરો થઈ એકમના ॥૫॥



૧ સુંદર, ૨ ઉલટલયું, ૩ ઝોળખાય ? ૪ સ્પષ્ટ, ૫ મુગટ
૬ વિશિષ્ટ જ્ઞાનથી, ૭ શરીર,

(૧૩૫૪) (૫૭-૬) શ્રી પદ્મપ્રભ-જિન સ્તવન

પદ્મ ચરણ જિનરાય,

બાલ અરુણ સમ કાય,

જીવન લાલ ! ઉદયો ધર-નૃપ કુલતિલોજી-પદ્મ ॥૧॥

મોહાદિક અંતરંગ,

અરિયણ આઠ અલંગ,

જીવન લાલ ! મારવા માનું રતો થયેજી-પદ્મ ॥૨॥

ચઢી સંજમ ગજરાય

ઉપશમ બુદ્ધ બનાય,

જીવન લાલ ! તપ-સિંદુરે અલંકર્યોજી-પદ્મ ॥૩॥

પાખર ભાવના ચાર,

સમિતિ શુભિત શિષ્યગાર,

જીવન લાલ ! અધ્યાતમ-અંબાડીયેજી-પદ્મ ॥૪॥

પંડિત વીર્ય કબાન,


ધર્મ ધ્યાન શુભ બાણ,

જીવન લાલ ! ક્ષપક્રેણિ સેના વલીજી-પદ્મ ॥૫॥

શુદ્ધધ્યાન સમશેર,

કર્મકટક કિયો જેર,

જીવનલાલ ! ક્ષમા વિજય-જિનરાજવીજી-પદ્મ ॥૬॥



(૧૩૫૪) (૫૭-૭૩) શ્રી સુપાર્શ્વનાથ-જિન સ્તવન
(અણત જિણંદશું પ્રીતડી)

શ્રી સુપાસ-જિન સાહિબા,

સુણો વિનતી હો ! પ્રભુ પરમ કૃપાલ કે ।

સમકિત-સુખદી આપીયે,

હુઃખ કાપીયે હો ! જિન ! દીન-દયાલ કે-શ્રી સુ૦ ॥૧॥

મૌન ધરી બેઠા તુમે,

નિચિંતા હો ! પ્રભુ ! થઇને નાથ કે ।

હું તો આતુર અતિ ઉતાવળો,

માંયું છું હો ! જોડી હોય હાથ કે-શ્રી સુ૦ ॥૨॥

સુગુણ સાહિબ તુમ વિના,

કુણ કરશે હો ! સેવકની સાર કે ।

આખર તુમહી જ આપશે,

તો શાને હો ! કરો છો વાર કે-શ્રી સુ૦ ॥૩॥

મનમાં વિમાસી થું રહ્યા ?,

અંશ બોલું હો ! તો હોય મહારાજ ! કે ।

નિશુભને શુભ આપતા,

તે વાતે હો ! નહિ પ્રભુ લાજ કે.-શ્રી સુ૦ ॥૪॥

મોટા પાસે માંગે સહુ,

કુણ કરશે હો ! ખોટાની આશ કે ।

ઠાતાને હેતાં વધે ઘણું,

કૃપણને હો ! હોય તેહનો નાશ કે.-શ્રી સુ૦ ॥૫॥

કૃપા કરી સાચું બુઝો,

તો ભાંજે હો મુજ કર્મની બલ કે ।

ઉત્તર સાધક ઉભા થકા,

જિન વિદ્યા હો સિદ્ધ હોય તત્કાલ કે.-શ્રી સુ. ૧૧૬॥

જાણુ આગળ કહેવું કીર્યું,

પણુ અર્થો હો ! કરે અરદાસ કે ।

ખીમાવિજય પય સેવતા,

જસ લહીએ નામે પ્રભુ ખાસ કે-શ્રી સુ. ૧૧૭॥



(૧૩૫૫) (૫૭-૭૭) શ્રી સુપાર્શ્વનાથ-જિન સ્તવન

શ્રી સુપાસ જિનરાજ,

તું ત્રિભુવન-શિરતાજ,

આજ હો ! છાને રે ઠકુરાઈ

પ્રભુ ! તુજ પદ તણીલ-શ્રી સુ. ૧૧૮॥

દિવ્ય ધ્વનિ સુર ફૂલ,

આમર છત્ર અ-મૂલ,

આજ હો ! રાને રે,

ભામંડલ ગાએ હુંદુભિલ-શ્રી સુ. ૧૧૯॥

સિંહાસન અશોક,

બેઠા મોઢે લોક,

આજ હો ! રાને રે દીવાને છાને આઠશુંલ-શ્રી સુ. ૧૨૦॥

અતિશય સહજના ચાર,

કર્મ ખપ્યાથી અગ્યાર,

આજ હો ! કીધા રે યોગણીશે,

સુર-ગણુ ભાસુરેલ-શ્રી સુ. ૧૨૧॥

વાણી ગુણ પાંત્રીશ,
 પ્રાતિહારજ જગદીશ,
 આજ હો ! સ્વામી રે શિવગામી,
 વાચક યશ થુણ્યોજી-શ્રી સું ॥૫૫॥

★

(૧૩૫૭) (૫૭-૮૪) શ્રી ચંદ્રપ્રભ-જિન સ્તવન
 શ્રી ચંદ્રપ્રભ-જિનરાજ,
 ઉદિત મન અંબરે હો ! લાલ-ઉદિતં ।
 વદને જિત-દ્વિજરાજ^૧,
 રહ્યો સેવા કરે હો ! લાલ-રહ્યોં ॥૧૧॥
 લંછન મિસિ નિતુ પાસ,
 રહ્યો કરે વિનતિ હો ! લાલ-રહ્યોં ।
 નિત્ય ઉદય નિષ્કલંક,
 કરો મુજ જિનપતિ હો ! લાલ-કરોં ॥૨૧॥
 શ્રી મહાસેન નરેશ,
 કુલાંબુજ ચંદ્રમા હો ! લાલ-કુલાંં ।
 લક્ષ્મણા માત મલ્હાર,
 જિણુંદ છો આઠમા હો ! લાલ-જિણુંદં ॥૩૧॥
 રવિધુરચિ દેહ અનેહ,
 અ-ગેહ અ-સંગ છે હો ! લાલ-અગેહં ।
 આઠમો ચંદ ને સુખકર,
 અચરિજ એહ છે હો ! લાલ-અચં ॥૪૧॥

૧ ચંદ્ર, ૨ ચંદ્ર જેવી કાંતિવાળા,

આઠ કર્મના નાશ,

કરી અડસિદ્ધિ લઘ્યા હો ! લાલ-કરી૦ ૧

ન્યાય સાગર કવિરાયે,

પ્રભુના ગુણ કહ્યા હો ! લાલ-પ્રભુ૦ ૥૫૫



(૧૩૫૮) (૫૭-૮આ) શ્રી ચંદ્રપ્રભ-જિન સ્તવન.

તુંહી તુંહી સાહિબારે, મન માન્યા ।

તું તેા અ-કળ-સ્વરૂપ જગતમાં, કોણે^૧ ન પાયો ।

શબ્દે બોલી બોળખાયો, શબ્દાતીત કરાયો-તુંહી૦ ૥૧૥

રૂપ નિહાળી પરિચય કીનો, રૂપમાંહિ નહિ આયો ।

પ્રાતિહારજ અતિશય^૨ અહિનાણે,

શાસ્ત્રમાં^૩ બુધે ન લખાયો. તુંહી૦ ૥૨૥

શબ્દ ન રૂપ ન રસ ન ગંધ ન, ફેરસ ન વરણ ન વેદ. ।

નહિ સંજ્ઞા નહિં છેદન ભેદન,

હાસ નહી નહી ખેદ-તુંહી૦ ૥૩૥

સુખ નહીં દુઃખ નહીં વળી વાંછા નહીં,

નહીં રોગ યોગ ને ભોગ ।

ગતિ નહીં ધિતિ નહીં રતિ નહીં અરતિ,

નહીં તુજ હરખ ને શોગ-તુંહી ૥૪૥

પુણ્ય ન પાપ ન બંધ ન, છેદ ન,

જનમ ન, મરણ ન પ્રીડા ।

રાગ ન દ્વેષ ન કલહ ન ભય નહી,

નહી, સંતાપ ને ક્રીડા-તુંહી૦ ૥૫૥

૧ કોઈએ ૨ નિશાનીથી. ૩ પંડિત પુરૂષથી

અ-લાખ અ-ગોચર અ-જ અ-વિનાશી,

અ-વિકારી નિરૂપાધિ ।

પૂરણુ બ્રહ્મ ચિદાનંદ સાહિબ ધ્યાયો સહજ સમાધિ-તુંડીં ॥૬॥

જે જે પૂજા તે તે અંગે, તું તો અંગથી દૂરે ।

તે માટે પૂજા ઉપચારિક, ન ઘટે ધ્યાનને પૂરે-તુંડીં ॥૭॥

ચિદાનંદધન-કેરી પૂજા, નિવિઠલપ ઉપયોગ ।

આતમ-પરમાતમને અ-ભેદે,

નહી કોઈ જડને ભેગ-તુંડીં ॥૮॥

રૂપાતીત-ધ્યાનમાં રહેતાં, ચંદ્રપ્રભ જિનરાય ।

માન વિજય વાયક ઈમ જાંપે,

પ્રભુ સરખાઈ થાય-તુંડીં ॥૯॥



(૧૩૫૯) (૫૭-૯૩) શ્રી સુવિધિનાથ-જિન સ્તવન

તાહરી અજબ શી ? યોગની મુદ્રારે ! લાગે મુને મીઠી રે ।

એ તો ટાળે મોહની નિદ્રા રે ! પ્રત્યક્ષ હીઠી રે ॥

લોકોત્તર શી ભેગની મુદ્રા !,

વાલ્હા મહારા ! નિરૂપમ આસન સોહે ।

સરસ રચિત શુક્લધ્યાનની ધારે,

મુર-નરના મન મોહિરે-લાગે ॥૧॥

ત્રિગટે રતન સિંહાસન બેસી, વાલ્હાં,

ચિહ્નં દિશે આમર ઢલાવે !

અરિહંત પદ પ્રભુતાને ભોગી,

તો પણ ભેગી કહાવે-લાગે ॥૨॥

અમૃત-અરણી મીઠી તુજ વાણી-વાલ્હાં જેમ અપાઠી ગાજે ।
કાન મારજ થઈ હિયડે પેસી,

સંઘેહ મનના ભાંજેરે-લાગેં ॥૩૧॥

કોડિ ગમે ઉભા દરબારે વાલ્હાં જય મંગલ સુર બોલે ।
ત્રણ ભુવનની રિદ્ધિ તુજ આગે,

દીસે ઈમ તુણ તોલે રે-લાગેં ॥૩૨॥

લેદ લહું નહિં જોગ-જુગતિનો વાલ્હાં

સુવિધિ જિણુંદ બતાવે ।

પ્રેમશુ' કાન્તિ કહે કરી કરણા.

મુજ મન-મંદિર આવોરે-લાગેં ॥૩૩॥



(૧૩૬૦) (૫૭-૯૪) શ્રી સુવિધિનાથ-જિન સ્તવન

દરશનીયાનો સ્વામી પ્યારો, લાગે મહારા જિણુંદા ।

તુંહીજ અદ્વા આદ્ય જણે,

વૈષ્ણવ વિષ્ણુ વખાણે-મહારાં ॥૧॥

રૂપ તપસ્વી તુજને ભાણે,

સઘળા તુજ દિલ રાખે-મહારાં ॥૨॥

જૈન જિનેન્દ્ર કહે શિવદાતા,

બુદ્ધ બૌદ્ધ મત રાતા-મહારાં ॥૩॥

કોલિક કોલ કહી ગુણ ગાતા,

ખટ દરશનનો ત્રાતા-મહારાં ॥૪॥

રૂપ અનેક ફટિકમાં ભાસે,

વણું ઉપાધિને પાસે-મહારાં ॥૫॥

ખટ દરશન સવિ તુજને ધ્યાવે,

એક અનેક કહાવે-મહારાં ॥૬॥

વિવિધ-રૂપ જલ ભૂમિ-વિભાજે,

તિમ તુમ દરશન લાજે-મહારાં ॥૭॥

કેવલ-ધ્યાન ગમ્ય દિલ રાજે,

કેવલજ્ઞાન જિરાજે-મહારાં ॥૮॥

ન્યાયસાગર પ્રભુ સુવિધિ મનાવે,

મહાનંદ પદ પાવે-મહારાં ॥૯॥

(૧૩૬૧) (૫૭-૧૦) શ્રી શીતલનાથ-જિન સ્તવન

શીતલ જિન સહજનંદી,

થયો મોહનો કમં નિકંદી ।

પરજયો બુદ્ધિ નિવારી,

પરિણામિક ભાવ સમારી

-મનોહર મિત્ર ! એ પ્રભુ સેવો !

-દુનિયામાં દેવ ન એવો-મનનો ॥૧॥

વર કેવલ નાણુ વિલાસી,

અજ્ઞાન-તિમિર ભટ નાસી ।

જયો લોકાલોક-પ્રકાશી,

ગુણ-પગજવ, વસ્તુ વિલાસી-મનનો ॥૨॥

અ-ક્ષયથિતિ અ-વ્યાપાધ

દાનાદિક લળિધ અગાધ ।

જેહ શાશ્વત-સુખનો સ્વામી,

જડ ઇન્દ્રિય ભોગ-વિરામી-મનનો ॥૩॥

જેહ દેવ દેવનો કહાવે,
ચોગીશ્વર જેહને ધ્યાવે ।

જસ આણા સુરતરૂ વેલી
મુનિ હૃદય-આરામે ફેલી-મનનો ॥૪॥

જેહની શીતલતા સંગે
સુખ પ્રગટે અંગે અંગે ।

ક્રોધાદિક તાપ સમલાવે,
જિન-વિજયાનંદ સલાવે-મનનો ॥૫॥



(૧૩૬૨) (૫૭-૧૧) શ્રી શ્રેયાંસનાથ-જિન સ્તવન
(અનંત વોરજ અરિહંત)

શ્રી શ્રેયાંસ-જિષ્ટદં ઘનાઘન ગહગદ્યો,
વૃક્ષ અશોકનો છાયા સુભર છાઈ રહ્યો ।

ભામંડલની ઝલક, ઝખુકે વિજળી,
ઉન્નત ગઢ તિગ, ઈન્દ્ર-ધનુષ શોભા મિલી ॥૧॥

દેવ-હંદુભિનો નાદ, ગુહિર ગાજે ઘણું,
ભાવિક-જનનાં નાટિક, મોર કીડા લણું ।

ચામર કેરી હાર ચલંતી બગતણી,
દેશના સરસ સુધારસ, વરસે જિનપતિ ॥૨॥

સમકિતી ચાતક વૃંક તૃપ્તિ પામે તિહાં,
સકલ કપાય-દાવાનલ શાન્તિ હુઇ જિહાં ।

જનચિત્ત-વૃત્તિ સુભૂમિ, નેહાલી થઈ રહી,
તેણી રોમાંચ અંકુર વતી કાયા લહી. ॥૩॥

શ્રમણ કૃષીવલ્લ સન્નજ, હુએ તવ ઉન્નજમી,
 ગુણુવંત જન-મન-ક્ષેત્ર સમારે સંયમી ।
 કરતાં બીજધાન સુ-ધાન નીપાવતા,
 જેણે જગના લોક, રહે સર્વિ જીવતા ॥૪૧॥
 ગણુધર ગિરિતટ સંગી થઈ સૂત્ર ગુંથતા,
 તેહજ નદી પરવાહે, હુઈ બહુ પાવતા ।
 એહજ મોટો આધાર, વિષમ કાલે લલ્લો,
 માનવિજય ઉવજગાય, કહે મેં સદ્લો ॥૪૨॥



(૧૩૬૩) (૫૭-૧૨) શ્રી વાસુપૂજ્ય-જિન સ્તવન

શ્રી વાસુપૂજ્ય-નરેશ્વરે-નંદ જયા જસ માય ।
 શ્રી વાસુપૂજ્યને પૂજતાં રે, મંદિર રિદ્ધિ લસાય
 -ભવિક જન ! પૂજે એ જિનરાય ।
 -જિમ ભવજલધિ તરાય-ભવિં

-મુગતિનો એહ ઉપાય-ભવિં ॥૧॥
 સોહે સોવન સિંહાસને રે, કુંકુમવરણી કાય ।
 જિમ કંચનગિરિ ઉપરે રે નૂતન ભાણુ સુહાય-ભવિં ॥૨॥
 લંછન ¹મિસિ વિનતી કરે રે, ²મહિષી-સુત જસ પાય ।
 લોકે હું સંતાપીઓ રે છુટું તુમ્હ પસાય-ભવિં ॥૩॥
 મન રંજે એ રાતડો રે, એ તો જુગતો ન્યાય ।
 પણુ જે ઉન્નજવલ્લ મન કરે રે, તે તો અચરિજ થાય-ભવિં ॥૪॥

૧ બહાને, ૨ પાડો,

બાર ઉઘાડે યુગતિનાં રે, બારસમે જિનરાય ।

કીર્તિવિજય ઉવજગાયનો રે,

વિનયવિજય શુભ ગાય-ભવિક-જન૦ ॥૫૦॥



(૧૩૬૪) (૫૭-૧૩) શ્રી વિમલનાથ-જિન સ્તવન

(ઉઘાળ કહીએ બહુરી-એ દેશી)

પ્રભુજી ! મુજ અવશુભ મત દેખો ।

રાગ-દશાથી તું રહે ન્યારો, હું રાગે મન વાહું ।

દ્વેષ-રહિત તું સમતા-ભીનો,

દ્વેષ-મારગ હું ચાહું-પ્રભુજી ॥૧॥

મોહલેશ કરસ્યો નદી તુમહી, મોહ-લગન મુજ ન્યારી ।

તું અ-ઠલંકી કલંકિત હું તો,

એ પણ રહેણી ન્યારી-પ્રભુજી ॥૨॥

તુંહી નિરાશ-ભાવ પદ સાધે, હું આશા-સંગ વિ-લુધો ।

તું નિશ્ચલ હું ચલ, તું સૂધો,

હું આચરણે ઉધો-પ્રભુજી ॥૩॥

તુજ સ્વભાવથી અવળા માહરા, ચરિત્ર સકળ જગે જાણ્યા ।

એવા અવશુભ મુજ અતિ ભારી,

ના ઘટે તુજ મુખ આપ્યા-પ્રભુ ॥૪॥

પ્રેમ નવલ જો હોયે સવાઈ વિમલનાથ મુખ આગે ।

કાંતિ કહે ભવ-રાન ઉતરાતાં,

તો વેળા નવિ લાગે-પ્રભુ ॥૫॥



(૧૩૬૫) (૫૭-૧૪) શ્રી અનંતનાથ-જિન સ્તવન

(સાબરમતી આવી છે ભરપૂર જો-એ દેશો)

મુજશા-નંદન જગ આનંદ દેવ જો,

નેહો રે નવરંગે નિત નિત ભેટીયે રે ।

ભેટયાથી શું થાયે મોરી ૧સૌઅર,

ભવ-ભવના પાતિકઠાં અળગાં મેટીયે રે ॥૧॥

સુંદર ચોળી પહેરી ચરણા ચીર રે,

આવો રે ચોવટડે જિન-ગુણ ગાઈયે રે ।

જિન-ગુણ ગાયે શું થાયે મોરી બેની રે,

પરભવ રે સુર-પદ્મૌ સુંદર પામીયે રે ॥૨॥

સહિયર ટોળી ભોળી રપરિગળ ભાવે રે,

ગાવે રે ગુણવંતી હૃદયે ગહગહી રે ।

જય જગનાયક શિવ-સુખદાયક દેવ રે,

લાયક રે તુજ સરિખો જગમાં કેા નહી રે ॥૩॥

પરમ નિરંજન નિર્જિત ભગવંત રે,

પાવન રે પરમાત્મ શ્રવણે સાંભળ્યો રે ।

પામી હવે મેં તુજ શાસન પરતીત રે,

ધ્યાને રે એક-તાને પ્રભુ આવી મળ્યો રે ॥૪॥

ઉચ્ચપણે પચાશ ધનુષનું માન રે,

પાળ્યું રે વળી આઉખું લાખ તીશનું રે ।

શ્રી ગુરુ સુમતિવિજય કવિરાય પસાય રે,

અહનિશ રે દિલ ધ્યાન વસે જગદીશનું રે ॥૫॥



૧ સખી, ૨ વિપુલ,

(૧૩૬૬) (૫૭-૧૫૪) શ્રી ધર્મનાથ-જિન સ્તવન

(એક દીન પુંડરીક ગણધર્મ-એ દેશી)

રતનપુરીનગરી હુઓ રે-લાલ,

લંછન વજ ઉદાર-મેરે પ્યારે રે ।

ભાનુ-નૃપતિ-કુળ-કેશરી રે-લાલ,

સુપ્રતા માત મદહાર-મેરે પ્યારે રે

-ધર્મ-જિનેસર ધ્યાઈયે રે લાલ ॥૧॥

આયુ વરસ દશ લાખનું રે લાલ,

ધણુ પણુયાલ પ્રસિદ્ધ-મેરે ૦ ।

કંચનવરણુ વિરાજતો રે-લાલ,

સહસ સાથે વ્રત લીધ-મેરે ૦ ॥૨॥

સિદ્ધિ-કામિની કર ગ્રહે રે-લાલ,

સમેતશિખર અતિ રંગ-મેરે ૦ ।

સહસ ચોસઠ સોહામણુ રે લાલ,

પ્રભુના સાધુ અ-લંગ-મેરે ૦ ॥૩॥

આસઠ સહસ સુ-સાહુણી-રે લાલ,

વળી ઉપર શત વ્યાર-મેરે ૦ ।

કંદર્પા શાસન સુરી-રે લાલ,

કિન્નર સુર સુવિચાર-મેરે ૦ ॥૪॥

સપ્તકાળે તુજ લોયણે રે-લાલ, મોહ્યા જગજન ચિત્ત-મેરે ૦ ।

શ્રી નયવિજય વિબુધ તણો રે લાલ,

સેવક સમરે નિત્ય-મેરે પ્યારે રે

-ધર્મ જિનેસર ધ્યાઈયે રે લાલ ॥૫॥



(૧૩૬૭) (૫૭-૧૫આ) શ્રી ધર્મનાથ-જિન સ્તવ

ધર્મ-જિણુંદ તેરે ધર્મકી ^૧હેરી,

મેટત હે ભવ-ભવકી ફેરી ।

પરમ ધરમ હૈ સાહિબ ! તેરા,

ધર-ધર ^૨દુઠત સખહી મેં હેર્યા ।

એસા ન ધરમ શરમકા યેરા,

પરમ-ધરમ હૈ સાહિબ ! તેરા-ધર્મ^૦ ॥૧॥

નામ-ધરમ કછું કામ ન આવે,

ઠવણુ-ધરમ તિમ સિદ્ધિ ન પાવે ।

દ્રવ્ય-ધર્મ પણુ મુક્તિ ન દેવે,

ભાવ-ધરમ વિનુ કોઉ સેવે-ધર્મ^૦ ॥૨॥

શબ્દ-ધરમ ઝજિઉ કામ સુધારે,

હુરગતિ પડતાં નિજ કરી ધારે ।

ઉત્તમ સ્થાનકે ઉનહીકું ભેડે,

પાપ-ધરમ સવિ ઉનકે તોરે-ધર્મ^૦ ॥૩॥

ભાવ-ધરમ તે સહેજે સાચે,

મેરા મન ઉનહીસે રાચે ।

મિથ્યામતીઓ જૂઠું માચે,

પણુ ઉન ધર્મશું કર્મ નિઠાચે-ધર્મ^૦ ॥૪॥

ભાવ-ધરમ નિજ આતમ દેખે,

કષ્ટ-ક્રિયા સખહી તણ ઝલેખે ।

૧ સેવા, ૨ શોધવા, ૩ જ્ઞેન, ૪ સફળ,

ઉત્તમ સાગર સાહિબ આગે,
ન્યાયસાગર શિવ-પદવી માગે-ધર્મ'ં ॥૫૧॥

○

(૧૩૬૮) (૫૭-૧૬૪) શ્રી શાંતિનાથ-જિન સ્તવન

સેવો સેવોને રાજ શાંતિ-જિનેશ્વર સ્વામી ।

સોળમા જિનવર શોભિત સોવન,

વરણે શિવગતિ ગામી-સેવોં ॥૧॥

જગ-શુર જગ-લોચન-જગ-નાયક, જગ-તારણ હિતકારી ।

જગ-જીવન જગ-ખંધવ જિનવર,

વંદો સવિ નરનારી-સેવોં ॥૨॥

નિજ-નિર્વાણુ-સમય પ્રભુ બહી, બહુ સાધુ પરિવારે ।

સમેતશિખરે પધાર્યા પ્રભુજી,

આપ તરે પર તારે-સેવોં ॥૩॥

માનું શિવ ચડવાની નિસરણી, સમેતશિખર-ગિરોંદા ।

આરોહે અલવેસર જિનવર,

અચિર-રાણી-નંદા-સેવોં ॥૪॥

પદ્માસન-ધારી પરમેશ્વર, બેઠા ધ્યાન-સમાધિ ।

સુરવર સમવસરણુ તિહાં વિરચે,

હેજથું દેડું વાધે-સેવોં ॥૫॥

તિહાં બેસી ઉપદેશ દીયે પ્રભુ,

નિસુણે અસુર-સુરિંદા ।

ભાવ અનિત્ય સકલ ભવ માંહે,

દીસે એ સેવી કંદા-સેવોં ॥૬॥

મ મ કરશેા મમતા મનમાંડે, સહુ સંબંધે મલીયું ।
 રાખે ભવમાંડે રોકીને, કર્મ-કટક એ બલીયું-સેવો ॥૭૧॥
 તું કોણુ ધરનો ચેતના તાહરી,
 સમતા સુંદરી નારી ।

શું લાગ્યો મમતા ગણિકાશું ?
 હોય રહ્યો બિખારો-સેવો ॥૮॥
 ચેતન-સંગ તજો મમતાનો, કરો સમતા શું યારી ।
 જો તે જાતિ મીલે હોય જુગતું,
 અસરિસ સંગ નિવારી-સેવો ॥૯॥
 કામ કરો કોઈ એહવું ધારી
 બંધનો હેતુ નિવારી ।

જેમ ભવ-સ્થિતિ છાંડી અતિ ભારી,
 વરીયે સુક્રિત સુ-નારી-સેવો ॥૧૦॥



(૧૩૬૯) (૫૭-૧૬આ) શ્રી શાંતિનાથ-જિન સ્તવન
 શાંતિ જિનેશ્વર સાચો સાહિબ,
 શાંતિકરણ ધણુ કલિમેં-હો જિનજી !
 તું મેરા મનમેં તું મેરા દિલમેં
 ધ્યાન ધરું પલ-પલમેં સાહેબજી !-તું મેરા ॥૧॥
 ભવમાં ભમતાં મેં દરિશણુ પાચો,
 આશા પૂરો એક પલમેં હો જિનજી !-તું ॥૨॥
 નિર્મલ જ્યોત વદન પર સોહો,
 નિકર્યો જ્યું ચંદ વાદળમેં હો ! જિનજી !-તું ॥૩॥

મેરો મન તુમ સાથે લીનો,

મીન વસે જ્યુ' જળમે' - હો જિનજી ! - તુ'ં ॥૪૮॥

જિનશંગ કહે પ્રભુ શાંતિ-જિનેશ્વર,

દીઠોજી દેવ સકળમે' હો ! જિનજી ! - તુ'ં ॥૪૯॥



(૧૩૭૦) (૫૭-૧૭૬) શ્રી શાંતિનાથ-જિન સ્તવન

સુણો શાંતિ-જિણ્દ સોભાગી,

હું તો થયો છું તુમ ગુણરાગી ।

તુમે નિરાગી ભગવંત,

જેતાં કિમ મળશે તંત-સુણો ॥૧॥

હું તો ક્રોધ-કષાયનો ભરિયો.

તું તો ઉપશમ-રસનો દરિયો ।

હું તો અજ્ઞાને આવરિયો,

તું તો કેવલ-કમલા વરિયો-સુણો ॥૨॥

હું તો વિષયા-રસનો આશી,

તેં તો વિષયા કીધી નિરાશી ।

હું તો કરમને ભારે ભરિયો,

તેં તો પ્રભુ ભાર ઉતાર્યો-સુણો ॥૩॥

હું તો મોહતણે વશ પડીઓ,

તેં તો સખળા મોહને હણીયો ।

હું તો ભવ-સમુદ્રમાં ખૂંચ્યો,

તું તો શિવ-મંદિરમાં પહુંચ્યો-સુણો ॥૪॥

મારે જન્મ-મરણનો ભરો, તેં તો તોડ્યો તેહનો ઢોરો ।
મારો પાસો ન મેલે રાગ,

તમે પ્રભુજી થયા વીતરાગ-સુષુઠ ॥૫૥॥

મને માયાએ મૂક્યો પાશી,

તું તો નિરબંધન અ-વિનાશી ।

હું તો સમક્ષિતથી અધૂરો,

તું તો સકલ પદારથે પૂરો-સુષુઠો ॥૬૥॥

મારે તો તુંહી પ્રભુ ! એક,

હારે મુજ સરીખા અનેક ।

હું તો મનથી ન મૂકું માન,

તું તો માન-રહિત ભગવાન-સુષુઠો ॥૭૥॥

મારું કીધું કથું નવિ થાય,

તું તો રંકને કરે છે રાય ।

એક કરો મુજ મહેરબાની,

મારો મુજરો લેને માની-સુષુઠો ॥૮૥॥

એકવાર ભે નજરે નિરખો,

તો પ્રભુ ! હું થાઉં તુમ-સરીખો ।

ભે સેવક તુમ-સરીખો થાશે,

તો શુભ તુમારા ગાશે-સુષુઠો ॥૯૥॥

ભવેભવ તુમ ચરણોની સેવા,

હું તો માશું છું દેવાધિદેવા ।

સામું જીઓને સેવક બાણી,

એવી ઉદયરતનની વાણી-સુષુઠો ॥૧૦૥॥



(૧૩૭૧) (૫૭-૧૬ ર્) શ્રી શાંતિનાથ-જિનસ્તવન

તું પારંગત તું પરમેશ્વર,

વાલા મારા! તું પરમારથ-વેદી ।

તું પરમાત્મ તું પુરુષોત્તમ,

તુંહી અ-છેદી અ-વેદી રે-મનના મોહનીયા ।

તાહરી કીકી કામણગારી રે-જગના મોહનીયા ॥૧॥

ચોગી અ-ચોગી લોગી અ-લોગી-વાલાં,

તુંહી જ કામી અ-કામી ।

તુંહી અ-નાથ નાથ સહુ જગનો,

આતમ-સંપદ-રામી રે-મનના ॥૨॥

એક અ-સંખ્ય અનંત અગોચર-વાલાં,

અ-કલ-સકલ અ-વિનાશી ।

અ-રસ અ-વર્ણ અ-ગંધ અ-દાસી,

તુંહી અ-પાશી અ-નાશી રે-મનના ॥૩॥

સુખ-પંકજ અમરી પરે અમરી-વાલાં,

તુંહી સદા અશ્વચારી ।

સમવસરણ-લીલા-અધિકારી,

તુંહીજ સંયમધારી રે-મનના ॥૪॥

અચિરા-નંદન અચરિત્ત એહી-વાલાં,

કહણી માંહિ ન આવે ।

સમાવિજય-જિન-વયણ-સુધારસ,

પીવે તેહિજ પાવે રે-મનના ॥૫॥



(૧૩૭૨) (૫૭-૧૬૩) શ્રી શાંતિનાથ જિન સ્તવન
સુષ્ટુ દયાનિધિ !

તુજ પદપંકજ સુજ મન મધુકર લીનો ।

તું તો રાત દિવસ રહે સુખલીનો-સુષ્ટુ ॥

પ્રભુ અચિરા માતાનો જાણે, વિશ્વસેન ઉત્તમ કુળ પાથે,

એક ભવમાં હોય પદવી પાથે-સુષ્ટુ ॥૧॥

પ્રભુ ચક્રી-જિનપદનો ભોગી,

શાંતિ નામ થકી થાય નીરોગી,

તુજ સમ અવર નહિ દુલ્લે યોગી-સુષ્ટુ ॥૨॥

પદ-ખંડ તણે પ્રભુ ! તું ત્યાગી,

નિજ આતમ-ઋદ્ધિ તણે-રાગી ।

તુજ સમ અવર નહિ વૈરાગી-સુષ્ટુ ॥૩॥

વડવીર થયા સંજમ-ધારી, કેવળ-દુઃ-કમળા સારી ।

તુજ સમ અવર નહિ ઉપકારી-સુષ્ટુ ॥૪॥

પ્રભુ મેઘરથ ભવ ગુણખાણી,

પારેવા ઉપર કરુણા આણી,

નિજ-ચરણે રાખ્યો સુખખાણી-સુષ્ટુ ॥૫॥

પ્રભુ કર્મકંટક ભવ-ભય ટાળી,

નિજ આતમ-ગુણને અનુઆળી ।

પ્રભુ પામ્યા-શિવવધૂ લટકાળી-સુષ્ટુ ॥૬॥

સાહેબ ! એક સુજરો માની જે,

નિજ સેવક ઉત્તમ-પદ દીજે,

રૂપ કીર્તિ કરે તુજ જીવવિજે-સુષ્ટુ ॥૭॥



(૧૩૭૩) (૫૭-૧૬૫) શ્રી શાંતિનાથ-જિન સ્તવન

ક્ષણ ક્ષણ સાંભરો શાંતિ સહુણા !

ધ્યાન-ભુવન જિનરાજ પરુણા-ક્ષણ૦ ।

શાંતિ-જિનંદકો નામ અમીસેં,

ઉલ્લસિત હોત હમ રોમ વપુના ।

ભવ-ચોગાનમેં ફિરતે પાએ,

છોરત મેં નહિ ચરણ પ્રભુનાં-ક્ષણ૦ ॥૧૧॥

છીલ્લરમેં રતિ કબહૂ ન પાવે,

જે ઝીલે જલ્લ ગંગ-યમુના-ક્ષણ૦ ।

તુમ સમ હમ શિર નાથ જો થાશે,

કમ^૧ અધૂના ^૨ફૂના-ધૂના-ક્ષણ૦ ॥૨૧॥

મોહ-લડાઈ મેં તેરી સહાઈ

તો ક્ષણમેં છિન્ન-છિન્ન કરના-ક્ષણ૦ ।

નહિ ઘટે પ્રભુ ^૨આના-ફૂના,

અચિરા-સુત પતિ મોક્ષ વધૂના-ક્ષણ૦ ॥૩૧॥

ઓરકી પાસમેં આશ ન કરતે,

ચાર અનંત પસાય કરુના-ક્ષણ૦ ।

કયું કર માંગત પાસ ધત્તુરે,

યુગલિક યાચક કલ્પતરૂના-ક્ષણ૦ ॥૪૧॥

ધ્યાન ખડ્ગ વર તેરે ^૩આસંગે,

મોહ ડરે સારી ^૪ભીક ભરુના-ક્ષણ૦ ।

૧ દુઃખાં સંધિને ચરચરવા લાગ્યા, ૨ આનાકાની, ૩ ભક્તિભર્યા
રાગથી ૪ ભયભીત બનીને,

ધ્યાન અરૂપી તો સાંઈ અરૂપી,

ભકતે ધ્યાવત તાના-તૂના-ક્ષણું ॥૫॥

અનુભવ-રંજ વધ્યો ઉપયોગે,

ધ્યાન-સુ-પાનમેં કાયા-ચૂના ક્ષણું ।

ચિદાનંદ ઝકઝોલ ઘટાસેં,

શ્રી શુભવીરવિજય પડિયુન્ના-ક્ષણું ॥૬॥



(૧૩૭૪) (૫૭-૧૬૪) શ્રી શાંતિનાથ-જિન સ્તવન

શાંતિ-જિનેશ્વર સાહિબા ! રે, શાંતિ તણા દાતાર ।

અંતરબામી છો ! માહરા રે,

આતમના આધાર-શાંતિં ॥૧॥

ચિત્ત ચાહે પ્રભુ ! આકરી રે,

મન ચાહે મળવાને કાજ ।

નયણ ચાહે પ્રભુ નિરખવા રે,

ઘો ! દરિશન મહારાજ-શાંતિં ॥૨॥

પણક ન વિસરી મન થકી રે, જેમ ૧ મોરા મન મેહ ।

૨ એક-પખો કેમ રાખીયે રે ?

રાજ કપટનો નેહ-શાંતિં ॥૩॥

નેહ-નજરે નિહાળતાં રે, વાધે બમણો ૩ વાન ।

અ-ખૂટ ખબનો પ્રભુ ! તાહરો રે,

દીનિયે વંછિત-દાન-શાંતિં ॥૪॥

૧ મોરના, ૨ એક તરફી, ૩ અનુરાગ,

આશ કરે જે કેઇ આપણી રે, નવિ મુકીયે નિરાશ ।
સેવક બાણીને આપણો રે,

દીલ્યે તાસ ઋદ્ધિલાસ-શાંતિ ॥૫॥

દાયકને દેતાં થકાં રે, ક્ષણ નવિ લાગે વાર ।

કાજ સરે નિજ-દાસનાં રે,

એ માટે ઉપકાર-શાંતિ ॥૬॥

એવું બાણીને જગ-ધણી રે, દિલમાંહી ધરજો ! ખ્યાર ।

રૂપવિજય-કવિરાયનો રે,

મોહન જય જયકાર-શાંતિ ॥૭॥

(૧૩૭૫) (૫૭-૧૬૬) શ્રી શાંતિનાથ-જિન સ્તવન

ધન દિન વેલા ! ધન ઘડી ! તેહ,

અચિરાનો નંદન જિન જહી ભેટશું છ ।

લહીશું રે સુખ દેખી સુખ-ચંદ,

વિરહ-વ્યથાનાં દુઃખ સવિ ભેટશું છ ॥૧॥

બણ્યો રે જેણે તુજ શુભ-લેશ,

ખીજ રે રસ તેહને મન નવિ ગમેછ ।

ચાખ્યો રે જેણે અમી-લવલેશ,

બાકસ-બુકસ તસ ન રૂચે કિમેછ ॥૨॥

તુજ સમકિત-રસ-સ્વાદનો બાણ,

પાપ 'કુ-ભગતે બહુ દિન સેવીશું છ ।

૪ આશ્રમન

૧ કુભકત=ખરાબ ભોજન,

સેવે જો કરમને જાગે તોહી,

વાંછે તે સમક્ષિત-અમૃત ધુરિ લિખ્યું' જી ॥૩॥

તાહરું ધ્યાન તે સમક્ષિત-રૂપ,

તેહીજ જ્ઞાનને ચારિત્ર તેહ છે જી ।

તેહથી રે જાયે સઘળાં હો પાપ,

ધ્યાતા રે ધ્યેય સ્વરૂપ હોય પછે જી ॥૪॥

દેખી રે અદ્ભુત તાહરું રૂપ,

અચરિત-ભવિક અ-રૂપી-પદ વરે જી ।

તાહરી ગત તું જાણે ! હો દેવ,

સમરણ ભજન તે વાચક જશ કરે જી ॥૫॥



(૧૩૭૬) (૫૭-૧૭૪) શ્રી કુંથુનાથ-જિન સ્તવન

(પંથડા નિહાળું રે ! જીજ જિન તણા રે)

કુંથુ-જિનેસર ! સાહિબ ! તું ધણી રે,

જગજીવન ! જગદેવ ! ।

જગત-ઉદ્ધારણુ ! શિવ-સુખ-કારણુ રે,

નિશદિન સાડું સેવ-કુંથુ ॥૧॥

હું અપરાધી કાલ અનાદિનો રે, કુટિલ કુ-બોધ કુ-નીત ।

લોભ-ક્રોધ-મદ-મોહે માચીયો રે,

મત્સર-મન્ન અ-તીત-કુંથુ ॥૨॥

સંપટ કંટક નિંદક હંભીયો રે, પરવંચક ગુણુ-ચોર ।

આપ-થાપક પર-નિંદક માનીયો રે,

કલહ-કઠાગ્રહ વોર-કુંથુ ॥૩॥

ક્રિયાદિક અવશુભ કહું કેટલા રે? તું સખ જનનહાર ।

જે મુજ વીતક વીત્યો વીતશે રે,

તું જાણે કીરતાર-કુંથુ ॥૪૮॥

જે જગ પૂરણ વૈદ કહાઈયો રે,

રોગ કરે સખ દૂર ।

તિનહી અપના રોગ હીઆઈયો રે,

તો હોવે ચિંતા ચૂર-કુંથુ ॥૪૯॥

તું મુજ સાહિબ ! વૈદ ધનંતર રે,

કરમ-રોગ મોહ કાટ ।

સ્તનત્રયી પંથ મુજ મન માનીયો રે,

હીજો સુખનો ઘાટ-કુંથુ ॥૫૦॥

નિરશુભ લોહ કનક પારસ કરે રે,

માગે નવિ કષ્ટ તેહ ।

તો તુજ આતમ-સંપદ નિરમલી રે,

હાસ ભણી અખ દેહ-કુંથુ ॥૫૧॥



(૧૩૭૭) (૫૭-૧૭આ) શ્રી કુંથુનાથ-જિન સ્તવન

કુંથુ-જિનેસર જાણો રે-લાલ,

મુજ મનનો અભિપ્રાય રે-જિનેશ્વર મોરા ।

તું આતમ અલ્પેસર રે લાલ,

રખે તુજ વિરહો થાય રે-જિને

તુજ વિરહો કિમ વેઠીયે રે લાલ ।

તુજ વિરહો દુઃખદાય રે-જિને

તુજ વિરહો ન ખમાય રે-જિને૦

ક્ષણ વરસો સો થાય રે, જિને૦
વિરહો મોટી બલાય રે, જિને૦ ૥૧૧૬

તાહરી પાસે આવવું રે-લાલ,

પહેલાં ન આવતું ^૧ હાય રે-જિને૦ ૬

આંચા પછી જે જાયવું રે-લાલ,

તુજ ગુણ-વશે ન સુહાય રે-જિને૦ ૥૨૧૭

ન મિદ્યાનો ઘોખો નહિં રે લાલ,

જશ ગુણનું નહિ નાણુરે-જિને૦ ૬

મળીયા ગુણ કળીયા પછી રે લાલ,

વિદ્યુત જાયે પ્રાણુ રે-જિને૦-તુજ૦ ૥૩૧૮

જાતિ-અંધને દુઃખ નહિ રે લાલ,

ન લહે નયનનો સ્વાદ રે-જિને૦ ૬

નયન-સ્વાદ લહી કરી રે-લાલ,

હાર્યાને વિખવાદ રે-જિને૦-તુજ૦ ૥૪૧૯

ખીજે પણ કિહાં નવિ ગમે રે-લાલ,

જિણે તુજ વિરહો અચાય રે-જિન૦ ૬

માલતી-કુસુમે મહાલીયો રે-લાલ

મધુપ રંકરીરે ન જાય રે-જિને૦-તુજ૦ ૥૫૨૦

ડવન-દવ-દીધાં રૂપડાં રે-લાલ,

૪ પાલકુવે વલી વરસાત રે-જિને૦ ૬

૧ અનુકૂળ ૨ કરડો, ૩ જંગલના દાવાનળથી જળેલા, ૪ ખીલી લીટો,

તુજ વિરહાનલના બલ્યા રે લાલ,

કાલ અનંત ગમાય રે-જિને૦ ॥૬॥

ટાઢક રહે તુજ સંજમાં રે-લાલ,

આકુલતા મિત્રી જાય રે-જિને૦ ।

તુજ સંગે સુખીયો સદા રે-લાલ,

માનવિજય ઉવજાયાય રે-જિને૦-તુજ૦ ॥૭॥



(૧૩૭૮) (૫૭-૧૮) શ્રી અરનાથ-જિન સ્તવન

શ્રી અરનાથજી સાંભળો, સેવકકી અરદાસ ।

ભવ-અટવી માંહિ હું ભમ્યો,

અંધાણો મોહ-પાશ-શ્રી૦ ॥૧॥

મોહ-રાજ્યના રાજ્યમાં, બહુલું^૧ કટક જણાય ।

મિથ્યા મહેતો તિહાંય છે,

મંત્રી કુબુદ્ધિ કહાય-શ્રી૦ ॥૨॥

રઅભંગા સિપાઈ અતિ ઘણા, કહેતાં નાવે વાર ।

તો પશુ અધિકારી તણાં, નામ કહું નિરધાર-શ્રી૦ ॥ ૩ ॥

ક્રોધ માયા લોભ માન તે, મૂકે ન મારો સંગ ।

મુજ પશુ તે છે વાણહા, નવિ મૂકું રંગ-શ્રી૦ ॥૪॥

રાગ-દ્વેષ ઢાય મલલ મલી, બાંધ્યો બાંધ્ય મરોડ ।

હવે પ્રભુ! તુમ્હ આગળ રહી,

વિનતિ કરૂં કરજોડ-શ્રી૦ ॥ ૫ ॥

અંધન-માંહિથી છોડાવો, ઉતારો ભવ-પાર ।

૧ રોન્ય, ૨ વિષમ.

હરિ-હર-દેવ સેવ્યા ઘણા,

નવિ પામ્યો હું સાર-શ્રીં ॥૬॥

ઠસહસ-વદન ન સ્તવી શકે,

તુજ ગુણ અ-ગમ અ-પાર ।

જિમ રચણાયર રત્નનો, નવિ વિદ્યસે પાર-શ્રીં ॥૭॥

આચારજ પંડિત ઘણા, સત્યવિજય ગુરુરાય ।

કુપુરવિજય તસ પાટવી,

ભવિ-જનને સુખદાય-શ્રીં ॥ ૮ ॥

ખીમાવિજય તસ પાટવી, જિનવિજય સુપસાય ।

પંડિત ઉત્તમવિજયનો,

પદ્મવિજય ગુણ ગાય-શ્રીં ॥૯॥



(૧૩૭૯) (૫૭-૧૯૭) શ્રી મદિલનાથ-જિન સ્તવન

(પાંચમે મંગળવાર પ્રભાતે ચાલવું રે લોલ.-એ દેશી)

સાહિબા ! મદિલ-જિનેસર !

નાથ અનાથતણેા ઘણી રે લો,

સાં વસ્તુ સ્વભાવ પ્રસારક ભાસક કિનમણી રે લો ।

સાં ધર્મ અનંતા સુખ દેતાં પરગટ થયા રે લો,

સાં વસ્તુ સર્વ પર્યાવ ભાખી જિન ગયા રે લો ॥૧॥

સાં યુગપદ્ ભાવી ને કમભાવી સુણો રે લો,

સાં જ્ઞાનાદિક યુગપદ્ ભાવી પછે સંગ્રહ્યા રે લો ।

૩ હજાર મો વાજો, શેષનાગ.

સાં નવ-શુભાદિક થાય તે કનભાવી મુણે રે લો,
 સાં શબ્દ-અસ્થથી તે પણ દ્વિવિધ-પરે મુણે રે લો ॥૨૧॥
 સાં ઇંદ્ર હરિ ઇત્યાદિક શબ્દ તણા ભલા રે લો,
 સાં જે અભિલાષ નહિ તે અર્થ-પર્યં વ કળા રે લો ।
 સાં તે પણ દ્વિવિધ કહીજે સ્વ-પર ભેદે કરી રે લો,
 સાં તે પણ સ્વાભાવિક આપેક્ષિકથી વરી રે લો ॥૨૩॥
 સાં સર્વ અતીત-અનાગત-સાંપ્રત કાળથી રે લો,
 સાં ઇત્યાદિક નિજ-બુદ્ધે કરે સંભાળથી રે લો ।
 સાં સમકાળે ઇમ ધર્મ અનંતા કામીયે રે લોલ,
 સાં તે સર્વ પ્રગટ ભાવથી

તુમ્હ શિર નામીયે રે લો ॥૨૪॥

સાં ખટદ્રવ્યના જે ધર્મ અનંતા તે સર્વે રે લો,
 સાં નહિ પ્રચ્છન્ન-સ્વભાવ

અભાવ મુજ સંભવે રે લોલ,

સાં પુષ્ટ તુંહી પ્રગટપણે પામીયો રે લો, :

સાં હું પણ હવે તુજ રીતે

થવાને કામીયો રે લો. ॥ ૫ ॥

સાં મલ્લિનાથ પરે હસ્તિમલ્લ થઈ બુઝશું રે લો ।

સાં જ્યું ખટ્તમિત્રને બૂઝવ્યા તિમ અમે બૂઝશું રે લો ।

સાં તમ પરે ઉત્તમ શિષ્યને મહેરથી નિરખીયે રે લો,

સાં પદ્માવજય કહે તે અમહે.

ચિત્તમાં હરખીયે રે લો ॥૬॥



(૧૩૮૦) (૫૭-૧૯આ) શ્રી મલ્લિનાથ-જિન સ્તવન

(સુણ ખહેની પીરો પરદેશી-એ દેશી)

મલ્લિ-જિનેસર ! ધર્મ તુમ્હારો, સાદિ-અનંત સ્વભાવળ ।
લોકાલોક-વિશેષ ભાસન,

જ્ઞાનાવરણી અભાવળ-મલ્લિ૦ ॥૧૧॥

એક નિત્યને સઘળે વ્યાપી, અવયવ વિણુ સામાન્યળ ।
ખીયાવરણુ અભાવે દેખે,

ઉપયોગાંતર માન્યળ-મલ્લિ૦ ॥૧૨॥

આતમ એક અસંખ્ય-પ્રદેશી, અવ્યાખાધ અનંતળ ।
વેદનીય વિનાશે માયે,

લોકે દ્રવ્ય મહંતળ-મલ્લિ૦ ॥૧૩॥

મોહનીય ક્ષયથી ક્ષાયિક સમકિત, વથાખ્યાત ચરિત્રળ ।
વીતરાગતા રમણુ આયુ-ક્ષય

અ-ક્ષય-થિતિ નિત્યળ-મલ્લિ૦ ॥૧૪॥

અગુરુલઘુ ગુણુ ગોત્ર-અભાવે,

નહિ હલુષા નહિ ભારેળ ।

અંતરાય વિજયથી દાનાદિક,

લખિધ ભંડારળ-મલ્લિ૦ ॥૧૫॥

ચેતન સમતાયે મુજ સત્તા, પરખી પ્રભુસદ પામીળ ।

૧ આરીસો કાટે અવરાણો,

મલનાશે નિજ થામળ-મલ્લિ૦ ॥૧૬॥

૧ દર્પણ મેલથી અવરાયું પણ સાફ કરવાથી મૂળ સ્વરૂપે આવે.
(છઠી ગાથાની ખીળ લીટીનો અર્થ)

સંગ્રહનય જે આતમ સત્તા, કરવા એવંભૂતલ ।

ક્ષમાવિજય જિનપદ અવલંબી,

સુરનર મુનિ પુહુતલ-મદ્દિલ ૦ ॥૭૧॥

(૧૩૮૧) (૫૭-૨૦-અ) શ્રી મુનિસુવ્રત-જિન સ્તવન

(દીઠી હો પ્રભુ દીઠી જગ ગુરુ તુજ)

મુનિસુવ્રત હો ! પ્રભુ ! મુનિસુવ્રત મહારાજ,

મુણ્ણે હો ! પ્રભુ ! મુણ્ણે સેવકની કથાલ ।

ભવમાં હો ! પ્રભુ ! ભવમાં ભમીયો હું જેહ,

તુમને હો ! પ્રભુ ! તુમને તે કહું છું કથાલ ॥૧॥

નરકે હો ! પ્રભુ ! નરકે નૌધારો દીન,

વસીયો હો ! પ્રભુ ! વસીયો તુમ આણુ વિનાલ ।

દીઠાં હો ! પ્રભુ ! દીઠાં દુઃખ અનંત,

વેઠી હો ! પ્રભુ ! વેઠી નાનાવિધ-વેદનાલ ॥૨॥

તિમ વલી હો ! પ્રભુ ! તિમ વલી તિય'અ માંહી,

જલ્લીમ હો ! જલ્લીમ પીડા જેહ સહીલ ।

તુંહીજ હો ! પ્રભુ ! તુંહીજ જાણે તેહ,

કહેતાં હો ! પ્રભુ ! કહેતાં પાર પામું નહિ લ ॥૩॥

નરની હો ! પ્રભુ ! નરની જાતિમાં જેહ,

આપદા હો ! પ્રભુ ! આપદા જેમ જાયે કથીલ ।

તુજ વિણુ હો ! પ્રભુ તુજ વિણુ જાણુહાર,

તેહનો હો ! પ્રભુ ! તેહનો ત્રિભુવન કે નથીલ ॥૪॥

૧ નિરાધાર;

દેવની હો ! પ્રભુ દેવની ગતિ દુઃખ દીઠ,

તે પણ હો ! પ્રભુ ! તે પણ સમ્યક્ તું લહેજી ।

હોજો હો ! પ્રભુ ! હોજો તુમશું નેહ,

ભવોભવ હો ! પ્રભુ ભવોભવ ઉદયરતન કહેજી ॥૫૫॥



(૧૩૮૨)(૫૭-૨૦-આ) શ્રી મુનિસુવ્રત-જિન સ્તવની

મુનિસુવ્રત જિન વંદતાં,

અતિ ઉલ્લસિત તન મન થાય રે ।

વદન અનુપમ નિરખતાં,

મારા ભવભવના દુઃખ જાય રે-

મારા ભવભવના દુઃખ જાય,

જગતશુર ! જગતો સુખકંદ રે ।

સુખકંદ અમંદ આનંદ,

પરમશુરુ ! દીપતો સુખકંદ રે ॥૧॥

નિશદ્ધિન સૂતાં જગતાં, :હિયડાથી ન રહે દૂર રે ।

જખ ઉપગાર સંભારીયે,

તખ ઉપજે આનંદ-પૂર રે-તખ જગત ॥૨॥

પ્રભુ-ઉપગાર ગુણે ભર્યા,

મન અવગુણ એક ન સમાય રે ।

શુષ્ક-ગણ અનુખંધી હુખા,

તે તો અક્ષય-ભાવ-કહાય રે-તે તો જગત ॥૩॥

અ-ક્ષય પદ દીએ પ્રેમ જે, પ્રભુનું તે અનુભવ-રૂપ રે ।

અ-ક્ષય સ્વર-ગોચર નહિ,

એ તો અ-કલ અ-માય અ-રૂપરે-એ૦ જગત૦ ॥૪॥

અ-ક્ષર થોડા ગુણ ઘણા સજનતા તે ન લિખાય રે ।

વાચક જશ કહે પ્રેમથી,

પશુ મનમાંહે પરખાય રે-પણ૦ જગત૦ ॥૫॥



(૧૩૮૩) (૫૭-૨૦૩) શ્રીમુનિસુવ્રત-જિન સ્તવન

મુનિસુવ્રત કીજે મયા રે, મનમાં આણી ^૧મહેર ।

મહેર-વિહૂણા માનવી રે, કઠોન જણાય ^૨કહેર-
-જિનેસર ! તું જગ નાયક દેવ.

તુજ જગ-હિત કરવા ટેવ, -જિનેસર !,

ખીજા જુએ કરતા સેવ-જિનેસર ! તું૦ ॥૧॥

^૩અરહટ્ટ ^૪ક્ષેત્રની ભૂમિકા રે, સિંચે કૃતારથ હોય ।

^૫ધારાધર સઘળી ધરા રે,

ઉદ્ધરવા સજજ જોય-જિને૦ તું૦ ॥૨॥

તે માટે અશ્વ ઉપરે રે, આણી મનમાં મહેર ।

આપ આપ્યા ^૬આફણી રે,

જોધવા ભરૂય^૭ શહેર-જિને૦ તું૦ ॥૩॥

^૭અણુ-પ્રારથતા ઉદ્ધર્યા રે, આપે કરી ય ઉપાય ।

૧ દયા, ૨ કઠોર, ૩ રેંટ, ૪ ખેતર, ૫ મેઘ, ૬ પોતાની મેળે,

૭ ભાગણી કરનારને,

‘પ્રારથતા રહે ‘વિલવતા રે,

એ કુણુ કહીએ ન્યાય ?-જિનેં તું ॥૪॥

સંબંધ પણુ તુજ-મુજ વિચે રે સ્વામી-સેવક ભાવ ।

માન કહે હવે મહેરનો રે.

ન રહ્યો ૧૦અજર પ્રસ્તાવ-જિનેં તું ॥૫॥

(૧૩૮૪) (૫૭-૨૧અ) શ્રી નમિનાથ-જિન સ્તવન

પરમ રૂપ નિરંજન, જન મન રંજણો-લલના,

ભકત-વરછલ ભગવંત, તું, ભવભવ ભંજણો-લલના ।

જગત-જંતુ-હિતકારક, તારક જગધણી-લલના,

તુજ પદ પંકજ-સેવ, હેવ મુજને ઘણી-લલના ॥ ૧ ॥

આવ્યો રાજ ! હજુર, પૂરણ ભગતિ ભર્યો-લલના,

આપો સેવના આપ, પાપ જિમ સવિ ટળે-લલના ।

તુજ સરીખા મહારાજ ! મહેર જો નહિ કરે-લલના,

તો અમ સરીખા જીવનાં,

કારજ કીમ સરે ?-લલના ॥ ૨ ॥

જગતારક જિનરાજ ! મિરુદ છે તુમ તણો લલના-

આપો સમક્રિતદાન પરાયા મત ગણો-લલના ।

સમરથ જાણી દેવ, સેવના મેં કરી-લલના,

તુંહીજ છે સમરથ, તરણ-તારણ-તરી-લલના ॥ ૩ ॥

મૃગશિર-સિત-એકાદશી, ધ્યાન શુદ્ધ ધરી-લલના,

ઘાતી-કરમ કરી અંત કે, કેવલ-શ્રી વરી-લલના ।

૮ માગણી કરનારા, ૯ રોતા=રડતા, ૧૦ યોગ્ય.

જગનિસ્તારણ-કારણ, તીરથ થાપીયો-લલના,
 આતમ સત્તા ધર્મ ભક્તોને આપીયો-લલના ॥૪॥
 અમ વેળા કિમ આજ, વિલંબ કરી રહ્યા ?-લલના,
 જાણો છો મહારાજ ! સેવક ચરણ ગ્રહ્યાં-લલના ।
 મન માન્યા વિના માહરું નવિ છોડું કદા-લલના,
 સાચો સેવક તેહ જે સેવ કરે સદા-લલના ॥૫॥
 વધ્યા માત-સુખત, કહાવો શ્યું ઘણું ?-લલના,
 આપો ચિદાનંદ દાન, જનમ સફલો ગણું લલના ।
 જિન-ઉત્તમ પદ પદ્મ વિજય પદ લીજીયે-લલના,
 રૂપવિજય કહે સાહિબ ! મુજરો લીજીયે-લલના ॥૬॥



(૧૩૮૫) (૫૭-૨૧-અ) શ્રી નમિનાથ-જિન સ્તવન

(સેવો ભવિયાં વિમલ જિનેસર)

શ્રી નમિનાથને ચરણે રમતાં,

મન-ગમતાં સુખ લહીયે રે ।

જવ-જંગલમાં ભમતાં રહીયે,

કર્મ નિકાચિત દહીયે રે-શ્રી૦ ॥૧॥

સમકિત શિવમાંહી પહોંચાડે, સમકિત ધરમ આધાર રે ।

શ્રી જિનવરનો પૂજા કરીએ,

એ સમકિતનો સાર રે-શ્રી૦ ॥૨॥

જે સમકિતથી હોય ઉપરાંડા,

તેના સુખ જાએ નાડા રે ।

જે કહે જિન-પૂજા નવિ કીજે,

તેહનું નામ ન લીજે રે-શ્રી૦ ॥૩૧॥

૨વત્રા શાણીનો સુત પૂજે, જિમ સંસાર ન ધૂજે રે ।

ભવ-જલ-તારક કષ્ટ-નિવારક,

નવિ કોઈ એહવો ફૂજે રે-શ્રી૦ ॥૪૧॥

શ્રી કીર્તિવિજય ઉવજઝાયનો સેવક,

વિનય કહે પ્રભુ સેવો રે ।

ત્રણ તત્ત્વ મનમાંહી અવધારી,

વંદો અરિહંત દેવો રે-શ્રી૦ ॥૫૧॥



(૧૩૮૬)(૫૭-૨૨અ) શ્રી નેમિનાથ--જિન-સ્તવન

કામ સુભટ ગયો હારી-થાંશું કામ૦ ।

૧રતિપતિ આણુ વસે સૌ સુર-નર,

૨હરિ-૩હર-૪બ્રહ્મા ૫મુરારિ રે-થાંશું ॥૧॥

૬ગોપીનાથ ૭વિગોપિત કીનો, હર અર્ધાંગિત નારી ।

તેહ અનંગ કીયો ચકચૂરણ,

એ અતિશય તુજ ભારી રે-થાંશું ॥૨॥

એ સાચું જિમ નીર-પ્રભાવે, અગ્નિ હોત સવિ છારી ।

તે વડવાનલ પ્રબલ જળ પ્રગટે,

તળ પીવત સવિ વારિ રે-થાંશું ॥૩॥

૨ પ્રભુજીની માતાનું નામ,

૧ કામદેવ, ૨ વિષ્ણુ, ૩ મહાદેવ, ૪ બ્રહ્મા ૫ કૃષ્ણ, ૭ વિડંબિત,

તેણી પરે વહવટ અતિ કૌની, વિષય રતિ-અરતિ નારી ।
નયવિજય પ્રભુ તુંહી નિરાગી,

તુંહી મોટા બ્રહ્મચારી રે-ચાંચું ॥૪૧॥

(૧૩૮૭) (૫૭-૨૨આ) શ્રી નેમિનાથ-જિન સ્તવન:

પરમાતમ પૂરણ કલા,

પૂરણ-શુણ હો ! પૂરણ જન આશ કે ।

પૂરણ-દષ્ટિ નિહાળીએ,

ચિત્ત ધરીયે હો ! અમચી અરદાસ કે-પરં ॥૧॥

સર્વ-દેશ ઘાતી સહુ,

અ-ઘાતી હો ! કરી ઘાત દયાલ કે ।

વાસ કીયો શિવમંદિરે,

મોહે વિસરી હો ! ભમતો જગ-જાલ કે-પરં ॥૨॥

જગ-તારક પદવી લહી,

તાર્યાં સહી હો ! અપરાધી અ-પાર કે ।

તાત ! કહો મોહે તારતાં,

કિમ કિની ? હો ! ઈણે અવસર વાર કે-પરં ॥૩॥

મોહ-મહામહ-^૧છાકથી,

હું છકીયો હો ! નહિ શુદ્ધિ લગાર કે ।

ઉચિત સહી ઈણે અવસર,

સેવકની હો ! કરવી સંભાળ કે-પરં ॥૪॥

૮ વિશિષ્ટ પદ્ધતિ,

૧ ઘેનથા,

મોહ ગયે જો તારશો,

તિષ્ઠ વેળા હો ! કીશો તુમ ઉપગાર કે ।

સુખ-વેળા સજ્જન ઘણા,

દુઃખ-વેળા હો ! વિરલા સંસાર કે-પરં ॥૫૫॥

પણ તુમ દરિશન-જોગથી.

થયે હૃદયે હો ! અનુભવ-પ્રકાશ કે ।

અનુભવ-અભ્યાસો કરે,

દુઃખદાયી હો ! સદુ કર્મ-વિનાશ કે-પરં ॥૬૫॥

કર્મ-કલંક નિવારીને, નિજ રૂપે હો ! રહે રમતા રામ કે ।

લહત અપૂરવ-ભાવથી,

છણ રીતે હો ! તુમ પદ-વિસરામ કે-પરં ॥૭૫॥

ત્રિરણુ-જોગે હું વિનવું,

સુખદાયી હો ! શિવાદેવીના નંદ કે ।

ચિદાનંદ મનમે સદા,

તુમે આપો હો ! પ્રભુ ! નાણુ-રદિષ્ટુંદ કે-પરં ॥૮૫॥



(૧૩૮૮) (૫૭-૨૨૩) શ્રી નેમિનાથ જિન-સ્તવન
રહો રહો રે યાદવ ! દો ઘડીયાં-રહો ।

દો ઘડીયાં દો-ચાર ઘડીયાં-રહો ।

શિવા-માત મદકાર નગીનો, કયું ચણીએ હમ વિછડીયાં ।

યાદવ-વંશ-વિભૂષણુ સ્વામી !

તુમે આધાર છો ! અડવડીયા-રહો ॥૧૧॥

૨ સૂર્ય,

તો બિન ચોરસે' નેહ ન કીનો,

ચોર કરનકી આખડીયાં ।

ઈતને બિચ હમ છોડ ન જઈએ,

હોત ખુરાઈ લાજડીયાં-રહો ॥૨૧॥

પ્રીતમ ! પ્યારે ! કહ કર જાના,

જે હોત હમ શિર બાંકડીયાં ।

હાથસે' હાથ મિલા દે ! સાંધ !

કુલ બિછાઈ' સેજડીયાં-રહો ॥૨૨॥

પ્રેમકે પ્યાલે બહુત મસાલે, પીવત મધુર સેલડીયા ।

સમુદ્રવિજય-કુલ-તિલક નેમકું,

રાજુલ ઝરતી આંખડીયાં-રહો ॥૨૩॥

રાજુલ છોર ચલે ગિરનારે,

નેમ યુગલ કેવલ વરીયાં ।

રાજમતી પણ દીક્ષા લીની,

લાવના-રંગ રસે ચડીયાં-રહો ॥૨૪॥

કેવલ લહી કરી યુગતી સિધારે, દંપતિ મોહન વેલડીયાં ।

શ્રી શુભવીર અચલ લઈ જોડી,

મોહરાય શિર લાકડીયાં-રહો ॥૨૫॥



(૧૩૮૯) (૫૭-૨૩૩) શ્રી પાર્શ્વનાથ-જિન સ્તવન

અબ મોહે એસી આય બની ! ।

શ્રી શંખેશ્વર-પાસ-જિનેસર,

મેરે તું એક ધણી-અબ ॥૨૬॥

તુમ બિન કોઈ ચિત્ત ન સુહાવે, આવે કોઈ ગુણી ।

મેરો મન તુમ ઉપર રસિયો,

૧ અલિ જિમ કમલ ભણી-અખ૦ ॥૨॥

તુમ નામે સવિ સંકટ ચૂરે, નાગરાજ ધરણી ।

નામ જપું નિશિ-વાસર તેરો,

એ મુજ શુભ કરણી-અખ૦ ॥૩॥

કોપાનલ ઉપગવત દુર્જન, મથન વચન અરણી ।

નામ જપું જલધાર તિહાં તુજ,

ધારું દુઃખહરણી-અખ૦ ॥૪॥

મિથ્યામતિ ખડુ જન હૈ જગમેં, પદ ન ધરત ધરણી,

ઉનકા અખ તુજ ભક્તિ-પ્રભાવે,

ભય નહિ એક કની-અખ૦ ॥૫॥

સજ્જન-નયન-સુધારસ અંજન, દુર્જન-રવિ-ભરણી ।

તુજ મૂરતિ નિરખે સો પાવે,

સુખ-જશ-લીલ ઘણી-અખ૦ ॥૬॥

★

(૧૩૯૦) (૫૭-૨૩આ) શ્રી પાર્શ્વનાથ-જિન સ્તવન

પ્રભુ ! જગજીવન ! જગખંધુ ! રે સાંધ સયાણો રે ।

તારી મુદ્રાએ મન માન્યું રે, જૂક ન જાણો રે-પ્રભુ ॥૧॥

તું પરમાત્મ ! તું પરમેશ્વર ! તું પરબ્રહ્મ-સ્વરૂપી ।

સિદ્ધ-સાધક ! સિદ્ધાન્ત ! સનાતન !

તું મય-ભાવ-પ્રરૂપી ! રે-સાંધ ॥૨॥

૧ બ્રમર,

તાહરી પ્રભુતા તિહું જગમાંહે, પણ અજ પ્રભુતા મોટી ।
તુમ સરીખો મારે મહારાજ,

તેમાં કાંઈ નવી ખોટી રે-સાંઈ ॥૩૭॥

તું નિર્દ્રવ્ય પરમ-પદ-વાસી, હું તો દ્રવ્યનો ભોગી ।
હું નિર્ગુણ ! તું ગુણધારી !,

હું કમી ! તું અ-ભોગી ! રે-સાંઈ ॥૪૦॥

તું તો અરૂપી ! ને હું રૂપી ! હું રાગી ! તું નિરાગી !
તું નિર્વિષ ! હું વિષધારી !,

હું સંબ્રહ્મી ! તું ત્યાગી ! રે-સાંઈ ॥૪૩॥

તારે રાજ નથી પ્રભુ ! એકે, ચૌદ રાજ છે મારે ।

મારી લીલા આગળ પ્રભુજી !,

અધિકું શું છે ત્હારે ? રે-સાંઈ ॥૪૬॥

પણ તું મોટો ને હું છોટો, ફાગટ કુંભે શું થાયે ।

અમળે એ અપરાધ અમારો,

લકિત-વશે કહેવાયે રે-સાંઈ ॥૪૯॥

શ્રીશંખેશ્વર વામા-નંદન ! ઉલા ઓલગ કીજે ।

રૂપ-વિબુધનો મોહન પમણે,

ચરણોની સેવા પ્રભુ હીજે રે-સાંઈ ॥૫૨॥



(૧૩૬૧) (૫૭-૨૩૬) શ્રી પાર્શ્વનાથ-જિન સ્તવન

મોહન ! અજરો લેજો ! રાજ ! તુમ સેવામાં રહેશું ।

વામા-નંદન જગદાનંદન, જેહ સુધારસ ખાણી ।

મુખ મટકે લોચનને લટકે, લોભાણી ઈંદ્રાણી-મોહન ॥૧૧॥

ભવ-પદ્મ શિહુંદિશિ ચારે ગતિ, ચોરાશી લાખ ચૌટા ।
ક્રોધ-માન-માયા-લોભાદિક,

ચોવટીયા અતિ ખોટા-મોહન૦ ॥૨૧॥
મિથ્યા-મહેતો કુમતિ-પુરોહિત, મદન-સેનાની તોરે ।
લાંચ લઈ લખ લોક સંતાપે,

મોહ-કંદર્પને જોરે-મોહન૦ ॥૨૩॥
અનાદિ નિગોહના બંદીબાને તૃણા તોપે રાખ્યો ।
સંજ્ઞા ચારે ચોક્કી મેલી, વેદ નપુંસક આંક્યો-મોહન૦ ॥૨૪॥
ભવ-સ્થિતિ કર્મ-વિવર લઈ નાઠો,

પુણ્ય-ઉણ્ય પણ વાક્યો ।
સ્થાવર વિકલોદ્રિયપણું ઓળંગી,
પંચેદ્રિયપણું લાક્યો-મોહન૦ ॥૨૫॥

માનવભવ આરજ કુલ સકશુરુ,
વિમલ-બોધ મદ્યો મુજને ।

ક્રોધાદિક સહુ શત્રુ વિનાશી,
તેણે ઓળખાવ્યો તુજને-મોહન૦ ॥૨૬॥

પાટણુ માંહે પરમહયાળુ જગત વિભૂષણુ ભેટયા ।
સત્તર બાણું શુભ પરિણામે,

કર્મ કઠિન બલ મેટયા-મોહન૦ ॥૨૭॥
સમકિત ગજ ઉપશમ અંબાડી, જ્ઞાન કટક બલ કીધું ।

ખીમાવિજય-જિન-ચરણ-પસાયે,
રાજ પોતાનું લીધું-મોહન૦ ॥૨૮॥



(૧૩૯૨) (૫૭-૨૩૬) શ્રી પાર્શ્વનાથ-જિન સ્તવન

શ્રી પાસજી પ્રગટ પ્રભાવી, તુજ મુરતિ મુજ મન લાવી રે-
મનમોહના જિનરાયા ।

સુર-નર-કિન્નર ગુણ ગાયા રે-મનમોહના જિનરાયા ।

જે દિનથી મૂરતિ દીઠી,

તે દિનથી આપદા ૧નીઠી રે-મન૦ ॥૧૧॥

મટકાલું મુખ મુપ્રસન્ન,

દેખત રીઝે લવિ મન્ન રે-મન૦ ॥

સમતા-રસ કેરાં કચોળાં,

નયણે દીઠે રંગ-રોળાં રે-મન૦ ॥૨૧॥

હાથ ન ધરે હથિયાર,

નહિ જપમાળાનો પ્રચાર રે-મન૦ ।

ઉત્સાંગે ન ધરે રવામા,

જેહથી ઉપજે સવિ કામા રે-મન૦ ॥૩૧॥

ન કરે ગીત-નૃત્યના ચાળા,

એ તો પ્રત્યક્ષ નટના ખ્યાલા રે-મન૦ ।

ન બજાવે આપે વાજાં.

ન ધરે વસ્ત્ર ઝેરણુ ૪સાજાં રે-મન૦ ॥૪૧॥

ધમિ મૂરતિ તુજ નિરુપાધિ,

વીતરાગપણે કરી સાધી રે-મન૦ ।

કહે માનવિજય ઉવજાયા,

મેં અવલંબ્યા તુજ પાયા રે-મન૦ ॥૫૧॥



૧ દૂર, ૨ સ્ત્રી, ૩ જુનાં, ૪ નવાં,

૪૪

(૧૩૯૩) (૫૭-૨૩૬) શ્રી પાર્શ્વનાથ-જિન સ્તવન

સાર કર સાર કર સ્વામી શંખેશ્વરા ।

વિશ્વ-વિખ્યાત ઝોકાંત આવો ! ।

જગતના નાથ ! મુજ હાથ ઝાલી કરી

આજ કિમ કાજમાં વાર લાવો-સાર૦ ॥૧॥

હૃદય મુજ રંકનો શત્રુ હુઃખ-ભંજનો,

છોટ પરમેઠી મોઢે તુંહિ સાચો ।

૧ખલક રખિજમત કરે વિપત્તિ સમે ખિણુ^૩ ભરે,

નવિ રહે તાસ અભિલાષ કાચો-સાર૦ ॥૨॥

યાદવા રણુઝણે ૪રામ-૫કેશવ રણે,

૬ભમ લાગી જરા નિંદ સોતી ।

સ્વામી શંખેશ્વરા-ચરણુ જલ પામીને,

યાદવોની જરા ભય રોતી-સાર૦ ॥૩॥

આજ જિનરાજ ઉંચે કિશ્યું આ સમે,

ભગ મહારાજ સેવક-પનોતા ।

સુખુદ્ધિ મયે ટલે ધૂતે ઢોલત હરે !,

વીર-હાકે રિપુવૃંદ રોતા-સાર૦ ॥૪॥

હાસ છું જન્મનો પૂરીએ કામના,

ધ્યાનથી માસ દશ હોય વીત્યા ।

વિકટ સંકટ હરે નિકટ નયનાં કરો,

તો અમે શત્રુ નૃપતિકું છુટ્યા-સાર૦ ॥૫॥

૧ કુનિયા, ૨ સેવા, ૩ જલ્દી, ૪ બળદેવ, ૫ શ્રીકૃષ્ણ, ૬ ઘેરી,

કાલ ૭ મોઘે ૮ અશન શીતઠાળે ૯ વસન,

૧૦ શ્રમ ૧૧ સુખાસન ૧૨ રણે ૧૩ ઉઠકે-દાઠં ।

સુગુણ નર સાંભરે વિસરે નહિ કદા,

પાસજી ! તું સદા છે સખાધ-સારં ॥૬॥

માત તું ! તાત તું ! બ્રાત તું ! દેવ તું !

દેવ દુનિયામાં ફળે ન વહાલો ।

શ્રી શુભવીર જગ જીત ડંકો કરે,

નાથજી ! નેક-નયણે નિહાલો-સારં ॥૭॥



(૧૩૯૪) (૫૭-૨૩૩) શ્રી પાર્શ્વનાથ-જિન સ્તવન

પરમપુરૂષ પરમાતમા-સાહેબજી,

પુરિસાદાણી પાસ-હો ! શિવસુખરા ભભરા !

થાંશું વિનતિ સાહેબજી !

અવસર પામી ઓલણું-સાં,

સફલ કરો અરદાસ-હો ! શિવં ॥૧॥

દોય નંદન મોહ-ભૂપના-સાં

તિણુ કર્યો જગદીધ-ધોલ-હો શિવં ।

દ્વેષ-કરી રાગ-કેસરી-સાં,

તેહના રાણા સોલ-હો ! શિવં ॥૨॥

મિથ્યા મહેતો આગલો-સાં,

કામ કટક સિરદાર-હો ! શિવં ।

૭ દુકાળમાં, ૮ ખાવાનું, ૯ કપડાં, ૧૦ થાક લાગે ત્યારે, ૧૧ પાલખી,

૧૨ મારવાડના રણમાં, ૧૩ પાણી આપનાર,

૧ તોફાન,

૨ ત્રણ રૂપ ધરી તેહ રમે-સાં,

હાસ્યાદિક પરિવાર-હો ! શિવં ॥૩૦॥

મોહ મહીપના ભેરથી-સાં,

જગ સઘલો થયો-૩જેર-હો ! શિવં ॥

હરિ-હર-સુર-નર સહુ નમ્યા-સાં,

અકડી કર્મની ઘેર-હો ! શિવં ॥૩૧॥

ભવધિતિ ચક્રગતિ ચોકમાં-સાં,

લોક કરે પોકાર હો ! શિવં ॥

આપ ઉદાસી હુઈ રહ્યા-સાં,

ઈમ કિમ રહસ્યે ૪કાર-હો ! શિવં ॥૩૨॥

ક્ષપક શ્રેણિની ગજઘટા-સાં,

પહલકારો અરિહંત-હો ! શિવં ॥

નાણુ ખડગ મુજ કર દીયો-સાં,

ક્ષણમાં કરું અરિ અંત-હો ! શિવં ॥૩૩॥

કરણા નયણુ-કટાક્ષથી-સાં,

રિપુદલ થાયે વિસરાલ-હો ! શિવં ॥

ક્ષમાવિજય જિન સંપદા-સાં,

પ્રગટે અક-અમાલ-હો ! શિવં ॥૩૪॥



૨ ત્રણવેદ, ૩ દુઃખી, ૪ મર્યાદા, ૫ આગળ વધારો,

(૧૩૯૫) (૫૭-૨૩૬) શ્રી પાર્શ્વનાથ-જિ નસ્તવન

(જિજ્ઞંઠ રાય રે-એ દેશી)

આજ શંખેશ્વર-જિન લેટીએ,

લેટતાં લવ-દુઃખ-નાશ-સાહિબ મોરા રે !

જયો અશ્વસેન કુલ ચંદ્રમા,

માતા વામા-સુત પાસ-સાહિબં આજં ॥૧॥

ભક્ત-વત્સલ જન-લયહર, હસતાં હણીયા ખટ હાસ્ય-સાં ।

દાનાદિક પાંચને હુહંચ્યા,

કરી નાવે પાસની પાસ-સાહિબં આજં ॥૨॥

કરી કામને કારમી કમકમી,

મિથ્યાત્વને ન દીઠં માન-સાહિબં ।

અવિરતિને શતિ નહિ એક ઘડી,

અ-ગુણી^૧ અલગું અજ્ઞાન-સાં આં ॥૩॥

નિંદક નિદ્રાને નાશવી, મૃત-રાગને રોગ અ-પાર રે-સાહિબં ।

એક ઘડકે દ્રેષને ઢોલિયો,

એમ નાઠા દોષ અઠાધ-સાહિબં આજં ॥૪॥

વલી ખત્સર એહ મમત જયો,

અરિહા નિરીહા નિરદોષ-સાહિબં ।

ધરણેન્દ્ર કમઠ સુર ખિંહુ પરે,

તલ^૨-માત્ર નહિ^૩ તોસ^૪-રોસ-સાં આજં ॥૫॥

અચરિજ સુષુળે એક તેણે સમે

શત્રુને સમકિત હાય રે-સાહિબં ।

૧. ખરામ, ૨. જરાપણ, ૩. રામ ૪. દ્રેષ,

ચંદન પારસ ગુણ અતિ ઘણા,

અક્ષર થોડે ન કહાય-સાહિબં આજં ॥૧૧॥

જાગરણ દશા ઉપર ચઢ્યા, ઉજાગરણ વીતરાગ-સાહિબં ।

આલંબન ઘટતાં પ્રભુ તણું,

પ્રભુના સેવક સૌભાગ્ય-સાહિબં આજં ॥૧૨॥

ઉપાદાન-કારણ કારજ સીધે,

અ-સાધારણ કારણ નિત્ય-સાહિબં ।

જે અપેક્ષા-કારણ ભવિ લેહ,

ફલ કારણ નિમિત્ત-સાહિબ આજં ॥૧૩॥

પ્રભુ ત્રાયક સાર્થકતા ધરી, દાયક નાયક-ગંભીર-સાહિબ ।

નિજ સેવક જાણી નિવાજિએ,

તુમ ચરણે નમે શુભવીર-સાહિબ આજં ॥૧૪॥



(૧૩૯૬) (૫૭-૨૩૬) શ્રી પાર્શ્વનાથ-જિન સ્તવન

વામા નંદન ! હો પ્રાણ થકી છો ખ્યારા ! ।

નાંહિ કીજે હો ! નયન થકી ક્ષણ ન્યારા ॥

પુરીસા-ઢાણી શામળ વરણો, શુદ્ધ સમકિતીને ભાસે ।

શુદ્ધ-પુંજ જિણે કીધો તેહને,

ઉજવળ-વરણ પ્રકાશે-વામાં ॥૧૫॥

તુમ ચરણે વિષધર પણ નિરવિષ, દંસણે થાયે ૧ખિડામ ।

જોતાં અમ શુદ્ધ સ્વાભાવિક ન હુએ,

એમ અમી ગ્રહ્યા ૨છોળા-વામાં ॥૧૬॥

૧. ઈંદ્ર, ૨. ખળભળાટ,

કમઠરાય મદ કીણુ ગિણુતિમાં, મોહ તણે। મદ જ્ઞેતાં ।
તાહરી શક્તિ અનંતી આગળ,

કેઈ કેઈ માર ગયા ગોતાં-વામા ॥૩૩॥

તેં જિમ તાર્યા તિમ કુણુ તારે, કુણુ તારક કહું જોહવો ? ।
સાયર માન તે સાયર સરિણો,

તિમ તું પણુ તું જોહવો-વામા ॥૩૪॥

કિમપિ ન જોસો કર્ણુ-કરતેં પણુ મુજ પ્રાપ્તિ અનંતી ।
જેમ પડે કણુ-કુંજર મુખથી, કીડો બહુ ધનવંતી-વામા ॥૩૫॥

એક આવે એક મોજાં પાવે, એક કરે ઓળમડી^૪ ।

નિજ ગુણુ-અનુભવ દેવા આગળ,

પડજે નહિં તું જે ઘડી-વામા ॥૩૬॥

જોહવી તુમથી મારી માયા, જોહવી તુમે પણુ ધરજ્યો ।

૩૫-વિબુધનો મોહન પભણે,

પ્રત્યક્ષ કર્ણુ કરજ્યો-વામા ॥૩૭॥



(૧૩૯૭) (૫૭-૨૩૬) શ્રી પર્શ્વનાથ-જિન સ્તવન

(રાગ-પ્રથમ જિનેશ્વર પ્રણમીએ)

પરમાતમ પરમેશ્વર, જગદીશ્વર જિનરાજ ।

જગ-અધવ જગ-ભાણુ, બલિહારી તુમતણી-

ભવ-જલધિમાં રે જહાજ-પરમાતમ ॥૧॥

૩. કર્ણુના ભંડારથી, ૪. સેવા

તારક વારક મોહનો, ધારક નિજ-ગુણ-ઋદ્ધિ ।

અતિશયવંત લદંત રૂપાળી શિવવધુ,

પરણી લડી નિજ સિદ્ધિ-પરમાત્મનં ॥૨૥॥

દર્શન-જ્ઞાન અનંત છે, વળી તુજ ચરણ અનંત ।

એમ દાનાદિ અનંત ક્ષાયિક-ભાવે થયા,

ગુણ તે અનંતા-અનંત-પરમાત્મનં ॥૩૥॥

અત્રીય વર્ણ સમાય છે, એક જ પ્રલોક મોહાર ।

એક જ વર્ણ પ્રભુ તુજ ન માયે જગતમાં,

કેમ કરી શુભીએ ઉદાર ?-પરમાત્મનં ॥૪૥॥

તુજ ગુણ કોણ ગણી શકે ? જો પણ કેવળ હોય ।

આવિર્ભાવે તુજ સયલ ગુણ માહરે,

પ્રવચન-ભાવથી જોય-પરમાત્મનં ॥૫૥॥

શ્રી પંચાક્ષર-પાર્શ્વજી ! અરજ કરું એક તુજ ।

આવિર્ભાવથી થાય ક્યાલ ! કૃપાનિધિ,

કરૂણા કીજેજી મુજ-પરમાત્મનં ॥૬૥॥

શ્રી જિન-ઉત્તમ તાહરી, આશા અધિકી મહારાજ ।

પદ્મવિજય કહે એમ, લહું શિવનગરીતું,

અ-ક્ષય અ-વિચળ રાજ-પરમાત્મનં ॥૭૥॥



(૧૩૯૮) (૫૭-૨૭૬) શ્રી પાર્શ્વનાથ-જિન સ્તવન

શ્રી ચિંતામણિ-પાર્શ્વજી ! વાત સુણો એક મોરી રે ।

મારા મનના મનોરથ પૂરજો,

હું તો લક્ષિત ન છોડું તોરી રે-શ્રીં ॥૧૥॥

મારી ખિજમતમાં ખામી નહિ,

તારે જોટ ન કાંઈ ખજાને રે ।

હવે દેવાની શી ઢીલ છે ?

હવે શું ? કહીએ છાને રે ? શ્રી૦ ॥૨॥

તે ? ઉરણુ સવિ પૃથ્વી કરી, ધન વરસી વરસી-દાને ।

મારી વેળા શું ? એહવા,

દીએ વંછિત વાળો વાન રે-શ્રી૦ ॥૩॥

હું તો કેડ ન છોડું તાહરી,

આખ્યા વિષુ શિવ-સુખ સ્વામી । રે ।

સુરખ તે ઓછે માનશે, ચિંતામણી કરચલ પામી રે-શ્રી૦ ॥૪॥

મત કહેશે તુજ કર્મે નથી, કર્મે છે તો તું પામ્યો રે ।

સુજ સરીખા કીધા મોટકા,

કહો તેણે કાંઈ તુજ રધામ્યો રે-શ્રી૦ ॥૫॥

કાલ રાભાવ ભવિતવ્યતા, તે સઘળા તારા દાસો રે ।

સુખ્ય હેતુ તું મોક્ષનો,

એ સુજને સ-બલ વિશ્વાસો રે-શ્રી૦ ॥૬॥

અમે ભકતે મુક્તિને ખેંચશું, જિમ લોહને ચમક પાપાણો રે ।

તુમે હજે હસીને દેખશે,

કહેશે સેવક છે સપરાણો^૩ રે-શ્રી૦ ॥૭॥

ભક્તિ આરાધ્યા ફલ દીએ ચિંતામણી પણ પાપાણો રે ।

વલી અધિકું કાંઈ કહાવશે,

એ ભદ્રક-ભક્તિ તે જાણો રે-શ્રી૦ ॥૮॥

૧. અનૃશુ = દેવા વગરની, ૨. લાંચ આપી, ૩. ચતુર

બાલક તે જિમ-તિમ બોલતો, કરે લાડ તાતને આગે રે ।
તે તેહયું વંછિત પૂરવે,

બની આવે સઘળું રાગે રે-શ્રી૦ ॥૬॥

મારે બનનારું તે બન્યું જ છે,

હું તો લોકને વાત શીખાવું રે ।

વાચક જસ કહે સાહિબા,

એ રીતે પ્રભુ ગુણ ગાવું રે-શ્રી૦ ॥૧૦॥



(૧૩૯૯) (૫૭-૨૩૯) શ્રી પાર્શ્વનાથ-જિન સ્તવન

તારી મૂરતિનું નહિ મૂલ રે, લાગે મને પ્યારી રે !

તારી આંખડીયે મન મોહું રે, જાઉં બલિહારી રે ! ! !

ત્રણ ભુવનનું તત્ત્વ લઈને, નિર્મલ તુંહી નિપાયો રે ।

જમ સઘળું નિરખીને જોતાં,

તાહરી હોડે કે નહિ આયો રે-લાગે૦ ॥૧૧॥

ત્રિભુવન-તિલક સમોવડ તાહરી, સુંદર સૂરતિ દીસે રે ।

કોટિ કંઠપં સમ રૂપ નિહાળી,

સુર-નરનાં મન હીસે રે-લાગે૦ ॥૧૨॥

જ્યોતિ-સ્વરૂપી તું જિન દીઠો,

તેહને ન ગમે બીજું કાંઈ રે ।

જિહાં જઈએ ત્યાં પૂરણ સઘલે,

દીસે તુંહીજ તુંહી રે-લાગે૦ ॥૧૩॥

તુજ મુખ જોવાને રહ લાગી,

તેહને ન ગમે ઘરનો ધંધો રે ।

આળ પંપાળ સવિ અલગી મૂકી,

તુજશું માંડ્યો પ્રતિબંધો રે-લાગે૦ ॥૪૧॥

ભવ-સાગરમાં ભમતાં ભમતાં,

પ્રભુ પાસનો પામ્યો આરો રે ।

ઉદયરતન કહે બાંહુ ગ્રહીને,

સેવક પાર ઉતારો રે-લાગે૦ ॥૪૨॥



(૧૪૦૦)(૫૭-૨૪અ) શ્રી મહાવીરસ્વામી-જિન સ્તવન

ના રે પ્રભુ ! નહીં માતું !

નહીં માતું અવરની આણુ, નારે પ્રભુ ! નહીં માતું ।

મહારે તહારું વચન પ્રમાણુ-ના રે૦ ॥૧॥

હરિ-હરાદિક દેવ અનેરા, તે દીઠા જગમાંય રે ।

૧ભામિની-બ્રમર-બ્રહ્મટીએ બૂલ્યા,

તે મુજને ન સુહાય-ના રે૦ ॥૨॥

કેઈક રાગી ને કેઈક દેવી, કેઈક લોભી દેવ રે ।

કેઈક મદ-માયાના ભરિયા,

કિમ કરીએ તસ સેવ ? ના રે૦ ॥૩॥

મુદ્રા પણ તેહમાં નવિ દીસે,

પ્રભુ ! તુજ માંહિલી તિલ-માત્ર રે ।

જે દેખી દિલડું નવિ રીઝે !,

શો કરવી તસ વાત ? ના રે૦ ॥૪॥

૧ સ્ત્રીની ભમરા જેવી કાળી બ્રહ્મટીથી),

તું ગતિ ! તું ભતિ ! તું મુજ પ્રીતમ !

જીવ-જીવન આધાર રે ।

શત-દિવસ સુપનાંતર માંહિ,

તુંહી મ્હારે નિરધાર-ના રે૦ ॥૫૦॥

અવગુણ સહુ ઉવેખીને પ્રભુ ! સેવક કરીને નિહાલ રે ।

જગખંધવ એ વિનતી મ્હારી,

મારાં સવિ હુઃખ દૂરે ટાળ-ના રે૦ ॥૫૧॥

ચોવીશમા પ્રભુ ! ત્રિભુવન-સ્વામી ! સિદ્ધારથના નંદ રે ।

ત્રિશક્તાજીના નાનડીયા પ્રભુ !

તુમ દીઠે અતિહી આનંદ-ના રે૦ ॥૫૨॥

સુમતિવિજય કવિરાયનો, રામવિજય કરજોડ રે ।

ઉપકારી અરિહંતજી ! માહરા,

માહરા ભવોભવનાં ખંધ છોડ-ના રે૦ ॥૫૩॥

૩૩

(૧૪૦૦)(૫૭-૨૪આ) શ્રીમહાવીરસ્વામી-જિન સ્તવન

આજ જિનરાજ ! મુજ કાજ સિધ્યાં સવે,

તું કૃપાકુંભ જો મુજ તુઠ્યો ।

કલ્પતરુ કામઘટ કામધેનુ મિલ્યો,

આંગણે અમીયરસ મેહ વૂઠ્યો-આજ૦ ॥૫૪॥

વીર ! તું કુંડપુર નયર-ભૂષણ હુઓ,

રાય સિદ્ધાથ ત્રિશક્તા-તનૂજો ।

સિંહ-લાંછન કનકવર્ણ કર-સપ્ત-તનુ,

જુજ સમો જગતમાં કો ન દૂજો-આજ૦ ॥૫૫॥

સિંહ પરે એકલો ધીર સંયમ ગ્રહી,

આયુ ખહોંતેર વરસ પૂરણ પાલી ।
પુરી અપાપાએ નિપાપ શિવવહૂ વર્યા,

તિહાં થકી પવ' પ્રગટી દિવાલી-આજઁ ॥૩॥
સહસ તુજ ચીંદ મુનિવર મહા-સંયમો

સાહુણી સહસ છત્રીસ રાજે ।
યક્ષ માતંગ સિદ્ધાચિકા વર સુરી,

સકલ તુજ ભવિકની ભીતિ ભાજે-આજઁ ॥૪॥
તુજ વચન-રાગ-સુખ-સાગરે ઝીલતો,

પીલતો મોહ મિથ્યાત્વ-વેલી ।
આવીયો ભાવીયો ધરમપથ હું હવે,

દીજીએ પરમપદ હોધ બેલી-આજઁ ॥૫॥
સિંહ નિશ-ઘીહ જો હૃદયગિરિ મુજ રમે,

તું ^૧સુગુણ-ઘીહ અ-વિચલ નિરીહો ।
તો ^૨કુમત-રંગ-માતંગના બુથથી,

મુજ નહિ કેઇ લવલેશ ^૩ખીહો-આજઁ ॥૬॥
ચરણ તુજ શરણ મેં ચરણ-ગુણનિધિ! ગ્રહા,

ભવતરણ ^૪કરણદમ શમ' દાખો ।
હાથ જોડી કહે જશવિજય બુધ ધરિયું

દેવ! નિજ ભવનમાં દાસ રાખો-આજઁ ॥૭॥



૧ સારા ગુણવાળામાં શ્રેષ્ઠ, ૨ મિથ્યા મતરૂપ મસ્ત હાથીઓના
સમૂહથી, ૩ ભય, ૪ ઈંદ્રિયો ને દમવા રૂપ,

(૧૪૦૧) (૫૭-૨૪૩) શ્રીમહાવીરસ્વામી-જિન સ્તવન

જગપતિ ! તું તો દેવાધિદેવ ! દાસનો દાસ છું તાહરો ।

જગપતિ ! તારક ! તું કીરતાર,

મનરો મોહન પ્રભુ માહરો ॥૧॥

જગપતિ ! તાહરે ભક્ત અનેક,

માહરે એકજ તું ધણી ।

જગપતિ ! વીરમાં તું મહાવીર,

મૂરતિ તાહરી સોહામણી ॥૨॥

જગપતિ ! ત્રિશલા રાણીનો તું મુત,

ગંધાર-ખંદરે ગાળ્યો ।

જગપતિ ! સિદ્ધારથ-કુલ શણગાર,

રાજ-રાજેશ્વર રાણ્યો ॥૩॥

જગપતિ ! ભક્તોની ભાંગે તું બીડ,

પીડ પરાઈ પ્રભુ પારખે ।

જગપતિ ! તુંહી ! પ્રભુ ! અ-ગમ અ-પાર.

સમજ્યો ન જાયે મુજ-સારીખે ॥૪॥

જગપતિ ! ખંભાયત જમ્બુસર સંઘ,

ભગવંત ચોવીસમો ભેટીયો ।

જગપતિ ! ઉદય નમે કર જોડ,

સત્તર નેવું સંઘ સમીટીયો ॥૫॥



(૧૪૦૩)(૫૪-૨૪૬) શ્રી મહાવીરસ્વામી-જિન સ્તવન

સિદ્ધારથ રાયકુલ તિલોએ, ત્રિશલા માત મહાર તો ।
અવનીતલે તમે અવતર્યા એ,

કરવા અમ ઉપકાર-જયો જિન વૌરજી એ૦ ॥૧॥
મેં અપરાધ કર્યા ઘણા એ, કહેતાં ન લહું પાર તો ।
તુમ ચરણે આઘ્યા લણીએ, જો તારે તો તાર-જયો૦ ॥૨॥
આશ કરીને આવીયો એ, તુમ ચરણે મહારાજ તો ।
આઘ્યાને ઉવેખશે એ, તો કિમ રહેશે લાજ-જયો૦ ॥૩॥
કરમ અલુજણ આકરાં એ, જન્મ-મરણ જંજલ તો ।
હું છું એહથી ઉભયો એ,

છોડાવ દેવ દયાલ-જયો૦ ॥૪॥
આજ મનોરથ મુજ દેહ્યા રે, નાઠાં દુઃખ-દંડોલ તો ।
તૂઠ્યો જિન ચોવીસમો રે,

પ્રગટ્યા પુણ્ય કલ્લોલ-જયો૦ ॥૫॥
ભવે ભવે વિનય તુમારડો એ,
ભાવ-ભક્તિ તુમ પાય તો ।

દેવ દયા કરી દીજીએ એ,
બોધિ-બોજ સુપસાય-જયો૦ ॥૬॥



(૧૪૦૪) (૫૭-૨૪૩) શ્રી મહાવીર સ્વામીનું સ્તવન

વીરજી સુણે એક વિનતી મોરી,

વાત વિચારેને તુમે ધણી રે ।

વીર ! મને તારો ! મહાવીર ! મુને તારો !

ભવ-જલ-પાર ઉતારેને રે-વીર૦ ॥૧॥

પરિબ્રમણ મેં અનંતા રે કીધાં,

હજીએ ન આવ્યો છેડલો રે ।

તુમે તો થયા પ્રભુ સિદ્ધ નિરંજન,

અમે તો અનંતા ભવ ભમ્યા રે-વીર૦ ॥૨॥

તુમે ને અમે વાર અનંતી વેળા,

રમીયા સંસારીયણે રે ।

તેહ પ્રીતિ જો પૂરણ પાળો,

તો હમને તુમ-સમ કરો રે-વીર૦ ॥૩॥

તુમ સમ અમને યોગ્ય ન જાણો,

તો થોડું કાંઈ હીજીએ રે ।

ભવોભવ તુમ ચરણોની સેવા,

પામી અમે ઘણું રીઝીએ રે-વીર૦ ॥૪॥

ધન્દ્રજાણીએ કહેતો રે આવ્યો,

ગણધર-પદ તેહને દીયો રે ।

અનુનમાળી જે ઘોર-પાપો,

તેહને જિન ! તમે ઉદ્ધર્યો રે-વીર૦ ॥૫॥

ચંદનખાણાએ અડદના બાકુલા,

પડિલાણ્યા તમને પ્રભુ રે ।

તેહને સાહુણી સાચી રે કીધી,

શિવવધુ સાથે લેળવી રે-વીર૦ ॥૬॥

ચરણે ચાંડકોશીયો ડસીયો, કદપ આઠમે તે ગયો રે ।

ગુણુ તો તમારા પ્રભુ ! શ્રવણુ નિસુણી,

આવી તુમ સન્મુખ રહ્યો રે-વીર૦ ॥૭॥

નિરંજન પ્રભુ નામ ધરાવો, તો સહુને સરીખા ગણ્યો રે ।

લેદલાવ સહુ દૂર કરીને,

મુજશું રમો એકમેકશું રે-વીર૦ ॥૮॥

મોડા વહેલા તુમહી જ તારક, હવે વિલાંબ શા કારણે રે ? ।

જ્ઞાન તણાં લવનાં પાપ મિટાવો,

વારી જાઉં વીર ! તોરા વારણે રે-વીર૦ ॥૯॥



(૧૪૦૬) (૫૭-૨૪ક) શ્રી મહાવીર સ્વામીનું સ્તવન

(રાગ-સાંભળજો મુનિ સંયમ રાગ)

વીર જિનેસર સુણુ મુજ સ્વામી, વિનવીયે શિરનામી રે ।

તું પ્રભુ ! પૂરણુ મન હિત-કામી,

તું મુજ અંતરજામી રે-વીર૦ ॥૧॥

એક જ તું શિર સાહિબ કીજે, તુમ સમ કોણુ કહીજે રે ।

ભગતિ કરતાં જો તું રીઝે,

તો મન-વંછિત સીઝે રે-વીર૦ ॥૨॥

તુજ હિતથી મુખ-સંપદ આવે, હારિદ્ર દૂર ગમાવે રે ।

જગ-બંધવ જિન ! તુંહી કહાવે,

સુર-નર તુજ ગુણુ ગાવે રે-વીર૦ ॥૩॥

તું પ્રભુ ! પ્રીતિ ન હેત જણાવે, પણ સેવક સુખ પાવે રે ।
ગિર્યા-સેવા-ફલ નવિ જાયે,

સેવીજે ઇશુ ભાવે રે-વીર૦ ॥૪॥

ત્રિશલા-નંદન વીર-જિનેશ્વર, વિનતડી અવધારી રે ।

કેસર જયે દરિશન હીજે,

હરગતિ દૂર નિવારી રે-વીર૦ ॥૫॥



(૧૩૦૭) (૫૭-૨૪ઋ) શ્રામહાવીર સ્વામીનું સ્તવન

રૂડી ને રહીયાલી રે, વીર ! તારી દેશના રે ।

એતો વલી જોજનમાં સંભળાય,

સમકિત-બીજ આરોપણ થાય-રૂડી૦ ॥૧॥

પટ મહિનાની રે ભૂખ તરસ શમે રે.

સાકર દ્રાક્ષ તે હારી જાય,

કુમતિ જનના મદ મોડાય-રૂડી૦ ॥૨॥

ચાર નિરોધે રે સાત નયે કરી રે,

માંહી લલી સખતભંગી વિખ્યાત

નિજ-નિજ ભાષાએ સહુ સમજાત-રૂડી૦ ॥૩॥

પ્રભુજીને ધ્યાતાં રે શિવ પદવી લહે રે.

આતમ-ઋદ્ધિનો ભોક્તા થાય,

જ્ઞાનમાં લોકાલોક સમાય-રૂડી૦ ॥૪॥

પ્રભુજી સરિખા હો ! દેશક કે નહિ રે.

એમ સહુ જિન-ઉત્તમ ગુણ ગાય.

પ્રભુ-પદ-પદ્મને નિત્ય નિત્ય ધ્યાય-રૂડી૦ ॥૫॥



(૧૪૦૮) (૫૭-અ) શ્રી સાધારણ જિન સ્તવન

ભવિ તમે વંદો રે, અરિહા દેવ જિણુંદા ।

ગુણ-ગણ કંદો રે, નમતાં જાએ ભવકુંદા ॥

જય પરમેશ્વર ! જગદાનંદન ! જય જગવલ્લભ ! નાથ ! ।

જય ત્રિભુવન જોકે મંગલરૂપી,

જય તું શિવપુર-સાથ !-ભવિં ॥૧॥

જય જોગીસર-સેવિત પદકજ !, જય ઇન્દ્રિય-ગજ-સિંહ ! ।

જય દુર્જય-નિર્જિત-કંદપ્પહ,

જય તું અ-કલ ! અ-ખીહ !-ભવિં ॥૨॥

જય ભવિ-કમલ-વિકાસન-દિનકર, જય સુરનર-નત પાથ ।

જય મનવંછિત-પૂરણ સુરગવી,

જય તું અ-મલ અ-માય-ભવિં ॥૩॥

જય પારંગત ! જય નિકલંકી !, જય સ્યાદ્રાદ-સ્વરૂપ ।

જય ગુણ-રહિત ! ગુણાકર ! સ્વામી,

જય અ-શરીર અ-રૂપ-ભવિં ॥૪॥

જય પરિપહ-ફાળે ઐરાવણ, જય અજરામર દેવ ।

જય ભવ-ભય-ભંજન ! અવિનાશી !,

જય સુરતરૂ-સમ-સેવ-ભવિં ॥૫॥

જય ગત-રાગ-દ્વેષ ગત-વેદ, જય ગત-રોગ ને શોગ ।

જય ગત-માન-મત્સર-રતિ-અરતિ,

જય ગત-લોગ-વિભોગ-ભવિં ॥૬॥

જય સર્વજ્ઞ તથા સર્વદર્શી, જય તું અરણ્ય અનંત ।

જય અ-પુર્નભવ જય જય નિરુપમ,

જય ભગવંત ભદંત-ભવિં ॥૭૭॥

જય તું અ-ચલ અનંત અખંડહ, જય અ-ક્ષય અવિકાર ।

જય નિજ-ગુણ-ભોગી ને અ-ભોગી,

જય તું માર્ગ-દાતાર. ભવિં ॥૮૦॥

જય જગખંધવ ! જય જગ રક્ષક !, જય નિરીહ ! નિસંગ ।

જય શાશ્વત-સુખ અ-વ્યાખાધહ,

જય નિજ-આતમરંગ-ભવિં ॥૮૩॥

જય પૂર્ણાનંદી ! પરમાત્મ !, જય ચિદ્-અમૃત ખાની ।

જય નિજ-ગુણ કર્તા તહ ભોક્તા,

જય તુજ અ-કહ કહાની-ભવિં ॥૧૦૧॥

જય ગુણ-અનંત અદ્ય મુજ ખુદ્ધિ,

જય જિનવર ! કેમ કહીએ !

ઉત્તમ ગુણ ભે પદ્મવિજય કહે,

પ્રગટે તો સાથ લહીએ-ભાવિં ॥૧૧૧॥



(૧૪૦૯) (૫૭-આ) સાધારણ જિન સ્તવન

મેરે સાહિબ તુમહી હો, જીવન-આધારા ।

પાર ન આવે સમરતાં, તુમ ઉપગારા-મેરેં ॥૧॥

ફર કરે દુઃખ વિશ્વકો, વરસતી જલધારા ।

તૈસે તુમ હમકું ભયે, સમકિત-દાતારા-મેરેં ॥૨॥

તુમ ગુણ-સાયરમેં ભજે, હમ ભાવ દ્યારા ।

અ-ખય અ-ખંડિત ગુણ ભયે, નહિ ભેદ-વિચારા-મેરેં ॥૩॥

હમ ગુણકું કંચન કરે, તુમ ગુણ રસ તારા ।

સો કયું તાંબા હોઈગા, ભયા કંચન સારા-મેરે ॥૪॥

તુમ અનંત કેતા કહું, તુમ ગુણ અનંત અપારા ।

જશ કહે સમરણ-ભજનથે, તુમ તારણહારા-મેરે ॥૫॥



(૧૪૧૦) (૫૭-૬) શ્રી સાધારણ જિન સ્તવન

(રાગ-માતાજી તુમ ધન ધન રે)

જિનરાજ નમો જિનરાજ નમો,

અહનિશ પ્રભુ ભાવે ચિત્ત રમી ।

હુઃખ-હોહમ દુરિત-મિથ્યાત ગમી,

ચઉગતિ ભવ-વનમાં જિમ ન ભમી-જિન૦ ॥૧॥

પ્રભુ પાસ-જિનેસર વંદો રે,

ભવ સંચિત દુરિત નિકંદો રે ।

પ્રભુ અનુભવ-જ્ઞાન-દિણ્દો રે,

સમતા વનિતા સવિ ઈંદો રે-જિન૦ ॥૨॥

પ્રભુ ! મેં કાળ અનંત ગમાયો રે,

તુમ દરિશન સાર ન પાયો રે ।

જો પાયો તો ન સુહાયો રે,

ત્રિકરણ-શુદ્ધે નવિ ધ્યાયો રે-જિન૦ ॥૩॥

મુજને મોહ-મહીશે રમાડયો રે.

ભવ-નાટકમાંહિ ભમાડયો રે ।

વલી કુ-શુર કુ-દેવે નમાડયો રે,

ચુંદી એળે અવતાર ગમાડયો રે-જિન૦ ॥૪॥

શુદ્ધ-બોધ-નૃપતિ-સુપ્રસાદે રે,

લલ્યું સમકિત પરમ-આદ્યદે રે ।

ટળ્યું પરમ મિથ્યાત અનાદિ રે

ગયો સહજ-સ્વભાવ સવાદિ રે-જિન૦ ॥૫॥

જળ આપે આપ વિચાર્યું રે,

તળ નિશ્ચય એહિજ ધાર્યું રે ।

ઉપગાર શુણે ન વિસાર્યો રે,

જળ વિષય-કષાય નિવાર્યો રે-જિન૦ ॥૬॥

એ મહિમા સર્વ તુમારો રે,

તુજ મુજ વચ્ચે અંતર વારો રે ।

જિમ સફળ હોવે અવતારો રે,

જ્ઞાનવિમલ શુણ દિલધારો રે-જિન૦ ॥૭॥



શ્રી વર્ધમાનસ્વામિને નમઃ
 પૂ. આ. શ્રી જ્ઞાનવિમલ કૃત
 સાધારણ જિનસ્તવન-ચોવીસી
 (૫૮)

(૧૪૧૧) સ્તવન-૧ (૫૮-૧)

(રાગ-રામગિરિ)

સકલ સમતા-સુરલતાનો, તુંહી અનોપમ કંદ રે ।
 તું કૃપારસ-કનક-કુંભો. તું જિણુંદ મુણીંદરે- ॥૧॥
 -તુંહી તુંહી તુંહી તુંહી ચુંહી કરતા ધ્યાન રે-
 તુજ સરૂપી થયા જેણે, લહું તાહરું ધ્યાન રે-તુંં ॥૨॥
 તુંહી અલગો ભવથકી પણ, ભવિક તાહરે નામ રે ।
 પાર ભવનો તેહ પામે, એહિ અચરજ ઠામ રે-તુંં ॥૩॥
 જનમ પાવન આજ મહારો, નિરખીઓ તુજ નૂર રે ।
 ભવોભવ અનુમોદના જે, થયો તુજ હજૂર રે-તુંં ॥૪॥
 એહ મારો અ-ક્ષય આતમ, અ-સંખ્યાત-પ્રદેશ રે ।
 તાહરા ગુણ છે અનંતા,
 કિમ કરું? તાસ નિર્દેશ રે-તુંં ॥૫॥
 એક એક પ્રદેશે તારા, ગુણ અનંત નિવાસ રે ।
 એમ કરી તુજ સહજ મિલતાં,
 હોય જ્ઞાન-પ્રકાશ રે-તુંં ॥૬॥

ધ્યાન ધ્યાતા ધ્યેય એકી-ભાવ હોયે એમ રે ।

એમ કરતાં સેવ્ય-સેવક-ભાવ પ્રગટે ક્ષેમ રે-તું ॥૭૭॥

એક સેવા તાહરી જો, હોય અચળ-સ્વભાવ રે ।

જ્ઞાનવિમલસૂરીંદ-પ્રભુતા,

હોય સુજસ-જમાવ રે-તું ॥૮૦॥



(૧૪૧૨) સ્તવન-૨ (૫૮-૨)

(રાગ-રમતાં રાસ વિલાસ રે ગોવાલીડા)

(મિચીલાનગરી સોહામણી મેરે લાલ-અ દેશી)

ભમતાં આ સંસાર રે-અરે પ્રાણીયડા ।

-દીઠો પ્રભુ દીદાર રે-મેરે લાલ ॥

ઉપશમ-રસ સુધાકુંડ છેરે-મેરે લાલ,

નયન-કમલ જસ જાણુ રે-અરે ! પ્રાણીયડા-દીઠો ॥૧॥

વદન-કમલ પશુ જેહતું રે-મેરે લાલ,

પ્રસન્ન સકલ શુભુ-ખાણુ રે-અરે ! પ્રાણીયડા-દીઠો ॥૨॥

જસ ઉછંગ ન કામિની રે-મેરે લાલ,

અંગ-અનંગ ન સંગ રે અરે ! પ્રાણીયડા !-દીઠો ॥૩॥

કર-યુગ ન ધરે શસ્ત્રનો રે-મેરે લાલ,

હિંસક-ભાવ-પ્રસંગ-અરે ! પ્રાણીયડા !-દીઠો ॥૪॥

પક્ષી-પશુ-પ્રમુખાસને રે-મેરે લાલ,

વાહન-સ્થિતિ ન વિશેષ રે-અરે ! પ્રાણીયડા !-દીઠો ॥૫॥

નેત્ર-વદ્ધત્ર-ગાત્રાદિકે રે-મેરે લાલ,

વિકૃત-વિકાર વરેષ રે-અરે ! પ્રાણીયડા !-દીઠો ॥૬॥

કોપ-પ્રસાદ ન દેખીયે રે-મેરે લાલ,
 નાંદિત નહિ અવદાત રે-અરે ! પ્રાણીયડા !-દીઠો ॥૭૧॥
 જ્ઞાનવિમલ-ચરિતે કરી રે-મેરે લાલ,
 દેવાધિદેવ વિખ્યાત રે-અરે ! પ્રાણીયડા !-દીઠો ॥૮૧॥



(૧૪૧૩) સ્તવન-૩ (૫૮-૩)

(રામ ધન્યાશ્રી તથા દેવગંધાર)

પ્રભુ ! તેરો મોહન હૈ મુખ મટકો,
 નિરખી નિરખી અતિ હરખિત હોવે,
 અનુભવ મેરે ઘટકો-પ્રભુ ॥૧॥

સહજ સુલગતા સમતા કેરી, એહી જ ચરણકો અટકો ।
 દરિસણુ જ્ઞાન અક્ષય ગુણુનિધિ તુમ,
 દિઓ પ્રેમે તસ ઠટકો-પ્રભુ ॥૨॥

શુદ્ધ સુવાસન ૧ સુરભિ-સમીરે, મિથ્યામત રજ ઝટકો ।
 દંભ-પ્રપંચ જોર જિમ ન હોય,
 રપટ ઝટકે મોહ-નટકો-પ્રભુ ॥૩॥

ધર્મ-સંન્યાસ-યાગ શિરપાગે, બંધન પણુ જય-પટકો ।
 દર્શનચક્રે કર્મ-નૃપતિશુ,
 કરત સદા ૪ રણુ-રટકો-પ્રભુ ॥૪॥

વીતરાગતા દિલમેં ઉલસત, નહીં અવર ખલ ખટકો ।
 પૂરવ સંચિત પાતક^૫-જાતક-અમથી દૂરે સટકો-પ્રભુ ॥૫॥

૧ સુગંધી પવનથી ૨ પદોં, ૩ દૂર થાય, ૪ લગાઇનો જેમ, ૫ સમૂહ,

જ્ઞાનવિમલ-પ્રભુ ધ્યાન પસાયે,

ભવે-ભવે ભવિ નવિ ભટકો ।

આઈ મિલે જ્યું એકી-ભાવે,

શિવ-સુંદરીકો ભટકો-પ્રભુ ॥૬॥



(૧૪૧૪) સ્તવન-૪ (૫૮-૪)

જિનરાજ ! હમારે દિલ વસ્યા,

કિમ વસ્યા ! કિમ વસ્યા ! કિમ વસ્યા-જિન ॥

જ્યું ધન મોર ચકોર કિશોરને,

ચંદ્રકલા જિમ મન વસ્યા-જિ ॥૧॥

વીતરાગ તુમ મુદ્રા આગે, અવર દેવ કહિયે કિસ્યા ? જિ ॥

રાગી દોષો કામી કોધી,

જે હોય તેઓની શી દશા ? જિન ॥૨॥

આધિ-વ્યાધિ ભવની ભ્રમણા,

અમથી તે સઘળા નસ્યા-જિન ॥

જેણે તુમ સેવ લહીને છોડી,

તેણે ૧ મધુમખ-પરે કર ઘસ્યા-જિન ॥૩॥

મોહાદિક ૨ અરિયણુ ગયા ફરે,

આપ-ભયથી તે ખસ્યા-જિન ॥

તાલી દઈ ૩ સયણુ સદાગમ,

-પ્રમુખા તે સવિ મન વસ્યા-જિન ॥૪॥

૧ મધમાખીની જેમ, ૨ દુશ્મન સમૂહ, ૩ કુટુંબી,

પ્રભુ ! તુમ શાસન આગે અવરના,

મત-ભાષિત ક્રીકા જિરયા-જિન૦ ।

આજ અમારે એહ શરીરે,

હરખ રોમાંચિત ઉલ્લસ્યા-જિન૦ ॥૫॥

મિથ્યામત ય ઉરગે બહુ પ્રાણી,

જે પહઠ-વિષ-ફરસે ડસ્યાં-જિન૦ ।

તે હવે જ્ઞાનવિમલ-પ્રભુ પામી,

સરસ સુધારસ મેં લસ્યાં-જિન૦ ॥૬॥



(૧૪૧૫) સ્તવન-૫ (૫૮-૫)

(રાગ-મેં થારો ચેલો મારા સાહિબ !

મેં થારો ચેલો-એ દેશી.)

કરમ ^૧કસાલામાંહિ, દિલ મેરો કિમહિ ન લીંજે ।

તુમે મારે મન આંચો રે-સાહિબા-મેરો ॥૧॥

આ ભવ પરભવ-માંહિ, દિલ મેરો તુંહિચું રીજે,

સેવક અપનો કરી ભાંચો રે-સાહિબા-મેરો ॥૨॥

ચરણ-કમલની છાંદો વસું, મુજ એહિજ સૂજે,

કર અછાની લાજ વહાચો રે-સાહિબા ॥૩॥

પ્રભુ ! તુમ ધ્યાન-સુધારસે, વિષયાનલ ન બૂજે,

દાસ-દોષ ન વાંચો રે-સાહિબા ॥૪॥

એહિ ત્રિભુવન માંહે, તુમ સમ કેઈ ન દીસે,

પાવન ખિરૂદ ધરાંચો રે-સાહિબા ॥૫॥

મહિમા રમોટમ એન શહીજે, નિજ-પર ન ગણીજે,

મુહ દેખી તિલક બનાવ્યો રે-સાહિબાં મેરોં ॥૬॥

જ્ઞાનવિમલ-પ્રભુ ગુણ, કેહિ ઉપસાય કરીજે,

ધમિ સહજે બાલ મનાવ્યો રે-સાહિબાં મેરોં ॥૭॥



(૧૪૧૬) સ્તવન-૬ (૫૮-૬)

(રાગ-ભીમ પલાસી)

તૃષ્ણા લાગે ન અંગે રે ।

પૂરણ આશ લઈઅખ મેરી, અનુભવ કેરે સંગે રે-તૃષ્ણાં ॥૧॥

રોમ રોમ ઉલ્લસત હૈ શિવ-સુખ,

લાગ્યો રંગ અ-ભંગે રે-તૃષ્ણાં ॥૨॥

સો તો નાહિ મિટાયો મેટે જ્યું,

પરવાલી નંગે રે-તૃષ્ણાં ॥૩॥

જ્ઞાનદશાથેં ક્રિયા નહી નિષ્ફલ,

જ્યું ધર રઆર્દ્ર ઉધનસંગે રે-તૃષ્ણાં ॥૪॥

મોહ-મિથ્યાત-ભરમ સવિ નિકસ્યો,

મન બાવે નો મંગે રે-તૃષ્ણાં ॥૫॥

રાગ-દ્વેષ અરિ દૂરે ઉડીયે,

જ્યું હુશમન ઘેરી ૪તુકંગે રે-તૃષ્ણાં ॥૬॥

જ્ઞાનવિમલ-પ્રભુ આતમ નિરમલ,

જેસે ગંગ-તરંગે રે-તૃષ્ણાં ॥૭॥



૨ મોટાઈની, ૩ બક્ષીશ કરો,

૧ પૃથ્વી, ૨ ભીની, ૩ મેઘ-વરસાદથી, ૪ વિશિષ્ટ ઘેરાવાથી,

(૧૪૧૭) સ્તવન-૭ (૫૮-૭)

(રાગ-વિહંગાડા.)

(અવધે આવજો રે નાથ-એ દેશી)

મનમાં આવજો રે નાથ !, હું થયો આજ અનાથ-મન૦ ॥
 જય જિનેશ ! નિરંજનો, ભંજનો ભવદુઃખરાશિ ।
 રંજનો સવિ ભવિ-ચિત્તનો રે,

૧મંજણો પાપનો ૨પાશ-મન૦ ॥૧॥

આદિ બ્રહ્મ અનુપમ તુંહી, અબ્રહ્મ કીધો દૂર ।
 ભવબ્રમ સવિ ભાંજી ગયો રે,

તુંહી ચિદાનંદ ઝસ-નૂર-મન૦ ॥૨॥

વીતરાગ-ભાવ ન આવહી, જિહાં લગી મુજને દેવ ।
 તિહાં લગે તુમ પદ-કમલની રે,

સેવની રહેલો એ દેવ-મન૦ ॥૩॥

યઘપિ તુમ હો ! અતુલ-બક્ષી, યશવાદ એમ કહેવાય ।
 પણ કબજે આવ્યા મુજ મને રે,

તો સહજથી કેમ જવાય-મન૦ ॥૪॥

મન મનાવ્યા વિણ માહરો, કેમ બંધથી છુટાય ? ।
 મન-વંછિત દેતાં થકાં રે,

પાસવડો ન ઝલાય-મન૦ ॥ ૫ ॥

હઠ બાલકનો હેય આકરો, તે રહે છે જિનરાજ ! ।
 ઝાઝું કહાંચે શું હોવે રે !,

ગિરૂઆ ગરીબ-નિવાજ-મન૦ ॥૬॥

૧ તોડી ભાગનાર, ૨ જળ, ૩ તેજસ્વી.

જ્ઞાનવિમલ-શુભ્રથી લહે, સવિ ભવિ મનના ભાવ ।

તો અક્ષય-સુખ લીલા દિયો રે,

જિમ હોવે મુજશ-જમાવ-મન૦ ॥૭૧॥



(૧૪૧૮) સ્તવન-૮ (૫૮-૮)

નિસ્નેહીશું નેહલો,

કાંઈ કીધો કેણી પેરે જાય-હે ! મિત્ત ! ।

એક-પખો એમ કીજતે,

કાંઈ ! જનમાં હાંસો થાય-હે ! ચિત્ત !

કાંઈ જાણું કયું બની આવહી ?

કાંઈ ! ત્રિભુવન-જનનો નાથ-હે ચિત્ત ! ।

-કાંઈ મુગતિપુરીનો સાથ ! હે ! મિત્ત-કાંઈ૦ ॥૧॥

લૌકિક શુભ્ર-ગણ જો હોવે,

તો રસનાએ કહ્યા જાય-હે ! ચિત્ત ! ।

પણ લોકોત્તર-શુભ્રવંત છે,

કિમ તે વર્ણન થાય ? હો ! મિત્ત-કાંઈ૦ ॥૨॥

તરીયે લઘુનદી બાંધશું,

કાંઈ સ્વયંભૂરમણ ન તરાય હે ! ચિત્ત ! ।

લઘુ નંગ હોય તો તોળીએ,

કાંઈ મેરૂ તોલ્યો ન જાય-હે ! મિત્ત ! કાંઈ૦ ॥૩॥

યદપિ સુરની સાનિધ્યે,

કાંઈ તે પણ સોહિલું થાય-હે ! ચિત્ત ! ।

પણ પ્રભુ શુભ્ર અનંત-અનંત છે,

કાંઈ તે કિમ બોલ્યા જાય ? હે ! મિત્ત ! કાંઈ૦ ॥૪॥

જ્ઞાન-કળા તેહવી નહિં,

કાંઈ સંયમ શુદ્ધ ન થાય-હે ! ચિત્ત ! ।

સંઘયણાદિક-દોષનો,

કાંઈ અંતર બહુ એમ થાય-હે ! મિત્ત ! કાંઈં ॥૫॥

પણ તુજ લક્ષિત રીઝશે,

કાંઈ મુક્તિ ખેંચીને તેણ-હે ! ચિત્ત ! ।

ચમક-ઉપલ જિમ લોહને,

કાંઈ કુમુદને ચંદ મહેણ-હો ! ચિત્ત ! કાંઈં ॥૬॥

એવું જાણી શરણે આવેલાને,

નેક-નજરશું નિરખતાં કાંઈ તુમને લાગે દામ-હે ! ચિત્ત ! ।

જ્ઞાનવિમલ ચડતી કળા,

કાંઈ વાધે જગે જશ મામ હે ! મિત્ત ! કાંઈં ॥૭॥



(૧૪૧૯) સ્તવન-૯ (૫૮-૯)

લોર લયો લયો લયો જાગી રે,

ઉઠી જિનરાજ કે ધ્યાને લય લાગી રે લોર૦ ॥૧॥

મોહકી નિંદમે સોયો બહુ કાલ રે,

દુલ્લહ નર-જનમ પાઈ ખોયો તે' ૧ આલરે-લોર૦ ॥૨॥

જો તું ખૂદો થયો તોહી પણ ખાલ રે,

૨ અજહુ ન હુ પાઈઓ વિરતીનો ૩ ઢાલ રે-લોર૦ ॥૩॥

૪ જીઆ ! તું જાતિ-કુલ અપની સંભાલ રે.

નરક-નિગોદમે' કેઈ વહ્યો કાલ રે-લોર૦ ॥૪॥

૧ મોટો, ૨ હજી સુધી, ૩ અબ્યાસ, ૪ હે જીવ !

અંજલિ-જલ પરે આયુ વિસરાલ રે,

તો ૫ આજહી બાંધે પ્રથમ ૬ સર પાલ રે-ભોર૦ ॥૫૫॥

આણુ જિનદેવકી જો ધરે ભાલ રે,

શુદ્ધ સમકિત લહે તો હોઈ ૭ નિહાલ રે-ભોર ॥૬૫॥

કહતે નય નેહશું ધર્મ ધુરિ ઢાલ રે,

જ્યું લહે સકલ સુખમંગલ માલરે-ભોર૦ ॥૭૫॥



(૧૪૨૦) રતવન-૧૦ (૫૮-૧૦)

જિન રાજે રે જિન રાજે રે, ત્રિભુવન-ઠકુરાઈ છાજે રે ।

વર હુંહલિ ૧ શુદ્ધિરી વાજે રે,

તસ નાદે ૨ અંબર ગાજે રે-જિન૦ ॥૧૫॥

તિહાં જાતિ-વૈર સવિ ભાંજે, પરમત મદમાની લાજે રે ।

પ્રભુ ત્રિગટે બેઠા સોડે રે,

ભાવ જનના મનઠાં મોડે રે-જિન૦ ॥૨૫॥

જિન ! તોરા નયનતણી બલિહારી રે,

તોરે મુખડે ચંદ્ર ઓવારી રે ।

જિન ! તોરી સરસ સુધારસ વાણી રે,

મુજ લાગે અમિય-સમાણી રે-જિન૦ ॥૩૫॥

હુઃખ-તિલ પીલણુને ઘાણી રે, જે ભવિકે મનમાં આણી રે ।

એ તો સમકિતની ૩ સહિનાણી રે.

આગમને પાઠે બંધાણી રે-જિન૦ ॥૪૫॥

૫ જલદી ૬ સરોવર=તળાવની પાળ ૭ કૃતકૃત્ય,

૧ ગંભીર, ૨ આકાશ, ૩ નિશાની,

લામંડલ યજ્ઞાઉ સવાઈ રે, પ્રભુ-પુઠે રહ્યું લય લાઈ રે ।

સુર-કૃત પસુમ-વૃષ્ટિ ઉવાઈ રે,

પ્રાતિહારજ શોભા બનાઈ રે-જિન૦ ॥૫॥

મુજ નેક-નજરશું નિહાળો રે,

મિથ્યામત-વાસના ટાળો રે-જિન૦ ॥૬॥

સમકિત સુખલડી હીજે રે, એ તો કોઠિ પસાય કરીજે રે ।

જેમ સહજ-શક્તિ મુજ હીપે રે,

તો આપ-બલે અરિ જીપે રે-જિન૦ ॥૭॥

મહારા કરમ-મરમ સવિ જાયે રે,

તુજ નામતણે સુપસાયે રે ।

તો જો જ્ઞાનવિમલ-ગુણ વાધે રે,

આતમ-પરમારથ સાધે રે-જિન૦ ॥૮॥

(૧૪૨૧) સ્તવન-૧૧ (૫૮-૧૧)

(રાગ-કાફી)

(આઘા આમ પધારો પૂજ્ય અમ ઘેર વહોરણ વેલા-એ
દેશી,)

મેરા સાહિબ સુગુણ સૌભાગી, સમતાકે ઘરે આયા ।

રંગ વિબેકી સુજ્ઞાનતણે ગુણ, લાલ જલેચા લાયા-

^૧દુરમતિ દૂર ખડી રે, મમતા દૂર પડી રે ॥૧॥

જળ સમતાકા ગુણ ન હુ જાણ્યા, તખ તું લાગત નીકી ।

પ્રીતિ જડી જળ સુંદર રસેતી

અખ તું લાગત ફીકી-દુર૦ ॥૨॥

કોઈક સહશુરૂ એસા મિલીયા, સમતાકા સહકારી ।

અર્મદોષ તુમચા સબ પાયા,

તબ સંગતિ દૂરે નિવારી-દુરં ॥૩॥

નાહી-ધોઈ ગાત્ર સમારી, પરશુ^૧ રમલિ કરંતી

તનક તનક પર-સંપદકી,

મનમાં આશા ધરંતી-દુરં ॥૪॥

તૃષ્ણા-ઠાસી દુષ્ટ દોભાગિણી, તે પશુ તેરી સંગે ।

દ્વેષ દુષ્ટ-સુત લારે ન છંડે,

જડ-જનકે પરસંગે-દુરં ॥૫॥

સુમતિ સાહેલી સહેજ સોભાગીણી, સા રાગિણી સમતાકી ।

કારભાર તિનકે શિર હીના,

કુમતિ રહી તબ થાકી-દુરં ॥૬॥

સુશુષ્ણ સપૂત વિવેક કલા-નિધિ, તાત ગોહમે^૨ ખેલે ।

અનુભવ છત્ર ધર્યો શિર ઉપર,

પરતિ-આતપ ઠેલે-દુરં ॥૭॥

એમ આતમ પ્રીતમ રસરંગે, લીણો સમતા સાથે ।

નવલ-નેહ કાંઈ એસો પ્રગટયો,

અ-વિચલ-પદ લહે માથે-દુરં ॥૮॥

પરમાનન્દ-વિલાસી આતમ, નાથ નામ શુષ્ણ પાયા ।

જ્ઞાનવિમલ-પ્રભુ અ-વિચલ લીલા,

સુજસ-શુષ્ણ તવ આયા-દુરં ॥૯॥



૩ શયુગારી, ૪ પોછા, ૫ આર્તધ્યાન રૂપ, ૬ તડકો-ગર્ભી,

(૧૪૨૨) સ્તવન-૧૨ (૫૮-૧૨)

(રાગ-ધનાશ્રી)

આજ સફલ દિન મુજ તણે એ,

દીઠા શ્રી ભગવંત, અનંત-ગુણકર એ ॥૧॥

હરખે નયન-ચકોરકા એ,

નિરખી પ્રભુ-મુખચંદ, કલાગુણ-પરિવયુ એ ॥૨॥

દીઠા દેવ ઘણા ઘણા એ,

પણ તે નાવે ચિત્ત તો, પ્રીતિ કિહાં બને ? એ ॥૩॥

જે હીરાને સહી પારખે એ,

તે કિમ કાચે સાચ-ધરીને સંગ્રહે એ ॥૪॥

તુજ મુખ-મુદ્રા ભાવતા એ,

વિચરંતા જિનરાજ-પરે તે સાંભરે એ ॥૫॥

જિણ પર દેશના દેયતા એ,

સમરૂં મનમાં તેહ-પ્રભો ! તુમ્હ દરિશને એ ॥૬॥

તુમ્હ દરિસણુ વિણ હું ભમ્યો એ,

કાલ અનંત અનંત-કૃપા હવે કીલ્યો એ ॥૭॥

તુમ્હ દરિસણુથી ઉજલું એ,

સમકિત વિધાવીશ-લહું મેં કલિયુગે એ ॥૮॥

સતયુગથી કલિયુગ ભલો એ,

લહું સમકિત મંડાણુ, જિહાં તું જોલખ્યો એ ॥૯॥

મેરૂ થકી મરૂધર ભલો એ,

જિહાં સુરતરૂની છાંય, લહીજે સુખકર એ ॥૧૦॥

સકળ પદારથ પામીયા એ,

ઘીઠે તુમ્હે ઘીદાર, ^૧જીલામલ જ્યોતિમાં એ ॥૧૧૧॥
જ્ઞાનવિમલ-પ્રભુ સેવતાં એ,
અ-વિચલ-સુખ નિતુ હોય, કરો નિત્ય વંદના એ ॥૧૨૦॥



(૧૪૨૩) સ્તવન-૧૩ (૫૮-૧૩)

(રાગ-દેશી સિપાઈડાની.)

અરજ સુણો જિનરાજ !

મેરે દિલ આય વસો-માહુરી અરજ ॥૧॥

સકલ સુરાસુર-નર-વિધાધર,

આય ખડે તુમ પાય-મેરે દિલ ॥૧૧॥

ઠાસ સલાવ કરી જો દેખો,

તો લવ-ભવનાં દુઃખ જાય-મેરે ॥૨૧॥

ઘીન-ઉદ્ધાર-ધુરંધર તુમ સમ,

અવર ન કો કહેવાય-મેરે ॥૩૧॥

મુઝ સમ કરૂણા-ઠામ ન કોઈ,

રથે ન કરો ? સુપસાય-મેરે ॥૪૧॥

દેતાં દામ ન બેસે કાંઈ,

^૧ઉણીમ કાંઈ ન થાય-મેરે ॥૫૧॥

જે જેહના તે તેહના આખર,

જિહાં તિહાં ચિત્ત ન બંધાય-મેરે ॥૬૧॥

પણ કાચે એક સાચે બોલે,

સુણી મનમાં સુખ થાય-મેરેં ॥૭૭॥

આહરે છે તે પ્રગટ કરતાં,

પ્રભુ! તુજ નામ સુહાય-મેરેં ॥૮૦॥

જ્ઞાનવિમલ-પ્રભુશ્યુ' ધમ વિનતિ,

કરતાં પાપ પલાય-મેરેં ॥૮૧॥

અનુભવ-લીલા-સુંદરી સહેજે,

રધાઈ મિલે ગલે આય-મેરેં ॥૯૦॥



(૧૪૨૪) સ્તવન-૧૪ (૫૮-૧૪)

(રાગ કાફી-કનડી.)

અગતિકે મારગ મસ્ત હૈ! સુણો જ્ઞાની લોકો!-અગતિં

પરમ-પુરૂષકી ભક્તિ હૈ-સુણો! અગતિં ॥૧॥

સકલ સુરાસુર-નર-વિદ્યાધર,

પ્રભુ અરણ્ય-કમલે આશકત હૈ-સુણો! અગતિં ॥૨॥

તુમ આણા-ફલ પ્રાપતિ રાખે,

કાલ અનાદિ ગુદસ્ત હૈ-સુણો! અગતિં ॥૩॥

પરમ-ધરમપદ અરમ-ધરણ્ય-ગુણ,

કારણ એહી પ્રશસ્ત હૈ-સુણો! અગતિં ॥૪॥

દ્રવ્ય-ભાવશ્યુ' બહુવિધ ભેદે,

ભરમ નિઃકાશન ભક્ત હૈ-સુણો! અગતિં ॥૫॥

૨ દોડોને,

વચન-અગોચર ચરિત પવિત્ર ગુણ,
 તુમચી અનંતી શક્તિ હૈ-સુણોં મુગતિં ॥૬૧॥
 તુમ સેવા-મેવા-રસ પીવત,
 મેરો ૧મન-અલિ મસ્ત હૈ-સુણોં મુગતિં ॥૬૨॥
 જ્ઞાનવિમલ-પ્રભુ-નામનું ચિંતન,
 એહી પરમ-નિધિ વસ્તુ હૈ-સુણોં મુગતિં ॥૬૩॥



(૧૪૨૫) સ્તવન-૧૫ (૫૮-૧૫)

સમવસરણ સુખ દેત હૈ, સુણો ભવિકા-લોકો !-સમં
 સુકૃત-સુ-ખીજકો ખેત હૈ, સુજ્ઞાની-લોકો ! સમં ।
 પ્રભુમત સુર-નર-સુકૃત-રતનરૂચિ,
 ભાસિત ! ભુવન-ઉદ્યોત હૈ-સુજ્ઞાનીં ॥૧૧॥
 સમવસરણે નિરખી નવિ હરખે,
 ભાવ થકી અ-૧ચેત હૈ-સુજ્ઞાનીં ॥૧૨॥
 રશિવ-સુખ કમલાહર-મેલાવણ,
 એહી સાચો સંકેત હૈ-સુજ્ઞાનીં ॥૧૩॥
 જગ-જીવન જગ-નાયક બેડત,
 પરખદા બાર સમેત હૈ-સુજ્ઞાનીં ॥૧૪॥
 અમૃત-અંજનપરે જ્યોતિ-પ્રકાશક,
 ૩સુદેશ સુરાગ-જન-નેત હૈ-સુજ્ઞાનીં ॥૧૫॥

૧ મનરૂપ, બ્રમર,

૧ ચેતના વગરનો=જડ, ૨ મોક્ષ-સુખરૂપી લક્ષ્મીના ધર=સ્થાનને
 મેળવવા, ૩ સમ્યગ્દષ્ટિવાળા સારા રાગવાળા જનોના નાયક,

મણિમય કંચન-રજત-વિરાજિત,

કાંતિ યત્રિગદ-મદ-સેત હૈ-સુજ્ઞાની૦ ॥૬॥

શ્રી જ્ઞાનવિમલ-શુભ રતન-મહોદધિ,

ઉદ્ભવત બહુ બહુ હેત હે-સુજ્ઞાની૦ ॥૭॥



(૧૪૨૬) સ્તવન-૧૬ (૫૮-૧૬)

(સામીડા ! મુજને શત્રુજે લઇ ચાલ-એ દેશી)

પ્રભુજી ! મુજને ચિત્તમાંડી અવધાર રે-પ્રભુજી૦ ।

હાં ! હાં ! રે ! સાહિબજી ! મુજને ચિત્તમાંડી અવધાર ॥

વિલંબ કિસ્સો છે ? અનંત-શક્તિને,

ખાંદા ગ્રહી મુજને તાર રે-સાહિબ૦ ॥૧॥

એ નિરહંભી દાસ છે રે આપણો,

સયંમુખે એમ કહી ભાખે રે ।

માહરે રે એક તુંડી, પણ તુજને,

મુજ સરિખા કેઈ લાખ રે-સાહિબ૦ ॥૨॥

પ્રભુ-દરિસણુ-અનુભવ-અમૃત-રસ,

આતમ અહનિશ ચાખી રે ।

એહ મધુર આગે અધિક ન કાંઈ,

દ્રાખ ૧સરાખ સુધા સાખી રે-સાહિબ૦ ॥૩॥

કઠિન કર્મના મર્મથી તાર્યા, સહેજે સુશુષ્ક નર-નારી રે ।

અમ-સરીખા, કહો કેમ વિસાર્યા ?

કીધા ન ભવને પાર રે-સાહિબ૦ ॥૪॥

મહેર ન કરતે મૈત્રી ન રહે, નહિ અનાલોગ આચાર રે ।
દોષ અમારા ચિત્ત વિસાર્યા,

તુમે તો નિ-કારણ ઉપકારી રે-સાહિબ૦ ॥૫॥
ત્રિ-કરણ-યોગે ત્રિ-ગુણ-અ-લેહે. તુમ આણુ જિહાં હોય રે ।
જ્ઞાનવિમલ-ગુણ ઉદય અહોનિશ,

અંતરભાવ ન કોય રે-સાહિબ૦ ॥૬॥



(૧૪૨૭) સ્તવન-૧૭ (૫૮-૧૭)

(રાગ સામેરી)

લીના રે મન દુંદુભિ ૧ હરિ કે ।

દુંદુભિકો ૨ ધુનિ સુણી પાવન ભયે,

મોહ-મિથ્યાત સખ, હરિ કે-લીના૦ ॥૧॥

ચિંહુ દિશિ ચાર ઉદાર સોહાવત,

સહસ યોજનકો-ધ્વજ સોહાકર કે-લીના૦ ॥૨॥

૩ સાલ વિશાલ રજત કંચન મણિ,

વિવિધ રતન કે-સાજસેં ધર કે-લીના૦ ॥૩॥

જિનકી મૂરતિ સૂરતિ પેખી,

આધિ-વ્યાધિ અરિ અંતર ધર કે-લીના૦ ॥૪॥

જિનકી દેશની સરસ સુહાવત,

માનું ૪ સૂધી અમૃત રસ ૫ તર કે-લીના૦ ॥૫॥

ભુવન-તિલક-સમ જન તે હોવત,

જ્ઞાનવિમલ-પ્રભુ આણુ શિર ધર કે-લીના૦ ॥૬॥



૧ દેવની, ૨ અવાજ, ૩ ગદ, ૪ નિર્મળ, ૫ ફળ

(૧૪૨૮) સ્તવન-૧૮ (૫૮-૧૮)

(રાગ ધન્યાશ્રી)

પ્રભુકી ભક્તિ વિના ના કછુ ।-પ્રભુકીં

પુરુષાતનકે એહી પરમારથ,

પ્રભુકી આણુમે' રહણા-ના કછુ ॥૧॥

વીતરાગ-ભાવે હોવે શિવ-ગતિ, વીતરાગ મન કરના ।

આગમ-વેદ-પુરાણ-કુરાનમે',

એહીજ વચણુ વિના-ના કછુ ॥૨॥

જુઠે તન-ધન સયણુ કે કારણુ, કરે પ્રપંચ ઘણા ।

અંતે શરણુ ન આવત કેઈ,

પ્રભુકી આણુ વિના-ના કછુ ॥ ૩ ॥

મેરી ગતિ મતિ સ્થિતિ પરતીતે, યાહી એક-મના ।

પાપ-પડલ-વાદલ હોયે દરે,

પાવન કરે જ્યું ઘના-ના કછુ ॥૪॥

૧ સત્યકી ૨ ભંલસાર નરપતિ જ્યું, કરત ૩ દેવકીનંદના ।

દેવપાલ-પ્રમુખા લહે તીર્થ-કર,

પદ તુમ સ્તવના-ના કછુ ॥૫॥

જ્ઞાનવિમલ-પ્રભુકી સેવાથી, હોવત યું સુમના ।

ભાવથી તદ્રુપે હોવત,

તો ઈહાં કહા કહના ?-ના કછુ ॥૬॥



૧ પેદાશના પુત્ર-વિદ્યાધર અવિરતિ, શ્રાવક ૨ શ્રેણિક મહારાજ,

૩ કૃષ્ણ

(૧૪૨૯) સ્તવન-૧૯ (૫૮-૧૯)

(રાગ સારંગ)

હમ લીનેં હે પ્રભુ ધ્યાનમેં,

કરમ-ભરમ-જંજીરસે છુટે, હોઇ રહેં એક તાનમેં,

હમં ॥૧॥

રોમ રોમ પરમાનંદ ઉલસત. હોત મગનતા જ્ઞાનમેં ।

સવિ સ-ભાવમેં તુંહી તુંહી,

ઝોર ન આવત માનસેં-હમં ॥૨॥

જ્યું તરવારે અરિ દૂર નિકંદે, અલગ રહી હે મ્યાનસે ।

આતમ-શક્તિ ભગતિ જ્યું તેસી,

હોવે પુરૂષોત્ત-ઠાનસેં-હમં ॥૩॥

અહનિશ મૈત્રીભાવ ઉદાસોત, ત્રિભુવન અભયા-દાનસે ।

અજબ કલા કોઇ એસી તુલ્યી,

નિશ્ચિત નય પરધાનસે-હમં ॥૪॥

જ્ઞાનવિમલ-પ્રભુતા ગુણુ તેરો, પસર્યો 'આનપ્રાનસેં' ।

સહજ સદાગમ-બોધ સુલભતા,

દેઇ સફલ કરો દાનસેં-હમં ॥૫॥



૧ શ્વાસોચ્છવાસથી,

(૧૪૩૦) સ્તવન-૨૦ (૫૮-૨૦)

(રાગ શ્રીરાગ)

અખ મેરો નરભવ સફલ ભયો ।

દરિસન દેખત શ્રી જિનવરકો,

દુઃખ-દુરમતિ સવિ દૂર ગએ-અખ૦ ॥૧॥

પૂરવ-સંચિત પુણ્ય-પ્રકૃતિભર, પરમાનંદ-ગુણ પ્રગટ થયે ।

પારંગત પરમેશ્વર પેખત,

અનુભવ શુભશ્રિ મહાઉદયે-અખ૦ ॥૨॥

તુંડી અ-વરણી બહુવિધ-વરણી, ધ્યાવત ધ્યાન વિધાનકીએ ।

નિર્ગુણપણે નિજ ત્રિગુણ-વિભાસિત,

સંત હૃદયકુરિત-પરિમલએ-અખ૦ ॥૩॥

આપ અ-કામી કામિત-પૂરણ, આપ અમલ-અ-ખએ ।

જ્ઞાનવિમલ-પ્રભુ-પદની સેવા,

સરસ સુધારસ અધિક થએ-અખ૦ ॥૪॥



(૧૪૩૧) સ્તવન-૨૧ (૫૪-૨૧)

(રાગ વસંત)

ધન આ વેળા રે ધન આ વેળા રે, છાંદા દીઠા ભગવંત ।

મીઠા સરસ સુધારસથી પણ,

વાહાલા અધિક અત્યંત-ધન૦ ॥૧॥

આવ્યા મનમાંહિ ઘણું ભાવ્યા, ગઈ મિથ્યા મતિ બ્રાંતિ

૧ભાયગ-ભોગે શુભ-સંકલ્પે, આય મિથ્યા એકંત-ધન૦ ॥૨॥

૧ ભાગ્ય યોગે,

ભાવ મનોગત જાણ બિરુદને રથું કહેવું ? મતિવંત ।
મિલન અ-લેહપણે થિરતાએ,

એ પૂરે મન-રખંત-ધન૦ ॥૩૩॥

તે સાહિબની શોભા ન કહીએ, સેવક ડખારિ ધરગંત ।

ભવ-થિતિ-પ્રમુખ અ-જર બહુ યદ્યપિ,

ખસ-જન દેખી હસંત-ધન૦ ॥૩૪॥

શિવસુખદાયક નાયક તુંહી, એહીજ માહરે તંત ।

જ્ઞાનવિમલ-પ્રભુ નામ અમારે,

એહી જ મોટી મંત-ધન૦ ॥ ૫ ॥



(૧૪૩૨) સ્તવન-૨૨ (૫૮-૨૨)

જેયો રે ભાઈ ! કર્મનો જોરો,

કિમ જિનને જઈ મિલીએ ?

અમે અ-જાણ અનાદિ-સંસારમાં,

કહો ! કિમ દુઃખથી ટળીએ ?-જેયો ॥૧॥

આપણડું ધન સવિ વશ કીધું, મોહ-મહીપતિ વળીએ ।

પર-આશાનો ? અ-થાહ નદીમાં,

વિષય-પંકે કલીએ-જેયો ॥૨॥

એહ અસાર-કંતારે, ચઉ-ગતિમાં રહફલીએ ।

૨ કર્મ-કંસ-જોરો તો ભાગે,

જો ડજિન-પુરૂષોત્તમને ભળીએ-જેયો ॥૩॥

૨ ઈચ્છા, ૩ બારણે ૪ આજીજી કરતાં,

૫ બિંડી ૨ કર્મરૂપ કંસનું જોર, ૩ શ્રીકૃષ્ણ,

તો પ્રવચન-ગો-રસની રચના, કરતાં કિમહી ન ખળીએ ।
મિથ્યામત-દંભાદિક અંતર,

દૈત્ય-થકી નવિ છળીએ-જેથો ॥૪૪॥

જ્ઞાનવિમલ-પ્રભુ-સંગતિ કરતે, કેવલ-કમલા મિલીએ ।

આપ-સમાન કરે એ સાહિબ,

જે હેજસ્યું હળીએ-જેથો ॥૪૫॥



(૧૪૩૩) સ્તવન-૨૩ (૫૮-૨૩)

(રાગ કડખો)

સકલ જિનરાજ ૧ દિનરાજ પરે દીપતા,

મોહ-મિથ્યાતમ તિમિર ટાળે ।

નામ ને થાપના દ્રવ્યભાવે કરી,

ત્રિ-જગ-જનતા તણા સહજ પાળે-

ધ્યાન-અનુભાવથી પાપ ટાળે-સકલ ॥૧૧॥

પંચ-કલ્યાણકે પરમ ઉપગારીયા,

તારિયા કેઈ ભવિ-ભવ-કોડી ।

કરણના દમનથી ચરણ-ગુણ-ધરણથી,

તરણનું હેતુ તુમ્હ ભક્તિ હોડી-

-દેવ કોઈ અવર નવિ તુજ જોડી-સકલ ॥૧૨॥

તાયી અનુયાયી નહી કેહને સૂત્ર કહે,

તું અ-માયો અ-કષાયો ભાઈ ! ।

પાઈ અદ્ભુત કલા કૌઈ લોચુતરા,

ચરિત વિ-સદશપણે ધિર વડાઈ-સકલં ॥૩૥

દર્શન-જ્ઞાન-ચારિત્ર-આવરણથી,

એક માંહે એક નહીં ભેદ ભાવે ।

ધ્યાનકે ભેદ તે દ્રવ્યથી દેખીયે, ઐક્યતારૂપ ગતરૂપ ભાવે-

પ્રવૃત્તિથી નિવૃત્તિ તો ધર્મ પાવે-સકલં ॥૪૥

જે મહાદેવ પરબ્રહ્મ વર શંકરો, જેહુ પુરૂષોત્તમો વિશ્વરૂપી ।

એહુ પર્યાયથી નામ પરધ્યાનના,

ધ્યેય ગુણ-ગેય મહિમા-અરૂપી-સકલં ॥૫૥

તીર્થ'કર વીર્ય'ધર ધૌર્ય'ધર જગત જન,

તારવા વાસના-મૂલ હેતે ।

અપરથી તેહ ગુણ લિન્ન તો દેખીયે,

સ્વ-પર-મત-વચણ મધ્યસ્થ ચેતે-સકલં ॥૬૥

પરમ-મંગલતણું મૂલ એ હેતુ છે,

જ્ઞાનવિમલાદિ ગુણ સહજ-ભાવે ।

ધર્મભાવે કરી ધર્મ આરાધતાં,

પરમ આણુંદમય અખય થાવે ।

હુબ્હુશ્મન સવિ હરિ જાવે,

જીત નિશાણુ જગમાં વળાવે-સકળં ॥૭૥



(૧૪૩૪) સ્તવન-૨૪ (૫૮-૨૪)

(રાગ-કલ્યાણ)

(ગાગરે કેસેં તરૂં રે કાનુડા તારી ગાગરે કેસેં તરૂં રે;
 યમુનાજીકો ઘાટ દોહલડો, ધીરે ધીરે પાઉં ધરૂં રે-એ દેશી)
 વિનતી કેસેં કરૂં રે સાંઈ! મોરા! વિનતી કેસેં કરૂં રે ।
 ભકિતકો મામ્ છે દોહલડો,

કિમ મન ઠોર ધરૂં રે-સાંઈ ॥૧॥

કાલ-અનાદિ વહ્યો મેં રે,

તુમ વિષ્ણુ ભવ-વન માંહે કરૂં રે-સાંઈ ॥૨॥

અબ તો ત્રિભુવન-નાયક પેખ્યો,

હરણે પાય પરૂં રે-સાંઈ ॥૩॥

કુંકરી નાપો તેહનું બતાવો,

અવળો અહીં અગરૂં રે-સાંઈ ॥૪॥

દરિસન પીઠ હૈ ચરન ભુવનકો,

પરિચય તાસ કરૂં રે-સાંઈ ॥૫॥

જ્ઞાનવિમલ-શુભ્ય ગણે મોતનકો,

કંઠશેં હાર કરૂં રે-સાંઈ ॥૬॥

તેણસેં અનુભવ ચરણ-વહાણસેં,

ભવ-જલ નિધિ તરૂં રે-સાંઈ ॥૭॥



શ્રીવર્ધ્માન-સ્વામિને નમઃ

૫. શ્રી જ્ઞાનવિમલ કૃત

જિન-સ્તવન ચોવિધી

(૫૯)

(૧૪૩૫) સ્તવન-૧ (૫૯-૧)

(રાગ-મુખને મટકલડે-એ દેશી)

સુંદર મૂરતિ તેરીલ-ભાઉં બલિહારીલ,
નિરખી હરખિત દગ મેરીલ, છે તે જયકારીલ
ઉલ્લસત અતિ છાતીયાં મેરીલ-

૧તાથેં-હર ગર્ધ ભવફેરીલ-છેં ॥૧॥

આણા નતી કાંઈ હેરીલ-ભાઉં.

તવ નિરખી નિવૃત્તિ સેરીલ-છેં ।

આશ સવિ મેરીલ-ભાઉં.

વાગી મંગલ લેરીલ-છેં ॥ ૨ ॥

અઘ્યાતમની ઠકુરાઈલ-ભાઉં ધર્મ ચોક ચતુરાઈલ-રેં ।

આપ-ગુણે પ્રભુતાઈલ-ભાઉં.

તુમે પામી એહ વડાઈલ-છેં ॥૩॥

હૃદય સદય-સુખદાયીલ-ભાઉં જગે કરૂણા સખાઈલ-છેં ।

જસ નયને હ્યારસ ભારીલ-ભાઉં.

જગજંતુને જે ઉપગારીલ-છેં ॥૪॥

૧ તેથી,

મુજ અંતરજામી સ્વામીજી-જાઉં.

તસ ચરણ નમું શિર નામીજી-છેં ॥૫૫॥



(૧૪૩૬) સ્તવન-૨ (૫૯-૨)

(રાગ-કનક-કમલ પગલાં ઠવે એ-એ દેશી)

શ્રી જિનવરને વંદના એ; કરતાં લાલ અનંત તો-

સ્વામી સોહામણ એ ।

ભવ-ભયનાં દુઃખ ભાંજવા એ

સમરથ તુમે શુણ્વંતતો-સ્વામીં ॥૧૧॥

તારક તુમ સમ કોઈ ન દીઠો ભૂતલે એ ॥

તુમે ઉપગાર ઘણા કર્યા એ, કહેતાં નાવે પાર તો-સ્વામીં ।

આ સંસાર બિહામણે એ,

ઉતારો તસ પાર તો-સ્વામીં ॥૧૨॥

જાણુ કને શું? યાચીએ એ,

જે જાણે વિણુ કહે વાત તો-સ્વામીં ।

પણુ એમ કહે માગ્યા વિના એ,

નવિ પીરસે નિજ માત તો-સ્વામીં ॥૧૩॥

તે માટે હું ત્રિનવું એ, આપો તુમ પદ-સેવતો-સ્વામીં ।

દીલ કિશી કરો? એવડી એ,

ઠાયક છો સ્વયમેવ તો-સ્વામીં ॥૧૪॥

જ્ઞાનવિમલ સુખ-સંપદા એ,

શુભ-અનુબંધી જાણુ તો-સ્વામીં ।

અધિક હુવે હવે આજથી એ,

પ્રભુ ! તુમ વચન પ્રમાણુ તો-સ્વામીં ॥૫૫॥

(૧૪૩૭) સ્તવન-૩ (૫૯-૩)

(ઓન્છવ રંગ વધામણાં...એ દેશી)

પ્રભુ ! માહરો વાંક કિસ્યો રે ? શીખામણુ દીજે ।

૧ ખલકમૂલ તુમે તારીયા તેણે સ્યું તુમને દીધું ?

-સ્યું કારણ કીધું ?-પ્રભું ॥૧॥

એહ અનાદિ-સંસારમાં આવીને વસ્યો ।

માયા-મમતાવશે પરયો કયાં દીન જિસ્યો રે-પ્રભું ॥૨॥

હું સહજે ભદ્રક અછું, શઠ વાત ન જાણું ।

કુમતિ કુધરણી-કુસંગતે ન લહું ગુણકાણું-પ્રભું ॥૩॥

તે તેવડી આવીને મિથ્યા, મુઝ વિષય-કષાયા ।

મન ગાફિલમેં આસરે, આજ લેહ તે પાયા-પ્રભું ॥૪॥

લટપટ શી ઝાઝી કરું ? ઘટ આવી વસો રે ।

એટલે મેં સઘળું લહું, હવે અરજ કિસ્યો-પ્રભું ॥૫॥

હું બહુનેહી તુમતણો, તું અ-દેહી અ-નેહી ।

દેહી હઃખ સહુ લહે, કહું વાત હું કેહી ?-પ્રભું ॥૬॥

મોહવશે સ્થિતિ એહવી, સહુ કેની દીસે ।

બાલયા (!) પણ જગે તેહના, સીમાધર દીસે-પ્રભું ॥૭॥

તુમ દરિયણુ ચક્ર સહાયથી ।

નહી મિથ્યા લાગે-પ્રભું ॥૮॥

૧ આપું જગત,

જ્ઞાનવિમલ પ્રભુ મોહરા, સેવક નિહાળો,
 તાદૃશ જ્ઞાન ક્રિયા નહિ. જેણે મોહ ભાગે ।
 સો વારે એક વાર એ, બાળક પ્રતિપાળો,
 નિજ મિફ્ત સંભાલો-પ્રભુ ॥૬॥



(૧૪૩૮) સ્તવન-૪ (૫૯-૪)

રાધ-નાનવાઈ કન્યા ન લૂટે તંબોલીકે પાન-એ દેશી)
 એતા લાભ લીજીયે જિન-ભકિતકે લોક ? ।

-સાહિબ ! સેવા ઠીજીયે મન મસ્તકે લોક ।

સાય-ચાય જયત, ભંભા ઉદારતા નિશાન ।

ભવ્ય યોગ્ય-૧બંધુ રસિંધુર રંગ,

શુભ શુભ-વાણુ-જિન૦ ॥ ૧ ॥

ઉછાહરાહ મહારથ, અણુદીણતા તુરંગ;

ગાયે સબજનભટ્ટ વજ્ર, પ્રીતિ પાયક સંગ-જિન૦ ॥૨॥

મિથ્યાત કે રીદ્ધિ તેં, લૂંટી કષાય કે મેદાન ।

મોહરાયકી સેના લૂંટી, અરિકુ કીયે હેરાન-જિન૦ ॥૩॥

વિવિધ નાટધાટસે, જયથંભકે આરોપ ।

જ્ઞાન-ધ્યાન વિધિવિધાન, આદિ કષ્ટ કટોપ-જિન૦ ॥૪॥

જ્ઞાનવિમલ-પ્રભુ પ્રસન્ન હોત દેત દાન છે ।

અક્ષય-ક્ષાયિક-ભાવ પામી,

નિત્ય એ નિધાન છે-જિન૦ ॥૫॥



૧ સુંદર, ૨ હાથી,

(૧૪૩૯) સ્તવન-૫ (૫૯-૫)

(રાગ-ગાડી માર.)

કૌણુ બલાઈ નરભવ પાવે, 'જોલુ' સુકૃત ન થાઉંલા-

-મેરા સાહિબા દિલ માન્યા મન માન્યા ॥૧૧॥

કાલ અનાદિ પ્રમાદ પ્રસંગે, શ્રીજિન-સેવા પાડેલા-મેરાં ॥૧૧॥

ગોદ બિછાડે લક્ષિત બનાડે, વિનતિ વચણ સુચાઉંલા-મેરાં ॥

મનુજ-જન્મ-ફલ એહીજ જાણે,

શુદ્ધ-સમકિત દિલ લાડેલા-મેરાં ॥૨૧॥

યોગ્ય ક્રિયા ફલવંચક સેતી,

કબૂટ-ક્રિયા ન હુ ધ્યાઉંલા-મેરાં ॥૨૧॥

ચરમાવતે ચરમ કરણથે,

અ-વંચક ફલ પાડેલા-મેરાં ॥૩૧॥

રાગ-દ્રેષ દુરમન દૂર થેપિડે, આપે આપસ બાહુંલા-મેરાં ॥

તો જસવાદ લહો જગમાંહે,

મહિમ-મહોદય પાડેલા-મેરાં ॥ ૪ ॥

કાયા કામિની કંત પ્રત્યે એમ, હિત શિક્ષા સમજાઉંલા-મેરાં ॥

જ્ઞાનવિમલ-પ્રભુતા ગુણ પ્રગટથે,

છત-નિશાન બજાઉંલા-મેરાં ॥૫૧॥

(૧૪૪૦) સ્તવન-૬ (૫૯-૬)

જિણુંદા! વેા દિન કયું ન સંભારે ?

સાહિબ! તુમ્હ-અમ્હ સમય અનંતો,

એકઠા ઇણે સંસારે-જિણુંદા ॥ ૧ ॥

આપ અજર-અમર હોઇ બેઠા, સેવક કરીય કિનારે ।

મોટા બેઠ કરે તે છાજે,

તિકાં કુણુ તુમ્હને વારે ?-જિ ॥ ૨ ॥

ત્રિભુવન-ઠકુરાઈ અબ પાઈ, કહો ! તુમ્હ કે કુણુ સારે ?

આપ ઉદાસ-ભાવમેં આયેં,

દાસકું કયું ન સુધારે ?-જિ ॥ ૩ ॥

તુંહી તુંહી તુંહી તુંહી, તુંહી જે ચિત્ત ધારે ।

યાહી હેતુ જે આપ સભાવે,

ભવ-જલ પાડ ઉતારે-જિ ॥ ૪ ॥

જ્ઞાનવિમલ-ગુણ પરમાનંદે, સકલ સમીહિત સારે ।

બાદ્ય-અભ્યંતર ઇતિ-ઉપદ્રવ,

અરિયણુ દૂર નિવારે-જિ ॥ ૫ ॥



(૧૪૪૧) સ્તવન-૭ (૫૯-૭)

જમ જિનરાજ કૃપા હોવે, તમ શિવમુખ પાવે ।

અક્ષય અનુપમ સંપદા, નવનિધિ ઘરે આવે ।

ઐસી વસ્તુ ન જગતમાં, જિણુથી સમતા આવે ।

સુરતરૂ-રતિ-શશી પ્રમુખ જે,

જિન-તેજે છિપાવે-જમ ॥ ૨ ॥

જન્મ-જરા-મરણ-તણા, દુઃખ-દુરિત સમાવે ।
 મન-વનમાં જિન-ધ્યાનનો, જલધર વરસાવે-જળ૦ ॥૩૭॥
 ચિંતામણિ-ચણે કરી, કાણુ કાગ ઉડાવે ? ।
 મૂરખ કાણુ ? જિન છોડીને, જે અવરકું ખ્યાવે-જળ૦ ॥૩૮॥
 ઇશ્વી લમરી-સંગથી, લમરી-પદપાવે ।
 જ્ઞાન કહે તિમ પ્રભુ-ધ્યાનથી, જિન-એપમ આવે-જળ૦ ॥૩૯॥

★

(૧૪૪૨) સ્તવન-૮ (૫૯-૮)

(રાગ-કેદારો.)

(જવા ન દઉં નાથ સાથ ન છોડું રે-એ દેશી)
 ચરણ ન છોડું રે ! મોહ-દલને મોડું રે,
 પ્રભુજી ! વિનતડી અવધારે ।
 દીલમાં છે તે કહીયે દુઃખ સમયે,
 સમકિત અમાંહિ તુમ આધાર રહીયે રે-ચરણ૦ ॥૧॥
 આગમ ગુરુગમ અતિ અપરેપર, પૂરણ-ભાવ ન લહીયે રે ।
 આપને આ ભવે સેવીયે,
 સારય કેમ સદહીયેરે ?-ચરણ૦ ॥૨॥
 શઠ હઠ છોડી સરલ જે દાખે, તે વિરલા જગે પહીયે રે ।
 દુરતિથી શંકિત તવ નિશંકિત,
 તે દોહિલા જગે લહીયે રે-ચરણ૦ ॥૩॥
 તુમ દરિસણુ એમ દરિસણુ પ્રતીતે,
 તુમ આણા શિર વહીયે રે ।

અહુનિશ ધ્યાન-તાન મુજ એહી,

જ્ઞાનવિમલ-ગુણ કહીયે રે-અરણ્ય ૦ ॥૪॥



(૧૧૪૩) સ્તવન-૯ (૫૯-૯)

(રાગ : આશાઊરી)

દુર્ભંતિ વીતિને રે અમ ઘરે આળ્યા, વાહલા તેં વારૂ કીધું રે ।
અવિરતિ વિરહ-વિછોડયા ભાગા,

કાજ અમારું સીધું રે-હૃં ૦ ॥૧॥

દ્રષ્ટિ-રાગની ધ્રુમતા હીસે, મઠ-મધુપાન જ કીધું રે ।

એમ પરઘરે પેસંતા દેખી, મુનિ સોકયે મેણું દીધું રે-હૃં ॥૨॥

જયું પીયું કહે સુણી સુમતિ સુંદરું,

મુજ હિયડું હૈજે વિહુધું રે ।

જ્ઞાનવિમલ ગુણ ભૂષણ આપી,

અક્ષય અહવા તન દીધું રે-હૃં ૦ ॥૩॥



(૧૪૪૪) સ્તવન-૧૦ (૫૬-૧૦)

(રાગ-કેદારૌ)

ભલું કીધું રે માહરા નાથ ! મુજ મન આળ્યા રે,

મિલીયો શિવપુર સાથ, સવિ સુખ પાળ્યા રે ।

સુ-પ્રસન્ન થઈને આજ, દરિદ્રન દીધું રે,

આ માનવના અવતાર તણું ફલ લીધું રે ॥૧॥

તુજ શાસન-પરતીતે મેં હિત જાણી રે,

છે યદિ અ-ગમ અ-થાહ પણ ચિત આણી રે ।

અનેકાંત-નયરૂપ જે તુમ વાણી રે,

ભિષક અવર ન કોઈ અનોપમ નાણી રે ॥૨॥

કરુણાવંત કૃપાલ કૃપા હવે કૌંજે રે,

ભવ-ભવ એહીજ રંગ અ-ભંગે દીજે રે ।

શ્રી જિનવર મહારાજ સાહિબ સુણીયે રે,

ભાવ મને મન જાણી ઘણું શું ભણીયે રે ? ॥૩॥

શું બહુ ભાખ્યે, હોઈ સેવક ગણીયે રે,

દેખી દોષ અનેક એ નવિ અવણીયે રે ।

સેવકની સવિ લાજ સ્વામી વધારે રે,

ભક્તિ-આતુરતા ભાવ એ વ્યવહારે રે ॥૪॥

આપ-સરૂપ ન કોઈ કેને આપે રે,

પણ સહાયને હેત ધ્યાને થાપે રે ।

જેમ રવિથી પંકજ વાસખંધન વિઘટે રે ।

તેમ જ્ઞાનવિમલ-શુષ્ક વૃદ્ધિ પ્રભુથી પ્રગટે રે ॥૫॥



(૧૪૪૫) રતવન-૧૧ (૫૯-૧૧)

(રાગ-વેલાહીલ.)

(પ્રભાતી રાગ)

જળ લગ સમક્ષિત-રત્નકું, પાયા નહિં પ્રાણી ।

તળ લગે નિજ-શુષ્ક નવિ વધે,

તરૂ વિષ્ણુ જિમ પ્રાણી-જળ ॥૧॥

તપ-સંયમ કિરિયા કરો, ચિત્ત રાખો ઠામ ।

દર્શન વિષ્ણુ નિષ્કલ હોવે, જેમ વ્યોમ-ચિત્રામ-જળ ॥૨॥

સમકિત-વિરહિત જીવને, શિવ-સુખ હોય કેમ ? ।
 વિષ્ણુ હેતે કાર્ય ન નીપજે મૃદવિષ્ણુ વટ જેમ-જમ ॥૩॥
 પરંપર-કારણ મોક્ષકો, એ છે સમકિત-મૂલ ।
 શ્રેષ્ઠિક-પ્રમુખતણી ! પેરે, હોએ સિદ્ધિ અનુકૂલ-જમ ॥૪॥
 ચાર અનતાનું અંધિયા, ત્રિદશન-મોહ ।
 જ્ઞાન કહે જે ક્ષય કરે, વંદુ તે ગુણ ગેહ-જમ ॥૫॥



(૧૪૪૬) સ્તવન-૧૨ (૫૯-૧૨)

(રાગ-અડાણો)

પ્રભુ ! તેરી ભકિત સદા સુખદાઈ ।
 અવિધિ-આશાતના દૂર કરીને,
 જો કરે મન નિરમાઈ-પ્રભુ ॥૧॥
 ઘર આંગણ પર સ્વર્ગતણા સુખ, નરસુખ લહત સવાઈ ।
 સૌભાગ્યાદિક સહજ સુભગતા,
 સહચર પડે ચતુરાર્ધ-પ્રભુ ॥૨॥
 હૃસ્તર ભવ-જલનિધિ સુખે તરીયે, દૂરે અરતિ-બલાઈ ।
 મન-વચન-તનુ કરી ભવે-ભવે ચાહું,
 એહિજ સુકૃત-કમાઈ-પ્રભુ ॥૩॥
 જ્ઞાનવિમલ-ગુણ પ્રભુતા પામી, શિવ-સુંદરી મિલ્લી ધાઈ ।
 સમકિતપદ જિનપદ ગુણ-સંભવ,
 એ ગુણ કરણ વડાઈ-પ્રભુ ॥૪॥



(૧૪૪૭) સ્તવન-૧૩ (૫૯-૧૩)

(રથયાત્રા ગભિર્ત.)

(આધ્યાત્મિક રથયાત્રા)

જિન-દરિસણથી દુઃખ જાવેલું-જિનં ।

પ્રભુ-ભગતે શિવસુખ થાવેલું, રથયાત્રા એમ સોહાવેલું ॥

પિંડસ્થાદિક-ચક્રે ૧ ચતુર ચઢે,

મૈત્ર્યાદિક ઘન્ટ વજાવેલું-રથં ॥૧॥

ખાદ્ય-અભ્યંતર-રજ-ભર-કંટક,

મિથ્યા અજ્ઞાન મિટાવેલું-રથં ॥૨॥

શ્રદ્ધા શેરી અ-દંભતા ભેરી,

વિવિધ વાજિંત્ર વજાવેલું-રથં ॥૩॥

અભયદાન ઉચિતાદિક અનુપમ,

કુસુમનો પગર ભરાવેલું-રથં ॥૪॥

જે નિરવિધન ૨અનધ અર્થાદિક,

ચામર ૩ચતુર વીંઝાવેલું-રથં ॥૫॥

શુણ્ણિગણ મહાજન-વૃંદ પ્રમોદે,

એમ શ્રીજિન પધરાવેલું-રથં ॥૬॥

ત્રાવધ વિવિધ શુભ-યોગ-જનિત ક્રિયા,

છત્ર પવિત્ર ધરાવેલું-રથં ॥૭॥

અનુચિત અ-વિધિ-આશાતનાદિક જે,

અનુચિત-કર્મ ઓસરાવેલું-રથં ॥૮॥

૧ ચાર. ૨ ઉત્તમ, ૩, સારા,

જ્ઞાનવિમલ-પ્રભુ સુ-જસ મહોદય,

(ત્રિભુવન સુજસ ચઢાવેજી-રથ૦ ॥૬॥



(૧૪૪૮) સ્તવન-૧૪ (૫૯-૧૪)

જાણ્યો રે મેં મન અપરાધી (૨)

જે પરભાવ પરમારથ જાણ્યો,

તિણુથી પંચમીગતિ નવિ સાધી રે-જાણ્યો૦ ॥૧॥

મહામૂઢતા : જેહ અનાદિની,

^૧દુર્મતિ-વિજ્યા-વિલાસૌવધી-જાણ્યો૦ ॥૨॥

શુદ્ધ-ચેતન જ્ઞાનદશા તખ,

સુમતિ સુસંગતિ રહી અલાધી-જાણ્યો૦ ॥૩॥

શુદ્ધાશુદ્ધ-વિચાર-વિવેચન,

તુજ આણી તે નવિ આરાધી-જાણ્યો૦ ॥૪॥

અ-વિધિ અનોતિ અ-સજ્જનસંગતિ,

તિણુથી તૃણાવેલડી વાધી-જાણ્યો૦ ॥૫॥

વિષય-કષાય-દાવાનલ-યોગે,

^૨સામ્ય-સુધારસ-વેલડી વાધી-જાણ્યો૦ ॥૬॥

એમ પ્રવચન-મર્યાદા-રોતિ,

અતિ અ-વિવેક-પસાય વિરાધી-જાણ્યો૦ ॥૭॥

એમ બહુ પુદ્ગલ-પરિવર્તનથી,

^૩આરતિ અરતિ ને અ-સમાધિ-જાણ્યો૦ ॥૮॥

૧. દુર્મતિરૂપ વિજ્યા=ભાંગના વિલાસની દવા રૂપ.

૨. સમતાના અમૃતરસની વેલડી. ૩. આર્તધ્યાન.

સો લય દૂર મિટ્ટ્યો અબ બાણ્યો,

તરવ-પ્રતીતની શેરી લાધી-બાણ્યો ॥૬॥

જ્ઞાનવિમલ-સાહિબ સુ-નજરે,

પ્રસરત સહજ-સમાવ સમાધી-બાણ્યો ॥૭॥



(૧૪૪૯) સ્તવન-૧૫ (૫૯-૧૫)

(રાગ-રામગીરી.)

પ્રભો ! તાહરી યોગમુદ્રા, લાવતાં લવ-નાશ રે ।

ચરણધર્મે શાંતિ-શર્મે, છેદીયો લવ-પાશ રે-પ્રભો ॥૧॥

દ્રવ્ય-શિવે સંયમી તું, ધરે બંધ અ-બંધ રે ।

જે પ્રવર્તન તે નિવર્તન,

શુભ-કષાય-સંબંધ રે-પ્રભો ॥૨॥

નિશ્ચય-વ્યવહાર હેતે, ક્રિયા અક્રિય-હેત રે ।

જાણુગે ગુણુઠાણુ-યોગે, એકરૂપ-સમેત રે-પ્રભો ॥૩॥

લાવ ઔઠાસીન્ય સઘળે, કરે તું નિજ કામ રે ।

ભીમ-કાંતગુણોધ પર-નિજ, ટાળવાને ધ્યાન રે-પ્રભો ॥૪॥

નિશ્ચયે તું જિહાં અ-યોગી, તિહાં પ્રવર્તનરૂપ રે ।

દ્રવ્યથી પણ નહિ અલગો,

સમયે અ-ચલ અનૂપ રે-પ્રભો ॥૫॥

એમ ચરિત્ર અનેક જોતાં, અ-લખ તું ન લખાય રે ।

ધ્યેય-ધ્યાતા-ધ્યાન-એકે, જ્ઞાનવિમલ કહાય રે-પ્રભો ॥૬॥



(૧૪૫૦) સ્તવન-૧૬ (૫૯-૧૬)

મહારા ભર-ભવના ભય ભય રે, પ્રભુને દિલ લાઉં ।
 સુર્ય-પવનસે આશ-ધર શોધું, છાંટું શમ-રક્ષ-પાની ।
 ઉચિત-સુગુણના ફૂલ બિછાઉં,

ધ્યાન-ધૂપધટી પ્રગટાણી રે-પ્રભુ ॥૧૧॥

ત્રિકરણ-યોગ-અ-વંચક ત્રિગડું, તર અશોક સિતજબણી ।
 ધ્યેય-સમાપત્તિ-શિખર-સિંહાસન,

એસે મહારો નાથજી નાણી રે-પ્રભુ ॥૨૧॥

છત્ર ત્રીન કરૂં ત્રીન અવસ્થા, મોટી માલ સુહાણી ।

વિધિ-અનાશાતન આમર સુર-નર,

અવગુણ-બ્રહ્મિ ઉજાણી રે-પ્રભુ ॥૩૧॥

સ્તુતિ-શબ્દાલક નાદ અનાહત, હંદુભિ-કોડિ બળની ।

હું મહારા પ્રભુશ્યું થઈ એક-તાને,

અ-વિચલ-પ્રીતિ મયાણી રે-પ્રભુ ॥૪૧॥

ઈણ વિધિશ્યું સવિ અંતર ભાગે, જ્ઞાનવિમલ-ગુણખાણી ।

એહ નિશાની શુદ્ધ-ચેતન,

સુંદર જિણધરે આણી રે-પ્રભુ ॥૫૧॥

(૧૪૫૧) સ્તવન-૧૭ (૫૯-૧૭)

(રાગ-નટ તથા સારંગ)

બાંહ્ય ગ્રહો પ્રભુ ! બાંહ્ય ગ્રહો, સાકિત્ર ! મોંકું બાંહ્ય ગ્રહો ।

આ સંસાર અથાગ-સમુદ્રમેં, તરણ ઉપાય કહો-પ્રભુ ॥૧॥

શુ-હો કીઓ અજ્ઞાનપણે મેં, સો અબ સખહી સહો ।

ભવિ-જન-પાવન બિરૂદ તમારું,

સો પ્રભુ ! સાચે વહો-પ્રભુ ॥૨૧॥

પ્રભુ ! સેવક તારંતા અપનો, જગમાં સુ-જસ લહો ।

લોચન-લીલા લલકે તુમારે, દુરિત-મિથ્યાત દહો-પ્રભુ ॥૨૩॥

જન્મ-જરા-મરણાદિક-બ્રમણા, બહોપિ બહોરિ મહો ।

જ્ઞાનવિમલ કહે શ્રી જિન-ચરણે,

અ-વિચલ-ચિત્ત રહો-પ્રભુ ॥૨૪॥



(૧૪૫૧) સ્તવન-૧૮ (૫૯-૧૮)

(રાગ-જય જયવંતી)

સમવસરણ રાજે જગત ઠંકુરાઈ છાજે ।

દેવ-દુંદુભિ ગાજે, ધનાઘન ઘોરરી-સમવ ॥૧॥

પુંઠે ભામંડલ રાજે, તેજે દિનકર લાજે ।

વૈર-વિરોધ ભાજે, ભુજંગમ-મોરરી-સમવ ॥૨॥

પંચવરણ-કુસુમ-માન, અધિક યોજન પ્રમાણ ।

રથે સુરવરણ, હીંચણ-પ્રમાણરી-સમવ ॥૩॥

તિહાં બેસે જિન-ભાણ, કરત નય નિતુ વખાણ ।

જયજયવંતી આણ, શિર ધરે સુ-જાણરી-સમવ ॥૪॥



(૧૪૫૩) સ્તવન-૧૯ (૫૯-૧૯)

મારા સાહિબા ! હો ! રાજ ! વિનતડી અવધાર ।

પરમ-પુરૂષ પરમેસર, પૂરણભાવ પ્રસન્ન ।

મૂરતિ મુદ્રા મોહિયા રે, કાંઈ !

ત્રણ, ભુવનના મન્ન-મારાં ॥૧॥

જનમ કૃતારથ માહરો, કાંઈ દિવસ બહી ધન્ય એહ ।

દરિસણથી દરિસણુ લહું,

કાંઈ ! જેહ સકલ-ગુણ-ગેહ-મારાં ॥૨॥

એહ સંસાર અસારમાં, કાંઈ ! જાણો એહી જ સાર ।

આતમ-ભાવે સાધતાં,

કાંઈ જ્ઞાન-ક્રિયા વ્યવહાર-મારાં ॥ ૩ ॥

તુંહી ૧ ત્રાતા તુંહી ૨ પાતા, તુંહી આતમરામ ।

કરૂણા-સિંધુ તુંહી બંધુ, તુંહી નયણુ નિદાન-મારાં ॥૪॥

જ્ઞાનવિમલ-ગુણથી લહ્યાં, કાંઈ આપે આપ સરૂપ ।

ગતિ મતિ ઈછતિ ચિતિ માહરે,

પાવન પરમ અનૂપ-મારાં ॥૫॥



(૧૪૫૪) સ્તવન-૨૦ (૫૯-૨૦)

અજબ બની છે આંગી પ્રભુ-દેહે ।

સોહે એકાંગી હો ! શ્રી જિન પૂજેજી ॥૧॥

૧ આવેલ આકૃતથી બચાવનાર, ૨ નવી આકૃતોથી રક્ષણ કરનાર,
૩ શોભા.

તુંહી અ-વણી અલગ ભવિ ભક્તિ કરે ।

બહુ-ભંગી હો ! શ્રીજિન પૂજેછ ॥૨૧॥

કનક-રજત કૃતરંગી અતિ-જડિત ।

જડાવશું ચંગી હોય-શ્રીજિન પૂજેછ ॥૨૩॥

બહુધા પરિમલ મહકે ભૂવણ મણિ-ગણ ।

લહલહકે હો ! શ્રીજિન પૂજેછ ॥૨૪॥

સુરભિ કુસુમ પંચવણી ઠવે માલાએ ।

ભવિ-કરણી હો ! શ્રીજિન પૂજેછ ॥૨૫॥

ઉપચારિક-ભક્તિ-નિમિત્તે શુભયોગ હોઈ ।

શુભ-ચિત્તો હો ! શ્રીજિન પૂજેછ ॥૨૬॥

સવિ ભક્તિથકી પ્રભુ ન્યારો ધ્યાયક ।

બહુ-લેહે ધારો હો ! શ્રીજિન પૂજેછ ॥૨૭॥

જ્ઞાનવિમલ-ગુણ આણી પાવન પૂજા કરો ।

ભવિ-પ્રાણી હો ! શ્રીજિન પૂજેછ ॥૨૮॥

(૧૪૫૫) સ્તવન ૨૧ (૫૯-૨૧)

(રાગ કેદારો કાફી)

મુજરો છેલ ! છેલ ! છેલ ! છેલ ! છેલ ! મુજરો છેલ,

જગબંધવ ! સાહિબ ! મુજરો છેલ ।

જગજીવન ! સાહિબ ! મુજરો છેલ ॥

આપ અ-રૂપી અ-કલ-સરૂપી, અ-લખ કિણે નવિ પાયા ।

પિંડસ્થાદિક રૂપ-ગુણમૈં ધ્યાન-ભુવનમાં લયાયા-મુજ૦ ॥૨૧॥

સકલ-લોક-શિર ઉપર ઘેઠા, બાહિર નયન ન બાણ્યા

જ્ઞાન-ધ્યાન-ગુણશું આકર્ષી,

એમ મન-ભીતરે આણ્યા-મુજ૦ ॥૨૨॥

સકલ-વસ્તુ ભાસિત તુમ આતમ, અ-ગાણિત જસ પ્રભુતાર્થ ।
લઘુ અમ મનમાં તે સવિ માયું,

અમચી એહ વડાર્થ-મુજ ૦ ॥૩૧॥

નિ-રાગીને રાગ-ભવનમાં, ધરવું અચરિજ એહી ।

તે પશુ સહજ-સ્વભાવ-પ્રસન્ને,

સાહિબ મુશુષ્ સનેહી-મુજ ૦ ॥૩૨॥

પ્રીતિ અંતર નહિં એ સાચો, કીધો લોક-ઉખાણો ।

જ્ઞાનવિમલ-શુષ્ હોઈ અ-લેદ,

તિથે પરે એ વિધિ આણો-મુજ ૦ ॥૩૩॥



(૧૪૫૬) સ્તવન-૨૨ (૫૯-૨૨)

(રાગ-સામેરી)

(પીઉડા ગાગરડીના ઝોલા તે મુને લાગે છે-એ દેશી)

પીઉડા ! મદ-મત વાલા ! ઝોલા મુને લાગે છે ।

અજ્ઞાન-પથ્યંકે પીઉડો પોઢ્યો,

કુમતિ-પાડોશણ જાગે-પીઉડા ૦ ।

તનુ ધરમેં પંચ રક્ષક કીના,

ચોર થઈ તે લાગે-પીઉડા ૦ ॥૧॥

ચોવટીયા જે ચોહરિ ચોરે, લાંચ ખલકની માંગે-પીઉડા ૦ ।

તૃષ્ણા-દાસી સેંતી લાગી,

જિહાં તિહાં થાવે આગે-પીઉડા ૦ ॥૨॥

મુમતિ-મુનારી પિઉશું પ્યારી,

અરજ કરે પતિ આગે-પીઉડા ૦ ।

શ્રી જિન-દરિસણ વંછિત-પૂરણ,

મિલીઓ આપણે ભાગે-પીઠડાં ॥૩૧॥

એક-તાન થઈ એહી જ સેવો,

વિષય-પ્રમાદને ત્યાગે-પીઠડાં ।

સહજાનંદ-સ્વરૂપ સકલ ગુણ,

પ્રગટતાં વાર ન ભાગે-પીઠડાં ॥૪॥

જ્ઞાનવિમલ-ગુણ આપ સવાઈ,

તો દુશ્મન ફરે ભાગે-પીઠડાં ।

જે જે શબ્દો હોય જમમાંડિ,

જશ-પડહો જિમ વાળે-પીઠડાં ॥૫॥



(૧૪૫૭) સ્તવન ૨૩ (૫૯-૨૩)

(રાગ-ભાંગડી ધ્રુવારી છે જો એ દેશી.)

અરિહંતને આદરો-માહરા લાલ ।

અરિહંત શિવદાઈ છે જો ।

અરિહંતને આદરો-માહરા લાલ, અરિહંત શિવદાઈ છે જો ।

જિનવરને આદરો-માહરા લાલ,

જિનવર નિરમાઈ છે જો ॥ ૧ ॥

ભગવંતને પૂજળ્યો-માહરા લાલ, ભગવંત ભવ-તાડ છે જો ।

ગુણવંતના ગુણ ગાવળે-માહરા લાલ ।

ગુણવંત ગુણકાડ છે જો ॥૨॥

જિન-આણા શિરે ધરો-માહરા લાલ ।

આણા સુરવેલી છે જો ।

સમતારયું સંગતિ કરો-માહરા લાલ ।

સમતા શિવ બેલી છે ને ॥૩૩॥

સેવાથી સુખ લહીયે-માહરા લાલ,

સેવા કામ-ગવી છે ને ।

સમકિત પણ નિર્મલ હોવે-માહરા લાલ ।

સમકિત જ્ઞાન છવી છે ને ॥૩૪॥

અ-રૂઝ અ-મલ અ-વિનાશી- માહરા લાલ ।

જિનવર પરમ-પુરૂષ છે ને ।

અ-કલ-અ-રૂપી અ-લખ-સરૂપી-માહરા લાલ

જિન જ્યોતિ-સરૂપી છે ને ॥૩૫॥

જ્ઞાનવિમલ તુમ્હ શુષ્ક ભણતાં-માહરા લાલ ।

નવ નિધિ ઋદ્ધિ પામી છે ને ।

બોધિ-બીજ શુદ્ધ-વાસના દીયો-માહરા લાલ ।

લવે લવે તું સ્વામી છે ને ॥૩૬॥



(૧૪૫૮) સ્તવન-૨૪ (૫૯-૨૪)

(રાગ-ધન્યાશ્રી)

આજ મહારા પ્રભુજી ! સ્હામું જુઓ, સેવક કહીને બોલાવો,
એટલે હું મનગમતું પામ્યો,

રૂઠાં બાલ મનાવો-મહારા સાંઈ રે આજ ॥૧॥

પતિત-પાવન શરણાગત-વચ્છલ, એ જશ જગમાં આવો ।

મન મનાવ્યા વિષુ નવિ મુકું,


એહીજ મારો દાવો-મહારા ॥૨॥

કબજે આવ્યા તે નહિ મુકું, જિહાં લગે તુમ સમ થાવો ।
જો તુમ ધ્યાન વિના શિવ લહીયે,

તો તે દાવ બતાવો-મહારાં આજાં ॥૩॥
મહા-જોપ ને મહા-નિર્વામક, ઇષ્ટિ પેરે બિરૂદ ધરાવો ।
તો શું ? આશ્રિતને ઉદ્ધરતાં,

બહુ-બહુ શું કહાવો ?-મહારાં આજાં ॥૪॥
જ્ઞાનવિમલ-પ્રભુ નામ મહાનિધિ, મંગલ એહી વધાવો ।
અ-ચલ અ-લેહપણે અવલંબી,

અહ-નિશ એહી દિલ ધ્યાવો-મહારાં આજાં ॥૫॥



શ્રીવર્દ્ધમાન-સ્વામિને નમઃ

સંપાદક સંકલિત

સ્તવન ચૌવિશી

(૬૦)

(૧૪૫૯) આદીશ્વર-જિન સ્તવન (૬૦-૧)

(રાગ રામકલી)

તુમ દરિસણુ લલે ! પાયો ! પ્રથમ-જિન ! તુમં ।

નાભિ-નરેશર-નંદન નિરૂપમ,

માતા મરૂદેવી-ભયો-પ્રથમં ॥૧॥

આજ અમીય-રસ જલધર વૂઠયો, માતું ગંગાજલ નાહ્યો ।

સુરતર-સુરમાણ-પ્રમુખ અનુપમ,

તે સવિ આજ મેં પાયો-પ્રથમં ॥૨॥

જુગલા ધર્મ-નિવારણુ તારણુ, જગ-જન મંડપ વાહ્યો ।

પ્રભુ ! તુજ શાસન-વાસન-શકતે,

અંતર-વૈરી હરાયો-પ્રથમં ॥૩॥

કુશુર-કુઠેવ-કુધર્મ-કુવાસન, કાલ અનંત વહાયો ।

મેં પ્રભુ ! આજથી નિશ્ચય કીનો,

સો મિથ્યાત ગમાયો-પ્રથમં ॥૪॥

ઘરઘર વિનતી કરૂં ઈતની, તુમ સેવા-રસ પાયો ।

જ્ઞાનવિમલ-પ્રભુ સાહિબ-સુ-નજરે,

સમકિત પૂરણુ સવાયો-પ્રથમં ॥૫॥

(૧૪૬૦) અજિતનાથ જિન-સ્તવન (૬૦-૨)

અજિત-જિન ! તુમથું પ્રીતિ બંધાણી-અજિત૦ ।

જિતશત્રુ-નૃપનંદન ૧ નંદન,

ચંદન-શીતલ વાણી-અજિત૦ ॥૧॥

માત-ઉદર વસતે પ્રભુ ! તુમચી, અચરિજ એજ કહાણી ।

સોગડ-પાશે રમતે છત્યો,

પ્રીતમ વિજયા-રાણી-અજિત૦ ॥૨॥

તુંહી નિરંજન રંજન જગ-જન,

તુંહી અનંત-ગુણ-ખાણી ૬

પરમાનંદ પરમપદ-હાતા,

તુજ સમ કેા નહી નાણી-અજિત૦ ॥૩॥

મજ-લંછન કંચન-વન ઓપમ, માથું સોવન-પિંગાણી ।

તુજ વદન પ્રતિબિંબિત શોભિત,

વદન સુર-ધંદ્રાણી-અજિત૦ ॥૪॥

અજિત-જિનેશ્વર ! કેશર-અરચિત, કેમલ કમલસમ-પાણી ।

જ્ઞાનવિમલ-પ્રભુ-ગુણ-ગણ લણતાં,

શિવસુખ-રચણી ખાણી-અજિત૦ ॥૫॥



(૧૪૬૧) શ્રી સંભવનાથ-જિન સ્તવન (૬૦-૩)

સાહિબ ! સાંભળો રે ! સંભવ ! અરજ અમારી,

ભવોભવ હું ભમ્યો રે, ન લહી સેવા તુમારી ।

૧ આનંદ આપનારા, ૨ હાથ,

નરક-નિગોદમાં રે, તિહાં હું બહુ ભવ ભમીયો-
તુમ વિના દુઃખ સદ્યાં રે,

અહોનિશ ક્રોધ ધમધમીયો-સાહિબ૦ ॥૧॥

ઇન્દ્રિયવશ પહયો રે, પાલ્યાં પ્રત નવિ 'સૂ'સે,
ત્રસ પશુ નવિ ગણ્યારે, હણીયા થાવર હુંસે ।
પ્રત ચિત્ત નવિ ધર્યાં રે, ખીજીં સાચું ન બોલ્યું,
પાપની ગોઠડી રે, તિહાં મેં હઈડહું બોલ્યું-સાહિબ૦ ॥૨॥
ચોરી મેં કરી રે, ચઉવિહ-અદત્ત ન ટાલ્યું,
શ્રીજિન-આણુશું રે, મેં નવિ સંજમ પાલ્યું ।
મધુકરતણી પરે રે, શુદ્ધ ન આહાર ગવેજ્યો-
રસના-લાલચે રે, નીરસ-પિંડ ઉવેજ્યો-સાહિબ૦ ॥૩॥

નરભવ દોહિલો રે, પામી મોહવશ પડિયો-
પરભી દેખીને રે, મુજ મન તિહાં જઈ અડિયો ।
કામ ન કે સર્યાં રે, પાપે પિંડ મેં ભરીઓ-
સૂધ-પ્રુધ નવિ રહી રે,

તેણે નવિ આતમ તરીઓ-સાહિબ૦ ॥૪॥

લક્ષ્મીની લાલચે રે, મેં બહુ દીનતા દાખી-
તો પશુ નવી મલી રે, મલી તો નવિ રહી રાખી ।
જે જન અભિલષે રે, તે તો તેહથી નાશે,
તૃષ્ણ-સમ જે ગણે રે, તેહની નિત રહે પાસે-સાહિબ૦ ॥૫॥
ધન ધન તે તે નરા રે એહનો મોહ વિછોડી,
વિષય નિવારીને રે, એહને ધર્મમાં જોડી ।

૧. હોંસસાથે,

અ-ભક્ત્ય તે મેં ભખ્યાં રે, રાત્રિ ભોજન કીધાં-
મત નવિ પાળીયાં રે,

જેહવાં સુખથી લીધાં-સાહિબં ॥૬॥
અનંત ભવ હું ભમ્યો રે, ભમતાં સાહિબ મલીયો,
તુમ વિના કેણુ દિયે રે ? બોધિ-રયણુ મુજ બલિયો ।
સંભવ ! આપજો રે ચરણુ-કમલ તુમ સેવા-
નથ એમ વિનવે રે, સુણજો દેવાધિદેવા-સાહિબં ॥૭॥



(૧૪૬૨) શ્રી સુમતિનાથ જિન-સ્તવન (૬૦-૪)

તુમ હો ! બહુ ઉપગારી સુમતિ-જિન ! તુમ હો ।
મેધ-નૃપ-નંદન આનંદન,

મંગલા-માત તુમારી-સુમતિં ॥ ૧ ॥

પંચમજિન પંચમી-ગતિદાતા પંચ-મહાવ્રતધારી ।

પંચ વિષય-વિકાર-રહિત-જિન,

પંચમ-નાણુ વિચારી-સુમતિં ॥૨॥

પ્રભુ ! તુમ દરિસણુ નિશ્ચય કીનો, સેવું સેવા તુમારી ।

સુમતિ-સુવાસ વસી મન બીતર,

કયા કરે ? કુમતિ બિચારી-સુમતિં ॥૩॥

જ્યું ધૃત-હૃદ્ય સુવાસ કુસુમમેં, પ્રીતિ બની એકતારી ।

હિલ ભરી હિલ દેખી સાહિબકો,

વિરચે કેણુ વિચારી ?-સુમતિં ॥૪॥

સુરતર-સુરમણિયો તુમ આણુ, અધિક લગી મોહે પ્યારી ।

નિષ્ણથી દૂરે ઝાંઝ ભવ-ભવકી,

દુરગતિ અલસે ? અટારી-સુમતિ ॥૫॥

તીન-ભુવન મન-મોહન સાહિબ, સેવે સુર-નર-નારી ।

જ્ઞાનવિમલ-પ્રભુ ચરણ શરણકી,

બાઉં મેં બલિહારી-સુમતિ ॥૬॥

❧

(૧૪૬૩) શ્રી ચંદ્રપ્રભ-જિન-સ્તવન (૬૦-૮)

(રાગ-મુજરૌ નયજારૌ એ દેશી)

શ્રી ચંદ્રપ્રભ-જિન રાજજી, ચંદ્રપુરી જસ વાસ ।

મુજરૌ છે મહારૌ મુણ જિનરાજ !

સવિ શિરતાજ,

સવિ મુજ કાજ સીધલા આજ

ચંદ્ર ફિરણથી ઉજલો રે કાંઈ,

પ્રસર્યૌ જગે જશ-વાસ-મુજરૌ ॥૧॥

ચંદ્ર-લંછન ચંદ્ર-રૂચિ વાને કાંઈ,

ચંદ્ર-ચીતલ દીદાર-મુજરૌ ॥

સૂરતિ સુંદર સોહિએ રે, ત્રિભુવન-મોહનગાર-મુજરૌ ॥૨॥

નિષ્ણ દિનથી તુમને શિર ધર્યા રે કાંઈ,

તિષ્ણ દીનથી જયકાર-મુજરૌ ॥

ઝટપતરૂ-ધર આંગણે રે કાંઈ,

તિહાં નહિ દુઃખ-સંચાર-મુજરૌ ॥૩॥

જિજ્ઞે કાનને રહે કેશરી રે કાંઈ,

તિહાં નહિ દુષ્ટ-પ્રચાર-મુજરોં ।

જિહાં દિનકર-કર વિસ્તરે રે કાંઈ,

તિહાં નહિ તિમિર-વિકાર-મુજરોં ॥૪૧॥

ભુજંગ-પરાભવ તિહાં નહિં રે કાંઈ,

જિહાં કરે મોર કિંજાર-મુજરોં ।

તિહાં દુર્ભિક્ષ ન વિસ્તરે રે કાંઈ,

જિહાં પુષ્કર-જલધાર-મુજરોં ॥૪૨॥

તિષ્ઠપરે પ્રભુ તુમહે ચિત્ત-ચસે રે કાંઈ,

ન રહે પાપ લગાર-મુજરોં ।

મહસેન-નૃપ કુલ ચંદ્રો રે કાંઈ,

લક્ષ્મણ-માત-મહાર-મુજરોં ॥૪૩॥

અઠમચંદ્ર સવિ સુખકર રે કાંઈ,

નિરખી તુમ હીદાર-મુજરોં ।

નયન-ચકોરા ઉલ્લસ્યા રે કાંઈ,

નિરખી તુમ હીદાર-મુજરોં ॥૪૪॥

જ્ઞાનવિમલ ! ચઢતી કળા રે કાંઈ,

તાહરી અ-ક્ષય અપાર-મુજરોં ।

અનુભવ-સુખ સહેજે મિલે રે કાંઈ,

એહ પ્રભુ-ઉપગાર-મુજરોં ॥૪૫॥

(૧૪૬૪) શ્રી શીતલનાથ જિન-સ્તવન (૬૦-૧૦)

શીતલ-જિન સોહામણો-માહરા બાહુડા ।

હુલરાવે નંદા માય-માહરા નાનડીયા ।

રતન સમોવડી તું અછે-મારા,

દીઠે અમ સુખ થાય-મારાં ॥૧॥

મુખડે ચંદ હરાવિઓ-માહરાં, તેજે સૂરજ-કોડી-માહરાં

રૂપ અનોપમ તાહરું-માહરાં,

અવર ન તાહરી જોડી-માહરાં ॥૨॥

આંખડી કમલની પાંખડી-માહરા,

ચાલે હાર્યા હંસ-માહરાં ।

તુજમી અમ સોભાગીયા-માહરાં,

પવિત્ર કર્યો અમ વંશ-માહરાં ॥૩॥

જે ભાવે તે મુખડી-માહરાં

લિઓ આપું ધરી નેહ-માહરાં ।

જોલા માંહી બેસીયે-માહરાં

તું અમ મનોરથ મેહ-માહરાં ॥૪॥

અમીય-સમાણે બોલડે-માહરાં,

બોલો ચતુર સુખજી-માહરાં ।

ભામણુડે હું તાહરે-માહરાં,

તું અમ જીવન-પ્રાણ-માહરાં ॥ ૫ ॥

ખમા-ખમા મુખે ઉચરે-માહરાં,

જીવો કોડિ વરિસ-માહરાં ।

જ્ઞાનવિમલ-જિનને માવડી-માહરાં,

દિથે એમ નિત આશીષ-માહરાં ॥૧॥

૩૩

(૧૪૬૫) શ્રી વિમલનાથ-જિન સ્તવન (૬૦-૧૩)

(દેશી મોતીડાની)

વિમલ-જિનેશ્વર જગતને પ્યારો,

જીવન-પ્રાણ-આધાર હમારો,

-સાહિબા ! મોઢે વિમલ-જિણુંદા ।

-મોહના શમ-સુરતરૂ-ઠંઠા-સાહિબાં ॥૧॥

સાત રાજ અલગો જઈ વસીયો,

પણ મુજ ભક્તિતણો છે રસીયો;-સાહિબાં ॥૨॥

મુજ ચિત્ત-અંતર કયું કરી જાશી ?

સેવક સુખી એ પ્રભુ-શાખાશી-સાહિબાં ॥૩॥

આલસ કરશે જો સુખ દેવા,

તો કુણ કરશે ? તુમચી સેવા-સાહિબાં ॥૪॥

મોહાદિક-દલથી ઊગારો,

જન્મ-જરાના દુઃખ નિવારો-સાહિબાં ॥૫॥

સેવક-દુઃખ જો સ્વામી ન ભંજે,

પૂરવ-પાતિક નહી મુજ મંજે-સાહિબાં ॥૬॥

તો કુણ બીજે આશા પૂરે ?

સાહિબ ! કાંઈ ઈચ્છિત પૂરે-સાહિબાં ॥૭॥

જ્ઞાન વિમલસૂરિ-જિન-ગુણ ગાવે,

સહેજે સમક્તિ-ગુણ બહુ પાવે-સાહિબાં ॥૮॥



(૧૪૬૬) શ્રી અનંતનાથ-જિન સ્તવન (૬૦-૧૪)

(રાગ-જિનરશ્મિ વડા રે એ દેશી)

અનંત-જિણુંદશું રે, કીધો અ-વિહડ નેહ,
 ખિણુ-ખિણુ સાંભરે રે જિમ આતક-મન મેહ ।
 તે તો સ્વારથી રે આ પરમારથ હોય,
 અનુભવ-લીલમાં રે લીણ્યો ભેદ ન હોય૦-અનંત૦ ॥૧॥
 સહજ-સ્વભાવથી રે સહુના છો રે આધાર,
 કિમ કરો પામીયે રે ? મોટા-દિલતણે પાર ।
 પણ એક આશરો રે પામ્યો છે નિરધાર,
 સુ-નજરે જોયતાં રે કીધા બહુ ઉપગાર-અનંત૦ ॥૨॥
 જિન-ગુણ તાહરા રે લખીયા કિમહી ન જાય ?
 ભવ ને ભવાંતરે રે પાઠ પણ ન કહાય ।
 આતમ-દર્પણે રે પ્રતિબિંબ્યા સવિ તેહ,
 ભક્તિ-પ્રભાવથી રે અચરિજ મોટું છે એહ-અનંત૦ ॥૩॥
 કે કોઈ હાણી છે રે ? કે કોઈ બેસે છે દામ ?
 એક ગુણ તાહરો રે દેતાં કહું ? કિશું સ્વામી ।
 ખોટ ન તાહરે રે થાશે સેવકા રામ,
 યશ તુમ વાધશ્યે રે એક ક્રિયા દોઈ કામ-અનંત૦ ॥૪॥
 અરજ સુણી કરી રે સુ-પ્રસન્ન થઈ હવે સ્વામી ।
 એક ગુણ આપીઓ રે નિર્મલ તત્ત્વ-શ્રદ્ધાન ।
 શક્તિ-સ્વભાવથી રે નાઠા દુશ્મન દુરિ,
 વાંછિત નિપન્યા રે ઈમ કહે જ્ઞાનવિમલ સૂરિ-અનંત૦ ॥૫॥



(૧૪૬૭) શ્રી ધર્મનાથ—જિન સ્તવન (૬૦-૧૫)

(રાગ રામગિરી)

ધર્મ—જિનવર દરિસણ પાયો, પ્રબલ-પુણ્યે આજ રે ।
 માનું ભવ-જલરાશિ તરતાં, જડ્યું જંગી જહાજ રે-ધર્મં ॥૧॥
 સુકૃત-સુરતરૂ સહેજે ફળીઓ, ફરિત ટલ્યો વેગ રે ।
 ભુવન પાવન સ્વામી મિલ્યો, ટાલ્યો સકલ-ઉદ્દેગ રે-ધર્મં ॥૨॥
 નામ સમરૂં રાત-ઘીહા, પવિત્ર જિહા હોઈ રે ।
 ફરી ફરી મુજ એહ ઈહા, નેહ નયણે જોઈ રે-ધર્મં ॥૩॥
 તુંહી માતા તુંહી ત્રાતા, તુંહી બ્રાતા સયણ રે ।
 તુંહી સુરતરૂ તુંહી સદ્ગુરૂ, નિમુણી સેવક-વયણ રે-ધર્મં ॥૪॥
 આપ વિલસો મુખ અનંતા, રહ્યા દુઃખથી દૂર રે ।
 ઇણિપરે કિમ શોભશે ? કરો દાસ હનુર રે-ધર્મં ॥૫॥
 એમ વિચારી ચરણ-સેવા, દાસને ઘો દેવ રે ।
 જ્ઞાનવિમલ-જિણુંદ ધ્યાને, લહે મુખ નિત્યમેવ-રે ધર્મં ॥૬॥



(૧૪૬૮) શ્રી શાંતિનાથ—જિન સ્તવન (૬૦-૧૬)

(રાગ-ધન્યાશ્રી કડખો)

તાર ! મુજ તાર ! તાર ! જિનરાજ તું,
 આજ મેં તોહિ દીદાર પાયો ।
 સકલ-સંપત્તિ મિલ્યો આજ શુભ દિન વલ્યો,
 સુરમણિ આજ અણુચિંત આયો-તારં ॥૧॥
 તાહરી આણ હું શેષપરે શિર વહું,
 નિરાતો લદા હું રહું ચિત્ત શુદ્ધિ ।

ભમતાં ભવ-ઠાનને સુરતરૂની પરે,
તું પ્રભુ ! ઓળખ્યો દેવ બુદ્ધિ-તાર૦ ॥૨॥

અચિર-સંસારમાં સાર તુજ સેવના,
દેવના દેવ તુજ સેવ સારે ।

શત્રુ ને મિત્ર સમભાવે બેહુ ગણે,
ભકતવત્સલ સદા મિરદ ધારે-તાર૦ ॥૩॥

તાહરા ચિત્તમાં દાસ બુદ્ધિ સદા,
હું વસું એહવી વાત ફરે ।

પણ મુજ ચિત્તમાં તુંહી જો નિત વસે,
તો કિશું કીલ્યે મોહચૂરે-તાર૦ ॥૪॥

તું કૃપા-કુંભ ગતદંભ ભગવાન તું,
સકલ વિલોકને સિદ્ધિ દાતા ।

ત્રાણ મુજ પ્રાણ મુજ શરણુ-આધાર તું,
તું સખા માત ને તાત બ્રાતા-તાર૦ ॥૫॥

આતમારામ અભિરામ અભિધાન તુજ,
સમરતાં જન્મના દુરિત જાવે ।

તુજ વદન-ચંદ્રમા નિશદિન ચેષતાં,
નયન ચક્રેર આનંદ પાવે-તાર૦ ॥૬॥

શ્રી વિશ્વસેન-કુળ-કમલ-દિનકર જિશ્યો,
મન વશ્યો માત અચિર મદહાયો ।

શાંતિ-જિનરાજ શિરતાજ દાતારમાં,
અભયદાની શિરે જસ ગવાયો-તાર૦ ॥૭॥

લાજ જિનરાજ અળ દાસની તો શિરે,

અવસરે મોહરયુ' લાજ પાવે ।

પંડિતરાય કેવિ-ધોરવિમલ તણા

સૌસ ગુણ જ્ઞાનવિમલાદિ ગાવે-તાર૦ ॥૮૧॥



(૧૪૬૯) શ્રી નેમિનાથ-જન સ્તવન (૬૦-૨૨)

(તીરથની આશાતના નવિ કરીએ-એ રાગ)

શિવાનંદનકું ખેલાવે હરિગોરી,

હારે હરિગોરી ખેલાવે હોરી;

હારે સરોવરીયાને તીર

નેમકુંવર કેડે પડી હરિગોરી-શિવા૦ ૧

કેસરીયા વાઘા ધરી હરિ પાસે,

હારે હરિ પાસે રે ફૂલવાસે;

હારે ફૂલ વાસે રે જળવાસે,

હારે રાધા સહુ સાથ-

-નેમકુમર ખેલાવતી તિહાં હોરી-શિવા૦ ૨

નેમ-નગીના નાથજી હોરી ખેલે,

હારે હોરી ખેલે રસીયા ખેલે ।

હારે રંગભરી ભરીરે કચોલે

હારે ઝક ઝોલે નેમ;

કેશવ કેસુડા ભરી રસ ઘોળે-શિવા૦ ૩

કાગ રાગ રસ રીતસે' ગીત ગાવે,

હારે ગીત ગાવે તાન બજાવે ।

હારે હોરી કુશા ખ્યાલ, ખેલવિ,
 હારે ઉડે લાલ ગુલાલે;
 લાલ કન્હૈયાં લાલસે પ્રભુ ખેલે-શિવાં ૪
 ચંપક કેતકી માલતી વાસંતી,
 હારે વસંતે તરુવર ફલિયાં,
 હારે પ્રભુ દેખી વિનયસેં ટલિયાં,
 હારે વાજે વીણા રસાળ,
 તાલ-કંસાલ મૃદંગસે હોરી ખેલે-શિવાં ૫
 ગોવિંદ ગોપી સાથમેં પ્રભુ રમતે,
 હારે તીનસેં વરસાં નિગમતે,
 હારે રાજ્યલસેં મિલણાં કરતે,
 હારે સહસ્રાવન સાંઈ,
 -સંજમ સાધી કેવળી હુઆ જ્ઞાની-શિવાં ૬
 રાજ હુઈ રાજમતી વ્રત લીધું,
 હારે પોતાનું જોલ્યું કીધું,
 હારે નાથ સરીખું નાથ તે લીધું,
 -શિવ (મોક્ષ) મંદિરમેં મહાલતે જોઈ જોડી-શિવાં ૭
 જિન ગુણ રાગ સુકાગમેં ભવિ ગાવો,
 હારે દોય ધ્યાન મૃદંગ મઢાવો,
 હારે તિંહુ શુદ્ધિ વેણુ વજાવો,
 હારે કંસતાલ વિશાલ,
 -ચાર શતકની ભાવના ચક્રતાલા-શિવાં ૮

હાસ્ય રતિને મોહ અખીર વિખરીયાં,
 હારે અનુભવ રસ ઘોળ કેસરીયાં,
 હારે શુભવીર વચન રસભરીયાં
 હારે ભાવ હોરી ખેલાય;
 સાકારે શિવસુંદરી ઘર લાવો-શિવા-૬



(૧૪૭૦) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ (૬૦-૨૩)

જિન-સ્તવન

સાર કર સાર કર સ્વામી શંખેશ્વર !
 વિશ્વ-વિખ્યાત એકાંત આવો ।
 જગતના નાથ ! મુજ હાથ ઝાલો કરી,
 આજ કીમ કાજમાં વાર લાવો-સાર-૧૧૥
 હૃદય મુજ રંજણે શત્રુ-હઃખ ભંજણે,
 છુટ પરમેષ્ટ મોહે તુંહી સાચો ।
 ખલક ખીજમત કરે વિપત્તિસમે ખીણ ભરે,
 નવિ રહે તાસ અભિલાષ કાચો-સાર-૧૨૥
 યાદવા રણુજણે રામ-કેશવ રણે,
 મમ લાગી જરા નિંદ સોતી ।
 સ્વામી શંખેશ્વર ચરણુજળ પામીને,
 યાદવોની જરા ભય રોતી-સાર-૧૩૥
 આજ જિનરાજ ઉંઘે કીસ્થુ આસને,
 ભગ મહારાજ સેવક પનોતા ।

સુખદિ મળે ટળે દુરિત દોલત કરે,
 વીર-હાઠે રિપુ-વૃન્દ રેતા-સાર૦ ॥૪૮॥
 દાસ છું જન્મનો પુરીએ કામના,
 ધ્યાનથી માસ દસ હોય વીત્યા ।
 વિકટ સંકટ હરો નિકટ નયણાં કરો,
 તો અમે શત્રુ નૃપતિકું છુટ્યા-સાર૦ ॥૪૯॥
 કાળમુખો અશન શીતકાળે વસન,
 શ્રમ સુખાસન રણે ઉઠક દાઈ ।
 સુગુણ-નર સાંભળે વિસરે નહિ કદા,
 પાસ જ તું સદા છે સખાઈ-સાર૦ ॥૫૦॥
 માત તું ! તાત તું ! ભાત તું ! દેવ તું !
 દેવ દુનિયામાં દુખો ન વહાલો ।
 શ્રી શુભવીર જગજીત ડંકો કરે,
 નાથજી નેક-નયણે નિહાળો-સાર૦ ॥૫૧॥



(૧૪૭૧) શ્રી પાર્શ્વનાથ-જિન સ્તવન (૬૦-૨૩)

(શાન્તિ જિન એક મુજ વિનતિ-એ દેશી)

પાસ જિન ! તાહરા રૂપનું, મુજ પ્રતિભાસ કેમ હોય રે ?
 તુજ મુજ સત્તા-એકતા, અ-ચલ વિ-મલ અ-કલ બેય રે-
 -પાસ૦ ૧

મુજ પ્રવચન-પક્ષથી, નિશ્ચય લેઈ ન કોય રે ।

વ્યવહારે લખી દેખીએ, લેઈ-પ્રતિલેઈ બહુ લોય રે-પાસ૦ ૨

બંધન મોક્ષ નહિ નિશ્ચયે, વ્યવહારે ભજ દોય રે ।

અ-ખંડિત અ-આધિત સોય કદા,

નિજ અ-આધિત સોય રે-પાસ૦ ૩

અ-વય-હેતુ-વ્યતિરેકથી, અંતરે તુઝ મુઝ રૂપ રે ।

અંતર મેટવા કારણે, આત્મ-સ્વરૂપ અનૂપ રે-પાસ૦ ૪

આતમતા પરમાતમતા, શુદ્ધ નય ભેદ ન એક રે ।

અવર આરોપિત ધર્મ છે, તેહના ભેદ અનેક રે-પાસ૦ ૫

ધરમી-ધરમથી એકતા, તેહ મુજ રૂપ-અ-ભેદ રે ।

એક-સત્તા લખ એકતા, કહે તે મૂઠ મતિ ખેદ રે-પાસ૦ ૬

આતમ-ધરમ અનુસરી, રમે જે આતમ રામ રે ।

આનંદધન પદવી લહે, પરમ-આતમ તસ નામ રે-પાસ૦ ૭



(૧૪૭૨) શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિન-સ્તવન

(૬૦-૨૩)

શ્રી ચિંતામણી-પાર્શ્વે રે ? વાત સુણો એક મોરી રે ।

મહારા મનના મનોરથ પૂરજો,

હું તો ભક્તિ ન છોડું તોરી રે-શ્રી૦ ૧૧૧

માહરી ખિજમતમાં ખામી નહિ રે,

તાહરે ખોટ ન કાંઈ ખજાને રે ।

હવે દેવાની શી ઢીલ છે ? કહેવું તે કહીયે છાને રે-શ્રી૦ ૧૧૨

તેં ઉરણ સવી પૃથ્વી કરી રે, ધન વરસી વરસી-દાને રે ।

માહરી વેળા શું એહવા,

દીઓ વાંછિત વાળો વાન રે-શ્રી૦ ૧૧૩

હું તો કેડ ન છોડું તાહરી રે,
 આખ્યા વિણ શિવ-સુખ સ્વામી રે ।
 મૂરખ તે ઓછે માનશે,
 ચિંતામણિ કર-યલ પામી રે-શ્રી૦ ॥૪॥

મત કહેશ્યો તુજ કર્મે નથી રે, કર્મે છે તો તું પામ્યો રે ।
 મુજ સરીખા કીધા મોટકા,
 કહો તિણે કાંઈ તુજ ધામ્યો રે-શ્રી૦ ॥૫॥

કાલ સ્વભાવ ભવિતવ્યતારે, તે સઘળા તારા ઘસો રે ।
 મુખ્ય હેતુ તું માક્ષનો,
 એ મુજને સ-ખલ વિશ્વાસો રે-શ્રી૦ ॥૬॥

અમે ભકતેં મુકિતને ખેચશું રે,
 જિમ લોહને ચમક-પાવાણો રે;
 તુમ્હે હજે હસીને દેખશો,
 કહેશો સેવક છે સપરાણો રે-શ્રી૦ ॥૭॥

ભક્તિ આરાધ્યા ફળ દીએ રે, ચિંતામણી પણ પાવાણો રે ।
 વળી અધિકું કાંઈ કહાવશો,
 એ ભદ્રક ભક્તિ તે જાણો રે-શ્રી૦ ॥૮॥

ખાળકને તે જિમ-તિમ ખોલતો રે, કરે લાડ તાતને આગે રે ।
 તે તેહશું વંછિત પૂરવે,
 ખની આવે સઘળું રાગે રે-શ્રી૦ ॥૯॥

માહરે ખનનારું તે ખન્યું જ છે રે,
 હું તો લોહને વાત શીખાવું રે ।
 વાચક જશ કહે સાહિબા !,
 એ રીતે તુમ ગુણ ગાવું રે-શ્રી૦ ॥૧૦



(૧૪૭૩) સુરજ મંડણ શ્રી પાર્શ્વનાથ જિન-સ્તવન
(૬૦-૨૩)

(સાહિબ ! વાસુપુન્ય જિહ્વંદા-એ દેશી)

સૂરજમંડન-પાસ-જિહ્વંદા, અરજ સુનો ટાલો દુઃખદંદા ।
-સાહિબા ! રંગીલા રે હમારા મોહના રે-જીવના રે ।

તું સાહિબા ! હું છું તુજ-ખંદા !,

પ્રીતિ ખની જિહ્વં કૈરવ-ચંદા-સાહિબાં ॥૨૧॥

તુઝચૂં નેહ નહીં મુઝ કાચો,

૧ ઘણી ન લાજઈ હીરો જાચો-સાહિબાં ॥૨૩॥

દેતાં દાન તે કાંઈ વિમાસો,

લાગઈ મુઝ મનિ એહ તમાસો.-સાહિબાં ॥૨૪॥

કેડિ લાગો તે કેડિ ન છોડઈ,

દિઓ વાંછિત સેવક કર જોડઈ.-સાહિબાં ॥૨૫॥

અ-ખય ખજનો તુઝ નવિ ખૂટઈ,

હાથ થકી તો ચૂં નવિ છૂટઈ ?-સાહિબાં ॥૨૬॥

જો ખિજમતમાં ખામી દાખો,

તો પશ્ચિ નિજ જાણી હિત રાખો ! સાહિબાં ॥૨૭॥

ધેનુ કૂપ આરામ સ્વભાવે,

દેતાં દેતાં સંપત્તિ પાવઈ-સાહિબાં ॥૨૮॥

તિમ મુઝનઈ તુઝે જો ગુણ દેસ્યો,

તો જગમાં યશ અધિક વહેસ્યો-સાહિબાં ॥૨૯॥

૧ ઘણું = લોખંડના મોટા હથોડાથી ઝીણો હીરો ન તુટે. ત્રીજી ગાથાની
બીજી લીટીનો માટે,

અધિકું ઓછું કિસ્યું રે કહાવો ?

જિમ તિમ સેવક-ચિત્ત મનાવો-સાહિબાં ॥૧૧॥

માગ્યા વિણ તો માધ ન પીરસે,

એ ઉખાણો સાચો દીસઈ-સાહિબાં ॥૧૨॥

ઈમ જાણીરે વીનતિ કીજઈ,

મોહનગારા ! મુજરા લીજઈ-સાહિબાં ॥૧૩॥

વાચક જશ કહે' ખમીય આસંગો,

દિઓ શિવ-સુખ ધરિ અ-વિહડ રંગો-સાહિબાં ॥૧૪॥



(૧૪૭૪) શ્રી પાર્શ્વનાથ જિન-સ્તવન (૬૦-૨૩)

(કહણી કરણી તુજ વિણુ સાચો કોઈ ન દેખ્યા જોગી-
એ દેશી)

પાસ-પ્રભુ પ્રભુમું સિર નામી, આતમ-ગુણ અભિરામી રે ।
પરમાનંદે પ્રભુતા પામી,

કામિતદાર્ઠ અ-કામી રે-પાસં ॥ ૧ ॥

ચોવિશમાં થે' તેવીસા, ફરી કર્યા તેવીસા રે ।

ટાળ્યા જેણે ગતિ-ચિતિ ચોવિશા,

આયુ ચતુષ્ક પશુવીસા રે-પાસં ॥૨॥

લેહ કુધાતુ કરે જે કંચન, તે પારસ પાષાણો રે ।

નિર્વિવેક-પણિ તુમચે નામે,

એ મહિમા સુપ્રમાણો રે-પાસં ॥૩॥

ભાવે ભાવ-નિશ્ચયે મિલતા, લેહ રહે કિમ જાણો રે ।

તાને તાન મિલે શ્યો અંતર ?

એહવેા લોક-ઉખાણેા રે-પાસ૦ ॥૪॥

પરમ-સરૂપી પરમ-રસસુ', અનુભવ-પ્રીતિ લગાઈ રે ।

હોય ટળે હોય દહિટ સુનિર્મલ,

અનુપમ એહ ભલાઈ રે-પાસ૦ ॥૫॥

કુમતિ-ઉપાધિ કુધાતુને તણ્યે.

નિરૂપાધિક ગુણ ભણ્યે રે ।

સોપાધિક-સુખ-દુઃખ પરમારથ,

તેહ લહે નવી રંણ્યે રે-પાસ૦ ॥૬॥

એ પારસથી કંચન બાયુ', તેહ કુધાતુ ન હોવે રે ।

તેમ અનુભવ-રસ-ભાવે લેધો,

શુદ્ધ-સરૂપે ભુવે રે-પાસ૦ ॥૭॥

વામા-નંદન ચન્દન-શીતલ, દર્શન બસ વિલાસે રે ।

જ્ઞાનવિમલ પ્રભુતા ગુણ વાધે,

પરમાનન્દ વિલાસે રે-પાસ૦ ॥૮॥



(૧૪૭૫) શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ જિન સ્તવન

(૬૦-૨૩)

જય જય જય જય પાસ-જિણુંદ ! ।

અંતરીક્ષ પ્રભુ ! ત્રિભુવન-તારન,

ભવિક-કમલ-ઉલ્લાસ-દિણુંદ-જય૦ ॥૧॥

તોરે ચરન શરન મેં કીને, તુમ બિનુ કુણ તોરે ભવ-કુંદ ?

પરમ-પુરૂષ પરમારથ-દશી^૧,

તું દિયે ભવિકકું પરમાનંદ-જયં ॥૨॥

તું નાયક તું શિવ-સુખ-દાયક, તું હિત-ચિંતક તું સુખ-કંદ ।

તું જન-રંજન તું ભવ ભંજન,

તું કેવલ-કમલા-ગોવિંદ-જયં ॥૩॥

કોડિ દેવ મિલકે કર ન શકે, એક અંગુઠ ૩૫^૧ પ્રતિષ્ઠં ।

એસો અદ્ભુત ૩૫ તિહારો,

વરસત માનું અમૃતકો ખુંદ-જયં ॥૪॥

મેરે મન મધુકરકે મોહન, તુમ હો । વિમલ-સ-દલ અરવિંદ ।

નયન-ચકોર વિલાસ કરતું હે,

દેખત તુમ સુખ પુરન-ચંદ-જય જયં ॥૫॥

ફર ભાવે પ્રભુ ! તુમ દરિશનતોં,

દુઃખ-દોહડગ-દાલિદ્ર-અધ-દંદ ।

વાયક જશ કહે સહસ ફલતોં તુમ હો,

જે ખોલે તુમ શુનકે વૃંદ-જયં ॥૬॥



(૧૪૭૬) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન (૬૦-૨૩)

રાગ-ધમાલ

ચિદાનંદ-ધન પરમ-નિરંજન, જન-મન-રંજન દેવ-લલના ?

વામા-નંદન જિનપતિ થુણીએ, સુરપતિ જસ કરે સેવ,

મનમોહન જિનજી ભેટીએ હો ।

-અહો મેરે લલના ! મેટીએ પાપકો પૂર-મનં ॥૧॥

કેસર ઘોળી ઘસી ઘનચંદન, આનંદન ઘનસાર-લલના ।

પ્રભુજીકી પુજા કરી મન-રંગે,

પાઈએ પુણ્ય અપાર-મન૦ ॥૨॥

બાઈ ભુઈ ચંપક કેતકી, દમણે ને મચકુંદ-લલના ।

કુંદ પિયંશુ રૂચિ સુંદર જોડી,

પૂજાએ પાસ-જિજ્ઞંદ-મન૦ ॥૩॥

અંગી ચંગી અંગ બનાઈ, અલંકાર અતિસાર-લલના ।

દ્રવ્યસ્તવ વિધિ પૂરણ વિરચી, ભાવીએ ભાવ-ઉદાર-મન૦ ॥૪॥

પરમાત્મ પૂરણ ગુણ પરતક્ષ, પુરૂષોત્તમ પરધાન-લલના ।

પ્રગટ-પરભાવ પ્રભાવતી-વલ્લભ,

તું જયો સુગુણ-નિધાન-મન૦ ॥૫॥

જો તુજ લક્ષિત મયૂરી સુજ મન,

વન વિચરે અતિ ચિત્ત-લલના ।

દુરિત-ભુજંગમ બંધન ત્રુટે,

તું સઘલો જગ-મિત્ત-મન૦ ॥૬॥

તુજ આણા સુરવેલી સુજ મન,

નંદન વન જિહ્વા રૂઢ-લલના ।

કુમતિ-કદાચિહ્ન કંટક-શાખી,

સંભવે તિહાં નહી ગૂઢ-મન૦ ॥૭॥

લક્ષ્મિરાગ તુજ આણા-આરાધન,

દોય ચક્ર-સંચાર-લલના૦ ।

સહસ અઢાર સૌભાંગરથ ચાલે,

વિધન-રહિત શિવ દુવાર-મન૦ ॥૮॥

શુર ઉપદેશે જો મુજ લાગ્યો, તુજ શાસનકો રામ-લલના ।
મહાનંદ પદ જોય લીએંગો,

જ્યું અલિ કુસુમ-પરાગ-મન૦ ॥૬૮॥

બાહિર મન નિકસત નાહિ આહત,

તુજ શાસનમેં લીન-લલના ।

ઉમગ-નિમગ કરી નિજ પદ રહેવે,

જ્યું જલનિધિ માંહી મીન-મન૦ ॥૬૯॥

મુજ તુજ શાસન-અનુભવકો રસ,

કયું કરી જાણે લોગ ?-લલના ।

અ-પરિણીત-કન્યા નવિ જાણે,

જ્યું મુખ દયિત-સંયોગ-મન૦ ॥૭૦॥

ઓરનકી ગણના નાહિ પાઉં, જો તું સાહિબ એક-લલના ।

ફલે વાસના દદ નિજ-મનકી,

જો અ-વિચલ હોય ટેક-મન૦ ॥૭૧॥

તું સાહિબ હું સેવક તેરો, એ વ્યવહાર-વિભાગ-લલના ।

નિશ્ચય-નય-મત દોનું બિચે,

હોય નહિ ભેદકો લોગ-મન૦ ॥૭૨॥

મન-વચનાદિ-પુદ્ગલ ન્યારા, નાસે સકળ-વિભાવ-લલના ।

શુદ્ધ-દ્રવ્ય શુભ-પર્યાય-ઘટના,

તુજ-સમ શુદ્ધ-સ્વભાવ-મન૦ ॥૭૩॥

તું ઘટ-અંતર પ્રગટ વિરાજે,

જ્યું નિર્મલ શુભ-કાંત-લલના ।

બાહિર-દુઠત મૂઢ ન પાવે,

જ્યું મૃગમદ-મન-બ્રાંત-મન૦ ॥૭૪॥

ગુણઠાણાદિકે-ભાવે મિશ્રિત, સખમે' હે તુજ અંશ-લલના ।
ખીર-નીર જ્યૂં લિન્ન કરત હૈ,

ઉજવલ-અનુભવ-હંસ-મન૦ ॥૧૬॥

આતમજ્ઞાન-દશા જસ-બગી, વૈરાગી તુજ-જ્ઞાન-લલના ।
સો પાવે જ્યૂં રતન પરીક્ષા,

પરખત રતન પ્રધાન-મન૦ ॥૧૭॥

પુણ્ય-પ્રમટ દેવનકો લચ્છન, મૂઠ લહે નાંહિ ધર્મ-લલના ।
જ્યૂં પિયરાકું કંચન માને,

લહે નાંહી અંતર-મર્મ-મન૦ ॥૧૮॥

અંધ-રૂપ-રસ-ફરસ-વિવર્જિત, ન ધરત હૈ સંઠાણુ-લલના ।
અન-અવતાર અ-શરીર-અવેહી,

તું પ્રભુ ! સિદ્ધ-પ્રમાણુ-મન૦ ॥૧૯॥

કેવલજ્ઞાન-દશા અવલોકી, લોકાલોક-પ્રમાણુ-લલના ।
દર્શન-વીર્ય-ચરણુ ગુણધારી,

શાશ્વતા સુખ-અહિઠાણુ-મન૦ ॥૨૦॥

સત્તા શુદ્ધ અ-રૂપી તેરી, નહિ જગકો વ્યવહાર-લલના ।
કા કહીએ? કછુ કહ્યો ન બાએ,

તું પ્રભુ ! અ-લખ અ-પાર-મન૦ ॥૨૧॥

દીપ-ચંદ્ર-રવિ-ચંદ્ર-ગણુ

કેરો, જિહાં પસરત નાંહિ તેજ-લલના ।

તિહાં એક તુજ ધામ વિરાજે,

નિર્મલ ચેતના સેજ-મન૦ ॥૨૨॥

શુદ્ધ-પ્રકૃતિ અક્ષયી, અ-માયી,

તું પ્રભુ ! બહુ શુભવંત-મનં ॥૨૩॥

તું માતા ! તું ત્રાતા ! બ્રાતા, પિતા બંધુ તું મિત્ર-લલના ।
શરણુ તુંહી તુજ સેવા કીજે,

દૃઢ કરી એક જ ચિત્ત-મનં ॥૨૪॥

પાસ આશ પુરો અબ મેરી, અરજ એક અવધાર-લલના ।
શ્રીનયવિજય-વિબુધ-પાય સેવક,

જશ કહે ભવ-જલ તાર-મનં ॥૨૫॥



(૧૪૭૭) શ્રી પાર્શ્વનાથ જિન-સ્તવન (૬૦-૨૩)

(ભાવપૂજા રહસ્ય)

(૨)

(શાલિભદ્ર ભોગી રહ્યો-એ દેશી)

પૂજા વિધિ માંહે ભાવિયેજી, અંતરંગ જે ભાવ ।

તે સવિ તુઝ આગલ કહુંજી, સાહેબ ! સરલ-સ્વભાવ-

-સુહંકર ! અવધારો પ્રભુ પાસ ! ॥૧॥

દાતણુ કરતાં ભાવિયેજી, પ્રભુ-શુભ જલ મુખ-શુદ્ધ ।

ઉલ ઉતારી પ્રમત્તતાજી,

હો ! મુઝ નિર્મલ બુદ્ધ-સુહંકરં ॥૨॥

જતનાયે સ્નાન કરીજીએજી, કાઢો મેલ મિથ્યાત ।

અંગુષ્ઠો અંગ શોભવીજી, બાણું હું અવદાત-સુહંકરં ! ॥૩॥

ક્ષીરોદ્ધકનાં ઘોતીયાંજી, ચિંતવો ચિત્ત-સંતોષ ।

અષ્ટકર્મ સંવર ભલોજી, આઠ પડો મુહકોષ-મુહકંકરં ॥૪॥

ઝોરસીયો ઝોકાગ્રતાજી, કેસર ભક્તિ કલ્લોલ ।

શ્રદ્ધા ચંદન ચિંતવોજી, ધ્યાન ઘોલ રંગરોલ-મુહકંકરં ॥૫॥

ભાલ વહું આણા ભલીજી, તિલક તણે તેહ ભાવ ।

જે આભરણ ઉતારીયેજી, તે ઉતારો પરભાવ-મુહકંકરં ॥૬॥

જે નિર્માલ્ય ઉતારીયેજી, તે તો ચિત્ત ઉપાધિ ।

પખાલ કરતાં ચિંતવોજી,

નિર્મલ ચિત્ત-સમાધિ-મુહકંકરં ॥૭॥

અંગ લૂહણાં બે ધર્મનાજી, આત્મ-સ્વભાવ જે અંગ ।

જે આભરણ પહેરાવીએજી,

તે સ્વભાવ નિજ અંગ-મુહકંકરં ॥૮॥

જે નવ-વાડ વિશુદ્ધતાજી, તે પૂજા નવ-અંગ ।

પંચાચાર-વિશુદ્ધતાજી, તેહ ફૂલ પંચરંગ-મુહકંકરં ॥૯॥

દીવો કરતાં ચિંતવોજી, જ્ઞાન-દીપક સુ-પ્રકાશ ।

નય-ચિંતા ઘૂત પૂરિયુંજી,

તત્ત્વ-પાત્ર સુવિલાસ-મુહકંકરં ॥૧૦॥

ધૂપ રૂપ અતિ કાર્યતાજી, કૃષ્ણ-ગરૂનો જોગ ।

શુદ્ધ-વાસના મહમહેજી,

તે તો અનુભવ-યોગ-મુહકંકરં ॥૧૧॥

મહ-સ્થાનક અડ છાંડવાજી, તેહ અષ્ટ-મંગલિક ।

જે નેવેઘ નિવેદીયેજી, તે મન નિશ્ચલ-ટેક-મુહકંકરં ॥૧૨॥

લવણ ઉતારો ભાવીએજી, કૃત્રિમ ધર્મનો રે ત્યાગ ।

મંગલ દીવો અતિ લલોલ,

શુદ્ધ-ધર્મ પરભાગ-સુહંકરં ॥૧૩॥

ગીત-નૃત્ય વાજિંત્રનોલ, નાદ અનાહત સાર ।

શમ-રતિ રમણી જે કરીલ,

તે સાચો થેઈકાર-સુહંકરં ॥૧૪॥

ભાવ પૂજા એમ સાચવીલ, સત્ય બળઓ રે ઘંટ ।

ત્રિભુવન માંહે તે વિસ્તરેલ,

ટાલે કર્મનો કંટ-સુહંકરં ॥ ૧૫ ॥

એણી પરે ભાવના ભાવતાલ, સાહેબ જસ-સુપ્રસન્ન ।

જનમ સફલ જગ તેહનોલ,

તેહ પુરૂષ ધન્ન ધન્ન-સુહંકરં ॥૧૬॥

પરમ-પુરૂષ પ્રભુ શામલાલ, માનો એ મુજ સેવ ।

દૂર કરો ભવ આમલાલ,

વાચક જશ કહે દેવ-સુહંકરં ॥૧૭॥



[આ સ્તવન સાથે પૂ. ઉપાધ્યાયજીવું 'ભાવપૂજાષ્ટક' તેમની પ્રસિદ્ધ કૃતિ 'જ્ઞાનસાર'માંથી અત્ર સાર્થ આપવામાં આવે છે, તેની સાથે અરખાવો :-

દયાંમસા કૃતસ્નાનઃ, સંતોષ-શુભવસ્ત્રમૃત્ ।

વિવેક-તિલક-બ્રાજી, ભાવના-પાવનાશયઃ ॥૧॥

મક્તિ શ્રદ્ધાન-ધુસૃણો-ન્મિશ્ર-કસ્મીરજદ્રવૈઃ ।

નવ-બ્રહ્માંગતો દેવં, શુદ્ધમાત્માનમર્ચય ॥૨॥

ક્ષમા-પુષ્પસ્રજં ધર્મ-યુગ્મક્ષૌમદ્વયં તથા ।
 ધ્યાનાભરણસારં ચ તદંગે વિનિવેશય ॥૩॥
 મદસ્થાન-ભિદાત્યાગૈ-લિંચાગ્રે ચાષ્ટમંગલીં ।
 જ્ઞાનાગ્નૌ શુભસંકલ્પ-કાકતુંડં ચ ધૂપય ॥૪॥
 પ્રાગ્ધર્મલવણોત્તારં, ધર્મસંન્યાસ-વહ્નિના ।
 કુર્વન્ પૂરય સામર્થ્ય-રાજન્નીરાજનાવિધિમ્ ॥૫॥
 સ્ફુરન્મંગલદીપં ચ, સ્થાપયાનુભવં પુરઃ ।
 યોગનૃત્યપર-સ્તૌર્ય-ત્રિક-સંયમવાન્ ભવ ॥૬॥
 ઉલ્લસન્મનસઃ સત્ય-ઘંટાં વાદયતસ્તવ ।
 ભાવપૂજારતસ્યેત્થં, કરક્રોડે મહોદયઃ ॥૭॥
 દ્રવ્યપૂજોચિતા ભેદો-પાસના ગૃહમેધિનાં ।
 ભાવપૂજા તુ સાધૂના-મભેદોપાસનાત્મિકા ॥૮॥

ભાવપૂજા અષ્ટકનો ભાવાર્થ

દયારૂપી જલરૂપી જેણે સ્નાન કર્યું છે, સંતોષરૂપી શુભ
 વસ્ત્રો જેણે ધારણ કર્યાં છે,
 વિવેકરૂપી તિલકરૂપી જે શોભે છે, ભાવનાએ કરીને
 જેનો આશય પવિત્ર છે,
 એવા તમે ભક્તિ અને શ્રદ્ધારૂપી કેશરૂપી મિશ્રિત
 ચંદને કરીને નવ બ્રહ્માંડે શુદ્ધાત્મારૂપ દેવની પૂજા કરો. ૧-૨
 ક્ષમારૂપી પુષ્પોનો હાર, (દેશવિરતિ અને સર્વ વિરતિ)
 એ ધર્મરૂપી એ વસ્ત્રો અને ધ્યાનરૂપી શ્રેષ્ઠ આભરણ તે
 પ્રભુના અંગે સ્થાપો. ૩

મહ સ્થાનના (આઠ પ્રકારના) ત્યાગે કરીને તે દેવની સમક્ષ આઠ મંગલ રચો અને જ્ઞાનાગ્નિને વિષે શુભ સંકલ્પ રૂપ કૃષ્ણાગરનો ધૂપ કરો. ૪

ધર્મ સંન્યાસરૂપી અગ્નિએ કરીને પૂર્વધર્મોના ત્યાગ રૂપે લવણોત્તાર કરીને સામથર્થ-યોગવડે શોભતી આરતીની વિધિ કરો. ૫

અનુભવરૂપી સ્ફુરતો મંગલદીપ તે દેવની આગળ સ્થાપો, યોગરૂપી નૃત્યને વિષે તત્પર થાઓ અને ત્રણ તૌર્થ [ઇન્દ્રિય, યોગ અને કષાયના નિગ્રહરૂપ] વાદ ધ્વનિઓ રૂપ સંયમવાળા થાઓ. ૬

આ પ્રમાણે ભાવપૂજાને વિષે તત્પર, ઉલ્લાસયુક્ત મન-વાળા અને સત્ય ઘંટાનાદ કરનારાઓનો મહોદય હાથની હથેળીમાં છે. ૭

લેહ રૂપે આરાધનારૂપ દ્રવ્યપૂજા ગૃહસ્થાને ઉચિત છે અને અભિન્ન આરાધના સ્વરૂપ ભાવપૂજા સાધુઓને ઉચિત છે. ૮

*

(૧૪૭૮) શ્રી મહાવીર જિન-સ્તવન (૬૦-૨૪)

(પંથડા નિહાળું રૂ બીજા જિન તણો-એ દેશી)

ચરમ-જિણેસર વિગત સ્વરૂપનું ભાવું કેમ સ્વરૂપ ? ।

સાકારી વિષ્ણુ-ધ્યાન ન સંભવે રે,

એ અ-વિકાર અ-રૂપ-ચરમ ॥૧૧॥

આપ સરૂપે રે આતમમાં રમે રે, તેહના ધુર એ લેહ ।

અસંખ ઉદ્ધૃતોસે સાકારી પડે રે,

નિરાકારી નિરલેહ-ચરમ૦ ॥૨॥

સુખમ નામકરમ નિરાકાર જે રે, તેહ લેહે નહિ અંત ।

નિરાકાર જે નિરગતિ કર્મથી રે,

તેહ અ-લેહ અનંત-ચરમ૦ ॥૩॥

રૂપ નહિ કંઈયે બંધન ઘટ્યું રે, બંધન મોક્ષ ન કોય ।

બંધ મોખ વિષ્ણુ સાદિ અનંતનું રે,

ભંગ સંગ કેમ હોય-ચરમ૦ ॥૪॥

દ્રવ્ય વિના તેમ સત્તા નવી લહે રે, સત્તા વિષ્ણુ રથો રૂપ ?

રૂપ વિના કેમ સિદ્ધ અનંતતા રે ?

ભાવું અ-કલ સ-રૂપ-ચરમ૦ ॥૫॥

આત્મતા પરિણતિ જે પરિણમ્યા રે, તે મુજ લેહાલેહ ।

તદાકાર વિષ્ણુ મારા રૂપનું રે,

ધ્યાવું વિધિ-પ્રતિષેધ-ચરમ૦ ॥૬॥

અંતિમ ભવ-ગહણે તુજ ભાવનું રે, ભાવશું શુદ્ધ સ્વરૂપ ।

તર્થએ આનંદધન પદ પામશું રે,

આત્મરૂપ અનૂપ-ચરમ૦ ॥૭॥



(૧૪૭૯) શ્રી મહાવીર-જિન સ્તવન (૬૦-૨૪)

(રાગ : મારણી ધનશ્રી; ગિરિમાં ગારો ગિરિઓ મેર
ગિરિ ચઢે રે-એ દેશી)

કરણા-કલપક્ષતા શ્રી મહાવીરની રે,
ત્રિભુવન મંડપમાંહિ પસારી રે;
-મીસરી રે પરે મીઠી અભયે કરી રે ॥૧॥

શ્રીજિન-આણા ગુણુઠાણે આરોપતાં રે,
વિરતિતણે પરિણામ પાવને રે;
અવને રે અતિહી અ-માય-સલાવ રે ॥૨॥

સર્વ-સંવર-ફલતી મિલતી અનુભવે રે,
શુદ્ધ અનેકાંત-પ્રમાણે ભલતી રે;
ફલતી રે સંશય-ભ્રમના તાપને રે ॥૩॥

ત્રિવિધ વીરતા જેણે મહાવીરે આદરી રે,
દાન યુદ્ધ-તપ રૂપ અભિનવ રે;
ભવોભવિ રે દ્રવ્ય-ભાવથી ભાપી રે ॥૪॥

હાટક કોડી દેઈ દારિદ્ર નસાડીઉં રે,
ભાવે અભયનું દાન દેઈ રે;
કોઈ રે લેઈને સુખીઆ થયા રે ॥૫॥

રાઆદિક અરિ મૂલ થકી ઉખેડીયા રે,
લહી સંયમ-રક્ષરંગ રોપી રે ।

ઓપી રે જિણે આપ કલા નિરાવરણની રે ॥૬॥
નિશાંસ વળી શિવસુખ હેતુ ક્ષમા ગુણે રે,

તપ તપીએ જિજ્ઞે એમ આપે રે,
આપે રે વરપાંડિત વીર્ય વિનોદથી રે ॥૭૭॥

દર્શન જ્ઞાન-ચારિત્ર ત્રિવિધની વીરતા રે,
મહાપદ શોભિત ભાવી ભાસે રે;
વાસે રે ત્રિભુવન જનમન બાયણા રે ॥૮૦॥

વીર-ધીર કોટિર કૃપારસનો નિધિ રે,
પરમાનંદ પયોદ વ્યાપે રે,
આપે રે નિજ સંપદ કૂળ યોગ્યતા રે ॥૮૧॥

બંધ-ઉદ્ધય-સત્તાદિક ભાવાભાવથી રે
ત્રિવિધ વીરતા જાસ જાણી રે
આણી રે ત્રિપદીરૂપે ગણધરે રે ॥૮૨॥

ઠાણુગ જાણુગ ગુણુઠાણુક ત્રિહું વિધિ રે,
કાઢ્યા જેણે ત્રિદોષ પોષો રે;
શોષો રે શોષ-તોષ કીધા તુને રે ॥૮૩॥

સહજ-સ્વભાવ સુધારસ સેચનવૃદ્ધિથી રે,
ત્રિવિધ-તાપનો નાશ હાવે રે;
જોવે રે ત્રિભુવન ભાવ સ્વભાવથી રે ॥૮૪॥

જ્ઞાનવિમલ ગુણ-મણિ-રોહણ-ભૂધરા રે,
જય જય તું ભગવાન ગાયા રે;
હાયક રે અખય અનંત સુખનો સદા રે ॥૮૫॥



(૧૪૮૦) શ્રી મહાવીર જિન-સ્તવન (૬૦-૨૪)

(કોઇ વિધિ જોતાં થકા રે-એ દેશી)

શ્રી વર્ધમાન જિનરાજીઆ રે!

રાજનગર-શણ્ણગાર રે-સુખ દરિયા ।

વાલેસર ! સુણો વિનતી રે,

તું મુજ પ્રાણુ-આધાર રે-ગુણ ભારિયા ॥૧॥

તુજ વિણ હું ન રહી શકું રે,

જિમ બાલક વિણ માત રે-સુખં ।

ગાઈ દિન અતિ વાહીએ રે,

તાહરા ગુણુ અવદાત રે-ગુણું ॥૨॥

હવે મુજ મંદિર આવીયે રે,

મ કરો દેવ ! વિલંબ રે-સુખં ।

ભાણા ખડખડ કુણુ ખમે રે !,

પૂરો આશા અવિલંબ રે-ગુણું ॥૩॥

મન મંદિર છે માહરં રે,

પ્રભુ તુજ વસવા લાગ રે-સુખં ।

માયા-ઠંટક કાઢીયા રે,

કીધો ક્રોધ-રજ-ત્યાગ રે-ગુણું ॥૪॥

અગટી સુરૂચિ સુવાસનારે,

મૃગમદ-મિશ્ર કપુર રે-સુખં ।

ધૂપ-ઘટી ઇહાં મહમહેરે,

શાસન-શ્રદ્ધા પૂર રે-ગુણું ॥૫॥

કરિયા શુદ્ધ બિછાવણા રે,

તકીયા પંચ આચાર રે-સુખં ૪

ચિહ્ન દિશી દીવા ઝગમગે રે,

જ્ઞાન-રત્ન વિસ્તાર રે-ગુણં ૥૬૧૭

અધ્યાતમ ધન લહલહે રે,

મતિ તોરણ સુ-વિવેક રે-સુખં ૪

ગમા પ્રમાણ ઇહાં ઓરડા રે,

મણિ પેટી નય ટેક-ગુણં ૥૭૧૮

ધ્યાન કુસુમ ઇહાં પાથરી રે,

સાચી સમતા સેજ રે-સુખં ૪

ઇહાં આવી પ્રભુ બેસીએ રે,

કીજે નિજ ગુણ હેજ રે-ગુણં ૥૮૧૯

મન મંદિર જો આવશ્યો રે,

એકવાર ધરી પ્રેમ રે-સુખં ૪

ભગતિ-ભાવ દેખી ભલો રે,

જઈ શકશ્યો તો કેમ રે ! ગુણં ૥૯૨૦

અરજ સુણી મન આવીયા રે,

વીર-જિજ્ઞુસ મયાલ રે-સુખં ૪

ઓરછવ રંગ વધામણાં રે,

પ્રગટયો પ્રેમ વિશાલ રે-ગુણં ૥૧૦૨૧

અર્ધપાદ કરૂણા ક્ષમા રે,

સત્ય વચન તંબાલ રે-સુખં ૪

ધરણું તુમ્હ સેવા ભણી રે,

અંતરંગ રંગ રોલ રે-ગુણં ॥૧૧॥

હવે ભગતિ વસ રીઝીયો રે,

મત છોડો મન ગેહ રે-સુખં ।

નિરવહજો રૂડી પરે રે,

સાહિબ સુગુણ સનેહ રે-ગુણં ॥૧૨॥

ભમર સહજ ગુણ-કુસુમનો રે,

અમર મહિત જગનાથ રે-સુખં ।

જે તું મનવાસી થયો રે,

તો હું હુઓ સ-નાથ રે-ગુણં ॥૧૩॥

શ્રી નયવિજય વિબુધ તણો રે,

અરજ કરે ઈમ શીશ રે-સુખં ।

રમજો મુજ મન મંદિરે રે,

પ્રભુ પ્રેમ ધરી નીશ દિશ રે-ગુણં ॥૧૪॥



(૧૪૮૧) શ્રી મહાવીર જિન-સ્તવન (૬૦-૨૪)

(શાંતિ જિણેસર કેસર અરચિત જગધણી રે-એ દેશી)

સમરીય સરસતી વરસતી, વચન સુધા ઘણીરે કે-વચનં

વીર જિણેસર કેસર, અરચિત જગધણીરે કે-અરચિતં

રાજનગર વર ભૂષણ, દુષણ ટાળતોરે કે-દુષણં

યુષ્કરયું નિજગુણ કરણે, જગ અનુઆલતોરે કે-જગં ॥૧॥

સ્વામી ! મેં તુજ પામી, ધર્મ સોહામણોરે કે-ધર્મં
 માતું મન અવતાર, સકળ કરી આપણોરે કે-સકળં ।
 મેંહી તુજ પામ્યો જિનજી !, નયણ મેળાવડોરે કે-નયણં
 તો નિજ આંગણે રોપ્યો, સુરતરૂ પરગડોરે કે-સુરં ॥૨॥
 તુજ મનમાં મુજ, વસવું કિમ સંભવેરે ? કે-વસવું,
 સુપનમાંહી પણ વાત, ન એ હુઈ નવિ હોયોરે કે-ન એં ।
 મુજ મનમાંદિર, સુંદર વસો જો તુમ્હેરે કે-સુંદરં,
 તો અધિકું નવિ માંગશું, રાગશ્યું ફરી અમ્હેરે કે-રાગં ॥૩॥
 અમક-પાપાણ ખિંચસ્યે, સંચસે લોહનેરે કે-સંચસેં,
 તિમ તુજ ભગતિ મુગતિ ને, ખેંચશે મોહનેરે કે-ખેંચશેં ।
 ઈમ જાણી તુજ ભગતિ જૂગતિ રહ્યોરે કે-ભગતિં,
 તે જન શિવસુખ કરતલ, ઘરસિ ગહગહ્યોરે કે-ઘરસિં ॥૪॥
 લાગી તુજ ગુણ લરકી, ફરકી નવિ શકેરે કે-ફરકીં
 અલગુંઅ મુજ મન, વલગું તુજ ગુણશ્યું ટકેરે કે-તુજં,
 છોડયો પણ નવિ છુટે મોહ, એ મોહનારે કે-મોહં,
 શિવસુખ દેશે તો છોડશું, કેડિ નતે વિનારે કે-કેડિં ॥૫॥
 બાઉલ સરિખા પર સુર, જાણી પરિહરી કે-જાણીં,
 સુરતરૂ જાણી નાણી, તુમ્હે સાહિબ વર્યાંરે કે-તુમ્હેં ।
 કરો દેવ જો કરૂણા, કરમ તો નવિ ટકેરે કે-કરમં,
 ચોર જોર નવિ ચાલે, સાહિબ ! એક ધકેરે કે-સાહિબં ॥૬॥
 તુજ સરિખો મુજ સાહિબ, જગમાં નવિ મલેરે કે-જગમાંં,
 મુજ સરખા તુજ સેવક, લાખ ગમે રૂલેરે કે-લાખં ।
 તો આસંગો તુજશ્યું, કરવો નવિ ઘટેરે કે-કરવોં,
 સહજ મોજ જો આવે, તો સેવક દુઃખ મટેરે કે-તોં ॥૭॥

જિમ વિષ્ણુ પંકજ પરિમલ મધુકર નવિ રહેરે કે-મધુકર૦
 વિષ્ણુ મધુમાસ વિલાસ ન, કોકિલ ગહગહેરે કે-કોકિલ૦ ।
 તિમ તુજ શુભ રસ-પાન, વિના મુજ નવિ સરેરે કેનવિના૦,
 અંબશાખ જિજ્ઞે આખી, તે આંખલીશ્યું શું કરેરે ? કે-તે૦ ॥૮॥
 ત્યાં મહિકે તુજ, પરિમલ કીરતિ વેલડીરે કે-પરિમલ૦,
 મુજ મન તરૂંચર વિંટી, તે રહી પરગડીરે કે-તે રહી૦ ।
 ભગતિ રાજ તસ પલ્લવ, જોહના સમકિત-કુલડારે કે-જોહનાં ॥૯॥
 તુજ વાણી મુજ મીઠી, લાગે જોહવીરે કે-લાગે૦,
 સાકર દ્રાખ સુધા પણ, ન રૂચે તેહવીરે કે-ન રૂચે૦ ।
 કાન કરાવે જોહનાં જે, ગુરૂ પારણારે કે-ગુરૂ૦,
 તે નિત લીજે તેહનાં, દેવ ! ઓવારણારે કે-દેવ૦ ॥૧૦॥
 સુખદાયક જગનાયક, વીર-જિનેસરે કે-વીર૦,
 ઇમમે સ્તવી (યૌ), વંછિત-પૂરણ સુરતરે કે-વંછિત૦ ।
 એ સ્તવ ભણતાં, પ્રગટે નવનિધિ આંગણેરે કે-પ્રગટે૦,
 શ્રીનયવિજય વિખુધ પાય, સેવક ઇમ ભણેરે કે-સેવક૦ ॥૧૧॥

★

(૧૪૮૨) રાજનગર મંડન શ્રી મહાવીર જિન-
 સ્તવન (૬૦-૨૪)

(એક દિન એક પરદેશીઓ-એ દેશી)

મુણ સુગુણ સનેહી રે સાહિબા, ત્રિશલા-નંદન અરદાસ રે ।
 તું તો રાજનગરનો રાજિઓ,
 ગુણ-ગાજિઓ લીલ વિલાસ રે-મુણ૦ ॥૧॥

તુજ સરિખો સાહિબ શિર છતે જે, મોહ કરે મુઝ જોર રે ।
તે ન ઘટે રવિ ઉગ્યે રહે,

જિમ અંધકાર ઘનઘોર રે-સુણુ ॥૨૧॥
અલવેસર ! વેષ રચી ઘણું, હું નાચ્યો મોહને રાજ રે ।
હવે ચરણ શરણ તુજ મેં થયા,

એ ભાવઠ ભવની ભાંજ રે-સુણુ ॥૨૩॥
ટાલો પ્રભુ ! અવિનય મોહનો, મુજ ગાલો ભવની ભીતિરે ।
મુજ હૃદય પખાલો ઉપશમે,

પાલો પ્રભુ અવિહઠ પ્રીતિ રે-સુણુ ॥૨૪॥
વિ-ગુણો પણ તુજ ગુણ-સંગતે, ગુણ પામું તે ઘટમાન રે ।
હુએ ચંદન પરસંગથી, લિંખાદિક ચંદન માન રે-સુણુ ॥૨૫॥
નિગુણો પણ શરણે આવીયો, ન વિછડીજે ગુણ-ગેહ રે ।
નવિ છંડે લાંછન હરિણનું,

જુઓ ચંદ અમીમય દેહ રે-સુણુ ॥૨૬॥
મનમાંહી વિમાસી શું રહ્યો, હવે મહિર કરો મહારાજ રે ।
સેવકનાં દુઃખ જો નવિ ટલે,

લાગે કુણને ? લાજ રે-સુણુ ॥૨૭॥
તુજ આણથી હું પતિત છું, પણ પતિત પાવન તુજ નામ રે ।
નિજ નામ ભણી મુજ તારતાં,

શું લાગે છે તુજ ઠામ રે-સુણુ ॥૨૮॥
ચાખી તુજ સમકીત-સુખડી, નાહી તેહથી ભૂખડી દૂર રે ।
જો પામું સમતા-સુરલતા,

તો એટલે મુજ મહિ મુર રે-સુણુ ॥૨૯॥

તુજ અક્ષય સુખ જે રસવતી, તેહનો લવ દીજે મુજરે ।
 ભૂખ્યાની ભાંજે ભુખડી, શું અધિકું કહીએ તુજરે ?-સુણ ૦ ॥૧૦॥
 આરાધ્યો કામિત પૂરવે, ચિંતામણિ પણ પાપાણુરે ।
 ઈમ જાણી સેવક સુખ કરો, પ્રભુ તુમે છો ચતુર
 સુજાણુરે-સુણ ૦ ॥૧૧॥

શ્યૂં વિનવીએ તુમ અતિ ઘણું, તું મોટો ત્રિભુવન-ભાણુરે ।
 શ્રીનયવિજય સુ-શિષ્યને,
 હવે દેજે કોડિ કલ્યાણુરે-સુણ ૦ ॥૧૨॥



શ્રીવર્દ્ધમાન-સ્વામિને નમઃ
ભક્તિ-રસ-ઝરણીની
અનુપૂર્તિ

[પ્રસ્તુત સંપાદન પછી મળી આવેલ કેટલાક વિશિષ્ટ સ્તવનોને ઉપયોગી ધારી અહીં રજુ કરેલ છે.

જેકે આવી સામગ્રી પ્રકરણ વિચાર ગર્ભ-નિગોદ વિચાર ગર્ભ સ્તવનો આદિની ઘણી મળી છે, પણ તે બધી રજુ કરવા જતાં ઘણી જગ્યા રોકે, તેથી તેમાંની થોડીક વાનગી રૂપે અહીં રજુ કરી છે. સં.]



શ્રી પાર્શ્વનાથનું સ્તવન

રાગ-ગિરિઆરે ગુણ તુમતણા એદેશી

પાર્શ્વપ્રભુ શંખેશ્વરા મુજ દરિયણુ વેગે દીજે રે ।

તુજ દરિસણુ મુજ વાલહ જાણું, અહનિશ સેવા કીજે રે ॥

-પાર્શ્વ૦ ॥૧॥

રાત-દિવસ સુતાં જાગતાં, મુજ હૈયડે ધ્યાન તુમારું રે ।

જીભ જપે તુજ નામને, તવ ઉદલાસે મનડું મારું રે

-પાર્શ્વ૦-॥૨॥

દૈવ દીયે જો પાંખડી તો, આવું તુમ હજૂર રે ।

મુજ મન કેરી વાતડી,

કહી દુઃખડાં કીજે દૂર રે -પાર્શ્વ૦ ॥૩॥

તું પ્રભુ ! આતમ માહરો, તું પ્રાણુજીવન ! મુજ દેવ રે ।
સંકટ-ચૂરણ તું સદા,

મુજ મહેર કરો નિતમેવ રે -પાશ્વર્. ॥૪॥

કમલ સૂરજ જેમ પ્રીતડી, જેમ પ્રીતિ બપેયા મોર રે ।
ફર થકી તિમ રાખજો,

મુજ ઉપરે અધિક સનેહ રે -પાશ્વર્. ॥૫॥

સેવક તણી એ વિનતિ, અવધારી સુ-નજર કીજે રે ।

લખિય વિજય કવિ પ્રેમને,

પ્રભુ ! અ-વિચલ સુખડાં દીજે રે -પાશ્વર્. ॥૬॥



શ્રી સીમંધર સ્વામી પ્રભુ ને પત્રરૂપે વિનતિ સ્તવન

સ્વસ્તિ શ્રી મહાવિદેહ ક્ષેત્રમાં !

જિહ્વાં ભિરાજે તીર્થંકર વીશ-

-નમું તાસ શીષ

કાગળ લખું કૌડથી ॥૧॥

સ્વામી ! જઘન્ય તીર્થંકર વીશ છે !

ઉત્કૃષ્ટા એકસોને સીત્તેર-

-તેમાં નહીં ફેર- કાગળ ॥૨॥

સ્વામી ! બારે ગુણે કરી યુક્ત છે !

વળી લક્ષણ એક હજાર-

-ઉપર આઠ સાર-કાગળ ॥૩॥

સ્વામી ! ચોત્રીશ અતિશય શોભતા !,

વાણી પાંત્રીશ ગુણ રસાળ-

-ગુણો કેરી ખાણુ-કાગળ૦ ॥૪॥

સ્વામી ! ગંધહસ્તી પેરે ગાજતા !

ત્રણ લોક તણા પ્રતિપાળ-

-છેા દીન દયાળ-કાગળ૦ ॥૫॥

સ્વામી ! કાયા સુકોમળ શોભતી !

વળી સુવણું સરખો વાન-

-કરું હું પ્રણામ-કાગળ૦ ॥૬॥

સ્વામી ! ગુણ અનંતા છે તાહરા !

એક જીભે કહ્યા નવી જાય-

-લખ્યા ન લખાય-કાગળ૦ ॥૭॥

ભરતક્ષેત્રથી લિખીતંગ જાણો !

તુમ દર્શન ધરજીવ દાસ-

-રાખું તુમ આશ-કાગળ૦ ॥૮॥

એં તો પૂર્વે પાપ કર્યા ઘણા !

આપ-દર્શનથી રહ્યો દૂર-

-પહોંચ્યો ન હજુર-કાગળ૦ ॥૯॥

મારા મનમાં સંશય અતિ ઘણો !

આપ વિના કહ્યા નવી જાય-

-અંતર અકળાય-કાગળ૦ ॥૧૦॥

આઠા પહાડ પર્વતને ડુંગરા !

તેથી નજર નાંખી નવી જાય-

-દર્શન કેમ થાય-કાગળ૦ ॥૧૧॥

સ્વામી ! કાગળ પણ પહોંચે નહીં !

નહીં પહોંચે સંદેશે કોઈ-

-હું તો રહ્યો આંહી-કાગળ૦ ॥૧૨॥

દેવે પાંખ દીધી હોત પીઠમાં !

ઉડી આવું આનંદ-ભરપૂર-

-રહું તુમ હજુર-કાગળ૦ ॥૧૩॥

સ્વામી ! કેવળજ્ઞાને કરી દેખજો !

મારા આતમના છે આધાર-

-ઉતારો ભવપાર-કાગળ૦ ॥૧૪॥

ઓછું અધિકું જે મેં વિપરીત લખ્યું !

માફ કરજો જિનરાય ! -

-લાગું તુમ પાય-કાગળ૦ ॥૧૫॥

સંવત ૧૮૫૩ ની સાલમાં !

હરખે હર્ષ વિજય ગુણ ગાય-

-પ્રેમે પ્રભુમે પાય-કાગળ૦ ॥૧૬॥



શ્રી શત્રુંજય તીર્થનું સ્તવન

મોરા આતમરામ ! કુણ દિને શેત્રુંજે જાશું ! ! !

શેત્રુંજ કેરી પાળે ચડતાં

ઋષભજિણ્ણંદ ગુણ ગાશું-મોરા૦ ॥૧॥

એ ગિરિવરનો મહિમા સુણીને હૈયે સમકિત ભાસ્યું ।

ભાવસહિત જિનવર પૂજીને

પાતિક દૂર પલાશ્યુ-મોરાં ॥૨॥

મન વચ કાયા સ્થિર કરીને, સુરજકુંડમાં ન્હાશું ।

મારૂંદેવાનો નંદન નિરખી

હૈયે હર્ષિત થાશું-મોરાં ॥૩॥

એણે ગિરિ સિદ્ધ અનંતા હુવા, ધ્યાન સકળ મન ધ્યાશું ।

સકળ જનમમાં આ માનવ ભવ,

લેખે કરીએ ગણાશું-મોરાં ॥૪॥

સુરનર પૂજિત પ્રભુ-પદ-કજ-રજ, નીલવટે તિલક ચઠાવશું !

મનમાં હરખી ગિરિવર ફરસી

પાતિક દૂર પલાશ્યુ-મોરાં-॥૫॥

સમકિત ધારી સાચી સાથે, સદ્ગુરુ સમકિત લ.શ્યુ !

છહરી પાળી પાપ પખાળી,

દુરગતિ દૂર પલાશ્યુ-મોરાં ॥૬॥

શ્રી જિનનામી સમકિત પામી, લેખે ત્યારે ગણાશ્યુ ।

જ્ઞાનવિમલ કહે ધન ધન તે દિન.

પરમાનંદ પદ પાશું-મોરાં ॥૭॥



ઋષભદેવ ભગવાનનું સ્તવન

સમકિત પામી ભવ સ્વામી, અગીયારમે અણુગાર-લલના

સાત લવાયુ છઠ તપ બાકી,

દુઃખની સ્થિતિ આ સંસાર-લલના-

-મારૂંદેવા-નંદને વંદીએ રે ॥૧॥

પાંચમે અંગે ચક્રદમે શતકે, ચાર વિમાને એમ-લલનાં
બારમે લવ સર્વાર્થસિદ્ધિ,

પહોંચ્યા જિહ્વાં સુખસાત-લલના-મારૂં ॥૨૧॥

તેત્રીશ સાગરોપમનું આયુષ્ય, શરીર ઉંચાઈ એક હાથ-લં
તેત્રીશ હજાર વર્ષે આહારની ઈચ્છા,

તેત્રીશ પક્ષે શ્વાસોશ્વાસ-લલના-મારૂં ॥૨૩॥

શૈયામાં પોઢ્યા ચંદ્રુએ મોતી, ચોસઠ મણનું એક-લલના
ચારે બાજુ ચાર બત્રીશમણીયા,

સોળમણીયા અઠ હોય-લલના-મારૂં ॥૨૪॥

અડમણીયા સોળ, બત્રીશ ચક્ર-મણીયા લલના ।

દો મણના ચોસઠ, એકસો અડવીસ છે એકમણીયા-લલના

સર્વ તેપનશત હોય-લલના-મારૂં ॥૨૫॥

પવનની લહેરે મોતી અક્ષણાતાં, પ્રગટે મધુરા રાસ-લલના ।

તે રસ-લીના કાળ ગુમાવે,

દાખવે મુક્તિને પંથ-લલના-મારૂં ॥૨૬॥

સુર ઉપના જે નલ અવગાહે,

મૃત્યુ લગી સુતા હોય-લલના ।

પાંચે વિમાને પગ ન હલાવે

બોલે વિશેષાવશ્યક-લલના-મારૂં ॥૨૭॥

લઘુ સ્થિતિ ચાર વિમાનની,

ભાખી પણ એકત્રીસ-લલના ।

સમવાય અંગે બત્રીસ કૌધી,

ઉત્કૃષ્ટ સાગર તેત્રીશ-લલના-મારૂં ॥૨૮॥

આર વિમાને હોય કર દેહા, પાંચમાનું એકહાથ-લલના ।
આરમાં ભવ દો હોય ઉત્કૃષ્ટ

પાંચમે એક ભવ હોય-લલના-મા૩૦ ॥૬॥
વિજ્યાદિ સૌ અવધિએ દેખે, દેશે ઉણી લોકનાળ-લલના ।
આર જોજન ધન પર સિદ્ધિ

દેખે યુગલને કાળ (!) લલના-મા૩૦ ॥૧૦॥
તેરમે ભવથી ઋષભ જિનેશ્વર,
નીતિકા પંથ બતાવે-લલના ।

અમર સાથે બહુ વસંત ખેલીને
સ્વ-હાથે વિરતિ પમાયે-લલના ॥૧૧॥

કેવળ પાત્રી શિવ વિશ્રામી, ગુરૂલુ અવગાહ-લલના ॥
શ્રી શુભવીર મહોદય લીલા
જ્યાં સદા શીતલ છાયા-લલના-મા૩૦ ॥૧૨॥



શ્રી વર્ષોત્તિપનું સ્તવન

શ્રી ઋષભદેવ વરસ ઉપવાસી
પૂર્વની પ્રીત પ્રકાશી
ત્રેયાંસ બોલે શાખાશી-
દાદાજી ! વિનતિ અવધારો ।

મારે મંદિરીયે પધારો-
દાદાજી વિનતિ અવધારો ॥૧॥

શેલડી રસ સુગતો બેઠો,
નાયજી ન કરાવો નોરો,
દર્શન ફળ આપોને બેઠો-દાદાજી ॥૨॥

તવ પ્રભુજીએ માંડી પસલી,

આહાર લેવા તણી ગતી અસલી,

ત્યાંથી દાનતણી ગતિ પ્રસરી-દાદાજી ॥૩॥

અજવાળી ત્રીજ વૈશાખી,

પંચ દિવ્ય થયાં સુર સાખી ।

દાન તણી ગતિ દાખી-દાદાજી ॥૪॥

યુગાદિક પર્વ જ બાણું,

અક્ષયત્રીજ નામ વખાણું

તહીં સૌ કોઈ કરે ગજમાણું-દાદાજી ॥૫॥

સહસ વર્ષે કેવળ પાયા,

લાખ ચૌરાશી પૂર્વનું આયા,

પરમ મહોદય પાયા-દાદાજી ॥૬॥

કહે ઉદયરત્ન ઉવજાળયા,

પૂજે ઋષભ -જિણુંદના પાયા,

જેણે આદિ ધર્મ ઓળખાયા-દાદાજી ॥૭॥



શ્રી પાર્શ્વનાથ જિન-આધ્યાત્મિક સ્તવન

(લોજન થાળ ૩૫)

(હાલરડાની ફેરી)

માતા વામાદે બ્રહ્માવે જમવા પાર્શ્વને ।

જમવા વેળા થઈ છે રમવાને ચિત્ત બય ।

આલો તાત-તમારા થાએ બહુ ઉતાવળા,

ઠેલા હાલોને લોજનીયા ટાઢા થાય-માતા ॥૧॥

માતાનું વચન સુણીને જમવાને બહુ પ્રેમશું,
 બુદ્ધિ બાજેઠ ઢાળી, બેઠા થઈ હોશિયાર ।
 વિનય થાળ અબ્બુઆલી લાલન આગળ મુકીયો
 વિવિધ વાટકીયો, શોભાવે થાળ મોઝર-માતાં ॥૨૧॥
 સમકિત શેલડીના છોલીને ગટ્ટા મુકીયા,
 દાનના દાડમ દાણા ફોલી આપ્યા ખાસ ।
 સમતા સીતાફળનો, રસ પીજ્યો બહુ રાજ્યા,
 ભુકિત જમફળ પ્યારા, આરોગીને પાસ-માતાં ॥૨૨॥
 મારા નાનડીયાને ચોક્રખા ચિત્તના ચુરમા,
 સુમતિ સાકર ઉપર, ભાવનું લેળું ધૃત ।
 ભક્તિ ભણ્યાં પીરસ્યાં, પાસ કુમારને પ્રેમશું
 અનુભવ અથાણું, આખોને રાખો શરત-માતાં ॥૨૩॥
 પ્રભુને ગુણ ગુંજા, મેં જ્ઞાન ગુંદવડા પીરસ્યા,
 પેચના પેઠા જમજ્યો માન વધારણ કાજ ।
 જાણપણની જલેબી, જમતાં ભાંગે ભુખડી,
 દયા દૂધપાક અમીરસ, આરોગીને આજ-માતાં ॥૨૪॥
 સંતોષ શિરો ને વળી, પુણ્યની પુરો પીરસી,
 સંવેગ શાક ભજાં છે, દાતાર ઢીલી દાળ ।
 મોટાઈ માલપૂવાને, પ્રભાવનાના પુડલા,
 વિચાર વડી વઘારી, જમજ્યો મારા લાલ-માતાં ॥૨૫॥
 કરી રાચતાં રૂડાં પવિત્ર પાપડ પીરસ્યા,
 ચતુરાઈ ચોખા, ચોશાવી આણ્યા ભરપૂર ।

ઈન્દ્રિય-દમન દૂધ, તપ તાપે તાતું કરી,
 પ્રીતે પીરસ્યું, જમજો જગજીવન ! સહનૂર-માતા૦ ॥૭૧॥
 પ્રીતી પાણી પીધાં, પ્રભાવતીના હાથથી,
 તત્ત્વ તંબોલ લીધાં, શીયલ સોપારી સાથ ।
 અકલ એલાયચી આપીને, માતા મુખ વહે,
 ત્રિભુવન તારી તરજ્યો, જગજીવન જગનાથ-માતા૦ ॥૮૧॥
 પ્રભુના બાળ તજ્યા જે, ગુણગાવે ને સાંભળે,
 ભેદ-ભેદાન્તર સમજે, જ્ઞાની તે કહેવાય ।
 શુરુ ગુમાન વિજયનો શિષ્ય કહે ચિર નામીને,
 સદા સૌભાગ્યવિજય, ગાવે ગીત સદાય-માતા૦ ॥૯૧॥



ચોવીશ ભગવાનના પરિવારનું સ્તવન

રાજ રાણાને કુટુંબ ઘણું-મન મોહન મેરે,
 ભગતી કુંવરીની જ્યોત-મન મોહન મેરે ।
 રિખવદેવને દો બેટીઓ-મન૦,
 ભરતાદિકે સો પુત્ર-મન૦ ॥૧॥
 અજિતનાથને બેટો નહીં-મન૦,
 સહેજે ટળી ગયા પાપ-મન૦ ।
 સંસારી સગપણ જાણીને-મન૦,
 ન કરે મનમાં સંતાપ-મન૦ ॥૨॥
 અંબવ અભિનંદન સુમતિ પ્રભુ-મન૦,
 ત્રણેને ત્રણ ત્રણ પુત્ર-મન૦ ।

પદ્મપ્રભજીને તેર બેટડા-મન૦,

તે તો કરે લીલા-લહેર-મન૦ ॥૩૧॥

સુપાર્શ્વનાથને સત્તર બેટડા-મન૦,

ચંદ્રપ્રભને અઠાર-મન૦ ।

સુવિધિનાથને ઓગણીશ બેટડા-મન૦,

તે તો કરે લીલા-લહેર-મન૦ ॥૪૧॥

શીતલનાથજીને બાર બેટડા-મન૦,

શ્રેયાંસજીને નવાણું પુત્ર-મન૦

વાસુપૂજ્યજીને ઢોય બેટડા,

વિમળનાથને નહીં પુત્ર-મન૦ ॥૫૧॥

અનંતનાથજીને અઠ્યાસી બેટડા-મન૦

ધર્મનાથજીને ઓગણીસ-મન૦ ।

શાન્તિનાથજીને ઢોઢકોડ બેટડા-મન૦

કુંથુનાથજીને ઢોઢ કોડ-મન૦ ।

અરનાથજીને સવા કોડ બેટડા-મન૦,

કુળમાં જગતી જ્યોત-મન૦ ॥૬૧॥

મલ્લિનાથ કુંવારા રહ્યા-મન૦,

બાળ બ્રહ્મચારી કહેવાય-મન૦ ।

મુનિસુવતજીને અગીયાર બેટડા-મન૦ ।

નમી-નેમી બાળકુમાર-મન૦ ॥૭૧॥

પાર્શ્વનાથને બેટો નહીં-મન૦,

મહાવીર સ્વામીને એક પુત્રી-મન૦ ।

સવળાએ સંજમ આદર્યો-મન૦

પહોંચ્યા મુક્તિ મોઝાર-મન૦ ॥૮૮॥

સવાચાર કોડ બેટા થયા મન૦,

ઉપર ચારસોને સાત-મન૦ ।

બેટાની સંખ્યા કહી-મન૦

પુત્રી હોઈ ત્રણ-મન૦ ॥૮૯॥

સત્તર જિનને બેટા કહ્યા-મન૦,

ધન-ધન જિનનો પરિવાર-મન૦ ।

અજિત વિમલ મલિનાથજી-મન૦

નમિ-નેમિ પાસ જિણુંદ-મન૦ ॥૯૦॥

મહાવીર સ્વામી એ સાતને-મન૦

બેટાનો નહીં ફંદ-મન૦ ।

ઉદયરત્ન ગુરુ ધમિ કહે-મન૦

ભવસાગર પાર ઉતારો-મન૦ ॥૯૧॥

★

શ્રી પિસ્તાલીસ-આગમનું સ્તવન

સાંભળજો ! ભાવ ધરીને, જિન-આગમ મુખકારી રે ।

ગણુધર-પૂરવધરની રચના, જાડું નિત્ય બલિકારી રે-

-સાંભળજો ॥૯૨॥

આચારાંગ ને સુયગડાંગ, કાણુાંગ સમવાયાંગ રે ।

ભગવતી પંચમ અંગ શિરોમણિ, જ્ઞાતાધર્મ-કથાંગ રે-

-સાંભળજો ॥૯૩॥

ઉપાસક-દશાંગ અંતગડ, અનુત્તરોવવાઈ રે ।

પ્રશ્ન-વ્યાકરણુ વિપાક વખાણુ, અંગ અગીયાર કહાઈ રે-

-સાંભળજો ॥૩૩॥

ઉવવાઈ રાયપસેણી સુંદર, જીવાભિગમ રસાળ રે ।

પન્નવણા છત્રીશ પદ સુણતાં, પાપ ગયા પાયાલ રે-

-સાંભળજો ॥૪૪॥

સૂર પન્નત્તિ, ચંદ પન્નત્તિ, જંબૂપન્નત્તિ વિચાર રે ।

નિરયાવલી ને કર્પવડિંસયાને, સંસને પુષ્કિઆસાર રે-

-સાંભળજો - ॥૫૫॥

પુષ્કયૂલિયા વહ્નિદશા એ બાર ઉપાંગ ઉદાર રે ।

ચંદશરણુ આઉર પરચક્ષ્યાણુ, ભક્તપરિજ્ઞા સંચાર રે-

-સાંભળજો - ॥૬૬॥

તંદુલ વિયાલી ચંદગવિજ્ઞ, મહાપરચક્ષ્યાણુ સુભાવે રે ।

દેવિંદ થુઇ ને મરણુ સમાધિ, ગણિવિજ્ઞ દિલ ભાવે રે

-સાંભળજો ॥૭૭॥

આવશ્યક, દશવૈકાલિક તિમ ઓઘનિયુક્તિ ખંડ રે ।

ઉત્તરાધ્યયન છત્રીશ અજઝયણુ, વીરની અંતિમ ઉક્તિ રે-

-સાંભળજો ॥૮૮॥

ચાર મૂલ-સૂત્રોએ ભાખ્યા, નંદી અનુયોગ દ્વાર રે ।

સવિ આગમ સરવાળો જેમાં,

નય-નિદ્ધેપ નિસ્તાર રે.-સાંભળજો ॥૯૯॥

બૃહત્કંદપ નિશીથ દશાશ્રુત, મહાનિશીથ વ્યવહાર રે ।

જીતકલ્પ, પંચકલ્પ સમરીયે,

છ છેઠ-સૂત્ર શ્રીકાર રે-સાંભળજો-૥૧૦૥

એ પિસ્તાલીશ સંપ્રતિકાળે, અઠવિહ સંઘ આધાર રે ।

ટીકા ચૂણી લાભ્ય, નિચુકિત,

પંચાંગી જગ સાર રે-સાંભળજો ૦ ૥૧૧૥

સાચી સદ્ગુણશુ આગમ, આશા છે ભવિ પ્રાણી રે ।

જિન ઉત્તમ પદ પદ્મ પસાયે,

લહે નિજ રૂપ ગુણ પ્રાણી રે-સાંભળજો ૦ ૥૧૨૥



શ્રી મહાવીર સ્વામીનું પારણું

(હાલો હાલો હાલો મારા નંદને રે...એ દેશી)

માતા ત્રિશક્તા એ પુત્ર-રતન જાઈએ ।

ચોસઠ ઇંદ્રના આસન કંપે સાર ।

અવધિજ્ઞાને જોઈ ધાયા શ્રી જિનવીર ને,

આવે ક્ષત્રિયકુંડ નગર મજાર-માતા ૦ ૥૧૥

વીર-પ્રતિબિંબ મુકી માતા કને,

અવસ્થાપિની નિદ્રા દીએ સાર ।

એમ મેરૂ શિખરે જિનને લાવે ભકિતશું,

હરિ પંચ રૂપ કરી મનોહાર-માતા ૦ ૥૨૥

એમ અસંખ્ય કોટા કોટી મળી દેવતા ।

પ્રભુને ઓચ્છવ મંડાણે લઈ જાય ।

પાંડુક વન શિલાયે જિનને લાવે ભકિત શું,

હરિ-અંકે થાપે ઇન્દ્ર ઘણું ઉચ્છાય-માતા ૦ ૥૩૥

એક કોડી સાઠ લાખ કલશે કરી,

વીરના સ્નાત્ર મહોત્સવ કરે સાર ।

અનુક્રમે વીર કુમારને લાવે જનની મંદિરે,

દાસી પ્રિયંવદા જાણે તેણી વાર-માતા૦ ॥૪૮॥

રાજા સિદ્ધારથને દીધી વધામણી,

દાસી ને દાન ને માન દીધે મનોહાર ।

ક્ષત્રિયકુટુંબ માંહે ઓચ્છવ મંડાવીઓ,

પ્રજાલોકને હરખ અપાર-માતા૦ ૫

ઘર ઘર શ્રીકૃષ્ણ તોરણ ત્રાટજ બાંધ્યાં ।

ગોરી ગાવે મંગલ ગીત રસાલ ।

રાજા સિદ્ધારથે જન્મ મહોત્સવ કર્યો,

માતા ત્રિશલા થઈ ઉજમાલ—માતા૦ ॥૪૯॥

માતા ત્રિશલા જુલાવે પુત્ર પારણે,

જુલે લાડકડા પ્રભુજી આનંદ લેર ।

હરખી નિરખી ઈન્દ્રાણીઓ જાણે વારણે,

આજ આનંદ શ્રીવીર કુમારને ઘેર—માતા૦ ॥૫૦॥

વીરના મુખડા ઉપર વાફં કોટી ચંદ્રમા,

પંકજ લોચન સુંદર વિશાલ ખપોલ ।

શુક ચંચુ સરખી હીસે નિર્મલ નાસિકા,

કોમળ અધર અરૂણ રંગ રોળ—માતા૦ ॥૫૧॥

ઔષધિ સોવન શોભે હાલ રે

નાનુક આભરણ સઘલાં કંચન મોતી હાર ।

કર અંશુઠો ધાવે વીર કુમાર હર્ષે કરી,
 કાંઈ બોલાવતા કરે કિલકિલાટ—માતા. ॥૯॥
 વીરના નિલાડે કીધો છે કુંકુમ ચાંદલો,
 શોભે જડિત મરકત મણિમાં દીસે લાલ ।
 ત્રિશલાયે જુગતે આંજી અણિયાળી બેહું આંખડી,
 સુંદર કસ્તૂરીનું ટખકું કીધું ગાલ—માતા-॥૧૦॥
 કંચન સોલે ભતનાં રતને જડીયું પારણું
 બુલાવતી વેળા થાયે ધૂધરીનેા ધમકાર ।
 ત્રિશલા વિવિધ વચને હરખી ગાયે હાલરું,
 જેએ કૂમતીઆલો કંચન દોરી સાર—માતાં ॥૧૧॥
 મારો લાડકવાયો સરખે સંગે રમવા જશે,
 મનોહર સુખડલી હું આપીશ એહને હાથ ।
 ભોજન વેળા રમઝમ રમઝમ કરતો આવશે,
 હું તો ધાઈને ભોડાવીશ હૃદય સાથ—માતાં ॥૧૨॥
 હંસ કારંડવ કેઝિલ પોપટ પારેવડાં,
 માંડી બપૈયાને સારસ ચકોર ।
 મેના મોર મેલયાં છે રમકડાં રમવાં તણાં,
 ધમ ધમ ધુધરા બળવે ત્રિશલા કિશોર—માતાં ॥૧૩॥
 માતા ત્રિશલા ગાવે વીર-કુંવરનું હાલરું,
 મારો નંદન જીજ્ઞે કોડા કોડી વરસ ।
 એ તો રાજ રાજેશ્વર થાયે ભલો દીપતો,
 મારા મનના મનોરથ પુરશે જગીશ—માતાં ॥૧૪॥

ધન્ય ધન્ય ક્ષત્રિય કુંડ ગામ મનોહરં,

જિહાં વીર-કુંવરનો જન્મ ગવાય ।

રાજા સિદ્ધારથના કુલમાંહે દિનમણી,

ધન્ય ધન્ય ત્રિશલા રાણી જેહની માય-માતા૦ ॥૧૫॥

એમ સહી ટોલી ભોળી ગાવે હાલરં,

પૂરણ થાશે મનના મનોરથ તેહને ઘેર ।

અનુક્રમે મહોદય પદવી રૂપ વિજય પદ પામશે

ગાયે અમિય વિજય કહે થાશે લીલા લહેર-માતા૦ ॥૧૬॥



શ્રી વર્ધમાન સ્વામિને નમઃ

આ પુસ્તકના પ્રકાશનમાં લાલ લેનારા મહાનુભાવોની નામાવલી

- ૫૦૦૦-૦૦ બાલુભાઈ અમીચંદ શ્રી આદીશ્વર દેરાસર ચેરીટેબલ ટ્રસ્ટ-મુંબઈ.
- ૨૫૦૦-૦૦ શ્રી જૈન મિત્ર-મંડળ, પાલનપુર, ખોડા લીમડા, નૂતન જૈન ઉપાશ્રય પૂ. મ. શ્રી અશોકસાગરજી તથા શ્રી. જીનચંદ્રસાગરજી મ.ના ઉપદેશથી.
- ૧૦૦૦-૦૦ શ્રી ઋષભદેવજી, કેશરીમલ જૈન પેઢી જ્ઞાન ખાતેથી રતલામ.
- ૧૦૦૦-૦૦ શાહ મોતીશા રીલીજીયસ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-મુંબઈ.
- ૧૦૦૦-૦૦ શ્રાવિકા બહેનો તરફથી જૈન સંઘ-બીજાપુર,
- ૬૨૬-૦૦ ધોરાજી પ્લોટ ઉપાશ્રય તરફથી-૧૦૧૫ તથા ધોરાજી સંઘ તરફથી ૫૨૫.
- ૫૦૧-૦૦ શ્રી નારણપુરા, જૈન સંઘ, અમદાવાદ.
- ૫૦૦-૦૦ શ્રી ગદગ જૈન સંઘ તરફથી.
- ૩૫૧-૦૦ સા. શ્રી સુતારાશ્રીજી મ. સા.ની પ્રેરણાથી સુરેન્દ્રનગર.
- ૩૦૦-૦૦ શ્રી ચંદ્રોદય વિજયજી, નવસારી પ્રથમ ભાગના ૧૫૦૧ તથા બીજા ભાગના ૧૫૦૧


- ૨૫૧-૦૦ એમ. હીરાલાલ લાલચંદની કંપની, ભાવનગર.
- ૨૫૧-૦૦ સા. શ્રી નિત્યોદ્યાશ્રીજી મ.ના ઉપદેશથી શ્રી ધોરાજીના જૈન સંઘ.
- ૨૫૧-૦૦ રામપુરા, જૈન સંઘ, સાધ્વી શ્રી સદ્ગુણાશ્રી મ.ના ઉપદેશથી.
- ૨૫૧-૦૦ ઉમતા જૈન સંઘ „ „ „ „
- ૨૫૧-૦૦ પૂ. સાધ્વી શ્રી કિરણશ્રીજી મ.ના ઉપદેશથી શ્રી નાનજી ધનાજી ટ્રસ્ટ, જૈન ઉપાશ્રય, સુરત.
- ૨૫૧-૦૦ સા. શ્રી કનકપ્રભાશ્રીજી મ. સા.ની પ્રેરણાથી જામનગર.
- ૧૦૧-૦૦ સરસ્વતીશ્રીજી મ. સા.ના સ્મરણાર્થે શ્રી સુરેખાબેન કીરીટકુમાર તરફથી—અમદાવાદ.
- ૫૧-૦૦ સુશીમાશ્રીજી મ.ના ઉપદેશથી ભેરખાગ, જૈન સંઘ—જોધપુર.
- ૫૦-૦૦ સાધ્વી શ્રી સુયશાશ્રીજી મ.ના ઉપદેશથી.
- ૧૫-૦૦ બી. મનસુખરામની કુાંપની—મુંબઈ.
- ૧૫-૦૦ લક્ષ્મીચંદ લલ્લુભાઈ ઝવેરી, પૂ. પં. શ્રી કંચન સા. મ. ની પ્રેરણાથી.
- ૧૨-૦૦ બી. કે. શાહ, નરેન્દ્ર એન્જ-સી, બજારપેઠ—સંગમનેર.
- ૧૧-૦૦ મુકુંદભાઈ હેમચંદ—કપડવાંજ.



અગાઉથી આ પુસ્તક નોંધાવનારની નામાવલી

૨૧) અરવિંદકુમાર અમૃતલાલ	ચાણુસ્મા
૨૧) લાલભાઈ છોટાલાલ	”
૨૧) ગુણવંતલાલ મફતલાલ	”
૨૧) મહેન્દ્રકુમાર બાબુલાલ	”
૨૧) કુમારપાળ સોમચંદ	”
૨૧) ડૉ. સારાભાઈ છોટાલાલ	”
૨૧) રજનીકાન્ત જોશીંગલાલ	”
૨૧) રમણલાલ પોપટલાલ ગભરચંદ	”
૨૧) વિનોદકુમાર રમણલાલ	”
૨૧) વીરપાલ ચીમનલાલ	”
૨૧) કેશવલાલ રવચંદ	”
૨૧) રાજેન્દ્રકુમાર કેશવલાલ વસ્તાચંદ	”
૨૧) હરગોવિનદાસ કપૂરચંદ	”
૨૧) નરોત્તમદાસ હરખચંદ	”
૨૧) મંગળદાસ પ્રેમચંદ	”
૨૧) સેવન્તિલાલ કેશવલાલ	”
૨૧) કાંતિલાલ લહેરચંદ	”

- ૨૧) અશોકકુમાર મફતલાલ ”
 ૨૧) રજનીકાન્ત જ્યંતિલાલ બાપુલાલ ”
 ૨૧) રજનીકાન્ત છોટાલાલ મોહનલાલ ”
 ૨૧) મધુકુમાર રમણલાલ વાડીલાલ ”
 ૨૧) રમણલાલ ચતુરચંદ્ર ”
 ૨૧) સકરચંદ્ર કેવળચંદ્ર ”
 ૨૧) ચંદ્રકાન્ત પાનાચંદ્ર હીરાચંદ્ર ”
 ૨૧) જિતેન્દ્રકુમાર કાન્તીલાલ નથુચંદ્ર ”
 ૨૧) પનાલાલ હીરાચંદ્ર ”
 ૨૧) સ્વ. હીરાબેન હ: દલપતલાલ હેમચંદ્ર ”
 ૨૧) નવિનચંદ્ર ત્રીકમલાલ વાડીલાલ ”
 ૨૧) પોપટલાલ અમથાલાલ પ્રેમચંદ્ર ”



પરમાત્માની ભકિત એટલે

આપણું જીવન વિષય-કપાય અને ઈન્દ્રિયોના ખેંચાણને લીધે અહિંસુખ વનિઓથી કર્મના ઘેરાવાથી ઘેરાયેલું છે, જેને શાસ્ત્રીય પરિભાષાનાં અહિરાત્મજીવન કહેવાય છે.

જેમાં રતના કર્મના કટુવિપાકો અવનવી રીતે અનંત સુખના ધણી આત્માને પણ ઔદયિકભાવની મુખ્યતાએ ભોગવવા પડે છે.

પણ બકરાના ભોળાં પાસે ભાન-ભૂલી બેઠેલા સિંહની જેમ ભાન-ભૂલેલા આત્માને જ્યારે પરમાત્માના દર્શન-વંદન-પૂજન અને ગુણગાન-સ્તુતિના પળે સ્વરૂપનું ભાન થવા રૂપે અંતરાત્મદશા પ્રગટે છે ત્યારે “હું દેહ-બુદ્ધિ-ઈન્દ્રિય-સ્વરૂપ કે જડ સ્વરૂપ નથી ! પણ શુદ્ધાત્મરૂપ ચૈતન્યની અનંતભકિતથી ભરપૂર પરમાત્મ સ્વરૂપ છું છું ! પણ મારી આડે કર્મોના આવરણો આવેલા છે, તેને હડસેલવા જેમ જેમ પરમાત્મ-તત્ત્વનો વિશિષ્ટ અંતર્મુખવિચાર કે તીવ્રશુદ્ધ ભાવનાનું જરૂર વધે તેમ તેમ તેનીથી બચ્ચ ઓગળે તેમ આત્મા પર જામી પડેલ કર્મોના વિવિધ ઘરો પણ ઘટવા પામે છે. પરિણામે આત્મા નિર્મલ થતો જાય છે.

આવી પરમાત્મસ્વરૂપના માધ્યમથી અંતરાત્મદશાના વિકાસને કારણે મથામણ કરવી તેનું નામ પરમાત્માની ભકિત છે !

આવી ભકિત જન્મોજન્મના ઉપાજેલા તીવ્રાતિતીવ્ર કર્મોના બંધનેને ફાણમાત્રમાં છેદી નાંખે છે. તેથી આખતપુરૂષો એ કહ્યું છે કે—

“તિવ્રગુણગાતં અનન્તગુણાકરં”

